

# શ્રી ભાતૃવાણી


ગ્રંથ: ૧૨

કેળવણી

જાળો કલાલો રૂ - લો

બાળ વિજય પ્રદીપ

શ્રી ભાતણ



# શ્રી માતૃવાણી

ગ્રંથ ૧૨

કેળવાણી

શ્રી માતાજી

અનુવાદક :

શ્રી સુન્દરમ

શ્રી અમીધર ભક્ત

પ્રથમ આવૃત્તિ :  
શ્રી અરવિંદ સોસાયટી, અમદાવાદ  
મે, ૧૯૭૮

પુનર્મુદ્રણઃ  
શ્રી અરવિંદ સોસાયટી, વડોદરા  
જૂન, ૨૦૨૩

કિંમત : રૂ. 300-00

© શ્રી અરવિંદ આશ્રમ ટ્રસ્ટ, પોંડિચેરી

પ્રાપ્તિસ્થાન :  
શબ્દ, શ્રી અરવિંદ આશ્રમ,  
પોંડિચેરી-૬૦૫૦૦૨.



શ્રી માતાજી

શ્રી મા

જન્મ  
ઇંદ્રાચલ રિપોર્ટ, ૧૯૭૮

ભારતમાં આગમન  
માર્ચ ૨૬, ૧૯૭૪

મહાસમાધિ  
નવેમ્બર ૧૭, ૧૯૭૩

## પ્રકાશકની નોંધ

‘કેળવણી’ શીર્ષક હેડળનો શ્રી માતૃવાગીનો આ ગ્રંથ ૧૨ ધી કલેક્ટેડ વર્ક્સ ઓફ ધી મધર, વાંચ્યુમ ૧ રનો ગુજરાતી અનુવાદ છે.

આ ગ્રંથમાં શ્રી માતાજીએ લખેલા લેખો, પત્રો, સંદેશાઓ, વાર્તાલાપો અને કેળવણી પરના અભિના વિચારોનો સંગ્રહ કરવામાં આવ્યો છે.

### વિભાગ - ૧ : લેખો

આ લેખો સૌપ્રथમ ‘શારીરિક શિક્ષણ પત્રિકા’ (Bulletin of Physical Education) જેને પાઠળથી ‘શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્ર’ (Bulletetin of Sri Aurobindo International Education)ની પત્રિકા એવું નામ આપવામાં આવેલું, તેમાં ૧૯૪૮ થી પણના સમય દરમિયાન પસિદ્ધ કરવામાં આવેલા હતા. શ્રી માતાજીએ મૂળ તે ફેન્ચ ભાષામાં લખેલા, તેમાંના થોડાકનો અંગેજુમાં અનુવાદ કર્યો હતો અને બીજા કેટલાકના સર્વર્ષો અથવા થોડાક ભાગના અંગેજુમાં અનુવાદ કર્યા હતા. આ ગ્રંથમાં શ્રી માતાજીએ અંગેજુમાં કરેલાં ભાષાંતરને સ્થાન આપવામાં આવેલું છે. અન્ય વ્યક્તિઓએ કરેલાં ભાષાંતરમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે અને કેટલાકમાં તદ્દન નવેસરથી ભાષાંતર કરવામાં આવેલાં છે.

### વિભાગ - ૨ : સંદેશાઓ, પત્રો અને વાર્તાલાપો

- (૧) શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્ર : આ વિભાગમાં મોટે ભાગે શ્રી માતાજીએ શિક્ષણ કેન્દ્રના વિધાર્થીઓ અને શિક્ષકો સાથે કરેલો પત્રવ્યવહાર તેમ જ વાર્તાલાપ આપવામાં આવેલા છે. તેમાં કેટલીક અન્ય સંસ્થાઓ અને વ્યક્તિઓને આપવામાં આવેલા સંદેશાઓ અને પત્રોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આમાંનાં ઘણાંખરાં વિધાનો મૂળ તો ફેન્ચ ભાષામાં કરવામાં આવેલાં, તેમાંના કેટલાંક આશ્રમ તરફથી પસિદ્ધ કરવામાં આવેલાં વિવિધ પુસ્તકો અને પત્રિકાઓમાં પ્રકાશિત થઈ

ગયાં છે, અને કેટલાંક અહીં જ પ્રથમ વાર પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે. આ લખાણોમાં જેને તારીખ આપવામાં આવી છે તેમને સામાન્ય રીતે તેમના સમયકમાનુસાર મૂકવામાં આવેલા છે જ્યારે જે લખાણોમાં તારીખ નથી તેમને તેમના યોજ્ય સ્થાને મૂકવામાં આવ્યાં છે. જે લખાણો ફક્ત એક જ વ્યક્તિને લખવામાં આવેલાં તેવી લેખમાળાઓ વચ્ચે ફક્ત ખાલી જગ્ગા રાખવામાં આવેલી છે જ્યારે જુદીજુદી વ્યક્તિઓને લખવામાં આવેલાં લખાણોને જુદાં પાડવા માટે વચ્ચમાં ‘તારક’ ચિહ્નો મૂકવામાં આવ્યાં છે. જ્યાં જ્યાં શ્રી માતાજીએ મૌખિક ઉત્તરો આપેલા અને સાધકોએ પોતાની સમૃતિમાંથી તેની નોંધ કરેલી તે બધાં લખાણો પ્રસિદ્ધ કરતી વખતે શ્રી માતાજીની મંજૂરી મેળવી લીધી હોય એવાં લખાણો અંગે યથાસ્થાને ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- (2) શ્રી અરવિંદ આશ્રમ શારીરિક શિક્ષણ વિભાગ : આ વિભાગમાંના શરૂઆતના નવ નાના લેખો સૌપ્રથમ ૧૯૪૮ થી ૫૦ની વચ્ચમાં બુલેટિનમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા. આ વિભાગમાંના વચ્ચલા ભાગનાં લખાણોમાં શારીરિક શિક્ષણ વિભાગે તેની વાર્ષિક દુરીજાઈઓ અને શારીરિક શિક્ષણનાં પ્રદર્શનો યોજેલાં તે સમેયે શ્રી માતાજીએ તેમને જે સંદેશાઓ લેખિત સ્વરૂપમાં અથવા ટેઇપ પર રેકોર્ડ કરીને આપેલા તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પછીના ત્રીજા વિભાગમાં સામાન્ય સંદેશાઓ અને જુદી જુદી વ્યક્તિઓને લખવામાં આવેલા પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે; જ્યારે છેલ્લો લેખ ‘શ્રીઓને તેમના શરીર વિષે’ સૌપ્રથમ સપેમ્બર ૧૯૬૦ માં એક છૂટક પત્રિકાના રૂપમાં પ્રસિદ્ધ થયો હતો.
- (3) નૂતન યુગનું સંમેલન (The New Age Association) : અહીં આપવામાં આવેલા લેખો સૌપ્રથમ મૂળ અંગ્રેજીમાં ઈ. ૧૯૭૭માં પ્રસિદ્ધ કરવામાં આવેલા અને તે New Age Associationની શિબિરો અને સભાઓમાં આપવામાં આવેલાં સંભાષણોનો સંગ્રહ છે. આ ત્રિમાસિક શિબિરો અને બે વાર્ષિક સભાઓ માટે ચર્ચાનો વિષય તરીકે શ્રી માતાજીએ પોતે તેના વિષયો સ્વીચ્છવેલા, પસંદ કરેલા, અથવા તો મંજૂર કરેલા. આમાંના ઘણાખરા વિષયો પર શ્રી માતાજીએ પોતાની જાતે અથવા તો પોતાને

પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર રૂપે નોંધ કરેલી તેનો સંગ્રહ કરવામાં આવેલો છે. આમાંનાં ત્રણ સંમેલનોને શ્રી માતાજીએ પોતાના રાંદેશાઓ મોકલેલા એમાં જે છેલ્લો લેખ છે તે આ પ્રકારનાં શિબિરોમાં ભાગ લેવા પાછળ શો હેતુ હોઈ શકે તેના ઉત્તર રૂપે છે.

- (૪) શ્રી માતાજીનાં શાળાઓમાંનાં કાર્યોનો અહેવાલઃ આ પત્રો અને શ્રી માતાજીના મૌખિક વાર્તાલાપોની નોંધો કેળવણી કેન્દ્રના શિક્ષકોને ઉદેશીને ૧૯૬૦ થી ૭૨ની વચ્ચે સમય દરમિયાન આપવામાં આવેલી છે. આ સર્વનો સંગ્રહ સૌપ્રથમ મૂળ ફેન્ચ ભાષામાં અને તેના અંગેજુ ભાષાંતર રૂપે બુલેટિનના ૧૯૭૮ના એપ્રિલ અને ઓગસ્ટના અંકોમાં સૌપ્રથમ પ્રકટ કરવામાં આવ્યા હતા.
- (૫) એક સ્વી મોનિટરને આપવામાં આવેલા ઉત્તરો : આ ઉત્તરો મૂળમાં શારીરિક કેળવણી વિભાગની એક યુવાન સ્વી-નેતાને ફેન્ચ ભાષામાં આપવામાં આવેલા હતા, એમાંનાં સાત સૂત્રો સૌપ્રથમ બુલેટિનના નવેમ્બર ૧૯૮૮ના અંકમાં પ્રથમ પ્રસિદ્ધ કરવામાં આવેલાં. એ આખોયે પત્રવ્યવહાર ૧૯૭૫માં પ્રથમ ફેન્ચમાં પ્રસિદ્ધ થયો હતો. આમાંના કેટલાક પત્રો અને પત્રશૈશ્વરી આ અગાઉ બુલેટિનના ૧૯૭૦ના ફેબ્રુઆરી અંકમાં પ્રસિદ્ધ થઈ ગયા છે. એ મૂળ ભાષાંતરોને આ ગ્રંથમાં સંશોધન કરીને મૂકવામાં આવેલાં છે.
- (૬) એક મોનિટરને આપવામાં આવેલા ઉત્તરો : આ વિભાગમાં શારીરિક કેળવણી વિભાગના એક યુવાન કેપ્ટન સાથે ખાસ કરીને કેળવણીના વિષયમાં લખવામાં આવેલા પત્રોનો સમાવેશ કરવામાં આવેલ છે. એ આખોયે પત્રવ્યવહાર મૂળ ફેન્ચ તેમ જ તેના અંગેજુ ભાષાંતર સાથે બુલેટિનના ૧૯૭૭ના એપ્રિલથી ૧૯૭૫ નવેમ્બર સુધીના સમયમાં આપવામાં આવેલો છે. એ ભાષાંતરોમાં સામાન્ય જરૂરી સુધારા કરીને અહીં તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
- (૭) વાર્તાલાપો : આ વિભાગમાં ૧૯૬૭ના બે વાર્તાલાપો અને ૧૯૭૩ના ફેબ્રુઆરી અને માર્ચના સમયના ઇ વાર્તાલાપો આપવામાં આવેલા છે. ૧૯૭૩ના વાર્તાલાપ જે શિક્ષણ કેન્દ્રના એક કે બે શિક્ષકો સાથે થયેલા

તે શ્રી માતાજીએ કેળવણી વિષયમાં કરેલાં છેલ્લામાં છેલ્લાં વિધાનો છે. આમાંનાં કેટલાંક આ અગાઉ આશ્રમની પત્રિકાઓમાં પ્રસિદ્ધ થઈ ગયેલાં છે, અને અહીંની આપવામાં આવેલો સંપૂર્ણ સંગ્રહ સૌપ્રથમ મૂળ ફેન્ચ અને તેના નવેસરથી કરવામાં આવેલા અંગેજુ ભાષાંતર સાથે બુલેટિનના ઓંગસ્ટ ૧૯૭૮ના અંકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે.

### વિભાગ - ૩ : નાટકો

શિક્ષણ કેન્દ્રના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે ડિસેમ્બરમાં યોજાતા નાટકો માટે શ્રી માતાજીએ ફેન્ચ ભાષામાં ત્રણ નાટકો લખ્યા હતા. “ભાવિ તરફ” ૧૯૪૮માં, “મહા રહસ્ય” ૧૯૫૪માં, અને “સત્ય પ્રતિ આરોહણ” ૧૯૫૭માં નિર્માણ કરવામાં આવ્યું હતું. દરેક નાટક તેના પ્રદર્શન પછી તરત જ ફેન્ચ અને અંગેજુમાં, એમ બંને ભાષાઓમાં પુસ્તિકા રૂપે બહાર પાડવામાં આવ્યું હતું. આ ગ્રંથ માટે મૂળ અનુવાદો સુધારવામાં આવ્યા છે. “મહા રહસ્ય” માટે શ્રી માતાજીએ રાજકારણી, કલાકાર, અને અજ્ઞાત માનવના પાઠો લખ્યા હતા; બીજા ચાર પાત્રો ભજવનાર કલાકારોએ શ્રી માતાજીના પરામર્શમાં રહીને પોતાપોતાના પાઠો લખ્યા હતા. લેખક અને વ્યાયામવિદ્ધના પાઠો અંગેજુ ભાષામાં લખાયા હતા. ઉઘોગપતિનું ચિત્રણ કરનાર વ્યક્તિનો પત્ર નાટકના પરિચય તરીકે સમાવવામાં આવેલ છે.

ઉપરોક્ત પ્રકાશનની નોંધ અંગેજુ ગ્રંથના આધારે લખેલી છે.

# અનુક્રમણિકા

## ભાગ ૧: લેખો

જીવનનું શાસ્ત્ર .....	૦૩
કેળવણી .....	૧૦
શારીરિક કેળવણી .....	૧૪
પ્રાણની કેળવણી .....	૨૧
મનની કેળવણી .....	૨૮
અંતરાત્માની અને આધ્યાત્મિક કેળવણી .....	૩૫
આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કેન્દ્ર .....	૪૭
ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિઓ .....	૫૭
વિદ્યાર્થીઓને - નાના તથા મોટા .....	૮૮
ભાવિનું દર્શન .....	૯૪
રૂપાંતર .....	૯૭
મૃત્યુનો ભય અને તેના ઉપર વિજ્ય પ્રાપ્ત કરવાનાં ચાર સાધનો.....	૧૦૦
એક સ્વખન .....	૧૧૩
માનવજીતિને મદદ .....	૧૧૫
સ્ત્રીનો પ્રશ્ન .....	૧૨૩

## ભાગ ૨: સંદેશાઓ, પત્રો અને વાર્તાલાય

૧. શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્ર.....	૧૩૧
સંદેશાઓ .....	૧૩૩
લક્ષ્ય .....	૧૩૮
વિદ્યાર્થીઓને .....	૧૪૪
અભ્યાસ .....	૧૫૧
વાચન .....	૧૬૪

वर्तीણૂક .....	૧૭૨
રજાઓ .....	૧૮૪
આશ્રમની બહાર અભ્યાસ .....	૧૮૬
શિક્ષકોને .....	૧૯૦
શિક્ષણ .....	૧૯૨
શિસ્ત .....	૨૧૭
ગૃહકાર્ય .....	૨૨૨
પરીક્ષાઓ .....	૨૨૪
અભ્યાસક્રમ .....	૨૨૮
શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં પુસ્તકોનો અભ્યાસ .....	૨૨૮
ભાષાઓ .....	૨૪૧
શ્રી માતાજીના જુદી જુદી ભાષામાં હસ્તાક્ષરો .....	૨૪૭
કલા .....	૨૫૭
અન્ય વિષયો .....	૨૭૧
રાષ્ટ્રીય કેળવણી .....	૨૭૪
 ૨. શ્રી અરવિંદ આશ્રમ - શારીરિક શિક્ષણ વિભાગ .....	૨૭૮
ઘોવન .....	૨૮૦
એકાગ્રતા અને બૃહુમુખતા .....	૨૮૧
અમારો ધ્વજ અને અમારું પૂંકું .....	૨૮૪
અક્ષય શક્તિ .....	૨૮૫
સાચી નિર્ણયશક્તિ .....	૨૮૮
ઓલિમ્પિકની કડીઓ .....	૨૯૦
જ્યય ચેદ્રક .....	૨૯૨
સ્પર્ધાઓ .....	૨૯૩
યુવક કીડાદલની પ્રાર્થનાઓ અને ઉત્તરો .....	૨૯૪
સ્પર્ધાઓ પ્રસંગે સંદેશા .....	૨૯૮
શારીરિક કેળવણીનાં વાર્ષિક પ્રદર્શનના પ્રસંગોના સંદેશાઓ....	૩૦૩

सामान्य संदेशाओ अने पत्रो .....	304
खीओने - तेमना शरीर विषे .....	312
3. नवयुग मंडળ .....	320
4. आश्रममां श्री माताज्ञना कार्यनी झांभी .....	334
आश्रम अने शाणामां फेन्य .....	334
फेन्य वर्गमां कार्यव्यवस्था .....	336
फेन्य शीखवनार भारतीय शिक्षकोने फेन्यनु शिक्षण .....	338
विद्यार्थीओने फेन्य शीखववा विषे .....	340
पसंद करेलां पुस्तकोनु पुस्तकालय .....	343
दसथी बार वर्षनां बाणकोना वर्गमां श्री माताज्ञनु कार्य .....	344
सातथी नव वर्षनां बाणकोना वर्गमां श्री माताज्ञनु कार्य .....	348
सोणथी अटार वर्षनां बाणकोना वर्गमां श्री माताज्ञनु कार्य ...	346
5. ए खी मॉनिटरने उत्तरो .....	364
सूत्रो .....	364
पत्रव्यवहार .....	364
6. एक मॉनिटरने उत्तरो .....	409
7. वार्तालापो .....	494
५ ऐप्रिल १९६७ .....	494
११ नवेम्बर १९६७ .....	495
८ फेब्रुआरी १९७३ .....	480
१४ फेब्रुआरी १९७३ .....	488
१८ फेब्रुआरी १९७३ .....	484
२४ फेब्रुआरी १९७३ .....	480
२६ फेब्रुआरी १९७३ .....	484
१४ मार्च १९७३ .....	486

૮. નાટકો.....	૪૫૯
૧. ભાવિ તરફ.....	૪૬૧
૨. મહા રહસ્ય.....	૪૮૩
૩. સત્ય પ્રતિ આરોહણ .....	૪૯૦

---

## વિભાગ - ૧

### લેખો

આ લેખો દ્વારા, હું યોગની પરિભાષાને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયત્ન કરું છું, કારણ કે આ ‘બુલેટિન’ (પત્રિકાઓ) સામાન્ય જીવન ગાળતા હોવા છતાં યોગના અભ્યાસાંથી પણ હોય એવા લોકોને માટે છે – એટલે કે, જે લોકો મુખ્યત્વઃ કેવળ શારીરિક અને ભૌતિક જીવનમાં રસ ધરાવતા હોવા છતાં, સામાન્ય પરિસ્થિતિમાં પણ ભૌતિક જીવનમાં વધુ પૂર્ણતા પ્રાપ્ત કરવા ચાહતા હોય એવા લોકો માટે છે. એમ કરવું એ ધાર્યું મુશ્કેલ કાર્ય છે, છતાં એ પણ એક જાતનો યોગ જ છે. આવા લોકો પોતાને ‘ભૌતિકવાદી’ કહેવડાવે છે અને એમની પાસે જો યોગની પરિભાષા વાપરવામાં આવે તો, એમને અકળામણ આવે કે ચીડ ચે. એટલે આપણે તેમની સાથે એવી ભાષા વાપરવી જોઈએ કે જેથી તેમને આંચ્યકો ન લાગે. પરન્તુ મારા જીવન દરમ્યાન, મેં એવા લોકોને પણ જોયેલા છે જેઓ પોતાને ‘ભૌતિકવાદી’ કહેવડાવતા, હોવા છતાં, એવી શિસ્તનું પાલન કરતા કે જેવી શિસ્ત કેટલાક યોગ કરતા હોવાનો દાવો કરનાર લોકોમાં પણ જોવામાં આવતી નહિ.

અમારી ઈચ્છા છે કે, માનવજીતએ પ્રગતિ કરવી જોઈએ; એમાં પછી કોઈ યોગીનું જીવન જીવવાનો દાવો કરે કે નહિ તેની કશી અગત્ય નથી. ફક્ત એઝે પ્રગતિ માટે જરૂરી હોય તેટલો પ્રયત્ન કરવો જોઈએ.

૨૫ ડિસેમ્બર ૧૯૫૦

શ્રી માતાજી

\*



## જીવનનું શાસ્ત્ર

### આત્મજ્ઞાન અને આત્મ-સંયમ

ધ્યેય વિનાનું જીવન હમેશાં દુઃખી જીવન જ હોય છે. તમારે સૌ કોઈને જીવનનું ધ્યેય હોવું જોઈએ. પરંતુ એ ન ભૂલશો કે તમારું ધ્યેય જે પ્રકારનું હશે તે પ્રમાણે જ તમારા જીવનનું સ્વરૂપ બંધાશે.

તમારું ધ્યેય ઉચ્ચ અને વિશાળ રાખો, ઉદાર અને આસક્તિ વિનાનું રાખો. એમ કરશો તો તમારું જીવન તમારે પોતાને માટે તેમ જ અન્ય સર્વને માટે એક ઘણી કીમતી વસ્તુ બની રહેશે.

પરંતુ તમારો આદર્શ ભલે ગમે તે હો, પણ જ્યાં સુધી તમે તમારી પોતાની અંદર પૂર્ણતા પ્રાપ્ત નહિ કરી હોય ત્યાં સુધી એ આદર્શનો તમે પૂર્ણ રીતે સાક્ષાત્કાર નહિ કરી શકો.

આ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ પગલું છે સચેતનતા. તમારે પોતાને વિશે સચેતન બનો, તમારા સ્વરૂપના જુદા જુદા ભાગો વિષે, અને તે દરેકના જુદા જુદા કાર્ય વિષે સચેતન બનો. આ જુદા જુદા ભાગોને એકબીજાથી છૂટા પાડતાં તમારે શીખવાનું છે. એ જ્ઞાન થતાં એ વાત તમે સ્પષ્ટ રીતે જાણી શકશો કે તમારી અંદર જે જે કિયાઓ ચાલી રહી છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે, તમને જે વૃત્તિઓ, પ્રત્યાધાતો અને પરસ્પર અથડાતા સંકલ્પો કાર્યમાં ધકેલી રહેલાં હોય છે તે સૌનું મૂળ ક્યાં રહેલું છે. આ એક ઘણો મહેનત માગો લે તેવો વિષય છે, અને તે માટે તમારે સાચા દિલથી અને ખંતપૂર્વક કામે લાગવાનું છે. માણસની પ્રકૃતિમાં, ખાસ કરીને તેની મનોમય પ્રકૃતિમાં એક એવું કુદરતી વલાણ છે કે તે પોતે જે કાંઈ વિચારતો હોય છે, અનુભવતો હોય છે, બોલતો અને કરતો હોય છે તેને અનુકૂળ નીકે તેવા જ ખુલાસા તે આપતો રહે છે. આ બધી કિયાઓને આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક નિહાળવાની છે, તેમને જાણો કે આપણો જે ઉત્તમોત્તમ આદર્શ હોય તેના ન્યાયાસન પાસે લઈ આવવાની છે, અને એ આદર્શના આસન પરથી જે ચુકાઓ આવે તે સ્વીકારવા માટે સાચા હંદયથી તૈયારી રાખવાની છે. આ કરીશું તો જ આપણે એક સ્બલન વિનાની વિવેકબુદ્ધિ વિકસાવી શકીશું. આપણે જો ખરેખર પ્રગતિ કરવી હશે, આપણા સ્વરૂપનું સત્ય જાણવા માટેની શક્તિ

મેળવવી હશે, એટલે કે, જે એકમાત્ર વસ્તુ ખાતર આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે, અર્થાત્ જેને આપણે આપણું આ પૃથ્વી ઉપર આવવાનું ધ્યેય કહી શકીએ તેને જાગ્રવા માટેની શક્તિ જો આપણે મેળવવી હશે તો તે માટે આપણે એક ઘણી જ નિયમિત અને અખંડ સાધના આદરીને, જે જે વસ્તુઓ આપણા જીવનના સત્યથી ઉલટી હોય, જે જે વસ્તુઓ એ સત્યનો વિરોધ કરતી હોય તે સર્વને આપણે આપણામાંથી બહાર ફેંકી દેવાની રહે છે, યા તો તેમને નિર્મળ કરી લેવાની રહે છે. એમ કરતાં કરતાં આપણે આપણા સર્વ તત્ત્વોને, આપણા સર્વ ભાગોને ધીરે ધીરે એવી રીતે તો વ્યવસ્થિત કરી શકીશું કે જેથી તે બધાં આપણા સ્વરૂપના કેન્દ્રરૂપ અંતરાત્માની આસપાસ એક પૂર્ણ સંવાદમય એકતામાં ગોડવાઈ જશે. પણ આ એકીકરણની કિયા લાંબો વખત લે છે, એ એકીકરણને થોડીધણી પૂર્ણતાએ પહોંચાડતાં પણ ઘણો વખત ચાલ્યો જાય છે. એટલે આ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે આપણે ધૈર્ય અને તિતિક્ષાથી બરાબર સજજ બનવાનું રહે છે, અને આપણા પ્રયત્નને સફળ બનાવવા માટે જ્યાં સુધી જીવન ટકાવી રાખવું જરૂરી રહે ત્યાં સુધી આપણા જીવનને ટકાવી રાખવાનો દૃઢ નિશ્ચય કરવાનો રહે છે.

આ વિશુદ્ધિ અને એકીકરણ માટેની સાધના આપણે હાથ ધરીએ ત્યારે સાથે સાથે આપણે આપણા બાધ્ય સ્વરૂપને, આપણાં કરણને પણ પૂર્ણ કરવા માટે ખૂબ જ કાળજી લેવાની રહે છે. પ્રભુનું ઊર્ધ્વ સત્ય જ્યારે પોતાનો આવિર્ભાવ કરવા તૈયાર થાય ત્યારે તમારી અંદર એને એક એવું સૂક્ષ્મ અને સમૃદ્ધ અને મનોમય તંત્ર મળી રહેવું જોઈએ કે જે પેલા વ્યક્ત થવા માગતા વિચારને, તેમાંનું બળ અને સ્પષ્ટતા જાળવી રાખી શકે તેવી રીતનું એક વિચારમય રૂપ આપી શકે. વળી એ વિચાર જ્યારે પોતાને શબ્દો દ્વારા વ્યક્ત કરવા માગે ત્યારે તમારામાં વસ્તુને વ્યક્ત કરવાની એવી તો શક્તિ હોવી જોઈએ કે જેથી એ શબ્દો પેલા વિચારને પૂરેપૂરું પ્રાક્ટચર આપે, નહિ કે તેમને કોઈ બીજું વિકૃત રૂપ આપે. અને આ સત્યને તમે જે રૂપે આકારબદ્ધ કરતા હો તેનો રણકાર તમારાં સર્વ સંવેદનોની અંદર, તમારા સંકલ્પો અને કાર્યોની અંદર, તમારી સર્વ પ્રવૃત્તિની અંદર ગુજુ ઊઠવો જોઈએ. અને છીવટે, આ સર્વ પ્રવૃત્તિઓ પણ, એક અખંડ સાધના દ્વારા, તેમની ઉત્તમોત્તમ પૂર્ણતાએ પહોંચેલી બનવી જોઈએ.

આ બધું સિદ્ધ કરવા માટે એક ચતુર્વિધ સાધનાનો માર્ગ છે. એ સાધનાની એક સામાન્ય રૂપરેખા અત્રે આપવામાં આવે છે. એ સાધનામાં આ ચાર સ્વરૂપોને એકબીજાથી અલગ અલગ રીતે હાથ ધરવાનાં નથી. એ ચારે પ્રકારની સાધના એકીસાથે પણ થઈ શકે છે, બલ્કે એ ચારે પ્રકાર એકીસાથે જેડવા એ જ વધુ દ્યા

છે. આ ચ્યતુર્વિધ સાધનાનો પ્રથમ આરંભ આપણે જે સાધનાથી કરવાનો છે તેને આપણે ચૈતસિક સાધનાનું નામ આપીશું. આપણી અંદર ચિદ્વ્યાપારનું જે કેન્દ્ર છે તેને આપણે 'ચિટ્પુરુષ' (psychic) કહીશું. આપણા અસ્તિત્વનું ઉત્તમોત્તમ સત્ય ચિટ્પુરુષની આપણી આ આંતર વેદી ઉપર મંડાયેલું છે. ચિટ્પુરુષ એ સત્યને જાણી શકે છે અને તેનો આવિર્ભાવ કરી શકે છે. એટલે આપણે એ ચિટ્પુરુષની આપણામાં રહેલી ઉપસ્થિતિ વિષે સચેતન બનીએ, એના આ સાંનિધ્ય ઉપર આપણે એકાગ્રતા પ્રાપ્ત કરીએ, અને તેને આપણે માટે એક જીવતી હુક્કિકત બનાવી લઈએ અને તેની સાથે આપણી તદ્રૂપતા સાથી લઈએ એ ખૂબ જ મહત્વનું છે.

આજ સુધીમાં આ ચિટ્પુરુષનું જ્ઞાન મેળવવાની તથા તેની સાથે અંતે તદ્રૂપતા પ્રાપ્ત કરવાની અનેક પદ્ધતિઓ જગતમાં યોજાયેલી છે. એમાંની કેટલીક પદ્ધતિઓ ચૈતસિક પ્રકારની છે, કેટલીક ધાર્મિક રીતની છે તો કેટલીક યંત્ર જેવી સ્થૂલ પ્રકારની પણ છે. આમાંથી કઈ પદ્ધતિ કોને અનુકૂળ નીવડશે. તે ખરું જોતાં તો હુરેક વ્યક્તિએ પોતે જ શોધી લેવાનું છે. આપણામાં જો સાચી અને સ્થિર અભીપ્સા હશે, એક અસ્થાલિત અને સક્રિય સંકલ્પ હશે તો આપણા લક્ષ્યને પહુંચિયા માટે જરૂરની સહાય કોઈ ને કોઈ રીતે અવશ્ય મળી આવશે. આ સહાય સાધકને કાં તો બાધ રીતે ગ્રંથોના અધ્યયનમાંથી યા તો ગુરુના ઉપદેશમાંથી મળી આવે, યા તો આંતરિક રીતે તે તેને એકાગ્રતા કે ધ્યાન દ્વારા, યા તો તેની સમક્ષ સત્યના ગ્રાકટ્ય દ્વારા અને સત્યની અનુભૂતિ દ્વારા પણ મળી આવે. આ બાબતમાં માત્ર એક જ વાત જરૂરની છે: આ પરમ તત્ત્વને શોધવા માટેનો, તેનો સાક્ષાત્કાર કરવા માટેનો સંકલ્પ. આ શોધ અને સાક્ષાત્કાર એ જ આપણું સૌથી પ્રથમ કાર્ય બની રહેવું જોઈએ. આપણા મનમાં એ વાત દૂઢ થવી જોઈએ કે આ સિદ્ધિ એ એક એવી તો મહામૂલા મોતી જેવી છે કે જેને ગમે તે કિંમતે પણ આપણે મેળવવી જોઈએ. એટલે તમે ગમે તે કાર્ય કરતા હો, ગમે તે પ્રવૃત્તિ કે કામધંદો કરતા હો, પણ તમારા જીવનના સત્યને શોધવા માટેનો સંકલ્પ, તે સત્ય સાથે એકરૂપ થઈ જવાનો સંકલ્પ સદાય તમારામાં જીવત બની રહેવો જોઈએ, તમે જે કાંઈ કરતા હો, તમને જીવનમાં જે કાંઈ અનુભૂતિઓ થતી હો, તમે જે કાંઈ વિચારતા હો, તે સર્વની પાછળ એ સંકલ્પ સદાય હાજર રહેવો જોઈએ.

આ આંતર સિદ્ધિની કિયાને સંપૂર્ણ કરવા માટે તમે તમારા માનસિક વિકાસ પ્રત્યે પણ પૂરતું ધ્યાન આપો એ ઈષ્ટ છે. કેમ કે તમારું મન રૂપી યંત્ર પણ જેટલું મદદ રૂપ નીવડી શકે છે તેટલું જ વિધન રૂપ પણ બની શકે છે. માણસનું મન તેની કુદરતી અવસ્થામાં એક બહુ જ મર્યાદિત વસ્તુ છે. એની દૃષ્ટિ બહુ અદ્ય છે, એની

સમજશક્તિ બહુ સંકુચિત છે, એના ઘ્યાલો જડ પ્રકારના છે. આવા મનને વિશાળ કરવા માટે, તેને મુલાયમ અને ઉંઠું બનાવવા માટે અમુક પ્રયત્નની જરૂર રહે છે. અને તેથી આપણે હેઠેક વસ્તુનો બની શકે તેટલાં વધુમાં વધુ દૃષ્ટિબિંદુથી વિચાર કરતા થઈએ એ ખૂબ જ આવશ્યક છે. આ માટે એક નીચે મુજબનો પ્રયોગ અજમાવી શકાય એમાંથી મનને ખૂબ જ મુલાયમતા મળી શકે તેમ છે, અને વિચારની ઉન્નતિ સાધી શકાય તેમ છે. આ પ્રયોગમાં પ્રથમ તો એક અમુક વિષય લઈ તે અંગે એક સ્પષ્ટ રીતે વિચારેલું દૃષ્ટિબિંદુ રજૂ કરવું, તેની સામે પછી પેલાથી તદ્દન ઊલટું દૃષ્ટિબિંદુ રજૂ કરવું, પેલાના જેટલી જ સ્પષ્ટ રીતે વિચારીને. આમ કર્યા પછી ખૂબ જ કાળજીપૂર્વક વિચાર કરતાં કરતાં એ પ્રશ્નને વિશાળ ને વિશાળ રૂપ આપતા જાઓ, એ પ્રશ્નથી ઉપર ચાલ્યા જાઓ અને તેમ કરતાં તમને એક નવો સમન્વય મળી આવશે. એ સમન્વય તમને એક વધુ વિશાળ, વધુ ઉચ્ચ અને વધુ વ્યાપક વિચારની અંદર એવી રીતે તો મૂકી આપશે કે જેમાં પેલાં બંને વિરોધી દૃષ્ટિબિંદુઓ એક થઈ જશે.

આ પ્રકારનાં બીજો મનોયતનો પણ કરી શકાય છે. એવાં કેટલાંક મનોયતનો માણસના ચારિત્ય ઉપર પણ સારી અસર પહોંચાડે છે અને એ એનો બેવડો લાભ છે. આ રીતે તમે તમારા મનને તાલીમ આપો છો અને સાથે સાથે તમારી લાગણીઓ અને એ લાગણીઓનાં પરિણામો ઉપર તમે કાબૂ મેળવી શકો છો. દા. ત. તમારે તમારા મનને કોઈ પણ વસ્તુ યા તો વ્યક્તિ વિષે કશો નિર્ણય કરવા દેવો નહિ. કેમ કે મન એ પોતે જ્ઞાનનું સાધન છે જ નહિ. તેનામાં જ્ઞાન શોધવાની શક્તિ છે જ નહિ. ઊલટું મને પોતે જ્ઞાન દ્વારા સંચાલિત થવાનું રહે છે. જ્ઞાનનો પ્રદેશ તો માનવના મન કરતાં એક ધારે ધારે ઊંચે આવેલી ભૂમિકામાં, શુદ્ધ વિચારોના પ્રદેશથી પણ ઉપરની ભૂમિકામાં આવેલો છે. એ પ્રદેશમાંથી આવતા જ્ઞાનને મને જીલવાનું છે, અને તેને આવિર્ભાવ આપવાનો છે, અને તે માટે મને શાંત પડી જવાનું છે. એ જ્ઞાન તરફ ધ્યાનબદ્ધ થવાનું છે. મન પોતે રચના કરવા માટેનું, સંગઠન માટેનું, પ્રવૃત્તિ માટેનું કરણ છે. અને આ કિયાઓની અંદર જ મન પોતાની સાચી ઉપયોગિતા અને સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકે છે.

એક બીજો અભ્યાસ પણ ચેતનાના વિકાસ માટે બહુ મદદ રૂપ થઈ શકે તેમ છે. કોઈ પણ વસ્તુ અંગે જ્યારે મતબેદ પે, દા. ત. અમુક નિર્ણય લેવાનો હોય, યા તો કોઈ કામ પાર પાડવાનું હોય ત્યારે આપણે તે બાબતમાં આપણા જ દૃષ્ટિબિંદુને યા તો તે અંગેના આપણા ઘ્યાલને જ વળગી ન રહેવું જોઈએ. ઊલટું, આપણે સામા માણસના દૃષ્ટિબિંદુને સમજવા પ્રયત્ન કરવો જોઈએ, તેની જગાએ આપણને પોતાને મૂકી જોવા જોઈએ, અને તે અંગે ટંટોફિસાદ યા તો લડાઈ પણ

કરી લેવાને બદલે કોઈક એવો ઉકેલ શોધવો જોઈએ કે જેથી બંને પક્ષને માફકસર સંતોષ થઈ શકે. અને જેનું મન શુભનિષ્ઠાવાળું છે તેને હમેશાં આવો ઉકેલ અવશ્ય જરી આવે જ છે.

હુવે આપણો ગ્રાણની તાલીમનો વિચાર કરીએ. આપણામાં રહેલું ગ્રાણતત્ત્વ, એ શીધવૃત્તિઓ અને કામનાઓનું કેન્દ્ર છે. ઉત્સાહ અને ઉગ્રતા, કિયાત્મક શક્તિ અને તીવ્ર વિષાદ, ઉગ્ર વાસનાઓ અને બંડખોર વૃત્તિઓ એ બધું એમાં આવી રહેલું છે. એ ગ્રાણતત્ત્વ હરેક ચીજને ગતિમાન કરી શકે છે. તે વસ્તુઓ રચી શકે છે, સિદ્ધ કરી શકે છે અને તે હરેક ચીજનો નાશ પણ કરી શકે છે, હરેક ચીજને બગાડી પણ શકે છે. માણસમાં રહેલા આ તત્ત્વને તાલીમ આપવી એ એક ઘણું જ અધરામાં અધરું કામ છે. એ એક લાંબી સાધના છે, અને ખૂબ જ ધીરજ માગી લે છે. તે માટે માણસમાં સોએ સો ટકા સત્યનિષ્ઠાની જરૂર રહે છે. આવી સત્યનિષ્ઠા નહિ હોય તો સાધક પહેલે પગથિયેથી જ પોતાની જાતને છેતરી બેસરો, અને પ્રગતિ માટેની ચારીયે મહેનતા નકારી નીવડશો. પણ આ ગ્રાણતત્ત્વ જો સહકારમાં ઊતરે તો પછી કોઈ પણ સિદ્ધિ અશક્ય નહિ લાગે, કોઈ પણ રૂપાંતર અવ્યવહારું નહિ લાગે. મુશ્કેલી એટલી જ છે કે ગ્રાણ પાસેથી આવો સતત સહકાર મેળવવો એ ઘણું કઠણ છે. ગ્રાણ એ એક ઘણો અચ્છો કામદાર છે પણ મોટે ભાગે તે પોતાના સંતોષ માટે જ મથતો હોય છે. ગ્રાણના આ સંતોષને, પૂરેપૂરો યા તો થોડોઘણો પણ જો અટકાવવામાં આવ્યો, તો તે ચિડાઈ જાય છે, નાખુશ થઈ જાય છે, હડતાળ પર ઊતરી જાય છે. પરિણામે માણસને ગ્રાણ તરફથી મળી આવતી શક્તિ લગભગ પૂરેપૂરી અટકી જાય છે, તેને અન્ય લોકો અને વસ્તુઓ વિષે આણગમો થવા લાગે છે, તેનામાં નિરુત્સાહ અને બંડખોર વૃત્તિ આવી જાય છે, કે વિષાદ અને અસંતોષ આવી જાય છે. માણસ પોતે આવી અવસ્થામાં હોય ત્યારે તેણે તદન શાંત રહેવું જોઈએ અને કાંઈ પણ કાર્ય કરતાં અટકી જવું જોઈએ. કેમ કે આવી ક્ષાળોમાં જ માણસો મૂર્ખાઈભરેલાં કાખો કરી બેસે છે. પોતે મહિનાઓ સુધી નિયમિત પ્રયત્ન દ્વારા પ્રાપ્ત કરેલી વસ્તુને, એ દ્વારા સાધેલી સર્વ પ્રગતિને તે થોડી મિનિટોમાં જ બગાડી નાખી શકે છે, યા તો તેનો નાશ કરી લઈ શકે છે. જે લોકો પોતાના ચિત્પુરુષની સાથે સંપર્ક સાધી શક્યા હોય છે, તેઓ જ પોતાની અંદર અભીસાની જ્યોતને જીવતી રાખી શકે છે અને પોતે જે આદર્શ સાધવાનો છે તેની સચેતનતા ટકાવી શકે છે. એવા લોકોને માટે ગ્રાણની આવી કટોકટીઓ બહુ લાંબો વખત ટકી નથી અને એટલી બધી જોખમકારક પણ નથી બનતી. આ સચેતનતાની સહાય વડે તેઓ કોઈ તોફાને ચેઢલા બાળક સાથે કામ લેતા હોય તેમ પોતાના

પ્રાણી સાથે ધીરજથી અને ખંતથી કામ લે છે, તેને સત્યનું અને પ્રકાશનું દર્શન કરાવે છે, તેને ખાતરી કરી આપવા પ્રયત્ન કરે છે, અને તેની ઘડીભરને માટે હંકાઈ ગયેલી શુલ્ભવૃત્તિને જગૃત કરી શકે છે. આવી રીતે ધીરજપૂર્વક કામ કરતાં કરતાં હરેક કટોકટીના પ્રસંગને એક નવી પ્રગતિના રૂપમાં, લક્ષ્યની દિશામાંના એક વધુ આગેકદમ તરીકે ફેરવી શકાય છે. આ બાબતમાં પ્રગતિનો વેગ ધીરો રહે, માણસનું સ્ખલન વારંવાર થતું રહે, તોપણ તે જો હિંમતપૂર્વક પોતાના સંકલ્પમાં અવિયલ રહે તો એક દિવસ તેને અવશ્ય વિજય મળવાનો છે. તે જોશો કે તેનામાં જગેલી સત્યની પ્રકાશમાન ચેતના સમક્ષ બધીયે મુશ્કેલીઓ ઓળાળીને અદૃશ્ય થઈ ગઈ છે.

આપણી સાધનાનો છેલ્લો ભાગ શરીરની તાલીમનો છે. એ માટે આપણે એક સ્પષ્ટ દૃષ્ટિવાળી અને બુદ્ધિપૂર્વક યોજેલી શારીરિક કેળવણી દ્વારા શરીરને બળવાન અને મુલાયમ બનાવવાનું છે. એ રીતે તૈયાર થયેલું શરીર જે ઋજશક્તિ આપણી દ્વારા મનનો આવિભાવ સાધવા દૂચ્છી રહી છે તેને માટે આ સ્થૂલ જગતમાં એક સુયોગ્ય ઉદ્ઘિયાર બની રહેશે.

શરીર અંગે પ્રથમ વાત તો એ છે કે તે આપણું માલિક ન બની જવું જોઈએ. તોણે આપણી આજ્ઞામાં રહેવાનું છે. અને શરીર એની કુદરતી પ્રકૃતિ મુજબ તો એક નમ અને વફાદાર સેવક જોવું જ છે. દુઃખની વાત એટલી જ છે કે તેના બે માલિકો, પ્રાણ અને મન તેની સાથે જે રીતે કામ લે છે તે અંગે વિવેક કરવાની શક્તિ તેનામાં ઘણી વાર હોતી નથી. એક આંધળાની માફક તે આ માલિકોના હુકમો પોતાને ભોગે પાણ્યે જાય છે. મન પાસે તેના ઝૂઢ વિચારો હોય છે, તેના જડ અને સ્વચ્છંદી સિદ્ધાંતો હોય છે. પ્રાણ પાસે તેની વાસનાઓ છે, અતિરેકો અને વિલાસો છે. અને એ બધાં થોડા જ વખતમાં શરીરની કુદરતી સમતુલાને તોડી નાખે છે અને તેનામાં થાક, અશક્તિ, રોગ ઉત્પન્ન કરી દે છે. આ બેયના અત્યાચારમાંથી શરીરને મુક્ત કરવાનું છે. એ મુક્તિ માટેનો એક જ માર્ગ છે. આપણી અંદર રહેલા ચિત્પુરુષના કેન્દ્રની સાથે આપણે અખંડ અનુસંધાનમાં રહેતા થઈ જવું. શરીરની પાસે સહન કરવાની અને સાનુકૂળ થઈ જવાની એક અદ્ભુત શક્તિ છે. આપણે સામાન્ય રીતે ઘારીએ તે કરતાં કેટલીયે વધારે વસ્તુઓ શરીર કરી શકે તેમ છે. એટલે, અત્યારે શરીરના ઉપર જે બે અજ્ઞાન અને જુલમગાર માલિકોનું રાજ્ય ચાલે છે તેને બદલે આપણી અંદરના મધ્યવર્તી સત્યનું — અંતરાત્માનું — ચિત્પુરુષનું શાસન જો તેના ઉપર સ્થાપી શકાય તો પછી શરીર એવાં એવાં કામો કરી શકશો કે જે જોઈ આપણે આશ્રમ્યકિત થઈ જઈશું. એ પ્રકાશમય તત્ત્વના શાસન ડેઠળ શરીર સ્વસ્થ અને શાંત બનશો, સશક્ત અને સમતુલ બની રહેશો, અને તેની પાસે માગવામાં

આવતું કામ કરવા તે હર પળે તૈયાર રહેશે. કારણ કે હવે તેને એવું જ્ઞાન મળી ગયું હશે કે જેને લીધે તે કામની અંદર પણ આરામ મેળવી શકશે, અને પોતે જે શક્તિઓ જ્ઞાનપૂર્વક અને ફલદાયક રીતે ખરચી રહ્યું હોય છે તેને વિશ્વશક્તિઓ સાથે સંપર્ક સાધીને કેવી રીતે પુષ્ટ રાખવી તે પણ તેને આવડી ગયું હશે. આવી રીતે સુદૃઢ અને સમતુલ બનેલા જીવનની અંદર એક નવીન સંવાદિતાનો આવિર્ભાવ થશે. અને એ સંવાદિતા ઊર્ધ્વના પ્રદેશોમાં આવેલી સંવાદિતાના જ પ્રતિબિંબ જેવી હોઈ શરીરને તે એક સંપૂર્ણ પ્રમાણબદ્ધતા મેળવી આપશે, તેનામાં આકારનું એક આદર્શ સૌન્દર્ય રચી આપશે. આ સંવાદિતા ક્રમે ક્રમે વધતી જ જશે. આપણી અંદર રહેલું સત્ય એ કોઈ એક સ્થિર અને જડ વસ્તુ નથી. એ સત્ય તો જગતમાં નિત્ય વૃદ્ધિ પામતી, વધુ ને વધુ વ્યાપક અને વિશુરૂપ બન્યે જતી પૂર્ણતાનો જ એક અખંડ આવિર્ભાવ છે. માણસનું શરીર આવી કોઈ વધ્યે જતી સંવાદિતાની રીતે કામ કરતું બનશે ત્યારે તેનામાં રૂપાંતરની એક સતત ચાલુ રહેનારી પ્રક્રિયાનો આરંભ થઈ જશે અને એવા રૂપાંતર દ્વારા, શરીરમાં એક એવી શક્તિ આવશે કે જેને લીધે તે અત્યારે તેનામાં અનિવાર્ય રીતે આવતી શિથિલતા અને છેવટે આવતા નાશની સ્થિતિમાંથી મુક્ત થઈ જશે. અને આ વસ્તુ સિદ્ધ થતાં અત્યારે જગતમાં મૃત્યુનું જે અફર જેવું શાસન છે તેને ટકી રહેવા માટે કોઈ કારણ રહેશે નહિ.

આ પૂર્ણતા પ્રાપ્ત કરવી એ આપણું લક્ષ્ય છે. એ પૂર્ણતાની કોટિએ આપણે જ્યારે પહોંચ્યેશું ત્યારે આપણને જણાશે કે આપણે જે સત્યની ખોજ કરી રહ્યા છીએ તે સત્યનાં ચાર મુખ્ય સ્વરૂપો છે: પ્રેમ, જ્ઞાન, શક્તિ અને સૌન્દર્ય. સત્યનાં આ ચાર તત્ત્વો આપણી અંદર આપોઆપ જ પોતાનું પ્રાક્તય કરશે, આપણો ચિત્પુરુષ સાચા અને વિશુરૂપ પ્રેમનું વાહન બની રહેશે. આપણું મન એક અસંદિઘ એવા પરમ જ્ઞાનનું વાહન બનશે. આપણો પ્રાણ એક અજેય બલ અને શક્તિને આવિર્ભાવ આપશે અને શરીર એક પૂર્ણ સૌન્દર્યનું અને પૂર્ણ સંવાદિતાનું પ્રગટ રૂપ બની રહેશે.

(બુલેટિન, નવેમ્બર ૧૯૫૦)

\*

## કેળવાણી

માણસની કેળવાણી તેના જન્મ સમયથી જ શરૂ થવી જોઈએ અને તેના સારાયે જીવન પર્યંત તે ચાલુ રહેવી જોઈએ.

વળી, આ કેળવાણીમાંથી જો વધુમાં વધુ પરિણામ મેળવવું હોય તો તો તે બાળકના જન્મથી પણ પહેલાં શરૂ કરી દેવી જોઈએ. અને એ આરંભ માતાએ પોતે કરવાનો છે. માતાનું એ કાર્ય બે પ્રકારનું હશે. પ્રથમ તો તેણે પોતાનો વિકાસ થાય તે રીતની પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ અને બીજું તેણે જે બાળક તેની અંદર શરીર ધારણ કરી રહ્યું છે તેના વિકાસ માટે તેણે જરૂરી વસ્તુઓ કરવી જોઈશે. એ વાતમાં તો શક નથી કે આ નવા બાળકની પ્રકૃતિનો ઘણોખરો આધાર તો તેને શરીર આપનાર માતા ઉપર જ રહેલો છે. માતા કેવી સ્થૂલ પરિસ્થિતિમાં રહે છે તે ઉપરાંત તેના અંતરમાં કઈ રીતની અભીષ્ટા છે, તેનામાં કઈ રીતની સંકલ્પશક્તિ છે એ બધાને આધારે બાળકની પ્રકૃતિ બંધાય છે. માતાએ પોતે જે કેળવાણી લેવાની છે તે આ મુજબની હોવી જોઈએ. તે ધ્યાન રાખશે કે તેના વિચારો સદાયે સુંદર અને વિશુદ્ધ પ્રકારના રહેશે, તેની લાગણીઓ હમેશાં ઉમદા અને ઉત્તમ પ્રકારની હશે, તેમ જ તેની આસપાસની પરિસ્થિતિ બને તેટલી સંવાદભરેલી, કલેશરહિત અને ખૂબ જ સાદ્ધિથી ભરેલી હશે. આ ઉપરાંત માતાની અંદર એક રીતનો સ્પષ્ટ અને જાગૃત સંકલ્પ હોવો જોઈએ કે મારે તો મને જે ઉત્તમોત્તમ આદર્શ દેખાય છે તે મુજબ જ મારા બાળકને ઘડવું છે. આટલું થાય તો બાળકને જગતમાં આવવા માટે તે સારામાં સારી પરિસ્થિતિ બની રહેશે, તેનાં પરિણામ પણ શક્ય તેટલાં સારામાં સારાં જ આવશે, અને એ રીતે કેટલીયે પારાવાર મહેનતમાંથી અને નિરર્થક ગ્રંચવાણોમાંથી બચી જઈ શકશે.

મનુષ્યની પ્રવૃત્તિઓ મુખ્યત્વે પાંચ પ્રકારની રહેલી છે, અને એ હરેક પ્રવૃત્તિને અંગેની કેળવાણી જ્યારે માણસને અપાશો ત્યારે તે એક સંપૂર્ણ કેળવાણી બની શકશે. આ પાંચ પ્રવૃત્તિઓ તે શરીરની, પ્રાણની, મનની, ચિત્ત-તત્ત્વની અને આત્માની છે. કેળવાણી પણ આ પાંચ પ્રકારની હોવી જોઈએ. સામાન્ય રીતે એમ બને છે કે વ્યક્તિ જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ આ કેળવાણીનાં સ્વરૂપો એક પછી એક વ્યક્તિના જીવનમાં દાખલ થતાં જાય છે. પરંતુ અનો અર્થ એ નથી કે માણસની એક પ્રકારની કેળવાણી અટકી જાય અને પછી બીજા પ્રકારની શરૂ થાય. પણ એ પાંચ પ્રકારની કેળવાણી એકબીજાની પૂરક બનીને માણસનું જીવન પૂરું થાય ત્યાં સુધી ચાલુ રહેવી જોઈએ.

કેળવણીનાં આ પાંચે સ્વરૂપો અમે એક પછી એક અભ્યાસ માટે હાથ લેવા માગીએ છીએ અને તે દરેકનો એકબીજાની સાથે શો સંબંધ રહેલો છે તે પણ અવલોકવા માગીએ છીએ. પરંતુ આ વિષયની વિગતમાં ઊતરીએ તે પહેલાં માબાપોને હું એક ભલામણ કરવા દઈયું છું. પોતાનાં બાળકો માટે સાચી કેળવણી કઈ હોઈ શકે એ બાબતમાં મોટા ભાગના માણસો, જુદા જુદા કારણે, ભાજ્યે જ કાંઈ વિચાર કરતા હોય છે. સામાન્ય રીતે તેઓ એમ જ માની લે છે કે બાળકને અમે જગતમાં જન્મ આપ્યો, તેને ખવડાવ્યું—પિવડાવ્યું, તેનું આરોગ્ય બરાબર જળવાય તે રીતે તેની બનતી સંભાળ રાખી, અને તેની વિવિધ સ્થૂલ જરૂરિયાતો પૂરી પાડી એમાં અમારું માબાપ તરીકેનું કર્તવ્ય પૂરેપૂરું આવી ગયું. હવે બાળક મોટું થશે એટલે અને નિશાળે મૂકી આવીશું અને તેની માનસિક કેળવણીનું કામ શિક્ષકના હાથમાં સોંપી દઈશું.

પણ એવાં પણ માબાપો છે કે જેઓ પોતાનાં બાળકોને કેળવણી આપવાની જરૂર છે એમ સમજતાં હોય છે અને તે આપવાનો પ્રયત્ન પણ કરતાં હોય છે. પરંતુ એ માબાપોને એ વાતની ખબર નથી હોતી કે પોતે પોતાના બાળકને કેળવણી આપી શકે તે માટે પ્રથમ તો તેમણે પોતાની જાતને જ કેળવવાની રહે છે, પોતાને વિષે સભાન બનવાનું રહે છે, પોતાના ઉપર પ્રભુત્વ મેળવવાનું રહે છે કે જેથી પોતે બાળક આગળ એક ખરાબ દૃષ્ટાંત- રૂપ ન બની રહે. જે માબાપો સાચા હદયથી અને ખૂબ ગંભીર રીતે પોતાનાં બાળકોને કેળવવા માગતાં હોય છે તેમની પણ આવી જ સ્થિતિ હોય છે. ખરી અસરકારક કેળવણી તો દૃષ્ટાંત મારફતે જ અપાય છે. બાળકને માત્ર સારા સારા શબ્દો કહેવા, ડાહી ડાહી શિખામણ આપવી અનો કશો જ અર્થ નથી. આપણે જે કહેતા હોઈએ તેમાં રહેલું સત્ય જો આપણા જીવંત દૃષ્ટાંત દ્વારા આપણે બતાવી નહિ શકીએ તો પછી આપણા શબ્દોની કે શિખામણની કશી અસર પડતી નથી. સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, નિખાલસતા, હિંમત, અનાસક્તિ, નિઃસ્વાર્થતા, ધીરજ, સહનશક્તિ, ખંત, શાંતિ, સ્વસ્થતા, આત્મ-સંયમ આ બધી વસ્તુઓ એવી છે કે તેમને શીખવવા માટે સુંદર શબ્દો કરતાં આપણું પોતાનું દૃષ્ટાંત જ અનેકગણું સારું કામ આપે છે. માટે હું માબાપોને કહીશા કે તમારા જીવનમાં એક ઉચ્ચ આદર્શ રાખો, અને તે આદર્શ અનુસાર જ હુમેશાં તમારું વર્તન રાખો. તમે જોશો કે તમારું બાળક આ આદર્શને પોતાની અંદર થોડે થોડે ઝીલવા લાગ્યું છે, અને તેની પ્રકૃતિમાં તમે જે ગુણોનો વિકાસ દઈછો છો તે ગુણો તે પોતાની મેળે આપોઆપ જ પ્રગટ કરવા લાગ્યું છે. દરેક બાળકને સ્વાભાવિક રીતે જ પોતાનાં માબાપ તરફ માન અને અહોભાવ હોય છે. અને માબાપો જો સાવ નાલાયક નથી હોતાં તો તેઓ બાળકોને હુમેશાં દેવ જેવાં લાગે છે જ અને તેઓ પોતાથી બને તેટલું તેમનું જ અનુકરણ

કરવાનો પ્રયત્ન કરે છે.

માબાપો, અમુક વિરલ અપવાદ સિવાય, એ વાતનો તો કદી ઘ્યાલ જ નથી કરતાં કે તેમની ખામીઓ, તેમની જલદ વૃત્તિઓ, નિર્ભળતાઓ, આત્મ-સંયમનો અભાવ બાળકો ઉપર કેવી તો ભયંકર છાપ પડે છે. તમારા બાળકો તમને માન આપે એમ તમે ઈચ્છતા હો તો પ્રથમ તો તમે પોતે જ તમારી જાતનું માન કરતાં શીખો, અને હર પણે તમે પોતે એક માનયોજ્ય વ્યક્તિ બની રહો. તમે ધ્યાન રાખો કે તમારા વર્તનમાં કદી પણ તરંગીપણું ન આવે, અસંયમ ન આવે, તેમાં તુમાખી ન આવે, અધીરાઈ ન આવે, બદમિજાજ ન આવે. તમાનું બાળક તમને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તમારો જવાબ તે સમજી શકવાનું નથી એમ માનીને તમે તેને કોઈ અક્ષલ વગરનો કે મૂર્ખાઈભરેલો જવાબ ન આપશો. તમે જો બરાબર પ્રયત્ન કરશો તો તમારી વસ્તુ તમે હમેશાં બાળકને સમજાવી શકશો. લોક કહેવત ભલે એમ કહે કે સત્ય કહેવામાં હમેશાં લાભ નથી, પણ હું કહું છું કે સત્ય કહેવું એમાં જ હમેશાં લાભ છે. માત્ર તમારે તેને એવી રીતે કહેવાની કળા મેળવી લેવી જોઈએ કે જેથી તમારી વસ્તુ તમને સાંભળનારના મગજ સુધી પહોંચી શકે. નાની વયમાં, બારથી ચૌદ વર્ષ સુધી બાળકનું મન સૂક્ષ્મ રીતના સિદ્ધાંતો અને વ્યાપક સ્વરૂપના વિચારોને જીલી શકે તેવું નથી હોતું. પરંતુ તમે સ્પષ્ટ આકારવાળાં ચિત્રો, પ્રતીકો કે દૃષ્ટાંતોનો ઉપયોગ કરીને બાળકના મગજને એવી તાલીમ આપી શકો છો કે જેથી તે એ સૂક્ષ્મ અને વ્યાપક વિષયોને સમજતું થઈ શકે. બાળકોને માટે જ નહિ, પણ ઠીક ઠીક મોટી ઊમરના માણસોને પણ, તેમ જ કેટલાક લોકો કે જેમનું મન સદા બાળકની કક્ષાનું જ રહે છે તેવાઓને પણ એકાદ વારતા, કથા કે પ્રસંગ જો બરાબર રીતે કહેવામાં આવે તો તેથી તમને તાત્ત્વિક રીતનાં મોટાં મોટાં વ્યાખ્યાનો કરતાં પણ વિરોધ જ્ઞાન મળી શકે છે.

એક બીજી વસ્તુ સામે પણ ચેતતા રહેવાનું છે. બાળકોને કદી ઠપકો ન આપશો. અને ઠપકો આપવો પડે તો તે કોઈ ચોક્કસ હેતુસર જ અપાય, ઠપકો આપ્યા વિના ન જ ચાલે તેમ હોય ત્યારે જ તે અપાય. વારે વારે ઠપકો મળતાં બાળક ઠપકાથી ટેવાઈ જાય છે, પછી તમે તેને ગમે તે કહો, અવાજમાં ગમે તેટલી કઠોરતા લાવો પણ તેને તેનું કશું મહત્ત્વ જ રહેતું નથી. અને ભૂલ તમે પોતે કરી હોય અને તે માટે દોષ તમે બાળકનો કાઢો એવું તો કદી પણ ન થવા દેશો. બાળકોની અવલોકનશક્તિ બહુ તીક્ષ્ણ હોય છે, તે બધું સ્પષ્ટ રીતે સમજી શકે છે. તમારી નબળાઈઓ તેઓ તરત જ પકડી પડે છે અને તદ્દન નિર્દ્યપણે તેની નોંધ કરે છે.

બાળક કોઈ ભૂલ કરી બેસે ત્યારે તેની કભૂલત તે આપમેળે અને નિખાલસ ભાવે કરે એમ થવા દેખો. અને તે પોતાની ભૂલ કભૂલ કરે ત્યારે તેને પ્રેમપૂર્વક અને

માયાળુપણે સમજાવજો કે તેના કાર્યમાં ક્યાં ભૂલ હતી અને તે તોણે ફરીથી ન થવા દેવી જોઈએ. પણ કોઈ પણ પરિસ્થિતિમાં તેને દપકો તો ન જ આપશો, જે ભૂલ કબૂલ કરી લેવાઈ હોય તેની તો માફી જ અપાવી જોઈએ. તમારી અને તમારા બાળક વચ્ચે ભયનું તત્ત્વ દાખલ થઈ જાય એમ તો કદ્દી ન થવા દેશો. બીકના પાયા પર કેળવણીનું મંડાણ કરવું એ તો મહા જોખમનો માર્ગ છે. બીકમાંથી બાળક હમેશાં અસત્યનો અને દંભનો આશ્રય લેવા લાગે છે. બાળક પ્રત્યે તમારો પ્રેમ એવો હોય કે તેમાં સ્પષ્ટ દૃષ્ટિ રહેલી હોય, તે દૃઢ હોય અને છતાં કોમળ હોય. તમારામાં આ પ્રેમ અને પૂરતું વ્યવહારુ જ્ઞાન હશે તો તમારી અને બાળકની વચ્ચે એક વિશ્વાસની ગાંઠ બંધાશે. એવા વિશ્વાસ વિના તમે તમારા બાળકને સફળ રીતે કેળવી નહિ શકો. તમારી અને બાળકની વચ્ચે આ વિશ્વાસ હોવો અનિવાર્ય છે અને પેલી વસ્તુ કદી ભૂલશો નહિ કે તમારે સદાયે અને સતત તમારી જાતને વટાલી ઊંચે ને ઊંચે ચડવાનું છે. બાળકને આ જગતમાં જન્મ આપીને તમે તેના તરફ એક ફરજ નોતરી લીધેલી છે. એ ફરજ તમારે સાચી રીતે અદા કરવાની છે. તમારું આ કાર્ય તમારે ઉત્તમોત્તમ રીતે પાર પાડવાનું છે અને તેનો એક જ માર્ગ છે : તમે પોતે વધુ ને વધુ ઉન્નત બનો.

(બુલેટિન, ફેબ્રુઆરી ૧૯૫૧)

\*

## શારીરિક કેળવણી

માનવની ચેતનાના સર્વ પ્રદેશોમાં એક શરીરનો પ્રદેશ જ એવો છે કે જેમાં પદ્ધતિ, વ્યવસ્થા, શિસ્ત અને નિયમનું શાસન સંપૂર્ણપણે ચાલી શકે છે. જડતત્ત્વમાં ગ્રાહકતા અને મુલાયમતા નથી અને એ અભાવને પૂરવા માટે તમારે ખૂબ જ ચોક્કસ અને સર્વગ્રાહી રીતે વિગતોનું બરાબર સંગઠન કરવાનું રહે છે. પરંતુ આવું સંગઠન કરતી વેળા આપણે એ ભૂલવાનું નથી કે માનવ ચેતનાના સર્વ પ્રદેશો એકબીજાને આધારે ટકેલા છે અને તેઓ એકબીજાની અંદર ઓતપોત થયેલા હોય છે. અને છતાં મન યા તો પ્રાણની કોઈ પ્રેરણાને જો શરીર દ્વારા વ્યક્ત કરવી હશે તો તેને એક ચોક્કસ અને નિશ્ચિત રૂપની પદ્ધતિને માર્ગ જ વાળવી પડશે. અને તેથી શરીરની કેળવણીને સફળ બનાવવા માટે સારીયે શારીરિક કેળવણીને ખૂબ જ તનતોડ અને કડક કરવી પડશે, તેની બધી વિગતો નક્કી કરવી પડશે, તે વિષે બધો વિચાર આગામથી કરવો પડશે, અને તેને પદ્ધતિપૂર્વક હાથ ધરવી પડશે. આવી કેળવણી પછી વ્યક્તિને માટે એક કાયમની ટેવ રૂપે બની રહેશે. અને શરીર તો ટેવોનું જ બનેલું છે. પણ આ ટેવો બરાબર કાબૂ હેઠળની, શિસ્તબદ્ધ હોવી જોઈશે, અને છતાં સાથે સાથે તે એવી મુલાયમ પણ હોવી જોઈશે કે તે દરેક સંજોગોને અનુકૂળ થઈ શકે, વ્યક્તિના વિકાસ તથા વૃદ્ધિ માટે જે જે જરૂર ઊભી થાય તેને તે બરાબર સાનુકૂળ થઈ શકે.

શરીરની સર્વ કેળવણી જન્મ સાથે જ શરૂ થવી જોઈએ અને આખાયે જીવન દરમિયાન તે ચાલુ રહેવી જોઈએ. તમે એમ નહિ કહી શકો કે અમુક સમયથી વહેલાં શારીરિક કેળવણી ન આપી શકાય, યા તો અમુક વખત પછી તેને ચાલુ નહિ રાખી શકાય.

શરીરની કેળવણીનાં ત્રણ મુખ્ય પાસાં છે: (૧) શરીરની કિયાઓનો કાબૂ અને નિયમન, (૨) શરીરનાં સર્વ અંગો અને હુલનચલનનો એક સંપૂર્ણ, પદ્ધતિસર અને સુમેળભર્યો વિકાસ અને (૩) શરીરમાં કોઈ ખામીઓ કે વિકૃતિઓ હોય તેનો ઈલાજ.

એમ કહી શકાય કે બાળકના જન્મ પછી પહેલા દિવસથી જ, કહો કે પહેલા કલાકથી જ તેને માટે ઉપર જણાવેલી પ્રથમ પ્રકારની કેળવણી શરૂ કરી દેવી જોઈએ. એટલે કે બાળકનો ખોરાક, ઊંઘ, દસ્ત વગેરે તરફ બરાબર ધ્યાન આપાવું જોઈએ. આ બાબતોમાં બાળકને જો જન્મ સમયથી જ સારી ટેવો પાડવામાં આવે તો પછી આખાયે જીવન દરમિયાન તે ઘણી એક મુસીબતો અને અગવડોમાંથી બચી જશે, અને જે લોકોને બાળકનાં શરૂઆતનાં વર્ષોમાં તેની સંભાળ લેવાની હોય છે

તેમનું કામ પણ ઘણું હૃળવું બની જશે.

આપણે એ વાત તો જાણીએ છીએ જ કે આ કેળવણીને જો બુદ્ધિપૂર્વકની સમજણાભરી અને અસરકારક બનાવવી હશે તો તે માટે આપણી પાસે શરીર વિષે, શરીરની રચના અને તેની કિયાઓ વિષે અમુક ઓછામાં ઓછું જ્ઞાન તો હોવું જોઈશે જ. બાળક મોટું થતું જાય તેમ તેમ તેના પોતાના શરીરનાં અંગો કેવી રીતે કામ કરે છે તેનું અવલોકન કરવાની ટેવ પડવી જોઈએ. એમ કરવાથી તે કિયાઓ ઉપર તેને વધુ ને વધુ કાબૂ આવશે અને તે કિયાઓ કુદરતી રીતે અને સુમેળપૂર્વક થતી રહે તે બાબત તે ધ્યાન આપવા લાગશે. શરીરની વિધવિધ સ્થિતિઓ, બેસવા ઊભવાની પદ્ધતિઓ અને વિવિધ હિલચાલો અંગો બહુ જ વહેલી ઉમરે અને બહુ જ ઝડપથી ખોટી ટેવો પડી જાય છે અને તેનાં ભયંકર પરિણામો માણસે આખીયે જિન્દગી પર્યત ભોગવવાનાં રહે છે. આ કેળવણીનો પ્રશ્ન ગંભીર રીતે હાથ લઈ જે માબાપો પોતાનાં બાળકોનો વિકાસ સ્વાભાવિક રીતે બને તે માટે તેમને શક્ય તેટલી બધી જ સગવડો આપવા ઈચ્છતાં હશે તેમને માટે આ અંગેનાં જરૂરી સલાહસૂચનો સહેલાઈથી મળી શકશે. આ વિષયનો આજે વધુ ને વધુ કાળજીપૂર્વક અભ્યાસ થઈ રહ્યો છે અને એ અંગેની જરૂરી માહિતી અને દિશાદર્શન આપે તેવાં અનેક પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે અને નવાં નવાં પ્રસિદ્ધ થઈ રહ્યાં છે.

આ વિષયનો અમલ કરવાની વિગતોમાં હું ઊતરી શકું તેમ નથી. દરેક પ્રશ્ન નિરનિરાળો હોય છે અને તે માટેનો ઉકેલ પણ તે દરેક પ્રસંગને ધ્યાનમાં રાખીને વિચારવાનો હોય છે. ખોરાકનો વિષય ખૂબ વિસ્તારથી અને કાળજીપૂર્વક ખેડાયેલો છે. કયો આહાર બાળકના વિકાસમાં મદદ રૂપ થઈ શકે તે વસ્તુ સામાન્ય રીતે સર્વને જાણોતા જેવી છે અને તેનો ઉપયોગ લાભદાયક રીતે કરી શકાય છે. આ વિષયમાં એક વાત ખૂબ જ યાદ રાખવા જેવી છે. શરીરની પોતાની એક સહજવૃત્તિ છે. તે બરાબર અકબંધ રહે છે ત્યાં સુધી તેનામાં એક એવું જ્ઞાન રહેલું છે કે જે આ બધા સિદ્ધાંતો કરતાં પણ વિશેષ હોય છે. આ રીતે જોતાં, તમારા બાળકનો વિકાસ સ્વાભાવિક રીતે જ થાય એમ તમે ઈચ્છતા હો તો તમારે બાળકને જે ખોરાક તરફ આશગમો હોય તે ખાવા માટે તેના ઉપર કદી બળજબરી ન કરવી જોઈએ. કરણ કે શરીરને પોતાને કર્ય વસ્તુ હાનિકારક છે તે વાત તે ઘણી વાર આપોઆપ જ સહજવૃત્તિથી જાણી જતું હોય છે. બાળક જો કોઈ ખાસ રીતે ધૂની હોય તો વાત જુદી છે.

શરીર એની સ્વાભાવિક સ્થિતિમાં હોય છે ત્યારે, પોતાને માટે કઈ વસ્તુ સારી છે તેમ જ જરૂરની છે તે બહુ જ સારી રીતે જાણતું હોય છે. આ સ્વાભાવિક સ્થિતિ એટલો કે મનના ખ્યાલોની અને પ્રાણના આવેગોની દખલગીરીમાંથી મુક્ત એવું શરીર.

પરંતુ શરીરની આવી સ્વાભાવિક સ્થિતિ તો ત્યારે જ જળવાઈ શકે છે કે જ્યારે બાળકને દૃષ્ટાઓ અને જરૂરિયાતો વચ્ચેનો ભેદ બહુ કાળજીપૂર્વક શીખવવામાં આવ્યો હોય અને તોણે તે બરાબર શીખી લીધો હોય. બાળકની શુચિ આપણે એવી રીતે કેળવવી જોઈએ કે તેને સાદો અને તંદુરસ્ત ખોરાક જ ગમે, એ ખોરાક પુષ્ટિદાયક હોય અને રોચક પણ હોય અને તેમાં નકારી વસ્તુઓ ભરેલી ન હોય. બાળકના પેટમાં ભાર કરે, અને માત્ર પેટ ભરવાને ખાતર જ કામ આવતી હોય તેવી ચીજો બાળકના રોજના ખોરાકમાં ન આપવી જોઈએ. બાળક ભૂખ પ્રમાણે જ ખાય, ન ઓછું ન વધારે, તેમ જ તે ખાઉધું બનીને ન ખાય, ખાવાની લાલસાને ખાતર જ ન ખાય એ વાત બાળકને ખાસ શીખવવી જોઈએ. ડેઢ બચપણથી જ આપણે એ જાણી લેવાનું છે કે આપણે ખાઈએ છીએ તે શરીરના આરોગ્ય અને શક્તિને માટે જ ખાઈએ છીએ, જીબના સ્વાદની ખાતર ખાતા નથી. પણ બાળકને જે ખોરાક આપવામાં આવે તે તેની પ્રકૃતિને અનુકૂળ હોય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. વળી એ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતાની બાબતમાં ફૂર્ઝપૂરી સાવચેતી લઈને તૈયાર થવો જોઈએ, એ ખાવામાં આનંદ આપે તેવો હોય અને છતાં ઘણો જ સાદો હોય. આ ખોરાક બાળકની વય અને તેની હમેશણી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી તે મુજબ તેની પસંદગી કરવી જોઈએ, અને તેનું માપ બાંધવું જોઈએ. શરીરના સર્વ અવયવોના વિકાસ અને પ્રમાણસરની વૃદ્ધિ માટે જરૂરનાં હોય તેવાં બધાં જ રાસાયનિક અને બીજાં સહિય તત્ત્વો આ ખોરાકમાં આવી જવાં જોઈએ.

આમ બાળકનું આરોગ્ય બરાબર જળવાય અને તેને જરૂરની બધી શક્તિ મળતી રહે એટલા માટે જ આપણે બાળકને ખોરાક આપીશું. પણ પછી આપણે એક બાબતમાં ખૂબ જ સાવધ રહેવું પડશે, અને તે એ કે ખોરાકને આપણે સજાનું કે દબાણનું હુઠિયાર નહિ બનાવી શકીશું. ‘જો, આજે તો તો બહુ જ તોફાન કર્યું. જા, તને નાસ્તો નહિ આપવામાં આવે.’ આ પ્રમાણે બાળકને કહેવાની ટેવ ખૂબ જ ભયંકર છે. આ રીતે તમે બાળકની નાનકડી ચેતના ઉપર એ છાપ પાડો છો કે તમે એને ખોરાક, તેની ખાવાની લાલસા તૃપ્ત કરવા માટે જ મુખ્યત્વે આપો છો. એ ખોરાક તેના શરીરને સારી રીતે કામ કરતું રાખવા માટે અનિવાર્ય છે એ વાત તેના ધ્યાનમાં તમે આવવા દેતા નથી.

બાળકને આપણે એક બીજી વસ્તુ પણ ડેઢ બચપણથી શીખવવાની છે: એ છે સ્વચ્છતા માટેની, આરોગ્યભરી ટેવો માટેની ચાનક. પરંતુ આરોગ્યના નિયમો પ્રત્યે, સ્વચ્છતા પ્રત્યે આ રસ જગાડવા જતાં બાળકમાં માંદગીનો ડર તમે દાખલ ન કરી દો તે બાબત ખૂબ જ સાવધાન રહેવાનું છે. કેળવણી માટે ભયને પ્રેરક તત્ત્વ બનાવવું એ ખરાબમાં ખરાબ વસ્તુ છે. કોઈ વસ્તુથી ડરવું તે એ વસ્તુને આપણી તરફ બેંચવાનો

સારામાં સારો માર્ગ છે. પણ એક બાજુ તમે માંદગીથી ડરો નહિ, તો બીજુ બાજુ માંદગી માટે તમને ભાવ પણ ન હોવો જોઈએ. એવી એક માન્યતા પ્રચલિત છે કે તેજસ્વી બુદ્ધિના માણસોનું શરીર નબળું જ હોય છે. પણ આ એક ખોટો ભ્રમ છે, કશા પાયા વિનાનો. એક જમાનો એવો હતો ખરો કે જ્યારે લોકોને શરીરની માંદગી તરફ એક મુખ્ય પણ દુર્બળ રીતનું ખાસ આકર્ષણ રહેતું હતું. સારા નસીબે એ વલાણ હવે ચાલ્યું ગયું છે. આજે હવે એક સુગાંઠિત, નક્કર, સ્નાયુબદ્ધ, બળવાન અને પૂર્ણ સપ્રમાણ શરીરની ખરી કિંમત લોકોને બરાબર સમજાવા લાગી છે. એટલે હવે આપણે બાળકને તંદુરસ્તી પ્રાયે માન ધરાવતાં શીખવવાનું છે. તે કોઈ એવો તંદુરસ્ત માણસ જુઓ કે જેનું શરીર રોગના હુમલાને ફેંકી દેવાનું જાણતું હોય તો તેના તરફ તેને અહોભાવ થવો જોઈએ. વળી અમુક અમુક વખતે બાળક માંદગીનો ઢોંગ પણ કરે છે. કોઈ આણગમતી ફરજમાંથી છટકી જવું હોય, પોતાને રસ ન પડતો હોય તેવું કામ ન કરવું હોય ત્યારે, અથવા કંઈ નહિ તો માત્ર માબાપની લાગણી ઉશ્કેરવા યા તો પોતાની કોઈ ધૂન તેમની પાસેથી મેળવવા માટે પણ બાળક માંદું હોવાનો ઢોંગ કરે છે. આ બાબતમાં તો બાળકને પહેલી તક એ વાત બતાવી દેવી જોઈએ કે તેની આ ચાલાકી લેશ પણ કામ આવે તેમ નથી. બાળક માંદું પડશે એટલે માબાપને તેના તરફ વધુ ભાવ થશે એ વાત તેના મનમાં કદી ઊગવા ન દેવી જોઈએ. આથી ઊલટી જ વાત તેના મનમાં ઈસાવવાની છે. નિર્બળ માણસોમાં એક એવી માન્યતા હોય છે કે તેમની નિર્બળતાને લીધે લોકોને તેમના તરફ એક ખાસ ભાવ થાય છે અને એવા લોકો પછી પોતાની તરફ આસપાસના માણસોનું તેમ જ જેમની સાથે પોતે રહેતા હોય તેમનું ધ્યાન આકર્ષવા માટે પોતાની અશક્તિને, અને જરૂર પડે તો પોતાની માંદગીને પણ એક સાધન તરીકે વાપરે છે. આ દુષ્ટ વલાણને તો કોઈ પણ રીતે ટેકો આપી ન શકાય. બાળકને એ વાત બરાબર શીખવી દેવી જોઈએ કે માંદા પડવું એમાં કોઈ ખાસ લાયકાત રહેલી છે યા તો કોઈ આપખોગ સમાયેલો છે એવું લેશ પણ નથી. માંદગી એ તો એક નિષ્ફળતાનું અને હલકી દશાનું જ ચિહ્ન છે.

બાળક પોતાનું આરોગ્ય જાળવી શકે તે માટે તે પોતાના અવયવોનો ઉપયોગ કરી શકે તેટલી ઉમરનું થાય કે તરત જ તે રોજ થોડો થોડો વખત આપીને પોતાના શરીરનાં બધાં અંગોને પદ્ધતિસર અને નૈસર્જિક રીતે ખીલવવા માટે તો તે બહુ જ સારું થશે. આ માટે રોજ વીસથી ત્રીસ મિનિટ જેટલો વખત, અને બનતાં સુધી પથારીમાંથી ઊઠચા પછી તરત જ જો આવો વ્યાયામ કરવામાં આવે તો તેથી બાળકના સ્નાયુઓ બરાબર કામ કરતા થઈ જશે, અને તેમનો વિકાસ સપ્રમાણ રીતે થશે. આવી કસરત સાંધાઓ તેમ જ કરોડને અક્કડ થઈ જતાં પણ અટકાવશે. અને આ બીમારી એવી છે

કે જે ધાર્યા કરતાં પણ ધારી વહેલી આવી જાય છે. બાળકની કેળવણીના કાર્યક્રમમાં ખેલકૂદ અને મેદાની રમતોને પણ સારું એવું સ્થાન આપવું જરૂરી છે. જગતની તમામ દવાઓ કરતાં પણ આ રમતગમતો બાળકને વધારે સારું આરોગ્ય આપશે. પૌષ્ટિક દવાઓના ટગલે ટગલા લેવાથી પણ અશક્તિ કે એનીમિયા (અલ્પરક્ત) જેવી બીમારીમાં જે ફાયદો થતો નથી તે માત્ર સૂર્યના તડકામાં એક કલાક હરવા — ફરવાથી થઈ શકે છે. એટલે દવા લેવાનું બિલકુલ અનિવાર્ય ન બને તે સિવાય કદી જ દવાનો આશ્રય લેવો ન જોઈએ એ મારી સલાહ છે. અને આ ‘બિલકુલ અનિવાર્ય’ તે બરાબર બિલકુલ અનિવાર્ય જ સમજવું જોઈએ. શારીરિક વિકાસના આ કાર્યક્રમમાં માનવ-શરીરનો ઉત્તમ વિકાસ સાધવા માટેની કેટલીક જાણીતી સર્વસામાન્ય પદ્ધતિઓ તો છે જ. પરંતુ એ પદ્ધતિઓનો પૂરેપૂરો લાભ ઉઠાવવા માટે હુરેક વ્યક્તિનો પ્રશ્ન અલગ અલગ રીતે વિચારવાનો રહે છે, અને શક્ય હોય ત્યાં તે બાબતમાં કોઈ જાણકાર માણસની મદદ લેવી હુએ છે. એમ ન બને ત્યાં આ વિષયને લગતાં પ્રસિદ્ધ થયેલાં તેમ જ થઈ રહેલાં પુસ્તકોનો આધાર તો લઈ શકાય છે જ.

બાળકની પ્રવૃત્તિ ભલે ગમે તે રીતની હોય, પણ હુરેક સંજોગોમાં તેને ઊંઘ માટે પૂરતો વખત તો આપવો જ જોઈએ. આ ઊંઘનો સમય બાળકની ઊંમરના પ્રમાણશરીરમાં વતોઓછો હોઈ શકે છે. બાળક હજ ઘોડિયામાં હોય ત્યારે તેની ઊંઘનો વખત તે જાગે તે કરતાં વધુ હોવો જોઈએ. બાળક મોટું થતું જશે તેમ તેમ તેની ઊંઘનો સમય ઓછો થતો જશે. પણ બાળક પુખ્ત ઊંમરનું ન થાય ત્યાં સુધી તેને આઈ કલાકથી ઓછી ઊંઘ તો ન જ મળવી જોઈએ. અને તેના સૂવાની જગ્યા પણ શાંત અને સારા હવાઉઝાશવાળી હોય. વળી કોઈ ખાસ કારણ સિવાય બાળકની આગલી રાતની ઊંઘ પર સહેજ પણ કાપ ન મૂકવો જોઈએ. શરીરને સારામાં સારો આરામ તો મધ્યરાત્રિ પહેલાંના વખતમાં જ મળે છે. વળી આપણે જાગતા હોઈએ તે વખતે પણ આપણે આરામની સ્થિતિમાં રહીએ એ બહુ જ ફાયદાકારક છે. આપણા જ્ઞાનતંતુઓને સમતોલ અને સુભેણમાં રાખવા માટે આ આરામ સ્થિતિ અનિવાર્ય છે. શરીરના સ્નાયુઓ અને તંતુઓને કેવી રીતે આરામની સ્થિતિમાં મૂકવા એ પણ એક કળા છે અને બાળકોને તે છેક નાનપણાથી જ શીખવી દેવા જેવી છે. પણ કેટલાયે માબાપો એવાં હોય છે જે બાળકને આથી ઊંઘટું કોઈ ને કોઈ પ્રવૃત્તિમાં બળજબરીથી પરોવેલું રાખે છે. બાળક શાંતિથી બેદું હોય છે ત્યારે આ માબાપો એમ કલ્પી લે છે કે એ માંદું પડ્યું છે. એવાં માબાપો પણ હોય છે કે જે બાળકને તેના આરામ અને વિશ્રાંતિને ભોગે પણ ઘરકમભાં લગાડે છે. આ તો એક ધારી જ ખરાખ ટેવ કહેવાય. બાળકનું શરીર તો હજ એક ઊરી રહેલો છોડ છે. તેના ઉપર તેણે પોતે

ખુશીથી પસંદ ન કરી હોય એવી કોઈ પ્રવૃત્તિ લાદવી, તેનું શરીર સહન ન કરી શકે તેવી લાંબી એકધારી મહેનત તેની પાસે કરાવવી એ તેના નાજુક શરીર માટે ઘણું જ હાનિકારક છે, આપણે ત્યાં એક સામાન્ય માન્યતા એ છે કે બાળકે માબાપની સેવા કરવી જોઈએ. પણ આ બાબતમાં જે કોઈ વિચારો કે પૂર્વગ્રહો અત્યારે બંધાયેલા છે તે તમામની સામે થઈને પણ હું કહેવા માગું છું કે બાળકની પાસે સેવા કરવાની માગણી કરવી એ તદન ગેરવાજબી છે. ખરું સત્ય તો આથી ઊલટું જ છે. બાળકોએ નહિ, પણ માબાપોએ બાળકોની સેવા કરવાની છે, કંઈ નહિ તો તેમની ખૂબ સંભાળ તો લેવાની છે જ. બાળક જો રાજુખુશીથી કુટુંબ માટે કંઈ કામ કરવું પસંદ કરે અને એ કામ તે રમતની પેઠ કરે તો જ તેની પાસેથી કંઈ કામ લઈ શકાય. અને એવે વખતે પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે બાળકના આરોગ્ય માટે જેટલો વખત આરામ કરવો જરૂરી હોય તેમાં તો કશો જ ઘટાડો ન થાય.

હું ઉપર કહી ગઈ કે બાળકોને છેક નાનપણથી જ શરીરના આરોગ્ય તરફ, શરીરની શક્તિ અને સમતુલ્ય તરફ આદર કેળવતાં આપણે શીખવવાનું છે આની સાથે સાથે જીવનમાં સૌન્દર્યનું જે પરમ મહત્વ છે તે વસ્તુ પણ બાળકના મન ઉપર બરાબર ઠસાવવાની છે. નાના બાળકમાં સૌન્દર્ય પ્રત્યે પણ અભીષ્ટા જાગવી જોઈએ. બીજાઓને ખુશ કરવા ખાતર નહિ તેમ જ પોતે પ્રભ્યાત થવાને ખાતર નહિ, પણ સૌન્દર્યના પ્રેમ ખાતર જ બાળકે સુંદર થવાનું છે. માણસના શારીરિક જીવન માટે જો કોઈ આદર્શ હોય તો તે સૌન્દર્યનો આદર્શ જ છે. હુરેક માણસ પોતાનું શરીર કાંઈ પણ કિયા કરતું હોય ત્યારે શરીરના જુદા જુદા ભાગોની વચ્ચે અને તેમની જુદી જુદી કિયાઓની વચ્ચે સુમેળની સ્થાપના લાવી શકે છે. હુરેક માનવ શરીર, તેને જો જીવનના આરંભથી જ એક સમજપૂર્વકની પદ્ધતિ અનુસાર શારીરિક વિકાસની તાલીમ મળી હશે તો તે પોતાની અંદર સંવાદનું તત્ત્વ સિદ્ધ કરી શકશે અને એ રીતે સૌન્દર્યની અભિવ્યક્તિ કરવા માટેની પાત્રતા તે મેળવી શકશે. આ સૌન્દર્ય તત્ત્વને જો જગતમાં એક દિવસ પ્રગટ કરવું હશે તો તે માટે કઈ આંતરિક શરતો પૂર્ણ કરવી જરૂરની છે એ બાબત પણ આપણે જાણવાની છે. આપણે જ્યારે એક સર્વાંગી કેળવણીનાં બીજાં સ્વરૂપોનો વિચાર હુથ લઈશું ત્યારે આ અંગે વિચાર કરીશું.

અત્યાર સુધી મેં માત્ર બાળકોને આપવાની કેળવણીનો જ વિચાર કર્યો છે. કારણ કે, બાળકને જો યોગ્ય સમયે એક સમજપૂર્વકની શારીરિક તાલીમ આપવામાં આવે તો તેથી શરીરની ઘણીખરી ખામીઓ અને વિકૃતિઓને અટકાવી શકાય છે. પરંતુ આવી કેળવણી કોઈ કારણસર માણસને નાનપણમાં અને જુવાનીમાં પણ જો ન મળી હોય તો પણ ગમે તે ઉંમરે આ કેળવણીનો આરંભ કરી શકાય છે અને

તેને જીવન પર્યત ચાલુ રાખી શકાય છે. પણ આ કેળવણી જેટલી મોડી શકૂ થશે, તેટલા પ્રમાણમાં માણસે પોતાને પડી ચૂકેલી ખરાબ ટેવોને સુધારવા માટે, શરીરમાં આવેલી અક્કડતાને મુલાયમ કરવા માટે તેમ જ બીજી વિકૃતિઓને હટાવવા માટે વધારે તૈયારી રાખવી પડશે. આ તૈયારીનું કામ ખૂબ જ ધીરજ અને ખંત માગી લેશો; અને એવી લાંબી તૈયારીને અંતે જ શરીર અને તેની કિયાઓની અંદર સંવાદ સ્થાપિત કરવાનો રચનાત્મક કાર્યક્રમ આપણે હાથ ધરી શકીશું. પરંતુ આપણે જે સૌનંદર્ઘનો સાક્ષાત્કાર કરવાનો છે તેનો એક જીવંત આદર્શ જો તમારા અંતરમાં તમે ધારણ કરેલો હશો તો પછી તમારું એ લક્ષ્ય તમે એક હિવસ જરૂર પામી શકશો.

(બુલેટિન, એપ્રિલ ૧૯૫૧)

\*

## પ્રાણની કેળવણી

કેળવણીના સર્વ પ્રકારોમાં પ્રાણની કેળવણી કદાચ સૌથી વધુ મહત્વની કેળવણી છે અને સૌથી વધુ અનિવાર્ય છે. અને છતાં આ કેળવણી ભાયે જ હૃથ ધરવામાં આવે છે અને હૃથ ધર્યા પછી તેને સમજપૂર્વક અને પદ્ધતિપૂર્વક ભાયે જ પાર પાડવામાં આવે છે. આમ બનવાનાં ત્રણ કારણો છે: પ્રથમ તો આ કેળવણી સાથે કઈ કઈ વસ્તુઓ સંકળાયેલી છે તે બાબતમાં માનવની બુદ્ધિ પાસે કશું સ્પષ્ટ દર્શન નથી, અને બીજું આ સાહસ હૃથ લેવું એ ઘણું જ કઠણ કામ છે, અને તેમાં સફળ થવા માટે આપણામાં ખૂબ જ ધીરજ, અનંત ખંત અને અદ્ભુત એવા સંકલ્પબળની જરૂર રહે છે.

સાચે જ, માનવની પ્રકૃતિમાં આ પ્રાણ એક અત્યંત આપખુદ અને કસી કરીને કામ લેતું જુલમખોર તત્ત્વ છે. વળી એની અંદર બળ, શક્તિ, ઉત્સાહ અને અસરકારક ક્રિયાબળ રહેલાં છે અને તેને લીધે ઘણાખરા લોકો એનાથી ઉત્તા રહી તેને બહુ જ માનપૂર્વક જુઓ છે, અને તેને પ્રસાન રાખવાને હમેશાં પ્રયત્ન કરે છે, પરંતુ આ માલિક એવો છે કે જેને કોઈ પણ ચીજ સંતોષ આપી શકતી નથી, અને એ માલિકની માગણીઓને કશી હુદ જ નથી હોતી. આ અંગે પશ્ચિમમાં ખાસ બે વિચારો ખૂબ જ વ્યાપક બનેલા છે અને તેને લીધે તેની શિરજોરી ખૂબ જ બળવાન બનેલી છે. પશ્ચિમ આજે એક તો એમ માની રહેલું છે કે સુખ મેળવવું એ જ જીવનનું લક્ષ્ય છે, અને બીજું વ્યક્તિ એક એવી પ્રકૃતિ લઈને જન્મે છે કે જેને કદી બદલી શકતી નથી.

આમાંનો પહેલો વિચાર જગતના એક મહા ગણન સત્યને બહુ કઢંગી અને વિકૃત રૂપે રજૂ કરે છે. આ ગણન સત્ય એ છે કે આખુંયે વિશ્વ આત્માના આનંદ ઉપર મંડાયેલું છે. એ આનંદ ન હોત તો જીવન અસ્તિત્વમાં જ આવ્યું ન હોત. આ આનંદ એ પ્રભુનું પોતાનું જ એક તત્ત્વ છે અને તેથી તે કોઈ પણ પ્રકારની સીમાથી બદ્ધ નથી. પણ એ આનંદને જીવનમાં ચાલતી સુખની શોધ તરીકે ગણી લેવાની ભૂલ ન થવી જોઈએ. સુખ તો ઘણે ભાગે સંજોગો ઉપર આધાર રાખતી વસ્તુ છે. માણસ જ્યારે એમ ચોક્કસપણે માનવા લાગે છે કે મને સુખી થવાનો હુક છે ત્યારે તે સ્વાભાવિક રીતે જ ગમે તે ભોગે જીવનો રસ માણવાને તૈયાર થઈ જાય છે. આ પ્રકારના વલાગની અંદર પછી અજ્ઞાન અને તુમાખીથી ભરેલો એવો અહુંકાર દાખલ થાય છે, અને તેમાંથી માનવના જીવનમાં હરેક પ્રકારના સંઘર્ષો અને દુઃખો, છેતરપિંડીઓ અને નિરાશાઓ ઊભાં થાય છે અને એ બધાનું પરિણામ ઘણી વાર સર્વનાશમાં આવે છે.

અત્યારે જે રીતનું જગત છે તે જોતાં પોતાનું વ્યક્તિગત સુખ ગમે તે રીતે મેળવી લેવું એ કંઈ જીવનનું લક્ષ્ય હોઈ ન શકે. એ લક્ષ્ય તો એ જ હોઈ શકે કે વ્યક્તિ ક્રમે ક્રમે આગળ વધતી પરમ સત્ય ચેતના પ્રત્યે પહોંચે.

પ્રકૃતિના પરિવર્તનની અશક્યતા વિશેનો વિચાર ઉભો થવા પાછળ એક બીજી હુકીકત રહેલી છે. માણસના ચારિત્રયને ડેઠ મૂળમાંથી નવું સ્વરૂપ આપવા માટે તો વ્યક્તિમાંના અવયેતન તત્ત્વ ઉપર એક સંપૂર્ણ જેવો કાબૂ મેળવી લેવાનો રહે છે, તેમ જ પોતાની અંદર અચેતના પ્રદેશમાંથી જે જે વસ્તુઓ ઉપર ઊઠી આવતી હોય છે તેનું ખૂબ જ કડક નિયંત્રણ કરવાનું રહે છે. આ અવયેતના અને અચેતનાનું તત્ત્વ, સામાન્ય માણસોમાં તો પ્રકૃતિમાં પહેલેથી પડેલાં તત્ત્વોનું જ પ્રાક્ટચ હોય છે, અને તેણે જે પરિસ્થિતિમાં જન્મ લીધો હોય છે તેને આધારે જ તે ઘઢાયેલું હોય છે. આવી પ્રકૃતિનું રૂપાંતર હાથ ધરવું એ એક મહા વિરાટ કાર્ય છે અને માણસની ચેતનામાં કોઈ લગભગ અસાધારણ જેવો વિકાસ થાપ તેમ જ પ્રભુની કૃપા તેને સતત મદદ કરતી રહે તો જ એ કાર્ય સિદ્ધ બને તેમ છે. વળી એક બીજી વસ્તુ એ પણ છે કે આ કામ હાથ ધરવાનો પ્રયત્ન પણ જવલ્લે જ થયેલો છે. અનેક પ્રાચ્યાત તત્ત્વદ્રાયાઓએ તો એમ જ જાહેર કરી દીધું છે કે આ વસ્તુ કદ્દી સિદ્ધ થવાની નથી, એ એક ખાલી સ્વખ જ છે. અને છતાં આ વસ્તુ સિદ્ધ ન જ થઈ શકે તેમ નથી. એ પરિવર્તન પણ સિદ્ધ થયેલું છે. માણસોએ એક ચોખ્ખી સમજપૂર્વકની સાધના પદ્ધતિ ઉપજાવી તે મારફતે એ પ્રશ્ન હાથ ધરેલો છે. અને બેશક, તેમને સતત નિષ્ફળતાઓ મળતી રહેલી છે છતાં તેથી નિરૂત્સાહિત ન થતાં, એ નિષ્ફળતાઓની સામે તેવી જ દૃક્તાભરી ખંતપૂર્વક તેઓ ઝૂઝતા રહ્યા છે, અને ચારિત્રયનું રૂપાંતર તેમણે સિદ્ધ કરેલું છે.

પ્રાણી તાલીમનો આરંભ પોતાના અવલોકનથી શરૂ કરવાનો છે. જે ચારિત્રયનું આપણે રૂપાંતર કરવા માગીએ છીએ તેનું આપણે વિગતવાર અને સંપૂર્ણ અવલોકન કરવાનું રહે છે. એ રીતે જ આ તાલીમની શરૂઆત કરવાની છે. ઘણાખરાને તો આ વસ્તુ કરવી ઘણી જ કઠીન અને મૂળજવી નાખે તેવી હોય છે. પરંતુ આપણી પ્રાચીન સાધનાઓ પણ એક જ્ઞાન હતું. અને એ જ્ઞાનનો આધાર લઈ આપણે આ અંતર પ્રદેશની ભુલભુલામણીની શોધખોળ આદરી શકીએ છીએ. આ પ્રાચીન સાધનાઓએ બતાવ્યું છે કે હુરેક માણસના ચારિત્રયની અંદર બે ઊલયસૂલટા તત્ત્વો આવી રહેલાં છે, અને એક જ વસ્તુની ઊજળી અને છાયાવાળી બાજુઓની માફક તે સરખા પ્રમાણમાં જ હોય છે. દેરેક સામાન્ય વ્યક્તિમાં આ વિરોધી તત્ત્વો ઠીક ઠીક પ્રમાણમાં હોય છે જ, અને અસાધારણ વ્યક્તિઓની અંદર તો તે વિરોધી તત્ત્વો

વધુ ચોક્કસ રૂપે આવેલાં હોય છે. આ રીતે જે માણસમાં અસાધારણ ઉદારતાની શક્તિ હોય છે તે એકાએક પોતાની અંદર કોઈ મહા પ્રબળ લોભવૃત્તિનો ઘસરો અનુભવી રહે છે. અત્યંત હિંમતવાળો માણસ જુએ છે કે પોતાની અંદર ક્યાંક એક કાયર છુપાઈને બેઠેલો છે. અને ભલા અને સારા માણસોને પણ દેખાય છે કે પોતામાં પણ દુષ્ટ વૃત્તિઓ આવી રહેલી છે. જીવને જાણે કે હુરેક વ્યક્તિને પોતામાં એક આદર્શ તત્ત્વને પ્રગટ કરવાની શક્તિ આપેલી દેખાય છે, અને સાથે સાથે તેથી ઊલટાં તત્ત્વો પણ તેનામાં મૂકી આપેલાં દેખાય છે. આમ આ ઊલટાસૂલટા તત્ત્વોનું જ્ઞાન થતાં માણસે પોતે કઈ રીતનો સંગ્રામ ખેડવાનો છે, કઈ વસ્તુઓ ઉપર વિજય મેળવવાનો છે, એ વાત તેની સમક્ષ સ્પષ્ટ થઈ જાય છે. અને આ તત્ત્વોના વિજય ઉપર જ સાક્ષાત્કારનો આધાર રહે છે. આ રીતે જોતાં, સારુંયે જીવન એક કેળવણી રૂપે બની રહે છે. માનવની આ કેળવણી વધુઓછી સજ્ઞાનપણે તેમ જ સવિચાર ચાલી રહેલી હોય છે. આ કેળવણી અમુક માણસોના જીવનમાં પ્રકાશને પ્રગટ કરે તેવી રીતની કિયાઓને ટેકો પૂરો પાડે છે, તો અમુકના જીવનમાં તેથી ઊલટું પરિણામ પણ આવે છે, તેમના જીવનમાં અંધકારનાં તત્ત્વોનો પ્રાદુર્ભાવ વિશેષ થાય છે. માણસની પરિસ્થિતિ અને સંયોગો જો સાનુકૂળ હોય છે તો તેમના જીવનમાં અંધકારને જીતીને પ્રકાશ વૃદ્ધિ પામતો જાય છે, અથવા તો પ્રકાશને હૃતાવી દઈ અંધકાર પ્રબળ બને છે. આમ માણસના જીવનની ભૌતિક પરિસ્થિતિ અને તેનું ગ્રાણતત્વ જે રીતનો ઘાટ તેને માટે નિર્માણ કરશે તે મુજબ તેના ચારિત્યનો આકાર રચાશે. આ પ્રકારના માનવજીવનમાં રહેલી આ અસહાયતા એક જ રીતે ટળી શકે તેમ છે. માનવના જીવનમાં જો કોઈ ઊર્ધ્વનું પ્રકાશમય તત્ત્વ નીચે ઊતરી આવે, તેનામાં જો કોઈ સજ્ઞાન સંકલ્પશક્તિનો પ્રવેશ થાય, અને તે વસ્તુઓ આવીને કુદરતને તેની તરંગી કાર્ય પદ્ધતિને માર્ગ જતાં અટકાવી દઈ તેને સ્થાને એક તર્કબદ્ધ અને સ્પષ્ટ દર્શનવાળી સાધના જો સ્થાપી આપે તો પછી માનવ જીવનપ્રવાહ આમ અસહાય રીતે ગમે તેમ રજીતો નથી રહેતો. ઉપર જે સજ્ઞાન સંકલ્પશક્તિની વાત કરી તેને જ અમે કેળવણીની બુદ્ધિમય પદ્ધતિ કહીએ છીએ.

આ સ્થિતિમાં બાળકની ગ્રાણની કેળવણી વહેલામાં વહેલી શરૂ થઈ જાય એ ખૂબ જ મહત્ત્વનું છે. બાળક પોતાની ઈન્ડ્રિયોનો ઉપયોગ કરી શકે તે વયનું થાય કે તરત જ તેની આ કેળવણી શરૂ કરી દેવી જોઈએ. એમ થઈ શકશે તો બાળકને પડી જતી ઘણી ખરાબ ટેવોને સમયસર અટકાવી શકાશે, અને ઘણી એક હાનિકારક અસરોને નાખૂં કરી શકાશે.

પ્રાણની કેળવણીનાં મુખ્ય બે પાસાં છે. એ બંનેનું લક્ષ્ય અને તેમની ગ્રહિયા વરચે આમ તો જો કે બહુ જ ફરક છે. તોપણ એ બંને ગ્રાનારની કેળવણી એકસરખા મહત્ત્વની છે. પ્રાણની કેળવણીનું પહેલું પાસું છે ઈન્ડ્રિયોનો વિકાસ કરવો અને તેમનો પૂરો ઉપયોગ કરવો. બીજું પાસું છે વ્યક્તિએ પોતે સભાન બનવું, પોતાના ચારિત્ય ઉપર ધીરે ધીરે સંપૂર્ણ પ્રભુત્વ મેળવવું, અને છેવટે તેનું શૃપાંતર સાધવું.

ઇન્ડ્રિયોની કેળવણીને પણ વળી કેટલાંક પાસાં છે. બાળક મોટું થતું જાય તેમ તેમ એ પાસાં તેની કેળવણીમાં એક પછી એક ઉમેરતા રહેવાનું છે. ખરી વાત તો એ છે કે આ કેળવણીને કદી પણ અટકી જવા દેવાની નથી. અને એમ કરતાં કરતાં ઇન્ડ્રિયોની કિયાઓમાં એક એવી તો ચોક્કસતા અને શક્તિ આવે છે કે જે સામાન્ય રીતના જીવનમાં ભાંને જ જોવા મળતી હોય છે.

એક ગ્રાચીન ગુણ વિદ્યાએ તો એમ પણ કંધું છે કે માણસ પોતાની અંદર પાંચ નહિ પણ સાત ઇન્ડ્રિયોનો વિકાસ સાધી શકે છે અને અમુક ખાસ સંયોગોમાં તે બાર ઇન્ડ્રિયો પણ વિકસાવી શકે તેમ છે. અમુક જાતિઓએ, અમુક જમાનાઓમાં, આવી પૂરક ઇન્ડ્રિયોની જરૂર ઉભી થતાં એ ઇન્ડ્રિયોમાંની કોઈ ઇન્ડ્રિયનો થોડોઘણો સંપૂર્ણ વિકાસ પણ સાધ્યો હતો. આ પૂરક ઇન્ડ્રિયોનો વિકાસ કરવામાં અને તેમાંથી આવતાં પરિણામમાં જેમને સાચો રસ હશે તેઓ તે માટે જો ખંતપૂર્વક સાધના આદરશે તો તેમને એ ઇન્ડ્રિયો પણ જરૂર પ્રાપ્ત થઈ શકશે. આપણે આવી ઘણી અસાધારણ શક્તિઓની વાત ઘણીએક વાર સાંભળીએ છીએ. તેમાંની એક શક્તિ દા. ત., એ પ્રમાણેની છે કે જેનો વિકાસ થતાં તમે તમારી શારીરિક ચેતનાને વિશાળ કરી શકો છો, તમારી અંદરથી તેનો બહુાર પ્રક્ષેપ કરી શકો છો, તેને કોઈ ચોક્કસ બિંદુ ઉપર એકાગ્ર કરી શકો છો અને દૂર રદ્યાં રદ્યાં પણ તમે તે વસ્તુને જોઈ શકો છો, સાંભળી શકો છો, તેની ગંધ અને તેનો સ્વાદ લઈ શકો છો, અને તેનો સ્પર્શ પણ મેળવી શકો છો.

ઇન્ડ્રિયોની અને તેમની કિયાઓની આ એક સર્વસામાન્ય કેળવણી થઈ. એમાં હવે વિવેકશક્તિની અને રસદૃષ્ટિની કેળવણી ઉમેરવાની રહે છે, અને તે વહેલામાં વહેલી તકે. બાળકમાં આપણે એ રીતની શક્તિ વિકસાવવાની છે કે જેથી તે હુમેશાં સુંદર, સંવાદમય, સરલ, તંદુરસ્ત અને વિશુદ્ધ વસ્તુઓને જ પોતા માટે પસંદ કરે, એ ગ્રાનારની વસ્તુઓનો જ સ્વીકાર કરે. જેવી રીતે શરીરનું આરોગ્ય છે, તેવું જ મનનું પણ આરોગ્ય છે, શરીર અને તેના હુલન-ચલનમાં જે રીતે સૌન્દર્ય અને સંવાદિતતા છે તે મુજબ આપણાં આંતર સંવેદનોમાં પણ સૌન્દર્ય અને સંવાદિતતા રહેલાં છે. એટલે બાળકમાં જેમ જેમ શક્તિ અને સમજણ આવતી જાય તેમ તેમ

તેને કેળવણી મારફતે જે નવી શક્તિ અને ચોક્કસતા મળતી રહે છે તેમાં રસવૃત્તિ અને સુરુચિનાં તત્ત્વો પણ તે ઉમેરતું જાય તે તેને શીખવવાનું છે. કુદરતની સૂચિમાં યા તો માનવની સૂચિમાં રહેલી સુંદર અને ઉદાત, તંદુરસ્ત અને ઉમદા વસ્તુઓ આપણે બાળકને બતાવવી જોઈએ, અને એ સર્વનો તે રસ લે, એ સર્વ ઉપર તે પ્રેમ ધરાવે તે મુજબ તેને કેળવવું જોઈએ. આમ બાળકને આપણે એક સાચી રસાત્મકતાના સંસ્કાર આપીએ, અને બાળકમાં જન્મેલી એ રસાત્મક દૃષ્ટિ તેને હરેક પ્રકારની હુલકી અસરોમાંથી બચાવી લેશે. આજે જગત જે યુદ્ધોમાંથી પસાર થયું છે તેને લીધે લોકોના જ્ઞાનતંત્રોમાં એક ભયંકર પ્રકારની તંગાશ આવી ગઈ છે. એના પરિણામ રૂપે વ્યક્તિના તેમ જ આખાયે માનવસમાજના જીવનની અંદર એક બીભત્તસતાનું તત્ત્વ પ્રગટ થયેલું છે, અને તેણે વધી વધીને આખાયે જીવનનો કબજો લઈ લીધેલો દેખાય છે. અને આ વિકૃતિ ખાસ કરીને કલાના ક્ષેત્રમાં તેમ જ ઈન્દ્રિયોના જીવનમાં તો ખૂબ જ વધી પડેલી છે. આ બધું તે માનવ સંસ્કૃતિના અધઃપતનની જ એક કરુણ નિશાની છે, સમાજમાં ફેલાઈ રહેલા સરઢાનું ચિહ્ન છે. આ પરિસ્થિતિમાં બાળકની ઈન્દ્રિયોને જો એક વ્યવસ્થિત અને જ્ઞાનપૂર્વકની કેળવણી આપવામાં આવશે તો તેનામાં બીજા લોકોની સાથેના સંપર્કમાંથી જે કાંઈ અસંસ્કારી, પ્રાકૃત અને વિકૃત તત્ત્વો આવ્યાં હશે તે સર્વને ધીરે ધીરે નાબૂદ કરી શકશે. આ પ્રકારની રસાત્મકતાના સંસ્કારો બાળકના ચારિત્ય ઉપર પણ ઘણી સારી અસર ઉપજાવશે. જેનામાં એક વાર સાચી રીતની સંસ્કારિતાનો વિકાસ થાય છે તે પછી કદી પણ સંસ્કારહીન, બીભત્તસ કે અમાનુષ એવું વર્તન કરી શકતો નથી. તેનામાં જન્મેલી સંસ્કારિતા તેને એમ કરવા દેશે જ નહિ. અને માણસમાં જો આ સંસ્કારિતા સાચેસાચ આવી હશે તો તેની અંદર એક પ્રકારની ખાનદાની અને ઉદારતાનું તત્ત્વ પણ આવશે, એ તત્ત્વો તેના વર્તનની અંદર પણ આપોઆપ પ્રગટ થતાં રહેશે અને તેને અનેક હુલકાં અને વિકૃત કાર્યોમાંથી બચાવી લેશે.

અહીંથી હવે સ્વાભાવિક રીતે જ આપણે પ્રાણની કેળવણીના બીજા સ્વરૂપ તરફ, માણસનું ચારિત્ય અને તેનું રૂપાંતર એ વિષયને લગતી કેળવણી તરફ જઈએ છીએ.

જે જે સાધનાઓએ આજ સુધી પ્રાણનો વિષય હુથ લીધો છે, અને તેને વિશુદ્ધ કરી તેના ઉપર પ્રભુત્વ મેળવવા માટે પ્રયત્નો કરેલા છે, તે બધી સામાન્ય રીતે બળાત્કાર અને દમનને માર્ગે, તેમ જ ત્યાગ અને સંન્યાસવૃત્તિને માર્ગે કામ કરતી રહેલી છે. બેશક, પ્રાણ સાથે કામ લેવાની આ પદ્ધતિઓ સહેલી છે અને તેનાં પરિણામ પણ ઝડપથી આવતાં હોય છે. પરંતુ જરા ઊંડા ઊતરીને જોતાં જણાશે કે

એ પદ્ધતિઓ દ્વારા આવતાં પરિણામો તે પ્રાણ માટેની એક વિગતવારની અને કડક કેળવણીમાંથી આવતાં પરિણામો જેવાં સ્થાયી અને અસરકારક હોતાં નથી. વળી આ સાધના પદ્ધતિઓ, તેમના કાર્યમાં પ્રાણ પોતે સહકાર આપે, સહાય આપે, તેમ જ તે પોતે વચ્ચે પડીને સક્રિય બને એ રીતની શક્યતાઓને બિલકુલ ઉભી થવા દેતી નથી. પરંતુ પ્રાણના તરફથી મળતી આ પ્રકારની મદદ એ તો બહુ જ કિંમતી વસ્તુ છે, આપણે જો વ્યક્તિનો અને તેની પ્રવૃત્તિઓનો સર્વાંગપૂર્ણ વિકાસ સાધવા માગતા હોઈશું તો પ્રાણનું આ સહકાર્ય આપણને અત્યંત ઉપયોગી થઈ પડવાનું છે.

તો હવે આપણે ચારિત્રણનો વિકાસ અને રૂપાંતર માટેની કેળવણીનો વિચાર કરીએ. એ માટેનું અનિવાર્ય એવું પ્રસ્થાનબંધુ છે આત્મ-ભાન. આપણી અંદર ચાલી રહેલી અનેક કિયાઓ વિશે આપણે સભાન બનવું, આપણે શું શું કરીએ છીએ અને તે શા માટે કરીએ છીએ તેની નોંધ લેવી, એ છે આ કેળવણીનું પ્રથમ સોપાન. બાળકને પણ આ જ વસ્તુ શીખવવાની છે, આપણે તેને એ શીખવીશું કે તે પોતાની જાતનું અવલોકન કરે, પોતાની અંદર ઊઠતી પ્રતિક્રિયાઓ, શીખવૃત્તિઓ, તેમની પાછળ રહેલાં કારણો એ બધાની નોંધ કરે. વળી તેનામાં રહેલી ઈચ્છાઓ, તેનામાં જાગતી ઉગ્ર વાસનાઓ અને આવેશો, વસ્તુઓને મેળવવા માટેની, પચાવી પાડવા માટેની, પોતાનો અધિકાર જમાવવા માટેની સહજવૃત્તિઓ, તે બધાની પાછળ રહેલી મિથ્યાભિમાનની ભૂમિકા, અને આ બધાના જોડિયા જેવી દુર્ભણતા, નિરુત્સાહ, નિરાશા, વિષાદ આદિ વૃત્તિઓ તે સર્વનું તે એક તત્ત્વ સાક્ષી રહીને બહુ સ્પષ્ટ દૃષ્ટિપૂર્વક નિરીક્ષણ કરે.

આ પ્રમાણેની અવલોકન શક્તિ વધવાની સાથે સાથે વ્યક્તિમાં પોતે આગળ પ્રગતિ કરવા માટે, પોતાની જાતને પૂર્ણ કરવા માટે સંકલ્પ પણ જાગૃત થવાની જરૂર રહે છે. એ પ્રમાણે થાય તો જ આ કિયા ઉપયોગી નીવડી શકે, નહિ તો નહિ, એ વાત તો દેખીતી જ છે. એટલે બાળકમાં આપણે આ સંકલ્પશક્તિ પણ મૂકી આપવાની છે. બાળક સંકલ્પ સેવવા જેટલું મોટું થાય કે તરત જ તેનામાં આ સંકલ્પ મૂકી આપવો જોઈએ, અને એવો સંકલ્પ સેવવાની શક્તિ બાળકમાં સામાન્ય રીતે માનવામાં આવે છે તે કરતાં ઘણી વહેલી ઉમરે જાગૃત થઈ શકે છે.

આ સંકલ્પ એટલે કે પોતાની પ્રકૃતિને ઓળંગી જઈ તેના પર વિજય મેળવવા માટેનો દૃઢ નિશ્ચય. અને એ જગાડવા માટેની પદ્ધતિઓ પણ વ્યક્તિ પ્રમાણે જુદી જુદી હોય છે. કેટલાક માણસોને આપણે બુદ્ધિની દલીલો વડે સમજાવી શકીએ છીએ, તો કેટલાકને તેના પ્રત્યેની શુભ ભાવના અને લાગણી દ્વારા આપણે જાગૃત કરી શકીએ છીએ, તો અમુકને આપણે તેમના આત્મ-સંમાનની અને ગૌરવની ભાવના મારફતે આ સંકલ્પમાં મૂકી આપી શકીએ છીએ. પરંતુ આ સર્વ સાધનો કરતાંથે વધુ પ્રબળ સાધન તો

પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. એ સાધન તો હરેકના ઉપર અસર કરે છે. લોકો સમક્ષ સાચા દિલથી અસ્થબ્લિતપણે જો ઉત્તમ દૃષ્ટાંત રજુ કરવામાં આવશે તો તેની ધારી અસર અવશ્ય થશે જ.

આવો સંકલ્પ આપણામાં એક વાર બરાબર દૃઢ રીતે સ્થપાઈ જાય તે પછી તો આપણે બરાબર નિશ્ચયપૂર્વક અને ખંતપૂર્વક આગળ ને આગળ ચાલ્યે જવાનું રહે છે. આપણા એ પ્રયત્નમાં આપણને નિષ્ફળતા પણ મળવાનો સંભવ રહે છે, પરંતુ તેને આપણે કદી પણ છેવટની સ્થિતિ તરીકે સ્વીકારવાની નથી. આ અંગે તમારે એક મહાત્માની વસ્તુ જાણવા જેવી, અને સદા યાદ રાખવા જેવી છે. એ તમે કરી શકશો તો તમારી સાધના કદી શિથિલ નહિ પે, તેમાં કદી પીછેહઠ નહિ આવે. એ વસ્તુ એ છે કે તમે તમારા સંકલ્પબળને પણ, શરીરના સ્નાયુઓની માફક, પદ્ધતિપૂર્વક અને કર્મે કર્મે આગળ વધતી કસરતો દ્વારા કેળવી શકો છો અને વિકસાવી શકો છો. તમે કોઈ નજીવી વસ્તુ કરવા માટે હાથ લીધી હોય ત્યારે પણ તમારા સંકલ્પને તમારે ભારેમાં ભારે પ્રયત્ન માટે સજ્જ રાખવો જોઈએ. કેમ કે પ્રયત્નમાંથી જ શક્તિ વધે છે; પ્રયત્ન કરતાં કરતાં જ તમારામાં ધીરે ધીરે એટલી તો શક્તિ આવે છે કે જે વેગે ગમે તેવું કદણ કામ પણ હાથ ધરી શકો છો. એટલે તમે જો કોઈ વસ્તુ કરવા માટે એક વાર નિશ્ચય કરો, તો પછી ભલે ગમે તે થાય તો પણ તે તમારે પાર પાડવી જ જોઈએ. કદાચ તમારે એ વસ્તુ કેટલીયે વાર ફરી ફરીને કરવી પે તોપણ તમારો સંકલ્પ ચલિત ન થવો જોઈએ. આ રીતે તમે પ્રયત્ન કરશો તો તમારી સંકલ્પશક્તિ વધુ ને વધુ બળવાન બનતી જશે, અને અંતે તમારે માત્ર આટલું જ કરવાનું રહેશે: તમારું લક્ષ્ય બરાબર સમજપૂર્વક પસંદ કરી લો અને તેને સિદ્ધ કરવા માટે તમારા સંકલ્પને કામે લગાડી દો.

તો આપણે જે વિચાર્યુ તેનો સાર આ છે: આપણી પ્રકૃતિનું આપણો સંપૂર્ણ જ્ઞાન મેળવી લઈએ, આપણી સર્વ કિયાઓ ઉપર કાબૂ મેળવી લઈએ, અને એ રીતે આપણી અંદરનાં જે જે તત્ત્વોનું રૂપાંતર સાધવાનું છે તે સર્વ ઉપર આપણો સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લઈએ અને તેમનું રૂપાંતર સાધી લઈએ.

હવે આપણે એ વિચારવાનું છે કે આપણી પ્રકૃતિ ઉપર આ પ્રભુત્વ મેળવીને, અને તેનું રૂપાંતર સાધીને આપણે કયો આદર્શ સિદ્ધ કરવા માણીએ છીએ. એ આદર્શના ઉપર જ બધો આધાર રહેવાનો છે. તમારો આદર્શ જે કોટિનો હશે તે મુજબ જ તમારી સાધનાનું અને તેના પરિણામનું મૂલ્ય અંકાશે. આ આદર્શનો વિચાર હવે આપણે મનની કેળવાળીનો વિષય હાથ લઈશું તેની અંદર કરીશું.

(બુલેટિન, ઓગસ્ટ ૧૯૫૧)

## મનની કેળવણી

કેળવણીના સર્વ પ્રકારોમાં મનની કેળવણી સૌથી વધુ જાણીતી છે, અને એ જ કેળવણી સૌથી વધુ પ્રચારમાં છે. અને છતાં, અમુક વિરલ અપવાદો સિવાય, એ કેળવણીમાં પણ ખૂબ જ ઊણપો રહેલી છે. એ ઊણપો આ કેળવણીને ઘણી જ અપૂર્ણ વસ્તુ કરી મૂકે છે, અને છેવટે જતાં એ એક ઘણી જ અસંતોષકારક વસ્તુ બની રહે છે.

કેળવણી એટલે કે મનની કેળવણી એવો અર્થ જ સામાન્ય રીતે લેવામાં આવે છે. બાળકને આપણે અમુક વર્ષો સુધી અમુક પ્રકારની સખત તાલીમમાંથી પસાર કરીએ છીએ, અને એ તાલીમમાં પણ આપણે બાળકના ભગજને કેળવતા નથી, પણ મોટે ભાગે તેમાં અમુક વિષયોને જ ઢાંસીને ભરીએ છીએ, અને એ તાલીમને અંતે એમ માની લઈએ છીએ કે બાળકનો માનસિક વિકાસ કરવા માટે જે કાંઈ કરવા જેવું હતું તે આપણે બધું જ કરી લીધું છે. પરંતુ આ વાત સાચી નથી. એટલું જ નહિ પણ, બાળકના ભગજને કશી હાનિ ન પહોંચે એવી રીતે તેને યોગ્ય પ્રમાણમાં અને વિવેકપૂર્વક આપણે તાલીમ આપીએ છીએ ત્યારે પણ એ કેળવણીમાંથી બાળકનું મન એક અચ્છું અને ઉપયોગી કરણ તરીકે કામ કરતું થાય એવી શક્તિઓનો વિકાસ બાળકમાં થતો નથી. અત્યારે આપાઈ રહેલી કેળવણી એ મોટે ભાગે તો ભગજની ચપલતાને વધારવા માટેના એક વ્યાયામ તરીકનું જ કામ કરે છે. અને આ રીતે જોતાં જગતમાં વિદ્યાની જે જે શાખા પ્રશાખાઓ પ્રચારમાં છે તે બધી એક અમુક રીતના માનસિક વ્યાયામ જેવી જ હોય છે. અને એ દરેક વિભાગની કેળવણીમાં જે જે સાધનો વાપરવામાં આવે છે તે દરેક એક પ્રકારની ખાસ અને અલગ અલગ એવી આગવી ભાષા જ બની રહે છે.

સાચી માનસિક કેળવણી માણસને એક ઉચ્ચ જીવન માટે તૈયાર કરવા માગે છે. અને એવી કેળવણીનાં પાંચ મુખ્ય તત્ત્વો હોય છે. સામાન્ય રીતે આ પાંચ તત્ત્વો માનવના વિકાસમાં એક પછી એક વિકાસપામે છે, પરંતુ અમુક વિરલ વ્યક્તિઓમાં તે તત્ત્વો આગળ પાછળ અથવા તો એકીસાથે પણ પ્રગટ થાય છે. એ પાંચ વસ્તુઓ સંક્ષેપમાં નીચે મુજબનું:

(૧) એકાગ્રતાની શક્તિનો, ધ્યાન આપી શકવાની શક્તિનો વિકાસ.

(૨) વિસ્તાર, વિશ્વાણતા, સંકુલતા અને સમૃદ્ધતાની શક્તિઓનો વિકાસ.

(૩) કોઈ એક મધ્યસ્થ વિચારની આસપાસ, યા તો કોઈ ઉચ્ચ આદર્શની આસપાસ, અથવા તો જીવનમાં માર્ગદર્શક બની શકે તેવા કોઈ પરમ પ્રકાશમય વિચારની આસપાસ પોતાના વિચારોનું સંગઠન.

(૪) વિચારો ઉપર કાબૂ અને ન દુર્ઘટ્વા યોગ્ય વિચારોનો ત્યાગ, અને આ શક્તિને લીધે, છેવટે જતાં માણસ એવી અવસ્થા મેળવી શકે કે જેમાં તેણે પોતે જે વિચાર કરવો હોય તે જ વિચાર કરી શકે, અને જ્યારે વિચાર કરવો હોય ત્યારે જ કરી શકે.

(૫) મનની નીરવ અવસ્થા તેમ જ સંપૂર્ણ સ્વસ્થતાની પ્રાપ્તિ, અને ચેતનાના ઉર્ધ્વ પ્રદેશોમાંથી આવનારી પ્રેરણાઓને વધુમાં વધુ જીલતા થવાની શક્તિ.

આ તત્ત્વો હરેક વ્યક્તિમાં કેવી રીતે વિકાસ પામી શકે તે માટેની જે જે પદ્ધતિઓ છે તે દરેકનું વિગતવાર વાર્ણન તો અહીં આપી શકાય તેમ છે નહિ, તોપણ આ અંગે થોડુંક વિવરણ અત્રે આપીશું.

એ વાતનો તો સૌ કોઈ સ્વીકાર કરશે કે બાળકની માનસિક પ્રગતિને વધુમાં વધુ અટકાવનારી વસ્તુ તો તેના મનની ચંચળતા છે. બાળકનું મન પતંગિયાની માફક કાયમ આમતેમ ઉજ્યા જ કરતું હોય છે, અને મહાપ્રયત્નને અંતે જ તેને એક સ્થાનમાં સ્થિર રાખી શકાય છે. અને છતાં આ એકાગ્રતાની શક્તિ બાળકમાં ગુપ્ત રીતે રહેલી તો હોય છે જ. આપણે બાળકને કોઈ વિષયમાં રસ લેતું કરી શકીએ છીએ ત્યારે બાળક તે વિષયમાં ઠીક ઠીક એકધ્યાન થઈ શકે છે. એટલે કેળવણીકારમાં જો ખરી કુશળતા હશે તો બાળકમાં ધીરે ધીરે તે એવી શક્તિ ઉત્પન્ન કરશે કે જેને લીધે તે સતત એકાગ્રતા કરી શકશે, પોતે કોઈ કામ કરતું હશે તેમાં તે વધુમાં વધુ પૂર્ણ રીતે મન થઈ શકશે. આ એકાગ્ર ધ્યાનની શક્તિ વિકસાવવા માટે હરેક સાધન આપણે સ્વીકારી શકીએ છીએ. રમતોથી માંડીને ઇનામો સુધીનાં સાધનોમાંથી આપણે પરિસ્થિતિ તેમ જ આવશ્યકતા મુજબ હરકોઈ સાધનનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુ આ બધામાં સૌથી અગત્યની વસ્તુ તો બાળકના ચિત્તની કિયા છે. આપણે જે વિષય શીખવવા માગતા હોઈએ તે પ્રત્યે બાળકમાં રસ પ્રગટાવવો, બાળકમાં કામને માટેનો રસ જાગૃત કરવો, પ્રગતિ માટે તેનામાં સંકલ્પ ઉત્પન્ન કરવો, કેળવણી માટેનું સૌથી સમર્થ સાધન તે આ છે. બાળકને આપણે જો કોઈ સારામાં સારી, કીમતીમાં કીમતી ભેટ આપી શકતા હોઈએ તો તે એ છે કે, બાળકમાં આપણે જ્ઞાન માટેનો પ્રેમ જાગૃત કરી આપીએ. હરહમેશ, હર ડેકાણે બાળકને આપણે જ્ઞાનને માટે આતુર બનાવી આપીએ. જીવનના સર્વ બનાવવો, સર્વ સંયોગો બાળકને માટે વળી વળીને વધુ ને વધુ જ્ઞાન મેળવવા માટેના પ્રસંગો બની રહે તેવું આપણે કરી આપવું જોઈએ.

બાળકને આ સ્થિતિમાં પહોંચાડવા માટે તેનામાં એકાગ્રતા અને એકધ્યાનનો વિકાસ કરવાની સાથે સાથે અવલોકનશક્તિ, સાચી સ્મરણશક્તિ અને ચોક્કસ એવી નોંધશક્તિનો વિકાસ પણ કરાવવો જરૂરી છે. અવલોકન-શક્તિનો વિકાસ કરવા

માટે આપો આપ બની આવતાં જુદાં જુદાં પ્રકારનાં મનોયત્નો યોજી શકાય છે. તેમ જ બાળકના ચિત્તને જાગૃત કરવામાં, ચપળ અને વેગવાન કરવામાં મદદ રૂપ થાય તેવી સર્વ તકનો લાભ લઈ શકાય છે. સમરણશક્તિના વિકાસ કરતાં પણ વિરોધ ભાર તો સમજશક્તિના વિકાસ ઉપર આપવાની જરૂર છે. આપણે જે વસ્તુ સમજતા હોઈએ છીએ તેનું જ આપણાને બરાબર જ્ઞાન રહે છે. યાંત્રિક રીતે ગોખી કાઢેલી વસ્તુઓ ધીરે ધીરે સ્મૃતિમાંથી જાંખી થઈ જાય છે, અને આખરે ભુલાઈ પણ જાય છે. પણ તમે જે વસ્તુ સમજ્યા હશો તે પછી ભૂલી જવાતી નથી. વળી એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. બાળક જ્યારે તમને કોઈ પ્રશ્ન કરે કે આ વસ્તુ આમ કેમ છે, આમ શા માટે થતું હશે ત્યારે તેનો ખુલાસો તમે હુમેશાં આપજો. બાળકને કદ્દી ના ન પાડશો. તમને પોતાને જો એ વિષયનું જ્ઞાન ન હોય તો પછી બાળકને જે લોકો સમજાવી શકે તેવા હોય તેમની પાસે લઈ જાઓ અથવા તો એ અંગેનાં પુસ્તકો તમે બાળકને મેળવી આપજો. આ રીતે તમે કેમ બાળકમાં સાચા અભ્યાસ માટેનો રસ જાગૃત કરી શકશો, જ્ઞાન મેળવવા માટે અખંડ પરિશ્રમ કરવાની ટેવ પાડી શકશો.

આમાંથી હુવે આપણે સહજ રીતે બાળકના ચિત્તવિકાસની બીજી ભૂમિકામાં પહોંચીએ છીએ. એ ભૂમિકામાં બાળકનું ચિત્ત પોતાને વિશાળ કરે છે, અધિક સમૃદ્ધ કરે છે.

બાળક મોટું થતું જાય તેમ તેમ એને એ વસ્તુ બતાવી શકશો કે જીવનમાંની હરેક ચીજ અભ્યાસ માટેનો એક રસિક વિષય બની શકે છે. બેશક, આ વસ્તુ બાળકને સમજાવવા માટે તમારે તે તેની આગળ સાચી રીતે રજૂ કરવી જોઈશો. બાળકને માટે સૌથી ઉત્તમ શાળા તે આપણું નિત્યનું, હર પળે જીવાતું જીવન જ છે. આ જીવનમાં કેટલીયે વિવિધ વસ્તુઓ પડેલી છે, કેટલીયે સંકુલ, ગુંચવણ ભરેલી વસ્તુઓ આવેલી છે. તેમાં અનેક આણવાયા અનુભવો મળી આવે છે, કેટલાયે પ્રશ્નો તમારી આગળ ઉકેલની રાહ જોતા ખડા હોય છે. જીવનમાં તમને કેટલાયે પારદર્શક અને વેધક દૃષ્ટાંતો મળી આવે છે, કેટલાંયે નજરે દેખી શકાય તેવાં પરિણામો, પરિણામ-પરંપરાઓ જોવા મળે છે. આ બધા અંગે બાળકો અનેકાનેક પ્રશ્નો પૂછતાં રહે છે. બાળકના એ પ્રશ્નોને તમે જો સ્પષ્ટ રીતે અને બુદ્ધિપૂર્વક સમજાવી શકો તો બાળકની અંદર શુદ્ધ અને તંદુરસ્ત જિજ્ઞાસા વૃત્તિ ખીલવવી એ બહુ સહેલું કાર્ય બની રહે છે. બાળકના પ્રશ્નનો તમે જો રસિક જવાબ આપશો, તો તેમાંથી બાળક બીજા ઘણા પ્રશ્નો પૂછશો. અને આ રીતે બાળકનું ચિત્ત આકર્ષિત થતાં બાળક શાળાના બાંકડા પર બેસી ભાગનું હોય છે તે કરતાંયે કેટલીયે વધુ વસ્તુઓ વિનાપ્રયત્ન શીખી જાય છે. આ ઉપરાંત બાળકોને માટે તમે જો કાળજીપૂર્વક અને બુદ્ધિપૂર્વક અમુક પુસ્તકો પસંદ

કરી આપણો તો તેમાંથી પણ બાળકમાં તંદુરસત વાચન માટેનો એક રસ ખીલી શકશે અને બાળકને તેમાંથી જ્ઞાન અને આનંદ બંને મળી રહેશે. વળી, કોઈ પણ વસ્તુ જો બાળકની કલ્પનાને જગૃત કરી તેને તૃપ્ત કરી શકતી હોય તો તેથી તમારે લેશ પણ ડરવાનું નથી. આ કલ્પનાશક્તિને લીધે જ બાળકનો અભ્યાસ એક જીવતી જાગતી વસ્તુ બની રહે છે અને મન આનંદનો અનુભવ કરતું કરતું આગળ વધે છે.

બાળકના મનની ચપલતા અને ગ્રહણશક્તિ વધારવા માટે આપણો તેને જુદા જુદા અને અનેક વિષયો આપીએ એટલું જ બસ નથી. એ માટે આપણો એક જ વિષયને જુદી જુદી રીતે વિચારી શકાય છે તે વાત પણ બાળકને બતાવવાની જરૂર છે. આમાંથી બાળકને એક વ્યવહારુસ સમજ એ આવશે કે એક જ બૌદ્ધિક વિષયને જુદી જુદી રીતે જોઈ શકાય છે, અને જુદી જુદી રીતે તેનો વિચાર તેમ જ ઉકેલ કરી શકાય છે. આ રીતે બાળકના ચિત્તમાંથી તમામ રીતની જડતા ચાલી જશે, સાથે સાથે અનું ચિત્ત વધારે સમૃદ્ધ, વધારે ચપળ બનશે તેમ જ એક વધારે વ્યાપક અને સંકુલ એવો સમન્વય નિપાશવવાને તે તૈયાર થઈ શકશે. આ રીતની તાલીમમાંથી બાળકને એ વાતનો ઘ્યાલ પણ આવી જશે કે માનસિક જ્ઞાન એ તો એક ઘણી જ સાપેક્ષ વસ્તુ છે અને ધીરે ધીરે જ્ઞાનનું સાચું મૂળ ક્યાં છે તે શોધવા માટેની અભીસ્થા તેનામાં જગૃત થશે.

બાળક જેમ જેમ વધુ અભ્યાસ કરતું જાય છે, વયમાં મોટું થતું જાય છે તેમ તેમ તેનું મન પણ પક્ષવ થતું જાય છે, અને તેનામાં વ્યાપક વિચારોને જીલવાની શક્તિ પણ વધુ આવતી જાય છે. આવો વિકાસ થતાં બાળકમાં હમેશાં એક સાચા આધારભૂત જ્ઞાન માટેની ભૂખ પણ જાગે છે. તે એક સ્થિર અને સુદૃઢ જ્ઞાન મેળવવા માગે છે. આ જ્ઞાનના પાયા ઉપર બાળક એક એવી વિચારસૂચિનું સર્જન કરશે કે જેની અંદર તે પોતાના મગજમાં જે અનેક જુદા જુદા, વેરણછેરણ અને ઘણી વાર એકમેકથી ઊલટા વિચારો ભેગા થયેલા હોય છે તે બધાને તે સંગઠિત અને વ્યવસ્થિત રૂપ આપી શકશે. આપણા વિચારોની અંદર રહેલી અતંત્રતા દૂર કરવા માટે આવી કોઈ સુવ્યવસ્થિત સંગઠન કિયા બહુ જ જરૂરની છે. જગતમાં જે જે વિરોધી તત્ત્વો આવેલાં છે તે સર્વને એકબીજાનાં પૂરક બનાવી શકાય છે. પરંતુ આ કરવા માટે આપણો પ્રથમ તો આ તમામ વિરોધી તત્ત્વોને સંવાદમાં મૂકી શકે તેવા એક ઉચ્ચ વિચારતત્ત્વને શોધી કાઢવાનું રહે છે. આપણે પક્ષપાતી અને સંકુચિત એકાન્તિક માનસમાંથી બચવું હશે તો હુરેક પ્રશ્નને શક્ય તેટલાં તમામ દૃષ્ટિબિંદુથી જોવાની કળા આપણે મેળવવાની રહે છે. પરંતુ આપણા વિચારને જો સક્રિય અને સર્જનાત્મક બનાવવો હશે તો તે વિચાર હુરેક ગ્રસંગે તમામ દૃષ્ટિબિંદુઓમાંથી એક નેસર્જિક રીતે તેમ જ તર્કબદ્ધ રીતે

નીપજતા સમન્વય જેવો હોવો જોઈશે. અને તમારી સારી વિચારસરણીને તમે જો એક રચનાત્મક અને સક્રિય એવી શક્તિ રૂપ બનાવવા ઈચ્છતા હુશો તો તો પછી તમારા આ માનસિક સમન્વયના કેન્દ્રની અંદર તમે કયો વિચાર મુખ્ય રાખશો તેની પસંદગી તમારે ખૂબ જ સંભાળપૂર્વક કરવી જોઈશે. તમારા સમન્વયનું સારુંયે મૂલ્ય એ કેન્દ્રસ્થ વિચારના ઉપર જ રહેવાનું છે. એ કેન્દ્રસ્થ વિચાર જેટલો ઉચ્ચ હુશે, વિશાળ હુશે, તે જેટલો વિશ્વવ્યાપક હુશે, સ્થળ અને કાલથી પર હુશે, તેટલા પ્રમાણમાં તે અનેક પ્રકારના સંકુલ અને વિવિધ વિચારોને, ઘ્યાલોને અને ભાવોને વધુ ને વધુ સંગઠિત કરી શકશો, સંવાદમાં યોજી શકશો.

વિચારોને સંગઠિત કરવાની બાબતમાં એ વાત તો સ્પષ્ટ જ છે કે એ કાર્ય એકીસાથે થઈ શકે તેવું તો નથી જ. માનવના મને જો પોતાની શક્તિ, પોતાનું યૌવન જાળવી રાખવું હુશે તો પછી તેણે પોતાના ઘ્યાલોને નવા નવા પ્રગટ થતા તમામ જ્ઞાનના પ્રકારણી અંદર ફરી ફરીને તપાસવાના રહે છે. આ મને પોતાના તંત્રને એવું તો વધુ ને વધુ વિશાળ કરતા રહેવાનું છે કે તેમાં નવા નવા ઘ્યાલોનો સમાવેશ તે કરી શકે. એ માટે તેણે પોતાના વિચારોનું ફરી ફરીને વર્ગીકરણ કરવાનું, ફરી ફરીને સંગઠન કરવાનું રહે છે. એમ કરવાથી હુરેક વિચારને બીજા વિચારોના સંબંધમાં તેનું પોતાનું સારું સ્થાન મળી આવશે, અને એ સર્વ વિચારો સંવાદમય અને વ્યવસ્થિત બનીને ઊભા રહેશે.

આ બધું અમે જે કહ્યું તે માણસના ચિંતનાત્મક મનને, જ્ઞાન મેળવનારા મનને લાગુ પડે છે. પરંતુ જ્ઞાન મેળવવું એ તો મનની પ્રવૃત્તિનો માત્ર એક જ ભાગ છે. એ પ્રવૃત્તિનો એક બીજો ભાગ પણ છે, અને તે આ પ્રવૃત્તિના જેટલો જ અગત્યનો છે. એ ભાગ તે મનની રચનાત્મક શક્તિનો ભાગ છે, વસ્તુને આકાર આપનારી અને તેમાંથી કાર્યને માટે તૈયારી કરનારી શક્તિનો ભાગ છે. મનની પ્રવૃત્તિનો આ ભાગ આટલો બધો મહૃત્ત્વનો છે છતાં તેનો ખાસ અભ્યાસ ભાગ્યે જ થયેલો છે, તેમ જ તે માટેની કોઈ તાલીમ હજી યોજાયેલી નથી. માત્ર જે અમુક લોકોને પોતાના મનની પ્રવૃત્તિઓ ઉપર કોઈક કારણસર સખત કાબૂ મૂકવાની જરૂર જાણાયેલી છે તેવા લોકો જ આ રચનાકારક શક્તિનું અવલોકન કરવાનો અને તેને શિસ્તબદ્ધ કરવાનો વિચાર કરે છે. પણ એવા લોકોને પણ, તેઓ આ કામ હાથ લેવાનો પ્રયત્ન કરે છે કે તરત જ તેમાં ઘણી ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે, અને એ મુશ્કેલીઓ જાણે કદી ઊકલશે જ નહિ એવી મહા વિષમ જાણાય છે.

પરિસ્થિતિ આવી હોવા છતાં, મનની આ રચનાકારક પ્રવૃત્તિ ઉપર કાબૂ મેળવવો એ આત્મ-શિક્ષણનું એક અત્યંત મહૃત્ત્વનું અંગ છે. એટલું જ નહિ, આપણે એટલે સુધી કદી શકીએ કે એવા કાબૂ વિના મન ઉપર કોઈ પણ પ્રભુત્વ

મેળવવું અશક્ય છે. આપણે જ્યારે વિખ્યોનો અભ્યાસ લઈ બેસીએ છીએ ત્યારે તો આપણે સર્વ પ્રકારના વિચારોને સ્વીકારી શકીએ છીએ. અને આપણે જે સમન્વય ઉપજાતવા માગીએ છીએ તેની અંદર તો સર્વ વિચારોનો સ્વીકાર કરવો ઈષ્ટ પણ છે, કેમ કે એ સમન્વય તો આપણે હરેક રીતે વધુ ને વધુ સમૃદ્ધ અને વધુ ને વધુ સંકુલ કરવાનો છે. પરંતુ જ્યાં કાર્યોનો પ્રશ્ન આવીને ઊભો રહે છે ત્યાં તો વસ્તુ તદ્દન જુદી જ બની જાય છે. આપણે જ્યારે વિચારોને કાર્યનું રૂપ આપવા નીકળીએ ત્યારે તો કયા વિચારને અમલમાં મૂકવા તે બાબતમાં આપણે ખૂબ જ સાવધાન રહેવાનું છે. આપણે જે કેન્દ્રવર્તી વિચારની આસપાસ આપણા મનમાં સમન્વય રચેલો હોય છે તે વિચારના મુખ્ય પ્રવાહની સાથે જે વિચારો મેળમાં આવી શકતા હોય તેમને જ આપણે કાર્ય રૂપે પ્રગટ થવાની રજા આપી શકીએ. એનો અર્થ એ થયો કે આપણી મનોમય ચેતનામાં જે જે વિચાર દાખલ થાય તેને આપણે પેલા મધ્યવર્તી વિચારના સિંહાસનની પાસે લઈ જઈને ખડો કરીશું. એ મહા વિચારની આસપાસ ગોડવાયેલા બીજા વિચારોની અંદર જો તે બરાબર બેસી શકે તેમ હોય તો પછી તેને પેલા સમન્વયની અંદર સ્થાન મળી શકશે. અને એ વિચાર જો ત્યાં બેસવાને માટે સુપાત્ર ન નીવડે તો આપણે તેને આપણામાંથી તદ્દન ફેંકી દઈશું, અને આપણા કાર્ય ઉપર તેની લેશ પણ અસર થવા નહિ દઈશું. આ છે મનની વિશુદ્ધિનું કાર્ય અને આપણે આપણાં કાર્યો ઉપર જો સંપૂર્ણ કાબૂ મેળવવો હશે તો એ વિશુદ્ધિની કિયા આપણે ખૂબ જ નિયમિત રીતે કરવાની રહે છે.

આ કામ માટે જો દરરોજ થોડોક વખત અલગ કાઢી શકાય તો તો ઘણું જ સારું. એ વખતે આપણે આપણા વિચારોનું શાંતિથી અવલોકન કરીએ અને આપણા સમન્વયને બરાબર વ્યવસ્થિત કરતા રહીએ. આ પ્રકારની ટેવ એક વાર બરાબર પડી ગયા પછી તમે કોઈ કામમાં લાગેલા હશો, કોઈ પ્રવૃત્તિ કરતા હશો ત્યારે પણ તમે તમારા વિચારો ઉપર કાબૂ જાળવી શકશો, અને તમે હાથ લીધેલા કામને માટે જે કોઈ વિચાર બિનઉપયોગી જેવો હશે તેને મનમાં આગળ પડતું સ્થાન લેતાં અટકાવી શકશો. તમે જો એકાગ્રતા અને એકધ્યાનની શક્તિ બરાબર કેળવી હશે તો તો પછી તમારી સક્રિય બાધ્ય ચેતના એવી બની રહેશે કે કાર્ય માટે જે વિચારોની જરૂર હશે તે વિચારોને જ માત્ર તે પોતામાં આવવા દેશે. અને એમ થતાં તમારા વિચારો ઘણા જ વધુ સક્રિય અને અસરકારક થઈ શકશો. વળી, તમે ખૂબ તીવ્ર એકાગ્રતા કરતા હો તે વખતે તમારે જો એવી જરૂર ઊભી થાય કે તમારે હવે બિલકુલ વિચાર જ કરવો નથી તો તેવે વખતે મનનાં આંદોલન માત્રને બંધ કરી દઈ શકશે અને એક લગભગ સંપૂર્ણ એવી નીરવતા મેળવી શકશે. આવી નીરવ સ્થિતિમાં તમે ધીરે ધીરે મનના

ગુર્ધ્વ પ્રદેશો પ્રત્યે ખુલ્લા થઈ શકશો અને ત્યાંથી આવતી પ્રેરણાઓને કેવી રીતે જીલ્લવી તે શીખી શકશો.

પરંતુ તમે મનના આ ગુર્ધ્વ પ્રદેશોની સાથે સંબંધમાં આવી શકો તે પૂર્વે પણ, તમે આ નીરવ સ્થિતિ મેળવી શકો તો તેટલા માત્રથી પણ ઘણા જ લાભ થઈ શકે તેમ છે. જેમનું મન વિકાસ પામેલું તેમ જ સક્રિય રહેનારું હોય છે તે ભાયે જ કદી આરામ કરતું હોય છે. દિવસને વખતે તો તે મનની પ્રવૃત્તિ અમુક કાબૂ હેઠળ ચાલતી હોય છે, પણ રાતને વખતે, શરીર જ્યારે નિદ્રાધીન હોય છે ત્યારે, જાગૃત અવસ્થામાં મન ઉપર રહેતો કાબૂ લગભગ ચાલી જ જાય છે. અને મન અનેક કિયાઓમાં, અને ઘણી વાર તો કશા જ સંબંધ વિનાની કિયાઓમાં બેલગામ ઘૂમવા મંડી પેદે છે. આને લીધે મનમાં ઘણી જ ખેંચ જન્મે છે, તેમાંથી થાક આવે છે, મનની શક્તિઓ ક્ષીણ થાય છે.

ખરી વાત તો એ છે કે આપણા બીજા અવયવોની પેઠે મનને પણ આરામની જરૂર રહે છે, અને આ આરામ મનને કેવી રીતે આપવો તે જ્ઞાન આપણને નહિ થાય ત્યાં સુધી મનને કદી આરામ મળી શકવાનો નથી. મનને આરામ આપવો એ એક કણા છે, અને આપણે તેને પ્રયત્નપૂર્વક મેળવવાની રહે છે. આ આરામ મેળવવાનો એક માર્ગ એ છે કે આપણે આપણા મનની પ્રવૃત્તિમાં કાંઈક ફેરફાર કરી લઈએ, એક મૂકીને બીજી પ્રવૃત્તિ ઉપાડીએ. પરંતુ મનને વધુમાં વધુ આરામ તો નીરવ સ્થિતિમાં જ મળે છે. આ શાંત નીરવતામાં જો થોડીક મિનિટો પણ રહી શકાય તો તેથી મનની શક્તિઓને એટલો બધો તો આરામ મળી રહે છે કે જે આરામ કલાકો સુધીની નિદ્રામાંથી પણ મળતો નથી.

આમ મનને ઈચ્છા મુજબ શાંત કરવું, અને ઉપરની વસ્તુઓને જીલતી એ નીરવ શાંતિની અંદર એકાગ્ર બની શકવું એ કણા આપણે શીખી શકીશું ત્યારે આપણે માટે એવો કોઈ પણ પ્રશ્ન, એવી કોઈ પણ માનસિક મુશ્કેલી નહિ રહેશે કે જેનું નિરાકરણ આપણને નહિ મળી આવે. માણસનું ચિત્ત જ્યારે ખૂબ જ સક્રિય બની જાય છે ત્યારે તેની કિયાઓમાં અવ્યવસ્થા આવી જાય છે, તે દુર્બળ બની જાય છે. એ ચિત્ત જ્યારે એક ધ્યાનમય નીરવ અવસ્થામાં સ્થિર થાય છે ત્યારે તેની સમક્ષ પ્રકાશ પોતે પ્રકટ થઈ શકે છે અને એ પ્રકાશ માણસની શક્તિઓ સમક્ષ નવી નવી ક્ષિતિજો ખોલી આપી શકે છે.

(બુલેટિન, નવેમ્બર ૧૯૫૧)

## અંતરાત્માની અને આધ્યાત્મિક કેળવણી

અત્યાર સુધી આપણો જે કેળવણીનો વિચાર કર્યો તે પૃથ્વી ઉપર જન્મેલા બાળકો માટેની કેળવણી છે, અને તે સર્વ બાળકોને આપી શકાય તેમ છે. આ કેળવણી કેવળ માનવ પ્રકારની શક્તિઓનો જ વિચાર કરે છે. પરંતુ આપણે અહીંથી જ અટકી જવાની જરૂર નથી. દરેક મનુષ્યની અંદર, તેના સામાન્ય જીવનમાં વ્યક્ત થતી ચેતના કરતાં પણ એક વિશેષ મહાન ચેતનાની શક્યતા ગુપ્ત રીતે આવી રહેલી હોય છે. એ બૃહત્ ચેતના દ્વારા માણસ એક વધુ ઉચ્ચ અને વધુ વિશાળ જીવનની અંદર ભાગ લેતો થઈ શકે છે. અને હડીકત પણ એવી છે કે, જગતની અંદર જે જે અસાધારણ વ્યક્તિઓ થયેલી છે તેમના જીવનમાં આ બૃહત્ ચેતના જ હુમેશાં મુખ્ય ભાગ ભજવતી હોય છે. તેમના જીવનનું નિયંત્રણ એ ચેતના જ કરતી હોય છે, તેમ જ તેમના જીવનની જે પરિસ્થિતિ હોય છે અને એ પરિસ્થિતિ પ્રત્યે તે વ્યક્તિઓ જે પ્રત્યાઘાત આપતી હોય છે તેનું નિર્માણ પણ એ જ ચેતના કરતી રહે છે. માનવનું મન સામાન્ય રીતે જે વસ્તુઓ જાણતું નથી હોતું તેમ જ કરી શકતું નથી હોતું તે વસ્તુઓ આ ચેતના જાણતી હોય છે અને કરી શકતી હોય છે. એ ચેતના જાણે કે એક જ્યોતિની માફક આપણા સ્વરૂપના કેન્દ્રની અંદર બેઠેલી છે અને આપણી બાધ્ય ચેતનાનાં ગાઢ આવરણ ભેદીને તે પોતાનો પ્રકાશ રેલાવતી રહે છે. કેટલાક માણસોને આ ચેતનાની હાજરીનો ઝાંખોપાંખો ખ્યાલ હોય છે પણ ખરો. ઘણાએક બાળકો પણ આ ચેતનાના પ્રભાવ હેઠળ આવી રહેલાં હોય છે. એ બાળકો કુદરતી રીતે જે વર્તન કરતાં હોય છે તેમાં, તેમ જ તેમના શબ્દોમાં પણ એ ચેતના કેટલીક વાર બહુ સ્પષ્ટ રીતે પ્રગટ થતી દેખાય છે. દુઃખની વાત એ છે કે માબાપોને આ વસ્તુ વિષે કશું જ જ્ઞાન નથી હોતું. પોતાનાં બાળકોની અંદર શું થઈ રહેલું છે તેની તેમને કશી જ સમજ નથી હોતી, અને તેથી બાળકોના આવા વિલક્ષણ વર્તનને તેઓ આનંદપૂર્વક જીલી શકતાં નથી. તેઓ બાળકને જે કાંઈ કેળવણી આપે છે તેમાં તેઓ બાળકને આ અસાધારણ વસ્તુ પ્રત્યે બને તેટલું અભાન જ બનાવી મૂકે છે. આ કેળવણી બાળકનું બધું ધ્યાન બાધ્ય વસ્તુઓ ઉપર જ એકાગ્ર કરે છે અને એ રીતે બાળકની અંદર એક એવી તો ટેવ પાડે છે કે જેથી બાળક કેવળ એ બાધ્ય વસ્તુઓને જ અગત્યની ગણવા લાગે છે. બાધ્ય વસ્તુઓ ઉપર ધ્યાન એકાગ્ર કરવામાં આવે એમાં ખોટું તો કશું જ નથી. એ પણ એક ઘણી ઉપયોગી વસ્તુ છે. પરંતુ તે કાર્ય પણ સાચી રીતે કરવાનું રહે છે. આપણે ઉપર શરીર, ગ્રાણ અને મનની જે ત્રિવિધ કેળવણીનો વિચાર કરી

ગયા એને વિષે એમ કહી શકાય કે એ કેળવણી બાળકના વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટેની એક સામગ્રી પૂરી પાડે છે, વ્યક્તિને તે તેના અવચેતન તત્ત્વના કશા ઘાટઘૂટ વિનાની અવસ્થામાંથી ઉંચે ઉઠાવે છે અને તેને એક સુરેખ આકારવાળો આત્મ-જ્ઞાનયુક્ત માનવ બનાવી આપે છે. અંતરાત્માની કેળવણીમાં હવે આપણી સમક્ષ એક નવો વિષય આવીને ઊભો રહે છે. જીવનનું સાચું લક્ષ્ય શું હોઈ શકે, પૃથ્વી ઉપર આપણી હસ્તી થયેલી છે તેનું પ્રયોજન શું હશે, આ જીવનમાં આગળ જતાં જતાં આપણને કઈ વસ્તુ જરી આવશે, એ તત્ત્વ જડવાને અંતે તેનાં શાં શાં પરિણામ આવશે, અને તેને અંતે વ્યક્તિ છેવટે પોતાના શાશ્વત તત્ત્વને પોતાનું કેવું તો સર્માણ કરશે આવા આવા પ્રશ્નો હવે આપણા વિચારનો અને સંશોધનનો વિષય બની રહે છે. જીવનના આ શાશ્વત-તત્ત્વની સાધના સાથે સામાન્ય રીતે એક ગુદ્ધ રહુસ્યનો ભાવ, ધાર્મિકતાનો ભાવ જોડાયેલો રહેલો છે. પરંતુ આ તત્ત્વનું સંશોધન આ રીતે જ થવું જોઈએ એવું કાંઈ નથી. પરમાત્મા વિષેની જે ગૂઢ રહુસ્યમય ભાવના છે તેને સ્થાને આપણે સત્ય વિષેની એક વધુ દાર્શનિક પ્રકારની તત્ત્વ પ્રધાન વિચારણાનો આશ્રય લઈ શકીએ છીએ અને એમ કરીશું તોપણ આપણને એ રીતે જે તત્ત્વ પ્રાપ્ત થશે તે તેના અસલ રૂપે તો તેનું તે જ હશે. આ પદ્ધતિમાં વિશેષ લાભ એ રહેલો છે કે ગમે તેવો કંઈ વાસ્તવવાદી પાણ આ પદ્ધતિને અજમાવી શકે છે. આપણે જ્યારે આંતર જીવનની રચના કરવાનું કાર્ય હાથ લઈએ છીએ ત્યારે તેમાં માનસિક ઘ્યાલોનું તેમ જ વિચારોનું મહત્ત્વ બહુ ગૌપણ બની જાય છે. આ આંતર જીવનમાં જે ખરી મહત્ત્વની વસ્તુ છે તે તો અનુભૂતિ છે. આપણે એ આંતર તત્ત્વની અનુભૂતિમાં પહોંચવાનું છે, એની અનુભૂતિને જીવનમાં સક્રિય કરવાની છે. આ અનુભૂતિ આપણને પ્રાપ્ત થાય તે સમયે, યા તો તે પૂર્ણે કે તે પછી આપણે ભલે ગમે તે તત્ત્વ, સિદ્ધાંત કે વાદનો આશ્રય લઈએ, પરંતુ આ અનુભૂતિમાં આ બધા વાદથી તદ્દન સ્વતંત્ર એવી એક તેની આગવી વાસ્તવિકતા, એક આગવી શક્તિ રહેલી છે. આનું કારણ એ છે કે આ રીતના બધા સિદ્ધાંતો અને વાદો એ તો એક પ્રકારના માત્ર ખુલાસા જ છે, અને આપણે કંઈક જાણીએ છીએ એ રીતનો એક વતો ઓછો ભ્રમ આપણી અંદર ઊભો કરવા માટે જ આપણે તેનો આશ્રય લઈએ છીએ. માણસ પોતે જે કોઈ આદર્શની યા તો પરમ તત્ત્વની શોધ માટે નીકળે છે તેને તે જુદાં જુદાં નામોના અંચળા ઓફાડે છે. તે જે પરિસ્થિતિમાં જન્મેલો હોય છે, તેને જે રીતની કેળવણી મળેલી હોય છે તે અનુસાર તે આ બધાં નામો પાડે છે. પરંતુ આ બધાં બિન્ન બિન્ન નામોનો આશ્રય લેવા છતાં માણસને જે અનુભૂતિ થાય છે, તે જો સાચા પ્રકારની હોય છે તો સર્વત્ર તે તત્ત્વ રૂપે તો એકસરખી જ હોય છે. એ અનુભૂતિને પછી જે શબ્દો દ્વારા કે વાણી

દ્વારા રજૂ કરવામાં આવે છે તેમાં જ માત્ર બેદ બની આવે છે. વાણીના અને શબ્દોના આ બેદો વ્યક્તિને જે રીતની કેળવણી મળી હોય છે, તેમ જ તેની જે માન્યતાઓ બંધાયેલી હોય છે તે અનુસાર સરજાય છે. આ આંતર અનુભૂતિને જે શાફદેહ આપવામાં આવે છે તે તો મૂળ તત્વની કંઈક નજીક જતો તે વિશેનો કંઈક દીશારો જ હોય છે. એમાં આપણે માત્ર એટલી જ અપેક્ષા રાખવાની રહે છે કે અનુભૂતિ પોતે જેમ જેમ વધુ ચોક્કસ રૂપ લેતી જાય, તે જેમ જેમ વધુ સમન્વય રૂપ બનતી જાય તેમ તેમ તેનો આ વાંદેહ પણ તેની સાથે સાથે પ્રગતિ કરતો રહે અને વિશેષ સમૃદ્ધ થતો રહે. આમ છતાં, આપણે જ્યારે આ અંતરાત્માની કેળવણીની એક સામાન્ય રૂપરેખા આપવા નીકળ્યાં છીએ તો પછી આ અંતરાત્મા તે શું છે તે વિષે આપણે, ભલે એક સાપેક્ષ રીતનો પણ કંઈક ઘ્યાલ તો મેળવવાનો રહે છે જ. તો અંતરાત્માને વિષે આપણે કંઈક આ પ્રમાણે કહી શકીએ. આ વિશ્વમાં વ્યક્તિનું જે સર્જન થયેલું છે તે વિશ્વના આદિ મૂળમાં રહેલા એક પરમ તત્વનો જ આવિર્ભાવ છે. આ અભિલ વિશ્વના આવિર્ભાવના મૂળમાં રહેલા તે પરમ તત્વમાં અનેક ગ્રાકારની શક્યતાઓ ગૂઢ રૂપે રહેલી હતી. એ શક્યતાઓમાંની એક શક્યતા કાલ અને સ્થલની અંદર પ્રક્ષેપ પામી, તેણે પછી એક અદ્ભુત રૂપ વિશ્વ-ચેતનાનું રૂપ લીધું, અને તે વિશ્વ-ચેતના મારફતે તે આદિ તત્વ વ્યક્તિ રૂપે પ્રગત થયું, તે એક વ્યક્તિના સત્ય રૂપે, વ્યક્તિના ધર્મ રૂપે મૂર્ત થયું, અને એવા વ્યક્તિ રૂપમાંથી આગળ વૃદ્ધિ પામતાં પામતાં કમે કમે તેણે વ્યક્તિના આત્મા તરીકેનું યા તો ચૈત્ય પુરુષનું — અંતરાત્માનું રૂપ ધારણ કર્યું.

બેશક, અહીં આ જે નાનકું વર્ણન હું આપું છું, તેમાં વસ્તુસ્થિતિનું સંપૂર્ણ નિરૂપણ આવી જાય છે, આ બાબતમાં હવે કંઈ કહેવાનું રહેતું નથી એમ તો નથી જ. આ માત્ર એક વ્યવહારુ ઉપયોગ માટેની સાર રૂપ સમજૂતી છે, આપણે જે વિષય હાથ લીધો છે તેને વિચારણામાં આપણને આધાર મળી રહે તેટલા પૂર્તી જ વસ્તુ અહીં કહી છે.

માણસને તેના જીવનમાં પોતાની અંદર આવી રહેલા ગૂઢ સત્યનો સંગમ અંતરાત્મા કરાવી આપે છે. ઘણાખરા માણસોની બાબતમાં આ અંતરાત્મા કહો કે પડા પાછળ રહીને, તેમનાથી અજ્ઞાન્યો અને આણપ્રીષ્યો રહીને જ કામ કરે છે. પરંતુ કેટલાકની બાબતમાં એની હાજરી દેખી શકાય તેવી હોય છે, તેનું કાર્ય સમજી શકાય તેવું હોય છે. વળી આવા માણસોમાં પણ અમુક માણસ પાછા એવા હોય છે જેમનામાં તો એ અંતરાત્મા બહુ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવો હોય છે, તેમ, જ તેનું કાર્ય પૂરેપૂરું અસરકારક હોય છે. આવા પુરુષો પોતાના જીવનમાં એક દૃઢ વિશ્વાસપૂર્વક આગળ વધે જાય છે. પોતાનું ભાવિ તેઓ પોતે જ ઘડી શકે છે,

પોતે જ પોતાનો ભાગ્યવિધાતા બની શકે છે. અંતરાત્માંથી પ્રાપ્ત થતું આ પ્રભુત્વ આપણે મેળવી શકીએ, તેની હાજરી વિષે આપણે જાગૃત થઈ શકીએ એટલા માટે જ આ અંતરાત્માની કેળવણીની આવશ્યકતા રહે છે.

આ કેળવણી માટે એક વસ્તુ ખાસ અગત્યની છે. એ છે વ્યક્તિનો પોતાનો અંગત સંકલ્પ. અત્યાર સુધી એમ બનતું આવેલું છે કે કેળવણીના એક વિષય તરીકે અંતરાત્માનો સ્વીકાર કરી થયેલો નથી. અંતરાત્માને પ્રાપ્ત કરવો, તેની સાથે તાદાત્મ્ય સિદ્ધ કરવું, એ વિષય કેળવણીની અંદર હજી સુધી આવેલો નથી. હા, આ વિષય પરતે કેટલાક ખાસ ગ્રંથોમાં ઉપયોગી તેમ જ વ્યવહારું સૂચનાઓ મળી આવે છે ખરી. વળી કેટલાક નસીબદાર માણસોને એવી સમર્થ વ્યક્તિઓનો બેટો પણ થઈ જાય છે કે જેઓ તેમને આ વિષયમાં માર્ગ બતાવી શકે છે અને એ માર્ગ આગળ ધપવામાં જોઈતી સહાય પણ આપી શકે છે. આમ હોવા છતાં મોટા ભાગે સ્થિતિ એવી છે કે આ દિશામાં વ્યક્તિએ પોતાની જાતે જ આરંભ કરવાનો રહે છે. આ તત્ત્વની ગ્રાપિતનું કામ એ વ્યક્તિનું પોતાનું જ કામ રહે છે. આ ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યક્તિએ પોતે એક મહાન નિશ્ચય કરવાનો રહે છે, એક પ્રબળ, સંકલ્પશક્તિ કેળવવાની રહે છે, અને એક અખૂટ ખંતથી તેમાં મચ્યા રહેવાનું રહે છે. આમ, આપણે કહી શકીએ કે આ વિષયમાં દરેક વ્યક્તિએ પોતાની આગવી મુશ્કેલીઓમાંથી પોતાનો આગવો માર્ગ રચી લેવાનો રહે છે. આ ધ્યેય શું છે એ વાત તો થોડીધારી સર્વને સુવિદ્ધિ રહે છે. આ ધ્યેય સિદ્ધ કરનાર પુરુષોમાંથી ઘણાખરાઓએ એ વસ્તુને ઘણુંખરું સ્પષ્ટ રીતે કહી બતાવી પણ છે પરંતુ આ ધ્યેયને સિદ્ધ કરવાનો પરમ આનંદ તો એમાં છે કે એ સાધના વ્યક્તિ પોતે જ શરૂ કરે, એ સાધના આપોઆપ જ શરૂ થાય, અને તે સાચા દિલથી શરૂ થાય. અને આ વસ્તુ એવી છે કે જેને કોઈ પણ રીતના સામાન્ય માનસિક નિયમોની અંદર બાંધી નહિ શકાય. અને તેથી આ બાબતમાં એવું બને છે કે જે કોઈને આ સાહસ ખેડવાનું મન થાય છે તે સામાન્ય રીતે પ્રથમ તો એવા કોઈ પુરુષને ખોજી લે છે કે જેણે આ સાહસ સફળ રીતે સિદ્ધ કર્યું હોય, અને જે તેને સહાય આપી શકે તેમ હોય તથા માર્ગ બતાવી શકે તેમ હોય. આમ છતાં આ વિષયમાં કેટલાક એકલાપંથી, એકલરામ પ્રવાસીઓ પણ હોવાના અને તેવાઓને માટે ઉપયોગી નીવડે તેવાં થોડાંક સર્વસામાન્ય સૂચનો અહીં આપીશું.

આ વિષયમાં પ્રથમ તો તમારે તમારી પોતાની અંદર એવું તત્ત્વ શોધવાનું છે જે તમારા શરીરથી, તમારા જીવનની પરિસ્થિતિથી તદ્દન સ્વતંત્ર જ છે. એ તત્ત્વ, તમારા મનને જે ઘાટ મળેલો છે તેમાંથી કાંઈ જન્મતું નથી. તમે જે ભાષા બોલો છો, તમારી આસપાસના વાતાવરણમાં જે રૂઢિઓ અને રિવાજો હોય છે, તમે જે

દેશમાં જન્મ્યા હો છો, તમે જે યુગમાં આવેલા હો છો તે બધાથી તે એક નિરાણું સ્વતંત્ર તત્ત્વ છે. એ તત્ત્વ કંઈ આ બધામાંથી જન્મતું નથી. તમારી અંદર, તમારા સ્વરૂપની અંદર ઊર્ઝ ઊર્ઝ એક એવું તત્ત્વ આવેલું છે કે જે વિશ્વરૂપતાથી ભરેલું હોય છે, જેના વિસ્તારને કશી મર્યાદા હોતી નથી. અને જેનું સાતત્ય અખંડ અને નિરવધિ રીતે ચાલ્યા કરતું હોય છે. એ તત્ત્વને તમારે શોધી લેવાનું રહે છે. આ તત્ત્વ પ્રાપ્ત કર્યા પછી તમે હવે તમારી જાતને તમારા કેન્દ્રમાંથી બહાર ફેલાવવાનું કાર્ય શરૂ કરો, તમારી જાતનો તમે વિસ્તાર કરતા થાઓ, તેને વિશાળ કરતા થાઓ. એમ કરતાં તમે હુરેક વસ્તુની અંદર, સર્વ પ્રાણીઓની અંદર નિવાસ કરવા લાગશો, વ્યક્તિઓને એકબીજાથી છૂટા પાડી રહેલી દીવાલો હવે ટૂટવા લાગશે. તમે અન્ય લોકોના ચિત્તમાં પ્રવેશી તેમના ચિત્તની અંદર વિચાર કરવા લાગશો, તેમનાં સંવેદનોના ધબકરામાં ધબકવા લાગશો, તેમની લાગણીઓને તમે અનુભવવા લાગશો, તમે સર્વના જીવનમાં જીવતા થઈ જશો. અત્યાર સુધી જે કોઈ વસ્તુ નિર્ઝિય દેખાતી હતી તે હવે એકાએક જીવનથી સભર બની જાય છે, પથ્થરોમાં પ્રાણ પ્રગટવા લાગે છે, વનસ્પતિ હવે સંવેદન જીલતી બને છે, તેનામાં સંકલ્પ જાગે છે, તે વ્યથા અને હર્ષ અનુભવવા લાગે છે. પ્રાણીઓ હવે બોલવા લાગે છે. એમની વાણી એ ઘણું ખરું મૌનની વાચા હોય છે તો પણ તે સ્પષ્ટ હોય છે, પોતાને કહેવાનું કહી શકતી હોય છે. હવે હુરેક વસ્તુ સ્થળ અને કાલથી મુક્ત અને પર એવી એક અદ્ભુત ચેતનાથી ધબકવા લાગે છે. અંતરાત્માના સાક્ષાત્કારની આ તો માત્ર એક જ બાજુ છે. એ સાક્ષાત્કારનાં આ સિવાય પણ બીજાં ઘણાં સ્વરૂપો છે. આ બધા સાક્ષાત્કારો તમને તમારા અહંકારના વાડામાંથી બેંચીને બહાર લઈ જશો, તમારા બાધ્ય વ્યક્તિત્વની દીવાલોમાંથી તમને બહાર લઈ જશો. તમારા આધાત પ્રત્યાધાતોમાં રહેલી નિર્ભળતાને, તમારા સંકલ્પમાં રહેલી અશક્તિને તે નિવારી આપશો.

પરંતુ હું જણાવી ગઈ છું કે આ સાક્ષાત્કારમાં પહુંચ્યવાનો માર્ગ લાંબો છે, વિકટ છે. એ માર્ગ ઉપર અનેક ફંડાઓ, અનેક પ્રશ્નો પેલા છે. એ બધાને પહુંચ્યો વળવા માટે તમારે હુરેક કસોટી અને પરીક્ષામાં ટકી શકે તેવા નિશ્ચય-બળની જરૂર રહેશે. કોઈ અજાણ્યા મુલકની શોધ માટે કોઈ સાહસિક પ્રવાસી ગાઢ જંગલોને વીંધતો વીંધતો પ્રવાસ ડે, કોઈ મહાન પ્રદેશની શોધ આરંભે તેના જેવું આ છે. અંતરાત્માને પ્રાપ્ત કરવો એ પણ એક આવી જ મહાન શોધ આદરવા જેવું છે. નવા ખંડોની શોધખોળ માટે જે ધીરજ અને સહનશક્તિની જરૂર પડે છે તેવી જ ધીરજ અને સહનશક્તિ અહીં પણ જરૂરનાં છે. આ શોધ આદરવાનો જેમણે નિશ્ચય કર્યો હશે તેવા પ્રવાસીઓ માટે સલાહના શખ્દો ઉપયોગી નીવડશો. આ રહ્યા એ થોડાક શખ્દો.

તમારે પ્રથમ તો એ યાદ રાખવાનું છે કે આધ્યાત્મિક વસ્તુઓનો નિર્ણય તમે મન દ્વારા કદી પણ કરી શકવાના નથી. એ એક અશક્ય વસ્તુ છે, અને આ મુદ્દો તમારે કદી પણ ભૂલવાનો નથી. જેમાણે જેમારે યોગ વિષે કંઈ લઘ્યું છે તે સૌઅં આ વસ્તુ કહેલી છે. પરંતુ આનો અમલ બહુ થોડાકે જ કર્યો છે. તેમ છતાં, તમારે આ માર્ગમાં આગળ વધવું હશે તો તમે કોઈ પણ પ્રકારનો માનસિક નિર્ણય ન લો, માનસિક અભિપ્રાય ન બાંધો, અને મનોમય રીતનો પ્રત્યાધાત ન સેવો એ અત્યંત આવશ્યક છે.

તમારા અંગત આરામ માટેની, અંગત ઈચ્છાની તૃપ્તિની, આનંદવિનોદની કે સુખોપલોગની હુરેક રીતની ઝંખના તજી દો. તમારી ઝંખના માત્ર એક જ હોવી જોઈએ: પ્રગતિ. એ ઝંખનાનો અજીન તમારા અણુએ અણુમાં સળગી ઊઠવો જોઈએ. તમને જે કંઈ વસ્તુ મળી આવે તેને તમારી પ્રગતિમાં એક મદદ તરીકે ગણી લો અને તમારે કરવાની પ્રગતિ એકદમ કરી લો.

તમે જે કંઈ કરતા હો તે બધામાં આનંદ લેવાનો પ્રયત્ન કરશો. પરંતુ કોઈ પણ ચીજ આનંદને ખાતર ન કરશો.

કદી પણ ઉષ્ટેરાઈ ન જશો, ગભરાઈ ન જશો, મૂંજાઈ ન જશો. હરકોઈ પરિસ્થિતિમાં, તમામ પરિસ્થિતિમાં સંપૂર્ણ શાંત રહેણે. અને છતાં હમેશાં જગૃત રહી એ વસ્તુ જાણી લેજો કે તમારે હજુ કેટલી પ્રગતિ કરવાની છે અને એ પ્રગતિ કરી લેવામાં લેશ પણ વખત ગુમાવશો નહિ.

બાધ બનાવોને તે દેખાય છે તે રીતના કદી સમજશો નહિ. એ બનાવો તો કોઈ એક બીજી વસ્તુને જ પ્રગટ કરવા માટેના એક કંઠંગા પ્રયત્ન જેવા હમેશાં હોય છે. અનું પાછળાનું સત્ય કંઈ જુદું જ હોય છે અને તમારી ઉપરછદ્દી સમજશક્તિની પકડમાં ભાયે જ આવે છે.

કોઈના પણ વર્તન વિષે કદી પણ ફરિયાદ ન કરશો. એ માણસની પ્રકૃતિ જે કારણે આ પ્રમાણે વર્તન કરતી હોય છે તે વસ્તુને બદલી શકવાની તમારામાં શક્તિ હોય તો જ ફરિયાદ કરવી. અને જો તમારામાં એવી શક્તિ હોય તો તો પછી એ ફરિયાદ કરવાને બદલે એ માણસને જ બદલી નાખો.

તમે ગમે તે કામ કરો, પરંતુ તમારી સમક્ષ તમે જે લક્ષ્ય રાખેલું છે તે કદી ન ભૂલશો. તમે આ જે મહાન શોધ હાથ ધરી છે તેની સાધનાની અંદર કોઈ પણ વસ્તુ મોટી નથી કે નાની નથી. એમાં હરેક વસ્તુ એકસરખા મહત્વની છે. અને તમારી સાધનાની વિજય તરફની ગતિને તે વધારી શકે છે, યા તો ઘટાડી શકે છે. આ રીતે જોતાં તમે જ્યારે જમવા બેસો ત્યારે શરૂઆતમાં થોડીક ક્ષાળો ધ્યાનમાં એકાગ્ર થજો અને રીતની અભીષ્ટા કરજો કે તમે જે ખોરાક લેવાના છો તેમાંથી તમારા

શરીરને માટે જરૂરી એવી બધી સામગ્રી મળી રહે. એ ખોરાક તમારા મહાન ધ્યેયની સાધના માટે શરીરને એક નક્કર આધાર રૂપ બનાવી આપે અને એ સાધનામાં સતત ટકી રહેવાની તેમ જ અંદર ખંતની શક્તિ તમને આપે.

તમે રાત્રે સૂવા જાઓ તે પહેલાં પણ થોડીક ક્ષાણો તમે ધ્યાનમાં એકાગ્ર થજો અને એ રીતની અભીષ્ટા કરજો કે તમારી નિદ્રા તમારા થાકેલા જ્ઞાનતંતુઓને પાછા તાજા કરી આપે, તમારા મગજને શાંતિ અને સ્વસ્થતા આપે, અને જગૃત થયા પછી તમે પાછા નવી શક્તિથી સજજ બનીને તમારા મહાન ધ્યેય પ્રત્યેની તમારી યાત્રા ફરી પાછી શરૂ કરી શકો.

તમે કાંઈ પણ કર્મ કરો તે પહેલાં એકાગ્ર બનીને એ સંકલ્પ કરશો કે તમારું એ કર્મ તમારા મહાન ધ્યેય પ્રત્યેની તમારી કૂચની અંદર તમને મદદ રૂપ થઈ પે, અથવા તો એ આ કૂચમાં વિઘ્ન રૂપ તો ન જ થાય.

તમે કાંઈ પણ બોલો, તમારા મૌંનાંથી શબ્દો બહાર આવે તે પહેલાં ઘડીભર એકાગ્ર થઈને તમે જે કાંઈ બોલવાના હો તે શબ્દોની જરા તપાસ કરી લેશો, અને તમારા મહાન ધ્યેયના માર્ગે પ્રગતિ કરવા માટે અત્યંત જરૂરના હોય, અને બીજી કોઈ પણ રીતે તમારી પ્રગતિને હાનિકારક ન હોય એટલા શબ્દો જ તમે બહાર આવવા દેશો.

ટૂંકમાં, તમારા જીવનનો હેતુ, તમારા જીવનનું લક્ષ્ય તમે કદી પણ વીસરશો નહિ. આ મહાન તત્ત્વની પ્રાપ્તિ માટેનો મહા સંકલ્પ, પ્રકાશના કોઈ મહા પક્ષી જેવો, તમારા ઉપર હમેશા ધૂમતો રહેવો જોઈએ. તમે જે કાંઈ કરતા હો, તમે જે કોઈ અવસ્થામાં હો, તમારી સર્વ કિયાઓ ઉપર એ ધ્યેય રૂપી મહા ગરુડ પોતાનો પડછાયો પાથરતો સદાયે ચક્કર લગાવતો રહેવો જોઈએ.

આમ તમારી સાધનામાં તમે અંદર ખંતથી મચેલા રહેશો ત્યારે એક દિવસ તમારી અંદરનું દ્વાર એકાએક જ ખૂલ્લી જશો અને તમે એક જળહળતા પ્રકાશમાં પહોંચ્યી જશો. એ પ્રકાશમાં તમને અમૃતત્વની એક પાકી ખાતરીભરી અનુભૂતિ થશે, તમને એક એવી સધન અનુભૂતિ મળશે કે તમે જગતમાં હમેશાં રહેલા છો અને હમેશાં રહેવાના છો. તમે જોશો કે જે નાશ પામે છે તે તો માત્ર બાધ્ય રૂપો જ હોય છે. તમારા સાચા વાસ્તવિક સ્વરૂપની સાથે સરખાવતાં આ રૂપો એ તો માત્ર વસ્ત્રો જેવાં હોય છે, એ જ્યારે ઘસાઈ જાય છે ત્યારે એમને ફેંકી દેવાનાં જ હોય છે. આવી અનુભૂતિ થયા પછી તમે બંધન માત્રમાંથી મુક્ત બનીને ટટાર ઊભા રહેશો. તમારી પ્રકૃતિએ તમારા ઉપર લાદેલી અને તમે કચ્છાઈ જવા ઈચ્છતા ન હોઈ તમે સહી લીધેલી તેમ જ વેઠેલી પરિસ્થિતિઓના બોજ હેઠળ કષ્યપૂર્વક આગળ વધવાને બઢલે, તેમ હવે ટટાર અને દૃઢ પગલે તમારા ભાવ વિષે સભાન બનીને, તમારા

જીવનના સ્વામી બનીને આગળ વધી શકશો.

અને છતાં સ્થૂલની આ સર્વ ગુલામીમાંથી, હરેક પ્રકારની અંગત આસક્તિમાંથી તમને આ જે મુક્તિ મળે છે એમાં જ કાંઈ તમારી છેવટની સિદ્ધ આવી જતી નથી. તમે પરમ સત્યના શિખરે પહોંચો તે પૂર્વે તમારે હજ બીજાં પણ પગથિયાં સર કરવાનાં છે. અને એ પગથિયાં પછી પણ બીજાં આગળનાં પગથિયાં હોઈ શકે છે, અને હોવાં પણ જોઈએ. એ પગથિયાં ભાવિનાં દ્વાર ખોલી આપશો. આ આગળનાં પગથિયાંની ચર્ચા હું જેને આધ્યાત્મિક કેળવણી કહું છું તેમાં હવે આવશે.

પરંતુ આ નવા પ્રદેશમાં આપણે પ્રવેશ કરીએ અને આ પ્રશ્નનો વિચાર વિગતપૂર્વક હાથ લઈએ તે પહેલાં એક ખુલાસો કરી લેવો જરૂરી છે. આપણે અત્યાર સુધી આ જે અંતરાત્માની કેળવણીનો વિચાર કર્યો અને હવે જે આધ્યાત્મિક કેળવણીનો વિચાર કરીશું તે બે વચ્ચે ભેદ શા માટે કરવામાં આવે છે? સામાન્ય રીતે તો આ બેચ વસ્તુઓને ‘યોગ’ના એક સામાન્ય નામ હેઠળ જ ભેગો કરી દેવામાં આવે છે. પરંતુ આ બેના લક્ષ્યની વચ્ચે ઘણો ફેર રહેલો છે. અંતરાત્માની કેળવણી એ પૃથ્વી ઉપર જ એક અતિ ઉચ્ચ સાક્ષાત્કારને સિદ્ધ કરવા માગે છે, તો આધ્યાત્મિક કેળવણી પૃથ્વી ઉપરના સર્વ આવિર્ભાવમાંથી, કહો કે, સારાએ વિશ્વમાંથી છૂટીને દૂર દૂર ચાલી જવા માગે છે. એને તો આ વ્યક્ત જગતમાંથી છૂટી પાછા અવ્યક્ત તત્ત્વમાં પહોંચવું હોય છે.

આ રીતે આપણે કહી શકીએ કે અંતરાત્માનું જીવન એ અમૃતત્વનું જીવન છે, અનંત એવા કાલ અને અવકાશની અંદર, તે સદાએ પરિવર્તન પામતું પામતું આગળ વધે છે, અને રૂપોની આ સૃષ્ટિની અંદર પોતાનું એક અખંડ સાતત્ય ટકાવી રાખે છે. આથી ઊલદું, આધ્યાત્મિક જીવન કાલ અને સ્થળથી પર ચાલી જવા માગે છે, પોતાની જાતને તે સારીએ સૃષ્ટિમાંથી બહાર ખેંચી લઈ તે અનંત અને શાશ્વત એવા તત્ત્વમાં પોતાને સ્થિત કરી લે છે. તમારા અંતરાત્માનો પૂર્ણ સાક્ષાત્કાર કરવા માટે, અંતરાત્માના જીવનમાં પહોંચવા માટે તમારે તમારી અંદરના સર્વ સ્વાર્થભાવનો નાશ કરી નાખવાનો રહે છે, જ્યારે આધ્યાત્મિક જીવનમાં પહોંચવા માટે સ્વથી કેવળ પર થઈ જવાનું રહે છે.

આધ્યાત્મિક કેળવણીમાં પણ એવું બને છે કે, તમે જે પરિસ્થિતિમાં મોટા થયા હશો, તમે જે માર્ગનો આશ્રય લીધો હશો, તેમ જ તમારા સ્વભાવને જે વસ્તુઓ અનુકૂળ હશે તે મુજબ તમે તમારા લક્ષ્યને, તમારા મન દ્વારા તેને સમજવા માટે, જુદાં જુદાં નામો આપશો. તમારામાં જો ધાર્મિક રીતનું વલણ હશે તો આ લક્ષ્યને તમે પ્રભુના નામે ઓળખાવશો. તમારી આધ્યાત્મિક સાધના જગતના પ્રત્યેક રૂપમાં

વસતા અંતર્યાંભી પરમાત્માના સાક્ષાત્કાર તરફ નહિ વળશે, પણ તમે સર્વ રૂપોથી પર આવેલા વિશ્વાતીત પરમાત્મા સાથે તાદાત્મ્ય મેળવવા પ્રયત્ન કરશો. કોઈ બીજા લોકો આ લક્ષ્યને કેવળ બ્રહ્મ, પરમ આદ્ય તત્ત્વ એવું નામ આપશો, તો બીજા કોઈ વળી તેને નિર્વાણ કહીને ઊભા રહેશે. આ જગતને મિથ્યા આભાસ તરીકે વર્ણવતા વેદાંતીઓ તત્ત્વને જ જગતનું એકમાત્ર સત્ય ગણશે. આખું વિશ્વ કેવળ અસત્ય છે એમ આ માનનારા લોકો એને જ એકમાત્ર લક્ષ્ય તરીકે વર્ણવશે. આ દરેક વ્યાખ્યામાં સત્યનો કંઈ ને કંઈ અંશ તો રહેલો છે જ, પરંતુ એ બધી વ્યાખ્યાઓ અધૂરી છે, સત્યનું તેમાં માત્ર એક જ પાસું આવે છે. આ વિષયમાં પણ માનવમને રચેલી વિચારશૈલીનું કાંઈ બધું મહત્ત્વ રહેતું નથી. એ મૂળ તત્ત્વમાં પહોંચવાનાં આ વચ્ચાં પગથિયાં એક વાર વટાવી ગયા પછી સૌને હમેશાં એક જ પ્રકારની અનુભૂતિ થવાની. આમ આ લક્ષ્યને તમે ભલે ગમે તે રીતનું નામ આપો, પરંતુ હરેક સાધકે આ વિષયની સાધનાનો આરંભ આત્મસમર્પણથી કરવાનો રહે છે. તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટેનું પ્રસ્થાન-બિંદુ તે આ જ છે, તેમ જ તમારું લક્ષ્ય સાધવા માટેની સૌથી વધુ અસરકારક અને જડપી પ્રકૃતિ પણ આ જ છે — આત્મસમર્પણ. વળી એ પણ એક હકીકત છે કે તમારી કલ્પનાએ પોતાનું જે ઉચ્ચયમાં ઉચ્ચ ધ્યેય નક્કી કર્યું હોય — કેટલાકની બાબતમાં આ ધ્યેય પ્રબુ વિષેના એક વિચારનું રૂપ લે છે કેટલાકને માટે તે પૂર્ણતાની એક કલ્પના બની રહે છે — તેને તમે તમારું પૂર્ણ આત્મ-સમર્પણ કરો તેમાં રહેલા આનંદ જેવો પૂર્ણ આનંદ પણ જગતમાં બીજો કોઈ નથી. આ સમર્પણ જો એક અખંડ ઉત્સાહપૂર્વક અને સતત રીતે ચાલુ રહેશે તો પછી એક ક્ષણ એવી આવશે કે જ્યારે તમે, તમે પોતે બાંધેલા આ વિચારથી ઉપર ચાલ્યા જઈને એક તાત્ત્વિક અનુભૂતિમાં પહોંચશો. એ અનુભૂતિ જો કે શબ્દોથી તો વર્ણવી શકાય તેવી નથી, તો પણ તેનાથી સાધકો ઉપર જે અસર પેડ છે તે હમેશાં લગભગ એકસરખી જ હોય છે. તમારું સમર્પણ જેમ જેમ વધુ સંપૂર્ણ, વધુ સમગ્ર થતું જશો, તેમ તેમ તમારા સમર્પણના આ પરમ આરાધ્ય તત્ત્વ સાથે એકરૂપ થવા માટે, તેમાં સંપૂર્ણપણે ઓગળી જવા માટે તમારામાં અભીષ્ટા જગવા લાગશે. એ અભીષ્ટા ધીરે ધીરે હરેક પ્રકારના ભેદોને, હરેક પ્રકારનાં વિઘ્નોને જીતી લેશે. અને એ અભીષ્ટામાં જો વળી એક આપોઆપ જન્મતો તીવ્ર પ્રેમભાવ ઉમેરાયો હશે તો તો પછી તમારી સાધના સંપૂર્ણ રીતે અવશ્ય સફળ થશે. એની વિજયકૂચને કોઈ પણ રોકી શકશે નહિ.

આ રીતની આધ્યાત્મિક પ્રકારની એકરૂપતા અને અંતરાત્મા સાથેની એકરૂપતા એ બે વચ્ચે એક ખૂબ જ પાયાનો તફાવત રહેલો છે. અંતરાત્મા સાથેનું તાદાત્મ્ય તમે વધુ ને વધુ સ્થાયી પ્રકારનું બનાવી શકો છો, અને અમુક વ્યક્તિઓની બાબતમાં

તો એ તાદાત્મ્ય સંપૂર્ણ રીતે કાયમનું થઈ રહે છે. આ તાદાત્મ્યનો સાક્ષાત્કાર કરનાર વ્યક્તિ પછી ગમે તે બાધ્ય પ્રવૃત્તિઓમાં રોકાયેલી રહે તોપણ એ તાદાત્મ્ય તેની પાસેથી કદી ચાલ્યું જતું નથી. અર્થાત્, આ તાદાત્મ્ય માણસને માત્ર ધ્યાનમાં કે એકગ્રતાની અવસ્થામાં પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ એની અસર જીવનની અંદર હુરેક કાણો, જાગૃત તેમ જ નિજાવસ્થામાં પણ અનુભવી શકાય છે.

આધ્યાત્મિક પ્રકારની એકરૂપતામાં આથી ઉલદું બને છે. તેમે સર્વ પ્રકારના રૂપમાંથી મુક્ત થઈ જાઓ છો, અને રૂપથી પર રહેલા તત્ત્વ સાથે એકરૂપ થઈ જાઓ એ સ્થિતિ તેના પૂર્ણ સ્વરૂપે લાંબો વખત ટકી શકતી નથી. કારણ કે રૂપથી પર એવા તત્ત્વ સાથે એકરૂપતા સધાતાં સ્થૂલ રૂપ આપોઆપ જ વિસર્જન પામી જાય છે. કેટલીક સાધનાઓમાં એવી માન્યતા છે કે આ રીતનું પૂર્ણ તાદાત્મ્ય થઈ ગયા પછી વીસ દિવસની અંદર જ માણસનો દેહ પડી જાય છે. પરંતુ આમ થવું જ જોઈએ એમ નથી. આ રીતના તાદાત્મ્યનો અનુભવ માનો કે યોડો વખત જ રહેતો હોય તો પણ તેને લીધે ચેતનાની અંદર એવાં તો પરિણામો આવે છે જે કદી લુપ્ત થતાં નથી તેમ જ વ્યક્તિના સ્વરૂપની અંતર તેમ જ બાધ્ય પ્રકારની સર્વ ભૂમિકાઓ ઉપર તેની અસર થાય છે. વળી, આવી રીતનું તાદાત્મ્ય એક વાર થઈ આવ્યા પછી, એ અનુભવ તેમે જ્યારે ઈછો ત્યારે પાછો ફરીથી મેળવી પણ શકો છો. એ માટે માત્ર તમારી પાસે એવું જ્ઞાન હોવું જોઈએ કે જે વે તેમે તમારી જાતને બરાબર એ જ અવસ્થામાં પાછી મૂકી શકો.

જગતમાં એવા માણસો છે કે જેમને આ જગત પ્રત્યે કશું જ આકર્ષણ રહેલું નથી હોતું, એમાંથી તેઓ ચાલ્યા જવા માગતા હોય છે. એવા લોકોને માટે આ રીતે અરૂપ તત્ત્વની અંદર પોતાનો લય કરી દેવો એ જ ઉત્તમોત્તમ પ્રકારની મુક્તિ બની રહે છે. આવી વ્યક્તિઓને જગતના વર્તમાન સ્વરૂપથી સંતોષ ન થતો હોય તો તેમાં કશું આશ્રય નથી. પરંતુ જગતમાં બીજા પણ એવા માણસો છે જેમને આ પ્રકારની મુક્તિથી પણ સંતોષ થતો નથી. તેઓ જુઓ છે કે વ્યક્તિ પોતે મુક્ત થઈ જાય છે છતાં આ જગત તો જેવું ને તેવું જ રહે છે. જે પરિસ્થિતિના બોજ હેઠળ લોકો રિબાઈ રહેલા છે તેના ઉપર આ લોકોની મુક્તિને લીધે કશી જ અસર નથી પડતી. અને એ જોઈને તેઓ કહે છે કે આ મુક્તિનો જે આનંદ અમારે એકલાએ જ માણવાનો રહે છે તે આનંદ અમારે ખપતો નથી. આ જગતની બહારથી દેખતી અંધાધૂંધી તેમ જ સર્વવ્યાપી વેદનાની પાછળ અનેક ભવ્ય તત્ત્વો છુપાઈને રહેલાં છે. અને એ મહા તત્ત્વોને ધારણ કરી શકે તેવું એક નવું જગત બને તેનાં સ્વર્ણ તેઓ સેવતા હોય છે. તેમની ભાવના હોય છે કે તેમને પોતાની અંતર અનુભૂતિઓમાં જે અદ્ભુત વસ્તુઓ લાખેલી છે તેનો લાભ બીજાઓને પણ મળે. આવા પુરુષો પોતાની સાધનાના અંતિમ

શિખરે જ્યારે પહોંચ્યા હોય છે, ત્યારે પોતાની આ ભાવનાને, પોતાના આ સ્વપ્નને સિદ્ધ કરવાનાં સાધનો પણ તેમના હુથમાં મળી આવેલાં હોય છે.

રૂપોની સૃજિને પેલે પાર એક નવી શક્તિ આવી રહેલી છે, પૃથ્વી ઉપર હજી નહિ પ્રગટેલી એક ચેતનાની શક્તિ આવેલી છે. એ શક્તિને આપણે આમંત્રી શક્તિએ છીએ. એ શક્તિ અહીં પ્રગટ થઈને જગતના પ્રવાહને બદલી નાખી શકશે અને એક નવા જગતને અહીં જન્મ આપી શકશે. જગતમાં રહેલી વેદના, અજ્ઞાન અને મૃત્યુના પ્રશ્નનું સાચું નિરાકરણ એ નથી કે વ્યક્તિ પોતાનો આત્મ-વિલોપ સાધીને આ પૃથ્વીની વેદનામાંથી નાસી છૂટે અને અવ્યક્તાત્મી અંદર ભળી જાય. અથવા તો આખીએ સૃજિ પોતાની વેદનામાંથી છૂટવા માટે પોતાના સર્જનહારમાં સદાને માટે આખી ને આખી લય પામી જાય એ પણ આ પ્રશ્નનું ખરું નિરાકરણ નથી. આવી રીતનો લય એ એક શંકસ્પદ નિરાકરણ છે. આ તો જગતનો રોગ મટાડવાને માટે જગતને પોતાને જ મારી નાખવા જેવું થાય છે. જગતના પ્રશ્નનું સાચું નિરાકરણ છે રૂપાંતર, જગતમાંના જડતત્ત્વની એક સંપૂર્ણ-કાયાપલટ. પ્રકૃતિ પોતાની પૂર્ણતા પ્રત્યે આદરેલી ગતિમાં એક ઊંચી ને ઊંચી દિશામાં આરોહણ કરી રહેલી છે. એ આરોહણને જ આપણે હજી આગળ ને આગળ વધારતા જવાનું છે, પૃથ્વી ઉપર એક નવી માનવજાતિનું સર્જન કરવાનું છે. અને એ રીતે આ જગતનું રૂપાંતર, જડતત્ત્વની સંપૂર્ણ કાયાપલટ સાધી શકશે. અત્યારના માનવ અને પશુની વચ્ચે વિકાસનો જે ફેર રહેલો છે તેવો જ ફેર આ ભાવિની નવી માનવજાતિ અને અત્યારના માનવની વચ્ચે હશે. એ નવી માનવજાતિ પૃથ્વી ઉપર એક નવી શક્તિને, એક નવી ચેતનાને, નવા બલને આવિર્ભાવ આપશે. આ ઘટના બનશે ત્યારે જગતમાં એક નવી કેળવણીનો આરંભ થશે. એ કેળવણીને આપણે અતિમનસની કેળવણી કહી શકીશું. એ કેળવણીમાં એક સર્વશક્તિમાન કિયાશક્તિ હશે, અને એ શક્તિ દ્વારા તે વ્યક્તિઓની ચેતના ઉપર કામ કરશે, એટલું જ નહિ, પણ વ્યક્તિઓ જે તત્ત્વની બનેલી છે તે તત્ત્વ ઉપર પણ તે કામ કરશે, માણસો જે પરિસ્થિતિની અંદર જીવી રહેલા છે તે પરિસ્થિતિ ઉપર પણ તે પોતાનું કાર્ય કરશે.

આપણે અત્યાર સુધી જે કેળવણીનો વિચાર કરી ગયા તેની ગતિ નીચેથી ઉપરની દિશા પ્રત્યે થાય છે. આપણા સ્વરૂપના જુદા જુદા ભાગો એક ઉદ્ધ્વ આરોહણ સાધે છે. અતિમાનસ કેળવણી આથી ઊલટી રીતે કામ કરશે. તેની ગતિ ઉપરથી નીચે તરફ રહેશે. વ્યક્તિમાં રહેલાં જુદાં જુદાં સ્વરૂપો ઉપર તે પોતાનો પ્રભાવ એક પછી એક વિસ્તારતી જશે અને એમ કરતાં કરતાં તે વ્યક્તિની અંદરનું છેવટનું તત્ત્વ, સ્થૂલ શરીર તંય સુધી પોતાનો પ્રભાવ સ્થાપિત કરશે. વ્યક્તિનું આ છેવટનું રૂપાંતર તો તેની અંદરનાં તત્ત્વો સારું એવું રૂપાંતર પામશે ત્યાર પછી જ

આપણને દેખી શકાય તેવી રીતે સિદ્ધ થશે એટલે અતિમનસ તત્ત્વની હાજરી આહીં આપણી વર્ચ્યે છે કે નહિ તેનો નિર્ણય સ્થૂલ દેખાવોને આધારે કરવા બેસવું એમાં ભૂલ થશે. સ્થૂલ શરીરનું ઝ્યાંતર તો સૌથી છેલ્સે થશે. શારીરિક જીવનની અંદર અતિમાનસ શક્તિનું કોઈ કાર્ય પ્રગટ રીતે જોઈ શકાય તે પૂર્વે વ્યક્તિની અંદર તે કેટલાયે વખતથી કાર્ય કરતી રહેલી હોય છે.

અર્થાત, અતિમાનસની કેળવણી માનવ પ્રકૃતિનો કમે કમે વિકાસ સાધી આપશે, તેની ગૂઢ શક્તિઓને તે વધુ ને વધુ વૃદ્ધિ મેળવી આપશે. એટલું જ નહિ પણ, તે પ્રકૃતિને પોતાને જ એક નવા રૂપે બદલી આપશે. વ્યક્તિના સારાંથે સ્વદ્ધાનું તે ઝ્યાંતર કરી આપશે, પૃથ્વી ઉપરની જીવયોનિને તે માનવ કરતાંથે ઉપરની અને આગળની, અતિમાનવની દિશામાં એક નવું આરોહણ સધાવી આપશે અને એમ કરતાં કરતાં છેવટે પૃથ્વી ઉપર તે માનવની દિવ્ય જાતિનો આવિર્ભાવ કરશે

(બુલેટિન, ફેબ્રુઆરી ૧૯૫૨)

\*

# ૧. શિક્ષણનું એક નવું કેન્દ્ર

( ૧ )

પૃથ્વી ઉપર માણસોને પોતાના જીવન માટે જે પરિસ્થિતિ ભણે છે તે તેમની ચેતનાની અવસ્થાના પરિણામે સર્જિયેલી હોય છે. આ ચેતનામાં ફેરફાર કર્યા વિના માત્ર પરિસ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરવો એ એક વ્યર્થ સ્વખન છે. માનવ જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં, આર્થિક, રાજકીય, સામાજિક વિષયોમાં, નાણાં, ડેળવણી, આરોગ્ય આદિ બાબતોમાં ચાલુ હાલતને સુધારવા માટે શું થઈ શકે તેમ છે, યા તો શું થવું જોઈએ એ પરત્વે જે જે પુરુષોએ કાંઈક વિચારેલું છે તે બધી વ્યક્તિઓએ પોતાની ચેતનાને કોઈ વધુ ઓછી અસાધારણ કક્ષાએ પહોંચાડેલી હોય છે, અને પોતે ચેતનાના ઊર્ધ્વ પ્રેદેશો સાથે સંપર્કમાં આવેલા હોય છે. પરંતુ એ લોકોના વિચારો એકદ્વારા તાત્ત્વિક રીતના જ રહેલા હોય છે, અને તે વિચારોને વ્યવહારમાં ઉતારવાના જો કદી પ્રયત્નો થયેલા હોય છે તો તે રહેલા મોડા બહુ દ્યાજનક રીતે નિષ્ફળ જ નીવહેલા હોય છે. કારણ, જ્યાં લગી માનવ ચેતના પોતે બદલાઈ નથી ત્યાં સુધી કોઈ પણ માનવ વ્યવસ્થા સંપૂર્ણપણે બદલી શકવાની નથી. નવી માનવજ્ઞતિના આગમનનો ઉદ્ઘોષ કરનાર કેટલાયે પયગંબરો જગતની અંદર આવી ગયા છે. કેટલાયે ધર્મો આધ્યાત્મિક રીતના યા તો સામાજિક રીતના જગતમાં ઊભા થયા છે, અને તેમના આરંભ સામે ઘણી ઘણી આશાઓ પણ ઊભી થયેલી છે. પરંતુ માનવજ્ઞતિ દર્જ કોઈ સાંગ્ઘોપાંગ રીતે બદલાયેલી ન હોવાને લીધે, ખુદ માનવ પ્રકૃતિમાંથી જ પ્રગટની પુરાણી ભૂલો પાછી કમેકમે દેખા દેતી રહેલી છે, અને થોડા વખત પછી જણાયું છે કે માનવજ્ઞતિએ આટલા બધા ઉત્સાહ અને આશાપૂર્વક જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં ને ત્યાં જ તે ઊભી રહેલી છે.

માનવ પરિસ્થિતિને સુધારવા માટેના આ પ્રયત્નોમાં હમેશાં બે પ્રકારનાં વલાણો રહેલાં છે. એ વલાણો આમ દેખીતી રીતે તો પરસ્પર વિરોધી વલાણો લાગે છે, પણ વસ્તુતા: તો એ બે વલાણોએ એકબીજાના પૂરક તત્ત્વ બની રહેવાનું છે અને બંનેએ ભેગાં મળીને પ્રગતિ સિદ્ધ કરવાની છે. આમાંનું એક વલાણ તે સામુદ્દરિક દિશા તરફનું છે. આખી યે માનવજ્ઞતિનું સામૂહિક રીતે પુનઃસંગઠન કરવું, અને એમ કરતાં કરતાં માનવજ્ઞતિને સફળ રીતે એક એકતામાં પહોંચાડવી એ રીતે આ પ્રવૃત્તિનો

હેતુ રહ્યો છે. આથી ઊલટું એક બીજું વલાણ એમ કહે છે કે જગતમાં સારી યે પ્રગતિ પ્રથમ વ્યક્તિ દ્વારા સધાય છે, અને તેથી તે એવો આગ્રહ રાખે છે કે વ્યક્તિને એવી પરિસ્થિતિ મેળવી આપવી જોઈએ કે જેમાં તે સંપૂર્ણ મુક્તપણે પ્રગતિ કરી શકે. આ બંને વલાણો સાચાં છે અને જરૂરનાં છે, અને આ બંને દિશામાં આપણે આપણા પ્રયત્નો વાળવાના છે. સામુદ્દરિક પ્રગતિ અને વ્યક્તિગત પ્રગતિ એ બંને પરસ્પરાવલંબી વસ્તુઓ છે. વ્યક્તિ પોતે એક આગે કદમ ભરી શકે તે પૂર્વે એ જરૂરી છે કે સામુદ્દરિક જીવનની અંદર જ તેના પુરોગામી તત્ત્વ જેવી કોઈ પ્રગતિ થઈ આવવી જોઈએ. એટલે આપણે કોઈ એવો માર્ગ શોધી કાઢવાનો રહે છે કે જેથી આ બંને પ્રકારની, દ્વિવિધ પ્રગતિ એકબીજાની સાથે સાથે થઈ શકે.

માનવજ્ઞતિના આ વધતી જતી આવશ્યકતાના જવાબ રૂપે શ્રી અરવિંદે પોતાની આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીની યોજના વિચારી હતી. એમની એ કટ્યના હતી કે આવી યુનિવર્સિટી દ્વારા માનવજ્ઞતિની અંદર એક ઉત્તમ માનવવર્ગ ઊભો થશે. એ માર્ગ માનવજ્ઞતિના કમશઃ એકીકરણ માટે કાર્ય કરી શકશે અને સાથે સાથે, પૃથ્વીનું રૂપાંતર કરવા માટે નીચે આવી રહેલી એક નવી શક્તિને પોતામાં ધારણ કરવા માટે પણ તે તૈયાર બનશે. આ યુનિવર્સિટીનું સંયોજન કયા પાયા ઉપર થશે, તેના અભ્યાસકમો ડેવી રીતે રચાશે તે અંગે માર્ગદર્શન રૂપે થોડા મુખ્ય વિચારો અમો અહીં રજૂ કરીએ છીએ. એ વિચારોમાંથી ઘણાખરા તો શ્રી અરવિંદનાં વિવિધ લખાણોમાં તેમ જ આ પત્રિકામાં આવેલા કેળવાણી વિષેના લેખોમાં આ પૂર્વે વિચારાઈ ગયેલા છે.

આ વિચારોમાં સૌથી મહત્ત્વનો વિચાર આ પ્રમાણે છે. માનવજ્ઞતિની એકતા તે માનવજ્ઞતિને કોઈ એક જ રૂપની કરી દેવાથી નહિ આવી શકે, અથવા તો માનવજ્ઞતિ ઉપર એ એકતાને ઉપરથી લાદીને તેમ જ માનવજ્ઞતિને તેને આધીન બનાવીને પણ તે નિપજાવી નહિ શકાશે. આ એકતાનું નિર્માણ કરવાને જગતના સર્વ દેશોનું એક સમન્વયાત્મક સંગઠન ઊભું કરવું જોઈશે. એ સમન્વિત સંગઠનની અંદર હુરેક રાષ્ટ્ર પોતાની પ્રતિભા અનુસાર, તેમ જ રાષ્ટ્ર સમસ્તમાં તેણે પોતે જે ભાગ ભજવવાનો હશે તે અનુસાર પોતાનું સ્થાન લેશે. જગતનાં રાષ્ટ્રોનું આવી રીતનું એક સંગઠન કરીને જ જગતમાં એક વ્યાપક અને વૃદ્ધિમાન એકતાનું નિર્માણ થઈ શકશે. અને આવી રીતે નિપજાવેલી એકતા જ કંઈ ટકી શકવાનો સંભવ રહે છે. વળી આ રાષ્ટ્રસમન્વયને જો એક જીવંત વસ્તુ બનાવવી હશે તો પછી જગતનાં સર્વ રાષ્ટ્રોને એક ઉચ્ચ્યમાં ઉચ્ચ્ય અને વિશાળમાં વિશાળ એવા એક કેન્દ્રસ્થ વિચારની આસપાસ એકત્ર કરવાં જોઈશે. એ કેન્દ્રસ્થ વિચારમાં માનવજ્ઞતિનાં સર્વ વલાણોને, એકબીજાથી તદ્દન ઊલટાં વલાણોને પણ, પોતપોતાનું સ્થાન મળી રહેશે. આ કેન્દ્રસ્થ વિચાર આ રીતનો હશે: માનવજ્ઞતિને

એક એવી રીતના જીવનમાં મૂકી આપવામાં આવે કે જેમાં રહી તે જગતમાં આવનારી એક નવી શક્તિના આવિર્ભાવને માટે તૈયાર બનવા લાગે. આ નવી શક્તિ જગતમાં આવવાની છે અને આવતી કાળની માનવજીતિનું સર્જન કરી આપવાની છે.

જગતના આ નૂતન સર્જન માટે માનવમાંથી સ્પર્ધા માત્ર ચાલી જવી જોઈશે. પોતે આગણનું સ્થાન લેવું, બીજા ઉપર પોતાની સત્તા જમાવવી આ વૃત્તિ પણ માનવમાંથી નિર્મૂળ થઈ જવી જોઈશે. અને આ વૃત્તિઓને બદલે માનવજીતિનું એક સંવાદભરેલું સંગઠન ઊભું થાય, માનવની અંદર એક સ્પષ્ટ દૃષ્ટિપૂર્વકનો અને અસરકારક એવો સહકાર ઊભો થાય, તે માટેનો સંકલ્પ એકેએક માનવમાં જગ્યાનું થવો જોઈએ. આ વસ્તુને શક્ય કરવા માટે બાળકોને છેક નાની વયથી જ આ વિચારથી પરિચિત કરવાં જોઈએ, એટલું જ નહિ પણ તે વિચારને જીવનમાં મૂર્ત કરવાના પ્રયત્નોમાં પણ તેમને શામિલ કરવાં જોઈએ.

આ મહા વિચારોને આકાર આપવા માટે આ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કેન્દ્ર ઊભું થઈ રહ્યું છે. આ સંસ્થાની આંતરરાષ્ટ્રીયતા શામાં હશે? બેશક, અહીં સર્વ દેશોના વિદ્યાર્થીઓ આવશે, એ વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવશે. પરંતુ એટલા કારણે આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય નહિ બની શકે. આ સંસ્થાની આંતરરાષ્ટ્રીયતા તો એમાંથી આવશે કે પૃથ્વી ઉપરના જુદા જુદા પ્રદેશોની સંસ્કૃતિઓ અહીં ભેગી થશે. એ સંસ્કૃતિઓનાં બૌદ્ધિક તત્ત્વો, વિચારો, સિદ્ધાંતો, ભાષાઓ અહીં સૌને સુલભ થશે, એટલું જ નહિ, પરંતુ એ સર્વનો જીવનવ્યવહાર — તેમના રીતરિવાજો, ટેવો, તે સર્વની કળાઓ ચિત્ર, શિલ્પ, સંગીત, સ્થાપત્ય, સુશોભન — અહીં રજૂ થશે, તેમ જ એ સંસ્કૃતિનું બાધ જીવન — તેનું પ્રાકૃતિક સૌનાર્થ, તેનો પોશાક, રમતગમતો, ઉદ્ઘોગો, ખોરાક એ બધું પણ અહીં સુલભ બનશે. કહો કે અહીં એક પ્રકારનું વિશ્વ-પ્રદર્શન ઊભું થશે, અને તેમાં જગતનાં સર્વ રાષ્ટ્રોને એક જીવંત અને મૂર્ત રીતે રજૂ કરવામાં આવશે. આમાં આદર્શ તો એવો છે કે જે જે દેશની સંસ્કૃતિએ એક નિશ્ચિત પ્રકારનું રૂપ લીધેલું હશે તેને પોતપોતાનો એક શિબિર આપવામાં આવશે. એ શિબિર એવી રીતે રચના આવશે કે તેમાં એ દેશનો સર્વ જીવનવ્યવહાર ઉત્તમમાં ઉત્તમ રીતે રજૂ થયેલો હશે. એ દેશની સૌથી વિશેષ પ્રતિનિધિ રૂપ જે જે પેદાશો હશે, કુદરતી તેમ જ માણસે બનાવેલી, તે તેમાં મૂકવામાં આવશે. વળી એ દેશની બૌદ્ધિક તેમ જ કલાપ્રતિભાનાં, તથા તેની આધ્યાત્મિકતાનાં જે જે ઉત્તમ સર્જનો હશે તે પણ તેમાં રજૂ થશે. આવી રીતના સાંસ્કૃતિક સમન્વયની અંદર પ્રત્યેક રાષ્ટ્રને એક મૂર્ત અને વ્યવહારું રીતનો રસ માલૂમ પડશે અને પોતાને મળેલા શિબિરનો હવાલો સંભાળી લઈને એ કાર્યમાં તે પોતાનો સહકાર આપશે. આ

શિબિરની સાથે જરૂર પ્રમાણે નાનું કે મોટું એવું એક નિવાસગૃહ પણ બનાવવામાં આવશે, અને તેની અંદર એક જ રાષ્ટ્રના વિદ્યાર્થીઓને રહેવાની સગવડ મળશે. એ રીતે આ વિદ્યાર્થીઓ પોતાની માતૃભૂમિની મૂળ સંસ્કૃતિનો આનંદ માણશે અને સાથે સાથે કેન્દ્રની અંદર તેમને એવી કેળવણી મળશે કે જે દ્વારા તેઓ પૃથ્વી ઉપરની અન્ય સંસ્કૃતિઓના પરિચયમાં પણ આવી શકશે. આ પ્રમાણે આવી આંતરરાષ્ટ્રીય કેળવણી તે માત્ર સૈક્ષાંતિક રીતની નહિ રહે, શાળાના ઓરડામાંની જ નહિ રહે, પરંતુ જીવનની સર્વ વિગતોમાં તે એક વ્યવહારું રૂપની કેળવણી બનશે.

આ રીતે આ સંસ્થાનો એક વ્યાપક વિચાર અહીં આપવામાં આવે છે. આ વિચાર હવે વ્યવહારમાં કેવું વિગતવાર સ્વરૂપ લે છે તેની માહિતી જેમ જેમ એ સંસ્થા આકાર લેતી જશે તેમ તેમ કમે આ પત્રિકામાં આપવામાં આવશે.

ત્યારે, આ યુનિવર્સિટીનું પ્રથમ લક્ષ્ય આ પ્રમાણેનું હશે. આ યુનિવર્સિટી વ્યક્તિઓને પોતપોતાના રાષ્ટ્રની મૂળ પ્રતિભા વિષે સજ્ઞાન કરશે, અને સાથે સાથે બીજાં રાષ્ટ્રોની જીવનપદ્ધતિના પરિચયમાં પણ તેમને મૂકી આપશે, અને એ રીતે વ્યક્તિઓ પૃથ્વી ઉપરના સર્વ દેશોના સાચા આત્માને જાણી શકશે અને તેમના પ્રત્યે સમાન રીતે માનભાવ કેળવી શકશે. જે કોઈ વિશ્વ-સંસ્થા સાચી રીતે વિશ્વ-સંસ્થા બનવા માગતી હોય, અને તે જગતમાં ટકી રહેવા માગતી હોય, તેણે પોતાનું મંડાણ રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે અને વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના પરસ્પર માનભાવ અને અન્યોન્યની સમજણ ઉપર જ કરવું જોઈશે. માનવજાતિ આમ જ્યારે એક સામુદ્રાયિક તંત્રમાં અને સંગઠનમાં ભેગી થશે, પરસ્પરની શુભેચ્છા ઉપર રચાયેલા સહિકારની અંદર જોડાશે ત્યારે જ, તે તેની અત્યારની દુઃખ અંધાધૂંધીની દુર્દ્શામાંથી બહાર નીકળી શકશે. યુનિવર્સિટી કેન્દ્રની અંદર માનવ જીવનના સર્વ પ્રશ્નોનો અભ્યાસ આ રીતની દૃષ્ટિથી અને આ રીતની ભાવનાથી કરવામાં આવશે, અને શ્રી અરવિન્દે પોતાનાં લખાણોમાં અતિમાનસ જ્ઞાનનો પ્રકાશ આપેલો છે તે મુજબ આ પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવશે.

(બુલેટિન, એપ્રિલ ૧૯૫૨)

\*

( ૨ )

શ્રી અરવિન્દ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીમાં જે કેળવણી અપારો તેની પાછળ કર્યા સિક્ષાંતો હશે તેની ચર્ચા કરતાં અમે કહી ગયા કે જગતના આ રાષ્ટ્ર-સામુદ્રાયમાં

દરેક રાષ્ટ્ર તેનું પોતાનું આગવું સ્થાન લેશે, તેનો પોતાનો વિશિષ્ટ ભાગ ભજવશે.

પરંતુ આનો અર્થ એમ નથી કરવાનો કે દરેક રાષ્ટ્ર પોતાનું સ્થાન, પોતાને મનફાયતી રીતે, પોતાની મહિત્વાકાંક્ષા મુજબ, પોતાની લોભવૃત્તિ મુજબ પોતે જ નક્કી કરશે. જગતમાં કોઈ પણ દેશને માટે શું કાર્ય નિમાયેલું છે તેનો નિર્ણય મનોમય રીતે નહિ થઈ શકે, બાધ્ય ચેતનામાં રહેલા, અહુકાર અને અજ્ઞાનની આસપાસ ઊભા થયેલા રાગદેખના આધારે નહિ થઈ શકે. એમ થાય, તો તો પછી દેશો વચ્ચેના સંઘર્ષનું માત્ર ક્ષેત્ર બદલાય, પણ એ સંઘર્ષ તો ચાલુ જ રહે અને કદાચ વધુ તીવ્ર રૂપ પણ લે.

વ્યક્તિને જેવી રીતે અંતરાત્મા હોય છે તેવી રીતે પ્રત્યેક રાષ્ટ્રને પણ તેનો અંતરાત્મા હોય છે. આ અંતરાત્મા એ જ વ્યક્તિનું સાચું સ્વરૂપ હોય છે અને તેના ભાગ્યને તે જ વતીઓછી પ્રગટ રીતે દોરતો હોય છે. તેવું જ રાષ્ટ્રની બાબતમાં પણ બને છે. રાષ્ટ્રનું સાચું સ્વરૂપ પણ તેનો જે અંતરાત્મા છે તેમાં જ રહેલું છે. એ અંતરાત્મા રાષ્ટ્રના ભાવિને પરદા પાછળ રહ્યાં રહ્યાં ઘડે છે. એ અંતરાત્મા જ રાષ્ટ્રનો ગ્રાણ હોય છે. રાષ્ટ્રની પ્રતિભા, પ્રજાનો જોસ્સો, રાષ્ટ્રની અભીષ્ટાઓનું કેન્દ્ર, દેશના જીવનમાં રહેલા સુંદર, ઉદાર, ઉદાત, મહાન તત્ત્વોનું મૂળ આ અંતરાત્મા હોય છે. જે સાચા દેશભક્તો હોય છે તેઓ આ અંતરાત્માની હાજરીને બરાબર અનુભવી શકે છે, એ તેમને માટે એક જીવતી સ્પર્શક્ષમ વાસ્તવિકતા હોય છે. હિંદુમાં આ અંતરાત્માને લગભગ એક દેવતાનું રૂપ આપવામાં આવેલું છે. એ દેશને સાચા હદ્યથી ચાહનાર લોકો એને 'ભારત માતા'ના નામથી સંબોધે છે, અને એ દેવી સમક્ષ તેઓ પોતાના દેશના કલ્યાણ માટે હમેશાં પ્રાર્થના કરે છે. જગતમાં આ દેશ માટે જે કાર્ય નિમાયેલું છે, આ દેશનો જે સાચો આદર્શ છે તે આ દેવી રૂપે મૂર્ત્ત થયેલાં છે, આ દેવી એ આદર્શ તથા કાર્યની પ્રતીક છે.

હિંદુના વિચારશીલ અને આધ્યાત્મિક પુરુષો તો એમ પણ ગણે છે કે ભારત માતા તે વિશ્વરૂપ મા ભગવતીનું જ એક સ્વરૂપ છે. શ્રી અરવિન્દે રચેલા નીચેના 'દુગ્સ્ટોત્ર'માં ભારતમાતાનું આ પ્રમાણેનું સ્વરૂપ જોવા મળે છે:

"હે મા દુર્ગો! સિંહવાહિની! સર્વ શક્તિદાત્રી,... તારી શક્તિના અંશમાંથી જન્મ પામેલા, અમે ભારતના યુવકો તારા મંદિરમાં આવી પ્રાર્થના કરીએ છીએ. હે માતા, સાંભળ. પૃથ્વી ઉપર તું અવતરણ કર, આ ભારત દેશમાં તું પ્રગટ થા.

"હે મા દુર્ગો! બલદાયિની, પ્રેમદાયિની, શક્તિસ્વરૂપિણી, ભીષણ અને સૌભ્ય, રમ્ય અને રૌક્ર રૂપિણી! જીવનના સંગ્રામમાં, ભારતના સંગ્રામમાં અમે તારા પ્રેરિત થયેલા યોગ્યાઓ છીએ. મા! અમને ગ્રાણમાં અને ચિત્તમાં અસુરની શક્તિ આપ, અમારા આત્મામાં અને બુદ્ધિમાં દેવનું ચારિત્ય, દેવનું જ્ઞાન આપ.

“હે મા દુર્ગો! જગતમાં શ્રેષ્ઠ એવી ભારતની આ પ્રજા ધન અંધકારમાં પડેલી હતી. હે મા, ક્ષિતિજ ઉપર તું હવે ઉદ્ય પામી રહી છે. તારા દિવ્ય શરીરની તિમિર વિનાશક પ્રભા લઈ ઉખા આવી રહી છે, માતા, તારી જ્યોતિનો વિસ્તાર કર, તિમિરનો વિનાશ કર.

“હે મા દુર્ગો! અમે તારાં બાળક, તારો કૃપા પ્રસાદ પામીને, તારા પ્રભાવ વે તારું મહાન કાર્ય કરવા માટે, તારો મહાન આદર્શ સિદ્ધ કરવા માટે સુપાત્ર બનીએ. હે મા, અમારી કૃત્તુનાનો વિનાશ કર, અમારા સ્વાર્થીપણાનો, અમારા ભયનો સંહાર કર.

“હે મા દુર્ગો! કાલીસ્વરૂપ... હૃથમાં ખડગ લઈ તું અસુરનો સંહાર કરે છે. હે દેવી, તો એક ભીષણ ગર્જના કરી અમારામા વસેલા રિપુઓને સંહારી નાખ, એક પણ રિપુને જીવતો ન રહેવા દઈશ. હે મા, અમે નિર્મળ અને નિષ્કલંક બનીએ, આ જ છે અમારી પ્રાર્થના, હે મા, તારો આવિર્ભાવ કર.

“હે મા દુર્ગો! હિંદ સ્વાર્થ, ભય અને બીજી અનેક કૃદ્ર વૃત્તિઓમાં ગળાબૂડ ડૂબેલું છે. અમને મહાન બનાવ, મહા પુરુષાર્થી બનાવ, ઉદારદિલ બનાવ, સત્યસંકલ્પ બન વિ. હવે અમને કૃદ્ર ભાવનાવાળા, નિષ્ક્રિય, આળસુ, ભયભીત ન રહેવા દઈશ”.

“હે મા દુર્ગો! યોગશક્તિનો વિસ્તાર કર. અમે તારાં આર્થસંતાનો ધીએ. અમારી લુમથયેલી વિદ્યા, અમારું ચારિત્ર્ય અને આ મેધા, શ્રદ્ધા અને ભક્તિ, તપસ અને બ્રહ્માર્થ, અમારું સત્ય જ્ઞાન અમને પાછાં મેળવી આપ. અને આ સર્વનો આખા જગતમાં વિસ્તાર કર. હે જગત્નાતા, સર્વ દુરિતોને દૂર કર, માનવજાતિને સહાય કરવા પ્રગટ થા”.

“હે મા દુર્ગો! અમારા ભીતરમાં રહેલા શત્રુનો સંહાર કર અને બાધ વિઘ્નોને પણ પછી નિર્મળ કરી આપ. ભારતની બળવાન પરાકમી ઉત્તમ પ્રજા ભારતનાં પવિત્ર અરાધ્યોમાં, ફણદુર્પ ક્ષેત્રોમાં, ગગનચુંબી પર્વતોની ગોદમાં, પુરુષજલા સરિતાઓને તટે નિવાસ કરો અને ઐક્ય અને પ્રેમમાં, સત્ય અને શક્તિમાં, કળા અને સાહિત્યમાં, પરાકમ અને જ્ઞાનમાં તે સર્વશ્રેષ્ઠ બનો. માના ચરણોમાં આ અમારી પ્રાર્થના છે. પ્રગટ થા”.

“હે મા દુર્ગો! તારું યોગબળ લઈ અમારાં શરીરમાં પ્રવેશ કર અમે તારાં યંત્ર બનીશું, અશુભસંહારક તારી તલવાર બનીશું, અજ્ઞાનવિનાશક તારો દીપક બનીશું. તારાં યુવાન સંતાનોની આ અભીપ્સા પૂર્ણ કર, હે માતા! યંત્રની સ્વામિની થઈ તું યંત્રો ચલાવ, તારી તલવાર ચલાવી, અશુભનો સંહાર કર, દીપક ધરીને જ્ઞાનજ્યોતિ ફેલાવ. પ્રગટ થા”.

આપણે ઈચ્છાએ કે જગતના બીજા દેશોમાં પણ પોતાના રાષ્ટ્રના આત્મા પ્રત્યે આ જ પ્રમાણોની પૂજ્ય બુદ્ધિ પ્રગટે, એ દેશોના જે ઉત્તમોત્તમ આદર્શો હોય તેને આવિર્ભાવ આપવા માટેનાં યોગ્ય કરણો બનવાને આવી જ અભીપ્સા જાગે, પ્રગતિ અને પૂર્ણતા માટે આવો જ ઉત્સાહ જન્મે. એમ થતાં દરેક પ્રજા પોતાના રાષ્ટ્ર-

આત્મા સાથે એકરૂપતા મેળવશે, પોતાની સાચી પ્રકૃતિને તથા પોતાના સાચા કાર્યને સમજશે. અને એ રીતે, માનવના ઈતિહાસમાં ભલે ગમે તેવા અક્સમાતો થતા રહે છતાં હરેક માનવ એક ગ્રાણવાન અને અમૃતત્વને ધારણ કરનાર વ્યક્તિ બની રહેશે.

(બુલેટિન, ઓગસ્ટ ૧૯૫૨)

\*

( ૩ )

### નવા આવનારાઓને સલાહ

આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કેન્દ્ર ધીરે ધીરે રચાઈ રહ્યું છે. એને માટે બંધાનારાં નવાં મકાનો જ્યારે તૈયાર થશો ત્યારે તેમાં આ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. એ મકાનો માટેના પ્લાન તૈયાર થઈ ગયા છે. એ મકાનો તૈયાર થાય ત્યાં સુધી હમણાં તો અમૃક વિભાગો, જેવા કે પુસ્તકાલય, વાચનાલય તેમ જ થોડાએક વર્ગો જૂનાં મકાનોમાં જ શરૂ કરાયા છે. આ જૂનાં મકાનોને પાડી નાખીને તેને સ્થાને નવાં મકાનો બંધાશે. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હવે આવવા લાગ્યા છે. કેટલાક પરદેશથી પણ આવ્યા છે. એમને માટે અહીંનાં હવાપાણી તથા આ દેશના રીતરિવાજો તદ્વન નવી વસ્તુઓ છે. આ આગન્તુકો આશ્રમમાં પહેલી વાર આવતા હોય છે અને આશ્રમનું જીવન તથા તેની રીતરસમો વિષે તેમને કશી ખબર હોતી નથી. કેટલાક અહીં સેવા કરવાની યા તો જ્ઞાન મેળવવાની માનસિક અભીપ્સા લઈને આવ્યા હોય છે તો કેટલાક યોગ કરવાની, પ્રભુ મેળવવાની, પ્રભુ સાથે મિલન સાધવાની આશાપૂર્વક આવેલા હોય છે. કેટલાક વળી એવા પણ હોય છે કે જેમને પૃથ્વી ઉપર પ્રભુના કાર્ય માટે પોતાનું પૂર્ણ સમર્પણ કરવાની ઈચ્છા હોય છે. આ બધા પોતાના અંતરાત્માની પ્રેરણાથી દોરાઈને આવતા હોય છે. એ અંતરાત્મા તેમને આત્મ-સાક્ષાત્કાર પ્રત્યે લઈ જવા માગતો હોય છે, તેમનામાં એ અગ્રભાગે આવીને બેઠેલો હોય છે, તેમની ચેતના ઉપર અનું શાસન હોય છે. બીજાં માણસો તથા વસ્તુઓ સાથેનો તેમનો સંપર્ક અંતરાત્મામાંથી રચાતો હોય છે. આવા આગન્તુકોને અહીં દરેક વસ્તુ સરસ અને સુંદર લાગે છે. તેમની તબિયત સારી થવા લાગે છે, તેમની ચેતના વધારે સ્પષ્ટ થવા લાગે છે, તેમને એક પ્રકારની શાંતિ, સુખ અને સલામતીનો અનુભવ થાય છે. તેમને લાગે છે કે પોતાની ચેતનાની મોટામાં મોટી શક્યતા તેમણે હવે સિદ્ધ કરી છે. અંતરાત્માના સ્પર્શમાંથી મળતી આ

શાંતિ, સભરતા અને આનંદ તેમને હવે સ્વાભાવિક રીતે જ હરેક સ્થળે, હરેક વસ્તુમાં, હરેક વ્યક્તિમાં દેખાવા લાગે છે. અને આને લીધે, અહીં વ્યાપ્ત રહેલી તથા હરેક વસ્તુનો વિકાસ રચી રહેલી સત્ય ચેતના પ્રચે તેઓ ખુલ્લા બને છે. આ ખુલ્લાપણું ટકી રહે છે ત્યાં સુધી તેમનામાં શાંતિ, સભરતા અને આનંદ બરાબર ભરેલાં રહે છે, અને તેમાંથી તરત નીપજતાં પરિણામો પણ ચાલુ રહે છે. તેમની પ્રગતિ થતી રહે છે, તેમના શરીરની તંદુરસ્તી અને સ્વસ્થતા બરાબર રહે છે. તેમના પ્રાણમાં શાંતિ અને શુભેચ્છા આવે છે, તેમના મનમાં સ્પષ્ટ સમજશક્તિ અને વિશાળતા આવે છે, અને તેમની આખી યે ચેતનામાં એક સુરક્ષિતતા અને તૃપ્તિનો ભાવ પ્રગટે છે. પરંતુ મનુષ્યને માટે પોતાના અંતરાત્મા સાથેનો સંપર્ક અંડ ટકાવી રાખવો એ એક વિકટ કામ છે. થોડા સમય બાદ નવી આવનાર વ્યક્તિ જ્યારે અહીં દરીને સ્થિર થાય છે, નવા અનુભવની તાજગી ઝાંખી બનવા લાગે છે ત્યારે તેનામાંનો જૂનો માણસ પાછો સપાટી ઉપર આવવા લાગે છે. અહીં આવી રહેલી વ્યક્તિના જૂના વ્યક્તિત્વની બધી ટેવો, પસંદગીઓ, નાનાં નાનાં ગાંડપણ, ખામીઓ, ગેરસમજૂતીઓ એ બધું પાછું તેની ચેતનામાં ઉપર તરી આવે છે. એનામાં સ્થપાયેલી શાંતિને સ્થાને હવે બેયેની આવીને બેસે છે, એનો આનંદ અદૃશ્ય થઈ જાય છે. એની સમજશક્તિ ધૂંધળી થઈ જાય છે. આ જગ્ગા પણ બીજી જગ્ગાઓ જેવી જ છે એ લાગણી તેનામાં પાછી ધીરે ધીરે દાખલ થવા લાગે છે, કારણ કે તે હવે બીજે સ્થળે હતો તેવો જ પાછો બની ગયેલો હોય છે, તેના પોતાનામાં કેટલું કામ થયેલું છે તેના ઉપર નજર ન રાખતાં તે હવે જે કામ થવાનું બાકી રહેલું છે તેના તરફ જ પોતાની દૃષ્ટિ વધુ ને વધુ, કહો કે સર્વશો માંડી રાખે છે. આ નવો સાધક હવે ઉદાસ બની જાય છે, અસંતુષ્ટ થઈ જાય છે, પોતાનો વાંક કાઢવાને બદલે તે બીજાઓનો, બીજી વસ્તુઓનો વાંક કાઢવા લાગે છે. અહીં તો પૂર્તી સગવડો નથી, અહીંનાં હવા પાણી અસહ્ય છે, ખોરાક સારો નથી, અપયો કરે તેવો છે એવી એવી ફરિયાદો તે કરવા લાગે છે. ઊલટું, આ ફરિયાદો કરવામાં તો તે શ્રી અરવિંદનો આધાર લઈ આવે છે. શ્રી અરવિન્દે શું એમ નથી કહેલું કે શરીર એ તો યોગ માટેનો એક અનિવાર્ય એવો આધાર છે, એના તરફ બેદરકારી ન રાખતાં ઊલટું તેની ખૂબ જ સંભાળ લેવી જોઈએ. અને એમ કહીને સાધકની શારીરિક ચેતના કેવળ શરીરની બાબતોમાં જ તલ્લીન બની જાય છે, અને શરીરને સંતુષ્ટ કરવાના પ્રયત્ન કરે છે. અને આ કાર્ય તો લગભગ અશક્ય જેવું જ છે. કારણ કે, કદાચ અમુક અપવાદો સિવાય, મોટા ભાગનાં માણસોની બાબતમાં તો એવું જ બને છે કે શરીરને તમે જેટલું વધુ આપો છો તેથી વધુ તે માઝા જ કરે છે. વળી, માણસની શારીરિક ચેતના સામાન્ય રીતે અંધ અને અજ્ઞાન જ હોય છે, તેનામાં અનેક

ખોટા ખ્યાલો ભરેલા હોય છે, પહેલેથી બાંધેલા વિચારોથી, પૂર્વગ્રહોથી, પસંદગીઓ અને નાપસંદગીઓથી તે ભરેલી હોય છે. એ શરીર ચેતના પોતે એકલી શરીર ઉપર અસરકારક રીતે કામ કરી શકતી નથી. સાચી વસ્તુ સાચી રીતે કેમ કરવી એ માટેનું જરૂરી જ્ઞાન તથા સ્પષ્ટ દૃષ્ટિ તો માત્ર અંતરાત્માની ચેતનામાં જ રહેલાં હોય છે.

તો હવે આવી સ્થિતિનો શો ઈલાજ હોઈ શકે? આપણે હવે એક દુષ્ટ ચકમાં ફરવા માંડીએ છીએ. આ આખી આપત્તિ ઊભી થવાનું કારણ એ છે કે આપણે અંતરાત્માથી છૂટા પડી ગયા છીએ અને આ પ્રશ્નોનું નિરાકરણ માત્ર અંતરાત્મા જ શોધી શકે તેમ છે. એટલે આમાં માત્ર એક જ ઈલાજ રહે છે: સાવધ રહો, અંતરાત્માને બરાબર વળળી રહો, તેને પૃષ્ઠભાગમાં પાછો ચાલ્યો જવા ના દેશો, તમારી ચેતનામાંની કોઈ પણ વસ્તુને તેની અને તમારી વચ્ચે સરી આવવા ના દેશો, અંતરાત્મા સિવાયનાં બીજાં સૂચનો પ્રત્યે તમારા કાન બંધ કરી દો અને કેવળ અંતરાત્મામાં જ તમારો વિશ્વાસ સ્થાપો.

સામાન્ય રીતે, માણસ જ્યારે અંતરાત્મા વિષે સભાન થાય છે ત્યારે તે પ્રાણનાં અને શરીરનાં આકર્ષણો તથા પ્રવૃત્તિઓમાંથી મુક્ત થવા તરફ વળવા લાગે છે. માણસને જગતમાંથી હૃદી જવાનું મન થાય છે, અને ભગવાનના ધ્યાનમાંથી મળતા આનંદમાં, પ્રભુ સાથેના સતત સંપર્કમાંથી મળતી શાંતિમાં મન રહેવા માણસ જંખે છે. પરંતુ શ્રી અરવિંદના પૂર્ણયોગના સાધકો આવું વલાણ ઘરાવતા નથી. એમને જ્યારે અંતરાત્માનો સાક્ષાત્કાર થાય છે, તેની સાથે તેઓ એકત્ર પ્રાપ્ત કરે છે ત્યારે આ સાધકો અંતરાત્માને કહે છે કે તારી દૃષ્ટિ હવે તું અમારા શારીરિક સ્વરૂપ તરફ વાળ, પ્રભુ સાથેના નૈસર્જિક સંપર્કમાંથી જન્મતી તારી અંતરાત્મિક ચૈત્ય ચેતના વડે એ શરીર-સ્વરૂપ ઉપર કામ કર, અને શરીરનું એવું તો રૂપાંતર કરી આપ કે પછી એ શરીર દિવ્ય ચેતના તથા તેના સંવાદને જીલવાને માટે તથા તેના આવિર્ભાવને માટે સમર્પ થાય.

આપણી અહીની સાધનાનું લક્ષ્ય આ પ્રમાણેનું છે. આંતરાત્મીય યુનિવર્સિટી કેન્દ્રમાં વિવિધ વિષયોનો જે અભ્યાસ થશે તેનું છેવટનું પરિણામ પણ આ પ્રમાણેનું રહેશે.

એટલે આ યુનિવર્સિટીમાં જોડાવા આવનાર સૌ કોઈને હું ફરીથી આ વાત કહીશા: આપણો કાર્યક્રમ કદી ભૂલશો નહિ, જે ગહુન પ્રયોજન લઈને તમે અહીં આવ્યા છો તે કદી ભૂલશો નહિ. અને છતાં, તમારા સર્વ પ્રયત્ન છતાં પણ જો ક્ષિતિજ ઉપર અંધકાર છવાવા લાગે, તમારી આશા અને આનંદ ચાલ્યાં જાય, તમારો ઉત્સાહ મંદ થઈ જાય તો આટલું યાદ રાખજો કે એ વસ્તુ તમે અંતરાત્મામાંથી હૃદી ગયા છો તથા અંતરાત્માના આદર્શ સાથેનો તમારો સંપર્ક છૂટી

ગયો છે તેની નિશાની છે. અને આ તમને યાદ રહેશે તો પછી તમે બીજાઓ ઉપર તથા તમારી આસપાસની વસ્તુઓ ઉપર દોષ ઢોળવાની જે ભૂલ કરો છો, તથા એ રીતે કશા યે કારણ વિના તમારાં દુઃખ અને મુશ્કેલીઓમાં વધારો કરો છો તેમાંથી તમે બચ્ચી જશો.

(બુલેટિન, નવેમ્બર ૧૯૫૨)

\*

## ચાર તપસ્યાઓ અને ચાર મુક્તિ

અતિમનસના સાક્ષાત્કાર પ્રત્યે લઈ જાય એવી કેળવણીનું અનુશીલન કરવા માટે એક ચતુર્વિધ તપસ જરૂરનું છે તેમ જ એક ચતુર્વિધ મુક્તિ પણ મેળવવાની છે.

તપસને સામાન્ય રીતે દમન સાથે બેળસેળ કરી દેવામાં આવે છે. જ્યારે તપસની વાત આવે છે ત્યારે આપણને કોઈ ત્યાગીની સાધનાનો ઘ્યાલ આવે છે. આ ત્યાગી લોકો શરીરના જીવનને, પ્રાણ તથા મનના જીવનને આધ્યાત્મિક સ્વરૂપ આપવાના મહા કઠિન કાર્યથી દૂર રહેવા માગતા હોય છે અને તેથી તે એમ જાહેર કરી દે છે કે આ વસ્તુઓ — શરીર, પ્રાણ, મન રૂપાંતર પામી શકે તેમ નથી. ત્યાગી આ બધાને હરેક રીતના આધ્યાત્મિક વિકાસમાં એક અર્થહીન બોજા રૂપ, બંધન અને જંજીર રૂપ સમજું તેમને નિષ્કર રીતે બાજુએ હડસેલી દે છે અથવા કંઈ નહિ તો, આ શરીર, પ્રાણ તથા મનના જીવનને તે એક ન સુધરે તેવી ચીજ તો ગણે જ છે. તે એમ સમજે છે કે આ બધાં એક બોજો છે અને કુદરત યા તો પ્રભુની કૃપા મૃત્યુ દ્વારા તમને તેમાંથી મુક્ત ન કરે ત્યાં સુધી તે બોજાને તમારે બને તેટલા આનંદથી વહેવાનો છે. આ ત્યાગી માનસ વધુમાં વધુ માત્ર એટલું જ સ્વીકારે છે કે પૃથ્વી ઉપરનું આપણને મળેલું આ જીવન એ પ્રગતિ કરવા માટેનું માત્ર એક ક્ષેત્ર જ છે, અને માણસે તેમાંથી બને તેટલો વધુમાં વધુ લાભ મેળવી લેવાનો પ્રયત્ન કરવાનો છે. માણસે આ પૃથ્વી ઉપર બને તેટલી ઝડપે એટલી પૂર્ણતા મેળવી લેવી જોઈએ કે જેમાં પછી આ જીવનની કોઈ જરૂર રહે જ નહિ, અને એ રીતે આ કસોટીમાંથી પૂરેપૂરા છૂટી જવાય. આ છે ત્યાગપ્રધાન માનસનું દૃષ્ટિબિંદુ.

પરંતુ આપણે માટે આ પ્રશ્ન જુદું જ રૂપ ધારણ કરે છે. પૃથ્વી ઉપરનું જીવન આપણે માટે માત્ર એક સાધન રૂપ જ નથી, કોઈ અન્ય સૂચિમાં પહોંચવા માટે માત્ર એક રસ્તો જ નથી. એ જીવનનું રૂપાંતર સાધી લઈને આપણે એ જીવનને જ લક્ષ્ય બનાવવાનું રહે છે, એક સાક્ષાત્કાર રૂપ બનાવવાનું રહે છે. આપણે જ્યારે તપસની વાત કરીએ છીએ ત્યારે તેની પાછળ શરીર પ્રત્યે તિરસ્કારનો ભાવ નથી હોતો, તેમાંથી આપણે છૂટા થઈ જવા નથી માગતા. આપણા ધ્યેયને સાધવા માટે આપણને આત્મ-સંયમની તથા આત્મ-પ્રભુત્વની જરૂર રહે છે અને તેટલા માટે જ આપણે તપસની માગણી કરીએ છીએ. કારણ કે, જગતમાં એક બીજું પણ એવું તપસ છે કે જે ત્યાગીઓનાં તમામ તપસો કરતાં પણ એક ઘણું વિશેષ મહાન, વિશેષ સંપૂર્ણ

અને કઠિન તપસ છે. આપણા પૂર્ણ રૂપાંતર માટે આ એક ઘણું આવશ્યક તપસ છે. એ ચતુર્વિધ તપસ વ્યક્તિને અતિમનસ સત્યના આવિર્ભાવ માટે તૈયાર કરે છે. આ રીતે જોતાં, દા. ત. આપણે કહી શકીએ કે શરીરની પૂર્ણતા માટે શારીરિક તપસની જરૂર પેડ છે તેના જેવાં કઠણ તપ બીજાં ભાગ્યે જ હુશે. પરંતુ આ વિષયનો વિચાર આપણે આગળ ઉપર કરીશું.

તપસના આ ચાર પ્રકારોનું વર્ણન શરૂ કરતાં પહેલાં હું એક મુદ્રા વિષે સ્પષ્ટતા કરવી અગત્યનું ગણું છું. એ છે કે કેટલીક ત્યાગપ્રધાન સાધનાઓ વિષેની આપણી સમજણ. મોટા ભાગના લોકોના મનમાં આ બાબતો અંગે ઘણી જ ગેરસમજણ તથા ગોટાળો પ્રવર્તતાં જોવામાં આવે છે, અને આ વસ્તુઓ તે આધ્યાત્મિક સાધના છે એમ ઘણા માની લે છે. આ ત્યાગપ્રધાન સાધનાઓમાં શરીર ઉપર બહુ જ દમન કરવામાં આવે છે, અને એ રીતે આત્માને શરીરમાંથી છૂટો કરી શકાય છે એમ કહેવામાં આવે છે. ખરું જોતાં તો આવી સાધના એ આધ્યાત્મિક સાધનાને અપાયેલું એક સ્થૂલ વિકૃત રૂપ છે. આ એક પ્રકારની દુઃખ માણવાની વિકૃત ભૂખ છે અને તેનાથી પ્રેરાઈને વૈરાગી માણસ આવું આત્મ-દમન કરવા લાગે છે. બાવાઓને આપણે ખીલાની પથારી ઉપર સૂતેલા જોઈએ છીએ, બિસ્તી સાધુઓ પોતાને મારવા માટે એક ચાબુક રાખે છે, પહેરવાને ગુણિયા કાપડ રાખે છે. આ વસ્તુઓની પાઇળ એક પ્રકારનો કૂરતાનો રસ જ હોય છે. જો કે આ રસ આમ તો ગુપ્ત રીતનો જ હોય છે, એની કબૂલાત કોઈ કરતું નથી, તેમ જ તે કરાવી શકાય તેમ પણ નથી. ઉગ્ર સંવેદનો અનુભવવા માટેની આ એક રોગિક ઝંખના છે. માણસની અવચેતનાની એક ભૂખ છે. આ વસ્તુઓ ખરું જોતાં આધ્યાત્મિક જીવનથી બહુ જ વેગળી છે. એ સાવ હુલકી, ઘૃણાસ્પદ, અંધકારમય અને રોગિક છે. આધ્યાત્મિક જીવન તો, આથી ઊલદું, પ્રકાશ અને સમતુલાથી ભરેલી વસ્તુ છે, સૌન્દર્ય અને આનંદથી સભર હોય છે. મનમાં અને પ્રાણમાં રહેલી, શરીર ઉપર લદાતી એક પ્રકારની કૂરતાએ શરીરદમનની આ પ્રકૃતિઓ શોધી કાઢેલી છે તેમ જ તેના ગુણગાન કરેલાં છે. પરંતુ આ કૂરતા તમે તમારા પોતાના શરીર ઉપર આચરતા હો તોપણ છેવટે તો એ કૂરતા જ રહે છે. અને તમામ કૂરતા એક મહા અચેતનાનું જ લક્ષ્ણા છે. આવી અચેતન પ્રકૃતિવાળા માણસોને પ્રભર ઉગ્ર સંવેદનોની જરૂર હોય છે. એવાં ઉગ્ર સંવેદનો વિના પોતાને કોઈ અનુભવ થાય છે તેમ તે સમજ શકતા નથી. અને કૂરતા એ એક પ્રકારનો પીડા-રસ હોઈ તે આવાં ઘણાં ઉગ્ર સંવેદનો અનુભવાવી શકે છે. આવી સાધનાઓ સંવેદન માત્રનો નાશ કરવા માગતી હોય છે. તે એમ માનતી હોય છે કે આ રીતે સંવેદનનો નાશ થઈ ગયા પછી શરીર આપણાને આત્માની દિશામાં

જડપથી જવાના માર્ગમાં વિધન રૂપ નહિ બને. પરંતુ આવી પદ્ધતિ સફળ થઈ શકે કે કેમ એ શંકાસપદ વસ્તુ જ છે. બાકી એ વાત તો જાણીતી છે કે તમારે જો જલદી પ્રગતિ કરવી હોય તો પછી મુશ્કેલીઓથી કદી પણ ડરવું ન જોઈએ, ઉલટું જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે કઠણ કામ કરવા માટે તમારે ખાસ તૈયાર રહેવું જોઈએ, અને એમ કરશો તો તેથી તમારી સંકલ્પશક્તિમાં વૃદ્ધિ થશે, તમારા જ્ઞાનતંત્રાઓ બળવાન બનશો. એમાં તો શક છે જ નહિ કે ત્યાગના અતિરેકોનો આશ્રય લઈ ભોગવિલાસના અતિરેકોની સામે લડવું, એ અતિરેકોમાંથી જન્મતા તપસની સામે લડવું અને એ રીતે આ ભોગવૃત્તિઓને નિર્ભળ કરી નાખવી એ તો પ્રમાણમાં ઘણી સહેલી વસ્તુ છે. એના કરતાં એક ભિતાચારવાળું, સમતોલ, સમતા અને સ્વસ્થતાવાળું જીવન ગાળવું એ ઘણું જ કઠણ કામ છે. પોતાના શરીર પર અત્યાચાર કરવો અને તેને શૂન્ય જેવું કરી મૂકવું તેના કરતાં એક સ્વસ્થ અને સરળ રીતે શરીરનો સંવાદમય અને પ્રગતિમય એવો વિકાસ રચવો એ કામ ઘણું જ કઠણ છે. પોતાનામાં ઘણી ત્યાગશક્તિ છે એવું બતાવી આપવા માટે બિચારા શરીરને તેને માટે અનિવાર્ય એવા પોષણથી તથા સ્વચ્છ ટેવોથી વંચિત રાખવું એ વસ્તુ પ્રમાણમાં ઘણી સહેલી છે, અને કોઈ પણ ઈરદ્ધા સેવ્યા વિના એક શાંત સંયમિત જીવન ગાળવું એ આના કરતાં ઘણું વિકટ કામ છે. વળી શરીર માંદુ પડે ત્યારે રોગ તરફ ઉપેક્ષા કરવી, તેની પરવા ન કરવી, અને રોગને તેનું વિનાશક કામ કરવા દેવું એ સહેલું છે, પરંતુ એમ ન કરતાં આંતર તેમ જ બાધ્ય એવી ઉભયવિધ સંવાદિતતા દ્વારા, વિશુદ્ધ અને સમતુલ્ય દ્વારા રોગને દૂર જ રાખવો, રોગ થાય તો તેમાંથી બહાર નીકળી જવું, તેને જીતી લેવો એ મહા વિકટ કામ છે. અને આ બધા કરતાં પણ ચેતનાને હુમેશાં તેની શક્તિ ટોય પર ટકાવી રાખવી અને શરીરને નીચેલી વૃત્તિઓના પ્રભાવ હેઠળ કદી પણ કામ કરતું ન થવા દેવું એ તે અતિશાય વિષમ કામ છે.

આ દૃષ્ટિ ધ્યાનમાં રાખીને આપણે હવે ચાર તપસનું અનુશીલન કરીશું, અને એ અનુશીલનમાંથી આપણને ચાર પ્રકારની મુક્તિ મળશો. આ અનુશીલન એક ચાર પ્રકારની સાધના યા તપસ્યાનું રૂપ લેશો, જેની વ્યાખ્યા નીચે મુજબ આપી શકાય :

- (૧) પ્રેમની તપસ્યા
- (૨) જ્ઞાનની તપસ્યા
- (૩) શક્તિની તપસ્યા
- (૪) સૌદર્યની તપસ્યા

આમાં મૂકેલો કે તે ઉપરથી નીચેની દિશામાં જતો કે એ પરંતુ અહીં બતાવેલાં આ પગથિયાનો અર્થ એમ નથી કરવાનો કે આ તપસ્યાઓ એકબીજા

કરતાં ઊંચી વા નીચી છે, સરળ વા કઠળ છે. અથવા તો આ સૂચવેલા કમ મુજબ જ એમનો અમલ કરવાનો છે. આ તપસ્યાઓનો કમ, તેમનું મહૃત્ત્વ તેમ જ વિકટતા પ્રત્યેક વ્યક્તિ મુજબ જુદાં જુદાં હોઈ શકે છે. એ અંગે કોઈ છેવટનો નિયમ બનાવી શકાય તેમ નથી. દરેક વ્યક્તિએ પોતાની શક્તિ તેમ જ અંગત જરૂરિયાત મુજબ પોતાની તપસ્યાની પદ્ધતિ ઉપજાવી લઈ તેનો અમલ કરવાનો રહે છે.

અહીં તો અમે માત્ર આ બધાનો એક સર્વસામાન્ય એવો વિચાર કરીશું અને બને તેટલી સંપૂર્ણ એવી એક આદર્શ પદ્ધતિનું અતે નિરૂપણ કરીશું. આ સામાન્ય નિરૂપણને આધારે દરેક વ્યક્તિએ પોતે પોતાનાથી થાય તેટલી ઉત્તમ રીતે, અને શક્ય તેટલા વધુ પ્રમાણમાં આનો અમલ કરવાનો છે.

(બુલેટિન, ફેબ્રુઆરી ૧૯૫૩)



## સૌન્દર્યની તપસ્યા

સૌન્દર્યની સાધના વા તપસ્યા આપણને શરીરના તપના માર્ગે કર્મમાંની મુક્તિ પ્રત્યે લઈ જશે. એક સુંદર આકારવાળું, સંવાદમય અંગવિન્યાસવાળું, સૂક્ષ્મ ચ્યપળ ગતિવાળું, બળવાન, પ્રવૃત્તિવાળું, તથા આરોઝ તેમ જ અવયવોની કિયાઓમાં રોગ વગેરે સામે વિરોધ કરવાની શક્તિવાળું એવું એક શરીર તૈયાર કરવું એ આ તપસ્યાનો પાયાનો કાર્યક્રમ રહેશે.

આ પરિણામો મેળવવા માટે આપણે સામાન્ય રીતે શરીરને અમુક ઈષ્ટ પ્રકારની ટેવ પાડીએ અને આપણા સ્થૂલ જીવનને વ્યવસ્થિત કરવામાં તે ટેવોની મદદ લઈએ તો ઘણું જ સારું થશે. કારણ, શરીરને આપણે જો કોઈ નિયમિત વ્યવહારના ચોકામાં મૂકી આપીએ છીએ તો તે પોતાનું કામ વધારે સરળતાથી કરે છે. પણ આપણે એ પણ ધ્યાન રાખવાનું કે આપણી ટેવો ભલે ગમે તેટલી સારી હોય તોપણ આપણે પાછા તેમના ગુલામ ન થઈ જઈએ. શરીરને આપણે વધુમાં વધુ ચ્યપળ રાખવાનું છે, આપણે જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણી ટેવો બદલી શકીએ તેમ હોવું જોઈએ.

શરીરના સ્નાયુઓને આપણે મજબૂત અને સ્થિતિસ્થાપક બનાવીએ, અને એ સ્નાયુઓમાં એવા તો પોલાદી જ્ઞાનતંત્રાઓ આપણે બાંધી લઈએ કે કોઈ અનિવાર્ય પરિસ્થિતિમાં ગમે તેટલો શ્રમ કરવાની શક્તિ આપણામાં આવી જાય. પરંતુ સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે શરીર પાસેથી જરૂર હોય તેથી લેશ માત્ર પણ વધુ શ્રમ ન લઈએ, શરીરની વૃદ્ધિ તથા વિકાસ માટે જેટલી શક્તિ ખરચવાની જરૂર હોય તેટલી જ શક્તિ શરીર પાસે ખરચાવીએ. જે કોઈ વસ્તુઓ શરીરને થકવી નાખે તેવી હોય, અને આગળ જતાં જેમાંથી શરીરનાં તત્વોનો ક્ષાસ તેમ જ ક્ષય થાય તેમ હોય તે તમામ સામે આપણે ખૂબ જ કડક ચોકીપહેરો રાખવો જોઈએ.

આપણે એક એવું શરીર રચવા માણીએ છીએ કે જે ઉધ્વ ચેતના માટેનું એક બરાબર કરણ બની રહે. આવા શરીરની રચના કરવા માટે યોજાતી શારીરિક કેળવણી આપણી પાસે ઘણી કઠોર ટેવો માણી લે છે. શરીરનો આવો વિકાસ સાધવા માટે આપણી ઊંઘ, આહાર, શારીરિક વ્યાયામ તેમ જ સર્વ પ્રવૃત્તિઓમાં એક ઘણી મોટી નિયમિતતા આપણે સાધવાની છે. આપણે બહુ જ જીણવટપૂર્વક આપણા શરીરની જરૂરિયાતોનો અભ્યાસ કરીએ. વ્યક્તિએ વ્યક્તિએ આ જરૂરિયાતો જુદી જુદી હોય છે. અને એ જરૂરિયાતો મુજબ આપણા શરીરવિકાસ માટેનો એક સામાન્ય કાર્યક્રમ નક્કી કરીએ. આ કાર્યક્રમ એક વાર નક્કી થઈ જાય પછી તેને

ખૂબ જ કડકપણે આપણે વળગી રહેવું જોઈએ, એનો ભંગ કરે તેવી કોઈ પણ ધૂન કે શિથિલતા આપણામાં આવવા ન દેવાં જોઈએ. ‘આ એક વાર’ કહી આપણે નિયમનો જે અપવાદ રૂપે ભંગ થવા દઈએ છીએ તેવું લેશ પણ ન થવા દેવું જોઈએ. આવા અપવાદ રૂપી નિયમભંગો પછી ‘માત્ર એક વાર’થી અટકી જતા નથી. એ ભંગ વારંવાર થતા જ રહે છે. આ લાલચને તમે ‘માત્ર એક વાર’ નમતું આપો તેટલા માત્રથી પણ તમે તમારા સંકલ્પમાં રહેલી વિરોધની શક્તિને ઘટાડી નાખો છો અને ભવિષ્યના અનેક પરાજ્યો માટેનાં બારણાં ખોલી નાખો છો. નિર્ભળતા માત્ર સામે તમારે દાંત ભીસીને આગળા વાસી દેવા જોઈએ. તમારા છાનાછપના રાત્રીવિહિતો તમારે બિલકુલ અટકાવી દેવા જોઈએ. તમે જાણો છો કે એ તમારા આનંદપર્યટનોને અંતે તમે કેવા તો ખલાસ થઈને પાછા ફરો છો. તમારા જઈની કુદરતી કિયાઓને ખલેલ પહુંચાડે એવી મિજબાનીઓ, જાફાતો, ડાંસીઠાંસીને ખાવું, આમાંનું તમારે કશું ન થવા દેવું જોઈએ. આમ તમારા આનંદવિનોદો, કે બીજી પ્રવૃત્તિઓ કે જેમાંથી તમારી શક્તિનો માત્ર બગાડ જ થતો હોય અને જેને અંતે તમે તમારી નિત્ય સાધના માટે અત્યંત ઉદાસ કે અશક્ત બની જતા હો તે સર્વ તમારે સર્વથા વજ્ય ગણવાં જોઈએ. તમારા શરીરને શક્ય હોય તેટલું સંપૂર્ણ કરવાનું લક્ષ્ય રાખો અને તમારું સારું ધ્યાન શરીર ઉપર એકાગ્ર કરી દો. આ માટે તમારે એક સમજદાર અને સુનિયંત્રિત પ્રકારનું જીવન ગાળવાની તપસ્યા આદરવાની રહે છે. તમારા આ આદરને પહુંચવા માટે તમારે હરેક પ્રકારના અતિરેકો, નાના મોટા તમામ દુર્ગુણો વજ્ય કરવા પડશો. તંબાકુ, મદિરા વગેરે જેવાં ધીમાં વિષનું સેવન તમારે બંધ કરવું જોઈશો. આ વસ્તુઓનું સેવન કરતાં કરતાં માણસોને માટે તે જીવનની અનિવાર્ય જરૂર બની જાય છે અને એ વસ્તુઓ પછી તેનું સેવન કરનારની સંકલ્પશક્તિનો તથા સ્મરણશક્તિનો ધીરે ધીરે નાશ કરી નાખે છો. આ ઉપરાંત શરીર અંગે એક બીજી વસ્તુ એવી છે કે જે ભૂલ તો બધાં જ માણસો, મોટામાં મોટા બુદ્ધિશાળી માણસો પણ વિના અપવાદે કરે છે. એ છે ખોરાક પ્રત્યેનું આપણું દૂષિંબિદુ. કઈ વાનગીઓ ખાવી, તેને કેવી રીતે તૈયાર કરવી, કેવી રીતે ખાવી આ બાબતોમાં સૌ કોઈ પારવાર રસ લે છે. આ રસને સ્થાને આપણે ખોરાક પ્રત્યે એક શાખીય દૂષિંબિદુ સ્થાપિત કરવાની જરૂર છે. શરીરને કઈ કઈ વસ્તુઓ જરૂરની છે તેનું આપણે એક લગભગ રાસાયણિક કોટિનું જીબન મેળવી લેવું જોઈએ અને એ જરૂરી વસ્તુઓને પૂરી પાડવા માટે તદ્દન શાખીય પદ્ધતિનો આહુર લેવો જોઈએ. આ છે ખોરાકની મહા તપસ્યા. એ તપસ્યામાં આપણે એક બીજી તપસ્યા ઉમેરવાની રહે છે. એ છે નિદ્રાની તપસ્યા. આ તપસ્યા એટલે કે નિદ્રા લેવી બંધ કરી દેવી એમ નહિ પણ કેવી રીતે નિદ્રા

લેવી એ જાણી લેવાનું છે. સામાન્ય રીતે બને છે તેમ નિદ્રા એ અચેતનતાની અંદર ભૂસકા રૂપ ન બની જવી જોઈએ. આવી નિદ્રા શરીરને તાજગી આપવાને બધલે ઊલંઘું ભારેખમ કરી મૂકે છે. તમે માફકસરનો ભિતાલાર રાખો તથા હુરેક પ્રકારની અતિશયતાનો ત્યાગ કરો. આ બે વસ્તુઓ પણ તમે જો કરી શકશો તો એટલા માત્રથી પણ તમારે ઊંઘમાં જે અનેક કલાકો ગાળવા પડે છે તેમાંથી તમે બચી જશો. પણ નિદ્રાની બાબતમાં તમે કેટલો વખત ઊંઘો છો તેના કરતાં કેવા પ્રકારની ઊંઘ લો છો એ વસ્તુ વિશેષ મહુત્વની છે. ઊંઘમાંથી તમારે ખરેખરો અસરકારક આરામ તેમ જ વિશ્વાંતિ મેળવવાં હોય તો સૂતા પહેલાં કંઈક લેવાનું રાખશો. દૂધ, સૂપ કે ફળના રસ જેવું કંઈક લેશો તો તે બહુ લાભદાયક રહેશે. હળવો ખોરાક તમને બહુ શાંત નિદ્રા આપે છે. એટલે કોઈ પણ સંયોગોમાં વધારે પડતો તો ન જ લેવો. વધુ પડતો ખોરાક તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, તમારી ઊંઘને તામસિક, ભારે, મંદ બનાવી દે છે, એમાંથી તમારા પર ઓથાર ચડી આવે છે. નિદ્રાની બાબતમાં સૌથી વિશેષ મહુત્વની બાબત તો તમારા મનની અવસ્થા છે. સૂતા જતાં પહેલાં તમારું મન જો ચોખ્ખું હશે, તમારી લાગણીઓ શાંત હશે, ઈચ્છાઓના ઊભરા તથા તેને લગતી બીજી નાની મોટી અસ્વસ્થતાઓ શાંત થઈ ગયેલી હશે તો તેથી તમારી નિદ્રાને ઘણો લાભ થશે. એટલે તમારે સૂતાનો વખત થયો હોય તે પહેલાં તમે જો ખૂબ વાતો કરી હોય, ગરમાગરમ ચર્ચાઓ થઈ હોય કે કોઈ બહુ રસિક અને ઉતેજક પુસ્તક વાંચ્યું હોય તો સૂતા પહેલાં થોડો આરામ કરી લેવો ઢીક રહેશે. એવા આરામથી તમારા મનની કિયાઓ શાંત પડશે, અને એકલું શરીર ઊંઘનું રહે અને મગજની કિયાઓ અસ્તિત્વસ્ત રીતે ચાલ્યા કરે તેના જેવી સ્થિતિ નહિ થાય. તમને ધ્યાનનો અભ્યાસ હોય તો સૂતા પહેલાં કોઈ મહાન વિશાળ ચેતના પ્રત્યેની અભીપ્સામાં સ્થિર બની કોઈ ઉચ્ચ અને આરામ આપે તેવા વિચારમાં થોડીક મિનિટો એકાગ્ર બની રહો એ પણ ઢીક રહેશે. તમારી નિદ્રાને તેથી ઘણો લાભ થશે અને ઊંઘ દરમિયાન અચેતનતામાં સરી જવાના જોખમાંથી તમે ઘણો ભાગે બચી જ જશો.

આમ તમારું રાત્રિનું તપ પરૂં કરો, સ્વર્ણ અને શાંતિમય નિદ્રા લઈને શરીરને તમે સંપૂર્ણ આરામ આપી લો તે પછી તમારું દિવસનું તપ શરૂ થશે. આ દિવસની સાધનાને તમારે બહુ વિચારપૂર્વક યોજવાની રહેશે. તમારી દિવસની પ્રવૃત્તિઓને બે ભાગમાં વહેંચી નાખો: એક તો તમારા શરીરના વિકાસ માટે જરૂરની એવી પ્રવૃત્તિ, અને બીજી તમારા નિત્યના વ્યવસાય અંગેની પ્રવૃત્તિ. આ બંને વસ્તુઓ, કસરત તથા કામ શરીરની તપસ્યાનું અંગ બની શકે છે અને બનવી જોઈએ. તમારી કસરતો ક્રમે ક્રમે આગળ વધતી જાય એ રીતે બહુ સમજપૂર્વક ગોઠવાબી જોઈએ.

દરેક જણે પોતાના શરીરને સૌથી વધુ અનુકૂળ હોય તે કસરતો જ પસંદ કરવી જોઈએ. બની શકે તો આ કાર્ય તમારે એવા કોઈ જાણકારની દોરવાણી હેઠળ કરવું જોઈએ કે જે કસરતોને એવી રીતે સંયોજને કમવાર ગોઈવી આપે કે જેથી તેનો વધુમાં વધુ ફાયદો તમને મળે, કસરતની પસંદગી તથા તેનો અમલ એ બાબતમાં લેશ પણ તરંગીપણું ચાલવા ન દેવું જોઈએ. અમૃત કસરત સહેલી છે કે મજેદાર છે એટલા માટે જ તમે ગમે તે વખતે ગમે તે કસરત નહિ કરી શકો. તમારા શિક્ષકને જરૂર જાણાય ત્યારે જ તમારા કસરતના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે, શરીરને સંપૂર્ણ કરવું, વધારે સારું કરવું એ દૃષ્ટિએ જોતાં હુરેક વ્યક્તિનું શરીર એક સ્વતંત્ર કોયડા જેવું છે. અને એ કોયડાનો ઉકેલ બહુ ધીરજથી, ખંત અને નિયમિતતાથી લાવવાનો છે. લોકો ભલે માનતા હોય કે કસરતબાજના જીવનમાં તો મોજમજા જ કરવાની હોય છે, પણ એ વાત સાચી નથી. ખરું જોતાં તો કસરતબાજે પોતાનું દ્યાદ પરિણામ સાધવા માટે એક ઘણું જ કઠોર જીવન ગાળવું પડે છે. ઓણે ખૂબ જ નિયમપૂર્વક તાલીમ લેવાની રહે છે, ઘણી જ કડક ટેવો પાડવાની રહે છે. એના જીવનમાં નકામા અને નુકસાનકારક તરંગોને સ્થાન હોઈ શકતું નથી.

પોતાના નિત્ય વ્યવસાય પ્રત્યે પણ માણસે તપસ્યા કરવાની રહે છે. આ તપસ્યા એટલે પ્રથમ તો તમારે કોઈ પણ કામ પ્રત્યે વિશેષ પસંદગી ન રાખવી જોઈએ, તમે જે કાંઈ કરતા હો તે રસપૂર્વક કરવું જોઈએ, જે વ્યક્તિ પોતાની જાતને સંપૂર્ણ કરવા નીકળે છે તેને માટે પછી જગતમાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી રહેતું. કોઈ એક કામ વધુ મહત્ત્વનું અને બીજા ઓછાં મહત્ત્વનાં એમ નથી રહેતું. જેને પ્રગતિ કરવી છે, આત્મ-પ્રભુત્વ મેળવવું છે તેને માટે બધાં જ કામ એકસરખાં લાભદાયક હોય છે. તમને રસ હોય તેવાં કામ તમે વધારે સારી રીતે કરી શકો છો એમ જે કહેવાય છે તેમાં સત્યનો અંશ તો છે. પરંતુ એથીયે મોટું સત્ય તો એ છે કે તમે જે કાંઈ કરતા હો, એક તદ્દન ક્ષુદ્ર લાગે તેવું કામ કરતા હો તેમાં પણ તમને રસ મળી શકે છે. આ સિદ્ધિની ચાવી તમારામાં પૂર્ણતા માટેની જે ધગશ હોય છે તેમાં રહેલી છે. એટલે તમારે ભાગે જે કોઈ પ્રવૃત્તિ, જે કોઈ કામ આવી પડે તે તમે તમારે પ્રગતિ કરવી છે એવા સંકલ્પપૂર્વક કરતા રહો. તમે જે કામ કરો તે તમારાથી બને તેટલી સારી રીતે કરો એ તો ખરું જ, પણ એથીયે વિશેષ તો એ છે કે તમારા દરેક કાર્ય પાછળ એવી અખંડ જંખના રહેવી જોઈએ કે મારે પૂર્ણ બનવું છે અને તે માટેની પરમ આતુરતાપૂર્વક તમારે કામને વધુ ને વધુ ઉત્તમ રીતે કરતા રહેવું જોઈએ. આ રીતે કરતાં, છેક સ્થૂલ મહેનતના કામથી માંડી અત્યંત કલાત્મક કે બૌદ્ધિક કામો સુધીના તમામ કામો, કાંઈ પણ અપવાદ સિવાય તમારે માટે રસપ્રદ

બની રહેશે. આપણી સમક્ષ પ્રગતિ માટે એક અસીમ અનંત અવકાશ પેદેલો છે અને નાનામાં નાની વસ્તુ પણ આપણે પરમ ગંભીરતાથી કરી શકીએ છીએ.

આમાંથી હવે સ્વાભાવિક રીતે જ આપણે કર્મમાંની મુક્તિમાં આવી પહોંચીએ છીએ. આ કર્મમાંની મુક્તિ એટલે હરેક રીતની સામાજિક ઝળ પ્રાણાલીમાંથી મુક્તિ, હરેક રીતના નેતૃત્વ પૂર્વગ્રહોમાંથી મુક્તિ. બેશક, આનો અર્થ કેવળ સ્વચ્છંદી કે પછી કશાય નિયમના બંધન વિનાનું જીવન એવો તો નથી જ થતો. હવે તો તમે, આથી ઉલદું, એક એવા નિયમનો અંગીકાર કરો છો જે તમામ સામાજિક નિયમો કરતાં પણ ઘણો વધુ કડક નિયમ છે. આ નિયમ તો કોઈ પણ રીતના ભિથ્યાચાર કે દંબને લેશ પણ બરદાસ્ત નથી કરતો. એ મહા નિયમ તો તમારી પાસેથી એક પૂરેપૂરી સત્યનિષ્ઠા માગી લે છે. શરીરની સમતુલ્યા, શક્તિ અને સૌન્દર્યનો વિકાસ થાય એ રીતે જ આપણી તમામ શારીરિક પ્રવૃત્તિઓ યોજાવી જોઈએ. અને આ ધ્યેયને જો સિદ્ધ કરવું હશે તો પછી તમે કોઈ પણ રીતના ઈન્દ્રિય સુખની આરાધના નહિ કરી શકશો. તમારે ઈન્દ્રિયોના તમામ આનંદો વર્જય કરવા પડશો. આ ત્યાગમાં જાતીય આનંદનો પણ ત્યાગ આવી જાય છે. કારણ, જાતીય સંભોગની હરેક કિયા તમને મૃત્યુના મુખમાં જ લઈ જાય છે. એટલા માટે જ હરેક યુગમાં, હરેક ધર્મ સાધનામાં અમૃતત્વના ઉપાસકોને માટે જાતીય સંભોગનો નિષેધ કરવામાં આવેલો છે. એનું કારણ એ છે કે આ કિયાને અંતે વ્યક્તિ ઉપર હમેશાં અચેતનતાનો એક વધુઓછો લાંબો ગાળો ચડી આવે જ છે. એ અચેતનતાની પળોમાં માણસની ચેતના હરેક પ્રકારની અસરો પ્રત્યે ખૂલ્લી જાય છે, અને એક નીચલી અવસ્થામાં સરી પે છે, એટલે જે લોકો ખરેખર જ પોતાને અતિમનસના જીવન માટે તૈયાર કરવા માગતા હોય તેમણે આનંદ, આરામ કે વિશ્રાંતિના બહાના હેઠળ પોતાની ચેતનાને શક્તિના આ દુર્વ્યયમાં તથા અચેતનતાની ખાડમાં કદી પણ સરી પડવા ન દેવી જોઈએ. તમારે વિશ્રામ મેળવવો હોય તો તે અંધકાર કે દુર્ભિતામાં સરી પડીને નહિ પણ શક્તિ અને પ્રકાશમાં પહોંચીને મેળવવો જોઈએ. જીવનમાં પ્રગતિ ઈચ્છનારાઓ માટેનો એકમાત્ર નિયમ તે આત્મ-સંયમ જ છે. પરંતુ પોતાને જેઓ અતિમાનસના આવિર્ભાવ માટે તૈયાર કરવા માગે છે તેમણે તે આત્મસંયમથી પણ આગળ જવાનું છે. આત્મસંયમને સ્થાને તેમણે તો ઈન્દ્રિયોપભોગનો સંપૂર્ણ ત્યાગ સ્વીકારવાનો છે. પૂર્ણ્યોગનો સાધક આ ત્યાગ ઈન્દ્રિયો પર બળાત્કાર કરીને યા તો તેમનું દમન કરીને નહિ સાધે. એ માટે તે એક આંતર પરિવર્તનનો કીમિયો અજમાવશે. એ રીતે કામ કરતાં જે શક્તિઓ સામાન્ય રીતે પ્રજનનની કિયામાં વપરાઈ જાય છે તે બધી પ્રગતિ તથા પૂર્ણ રૂપાંતર માટેની

શક્તિઓ રૂપે પલટો પામે છે. એ વાત કહેવાની તો ભાયે જ જરૂર હોય કે સાચી રીતે લાભકારક અને સંપૂર્ણ એવું પરિણામ સાધવું હોય તો માત્ર સ્થૂલ શરીરના સંકલ્પમાંથી જ નહિ પરંતુ ગ્રાણ અને મનની ચેતનામાંથી પણ જીતીય ભોગની તમામ વૃત્તિ તથા દીદ્ધા સર્વર્થા નિર્મળ કરવાની રહે છે. જે કોઈ રૂપાંતર મૂલગામી તથા સ્થાયી સ્વરૂપનું હોય છે તે એ અંદરથી બહારની દિશામાં આવે છે, બહારનું રૂપાંતર તે આંતર રૂપાંતરનું જ એક સ્વાભાવિક અને અનિવાર્ય પરિણામ હોય છે.

આમ હવે તમારી પાસે એક ચોક્કસ પસંદગીનો પ્રશ્ન આવીને ઉભો રહે છે. કુદરત અત્યારે છે તેવી માનવજીતિને ટકાવી રાખવા માટે વ્યક્તિ પાસે માગણી કરતી રહે છે અને એ માગણીને વશ થઈ કુદરતના લક્ષ્યને સાધવા માટે માગસ તેના હૃથમાં પોતાનું શરીર સોંપી દે છે. તમે હવે પોતાને આ રીતે કુદરતના હૃથમાં મૂકી દેશો કે પછી એક નવી જીતિના સર્જન માટેનું એક નવું પગલું બની રહેવા માટે તમારું આ જે શરીર છે તેને જ તૈયાર કરશો? એટલું તો તમે અવશ્ય યાદ રાખો શકશો કે આ બે વસ્તુઓ કદી સાથે ચાલી શકવાની નથી. હુરેક પળે તમારે એ નક્કી કરવાનું રહે છે કે તમે ગઈ કાલની માનવતામાં પુરાઈ રહેવા માગો છે કે પછી આવતી કાલની પરમ માનવતામાં પહોંચવા માગો છો.

તમારે જો ભાવિમાં આવી રહેલા જીવન માટે તૈયાર થવું હશે, તથા એ જીવનના એક સક્રિય અને સુયોગ્ય અંગ રૂપ બની રહેવું હશે તો તમારું જીવન અત્યારે તેનો જે ઘાટ છે તે મુજબનું જ બની રહે એવા જીવનમાં તમને સફળતા મળે એ ભાવના તમારે પડતી મૂક્કવી પડશે.

તમારે પૂર્ણ સૌન્દર્યમય અને સંવાદિતામય જીવનનો આનંદ માણવો હશે તો પછી દીન્દ્રિયસુખોનો ત્યાગ કરવો જ પડશે.

(બુલેટિન, કેબ્ઝુઆરી ૧૯૫૩)



## શક્તિની તપસ્યા

આમાંથી હવે આપણે સહજ રીતે ગ્રાણની તપસ્યામાં આવી પહોંચીએ છીએ. ગ્રાણની તપસ્યા એટલે સંવેદનોનું તપસ, શક્તિની તપસ્યા. ગ્રાણ સાચે જ શક્તિનું સ્થાન છે. તમને સાક્ષાત્કાર કરાવી આપે તેવા ઉત્સાહો તેમાં છે. મનમાં રહેતો વિચાર ગ્રાણમાં આવીને સંકલ્પનું રૂપ લે છે અને કર્મ માટેની એક સક્રિય શક્તિ બને છે. ગ્રાણ એ ઈચ્છાઓ તથા આવેશોનું પણ સ્થાન છે એ વાત પણ સાચી છે. ગ્રાણમાં ઉગ્ર વૃત્તિઓ તથા એવા જ ઉગ્ર પ્રત્યાવાતો, બંડ અને વિષાદ પણ આવી રહેલાં છે. આવા ગ્રાણનો કોયડો ઉકેલવા માટેની સામાન્ય રીત એ ગણાય છે કે ગ્રાણને ગુંગળાવી નાખવો, સંવેદનોથી તેને વંચિત રાખીને ભૂખે મારી નાખવો. હા, એ વાત ખરી છે કે ગ્રાણનો મુખ્ય ખોરાક સંવેદનો જ છે. અને સંવેદનો ન મળે તો તે ઊંઘી જાય છે, શાથિલ અને જડ થઈ જાય છે અને આખરે સાવ ખાલી થઈ જાય છે.

ગ્રાણના નિર્વાહ માટેની સામગ્રી ખરું જોતાં તો ત્રણ દિશામાંથી આવી મળતી હોય છે. આમાંની સૌથી પહેલી દિશા તે નીચેની બાજુની દિશા છે. એ દિશામાંથી ગ્રાણને ઇન્દ્રિયોનાં સંવેદનો મારફતે સ્થૂલ શક્તિઓની સામગ્રી બહુ જ સરળ રીતે મળતી રહે છે.

ગ્રાણને માટે સામગ્રીનું બીજું દ્વાર તેની પોતાની જ સમાન ભૂમિકા ઉપર રહેલું છે. ગ્રાણ જો પૂરતા પ્રમાણમાં વિશાળ અને ગ્રહણશીલ હોય છે, તથા વિશ્વરૂપ ગ્રાણશક્તિઓ સાથે તે જો સંપર્કમાં હોય છે તો તેમાંથી પણ તેને પોતાના નિર્વાહની સામગ્રી આવી મળે છે.

ગ્રાણની સામગ્રીનું ત્રીજું મૂળ ઉપરની દિશામાં રહેલું છે. ગ્રાણમાં જ્યારે પ્રગતિ માટેની કોઈ મહાન અભીષ્ટા જાગે છે ત્યારે જ આ દિશા તરફ તે સામાન્ય રીતે ખુલ્લો બને છે. એ ઉધ્વર ભૂમિકામાં રહેલાં આધ્યાત્મિક બળોને તથા પ્રેરણાઓને તે પોતામાં પ્રવેશવા દે છે અને તેમને પોતામાં પચાવીને તે પોતાની પુષ્ટિ મેળવે છે.

આ ત્રણ ઉપરાંત એક ચોથા મૂળમાંથી પણ માણસો ગ્રાણની સામગ્રી મેળવવાને લગભગ હુમેશાં પ્રયત્ન કરતા રહે છે. પણ સાચે સાથે એ હકીકત પણ નોંધવાની છે કે માણસોને જીવનમાં મળતી ઘણીખરી યાતનાઓ તેમ જ કમનસીબીઓ પણ આ જ મૂળમાંથી મળી આવતી હોય છે. આ વસ્તુ તે બીજાં માણસો સાથેનો ગ્રાણશક્તિઓનો વિનિમય છે. આ વિનિમય મોટે ભાગે બબ્બેના જોડમાં મળીને

માણસો કરે છે. લોકો ભૂલથી એમ માની લે છે કે આ તો પ્રેમ છે, પણ વસ્તુતઃ તેમાં પ્રેમ જેવું કાંઈ જ હોતું નથી. તે માત્ર પરસ્પરના વિનિમયમાં રાચતાં બે બળો વચ્ચેનું આકર્ષણ જ હોય છે.

આ સ્થિતિમાં હવે આપણો જો પ્રાણને ભૂખે મારવો ન હોય તો પછી તેને મળતાં સંવેદનો આપણો પાછાં ઠેલી દેવાનાં નથી, ઘટાડી નાખવાનાં નથી, બુંધાં કરી નાખવાનાં નથી તેમ જ તેમનાથી ભાગી જવાનું પણ નથી. પ્રાણની તપસ્યાનો માર્ગ આ નથી. એ તપસ્યા સંવેદનોનો વિવેક અને શાનપૂર્વક ઉપયોગ કરવામાં રહેલી છે. સંવેદનો શાન તથા કેળવાણી મેળવવા માટેનું એક અત્યંત ઉત્તમ દુષ્ટિયાર છે. અને એટલે સંવેદનો પાસેથી આ રીતનું કામ લેવું હોય તો તેમનો ઉપયોગ આપણા અહંકારના કોઈ હેતુને સાધવા માટે ન થવા દેવો જોઈએ. ઈન્દ્રિય-સુખ તથા આત્મતૃપ્તિ મેળવવા માટેની આપણી અંધ અને અજ્ઞાનભરેલી પ્રવૃત્તિમાં તેમને આનંદના સાધન તરીકે ન વાપરવાં જોઈએ.

આપણી ઈન્દ્રિયો પોતે હરેક વસ્તુને લેશ પણ ઘૂણા કે અગ્રસન્તા વિના ભેટી શકે તેવું સામર્થ્ય તેમનામાં આવી જવું જોઈએ. પરંતુ આ સાથે ઈન્દ્રિયોમાં એક વિવેકશક્તિ પણ આવવી જોઈએ તથા ખીલવી જોઈએ. એ શક્તિ વે ઈન્દ્રિયો પ્રાણનાં વિવિધ આંદોલનોનું સ્વરૂપ, મૂળ તથા પરિણામ સમજી શકે તેવી થવી જોઈએ. તેમ જ એ આંદોલનો આપણા શરીર તથા પ્રાણની સ્વર્ણતા તથા પ્રગતિને માટે મદદ રૂપ થઈ શકે તેવાં છે કે નહિ તે જ્ઞાન પણ ઈન્દ્રિયોને આમાંથી થવું જોઈએ. આ ઉપરાંત, સ્થૂલ જગતોને તથા પ્રાણમય જગતોને તેમનાં તમામ સંકુલ સ્વરૂપોમાં સમજવા તથા અભ્યાસ કરવા માટેનાં સાધન તરીકે પણ ઈન્દ્રિયોનો ઉપયોગ થવો જોઈએ. આ બધું થશે ત્યારે ઈન્દ્રિયોને રૂપાંતર માટેના માનવજીતિના મહા પ્રયત્નમાં પોતાનું સાચું સ્થાન મળી રહેશે.

આપણે પ્રાણને દુર્ભળ કરી નાખીશું તો તેથી આપણી સાચી પ્રગતિ સાધવામાં આપણને કશી જ મદદ નહિ મળે. પ્રાણને પ્રકાશિત કરીને, બળવાન તથા વિશુદ્ધ કરીને જ આપણે સાચી પ્રગતિ સાધી શકીશું. શરીરને ખોરાક ન આપવાથી જેમ નુકસાન થાય છે તે જ રીતે પ્રાણને સંવેદનોથી વંચિત રાખવાથી પણ નુકસાન થાય છે. પરંતુ આ સંવેદનોની પસંદગી પણ આપણે શરીરના ખોરાકની પસંદગી જે રીતે ડહાપણ વાપરીને તથા અમુક દૃષ્ટિપૂર્વક કરીએ છીએ તેવી જ રીતે કરવાની રહે છે. પ્રાણ એક મહાન કિયાશક્તિ ધરાવતું કરણ છે. આપણા સ્વરૂપના અન્ય સર્વ અંશોની પ્રગતિ માટે એ કરણ એક અત્યંત અનિવાર્ય એવી વસ્તુ છે. એટલે, શરીરના ખોરાકની પસંદગી પાછળ શરીરની કિયાઓ બરાબર થતી રહે તથા

શરીરની વૃદ્ધિ થાય એવી દૃષ્ટિ આપણે રાખીએ છીએ તે જ રીતે આ પ્રાણ રૂપી કરણની વૃદ્ધિ તથા સંપૂર્ણતાને દૃષ્ટિમાં રાખીને જ પ્રાણ માટેનાં સંવેદનોની આપણે પસંદગી કરવાની રહે છે.

પ્રાણને આપણે કેળવવાનો છે, તેને વધુ સંસ્કારી, વધુ સંવેદનશીલ, વધુ સૂક્ષ્મ બનાવવાનો છે, તથા આપણે કહીશું કે તેને શાનદાર પણ, એ શબ્દના ઉત્તમ અર્થમાં, બનાવવાનો છે. તેને આ રીતે સંસ્કારીને જ આપણે તેમાં રહેલી ઉગ્રતાઓ તથા પાશવતાઓને જીતી શકીશું. કારણ કે પ્રાણમાં રહેલાં અજ્ઞાન અને અસંસ્કારિતાને લીધે જ, તેનામાં રસવૃત્તિના રહેલા અભાવમાંથી જ સામાન્ય રીતે આ ઉગ્રતાઓ અને પાશવતાઓ જન્મતી હોય છે.

ખરું જોતાં તો, પ્રાણ કેળવાયેલો નથી હોતો ત્યારે તે જેમ કુદરતી રીતે જ અસંસ્કારી, અહુંપ્રધાન અને વિકૃત હોય છે તેવી જ રીતે તે જ્યારે કેળવાય છે, પ્રકાશ પામે છે, ત્યારે તે એટલો જ ઉમદા, વીર અને નિઃસ્વાર્થી બની શકે છે. માનવમાત્રમાં સુખ માટેની એક જંખના વસેલી છે. એ જંખનાને જો અતિમનસની પરમ સમૃદ્ધિ માટેની અભીષ્ટામાં પલટી લેવાનું જ્ઞાન દરેક માણસને થઈ જાય તો તેટલું પણ બસ થયું ગણાય. અને આ માટે, પ્રાણની કેળવણીને જો ખંતપૂર્વક અને સાચા હિલથી ખૂબ ખૂબ આગળ વધારવામાં આવે તો પછી માનવના જીવનમાં એક એવી ક્ષાણ જરૂર આવે છે કે જ્યારે પ્રાણને પૂરી ખાતરી થઈ જાય છે કે અરે, મારી સમક્ષા તો એક ઘણું મહાન, ઘણું સુંદર, ઘ્યેય આવી રહેલું છે. અને એ પ્રગતિ થઈ ગયા પછી પ્રાણ પરમાત્માના હિવ્ય આનંદને પ્રાપ્ત કરવા માટે સજજ બને છે અને ઈન્ડ્રિયોની ક્ષુદ્ર અને ભામક તૃપ્તિઓને સર્વથા પડતી મૂકી દે છે.

(બુલેટિન, ફેબ્રુઆરી ૧૯૫૩)

\*

## જ્ઞાનની તપસ્યા

આપણે મનની તપસ્યાનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રથમ તો આપણને એ જ ઘ્યાલ આવે છે કે આમાં આપણે લાંબાં લાંબાં ધ્યાન કરવામાં આવશો, એમાંથી આપણા ચિત્ત ઉપર આપણે કાબૂ મેળવી શકીશું, અને છેવટે એની પરમ સિદ્ધિ તરીકે આપણને આંતર નીરવતાની પ્રાપ્તિ થશે. યોગસાધનાની આ બાજુ આપણને ઘણી પરિચિત છે અને તેથી તેના ઉપર વિસ્તૃત વિવેચન કરવાની જરૂર નથી. પરંતુ આ સાધનાની એક બીજી બાજુ પણ છે જેના પ્રત્યે લોકોનું ધ્યાન સામાન્ય રીતે બહુ ઓછું ગયેલું છે. એ છે વાણીનો સંયમ. આપણા વિચારકો, અમુક જૂજ અપવાદ સિવાય, વાણીના સ્વચ્છં ઉપયોગની સામે કેવળ મૌનની જ હિમાયત કરે છે. પરંતુ વાણીનો એકદમ લય કરી નાખવો તેના કરતાં વાણી ઉપર કાબૂ મેળવવો એમાં એક વધુ મહાન તપસ્યા રહેલી છે અને એ તપસ્યા વધુ લાભદાયક પણ છે.

પૃથ્વી ઉપર અર્થવાળા અવાજનો ઉપયોગ કરી શકે તેવું પહેલું ગ્રાણી તે માણસ છે. મનુષ્ય પોતાની આ શક્તિ વિશે મગઝરી ધરાવે છે અને એ શક્તિનો કશી મર્યાદા કે વિવેક વિના મનફાવતો ઉપયોગ કર્યે જાય છે. માણસની આ વાણીના ઘોંઘાટથી જગતના કાન ખરેખર બહેરા થઈ રહ્યા છે, અને કેટલીક વાર તો આપણને લગભગ એમ જ લાગે છે કે વનસ્પતિની દુનિયામાં જે એક સંવાદ પૂર્ણ મૌન વસેલું છે તે માણસની દુનિયામાંથી તો ખરેખર ચાલ્યું જ ગયેલું છે.

એ પણ એક જાગીરી બીજા છે કે માણસમાં મનની શક્તિ જેમ ઓછી હોય છે તેમ તેને વધારે બોલવાની જરૂર પડે છે. દાખલા તરીકે આપણે એવા કેટલાક જંગલી તથા કેળવાણી વિનાના લોકો જોઈએ છીએ કે જેઓ પોતે મોંઅથી બોલે નહિ ત્યાં લગી વિચાર કરી શકતા નથી. તમે જોશો કે એવા લોકો થોડાઘણા નીચા અવાજે કંઈક ગણગાણ્યા કરતા હોય છે, પોતાની વિચારમાળાને આગળ લંબાવવા માટે એમની પાસે આ જ રીત હોય છે. એ લોકો બોલે નહિ ત્યાં સુધી તેમનો વિચાર આકાર લઈ શકતો નથી.

વળી એવા પણ ઘણા લોકો હોય છે કે જેઓને પોતે શું કહેવા માગે છે તે વસ્તુ પોતે બોલવા માડે છે ત્યારે જ સમજવા લાગે છે. ભારેલા લોકોમાં પણ જે લોકો નભળી મનઃશક્તિવાળા હોય છે તેમની પણ આ પ્રમાણે જ સ્થિતિ હોય છે. એવા લોકોની વાતચીત ખૂબ જ લાંબી લાંબી અને કંટાળાજનક બની જાય છે. એ લોકો બોલવા લાગે છે ત્યારે તેમના વિચારો વધારે સ્પષ્ટ થતા જાય છે, યોક્કસ થતા

જાય છે. અને એ કારણે પોતાના કથનને વધુ ને વધુ ચોક્કસ રીતે કહેવા માટે તેઓ એકની એક વાત ફરીને કહેતા રહે છે.

કેટલાક લોકો એવા પણ હોય છે કે જેમને પોતાને કહેવાની વસ્તુ વિષે આગણથી તૈયારી કરવી પડે છે. એમને તમે એકદમ બોલવાનું કહેશો તે તેમની જીબ અચકાવા લાગશે. પોતાના કથનને બરાબર કરીબંધ રીતે ચોક્કસ શબ્દોમાં ગોઈવવા માટેનો સમય તેમને મળેલ નથી હોતો એટલે આમ બનતું હોય છે.

બોલનારાઓના વર્ગમાં છેલ્લો વર્ગ જન્મસિદ્ધ વક્તાઓનો આવે છે. વક્તવ્યની કળા તેમને વરેલી હોય છે. પોતાના કથનને રજૂ કરવા માટે જોઈતા શાંદો તેમને આપોઆપ મળી આવે છે. અને પોતાના વક્તવ્યને તેઓ સરસ રીતે કહી પણ આપે છે.

પરંતુ મનની તપસ્યાની દૃષ્ટિ જોતાં આ બધી વસ્તુઓ વાતોડિયાપણાની કક્ષામાં જ આવી જાય છે. કારણ બોલવાની અનિવાર્ય જરૂર વિના એક પણ શબ્દ બોલવો તેને હું વાતોડિયાપણું જ ગણું છું. હા, તમે પૂર્ણી શકો છો કે બોલવા માટે આવી અનિવાર્ય જરૂર ક્યારે સમજવી. અને એ વસ્તુ સમજવા માટે આપણે બોલાતી વાણીની સર્વ કક્ષાઓનું એક સામાન્ય વર્ગિકરણ કરીને વિચાર કરીશું.

બોલાતા શબ્દોમાં પહેલો વર્ગ છે સ્થૂલ ભૂમિકા ઉપરના બાધ્ય વ્યવહારને ખાતર વપરાતા શબ્દોનો. આવા શબ્દોની સંખ્યા સૌથી મોટી છે અને સામાન્ય જીવનમાં ઘણે ભાગે તે શબ્દો જ સૌથી વધુ ઉપયોગના હોય છે.

આપણા રોજિંદા વ્યવહારમાં શબ્દોનો આ અખંડ ગણગણાટ આપણને અનિવાર્ય જેવો જ લાગે છે. પરંતુ તમે આ ઘોંઘાટને ઓછામાં ઓછો કરી નાખવા પ્રયત્ન કરશો તો તમને જણાવા લાગશે કે ઘણીએક વસ્તુઓ તમે જો બોલ્યા વિના મૂંગા મૂંગા કરશો તો તે વધારે સારી રીતે અને વધારે જડપથી થઈ શકે છે. એવી શાંત કિયા તમારી આંતર શાંતિને તથા એકાગ્રતાને ટકાવી રાખવામાં પણ મદદગાર બને છે.

તમારે જો એકલા રહેવાનું ન હોય અને બીજાઓની સાથે રહેવું પડું હોય તો પછી તમે એવી ટેવ પાડો કે જેથી તમારે બોલી બોલીને તમારી જાતને સતત બહિરૂખ ન બનાવવી પડે. અને તમે જોશો કે તમારી અને બીજાઓની વચ્ચે ધીરે ધીરે એક આંતરિક સમજૂતી સ્થપાતી જાય છે. તે પછી તમે તમારી વાત ઓછામાં ઓછા શબ્દો દ્વારા અથવા બિલકુલ શબ્દ વિના પણ બીજાને પહોંચાડી શકશો. આ બહારની નીરવતા તમારી આંતરિક શાંતિને માટે પણ બહુ અનુકૂળ હોય છે અને તમારામાં જો શુભેચ્છા અને અખંડ અભીષ્ટા હશે તો તમે એવું વાતાવરણ સર્જ શકશો કે જે પ્રગતિને માટે બહુ જ પોષક નીવડશો.

બીજા માણસોની સાથેના જીવન વ્યવહારમાં આપણે આપણી આજવિકા

અને બીજુ સ્થૂલ પ્રવૃત્તિઓને અંગે જે શબ્દો વાપરીએ છીએ તે ઉપરાંત સંવેદનો, લાગણીઓ અને ઉમિઓને વ્યક્ત કરતા શબ્દો પણ આપણે વાપરતા હોઈએ છીએ. અને આ બાબતમાં આપણાને બાધ્ય મૌન જાળવવાની જો ટેવ પડેલી હોય તો તે બહુ જ કિંમતી મદદ રૂપ થઈ પડે છે. તમારા ઉપર જ્યારે કોઈ સંવેદન કે લાગણીનું મોજું ધસી આવે ત્યારે આ મૌનની ટેવને લીધે તમને વિચાર કરવા માટે જરૂરી વખત મળી જાય છે અને જરૂર પડે તો, તમારી લાગણીઓ અને સંવેદનોને તમે શબ્દોમાં બહાર કાઢી નાખો તે પહેલાં જ તમે અટકી જાઓ છો અને સાચે જ, આ રીતે કેટલા બધા ઝગડા ટાણી શકાય તેમ છે! આપણા ઉપર કેટલીયે માનસિક આફતો ઘણી વાર માત્ર વાણીના અસંયમને કારણે જ તૂટી પડતી હોય છે. આ મૌનની ટેવ દ્વારા તમે આવી કેટલીયે મુસીબતોમાંથી બચી જશો.

તમે આટલો બધો સંયમ ન પાળી શકો તોપણ તમે જે કાંઈ બોલતા હો તેના ઉપર તમારો કાબૂ તો હમેશાં રહેવો જ જોઈએ. ઝનૂન, ગુસ્સો કે મિજાજના આવેશમાં આવી જઈ તમારી જીબ ગમે તે બોલવા લાગે તેમ કદ્દી ન થવા દેવું જોઈએ. આવી જીબને લીધે ઝગડા ઊભા થાય છે જ. પરંતુ આ ઉપરાંત પણ બીજું એક પરિણામ આવે છે. તમારી જીબના આવા બેકાબૂ ઉપયોગને લીધે વાતાવરણમાં એક જાતનાં અનિષ્ટ આંદોલનો ઉત્પન્ન થાય છે. અવાજનાં આ આંદોલનો એક અત્યંત ચેપી વસ્તુ હોય છે. એ આંદોલનોને પ્રગટ થવા દેવાની તક આપીને તમે તેને તમારી અંદર તેમ જ બીજાઓની અંદર પણ એક કાયમની વસ્તુ બનાવી દો છો.

આપણે બીજાઓ વિષે જે કાંઈ બોલીએ છીએ તેને પણ એક પ્રકારનું વાતોડિયાપણું જ ગણવું જોઈએ, અને આ રીતની વાતચીત એ તો એક અત્યંત ખરાબ વસ્તુ છે.

તમારે અમુક માણસો માટે વાલી તરીકે, શિક્ષક તરીકે કે પછી ખાતાના ઉપરી તરીકે જવાબદારી હોય તો જ તેના વ્યવહાર માટે તમારે કાંઈ વિચારવાનું રહે છે. જે માણસોની સાથે તમારે આવો કાંઈ સંબંધ ન હોય તે પછી શું કરે છે કે શું નથી કરતા તે વિષે તમારે કશી જ લેવાદેવા રહેતી નથી. બીજા માણસો વિષે તમારે કશો પણ વાત ન કરવી જોઈએ, તેમને વિષે યા તો તેમના વ્યવહાર વિષે તમારે કશો અભિપ્રાય ન આપવો જોઈએ, અથવા તો બીજા લોકો એમને માટે શું ધારે છે કે શું બોલે છે તે વાત પણ તમારે બીજા કોઈને પાછી ફરી ફરીને કહી સંભળાવવી ન જોઈએ.

હા, તમે કોઈ અમુક ખાતામાં કે વેપાર રોજગારમાં કે કોઈ સહકારી કામોમાં કામ કરતા હોય ત્યારે ત્યાંના કામકાજ અંગે રિપોર્ટ કરવાની ફરજ તમારા ઉપર આવી શકે છે. એવું હોય ત્યારે તમારો અહેવાલ જે તે, કામ પૂરતો જ મર્યાદિત રહેવો

જોઈએ, તેમાં કોઈ પણ અંગત વસ્તુ તમારે આવવા દેવી ન જોઈએ. તમારું નિવેદન માત્ર વિષય પૂરતું જ રહે. તેમાં તમારો કોઈ પણ અંગત રીતનો પ્રત્યાધાત, તમારી પસંદગી, સહાનુભૂતિ કે વિરોધની લાગણી આવવાં ન જોઈએ. અને ખાસ કરીને, તમને મળેલા કામની અંદર તમારા ક્ષુદ્ર અંગત રાગદ્રેષને તો કદી દાખલ ન થવા દેશો.

આમ હરેક સંજોગોમાં તેમ જ સર્વસામાન્ય રીતે પણ બીજાઓ વિષે તમે જેટલું ઓછું બોલશો — પછી ભલે તે તેમની પ્રશંસા રૂપે પણ હોય — તેટલું વધુ ટીક રહેશો. આપણી પોતાની અંદર શું ચાલી રહ્યું હોય છે તે જાણવું એ પણ કેટલી બધી અધરી વસ્તુ છે? ત્યાં પછી બીજાઓની અંદર શું ચાલી રહ્યું છે તે વસ્તુ તો ખાતરીપૂર્વક જાણી શકાય જ કેવી રીતે? એટલે, કોઈ પણ વ્યક્તિ અંગે જારો કે તમે છેવટનો ચુકાદો આપી દેતા હોય તેવી રીતે કદી ન બોલો. તમારા એવા ચુકાદામાં જો કાંઈ દ્રેખનું તત્ત્વ નહિ હોય તે પછી એમાં ભારોભાર મૂર્ખતા જ હશે.

વિચારને જ્યારે વાણી દ્વારા પ્રગટ કરવામાં આવે છે ત્યારે એ અવાજનાં આંદોલનોમાં પણ એક શક્તિ હોય છે. એ શક્તિ તમારા વિચારને સાવ સ્થૂલમાં સ્થૂલ પદાર્થ સાથે પણ જોડી દે છે. અને એ રીતે એ વિચારને તે એક મૂર્ત અને અસરકારક વસ્તુ બનાવી આપે છે. આ કારણે જ તમારે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ વિષે કિંચિત્ પણ ખરાબ ન બોલવું જોઈએ. તમારી વાણી દ્વારા એવી એક પણ વસ્તુ ન બોલાવી જોઈએ કે જે જગતમાં દિવ્યતાના સાક્ષાત્કારની દિશામાં જે પ્રગતિ થઈ રહેલી છે તેની લેશ પણ વિરુદ્ધમાં જતી હોય. આ એક અફર એવો સર્વસામાન્ય નિયમ છે. પરંતુ અને એક અપવાદ છે. જે વસ્તુઓ કે કાર્યોને તમે ટીકાપાત્ર ગણતા હો તેને વિભેરી નાખવા માટે યા તો નવું રૂપ આપવા માટે તમારામાં સક્રિય સંકલ્પ હોય, તે માટેની તમારામાં એક સજ્ઞાન શક્તિ હોય તો તમે ટીકા કરી શકો છો. ખરી રીતે તો આ સજ્ઞાન શક્તિમાં અને સક્રિય સંકલ્પમાં એક એવું બળ આવી શકે છે કે જે વે તમે ડેઠ જડતત્ત્વમાં પણ એક એવી શક્તિ પૂરી શકો છો કે જેને લીધે તે ખરાબ આંદોલનો સામે પ્રત્યાધાત આપી શકશો, તેનો ઈન્કાર કરી શકશો, અને છેવટે જતાં એ આંદોલનોને એવાં તો ટીક કરી આપશો કે તે સ્થૂલ ભૂમિકા ઉપર પ્રગટ થતાં જ અટકી જશે.

પરંતુ આ એક જોખમ તથા સાહસનું કામ છે. જે વ્યક્તિએ જ્ઞાનની ભૂમિકા સિદ્ધ કરેલી હશે તથા જેની માનસિક શક્તિઓમાં આત્માનો પ્રકાશ તથા સત્યની શક્તિ આવી રહેલાં હશે તેવી વ્યક્તિ જ આ કાર્ય વિના જોખમે સફળ રીતે કરી શકશો. આવી વ્યક્તિ, કર્મનો આ દિવ્ય કર્તા, સર્વ પ્રકારના રાગદ્રેષ તથા આસક્તિથી મુક્ત હોય છે. પોતાની અંદરથી તેણે અહંકારની મર્યાદાઓ તોડી નાખેલી હોય છે. પૃથ્વી ઉપર અતિમનસના કાર્ય માટે તેણે પોતાની જાતને એક પૂરેપૂરું વિશુદ્ધ અને

કશા અંગત વ્યક્તિત્વ વિનાનું શુદ્ધ કરાણ બનાવી લીધેલી હોય છે.

અત્યાર સુધીમાં આપણે વ્યવહારમાં બોલાતા શબ્દોનો વિચાર કર્યો, હવે આપણે એક બીજા પ્રકારના શબ્દોનો વિચાર કરીશું. એ શબ્દો તે વિચારો, અભિપ્રાયો, ચિંતન તથા અભ્યાસનાં પરિણામોને વ્યક્ત કરવા માટે વપરાતા શબ્દો છે. અહીં આપણે હવે બુદ્ધિના પ્રદેશમાં આવીએ છીએ. આપણને કદાચ એમ લાગશે કે આ વિષયમાં તો લોકો વધારે સમજદાર હશે, સમતોલપણે કામ કરતા હશે, અને તેથી આ ક્ષેત્રમાં અતિશય કડક તપસ્યાની જરૂર નહિ રહેતી હોય. પરંતુ અહીં પણ પરિસ્થિતિ બહુ સારી નથી. આ જ્ઞાનની અને વિચારોની ભૂમિમાં પણ માણસો પોતાની પ્રતીતિઓને ઝન્ઝન્પૂર્વક ઉચ્ચારતા ફરે છે, અહીં પણ સાંપ્રદાયિક અસહિષ્ણુતા છે, રાગ્ન્દ્રેષના આવેશો છે. એટલે આ ક્ષેત્રમાં પણ આપણે એટલી જ કડક રીતે મનની તપસ્યા આચરવાની રહે છે. આપણે જેમાંથી ઘણી વાર ગરમાગરમ વાદાવાદી ઊભી થઈ જાય છે તેવા વિચારોનો તમામ વિનિમય બહુ જ કાળજીપૂર્વક બંધ કરી દેવો જોઈએ. એવી વાદાવાદી લગભગ શૂન્યમાં જ પરિણામતી હોય છે. વળી બીજા લોકોની માન્યતાઓનો વિરોધ કરવાનું પણ બંધ કરી દેવું જોઈએ. એવા વિરોધનું પરિણામ ગરમાગરમ ચર્ચાઓ અને ઝગડામાં પણ આવતું હોય છે. આ બધું મનની સંકુચિતતામાં આવે છે. મનના પ્રદેશમાં તમે ઢીક ઢીક ઊચે પહુંચ્યો જાઓ છો ત્યારે આ વસ્તુઓને તમે સહેલાઈથી મટાડી શકો છો.

આપણે જે કાંઈ વિચારો બાંધીએ છીએ તે તો એક અનિવાર્ય એવી શબ્દાતીત વસ્તુને વાણીમાં વ્યક્ત કરવાની અનેક રીતોમાંની એક રીત છે. આ જ્ઞાન જ્યારે આપણને થઈ જાય છે ત્યારે પછી કોઈ પણ રીતની સાંપ્રદાયિક મનોવૃત્તિમાં રહેવું ખરેખર અશક્ય જ બની જાય છે. દરેક વિચારની અંદર સત્યનો કંઈક અંશ યા સત્યનું કોઈક પાસું તો રહેલું હોય છે જ. પરંતુ એવો કોઈ પણ વિચાર જગતમાં નથી કે જે સંપૂર્ણ રીતે સત્ય હોય.

વસ્તુઓની આ સાપેક્ષતાનું ભાન જો આપણને રહે છે તેને લીધે આપણી સ્વસ્થતા ટકાવી રાખવામાં, વાતચીતમાં એક શાંત સમતોલપણું જગતવામાં આપણને બહુ જ સમર્થ મદદ મળી રહે છે. આ વિષયનું કંઈક જ્ઞાન ધરાવનાર એક વૃદ્ધ ગુણવિનને કહેતાં મેં સાંભળેલા કે, ‘જગતમાં મૂળે ખરાબ હોય તેવી વસ્તુ કોઈ છે જ નહિ. તકલીફ માત્ર એટલી જ છે કે વસ્તુઓ તેમના સાચા સ્થાને નથી. દરેક ચીજને તેના યોગ્ય સ્થાને મૂકી આપો અને જગત સંવાદથી ભરેલું બની જશો.’

પરંતુ કાર્યની દૃષ્ટિથી જોતાં, દરેક વિચારમાં વ્યવહારમાં સિદ્ધ થવા માટે જેટલી શક્તિ હોય છે તે મુજબ તે વિચારનું મૂલ્ય રહે છે. હા, એ સાચું છે કે વિચારમાં

રહેતી આ શક્તિ જુદી જુદી વ્યક્તિઓમાં જુદી જુદી રીતે કામ કરે છે. અમુક વિચાર એક માણસ ઉપર ખૂબ જ પ્રબળ અસર નિપાત્રે છે તો બીજા ઉપર તેની કશી પણ અસર નથી હોતી. પણ આ શક્તિ પોતે પણ એક ચેપી વસ્તુ છે. અમુક વિચારો આખા જગતને બદલી શકે તેવી શક્તિ ધરાવતા હોય છે. અને આવા વિચારોને જ આપણે વ્યક્ત કરવા જોઈએ. આત્માના વ્યોમમાં આવા વિચારો માર્ગદર્શક તારકો જેવા હોય છે. પૃથ્વીને તેના પરમ સાક્ષાત્કાર પ્રત્યે એવા વિચારો જ લઈ જાય છે.

શબ્દોનો હવે છેવટનો વર્ગ તે શિક્ષણ આપવાના હેતુથી બોલાતા શબ્દોનો વર્ગ છે. આ પ્રકારનો શબ્દવર્ણ ઠેઠ બાળશાળાઓથી માંડી તે વિદ્યાપીઠોના અભ્યાસક્રમ સુધી ફેલાયેલો છે. એ વર્ગમાં રસ યા તો જ્ઞાન આપવા માટે લખાયેલાં સર્વ પ્રકારનાં કળા અને સાહિત્યનાં સર્જનોનો સમાવેશ પણ થઈ જાય છે. આ પ્રદેશમાં, પ્રત્યેક પુસ્તક પોતે કેટલું મૂલ્ય ધરાવતું હોય છે તેના ઉપર બધો આધાર રહે છે. આ વિષય ઘણો વિશાળ હોઈ તેની સંપૂર્ણ ચર્ચા અતે શક્ય નથી. પરંતુ આ બાબતમાં એ વાત સાચી છે કે હમણાં હમણાં કેળવણી માટેની કાળજી બહુ જ વ્યાપક બની રહેલી છે તથા શિક્ષણમાં વિજ્ઞાનની છેલ્લામાં છેલ્લી શોધોનો ઉપયોગ કરવા માટે તથા તેમને કેળવણીની સેવામાં રજૂ કરવા માટે પ્રશંસનીય પ્રયત્નો ચાલી રહેલા છે. પરંતુ આ બાબતમાં પણ સત્યના અભીષ્ટુ માટે એક તપસ્યાની જરૂર ઊભી રહે છે જ.

એક વસ્તુ સામાન્ય રીતે બધાએ સ્વીકારી લીધેલી છે કે બાળકને તથા મોટાંઓને પણ અભ્યાસમાં લાગતા થાકને હળવો કરવા માટે, તથા આરામ આપવા માટે કેળવણીની પ્રક્રિયામાં એક હળવું, આનંદોત્પાદક અને ધીછરા પ્રકારનું સાહિત્ય પણ દાખલ કરી શકાય. અમુક દૃષ્ટિથી જોતાં આ સાચું છે. પરંતુ દુર્ભાયની વાત એ છે કે આ આરામ આપવાને બહુને શિક્ષણમાં એવી કેટલીયે વસ્તુઓ ઢગલેખંદ દાખલ થઈ ગયેલી છે કે જે કેવળ માનવ સ્વભાવની અસર્સારી, કુરૂપ તથા હલકી બાજુને જ રજૂ કરતી હોય છે. આ આરામ અને વિનોદના બદાના હેઠળ માણસમાં રહેલી અત્યંત અધમ વૃત્તિઓ, અને હલકામાં હલકા રસો પ્રગટ થઈ રહેલા છે અને એ બધાં પોતાને એક અનિવાર્ય આવશ્યકતા તરીકે ખાપાવીને પોતાનું સ્થાન કાયમ કરી રહેલાં છે. પરંતુ આ વસ્તુ લેશ પણ સાચી નથી. આપણે સ્વચ્છંદતામાં સર્યા વિના પણ વિશ્રાંતિ મેળવી શકીએ છીએ, આપણે બીભત્સમાં ગયા વિના પણ આરામ મેળવી શકીએ છીએ, આપણી પ્રકૃતિમાંનાં ગ્રામ્ય તત્ત્વોને ઉપર આવવા દીધા વિના પણ આપણે આસાયેશ અનુભવી શકીએ છીએ. અને જ્યારે તપસ્યાની દૃષ્ટિથી આ જરૂરિયાતોને તપાસીએ છીએ ત્યારે તો એમનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. ત્યાં વિશ્રાંતિ એ એક આંતર મૌનનું રૂપ ધારણ કરે છે, આરામ તે ચિંતન

રૂપે બને છે અને આસાયેશા તે આનંદ રૂપે બની રહે છે.

આપણે બધા સામાન્ય રીતે એ વાત સ્વીકારી લઈએ છીએ કે માણસને જીવનમાં આનંદવિનોદ મળવો જ જોઈએ, જીવનની જહેમતમાંથી આસાયેશા મળવી જોઈએ. પરંતુ એ વસ્તુ સાચી રીતે તો આપણા જીવનના ધ્યેયને એક થોડા વધુ લાંબા કાળ માટે પૂરેપૂરી ભુલાવી દેનારી જ નીવડે છે, આપણાને જે માટે જીવન મળેલું છે તે મૂળ ધ્યેયને જ તે વિસરાવી હે છે. આ આરામ કે આનંદવિનોદને આપણે એક કુદરતી અને અનિવાર્ય વસ્તુ તરીકે જરા પણ ગણુંવી ન જોઈએ. આ વસ્તુ તો માનવના જીવનની એક નબળાઈ છે. માણસની અત્ભીષ્ણામાંથી જ્યારે તીવ્રતા ઓસરી જાય છે, તેની સંકલપશક્તિ અસ્થિર બની જાય છે, તેનામાં જ્યારે અજ્ઞાન, અચેતનતા અને શિથિલતાનાં તત્ત્વો જોર કરે છે ત્યારે માણસ આ નબળાઈને વશ થઈ જાય છે. આ બધી વસ્તુઓને સાચી ઠેરવવાનો પ્રયત્ન તમે મૂકી દેજો અને તમને થોડી વારમાં જ જણાઈ આવશે કે એ ચીજો જીવનમાં જરા પણ જરૂરની નથી અને એક સમય એવો પણ આવશે કે જ્યારે તમને એ સર્વ પ્રાચે ઘૃણા ઉત્પન્ન થશે અને તમે તેને તમારા જીવનમાં લેશ પણ સ્થાન નહિ આપશો. અને આમ થશે ત્યારે, માણસને હાથે થયેલાં સર્જનોમાંથી મોટા ભાગનાં સર્જનો, જે દેખીતી રીતે આનંદ આપવા માટે લખાયાં છે પણ ખરું જોતાં જે માણસને અધોગતિમાં લઈ જનાર જ હોય છે તેમને કોઈ પણ રીતનું પ્રોત્સાહન કે ટેકો નહિ મળે.

પરંતુ આમાંથી આપણે એમ પણ ન માનવું જોઈએ કે આપણી વાતચીતનો વિષય જે રીતનો હશે તે રીતે આપણા બોલેલા શર્ષદનું મૂલ્ય ગણુશો, તમે બીજા કોઈ વિષયની માફક આધ્યાત્મિક વિષયો ઉપર પણ ગમે તેટલી વાતો કરી શકો છો. પણ આ રીતનું વાતોઉચ્ચાપણું પણ એક અત્યંત જોખમકારક વસ્તુ થઈ શકે છે. દા. ત. નવોસવો સાધક પોતે જે કાંઈ શીખ્યો હોય છે તે બીજાઓને કહેવા માટે હમેશાં આતુર રહે છે. પણ સાધનામાં તે આગળ વધતો જાય છે તેમ તેમ વધુ ને વધુ સમજવા લાગે છે કે પોતે કંઈ બહુ જાંયું જ્ઞાન મેળવ્યું નથી તથા બીજાઓને જ્ઞાન આપવાનો પ્રયત્ન કરવા પહેલાં તેણે પોતાના જ્ઞાનમાં શું મૂલ્ય રહેલું છે તેની ખાતરી કરી લેવાની રહે છે. એમ કરતાં કરતાં છેવટે તેનામાં શાણપણ આવે છે. તેને સમજાય છે કે કંઈક ઉપયોગો નીવડે તેવી વાતચીત થોડી એક ભિન્નિટો સુધી પણ કરવી હોય તો તે માટે કેટલાયે કલાકો સુધી મુંગી એકાગ્ર અવસ્થામાં રહેવું પડે છે. અને આંતરિક જીવનમાં તેમ જ આધ્યાત્મિક સાધનામાં તો વાડુંના ઉપયોગ ઉપર આથી પણ વિશેષ સખત નિયમન રાખવાનું રહે છે. એમાં તો બોલવાનું અનિવાર્ય ન બને ત્યાં સુધી એક પણ શર્ષદ બોલવાનો ન જોઈએ.

તમારે તમારી આધ્યાત્મિક અનુભૂતિઓ વિષે કદી પણ વાત ન કરવી જોઈએ એ તો એક જાણોતી હુકીકત જ છે. તમારી આ અનુભૂતિઓમાંથી તમારામાં એક શક્તિ સંચિત થાય છે અને એ શક્તિ તમારી પ્રગતિને વેગ આપવા માટે તમને મળે છે. એ શક્તિને એક જ મિનિટમાં તમારે તમારામાંથી ચાલી જતી જોવી ન હોય તો તમે આ અનુભૂતિની વાત કોઈને કદી ન કરશો. આ નિયમમાં માત્ર પોતાના ગુરુ પરતે અપવાદ થઈ શકે. તમને થયેલી અનુભૂતિ એ શું છે યા તો તેનો અર્થ શો છે એ અંગે તમારે ગુરુ પાસેથી કંઈ ખુલાસો મેળવવો હોય કે કંઈ સુચના જોઈતી હોય તો તમે ગુરુને એ વાત કહી શકો છો. આવી વસ્તુઓ તમે ફક્ત ગુરુ પાસે જ કશા જોખમ વિના કહી શકો છો. ગુરુને આ વિષયનું જ્ઞાન હોય છે, અને તે દ્વારા તે તમારી અનુભૂતિમાં આવેલી વસ્તુઓને તમારે માટે નવા આરોહણ માટેનાં પગથિયાં બનાવી આપે છે. આવી શક્તિ માત્ર ગુરુમાં જ હોય છે.

વળી, ગુરુને પોતાને પણ જે અનુભૂતિઓ અંગત પ્રકારની થતી હોય તે પરતે પણ આ જ મૌનનો નિયમ લાગુ પડે છે. પ્રકૃતિની અંદર હુકે વસ્તુ ગતિ કરી રહેલી છે અને જે વસ્તુ આગળની દિશામાં ગતિ નથી કરતી તેની ગતિ પછી ઊલટી દિશામાં પીછેહાઠ રૂપે જ બને છે. ગુરુએ પણ શિષ્યની માફક, પ્રગતિ કરવાની જ રહે છે, ભલે પછી એ પ્રગતિ શિષ્યની ભૂમિકા કરતાં જુદી ભૂમિકા ઉપરની હોય. અને એટલે ગુરુને માટે પણ પોતાની અનુભૂતિઓની વાત કરવી લાભદાયક નીવડતી નથી. એ અનુભૂતિને શબ્દોમાં મૂકવા જતાં, તેની પાછળ રહેલી જીવંત શક્તિ ઘણે અંશે લુપ્ત થઈ જાય છે. પરંતુ ગુરુ પોતાની અનુભૂતિઓ વિષે જો શિષ્યોને સમજૂતી આપે તો તેથી તે શિષ્યોની સમજશક્તિને ખૂબ જ વધારી શકે છે અને તેમાંથી શિષ્યોની પ્રગતિ પણ ખૂબ થાય છે. ગુરુ પાસે આમ બે વિકલ્પો રહે છે; પોતાની પ્રગતિ અને શિષ્યની પ્રગતિ. આ બેમાંથી કઈ વસ્તુનો પોતે કેટલો ભોગ આપી શકે છે વા આપવો જોઈએ એ વાત ગુરુએ પોતાના જ્ઞાન દ્વારા નક્કી કરવાની રહે છે. આમાં એ વાત તો ભાયે જ કહેવાની હોય કે ગુરુ પોતાની અનુભૂતિઓનું વાર્ણન આપે તેમાં આત્મ-શ્લાઘા કે મિથ્યાભિમાનનું તત્ત્વ તો કદી આવવું જ ન જોઈએ. એવું તત્ત્વ ગુરુને ગુરુ નહિ રહેવા દે, ગુરુ ગુરુ મટીને એક દંભી બની જશે.

અને શિષ્યોને હું આ કહીશા: ‘હુકે સંજોગોમાં તમારા ગુરુને વફાદાર રહેજો, એ ગુરુ પછી ભલે ગમે તેવા હો. એ ગુરુ તમારામાં જેટલે સુધી જવાની શક્તિ હશે ત્યાં સુધી તમને લઈ જશે. અને તમારે સદ્ભાયે જો તમને પ્રભુ પોતે જ ગુરુ તરીકે મહ્યા હશે તો તો પછી તમારા સાક્ષાત્કારને કશી સીમા જ નહિ રહેશે.’

પણ પરમાત્માને પોતાને પણ, તે પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે ત્યારે

પ્રગતિનો આ જ નિયમ લાગુ પડે છે. પોતાના આવિર્ભાવના સાધન રૂપે પરમાત્માએ જે શરીર રૂપી વખ્ત ધારણ કરેલું હોય છે તે પણ એક સતત પ્રગતિમાન અવસ્થામાં રહેવું જોઈએ. વળી આ અવતાર જે નિયમને અનુસરીને પોતાના વ્યક્તિત્વનો આવિર્ભાવ કરતા હોય છે તે નિયમ પણ એક રીતે પૃથ્વીની પ્રગતિના સર્વસામાન્ય નિયમની સાથે જ સંકળાયેલો હોય છે. આ રીતે જોતાં, પૃથ્વી ઉપર દેહમાં આવીને રહેલા પરમાત્મા પણ, જ્યાં સુધી માણસો પૂર્ણતાને સમજવા માટે તથા સ્વીકારવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી સંપૂર્ણ બની શકતા નથી. હા, એક દિવસ એવો અવસ્થય આવશે કે જ્યારે માનવો, અત્યારે પોતાનાં કામ પ્રભુ પ્રત્યેની ફરજના ભાનમાંથી પ્રેરાઈને કરે છે તેને બદલે, પોતાનાં સર્વ કામ પ્રભુ પ્રત્યેના પ્રેમમાંથી જ કરવા લાગશે. અથવા વધારે ચોક્કસ રીતે કહીએ તો માનવની પ્રગતિ તેના અહુંકાર તરફથી થતા વિરોધને દબાવી દઈને નહિ, પરંતુ માનવના સારાએ સ્વરૂપની પ્રભુ પ્રત્યેની પૂર્ણ નિષ્ઠામાંથી જન્મતા આનંદને માર્ગ થતી રહેશે. અહુંકારના વિરોધને દબાવતા રહીને આગળ વધવું એ વસ્તુ ખૂબ જ પ્રયત્ન માર્ગ લે છે અને કદી કદી એમાં ભારે યાતના પણ વેઠવી પડે છે.

આ વિષયનો ઉપસંહાર કરતાં છેવટે હું તમને આ કહીશઃ તમારી વાણી દ્વારા તમારે જો માત્ર સત્યને જ વ્યક્ત કરવું હોય અને તમારી વાણીમાં મંત્રનું બળ મેળવવું હોય તો તમે શું કહેવાના છો તે વિષે આગળથી વિચાર કરવા ના લાગશો, તમારે કહેવામાં કઈ વસ્તુ સારી નીવડશો, કઈ વસ્તુ ખરાખ નીવડશો તેનો આગળથી નિર્ણય ન કરી લેશો, તમે કહેશો તેની શી અસર થશે તેની પહેલેથી ગણતરી ન કરશો. તમારા મનને બિલકુલ શાંત કરી દો, તમે એક સાચા વલાશમાં સ્થિર થઈ જાઓ, એટલે કે સર્વ જ્ઞાન રૂપ, સર્વ વિદ્યા રૂપ, સર્વ ચૈતન્ય રૂપ મહા તત્ત્વ પ્રત્યે તમે એક અસખલિત અભીપ્સામાં સુસ્થિર બની રહો. અને પછી, તમારી અભીપ્સા જો સાચી હશે, એ અભીપ્સા તે તમારે સફળ રીતે, સારી રીતે કામ કરવું છે એ રીતની મહાત્વાકંશાને છુપાવા માટેનું માત્ર એક ઢાંકણ જ નહિ હોય, એ અભીપ્સા જો શુદ્ધ હશે, આપોઆપ આવેલી અને સાધારંત સમગ્ર હશે તો પછી તમારે બોલ્યે જવાનું રહેશે. જે શબ્દ બોલાવાની જરૂર હશે તે તમારા મુખેથી બોલાવા લાગશે, નહિ ઓછા, નહિ વધુ, અને એ શબ્દોમાં સર્જનનું બળ હશે.

(બુલેટિન, એપ્રિલ ૧૯૫૩)

\*

## પ્રેમની તપસ્યા

સર્વ તપસ્યાઓમાં સૌથી વિશેષ કઠિન તપસ્યા તે લાગણી અને ઉર્ભિની તપસ્યા છે, પ્રેમની તપસ્યા છે.

ખરેખર, માણસને જીવનમાં અન્ય ક્ષેત્રો કરતાં કદાચ લાગણીઓના વિષયમાં જ એવો વિશેષ અનુભવ થાય છે કે પોતે જાણે કે કોઈ એક અનિવાર્ય અપરિહૃત્ય એવા તત્ત્વની સામે આવીને ઊભો છે. માણસમાં જ્યારે લાગણી, ઊર્ભિ, પ્રેમ જગૃત થાય છે ત્યારે તેને લાગે છે કે પોતે વિધિની કોઈ પ્રચંડ ચૂહમાં પકડાયો છે અને એમાંથી પોતાને માટે કોઈ છૂટકબારી નથી. પ્રેમ વિષે (અથવા કંઈ નહિ તો માણસો જેને ‘પ્રેમ’ નામથી ઓળખે છે તે વસ્તુ વિષે તો) ખાસ એમ જ માનવામાં આવે છે કે એના જેવી સમર્થ શક્તિ જગતમાં બીજી છે જ નહિ. એના હાથમાં સપદાયા પછી તમારે માટે કોઈ બીજો રસ્તો રહેતો જ નથી. એ મહાતરંગી મન્મથ પોતાને ફાવે તેમ તમારા ઉપર પ્રહાર કરતો રહે છે, અને તમારી ઈચ્છા હોય કે ન હોય પણ તે તમારી પાસે પોતાનું ધાર્યું કરાવે છે. સાચે જ, જગતમાં પ્રેમના નામે માનવે ભયંકરમાં ભયંકર અત્યાચારો કરેલા છે, ભારેમાં ભારે મૂર્ખતાઓ આચરેલી છે.

અને છતાં માણસે પાછું આ પ્રેમની શક્તિને કાબૂમાં રાખવા માટે, તે શક્તિને હળવી અને વિનાન્દ્ર બનાવવાની આશાપૂર્વક અનેક નૈતિક તેમ જ સામાજિક નિયમો પણ બનાવેલા છે. પરંતુ આ બાબતમાં બનતું તો એમ જ આવેલું છે કે એ નિયમોનું જેટલું પાલન થાય છે તેના કરતાં તેમનો બંગ જ વિશેષ થતો રહેલો છે. આ બધા નિયમો પ્રેમની નિર્બંધ ગતિ ઉપર જે અંકુશ મૂકૂવા જાય છે તેને લીધે તો ઊલટી પ્રેમની અંદર રહેલી સ્ફોટક શક્તિ વધતી જ જતી લાગે છે, અને તે વધે જ એ સ્વાભાવિક છે, કેમ કે પ્રેમની વૃત્તિને તમે નિયમો દ્વારા કદી કાબૂમાં લઈ શકવાના નથી. પ્રેમની આ અદભ્ય વૃત્તિઓને કાબૂમાં લેવાનું કાર્ય તો આ પ્રેમ કરતાં પણ એક વધુ મહાન, વધુ ઉચ્ચ અને વધુ સત્યમય પ્રેમની શક્તિ દ્વારા જ સિદ્ધ થઈ શકે. પ્રેમના ઉપર પ્રેમનું જ શાસન ચાલી શકે છે, અને તે શાસન આ પ્રેમને વધુ જ્ઞાનમય, વધુ વિશાળ કરીને, તેનું રૂપાંતર કરીને જ સ્થાપી શકાય છે. કોઈ પણ વસ્તુ ઉપર કાબૂ મેળવવો એટલે કે તેને દબાવી યા તો નિર્મળ કરી નાખવી એમ નથી, પરંતુ કોઈ એક પરમ રસાયન દ્વારા તમારે તેનું એક નવું જ સ્વરૂપ બનાવવાનું રહે છે. અને બીજી કોઈ વસ્તુ કરતાં પ્રેમની બાબતમાં તો આ દીકીત વધારે લાગુ

પડે છે. કેમ કે, જગતમાં કાર્ય કરતી સર્વ શક્તિઓમાં પ્રેમની શક્તિ જ સૌથી વિશેષ સમર્થ, સૌથી વિશેષ અવિરોધ્ય શક્તિ છે. જગતમાં જો પ્રેમ ન હોત તો એ પાછું અચેતનતાના અંધારામાં જ ગરક થઈ ગયું હોત.

બેશક, આ વિશ્વનું સર્જન કરનારી શક્તિ તો ચેતના છે, પરંતુ એ વિશ્વનું ઉદ્ધારક તત્ત્વ તે પ્રેમ છે. આ પ્રેમ એટલે શું, તેનું લક્ષ્ય એટલે શું, તેની ગતિરીતિ કેવી હોય એની ઝાંખી તો આ પ્રેમતત્ત્વનો સજ્ઞાનપણે અનુભવ કરવાથી જ થઈ શકે. આ તત્ત્વનું શબ્દોમાં વાર્ણન આપવા બેસવું એ તો એક શબ્દાતીત વસ્તુને મનનાં વળ્ણો પહેરાવવા જેવું થાય. જગતના તત્ત્વજ્ઞાનીઓએ, મર્મજ્ઞાનીઓએ અને ગુહ્યવિદોએ આ વાર્ણન આપવાના પ્રયત્નો કરેલા છે, પણ એ પ્રવૃત્તિ બહુ સફળ નીવહેલી નથી. અને આ બધાઓ જેમાં નિષ્ફળ નીવહ્યા છે ત્યાં હું સફળ થઈ શકીશ એવું માનવાની ધૂષ્ટતા હું નહિ કરું. હું માત્ર આ જ્ઞાનીઓ અને પંડિતોએ જે વસ્તુને બહુ સૂક્ષ્મ અને સંકુલ રીતે વાર્ણવી છે તેને બને તેટલા સાદા શબ્દોમાં કહેવા માગું છું, આ પ્રેમની એક જીવંત અનુભૂતિ પ્રત્યે લઈ જવા માટે હું આ લખું છું, અને સાવ નાના બાળકને પણ હું આ અનુભૂતિમાં લઈ જવા ઈચ્છું છું.

પ્રેમ એના મૂળ સ્વરૂપે એક તાદાત્મ્યનો આનંદ છે. એ પ્રેમની પરમ અભિવ્યક્તિ મિલનના મહા આનંદ રૂપે થાય છે. આ મિલન અને તાદાત્મ્યની બે અવસ્થાઓની વચ્ચે વિશ્વમાં થતા પ્રેમના સર્વ પ્રકારના આવિર્ભાવો આવી રહેલા છે.

પોતાના વિશ્વરૂપ આવિર્ભાવના આરંભમાં પ્રેમ તેના મૂળ વિશુદ્ધ સ્વરૂપે બે પ્રકારની ગતિઓનો બનેલો હોય છે. આ બે એકબીજાની પૂર્ક એવી ગતિઓ પ્રેમની પ્રેરણાના સામસામેના છેડાઓથી શરૂ થઈને એકબીજા સાથેના સંપૂર્ણ મિલન તરફ જવા લાગે છે. આ પ્રેમની પ્રેરણા તેના એક છેડા ઉપર પૂર્ણ આત્મસમર્પણની એક ક્ષુધાનું રૂપ લે છે. વ્યક્તિની ચેતના તેના આદિ મૂળ તત્ત્વમાંથી જ્યારે ધૂટી પડી ગઈ, અને અચેતન રૂપની બની ગઈ ત્યારે વ્યક્તિની ચેતનામાં એક મોટી ખાઈ રચાઈ ગઈ. આ ખાઈના ઉપર પુલ બાંધવાનું કાર્ય કેવળ પ્રેમ જ કરી શકે તેમ છે.

જગતનું સર્જન થતાં પરમાત્માએ પોતાના અંશોને પોતામાંથી અવકાશમાં વહેતા મુક્કેલા. એ બધા અંશોને સજ્ઞયિલા જગતનો વિનાશ થવા દીઘા સિવાય પાછા તેના મૂળ સ્થાનમાં લઈ આવવાના હતા. આ કાર્ય કરી શકે તેવી પરમ શક્તિ માત્ર પ્રેમમાં જ હતી. અને તેથી જગતમાં પ્રેમે પોતાનો આવિર્ભાવ કર્યો.

વિશ્વના અંધકાર અને અચેતનતા ઉપર આ પ્રેમ ધૂમી રહેલો છે, અગાધ રાત્રિના હદ્યમાં એણે પોતાની જાતને આણુ આણુ કરીને વિખેરી નાખેલી છે. અને તે વખતથી પછી જગતમાં જાગૃતિ આવેલ છે. ઊર્ધ્વ આરોહણ શરૂ થયેલું છે,

જગતત્ત્વ ધીરે ધીરે બંધાવા લાગ્યું છે અને તેની અનંતવિધ પ્રગતિનાં મંડાણ થયાં છે. જુઓને, આ સ્થ્યલ તેમ જ પ્રાણમય પ્રકૃતિના સર્વ આવેગોની પાછળ આ પ્રેમનું તત્ત્વ જ, એક સ્ખલનશીલ તેમ જ અજ્ઞાનમય સ્વરૂપે રહીને, શું હરેક કિયાને તથા હરેક સમૂહરચનાને વેગ આપી રહેલું નથી? વનસ્પતિ જગતમાં તો આ વસ્તુએ તદ્દન દેખી શકાય તેવું રૂપ લીધેલું છે. છોડવામાં અને વૃક્ષમાં આ પ્રેમતત્વે વધુ પ્રકાશ, વધુ હવા અને વધુ સ્થળ, મેળવીને વિકાસ પામવાની એક આવશ્યકતાનું રૂપ લીધું છે, પુષ્પમાં તે એક પ્રેમપૂર્વક પ્રકુલ્પલન પામીને સૌન્દર્ય અને સુગાન્ધના એક ઉપહાર રૂપે બની રહેલો છે. પશુઓમાં પણ તે તેમની કુદા અને તરસની પાછળ રહેલો છે. અન્ય વસ્તુઓને આત્મસાત્ત કરવી, પોતાનો વિસ્તાર કરવો, વંશવૃદ્ધિ કરવી એ રીતની પશુઓમાં રહેલી જરૂરિયાતની પાછળ, અર્થાત્, તેમની હરેક પ્રકારની સયેતન યા અયેતન ઈચ્છાની પાછળ એ જ પ્રેમતત્વ રહેલું છે એમ નથી લાગતું? એથી ઉપરની કક્ષાઓનાં ગ્રાણીમાં જોઈશું તો ત્યાં માદા પોતાનું બલિદાન દઈને પોતાના સંતાનને જે ભક્તિભાવથી ઉઠેરે છે તેની પાછળ પણ આ જ તત્ત્વ રહેલું છે. અને આમાંથી હવે માનવની દુનિયામાં આવતાં પ્રેમનો વિશેષ સ્પષ્ટ પ્રાદુર્ભાવ જોવા મળે છે. માનવમાં મનની સ્થાપના થયેલી હોવાને લીધે તેનામાં આ પ્રેમતત્વનો સુયોગ તેનું ઉચ્ચયમાં ઉચ્ચય રૂપ ધારણ કરે છે, કેમ કે અહીં માનવમાં તે હવે એક સભાન રીતની તથા જ્ઞાનપૂર્વકની કિયા બની રહે છે. ખરી વસ્તુ તો એ છે કે પૃથ્વીનો વિકાસ અમુક જરૂરી કક્ષાએ પહુંચ્યા પછી પ્રકૃતિએ તરત જ પ્રેમના આ મહા સમર્થ તત્ત્વને વંશવર્ધનની કિયા સાથે જોડી આપ્યું છે, તેની સાથે મિશ્રિત કરી આપ્યું છે અને એ રીતે પોતાની સર્જક પ્રવૃત્તિની સેવામાં તેને જોડી દીધું છે. પ્રેમ અને વંશવૃદ્ધિ, એ બે વસ્તુઓ જગતમાં એટલી બધી તો ગાઢ અને નિકટની બની ગયેલી છે કે એ બેને છૂટાં પાડી શકે તેમ જ તેમનો અલગ અનુભવ કરી શકે એવી પ્રકાશમય ચેતના હજી બહુ વિરલ માણસોમાં જ આવેલી છે. અને આમ આ પ્રેમતત્વ જગતમાં હરેક પ્રકારની અધોગતિ ભોગવી રહેલું છે, નીચે સરતાં સરતાં તે ઠેઠ પશુ કોટિ સુધીનું બની ગયેલું છે.

અને પ્રેમતત્વનું આ અધઃપતન થયું તે જ ક્ષાણે પ્રકૃતિએ પાછો પોતાના આદિમ અદ્વૈતની જગતમાં ફરીથી સ્થાપના કરવા માટે સંકલ્પ આદરેલો છે. આ વસ્તુ પ્રકૃતિનાં કાર્યોમાંથી આપણો સ્પષ્ટ જોઈ શકીએ છીએ. કુદરત માનવજીતિમાં જીવનની અનેક અવસ્થાઓનું અને કક્ષાઓનું સર્જન કરતી કરતી વધુ ને વધુ સંકુલતાવાળાં, તેમ જ વધુ ને વધુ સંઘયામાં જૂથો રચવા લાગે છે. પ્રથમ તો તે આ પ્રેમની શક્તિને પ્રયોજીને બે માનવોને ભેગાં કરે છે. એમાંથી માનવયુગાલ રચાય

છે, કુટુંબના ઉદ્ભવનો પાયો નંખાય છે. આ રીતે કુદરત વ્યક્તિના અહુંકારને એક જોડિયા અહુંકાર રૂપે પલટીને વ્યક્તિગત અહુંકારની સંકદી સીમાઓને ભેદી આપે છે. એમાં પછી બાળકનું આગમન થતાં એક વધુ સંકુલ પ્રકારનો એકમ, કુટુંબની રચના ઊભી થાય છે. વખત જતાં આ કુટુંબો વચ્ચે વિવિધ પ્રકારના સંબંધો રચાતા ગયા, વ્યક્તિઓ વચ્ચે વિનિમય થવા લાગ્યો, લોઈનાં મિશ્રાગ બનવા લાગ્યાં અને તેમાંથી વધુ વિશાળ જૂથ રચાવા લાગ્યાં. કુટુંબમાંથી ટોળીઓ રચાઈ, જાતિઓ બની, જ્ઞાતિઓ અને વર્ગો ઊભા થયા અને આખરે તેમાંથી રાષ્ટ્ર સરજાયું. આ બધા સમૂહોના સર્જનનું કાર્ય જગતના જુદા જુદા ભાગોમાં એકીસાથે ચાલી રહેલું હતું. એ સમૂહોમાંથી આજે જગતની વિવિધ જાતિઓ રચાઈ છે. આ જાતિઓને પણ કુદરત ક્રમે ક્રમે એક કરી લેશે. કેમ કે, કુદરત તો આખીયે માનવજાતની એકતા નિપાત્વવા માટે પ્રયત્ન કરી રહેલી છે અને તે માટે તે ઠેઠ સ્થૂલ ભૂમિકા ઉપર એક સાચો પાયો બાંધી રહેલી છે.

માનવજાતના મોટા ભાગને તો આ બધું જીવનમાં એક અકસ્માતની લીલા જેવું લાગે છે. પરંતુ તેઓ એ વસ્તુ જોઈ શકતા નથી કે આ બધાની પાછળ એક વિશ્વયોજના કામ કરી રહેલી છે. જગતમાં જેમ જેમ પરિસ્થિતિ સરજાતી જાય છે તેમ તેમ લોકો પોતાની પ્રકૃતિ પ્રમાણે તેનો વતીઓછી સરળતાથી સ્વીકાર કરતા રહે છે. જગતમાં કેટલાક માણસો આ વિકસતી જતી પરિસ્થિતિથી પૂર્ણ સંતુષ્ટ રહેનાર હોય છે, તો કેટલાક અસંતુષ્ટ પણ રહે છે.

આ સંતુષ્ટ રહેનાર માણસોમાં અમુક વર્ગ એવો હોય છે કે જેને પ્રકૃતિની ગતિ સાથે હમેશાં મેળ જ રહેતો હોય છે. આ છે જગતના આશાવાદી લોકો. એમને જગતનાં અનિષ્ટ કે ઉદ્બેગકારક તત્વો સામે ફરિયાદ નથી હોતી. તેઓ કહે છે કે જગતમાં રાત્રિ ભલે રહી, એને લીધે દિવસના પ્રકાશનું મૂલ્ય વધુ સમજાય છે, જગતમાં પદ્ધતાયા છે એને લીધે જ રંગની ચમક વધુ ખીલે છે, જગતમાં દુઃખ છે તેથી જ આનંદની તીવ્રતા વધારે અનુભવી શકાય છે. દર્દને લીધે જ સુખની મોહકતા વધુ સમજાય છે, રોગને લીધે જ આરોગ્યની મહત્તમ પૂરી સમજાય છે. કેટલાકને તો મેં એમ પણ કહેતા સાંભળ્યા છે કે તેમને શત્રુઓ છે માટે આનંદ થાય છે. કેમ કે, શત્રુઓને લીધે ભિત્રોનું મૂલ્ય બરાબર સમજાય છે. આવા લોકોને માટે જાતીય આનંદ એ જીવનનો એક અતિ મધુર રસ બની રહે છે, ઉત્તમ ભોજન એ તો જીવનની એક અનેરી લહાગ અને તેથી અનિવાર્ય આવશ્યકતા બની રહે છે. અને માણસે જન્મ લીધો છે પછી તેનું મૃત્યુ થાય એ તો એમને કુદરતનો સ્વાભાવિક ક્રમ જ લાગે છે એટલું જ નહિ, મૃત્યુને તેઓ વધાવી પણ લે છે. કેમ કે, આ મૃત્યુ

તો એક મોટો મુક્તિદાતા છે. જીવનની યાત્રા જો વધુ પડતી લંબાઈ જાય તો તે કંટાળાજનક પણ બની જાય છે. અને મૃત્યુ આવીને એનો વેળાસર અંત લાવી આપે એથી વધારે આનંદજનક ઘટના કઈ કહેવાય!

અર્થાત, આ માનવીને માટે જીવન છે તેવું જ ભરાબર છે. જીવન પાછળ, કોઈ કારણ હોઈ શકે કે નહિ, તેનો કોઈ હેતુ હોઈ શકે કે નહિ, તે જાણવાની તેમને લેશ પણ ઉત્કંઠા નથી હોતી. બીજાઓનાં દુઃખોથી તેમને લેશ પણ વ્યથા થતી નથી, જીવનમાં પ્રગતિ કરવાની તેમને કશી જરૂર જણાતી નથી.

આવા માણસોનું પરિવર્તન કરવા તમારે કદી પ્રયત્ન ન કરવો. એમ કરવા જશો તો તમે ભારે ભૂલ કરી બેસશો. આવા લોકો જો કદીક અક્સમાત તમારી વાત સાંભળશે તો તેઓ એક નવી સમતુલામાં પહોંચ્યા પહેલાં જ પોતાની ચાલુ સમતુલાને ખોઈ બેસશો. આ માણસો આંતરિક જીવન માટે હજુ તૈયાર નથી હોતા, પણ તેમના ઉપર કુદરતની રહેભ હોય છે. કુદરત સાથે તેઓ ખૂબ જ ગાડ મેળમાં હોય છે અને તેમની આ સિદ્ધિને તમારે નિરથ્યક રીતે હુચમચાવવી ન જોઈએ.

એક બીજા પ્રકારના લોકો પણ સંતુષ્ટ જીવન ગાળતા હોય છે, પરંતુ તેમનો સંતોષ જરા ઓછી માત્રામાં, તેમ જ ઓછો ચિરંજીવી હોય છે. આ લોકોનું સંતોષનું મૂળ પ્રેમના જાદુમાં રહેલું છે. માણસ જ્યારે પોતાના અહુકારના કેદખાનાની સાંકડી દીવાલોને બેદીને બહાર નીકળે છે, પોતાના સમર્પણ દ્વારા તે જ્યારે એક મુક્ત હવામાં ઊંચે ચઢવા લાગે છે ત્યારે, એ સમર્પણ ભલે પછી બીજુ વ્યક્તિ માટે હોય, કુટુંબ ખાતર હોય, દેશને ખાતર કે પોતાના ધર્મને ખાતર હોય, પણ એ દ્વારા તે એક આત્મવિસમરણ અનુભવવા લાગે છે અને એવા આત્મ-વિસ્તરણમાં તેને પ્રેમના અદ્ભુત આનંદની એક પૂર્વ ઝાંખી થાય છે. આવા આનંદાનુભવથી તેને એમ લાગે છે કે તેને પ્રભુનો સંપર્ક પ્રાપ્ત થયો છે. પરંતુ આ સંપર્ક મોટે ભાગે ક્ષણિક પ્રકારનો જ છે, કારણ કે, આ દિવ્ય પ્રેમ માનવની અંદર ઊતરે છે ત્યારે તરત જ તે માનવના અહુકારની નિભન કોટિની કિયાઓ સાથે ભેળસેળ થઈ જાય છે. એ અહુકાર આ પ્રેમને મહિન કરી મૂકે છે, એ પ્રેમની વિશુદ્ધિમાં રહેલી તમામ શક્તિને હરી લે છે. પરંતુ ધારો કે આ પ્રેમ તેના વિશુદ્ધ સ્વરૂપે માનવમાં ટકી શકે તેમ હોય તોપણ તેટલા માત્રથી દિવ્ય ચેતના સાથેનો સંપર્ક હુમેશાં ટકી રહી શકતો નથી. કારણ પ્રેમ એ તો પ્રભુનાં અનેક સ્વરૂપોમાંનું માત્ર એક સ્વરૂપ છે. અને પ્રભુનાં બીજાં સ્વરૂપોની પૃથ્વી ઉપર વિકૃતિઓ થયેલી છે તેવી જ વિકૃતિઓ પ્રેમની પણ થયેલી છે.

આમ છતાં કુદરતના ચાલુ રાહને અનુસરતા સામાન્ય માનવને માટે આ બધા અનુભવો ખરેખર સારા અને હિતકારક છે. પરંતુ કુદરત ભાવિની એકતાની દિશામાં

બહુ અસ્થિર વેગે ગતિ કરતી રહે છે. અને જગતમાં જે લોકો આ એકતા તરફની ગતિને વેગવાન થેયેલી જોવા માગતા હોય છે તેમને આ અનુભવો પૂરતો સંતોષ આપી શકતા નથી. એ લોકોનું અંતઃકરણ કુદરતના આ ચાલુ રાહથી કોઈ જુદો માર્ગ લેવાને, એક વધારે સીધો અને વધારે ઝડપી, કોઈ અસાધારણ માર્ગ લેવાને જંખતું હોય છે. એવો કોઈ માર્ગ લઈ તેઓ માનવની સામાન્ય પ્રકૃતિમાંથી, અને એ પ્રકૃતિની અંતઃકીન યાત્રામાંથી મુક્ત થઈ જવાની ભાવના સેવતા હોય છે. એ અસાધારણ માર્ગ તેમને એક એવી આધ્યાત્મિક પ્રગતિમાં મૂકી આપે છે કે જે દ્વારા તેઓ વધુમાં વધુ ઝડપે નવી માનવજ્ઞતિનું જગતમાં સર્જન કરી શકશે અને એ માનવજ્ઞતિ પૃથ્વી ઉપર અતિમનસના સત્યને આવિર્ભાવ આપશે. આવા અસામાન્ય આત્માઓએ માનવ માનવની વચ્ચે જોવામાં આવે છે તેવા હરેક પ્રકારના પ્રેમને વિસર્જ દેવાનો રહે છે, કારણ, આ પ્રેમ ભલે ગમે તેટલો સુંદર અને વિશુદ્ધ હોય તોપણ તે માનવ આત્માના પ્રભુ સાથેના સંબંધમાં એક વિચ્છેદ ઊભો કરે છે, પ્રભુ સાથેના સીધા સંબંધને તે કાપી નાખે છે.

તમને પ્રભુના પ્રેમનો અનુભવ થશે તો તરત જ જણાઈ આવશે કે તે સિવાયના બીજા સર્વ પ્રેમમાં કેવું તો અજ્ઞાન રહેલું હોય છે. તમે જોશો કે આ બીજા પ્રેમમાં લયુતા, અહંકાર અને અંધકારનું કેવું તો ભિશાણ હોય છે. એ પ્રેમ એક સોદા જેવો હોય છે, એમાં પોતાની જાતને વધુ ઉત્તમ તરીકે ઠસાવવા માટેની, પોતાનો અધિકાર જમાવવા માટેની સતત ખેંચતાણ રહ્યા કરે છે. તમે જોશો કે સારામાં સારા માણસોના પ્રેમમાં પણ ગેરસમજૂતીઓ અને આળાઈ રહેલી હોય છે, તકરારો અને શંકાઓ ભરેલી હોય છે.

વળી એ પણ બહુ જાણીતી હકીકત છે કે તમે જેને ચાહતા હો છો તેના જેવા જ તમે બની રહો છો. એટલે તમારે જો પ્રભુના જેવા બનવું હશે તો તો પછી કેવળ પ્રભુ ઉપર જ તમારે પ્રેમ કરવાનો રહે છે. જે લોકોને પ્રભુ સાથેના પ્રેમાનુભવનો પરમ આનંદ અનુભવવા મળેલો હોય છે તેઓ જ માત્ર જાણી શકે છે કે પ્રેમની સરખામણીમાં બીજા બધા પ્રેમ કેવા તો શુષ્ક હોય છે, કેવા તો નિસ્તેજ અને દુર્બળ હોય છે. આવો પરમ આનંદમય પ્રભુપ્રેમ પ્રાપ્ત કરવા માટે તમારે કઠણમાં કઠણ સાધના કરવી પડે તોપણ તમે જોશો કે એ સાધના જો તમને પ્રભુપ્રેમમાં લઈ જશો તો તે જરાકે કઠણ નહિ લાગે, લાંબી કે કઠોર નહિ લાગે. એ પ્રેમાનુભવ એવી તો અનન્ય વસ્તુ છે કે જેને તમે ભાયે જ શાખ દ્વારા વર્ણવી શકો.

પ્રભુ-પ્રેમની આ અદ્ભુત અવસ્થાને આપણે પૃથ્વી ઉપર સિદ્ધ કરવા માણીએ છીએ, આ મહા પ્રેમ જ જગતની કાયાપલટ કરી આપશે અને પ્રભુના દિવ્ય

સાંનિધ્યને જગત પોતામાં ધારણ કરી શકે તેવી પાત્રતા તેમાં સરજી આપશે. જગત પ્રભુ માટે આવું એક સુપાત્ર નિવાસસ્થાન બનશે ત્યારે પ્રેમ તેના શુદ્ધ અને સત્ય સ્વરૂપે પૃથ્વી ઉપર એક શરીરની અંદર સાકાર બનશે, એ શરીર અવું હશે કે જે આ પ્રેમના ઉપર એક ઢાંકાણ કે બુરખા તરીકિનું કામ નહિ કરતું હોય. પરમાત્માએ પોતાના પરમ પ્રેમ દ્વારા માનવ અને પોતાની વર્ણેના સંબંધને એક વધુ ગાઢ નિકટતામાં મૂકી આપવાનો, એ નિકટતાને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકાય તેવી કરવાનો પ્રયત્ન કરેલો છે. અને આ માટે તેમણે માનવના જેવા જ દેખાવવાળું સ્થૂલ શરીર ધારણ કરેલું છે. પરંતુ ૪૩ તત્ત્વના સ્થૂલ આકારમાં નિબદ્ધ થવાને પરિણામે હમેશાં એમ જ બનતું આવેલું છે કે પ્રભુ પોતાના મૂળ સ્વરૂપને તેના વિશુદ્ધ રૂપે કદ્દી રજૂ કરી શકેલા નથી. આવા દેહમાં એ મૂળ સ્વરૂપ એક વિકૃત રૂપે જ વ્યક્ત થઈ શકેલું છે. માણસો જ્યારે પોતાની ચેતનામાં તેમજ શરીરમાં કોઈ એક અનિવાર્ય એવી પ્રગતિ સિદ્ધ કરશે ત્યારે જ પ્રભુ પોતાના સ્વરૂપને તેના પૂર વૈભવમાં આવિર્ભાવ આપી શકશે. માનવમાં એક એવું તો હુલકટ અભિમાન છે, એક એવી તો મૂર્ખ દાંબિકતા છે કે પ્રભુનો પરમ દિવ્ય પ્રેમ જ્યારે માનવના આકારમાં પ્રગટ થાય છે ત્યારે તેને તે એક દુર્બળતાની, પરાધીનતાની અને અપૂર્ણતાની નિશાની ગણી લે છે.

અને છતાં માણસ એ વાત ક્યારથીયે જાણે છે કે આ જગતની પીડાનો અંત લાવી શકે તેવી વસ્તુ તે એક પ્રેમ જ છે. બેશક, આ જ્ઞાન શરૂ શરૂમાં માણસને બહુ સ્પષ્ટ નથી હોતું પણ માણસ જેમ જેમ પૂર્ણતા પ્રત્યે આગળ વધતો જાય છે તેમ તેમ આ વસ્તુ તેને વધુ ને વધુ સ્પષ્ટ થતી જાય છે. માણસ જાણે છે કે પ્રેમના મૂળ તત્ત્વમાં રહેલ વાચાતીત આનંદ જ વિશ્વમાંથી વિરહની સળગતી વ્યથાને સંદર્ભ દૂર કરી શકશે. આ જગત શા માટે અસ્તિત્વમાં આવ્યું, એની અતિમ સાર્થકતા શામાં છે એનો જવાબ માણસને પ્રભુ સાથેના પરમ ભિલનના આનંદમાં જ માત્ર મળી શકશે.

એટલે આપણે ભલે ગમે તેટલો પુરુષાર્થ બેડવો પે, ગમે તેટલી કઠોર તપસ્યા કરવી પડે પણ તે દ્વારા જો આપણા શરીર-તત્ત્વને આપણે પ્રકાશમય કરી શકીશું, તેને વિશુદ્ધ, સંપૂર્ણ અને એક એવા નવા જ સ્વરૂપવાળું બનાવી શકીશું તો એ સારોયે પુરુષાર્થ અને તપસ્યા પૂરેપૂરાં સાર્થક ગણાશે. આપણું શરીર-તત્ત્વ આવી નવીન અવસ્થા પ્રાપ્ત કરશે તે પછી પરમાત્મા તેની અંદર આવીને બાધ આકાર ધારણ કરશે, અને ત્યારે એ આકાર પરમાત્માને ઢાંકી રાખનાર એક આચ્છાદન રૂપ નહિ રહેશે. એવા શરીર દ્વારા પેલું અદ્ભુત પ્રેમતત્વ જીવનને એક મધુર આનંદના સ્વર્ગ રૂપે પલટી નાખવાની શક્તિ ધરાવનાર એ દિવ્ય પ્રેમ પોતાની જાતને સંપૂર્ણ મુક્ત ભાવે વ્યક્ત કરી શકશે.

તમે કહેશો કે આ તો અંતિમ લક્ષ્યની વાત થઈ, આ તો સાધનાની છેવટની સિદ્ધિ છે, અંતિમ વિજય છે. પણ એ સિદ્ધિ સુધી પહોંચવા માટે અમારે શું કરવાનું રહે છે? એ વિજય મેળવવાને અમારે કેવો માર્ગ લેવો જોઈએ, એની સાધનાનાં પહેલાં પગથિયાં કયાં છે?

આના જવાબમાં આપણે પહેલી વસ્તુ તો એ સ્મરણમાં રાખીએ કે આપણે આપણા પ્રેમની સારી ગતિને એકમાત્ર પ્રભુ સાથેના અંગત સંબંધની દિશામાં જ વાળવાનો નિશ્ચય કરેલો છે. એટલે અન્ય માણસો સાથેના આપણા સંબંધમાં આપણે એક ખરેખર સાચી, નિરહંકારી, આવિકારી અને સ્થિર પ્રકારની શુભેચ્છા અને માયાળુતા ધારણ કરીશું. માનવો પ્રત્યેના આ ભાવના બદલામાં આપણે કોઈ પ્રત્યુત્તરની, કૃતજ્ઞતાની કે તેના સ્વીકાર સરખાની પણ આશા રાખીશું નહિ. તમારી સાથે અન્ય લોકો ભલે ગમે તેવું વર્તન રાખે પણ તમે તમારામાં તિરસ્કારની એક નાનકડી લહેર પણ ઊભી ન થવા દેશો. તમે તો કેવળ પરમાત્મા પ્રત્યેના અમિત્ર આનંદમાં જ સ્થિર રહેજો. જગતના માણસો તમને સમજતા ન હોય, તમારા તરફ શુભેચ્છા ન રાખતા હોય તેવે પ્રસંગે તમારું રક્ષણ કેવી રીતે કરવું, તમારો બચાવ કેવી રીતે કરવો એનો નિર્ણય તમે માત્ર પ્રભુના દાયમાં જ સોંપી દેજો.

જીવનમાં તમારે જે કાંઈ આનંદ જોઈએ, સુખ જોઈએ એ તમારે કેવળ પ્રભુ પાસેથી જ મેળવવાનાં છે. તમારે કાંઈ સહાય જોઈએ, કોઈ આધાર જોઈએ ત્યારે તે માટે કેવળ પ્રભુની ઉપર જ નજર માંડજો અને તે તમને ત્યાંથી જ મળી રહેશે. તમારાં તમામ દુઃખોમાં પ્રભુ તમને દિલાસો દેશો, તમારી સાધનામાં તમને તે માર્ગ બતાવશો, તમારી યાત્રામાં તમે ગબડી પડશો તો તમને તે ઉપાડી લેશો, તમે જો કદી મૂર્ખિત થઈ જશો, થાકી જશો, તો પોતાના સંશક્ત પ્રેમ-બાહુમાં એ તમને ઉપાડી લેશો અને પોતાની મધુરતાના આશ્વાસનથી તમને વીંટાળી લેશો.

અહીં કદાચ નાનકડી ગેરસમજ ઊભી થાય તેમ છે તો તેનો પણ જરા ખુલાસો કરી લઈશા. પ્રભુ વિષે બોલતી વેળાએ હું નરજાતિનો શબ્દ વાપરું છું તે તો મારે જે ભાષા વાપરવી પડે છે તેની મર્યાદાને કારણે બને છે. પરંતુ જે તત્ત્વને હું પ્રેમ તરીકે વાણવું છું તે ખરું જોતાં તો નર કે નારીના તમામ ભેદોથી પર છે. એ તત્ત્વ જ્યારે માનવનું શરીર ધારણ કરે છે ત્યારે તે પોતાના કાર્યની આવશ્યકતા મુજબ નર કે નારીનો દેહ લે છે.

તો ટૂંકમાં, લાગણીની તપસ્યા એટલે લાગણીમાંથી જન્મતી હરેક આસક્તિનો ત્યાગ. એ લાગણી ભલે ગમે તે પ્રકારની હો, એ કોઈ વ્યક્તિ માટેની હો, દેશ માટેની કે બીજી કોઈ વસ્તુ પ્રત્યેની હો, એ સર્વનો ત્યાગ કરીને તમારે પરમાત્માના

દિવ્ય સત્ય પ્રત્યેની આસક્તિમાં જ તમારી જાતને પૂર્ણ ભાવે એકાગ્ર કરી દેવી જોઈએ. આ એકાગ્રતાને પરિણામે તમને પરમાત્મા સાથે એક પૂર્ણ તાદાત્મ્ય પ્રાપ્ત થશે અને તમે પૃથ્વી ઉપર અતિમનસના સાક્ષાત્કાર માટેનું કરણ બની શકશો.

આવી સાધનામાંથી સ્વાભાવિક રીતે જ આપણાને ચાર મુક્તિઓ મળશે. એ મુક્તિઓ આપણાને થયેલા સાક્ષાત્કારનાં મૂર્તિ સ્વરૂપ જેવી હુશે. આપણાને લાગણીઓની મુક્તિ પ્રાપ્ત થશે ત્યારે તેની સાથે સાથે જ, અતિમનસ એકતાનો પૂર્ણ સાક્ષાત્કાર થતાં તેના પરિણામ રૂપે આપણાને દુઃખ માત્રમાંથી પણ મુક્તિ મળશે.

મનની મુક્તિ એટલે કે અજ્ઞાનમાંથી મળેલી મુક્તિ. આપણામાં પ્રકાશનું મન કિંવા જ્ઞાનમય ચેતના સ્થાપિત કરી આપશે, અને એ ચેતના શર્જક સ્વરૂપે વ્યક્ત થશે.

પ્રાણની મુક્તિ એટલે કે કામનામાંથી મળેલી મુક્તિ, વ્યક્તિના સંકલ્પમાં એક નવી શક્તિ લાવી આપે છે કે જે દ્વારા તમને પરમાત્માના દિવ્ય સંકલ્પ સાથે સંપૂર્ણ રીતે અને અજ્ઞાન રીતે તાદાત્મ્ય પામવાની શક્તિ મળી આવે છે, અને તેમાંથી તમને શાંતિ અને સ્વસ્થતા, તેમ જ તેના પરિણામ રૂપે મળી આવતી શક્તિ પણ મળી આવે છે.

અને છેવટે, આ બધી સિદ્ધિઓના શિખર જેવી શરીરની મુક્તિ આવે છે. આ મુક્તિ એટલે કે સ્થૂલ જગતના કાર્યકરણના નિયમમાંથી મુક્તિ. હવે તમને તમારી જાત ઉપર સંપૂર્ણ કાબૂ પ્રાપ્ત થઈ જાય છે. હવે તમે તમારી પાસે અવચેતના તથા અધ્યચેતનામાંથી આવતાં પ્રેરણ દ્વારા કામ કરાવતી, તેમ જ સામાન્ય જીવનની ઘરડમાં તમને પૂરી રાખતી પ્રકૃતિના નિયમોના દાસ નથી રહેતા. આ રીતની મુક્તિ પ્રાપ્ત થતાં તમારે જે માર્ગ લેવો હશે તેનો નિર્ણય તમે પૂરા જ્ઞાનપૂર્વક કરી શકશો, તમારે સિદ્ધ કરવાની વસ્તુની તમે પસંદગી કરી શકશો, હરેક પ્રકારની અંધ નિયતિમાંથી તમે તમારી જાતને મુક્ત કરી લઈ શકશો અને તમારા જીવનમાં એક ઉત્તમોત્તમ જ્ઞાનને, ઉત્તમોત્તમ સંકલ્પને, અતિમનસ ચેતનાને કાર્ય કરવા દઈ શકશો. એ સિવાયની બીજી કોઈ પણ વસ્તુને તમે તમારા જીવનમાર્ગમાં ફરકવા દેશો નહિએ.

(બુલેટિન, ઓગસ્ટ ૧૯૫૩)

\*

## વિદ્યાર્થીઓને — નાના તથા મોટા

પૃથ્વીના ઈતિહાસમાં કેટલીક સંકાન્તિની પળો આવે છે, અને એવી વેળાએ જગતમાં હજારો વર્ષો સુધી ટકી રહેલી વસ્તુઓએ આવિર્ભાવ માટે આવી રહેલી નવી વસ્તુઓને સ્થાન કરી આપવાનું હોય છે. આવા સમયે જગતની ચેતના એક ખાસ પ્રકારની એકાગ્રતામાં પહોંચે છે, અથવા કહો કે, જગતની સર્વ પ્રવૃત્તિઓમાં એક પ્રકારની તીવ્રતા આવે છે. આ એકાગ્રતા કે તીવ્રતા જે પ્રકારની પ્રગતિ કરવાની હોય છે, જે પ્રકારનું રૂપાંતર સાધવાનું હોય છે તે પ્રમાણે બદલાતી રહે છે. આપણે અત્યરે જગતના ઈતિહાસની આવી એક મહા સંકાન્તિની ક્ષાળમાં ઊભા છીએ. કુદરતે પૃથ્વી ઉપર જે રીતે એક મનોમય પ્રાણીનું — મનુષ્યનું સર્જન કરેલું છે, તે જ રીતે આ મનોમય ચેતનાની અંદર એક અતિમનસ ચેતનાનું અને વ્યક્તિત્વનું સર્જન કરવા માટે હમણાં એક અત્યંત એકાગ્ર પ્રવૃત્તિ ચાલી રહેલી છે.

જગતના જીવનની આ મહા ક્ષાળના મહત્વની જાણ વિશ્વમાંનાં કેટલાંક સત્ત્વોને, જેમને કહો કે દેવોના ગુપ્ત રહસ્યમાં પ્રવેશ મળેલો છે તેમને કરવામાં આવી છે. અને એ સત્ત્વોએ આ નવસર્જનમાં પોતાને માટે શક્ય હોય તેવો ભાગ ભજવવાને પૃથ્વી ઉપર જન્મ લીધેલો છે. પૃથ્વીના ઉપર એક મહા વિરાટ તેજોમય ચેતના ચક્કર લગાવી રહેલી છે, અને પૃથ્વીના વાતાવરણમાં એક ઘૂમરી ઊભી કરી રહી છે. પૃથ્વી ઉપર જે જે લોકો ખૂલેલી ચેતનાવાળા છે તેઓ આ ઘૂમરીમાંથી એક મોજું પોતાનામાં જીલે છે, આ પ્રકાશમાંથી એક કિરાણ તેમનામાં અવતરે છે અને એ બધી વ્યક્તિઓ પોતેપોતાની શક્તિ અનુસાર એ તત્ત્વને આકાર આપવા પ્રયત્ન કરી રહી છે.

આપણને અહીં, વિશ્વમાં વિસ્તરી રહેલા આ પ્રકાશને ઠેઠ કેન્દ્રમાં, વિશ્વમાં રૂપાંતરનું વિદ્યાન કરી રહેલી મહા શક્તિના છેક મૂળમાં આવીને રહેવાનો મહા અનન્ય લાભ મળેલો છે.

શ્રી અરવિંદ એક માનવ શરીરની અંદર આ અતિમાનસ ચેતનાને અવતારી હતી. અને એ લક્ષ્યમાં પહોંચવા માટે કયો માર્ગ લેવાવો જોઈએ તથા કેવી રીતે એ માર્ગનું અનુસરણ કરવું જોઈએ એ વસ્તુ આપણને બતાવી આપી છે, એટલું જ નહિ, તેમણે પોતાના અંગત સાક્ષાત્કાર દ્વારા એ સિદ્ધિનું દૃષ્ટાંત પણ આપણી સમક્ષ રજૂ કર્યું છે. અર્થાત્ તેમણે આપણને એ વસ્તુ સાબિત કરી આપી છે કે આ લક્ષ્ય સિદ્ધ થઈ શકે તેવું છે અને તેને સિદ્ધ કરવા માટેનો સમય હમણાં જ આવી લાગેલો છે.

બીજા લોકોએ આજ સુધીમાં જે કાંઈ કર્યું છે તેની તે વસ્તુ આપણે ફરીથી કરવા

માગતા નથી. આપણે તો એક નવી ચેતના અને એક નવા જીવનને આવિર્ભાવ આપવા માટે આપણી જાતને તૈયાર કરવાને અહીં એકત્ર થયા છીએ. અને એટલા માટે, હું તમને વિદ્યાર્થીઓને – એટલે કે જે કોઈ વ્યક્તિ જ્ઞાન મેળવવા માગે છે તે સર્વને કહી રહી છું કે તમે સૌ વધુ ને વધુ જ્ઞાન મેળવો, વધુ ને વધુ સારી રીતે જ્ઞાન મેળવો. અને એ રીતે તમે આ નૂતન શક્તિ પ્રત્યે તમારી જાતને ખુલ્લી કરતા થઈ શકશો, અને એ શક્તિ છેક સ્થૂલ ભૂમિકા ઉપર પોતાને પ્રકટ કરી શકે તેવી શક્યતા ઊભી કરી શકશો. આપણો કાર્યક્રમ તે આ છે એ વાત તમે હમેશાં સ્મરણમાં રાખજો. તમે અહીં આવ્યા છો તે પાછળનું સાચું કરાણ પણ એ જ છે કે આપણે અહીં જગત પાછળ રહેલી પરમાત્માની દૃઢાને વ્યક્ત કરી શકીએ તેવા આપણાથી શક્ય તેટલા એક સંપૂર્ણ કરાણ રૂપ બનવાનું છે. આપણું લક્ષ્ય તે આ છે એ વાત તમે હમેશાં યાદ રાખજો. અને આ કરાણને જો સંપૂર્ણ બનાવવું હોય તો તમારે તેને તૈયાર કરવાનું રહે છે, કેળવવાનું રહે છે, તાલીમ આપવાની રહે છે. એને તમે એક પડતર જમીનની માફક બેડચા વિનાનું પડી રહેવા નહિ દઈ શકો, કે આકાર વિનાના પથ્થરની માફક એણાઘ રહેવા દઈ શકશો નહિ. હીરાનું સંપૂર્ણ સૌન્દર્ય તો તમે જ્યારે તેના કળાત્મક રીતે પાસા પાડો છો ત્યારે જ ખીલી ઊંઠે છે. તમારે માટે પણ એમ જ છે. તમારા શરીરને – બાધ સ્વરૂપને તમારે અતિમાનસ ચેતનાને આવિર્ભાવ આપવા માટેનું એક સંપૂર્ણ કરાણ બનાવવું હશે તો તેને પણ તમારે તૈયાર કરવાનું રહે છે, તેને એક ઘાટ આપવાનો રહે છે, સંસ્કારવાનું રહે છે, તેમાં ખૂટતી વસ્તુઓને ઉમેરવાની રહે છે, અને તેમાં જે વસ્તુઓ આવી રહેલી હોય તેને સંપૂર્ણ કરવાની રહે છે. અને આ કાર્ય માટે જ, મારાં બાળકો, તમે સૌ વર્ગમાં આવો છો. તમે ભલે નાનાં હો કે મોટાં, પણ ગમે તે ઉમરે પણ આપણે ભાડું તો શકીએ જ છીએ. અને એટલે વિદ્યાભ્યાસ માટે વર્ગમાં જવું તમારે જરૂરનું જ છે.

પણ કેટલીક વાર એવું બને છે કે તમારા મનને ઠીક નથી હોતું અને ત્યારે તમને વર્ગમાં રસ નથી પડતો. તમે કહો છો, ‘ઓ, આ વિષયમાં તો મને બધું જ કંટાઓ આવે છે!’ હા, એવું બની શકે કે તમારા શિક્ષકને તમને આનંદ કરાવતાં નહિ આવકંતુ હોય. શિક્ષક તરીકે એ બધું સારા હશે, પરંતુ એ તમને બધું આનંદ નહિ આપી શકતા હોય. બીજાને આનંદ કરાવવો એ કેંદ્ર બધું સહેલી વાત નથી. કોઈ કોઈ વાર એવા દિવસો પણ આવે છે કે જ્યારે, બીજાને આનંદવિનોદ કરાવવાની દૃઢા આપણને થતી પણ નથી. વળી કોઈ વાર એવા પણ દિવસો આવે છે કે જ્યારે એકલા તમને જ નહિ, શિક્ષકને પણ, નિશાળ મૂકીને બીજે કયાંક ચાલ્યા જવાનું મન થતું હોય છે. પરંતુ તમારું મન આમ નારાજ હોય છતાં તમે તમારા વર્ગમાં જાઓ છો.

કારણ કે વર્ગમાં જવું એ તમારું કર્તવ્ય છે. તમારા કર્તવ્યનો ખ્યાલ ભૂલીને તમે જો તમારા મનની ધૂન પ્રમાણે જ કામ કરતા રહેશો તો તમે તમારી જાત ઉપર કદી કાબૂ નહિ મેળવી શકો, તમારી ધૂનો તમારા ઉપર કાબૂ મેળવી લેશો. એટલે તમે વર્ગમાં તો જરૂર જજો, પરંતુ જતાં જતાં મનમાં એમ વિચાર ન કરતા કે, ‘અરે, વર્ગમાં મને બધું જ કંટાળો આવશે, જરા યે રસ નહિ પેડે.’ આ રીતે વિચારવાને બદલે તમારે આમ કહેવું જોઈએ કે, જીવનમાં એવી એક પણ ક્ષાણ નથી, એવી એક પણ પરિસ્થિતિ નથી કે જેમાં આપણને પ્રગતિ કરવાની તક ન મળી શકે. તો પછી હું આજે વર્ગમાં કઈ પ્રગતિ કરીશા? હું જે વર્ગમાં જાઉં હું ત્યાં જે વિષય ચાલવાનો છે તેમાં મને રસ નથી પડતો. પણ મને આ રસ શા માટે નહિ પડતો હોય? કદાચ મારામાં કાંઈક ઊણાપ હશે, કદાચ મારા મગજના કોઈએક ખૂણામાંના કોશોમાં કંઈક ખામી હશે, અને એટલે જ મને વર્ગના વિષયમાં રસ નહિ પડતો હોય. પણ જો એમ હોય તો તો પ્રયત્ન કરીશા, બરાબર ધ્યાન દઈને સાંભળીશા, મારા મનને એકાગ્ર કરીશા. અને ખાસ કરીને આ ઉપરછલ્લી છીછારી મનોદશાને તો હું જરૂર હંડી કાઢીશ. કેમ કે મને કોઈ વસ્તુ સમજાતી નથી ત્યારે જે કંટાળો આવે છે તેનું ખરું કારણ જ આ છે. હું પોતે વિષયને સમજવા માટે કશો જ પ્રયત્ન કરતો નથી, પ્રગતિ કરવા માટે મારામાં કોઈ સંકલ્પ પ્રગટો નથી અને તેને લીધે જ મને કંટાળો આવે છે.’ દરેક માણસને જ્યારે પોતાની પ્રગતિ થતી દેખાતી નથી ત્યારે અવશ્ય કંટાળો આવે છે, ભલે પછી તે જુવાન હોય કે વૃદ્ધ. કારણ કે આપણું પૃથ્વી ઉપર આવવું તે પ્રગતિ કરવાને માટે જ છે. જીવન જો પ્રગતિ કરતું ન હોત તો તો તે કેટલું બધું કંટાળાજનક બની રહેત! હા, જીવન એ એક એકધારી વસ્તુ છે, ઘણી વાર એમાં કશો જ આનંદ નથી હોતો. અને એમાં સુંદરતા તો નથી જ નથી. પરંતુ આવા જીવનને આપણે જો પ્રગતિ માટેના એક ક્ષેત્ર તરીકે સ્વીકારી લઈએ તો તો પછી બધું જ બદલાઈ જાય છે, દરેક વસ્તુ રસપ્રદ બનવા લાગે છે, અને કંટાળાને માટે કોઈ જ સ્થાન રહેતું નથી. એટલે હવે ફરી વાર જ્યારે તમને વર્ગમાં શિક્ષક કંટાળો આપતા લાગે ત્યારે કંઈ પણ કામ કર્યા વિના વખત બગાડવાને બદલે શિક્ષક શા માટે રસ નથી આપી શકતા તે સમજવાનો પ્રયત્ન કરજો. અને તમારામાં જો અવલોકનની શક્તિ હશે અને તમે જો સમજવાને પ્રયત્ન કરશો તો તમે થોડા જ વખતમાં જોઈ શકશો કે જાણે એક ચમત્કાર બની ગયો છે અને તમને હવે કોઈ વસ્તુ કંટાળાજનક દેખાતી નથી.

આ હલાજ લગભગ દરેક પ્રસંગે કામ આવે તેવો છે. કેટલીક વાર અમુક પ્રકારના સંજોગોમાં તમને હરેક વસ્તુ નીરસ, કંટાળાજનક, અર્થહીન લાગે છે; પણ આનો અર્થ એ છે કે તમે પોતે પણ તમારા સંયોગોના જેટલા જ કંટાળાજનક બની

ગયેલા છો, અને વળી એમાંથી એક બીજી વસ્તુ પણ ભરાબર રૂપણ થઈ જાય છે કે તમે કોઈ પ્રગતિકારક સ્થિતિમાં નથી, તમારા ઉપર કંટાળાનું, નીરસતાનું એક મોજું ફરી વળેલું છે, અને આવી વસ્તુ તો જીવનનો આખો પાયો જ નાબૂદ કરી નાખે તેવી હોય છે. આવે વખતે તમે એક પ્રયત્ન કરીને તમારી જાતને પ્રશ્ન કરી શકો છો કે, ‘મને આ જે નીરસતા દેખાય છે તે એ જ બતાવી આપે છે કે મારે હજુ જીવનમાં કંઈક શીખવાનું બાકી છે, મારી પોતાની અંદર મારે એક પ્રગતિ કરવાની છે, મારામાંની કોઈ જડતાને જીતવાની છે, કોઈક નભળાઈને વશ કરવાની છે’. નીરસતા એ ચેતનાની એક સપાટ નિષ્પ્રાણ અવસ્થા છે. અને એનો ઈલાજ તમારી અંદરથી મેળવવા પ્રયત્ન કરશો તો એ નીરસતા તરત જ ચાલી જતી તમને દેખાશે. ઘણાખરા માણસો, પોતાને કંટાળો આવે છે ત્યારે પોતાની ચેતનામાં એક પગથિયું ઊંચું ચડવાનો પ્રયત્ન કરવાને બદલે એક કદમ નીચે ઊતરી આવે છે. એટલું જ નહિ, પોતે જ્યાં હોય છે ત્યાંથી પણ તેઓ વધુ નીચે સરકી પડે છે અને સાવ અક્કલ વગરનાં કામો કરવા લાગે છે. પોતાને આનંદ મળશે એવી આશાએ તેઓ જંગલી માણસના જેવી વસ્તુઓ કરવા લાગે છે, અને આ રીતે માણસો દારુ પીવા માર્દી છે, પોતાની તબિયત બગાડે છે, પોતાનું મગજ ગુમ કરી દે છે. આ લોકો આમ નીચે સરી પડવાને બદલે જો પોતાની ચેતનાને ઊંચે લઈ જઈ શક્યા હોત તો એ પ્રસંગનો લાભ લઈને તે જરૂરી પ્રગતિ સાધી શક્યા હોત.

જીવનના તમામ સંજોગો પરત્વે આ વસ્તુ લાગુ પડે છે. જીવનમાં તમને કોઈ સખત ફટકો પડે, લોકો જેને ઘોર આપત્તિ ગણે છે તેવો કોઈ બનાવ તમારા જીવનમાં બની આવે તેવે વખતે પણ તમે આ દૃષ્ટિથી કામ કરી શકો છો. આવા પ્રસંગો લોકો સૌથી પ્રથમ તો એ આપત્તિને ભૂલ્લી જવાનો પ્રયત્ન કરે છે, જાણે કે પોતાને એ બધું ભૂલ્લી જતાં બહુ વાર લાગવાની હોય! અને આ ભૂલવા માટે લોકો ભાતભાતની વસ્તુઓ કરે છે. આવા આધાતની વ્યથામાંથી રાહુત મેળવવા માટે તેઓ કોઈ બીજી વસ્તુમાં મન પરોવવા પ્રયત્ન કરે છે. અને મનને કોઈ બીજી વસ્તુમાં પરોવવી એટલે કે અર્થહીન વસ્તુઓ કરવી. એવી પ્રવૃત્તિઓ કરતાં માણસ પોતાની ચેતનામાં નીચે સરકી પડે છે, પોતાની ચેતનાને ઊંચે લેવાને બદલે નીચે ઘસડી જાય છે. એટલે તમારા જીવનમાં જો કોઈ આવી અત્યંત દર્દમય વસ્તુ બની આવે તો તેવે વખતે તમારી જાતને લાગણીશૂન્ય બનાવી દેવાનો પ્રયત્ન ન કરશો, તેને ભૂલી જવાનો, અચેતનામાં ઊતરી જવાનો પ્રયત્ન ન કરશો. એમ ન કરતાં તમે તમારી ચેતનામાં આગળ વધો, તમારા દર્દની ઠેઠ ભીતરમાં પહોંચી જાઓ, અને ત્યાં તમને એ દર્દની પાછળ જે એક પ્રકાશ, એક સત્ય, શક્તિ અને આનંદ છુપાઈ

રહેલાં હોય છે તે મળી આવશે. પરંતુ આ વસ્તુ કરવાને માટે તમારે મહા મક્કમ રહેવું પડશે, નીચે સરકી પડવાને ઘસીને ના પાડવી પડશે.

આવી રીતે તમારા જીવનના સર્વ બનાવો, પછી તે નાના હો કે મોટા, ગ્રાતિ માટેની એક તક બની શકે છે. જીવનની નાની નાની ક્ષુદ્ર બાબતો પણ, તમને જો તેનો લાભ લેતાં આવે તો, તમને નવાં નવાં સત્યોનું પ્રાકૃત્ય કરી આપી શકે છે. તમારે જ્યારે કોઈ એવું કામ કરવાનું હોય કે જેમાં તમારું બધું ધ્યાન વાપરવાની જરૂર ન હોય ત્યારે એવે પ્રસંગે તમે તમારી અવલોકન શક્તિને ખીલવવાનો પ્રયત્ન કરજો. અને તમે જોશો કે એમાંથી તમને બહુ જ રસિક રસિક વસ્તુઓ મળી આવશે. આ કેવી રીતે બને છે તે બતાવવા હું તમને બે પ્રસંગો કહીશા. આ પ્રસંગો પ્રસંગ તરફે તો સાવ નજીવા જ છે, અને છતાં એ પોતાની પાછળ એક ઘણી ઊંડી અને કાયમની છાપ મૂકી જાય તેવા છે.

પહેલો પ્રસંગ તે પેરિસમાં બનેલી એક ઘટનાનો છે. એ વિશાળ નગરના એક માર્ગ ઉપર થઈને તમે જઈ રવા છો. બધે જ ઘોંઘાટ ઘોંઘાટ છે, એક ટેખીતી રીતની અંઘાધૂંધી છે, ગભરાવી મૂકી તેવી ધાંધલ છે. એકાએક તમારી આગળ તમને એક સ્ત્રી ચાલી જતી દેખાય છે. બીજી અનેક સ્ત્રીઓના જેવી એ પણ એક સ્ત્રી છે. તેના પોશાકમાં કશું ધ્યાન બેંચે તેવું તત્ત્વ નથી. પરંતુ તેની ગતિ, ચાલવાની રીત અદ્ભુત છે. એની ચાલમાં તરલતા છે, લયબદ્ધતા છે, છટા છે, સંવાદિતતા છે. તમારું ધ્યાન એકદમ તેના ઉપર કરી જાય છે અને તમે પ્રસન્ન થઈ તેને જોઈ રહો છો. અને પછી આવી સુંદર રીતે ગતિ કરતું એ શરીર પ્રાચીન ગ્રીસની સારી યે જાહોજલાલીને તમારી સ્મૃતિમાં ખડી કરી આપે છે, એ દેશની સંસ્કૃતિએ સારા યે જગતને સૌન્દર્યના જે અપૂર્વ પાદ આપેલા છે તે તમને યાદ આવે છે અને તમારા જીવનમાં તમે એક અવિસ્મરણીય પળનો અનુભવ કરી રહો છે. અને આ બધું તે ફક્ત એક સરસ રીતે ચાલી જાણતી સ્ત્રીને કારણે બનેવું હોય છે.

બીજો પ્રસંગ તે જગતના એક બીજા છે, જાપાનમાં બનેલી ઘટનાનો છે. આ અતિશય સુંદર દેશમાં તમે હજુ હમણાં જ આવ્યા છો. તમારે અહીં ટીક ટીક વખત રહેવું છે અને તમને તરત જ એ ખ્યાલ આવે છે કે આ દેશની ભાષાનું તમને થોડું એક જ્ઞાન પણ નહિ હોય તો અહીં રહેવું મુશ્કેલ બની જશો. એટલે તમે જાપાની ભાષા શીખવી શરૂ કરો છો. એ ભાષા સાથે પરિચિત થઈ શકાય એટલા માટે તમે લોકોને બોલતા સાંભળવાની એકએક તકનો લાભ લઈ લો છે. એક વખતે તમે ટ્રામમાં જઈ રહેલા છો; અને તમારે પડખે તમે એક ચાર પાંચ વર્ષનું બાળક તેની મા સાથે બેઠેલું જુઓ છો. બાળક એક સ્પષ્ટ નિર્મળ ભાષામાં બોલવા

લાગે છે, અને એ સાંભળતાં સાંભળતાં તમને એ લાક્ષણિક અનુભવ થાય છે કે જે વસ્તુને શીખવા માટે તમારે આટલી બધી મહેનત કરવી પડે છે તે આ બાળક તો આપોઆપ જ શીખી ગયેલું છે અને જાપાની ભાષાના વિષયમાં તો, તમારા કરતાં એ આટલું બધું નાનું છે છતાં તે તમારો શિક્ષક થઈ શકે તેમ છે.

આ રીતે જોતાં આખું યે જીવન એક અદૃભુત આશ્ર્યોથી ભરેલી વસ્તુ બની રહે છે અને દરેક પગલે તમને તે કાંઈ ને કાંઈ પદાર્થપાઠ આપતું રહે છે. અને આ દૃષ્ટિબિંદુથી જોતાં જીવન તમને ખરેખર એક જીવવા જેવી વસ્તુ લાગશે.

(બુલેટિન, નવેમ્બર ૧૯૫૩)

\*

## ભાવિ દર્શન

ભાવિનું દર્શન! આ વસ્તુ પ્રાપ્ત કરવા માટે કેટકેટલા લોકો પ્રયત્ન કરી ચૂક્યા છે, કેટકેટલાં દર્શનો ઉભાં થયાં છે, ભવિષ્યદર્શનની કેટલી કેટલી વિદ્યાઓ ઉભી થઈ છે, વિકસી છે અને વહેમ અને ઊંટ વૈદકના નામે ઓળખાઈને પડી પણ ભાંગી છે! ભવિષ્ય શા માટે આમ હમેશાં અદૃષ્ટ જ રહેલું હશે? એ વસ્તુ તો સિદ્ધ થઈ ચૂકી છે કે વિદ્યમાં એકેએક વસ્તુ પૂર્વથી જ અનિવાર્ય રીતે નિર્ણાત થઈ ચૂકેલી છે. તો પછી આ નિર્માણનું સંપૂર્ણ ખાતરીપૂર્વકનું જ્ઞાન મેળવવામાં આપણને કેમ સફળતા નથી મળતી?

આ પ્રશ્નનો ઉકેલ પણ યોગમાંથી આપણને મળે છે. યોગની સાધના દ્વારા આપણે અગાઉથી ભાવિ જોઈ શકીએ છીએ, એટલું જ નહિ, તેમાં ફેરફાર પણ કરી શકીએ છીએ, કહો કે તેને લગભગ આખું ને આખું પલટી પણ શકીએ છીએ. યોગ પ્રથમ તો આપણને એ શીખવે છે કે આપણે કોઈ એક જ સ્વરૂપવાળી, એક જ સાદા તત્ત્વ રૂપી એવી વ્યક્તિ નથી કે જેને માટે એક જ પ્રકારનું સાદું અને તર્કબદ્ધ ભાવિ જ નિર્માયું હોય. આપણે એ સ્વીકારકું પડશે કે ઘણાં મનુષ્યોનું ભાવિ એ એક ઘણો સંકુલ વિષય છે.આ સંકુલતા કેટલીક વાર તો વધીને વિસંગતતા સુધી પહુંચેચી જાય છે. આ સંકુલતાને લીધે જ આપણને એમ ભાસ થાય છે કે માણસના ભાવિમાં તો ઘણી આશધારી વસ્તુઓ બને છે, એટલે કે એ ભાવિમાં પૂર્વનિર્માણનો અભાવ હોય છે, અને તેથી તે વિષે અગાઉથી કંઈ પણ કરી શકાય તેવું નથી.

આ પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપણે પ્રથમ તો જાણાવું જોઈએ કે જગતમાં સર્વ જીવંત પ્રાણીઓ, અને તેમાં યે ખાસ કરીને માનવપ્રાણી એક કરતાં વધુ તત્ત્વોના સંયોગમાંથી બનેલું છે. એ બધાં તત્ત્વો તેની અંદર ભેગાં મળીને રહેલાં હોય છે, એ તત્ત્વો એકબીજાની અંદર પ્રવેશ કરતાં હોય છે. કદી કદી પોતાને તેઓ સંગઠિત કરતાં હોય છે, એકબીજાનાં પૂરક બનતાં હોય છે, અને કદી કદી એકબીજાની સામે પડીને અન્યોન્યનો વિરોધ પણ કરતાં હોય છે. પ્રત્યેક પ્રાણીને અથવા તો પ્રાણીની પ્રત્યેક અવસ્થાને તેની પોતાની દુનિયા હોય છે, તે દરેકને તેનું પોતાનું ભાવિ હોય છે, તેનું પોતાનું નિર્માણ હોય છે. આ બધાં નિર્માણોના, અને કેટલીક વાર તો ઘણાં જ વિસંવાદી એવાં નિર્માણોના સંયોગમાંથી વ્યક્તિના ભાવિનું સર્જન થાય છે. પરંતુ આ બધાં તત્ત્વોનું સંગઠન તેમ જ તેમનો સંબંધ વ્યક્તિ પોતાની અંગત સાધના દ્વારા તથા પોતાના સંકલ્પબળ દ્વારા બદલી શકે છે. વળી આ બધાં બિન્ન

ભિન્ન નિર્માણો એકબીજાના ઉપર, વ્યક્તિમાં રહેલી ચેતનાની એકાગ્રતા મુજબ કાર્ય કરે છે, અને તેથી એ તત્ત્વોનું સંયોગોકરણ હુમેશાં બદલાતું રહે છે. વ્યક્તિને વિષે આગળથી ભવિષ્ય ભાખવું અશક્ય હોય છે તેનું કારણ આ છે.

દાખલા તરીકે, મનુષ્યનું શારીરિક ડિવા સ્થૂલ ભાવિ તેના પિતૃપક્ષના અને માતૃપક્ષના આધારે, તે જે સ્થૂલ પરિસ્થિતિમાં અને સંયોગોમાં જન્મ્યો હોય છે તેના આધારે રચાતું હોય છે. આ બધી હડીકતોનો આધાર લઈને આપણે આગળથી જોઈ શકીએ છીએ કે વ્યક્તિના સ્થૂલ જીવનમાં કેવા કેવા બનાવો બનશે, તેના આરોગ્યની સ્થિતિ કેવી રહેશે, તેનું શરીર આશારે કેટલો વખત ટકશે. પરંતુ વ્યક્તિના જીવનમાં તેનું ગ્રાણમય સ્વરૂપ (એટલે કે વ્યક્તિની ઈચ્છાઓ, ઉત્ત્ર વૃત્તિઓ તેમ જ પ્રેરક શક્તિ અને સક્રિય સંકટપદશક્તિનું બનેલું સ્વરૂપ) પણ ભાગ ભજવતું હોય છે અને એ સ્વરૂપને પણ તેનું આગવું ભાવિ હોય છે. આ ગ્રાણમય ભાવિ વ્યક્તિના સ્થૂલ શારીરિક ભાવિ ઉપર પોતાનો પ્રભાવ નાખે છે, તે એ શારીરિક ભાવિને તદ્દન બદલી પણ શકે છે, અને કેટલીક વાર તો એ ફેરફાર ઊલટા પ્રકારનો, ખરાખ પણ હોય છે. ઉદાહરણ રૂપે, કોઈ માણસ ઘણું જ સરસ શારીરિક સ્વાસ્થ્ય લઈને જન્મેલો હોય તો તેનું જીવન ઘણું જ તંદુરસ્ત નીવડવું જોઈએ. પરંતુ જો તેનો ગ્રાણ તેને હરેક પ્રકારના અતિરેકોમાં બેંચી જાય, તેનામાં ખોટી ટેવો અને દુર્ગણો ઊભા કરી આપે, તો પછી એ રીતે તેનું શારીરિક ભાવિ સારું હોય તો પણ તે અમુક અંશો જોખમાઈ જાય છે. તેનામાં રહેલો આરોગ્ય અને શક્તિનો મેળ, કે જે ગ્રાણની આ હાનિકારક દખલણીરી જો ન હોત તો ખરાખર ટકી રહ્યો હોત તે ચાલ્યો જાય છે. આ તો એક માત્ર દૃષ્ટાંતરૂપે વાત કહી છે. આ પ્રશ્ન તો આથી પણ ઘણું વધું ગુંચવાળાભરેલો છે. કારણ કે વ્યક્તિના શારીરિક તેમ જ ગ્રાણમય ભાવિની સાથે તેના મનોમય સ્વરૂપનું ભાવિ, તેના અંતરાત્માનું ભાવિ તેમ જ બીજાં પણ ઘણાં ભાવિઓ તેના જીવનમાં કામ કરી રહ્યાં હોય છે.

ખરું જોતાં તો, માનવ કક્ષાની અંદર વ્યક્તિ જેટલી વધુ ઉચ્ચ સ્થાને આવેલી હોય છે તેમ તેમ તેનું સ્વરૂપ વધુ સંકુલ બનતું જાય છે, અને તેનું ભાવિ પણ તેટલા જ પ્રમાણમાં આગળથી ઓછું ને ઓછું જોઈ શકાય તેવું હોય છે. પરંતુ આ તો માત્ર એક બહારનો આભાસ છે. આપણને જો વ્યક્તિની આ ભિન્ન ભિન્ન અવસ્થાઓનું તેમ જ તે પ્રત્યેક અવસ્થાની પાછળ આવેલી આંતર સૂચિઓનું જ્ઞાન થઈ શકે તો સાથે સાથે તે દરેક અવસ્થાનું ભાવિ જોવાની શક્તિ પણ મળી આવે છે. એ શક્તિ દ્વારા આપણે એ પણ જોઈ શકીએ કે એ અવસ્થાઓ કેવી રીતે એકબીજામાં પ્રવેશ પામે છે, કેવી રીતે ભેગો મળીને કાર્ય કરે છે યા તો તેમાંથી કઈ અવસ્થા પ્રધાન

ભાગ ભજવે છે. એ વાત તો સ્પષ્ટ છે કે આ ભાવિના પ્રદેશમાં જેમ જેમ ઉંચે ને ઉંચે જતા જઈએ તેમ તેમ આપણે વિશ્વના કેન્દ્રમાં રહેલા સત્યની વધુ ને વધુ નજીક પહોંચેતા જઈએ છીએ અને એ ઉદ્ઘા ભાવિઓને જીવનમાં પ્રવેશ કરવા દેવામાં આવે તો તેમનું કાર્ય અવશ્ય લાભદાયક જ હોય છે. આ રીતે જોતાં જીવનની કળા તો તે ગાણાય કે જેમાં આપણે આપણી ઉચ્ચ્યોચ્ચ ચેતનામાં જ સતત સ્થિત રહેતા હોઈએ અને એ રીતે આપણા ઉચ્ચ્યમાં ઉચ્ચ્ય ભાવિને આપણા જીવનનાં તથા કર્મનાં અન્ય ભાવિઓ ઉપર પોતાનો પ્રભાવ પાથરવા દઈએ. તો પછી આપણે સત્યને હાનિ કર્યા સિવાય આટલું તો અવશ્ય કહી શકીએ: હમેશાં તમારી ચેતનાના શિખર ઉપર જ સ્થિર રહો, અને તમારે માટે જે કંઈ વધુમાં વધુ ઈછ હશે તે જ તમને આવી મળશે. પરંતુ આ પણ એક એવો તો ઉચ્ચ્ય આદર્શ છે કે જ્યાં પહોંચવું સાવ સહેલું નથી હોતું. પરંતુ આ આદર્શ સ્થિતિ સિદ્ધ ન થઈ હોય ત્યારે પણ વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ ભય યા તો કટોકટીનો પ્રસંગ ઊભો થાય ત્યારે પોતાના ઉચ્ચ્યોચ્ચ ભાવિનું ઉદ્ભોધન કરી શકે છે, તે ભાવિ તરફ પોતાની અભીષ્ટા વાળીને, પ્રભુની દિવ્ય સંકલપશક્તિને પ્રાર્થના કરી શકે છે અને તેના હાથમાં શ્રદ્ધાપૂર્વક પોતાનું સમર્પણ કરી શકે છે. માણસ જો આટલું કરી શકે તો તેનો પુકાર જેટલો વધુ સાચો હશે તેટલા પ્રમાણમાં આ ઉચ્ચતર ભાવિ તેના સામાન્ય ભાવિની અંદર સાનુકૂળ રીતે પ્રવેશ કરે છે, અને તેના અંગત જીવન સાથે સંબંધ ધરાવતી ઘટનાઓને પણ બદલી આપે છે. આ પ્રકારના બનાવો જ બાધ્ય ચેતનાને ચમત્કાર રૂપ લાગે છે. જગતમાં પ્રભુના દિવ્ય અનુપ્રવેશ જેવા લાગે છે.

(બુલેટિન, ફેબ્રુઆરી ૧૯૫૦)



## રૂપાંતર

આપણે એક સંપૂર્ણ સર્વાંગ રૂપાંતર માગીએ છીએ, શરીરનું અને શરીરની સર્વ કિયાઓનું રૂપાંતર માગીએ છીએ. પરંતુ એ દિશામાં કોઈ પણ કાર્ય શરૂ કરી શકાય તે પહેલાં એક બીજી વસ્તુ કરી લેવાની રહે છે. એ છે ચેતનાનું રૂપાંતર. રૂપાંતરના કાર્યમાં એ સૌથી પ્રથમ પગલું છે, તદ્દન અનિવાર્ય. આ રૂપાંતર સિદ્ધ કરવા માટે પ્રથમ તો આપણામાં એ માટેની અભીષ્ટા હોવી જોઈએ, તેને સિદ્ધ કરવા માટેનો સંકલ્પ હોવો જોઈએ. આ વસ્તુ કહેવાની જરૂર ભાયે જ હોય. આવી અભીષ્ટા અને સંકલ્પ વિના કશું જ થઈ ન શકે. પરંતુ એ અભીષ્ટાની સાથે સાથે જો આપણે આંતર ચેતના ખુલ્લી થઈ શકે, તેનામાં એક રીતની ગ્રહણશક્તિ જો આવે તો પછી આપણે આ રૂપાંતર પામેલી ચેતનાને એકી સપાટે પામી શકીએ છીએ અને તેમાં સ્થિર રહી શકીએ છીએ. ચેતનાનું આ પરિવર્તન, એક રીતે કહીએ તો, એકાએક જ બની આવે છે. એ પરિવર્તન જ્યારે બની આવે છે ત્યારે તે એકદમ જ થઈ આવે છે, જો કે તે માટેની તૈયારી તો ઘણા લાંબા વખતથી અને ધીરે ધીરે શરૂ થઈ ચૂકેલી હોઈ શકે છે. આ જે પરિવર્તનની હું વાત કરું છું તે આપણા માનસિક દૃષ્ટિબિંદુમાં આપણે એકાદ સાઢો ફેરફાર કરી લઈએ એ રીતનું પરિવર્તન નથી. એ પરિવર્તન તો ચેતનાનું પોતાનું જ પરિવર્તન છે. આપણી અંદર એને લીધે એક સંપૂર્ણ પરમ ફેરફાર બની આવે છે, આપણી જે પ્રથમ પાયા જેવી અવસ્થા હોય છે તેમાં જ એક કાન્તિ આવી જાય છે. જાણો કે એક દાને ઉલટાવી નાખીને તેની અંદરનો ભાગ બહાર કાઢી લઈ આવીએ તેના જેવું આ બને છે. આ પલટાયેલી ચેતનામાં હરેક વસ્તુ નવી અને જુદી જ દેખાય છે એટલું જ નહિ, પણ આપણી સામાન્ય ચેતનાને તે જેવી દેખાતી હતી તે કરતાં તે લગભગ ઊલટી જ દેખાવા લાગે છે. તમે સામાન્ય ચેતનામાં હો છો ત્યારે તમારી પ્રગતિ બહુ ધીરી હોય છે, તમે એક પછી એક એક આવ્યે જતા અનુભવોમાંથી પસાર થતા જાઓ છો, અજ્ઞાનમાંથી કોક દૂર દૂરના અને તે ય શંકાસ્પદ એવા જ્ઞાન તરફ તમે આગળ વધો છો. પરંતુ રૂપાંતર પામેલી ચેતનામાં તમે જ્ઞાનથી જ તમારી યાત્રા શરૂ કરો છો, તમારી ગતિ જ્ઞાનમાંથી જ્ઞાન પ્રત્યે થવા માગો છે. તેમ છતાં આ હજી માત્ર આરંભની જ અવસ્થા છે. કારણ કે, તમારામાં થઈ આવતા આંતર રૂપાંતરને પરિણામે, તમારી બાધ્ય ચેતના તેમ જ તમારા બાધ્ય અને સક્રિય સ્વરૂપની જુદી જુદી ભૂમિકાઓ અને અંગો તો ધીરે ધીરે અને કમે કમે જ રૂપાંતર પામે છે.

એવું બને છે કે તમને એક વાર પ્રિય લાગતી વસ્તુઓમાંથી તમારો બધો જ

રસ ચાલ્યો જાય છે. આવું પરિણામ તમારી ચેતનામાં કંઈક આંશિક ફેરફાર થયો હોય છે ત્યારે આવે છે. એ ફેરફાર તે ચેતનામાં થયેલું માત્ર એક પરિવર્તન જ છે. જેને આપણે રૂપાંતર કહીએ છીએ એ વસ્તુ તે નથી. રૂપાંતર એ તો કશીક એકદમ મૂલગત - પાયાની અને અતિ પરમ વસ્તુ છે. એ માત્ર ફેરફાર જ નથી હોતો. એમાં તો ચેતનાની આખી ઊલટસૂલટ જ થઈ જાય છે. આપણી ચેતના જાણે કે એકદમ ઊલટી દિશામાં જ મોંકું ફેરવી લે છે અને એક તદન જુદી જ ભૂમિકા ઉપર ઊભી રહી બધું નિહાળે છે. આ ઊલટાયેલી ચેતનામાં આપણે જીવન અને જગતથી પર થઈ જઈએ છીએ અને ત્યાં રહ્યા રહ્યા તેમની સાથે કામ લઈએ છીએ. આપણે જાણે કે વિશ્વના કેન્દ્રમાં પહુંચ્યેલે છીએ અને એ કેન્દ્રમાંથી બહારના જગત તરફનાં આપણાં કાર્યોનું સંચાલન કરીએ છીએ. સામાન્ય ચેતનામાં આવું નથી હોતું. એ ચેતનામાં આપણે જાણે જગતથી બહાર ઊભેલા હોઈએ છીએ, જગતની નીચે ઊભેલા હોઈએ છીએ, અને ત્યાંથી નીકળીને કેન્દ્રની અંદર પહુંચ્યવા માટે કોશિશ કરીએ છીએ. આપણી અંધતા અને અજ્ઞાનના બોજા હેઠળ કચડાતા ભીસાતા નીચેની દિશામાંથી આપણે જગતથી ઉપર પહુંચ્યવા માટે મરણાતોલ મહેનત કરીએ છીએ. સામાન્ય ચેતનાને વસ્તુઓના સત્ય સ્વરૂપનું જ્ઞાન છે જ નહિ. એ માત્ર વસ્તુનું ઉપરનું પડ જ જુએ છે. પરંતુ સાચી ચેતના તો વાસ્તવિકતાના કેન્દ્રમાં, હાઈમાં જ બેઠલી હોય છે. જગતની સર્વ કિયાઓના આદિ મૂલનું અને સીધેસીધું દર્શન લાદે છે. આમ જગતના ભીતરમાં અને ઊર્ધ્વમાં રહીને તે જગતના સર્વ પદાર્થોનું અને સર્વ શક્તિઓનું આદિ મૂલ જાણતી હોય છે, તેમનું કારણ અને તેમનાં પરિણામો જાણતી હોય છે.

તો ચેતનાની આ ઊલટસૂલટ, હું એક વાર ફરીને કહીશા, એકાએક જ બની આવે છે. તમારી અંદર કશુંક ખૂલ્યી જાય છે, અને તમે પોતાને એકદમ જ કોક નવી દુનિયામાં પહુંચેલા ભાળો છો. આવો ફેરફાર શરૂ થાય તે જ ક્ષાળો તે સંપૂર્ણ અને અંતિમ અવસ્થાનો નથી હોતો. એ ફેરફાર તમારામાં હુમેશને માટે એક સ્થાયી તત્ત્વ બની રહે, તમારી એક સ્વાભાવિક પ્રકૃતિ જેવો બની રહે એમ થતાં વખત લાગે છે. પરંતુ એક વાર આ ફેરફાર તમારામાં બની આવ્યો, તે પછી એ તાત્ત્વિક રીતે તમારામાં હુમેશને માટે કાયમ રહેવાનો જ છે. તે પછીથી તે પરિવર્તન તમારી અંદર મૂર્ત રૂપે અને વિગતવાર ક્રમે ક્રમે સાકાર થતું રહે એટલું જ બાકી રહે છે.

રૂપાંતર પામેલી ચેતના જ્યારે પ્રથમ વાર પ્રગટ થાય છે ત્યારે એ કિયા હુમેશાં એકાએક જ બની આવતી દેખાય છે. તમને એમ નથી લાગતું કે તમે ધીમે ધીમે અને ક્રમે ક્રમે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જઈ રહ્યા છો. તમને એમ જ લાગે છે કે જાણે તમે એકાએક જ જાગી ગયા છો યા તો પેલી નવી સ્થિતિમાં તમારો

જન્મ થઈ ગયો છે. આવી જાગૃતિ કે આવો નવ જન્મ તમે મન દ્વારા ગમે તેટલો પ્રયત્ન કરશો તો પણ પામી નહિ શકો, કારણ કે એ વસ્તુ કેવી હોવાની તે તમે મન દ્વારા કલ્પી શકવાના નથી, અને મન તેનું ગમે તેટલું વર્ણન આપશો તો પણ તે સાચું હોવાનું નથી.

હુરેક પ્રકારના સર્વાંગ રૂપાતરનું પ્રસ્થાનબિંદુ આ પ્રકારનું હોય છે

(બુલેટિન, ઓગસ્ટ ૧૯૫૦)

\*

## મૃત્યુનો ભય અને તેને જીતવાની ચાર પદ્ધતિઓ

સામાન્ય રીતે કહીએ તો માણસની પ્રગતિને રોકનારું સૌથી મોટું વિઘ્ન કોઈ હોય તો તે કદાચ ભય છે. આ ભય ઘણી વિવિધ રીતનો, અસંખ્ય પ્રકારનો હોય છે. એમાં વળી આંતર વિરોધી તત્ત્વો પણ હોય છે, એ ભયની પાછળ કોઈ તર્કદૃષ્ટિ નથી હોતી, કોઈ કારણો નથી હોતાં. ઘણી વાર તો તેની પાછળ કોઈ જ બુદ્ધિગમ્ય વસ્તુ હોતી નથી. આ બધા ભયોમાં સૌથી વધુ સૂક્ષ્મ રીતનો અને માણસને સૌથી વધુ વળગી રહેનારો ભય તે મૃત્યુનો ભય છે. આ ભયનાં મૂળ અવચેતનામાં ઊરે ઊરે પેઢાં હોય છે અને તે સ્થળેથી તેને નિર્મળ કરવો એ એક મહા અધરી વસ્તુ છે. આપણે એ પણ જોઈ શકીએ છીએ કે એ ભય પરસ્પરમાં ભળી જતાં ઘણાએક તત્ત્વોનો બનેલો છે. માણસમાં હુમેશાં એક સંરક્ષણ વૃત્તિ કામ કરે છે, ચેતનાનું સાતત્ય જ્ઞાનવી રાખવાને માટે આત્મ-રક્ષણ કરવાની માણસને હુમેશાં હન્તેજરી રહે છે. એ હન્તેજરી તેને હરેક અજાણી વસ્તુ તરફથી પાછો ઘડેલી મૂકે છે. કોઈ આણધારી અને ગાણતરી બહારની વસ્તુ આવી પડતાં માણસ બેચેની અનુભવવા લાગે છે. અને કદાચ આ બધાની પાછળ, માણસના છેક શરીરના કોષોનાં ઊડાણમાં એ સહજવૃત્તિ પણ છુપાઈ રહેલી હોય છે કે મૃત્યુ એ કોઈ અપરિહૃદ્ય વસ્તુ નથી, જો અમુક શરતો પૂરી કરી શકાય તો મૃત્યુને જીતી પણ શકાય છે. આ બધાં તત્ત્વો પરસ્પર ભળી જઈને આપણામાં ભયનું સર્જન કરે છે. જો કે, ખરી વાત તો એ છે કે આ બધી વસ્તુઓ ઉપર વિજય મેળવવામાં ભય પોતે જ એક મોટું વિઘ્ન બની રહે છે. કેમ કે આપણે માત્ર તે જ વસ્તુને જીતી શકીએ કે જેનો આપણાને ભય ન લાગતો હોય. અને એ રીતે જોતાં જે માણસને મૃત્યુનો ભય લાગતો હોય છે તેના ઉપર મૃત્યુએ ક્યારનો યે વિજય મેળવી લીધો હોય છે.

તો આ ભયમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય? એ મુક્તિ મેળવવા માટે આપણે કેટલીક પદ્ધતિઓ અખત્યાર કરી શકીએ છીએ. પરંતુ આ વિષયના વિચારમાં ઊતરીએ તે પહેલાં આ મહા પુરુષાર્થમાં આપણાને મદદ રૂપ થઈ પે તેવા કેટલાક મૂળભૂત વિચારો આપણી નજર સમક્ષ આપણે રાખીશું. આપણે સૌથી પ્રથમ તો એ જાણવું જોઈએ કે જીવન એ એક અખંડ પદાર્થ છે, અમર વસ્તુ છે. આ એક અત્યંત મહત્વાનું જ્ઞાન છે. જે નાશ પામે છે તે તો રૂપો છે. આ અખંડ એકરૂપ જીવનતત્ત્વે જગતમાં અનંત રૂપો ધારણ કરેલાં છે અને એ રૂપોમાં ક્ષાણિકતા અને લંગુરતા રહેલી છે. આપણા મનમાં આ જ્ઞાન આપણે બરાબર સુદૃઢ રીતે

હમેશાને માટે સ્થાપિત કરી લેવું જોઈએ અને આપણી ચેતનાને આ સર્વ રૂપોથી સ્વતંત્ર રહેનાર છીતાં એ રૂપો દ્વારા પોતાનો આવિર્ભાવ કરતા પેલા શાશ્વત જીવન સાથે આપણાથી બને તેટલી એકરૂપ કરી લેવી જોઈએ. આપણામાં આ જીવન સ્થિર થઈ જતાં આપણને એક અત્યંત આવશ્યક એવી માનસિક ભૂમિકા પ્રાપ્ત થાય છે, અને એ ભૂમિકા ઉપરથી આપણે આ પ્રશ્નનો સામનો કરવાનો છે, કેમ કે એ પ્રશ્નનું અસ્તિત્વ પણ એ મનોમય ભૂમિકામાં જ છે. આપણી આંતર ચેતના ભય માત્રથી પર થઈ જવાય એટલો પ્રકાશ પામી ગઈ હોય તો પણ આ ભય આપણા શરીરના કોષોની અંદર જઈને પણ સંતાઈ રહેતો હોય છે. ત્યાં, શરીરના કોષોમાં તે એક અસ્પષ્ટ રૂપે પડી રહે છે, આપણી બુદ્ધિની નજર ચુકાવીને તે આપોઆપ જ પોતાની કિયા કરતો રહે છે. એની કિયાઓ ઘણી વાર તે લગભગ અચેતન રીતની જ હોય છે. આ અંધારા ઊંડાણોમાંથી આપણે આ ભયને શોધી કાઢી તેને પકડમાં લેવાનો છે. અને તેના ઉપર ચૈતન્યનો તથા અટલ શ્રદ્ધાનો પ્રકાશ નાખવાનો છે.

આ રીતે ત્યારે જીવન પોતે તો કદ્દી મૃત્યુ પામવનું નથી, માત્ર તેનાં બાધ્ય રૂપોનું જ વિસર્જન થાય છે. આપણી સ્થૂલ ચેતના આ રૂપોના વિસર્જનનથી ઉરે છે. પણ આપણે એ વાત ધ્યાનમાં રાખી શકીએ કે આ બાધ્ય રૂપ એ તો એક સતત બદલાતી વસ્તુ છે. તેમ જ એના આ સતત પરિવર્તનની કિયાને તમે હમેશાં પ્રગતિની દિશામાં જ ગતિ કરતી કરી શકો તો તે ગતિને પણ કોઈ અટકાવી શકે તેમ નથી. મૃત્યુની ઘટનાને તમારે અનિવાર્ય તરીકે મટાડવી હોય તો તે માટેનું એકમાત્ર સાધન તે આ જ છે: શરીરની પરિવર્તનની કિયાને તમે પ્રગતિશીલ રૂપની બનાવો. પરંતુ આવું પરિવર્તન સિદ્ધ કરવું એ એક અતિ કઠળ કાર્ય છે. એને માટે જે શરતો પૂરી થવી જોઈએ તે અલ્ય માણસો જ કરી શકે તેમ છે. આમ મૃત્યુના ભયને જીતવાની પદ્ધતિ પ્રત્યેક પરિસ્થિતિમાં, તેમ જ હરેક માણસની ચેતનાની અવસ્થા મુજબ જુદી જુદી રીતની રહેશે. આ બધી પદ્ધતિઓને ચાર મુખ્ય વિભાગમાં વહેંચી શકાય તેમ છે, વળી એ દરેક વિભાગમાં પણ પાછી બીજી ઘણી વિવિધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. જો કે ખરું જોતાં તો આ માટે દરેક માણસે પોતે જ પોતાની આગવી પદ્ધતિ ઉપજાવવાની રહે છે.

આ પદ્ધતિઓમાંથી પ્રથમ પદ્ધતિ આપણે બુદ્ધિ દ્વારા પ્રયોગ શકીએ છીએ. આપણી બુદ્ધિને તે સ્વીકાર્ય બને તેવી હોય છે. તમે કહી શકો છો કે અત્યારે જગત જે રીતનું છે તે જોતાં મૃત્યુ એ એક અનિવાર્ય જેવી ઘટના છે. જે શરીર જન્મ પામેલું છે તે કોઈ ને કોઈ દિવસ મૃત્યુ પામવાનું જ છે અને લગભગ દરેક માણસનું મૃત્યુ જે વખતે થવાનું હોય છે તે જ વખતે આવીને ઊભું રહેવાનું છે. તેના આગમનને તમે એક કાણ વહેલું કરી શકવાના નથી, તેમ જ એક કાણ પાછું

પાણ ઠેલી શકવાના નથી. કોઈને જલદી જલદી મરી જવું હોય છે તોપાણ તેણે મૃત્યુ માટે કેટલો યે વખત રાહ જોવી પડે છે અને કોઈને મરવું નથી હોતું, મરણનો પુષ્ટળ ઊર લાગતો હોય છે તોપાણ, તે માણસ મૃત્યુથી બચવા માટે ગમે તેટલી સાવચેતીઓ રાખે છે છતાં મૃત્યુનો પંજો તેના ઉપર એકાએક આગધાર્યો આવીને પડે જ છે. આમ હુરેક માણસના મૃત્યુની ઘડી જાણે કે અફર રીતે લખાઈ ચૂકેલી દેખાય છે. આમાં માત્ર જેમની પાસે સામાન્ય માણસના કરતાં કાંઈ વિશેષ અસાધારણ શક્તિઓ હોય છે તેવા વિરલ મનુષ્યો જ અપવાદ રૂપે હોઈ શકે છે. આ સ્થિતિમાં બુદ્ધિ આપણને એ વાત શીખવે છે કે જે વસ્તુને આપણે ખાણી શકતા નથી તેનાથી બીવું એનો કશો જ અર્થ નથી. માણસ પાસે તો માત્ર એક જ રસ્તો છે, અને તે એ કે મૃત્યુ થવાનું જ છે એ વિચારનો સ્વીકાર કરી લેવો અને ભવિષ્યમાં શું થવાનું છે તેની ચિંતા કર્યા વિના પોતે જે કાંઈ ઉત્તમ કાર્ય કરી શકે તે રોજ બ રોજ, ક્ષાણે ક્ષાણે શાંતિથી કર્યે જવું. જે બુદ્ધિ-પ્રધાન માણસો બુદ્ધિના નિયમો પ્રમાણે વર્તન કરવાને ટેવાયેલા હોય છે તેમને માટે આ પદ્ધતિ બહુ જ અસરકારક નીવડે તેવી છે. પરંતુ જે લોકો લાગણી-પ્રધાન છે, લાગણીઓમાં અને લાગણીઓના કાબૂ હેઠળ જ જીવતા હોય છે તેમને માટે આ પદ્ધતિ એટલી બધી અસરકારક નીવડશે નહિ. આવા લોકોએ પછી બીજી પદ્ધતિનો આશ્રય લેવો જોઈએ.

આ બીજી પદ્ધતિ તે આંતર નિરીક્ષણની પદ્ધતિ છે. આપણી સર્વ લાગણીઓથી ઉપર, આપણા સ્વરૂપનાં નીરવ અને શાંત ઊંડાણોમાં એક પ્રકાશ અખંડ પ્રકાશમાન બેઠેલો છે. એ છે અંતરાત્માની ચેતનાનો — ચૈત્ય ચેતનાનો પ્રકાશ. આ પ્રકાશની શોધમાં નીકળો, એના ઉપર એકાગ્રતા સાધો. તમારી અંદર એ બેઠેલો છે, તમે બરાબર ખંતીલા સંકલ્પથી મંચા રહેશો તો અવસ્થ એ તમને મળી આવશે. એ પ્રકાશમાં દાખલ થતાં વેંત જ તમારામાં અમૃતત્વનું ભાન જાગૃત થશે. તમને લાગશે કે તમે હુમેશાં જીવતા રહેલા છો અને સદા એ જીવંત રહેવાના છો. આ જ્ઞાન થતાં તમે હુવે તમારા શરીરથી સંપૂર્ણ સ્વતંત્ર બની રહો છો. તમારું સચેતન જીવન હુવે તમારા શરીર ઉપર આધાર નથી રાખતું. તમે જુઓ છો કે તમે તો અનેક શરીરો મારફતે તમારો આવિભાવ કરતા રહેલા છો અને તમારું આ શરીર તે એ અનેક નાશવંત શરીરમાંનું એક છે. મૃત્યુ એ હુવે કોઈ શૂન્યમાં લય નથી, એ તો માત્ર એક અવસ્થાની છે. આ જ્ઞાન થતાં વેંત જ ભય અદૃષ્ટ થઈ જાય છે અને તમે મુક્ત મનુષ્ય બનીને, એ મુક્તિનો સ્વર્ણ વિશ્વાસ ધારણ કરીને જીવનમાં આગેકૂચ કરવા લાગો છો.

ત્રીજી પદ્ધતિ તે શ્રદ્ધાનો માર્ગ છે. જે લોકોને પ્રભુમાં શ્રદ્ધા હોય છે, પોતાના

ઇછ દેવને ચરણે જેમણે પોતાનું સમસ્ત જીવન અર્પણ કરી દીધું હોય છે તેવા લોકો આ પદ્ધતિનો આશ્રય લઈ શકે છે. આવા ભક્તો તે પૂર્ણપૂરા પ્રભુના જ બની ગયેલા હોય છે. તેમના જીવનમાં બનતી સર્વ ઘટનાઓ તે પ્રભુના હિવ્ય સંકલ્પનો જ આવિર્ભાવ હોય છે. એ ઘટનાઓને તેઓ એક શાંતિમય સમર્પણપૂર્વક સ્વીકારી લે છે, એટલું જ નહિ પણ તે બદલ તેઓ એક ફુતક્ષે ભાવ પણ અનુભવે છે. કેમ કે એ લોકોને તો એ શ્રદ્ધા બેસી ચૂકી હોય છે કે પોતાના જીવનમાં જે જે કાંઈ બને છે તે તેમના ભલાને ખાતર જ બનતું હોય છે. આવા મનુષ્યોને પોતાના પ્રભુમાં, એ પ્રભુ સાથેના અંગત સંબંધમાં એક ગૂઢ વિશ્વાસ હોય છે. એમણે પોતાની સંકલ્પશક્તિને સંપૂર્ણપણે પ્રભુની સંકલ્પશક્તિના હાથમાં સૌંપી દીવેલી હોય છે અને પોતાને જીવન રૂપી કે મૃત્યુ રૂપી ભલે ગમે તેટલા અકસ્માતો પ્રાપ્ત થતા રહે તો પણ તેઓને પ્રભુના અવિકારી પ્રેમનો તથા સતત રક્ષણનો અનુભવ થતો રહે છે. તેમને એ એક અખંડ અનુભૂતિ રહેતી હોય છે કે પોતે પોતાના પ્રિયતમનાં ચરણોમાં પૂર્ણ સમર્પણપૂર્વક વસી રહેલા છે, એ પ્રિયતમના બાહુમાં લપાઈ રહેલા છે અને ત્યાં તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. તેમની ચેતનામાં હવે ભયને, ચિંતાને કે દુઃખને લેશ પણ સ્થાન હોતું નથી. તેમનામાંથી એ બધી વસ્તુઓ ચાલી ગયેલી હોય છે અને એક સ્વસ્થ અને પ્રસન્ન આનંદમયતા તેમનામાં આવેલી હોય છે.

પરંતુ આવા પરમ ભક્ત બનવાનું સદ્ગ્રામ હુરેક માણસનું નથી હોતું.

અને હવે આપણે છેલ્લી પદ્ધતિ જોઈએ. એ છે સંગ્રામની પદ્ધતિ, અને જે જન્મથી જ યોગ્ય હોય તેવાને માટે જ તે કામની છે. આવા મનુષ્યો જીવનને છે તેવું ને તેવું સ્વીકારી શકતા નથી. પોતે અમૃતત્વને મેળવવાને જન્મેલા છે, એક પૂર્ણ અમૃતત્વને અને તે આ પૃથ્વી ઉપર, આ વાત તેમની નસોમાં ધબકી રહેલી હોય છે. એમનામાં એક પ્રકારનું એવું સહજ જ્ઞાન હોય છે કે મૃત્યુ એ તો આપણાને પહેલી એક ખોટી ટેવ છે અને તેને જીતવાનો નિશ્ચય કરીને તેઓ જન્મેલા લાગે છે. પરંતુ આ વિજય મેળવવો એ એક મહા વિષમ કાર્ય છે. એ માટે એક ઘણા ઉગ્ર અને સૂક્ષ્મ પ્રકારના શત્રુઓની સેના સામે ભરણતોલ જંગ ખેલવાનો રહે છે. અને આ જંગ તે સતત, કહો કે હરપળે ખેલવાનો રહે છે. જેનામાં કોઈ મહુાન અદ્ભુત આત્મા આવેલો હોય તેવા માણસે જ આ જંગ માટેનું બીજું ઝડપવું જોઈએ. આ યુદ્ધ અનેક મોરચાઓ ઉપર તેમ જ જુદી જુદી ભૂમિકાઓ ઉપર ખેલાતું હોય છે, અને એ ભૂમિકાઓ એકબીજામાં ભળી જતી હોય છે, તેમ જ એકબીજાની પૂરક પણ હોય છે.

આ પદ્ધતિમાં આપણે જે પ્રથમ લડાઈ ખેલવાની આવે છે તે પોતે જ એક

મહા ભીષણ લડાઈ છે. એ લડાઈ આપણા મને જગતમાં પહેલા એક પ્રચંડ સૂચન સામે ખેડવાની છે. એ સૂચન આખા યે માનવસમુદ્દાયમાં વ્યાપી રહેલું છે, એ સૂચન મહા પ્રચંડ છે, મહાકાય છે, દુર્ધિં છે, માણસને ગુંગળાવી નાખે તેવું, વિવશ કરી નાખે તેવું છે. માનવજાતિના હજારો વર્ષોના અનુભવમાંથી તેનો જન્મ થયેલો છે. કુદરતના એક એવા નિયમને આધારે તે સરજાયું છે કે જે નિયમમાં હજુ સુધી કોઈ અપવાદ બનતો દેખાયો નથી. એ સૂચન પોતાની વાત આ રીતે ભારપૂર્વક રજૂ કરે છે: જુઓ ભાઈ, આ વાત તો હમેશાં બનતી જ આવેલી છે. એમાં કાંઈ મીનમેખ થઈ શકે તેમ જ નથી. મૃત્યુ તો એક અનિવાર્ય ઘટના છે, અને એની અનિવાર્યતાને તમે મટાડી શકો એવી આશા રાખવી એ તો ગાંડપણ છે. આ રીતનો સૂર આખું યે જગત એક મતે કાઢી રહેલું છે. આજ સુધીના આપણા કોઈ મહાનમાં મહાન વિદ્ધાને પણ આની સામે વિરોધનો સૂર ઉચ્ચાર્યો નથી કે ભાવિ માટે કોઈ આશા ઉદ્ગારી નથી. જગતના ધર્મોમાંથી તો ધણાખરાએ મૃત્યુની હડીકતના આધાર ઉપર જ પોતાની બધી શક્તિ વિકસાવેલી છે. ધર્મો તો એમ જ કહેતા રહેલા છે કે માણસને પ્રભુએ મર્ત્ય બનાવેલો છે, અને એટલે માણસ મૃત્યુ પામે એ પ્રભુની જ ઈચ્છા છે. ધણા ધર્મો તો મૃત્યુને મુક્તિના અને મોક્ષના દ્વારા તરીકે પણ વણિયે છે, અને કોઈ વાર તો મૃત્યુ ઈનામ રૂપે પણ મળે છે એમ સમજાવે છે. એમનો આદેશ તો આ રીતે આવે છે કે, હે માનવ, પરમાત્માની ઈચ્છાને તું મસ્તક નમાવીને સ્વીકારી લે. લેશ પણ વિરોધ કર્યા વિના મૃત્યુના વિચારને અંગીકાર કરી લે. અને તને શાંતિ અને સુખ મળશે. પરંતુ આ બધાં સૂચનોની સામે લડી લઈને આપણા મને પોતાને થયેલી અમૃતત્વની પ્રતીતિમાં અવિયલ રહેવાનું છે અને એક મહા અણનમ સંકલ્પશક્તિ ટકાવી રાખવાની છે. જે મનુષ્ય મૃત્યુને જીતવાનો નિશ્ચય કરે છે તેના ઉપર આવાં સૂચનોની કશી અસર થતી નથી, પોતાને મળેલા ગંભીર આંતર દર્શનમાંથી તેનામાં જે અવિયલ શ્રદ્ધા બંધાઈ હોય છે તે શ્રદ્ધાને આવાં સૂચનો કશી આંચ લગાડી શકતાં નથી.

બીજુ લડાઈ તે લાગણીઓના મોરચા પર લડવાની છે. જીવનમાં આપણે જે જે વસ્તુઓ સર્જેલી છે, જે જે વસ્તુને આપણે ચાહેલી છે તે સર્વ પ્રત્યેની આપણી સારી યે આસક્તિ સામે આ લડાઈ છે. જીવનમાં મહા મહેનતે, અથવા કદીક તો કોઈ પ્રચંડ પુરુષાર્થને પરિણામે તમે તમારું ઘર સર્જ્યુ હોય છે, તમારી કારકિર્દી બાંધી હોય છે, સમાજમાં, સાહિત્યમાં, કળામાં, વિજ્ઞાનમાં કે રાજકારણમાં તમે ધણું ધણું કાર્ય કર્યું હોય છે. તમારી આસપાસ તમે સગાંસ્નેહીઓનું, મિત્રોનું, સાથીદારોનું, એક આખું મંડળ બેગું કર્યું હોય છે, અને તેના કેન્દ્ર રૂપે તમે વિરાજતા હો છો. તમારા જીવનનો

તમે વિચાર કરો છો ત્યારે તમને જણાય છે કે તમારા ચિત્તંત્રમાં જેટલા તમે પોતે રમતા હો છો તેટલાં જ આ બધાં પણ રમતાં હોય છે. એ બધાંને જો તમારી પાસેથી હૃટાવી લેવામાં આવે તો તમે જોશો કે તમે જાણો સાવ શૂચ બની ગયા છો, જાણો કે તમારા પોતાના સ્વરૂપનો જ એક અત્યંત અગત્યનો અંશ અદૃષ્ટ બની ગયો છે.

તમારે આ બધી વસ્તુઓ તજી દેવી જોઈએ એવો તો કોઈ પ્રશ્ન નથી. કારણ કે એ બધામાંથી તો, અથવા કાંઈ નહિ તો એમાંની મોટા ભાગમાંની વસ્તુઓમાંથી તો તમારા જીવનની ભૂમિકા બંધાયેલી છે. આ બધું તો તમારા જીવનના એક લક્ષ્ય તરીકે, ધ્યેય તરીકે રહેલું છે. આમાં જે તજવાનું છે તે તો આ વસ્તુઓ પ્રત્યેની આસક્તિ ચાલી જતાં તમે જોશો કે તમારામાં એ વસ્તુઓ વિના પણ જીવન ગાળવાની શક્તિ ઉદ્ય પામે છે, અથવા તો આ બધાં જો તમને મૂકીને ચાલ્યાં જાય તો તમે બધા સંયોગો હેઠળ પણ તમારા માટે એક નવું જીવન ફરીથી ઊભું કરી શકો છો, અને જીવનનું આવું નવવિધાન તમે હુરહુમેશ કરતા રહી શકશો. આ છે અમૃતત્વની ગ્રાપિતનું પરિણામ. આ એક એવી અવસ્થા હોય છે કે જેમાં તમે હરકોઈ વસ્તુ ખૂબ જ કાળજીપૂર્વક, ધ્યાનપૂર્વક પ્રયોજિત કરી શકો છો, અમલમાં લાવી શકો છો અને છતાં તે વસ્તુ અંગેની કામના અને આસક્તિમાંથી તમે મુક્ત રહી શકો છો અને આ વસ્તુ જ ખાસ મહત્વની છે. તમારે જો મૃત્યુમાંથી મુક્ત રહેવું હોય તો પછી કોઈ પણ નાશવંત વસ્તુની અંદર તમે તમારી જાતને બંધાઈ જવા ન જ દઈ શકો.

લાગણીઓ પછી આવે છે સંવેદનોનો પ્રશ્ન. આ મોરચા પરનો જંગ તો ખરેખર ભયંકર છે. તમારી સામેના શત્રુઓ પણ અહીં મહા બળવાન છે. તમારી નાનામાં નાની નબળાઈઓ આ શત્રુની જાણમાં હોય છે અને તમારો જે કોઈ ભાગ ખુલ્લો અરક્ષિત પેડ્લો હોય છે ત્યાં ત્યાં તેઓ પ્રદ્દાર કરતા જ રહે છે. આ મોરચા ઉપર તમે કોઈ વિજય મેળવો તોપણ તે ક્ષણિક પ્રકારનો જ વિજય નીવડે છે. અહીં તમારે એકની એક લડાઈ અનેક વાર, અનંત કાળ સુધી લડવાની રહે છે. તમે જે શત્રુને જિતી લીધેલો ગણતા હો છો તે જ શત્રુ ફરી ફરીને પાછો ઊભો થાય છે અને તમારા પર હુમલા કરતો રહે છે. તમે જોશો કે આ પૃથ્વી ઉપર બની રહેલા બનાવો, જીવનમાં તમને થતા રોજ-રોજના અનુભવો એ બધું તમારાથી હુમેશ વિરોધમાં જ જતું રહે છે ત્યારે તમારા ઉપર અતિશય જ્વાનિ ચડી આવે છે, તમારો ઉત્સાહ ઓસરી જાય છે, જગત તમને સતત જાકારો આપતું રહે છે, તમને નિરાશા અને પરાજય મળતાં રહે છે. આ બધામાંથી પસાર થવા માટે તમારી પાસે એક પ્રચંડ ચારિત્યબળ હોવું જોઈશે, તમારામાં એક

આગથક સહનશક્તિ, અપાર તિતિક્ષા હોવી જોઈશે.

અને આપણે હુવે આ સંગ્રામના સૌથી ભીષણ મોરચા પર આવીએ છીએ. એ છે જડતત્ત્વ સાથેની લડાઈ. આ લડાઈ આપણા શરીરની અંદર જ ખેલાઈ રહેલી છે. એ જંગ લેશ પણ વિરામ વિના, સુલેહના નામ પણ વિના ભયંકર રીતે ખેલાઈ રહેલો છે. માણસનો જન્મ થવાની સાથે જ એ લડાઈ શરૂ થઈ જાય છે, અને એ લડાઈના બે પક્ષોમાંથી કોઈ એકનો — રૂપાંતર વિધાયક શક્તિ અને વિસર્જનકારક શક્તિ એ બેમાંથી કોઈ એકનો — પરાજય થાય ત્યારે જ તેનો અંત આવી શકે છે. હું કહી ગઈ કે આ લડાઈ જન્મની સાથે જ શરૂ થઈ જાય છે, કારણ કે હુકીકત એ છે કે આ સર્જક અને વિસર્જક શક્તિઓ તમે જગતમાં પ્રવેશ કરો છો તે જ ક્ષણેથી તમારામાં લડવા લાગી જાય છે. હા, આ સંગ્રામ સભાન અને સજ્ઞાન રીતે તો બહુ મોડેથી ખેલાવા લાગે છે. માણસના શરીરમાં જે જે કાંઈ અસ્વસ્થતા, બીમારી, વિકૃતિઓ, અક્સમાતો આવે છે તે બધું ખરું જોતાં આ વિસર્જક શક્તિની કિયાનું જ પરિણામ હોય છે. અને એથી ઉલંઘું, આપણા શરીરમાં ચાલી રહેલી વૃદ્ધિની કિયા, શરીરનો સુમેળખ્યો વિકાસ, વિરોધી શક્તિઓનો સામનો, રોગનું નિવારણ, બગડેલી શારીરિક કિયાઓ પાછી નૈસર્જિક અવસ્થામાં આવી જવી, અને આમ પ્રગતિની દિશામાં લઈ જતા હરેક પ્રકારના સુધારા એ બધું પેલી રૂપાંતર વિધાયક શક્તિની કિયાનું જ પરિણામ છે. આગળ જતાં, તમારા જીવનમાં જ્યારે ચેતનાનો વિકાસ થાય છે ત્યારે આ લડાઈ વધારે સભાન રીતનું સ્વરૂપ લે છે. આ બે વિરોધી શક્તિઓ વચ્ચે જીવસ્ટોસટની હરીફાઈ શરૂ થઈ જાય છે. આ બેમાં કઈ શક્તિ, રૂપાંતરક શક્તિ કે મૃત્યુની શક્તિ શરતને છેડે પહેલી પહોંચી જાય છે અને પોતાનું ધ્યેય સર કરી લે છે તેની તીવ્ર સ્પર્ધા જામે છે. અને આ એક અખંડ જહેમતનું કામ બની રહે છે. તમારે પુનર્જીવનની શક્તિને નીચે લઈ આવવા માટે, એ શક્તિને તમારા શરીરના કોષોમાં ધારણ કરવાની શક્તિમાં વૃદ્ધિ કરવા માટે એક સતત એકાગ્રતા સાધવાની રહે છે. વિનાશ અને વિસર્જનનાં બળોની મહા વિનાશક કિયાની સામે તમારે કદમે કદમે, એક એક બિંદુ પર, લડાઈ આપવાની રહે છે. વળી, આ ઊર્ધ્વની ગતિ માટે તૈયાર હોય તેવી સર્વ વસ્તુઓને તમારે આ વિનાશક શક્તિની પકડમાંથી મુક્ત કરી લેવાની રહે છે. એ બધાની અંદર તમારે પ્રકાશ મૂકવાનો રહે છે, તેમને વિશુદ્ધ અને સુદૂર કરવાની રહે છે. આમ આ એક અંધારામાં ખેલાઈ રહેલો મહા જિદી સંગ્રામ છે. ધર્મી વાર તો અનું કોઈ જ પરિણામ દેખીતી રીતે નજરમાં આવતું નથી. તમને થોડોધણો વિજય મજયો હોય તોપણ તેનું કોઈ બાધ્ય ચિહ્ન જોવામાં આવતું નથી, વિજય થવાનો જ છે એવી કશી ખાતરી વરતાતી નથી.

કેમ કે આ આખી યે વસ્તુ તમારે ફરીને કર્યે જવાની રહે છે. તમે એક સ્થળે એક કદમ આગળ વધો છો તો બીજે સ્થળે તમારે માટે કોઈ પીછેહું ઊભેલી જ હોય છે. આજનું કરેલું કામ આવતી કાલે હતું ન હતું થઈ જાય છે. અર્થાત, આપણાને આખરી વિજય મળી ચૂક્યો છે, પાકો અને હમેશાને માટે, એમ તો જ્યારે આખો યે સંગ્રામ પૂરેપૂરો જિતાઈ જાય ત્યારે જ કહી શકાય તેમ છે. અને આ બધું થતાં સમય લાગે છે, ઘણો સમય લાગે છે. વરસ પર વરસ, એક પછી એક, અવિરામ, વહિંા જ જાય છે અને સાથે સાથે વિરોધી શક્તિઓનું બળ પણ વધ્યે જાય છે.

આ આખી યે લડાઈ દરમિયાન ચેતના, ખાઈમાં ઊભેલા પહેરેગીરની માફક ખે પગે ઊભી રહે છે. તમારે મોરચા પર ગમે તે ભોગે અચલ અને અડગ ટકી રહેવાનું છે. એક પણ રૂંવું ફરકવા દીધા વિના, નિર્ભયપણે, ક્ષાણ પણ અસાવધ થયા વિના તમારે ઝૂઝ્યે જવાનું છે. તમારા ધ્યેયમાંથી તમારી શ્રદ્ધા લેશ પણ ચલિત થવા દેવાની નથી. ઊર્ધ્વમાંથી આવી તમને પ્રેરતી અને ટકાવતી સહાયમાં અવિચલ વિશ્વાસ રાખવાનો છે. લડાઈમાં જે વધુમાં વધુ સમય ટક્કર જીલી શકે છે તેને જ વિજય વરે છે.

મૃત્યુના ભયને જીતવાનો આ ઉપરાંત એક બીજો માર્ગ પણ છે. પરંતુ એ માર્ગ બહુ ઓછા માણસોને સુલભ હોઈ અહીં તેનો ઉલ્લેખ માત્ર એક માહિતી રૂપે કરી લઈએ છીએ. એમાં તમે જીવનમાં હો તે દરમિયાન જ સભાન રીતે અને સશાન રીતે મૃત્યુના પ્રદેશમાં દાખલ થાઓ છો અને ત્યાં જઈ આવીને પાછા સ્થૂલ શરીરમાં પાછા ફરો છો, એ શરીરમાં આવી જાઓ છો અને પૂરી સમજપૂર્વક સ્થૂલ જીવનમાં ગતિ કરવા લાગો છો. પરંતુ આ કાર્ય આદરવા માટે તો માણસે દીક્ષા મેળવવાની રહે છે.

(બુલેટિન, કેન્દ્રીય માનુષની માર્ગસ્રણ કાર્યક્રમ, જુન ૧૯૫૪)

\*

## (મૃત્યુના ભયને જીતવાનાં સાધનોના લેખમાં આવેલા છેલ્લા ફકરામાંથી જન્મેલા પ્રશ્નોનો ઉત્તર)

આ બધા પ્રશ્નોને એક જ પ્રક્ષેપણમાં સમાવી શકાય છે: નિર્ભય બનીને તમે મૃત્યુનો સામનો કરી શકો એવી શક્તિ આપનારું આ જ્ઞાન કિંવા સાધના તે શું છે?

આ જ્ઞાનની પદ્ધતિ વિષે અત્યાર સુધી કશું કહેવામાં આવ્યું નથી. એ પદ્ધતિ જ્ઞાનની જ નહિ પણ કાર્યસિદ્ધ માટેની પણ એક પદ્ધતિ છે. એને માટે કાંઈ પણ ન કહેવાનું કારણ એ છે કે આ વિદ્યાનો અભ્યાસ તથા તેનો પ્રયોગ હરેક માણસના હાથમાં સોંપી શકાય તેમ નથી. આપણે ગુહ્ય વસ્તુઓ વિષે વાતો કરીએ એનો કાંઈ અર્થ નથી. આ વસ્તુઓ તો અનુભવ માટેની છે. એને એ અનુભવ મેળવવા માટે તમારામાં ખાસ શક્તિઓની જરૂર રહે છે, તમારો માનસિક વિકાસ પણ અમુક કક્ષા સુધીનો હોવો જોઈએ. પણ એ શક્તિઓ અને એવો વિકાસ બહુ અદ્ય લોકોમાં હોય છે. બીજું વળી એ પણ છે કે આ એક વૈજ્ઞાનિક ટબનું જ્ઞાન છે એ વાત આજના જગતમાં ભાયે જ કોઈ સ્વીકારે છે. પરંતુ આ જ્ઞાન ખરેખર એક વૈજ્ઞાનિક પ્રકારનું જ જ્ઞાન છે. કોઈ પણ વિદ્યાએ વિજ્ઞાન થવા માટે જે જે શરતો પૂરી પાડવાની જરૂર હોય છે તે બધી જ શરતો આ વિદ્યા પૂરી પાડે છે. આ જ્ઞાન અમુક ચોક્કસ સિદ્ધાંતોની આસપાસ રચવામાં આવેલું છે. અમુક ચોક્કસ પ્રક્રિયાઓ પ્રમાણે એ કામ કરે છે, એને તમે જો અમુક પરિસ્થિતિ બરાબર ચોક્કસ રીતે ઊભી કરી શકો તો તેનાં અમુક પરિણામો પણ હમેશાં અચૂક આવતાં રહે છે. વળી એ જ્ઞાન ક્રમે ક્રમે વિકાસ પણ પામતું રહે છે. આજના કોઈ પણ સ્વીકારાયેલા વિજ્ઞાનની માફક એનો પણ તમે એકાગ્ર રીતે અભ્યાસ કરી શકો છો, તેને પદ્ધતિસર તથા બુદ્ધિપુરઃસર વિકસાવી શકો છો. પરંતુ આ વિદ્યાની ખાસ વિશેષતા એ છે કે એના અભ્યાસ માટે તમારે આ નર્યા સ્થૂલ જગતની વાસ્તવિકતાઓ કરતાં એક જુદા જ પ્રકારની વાસ્તવિકતાઓમાં જઈને કામ કરવાનું રહે છે. એ વિદ્યાને ભાણવા માટે તમારી પાસે ખાસ ઈન્ડ્રિયો હોવી જરૂરની છે, કેમ કે આ વિદ્યા સામાન્ય ઈન્ડ્રિયોના પ્રદેશથી એક ઉપરના પ્રદેશમાં કામ કરે છે. આ ખાસ ઈન્ડ્રિયો માણસમાં રહેલી તો છે જ, પણ તે ગુપ્ત રીતે. આપણા સ્થૂલ શરીરની માફક આપણને બીજાં વધુ સૂક્ષ્મ શરીરો પણ છે. એ શરીરોને પોતાની ઈન્ડ્રિયો પણ છે, પણ એ ઈન્ડ્રિયો ઘણી વધુ સૂક્ષ્મ છે, વધુ ચોક્કસ છે, તેમ જ આ સ્થૂલ ઈન્ડ્રિયો કરતાં તેમનું સામર્થ્ય પણ અનેકગારું છે. આપણી કેળવાણી આ બાબતમાં કાંઈ જ જાણતી નથી હોતી એટલે આપણામાં આ ઈન્ડ્રિયોનો કોઈ વિકાસ ન થયો હોય તો તે સ્વાત્માવિક જ

છે. અને એટલે આ ઇન્ડિયોના પ્રદેશો આપણી ચેતનાથી બહાર જ રહી ગયેલા છે. આમ છતાં તમે જોશો કે બાળકો આ પ્રદેશમાં આપોઆપ પહોંચી શકે છે અને ત્યાં કેટલો ય વખત રહે છે. બાળકોને કેટલીયે સૂક્ષ્મ વસ્તુઓ દેખાતી હોય છે અને આપણી આ સ્થ્યલુલ વસ્તુઓ જેવી જ તેમને માટે તે તદ્દન સાચી હોય છે. બાળકો એ વિષે વાતો પણ કરતાં હોય છે, પણ એ સાંભળી આપણે તેમને ઘણુંખરું તો જૂઠાં અને અક્કલ વગરનાં જ ગણી કાઢીએ છીએ. એ કોઈ એવી વસ્તુની વાત કરતાં હોય છે કે જે આપણને દેખાતી નથી પણ તેમને માટે તો તે આ બીજી વસ્તુઓના જેટલી જ સાચી, સ્પર્શક્ષિમ અને વાસ્તવિક હોય છે. તમે જોશો કે બાળકોને સ્વખન આવતાં હોય છે, ઊંઘમાં કે પછી જાગતાં જાગતાં પણ, તે ઘણી વાર બહુ જ તાદૃશ હોય છે, અને બાળકના જીવનમાં એ સ્વખન બહુ જ મહત્વનો ભાગ ભજવતાં રહે છે. બાળકની આ શક્તિ તેનામાં મનનો વિકાસ બહુ વધી પડ્યા પછી ઝાંખી થઈ જાય છે અને ઘણે ભાગે તે પછી જતી જ રહે છે, પણ કેટલાક માણસોને આવી આંતરિક ઇન્ડિયો જન્મની સાથે જ મળેલી હોય છે, અને એમના જીવનમાં એ ટકી રહી શકે છે તેમ જ વિકાસ પણ પામી શકે છે. આવા લોકોને ભાગ્યશાળી જ ગણવા જોઈએ. આવા માણસને જો કોઈ એવી વ્યક્તિનો વેળાસર બેટો થઈ જાય કે જેને આ વિષયની જાણ હોય તેમ જ એ સૂક્ષ્મ ઇન્ડિયોને કેળવવામાં તે પદ્ધતિસર મદદ કરી શકે તેમ હોય તો પછી એવા માણસો ગુહ્ય જગતોનું સંશોધન તેમ જ શોધખોળ કરવાના કાર્યમાં બહુ રસિક કરણ તરીકેનો ભાગ ભજવી શકે છે.

આ વિદ્યાની એક પરંપરા ઘણા જ પ્રાચીન સમયથી ચાલતી આવેલી છે, અને એ વિદ્યાનું રક્ષણ કરનારી છૂટીછવાઈ વ્યક્તિઓ અથવા તો નાનાં નાનાં જૂથો પૃથ્વી ઉપર બધા જ યુગોમાં હસ્તી ધરાવતાં રહેલાં છે. આ પરંપરામાંનું સત્ય આ લોકોને પણ પોતાની અનુભૂતિઓ દ્વારા પુષ્ટ બનતું જણાયેલું છે, અને તેઓ પોતે તેનો પ્રયોગ પણ કરતા રહેલા છે. આવા લોકો જગતમાં ખાસ શક્તિવાળા આત્માઓની તપાસમાં રહેતા અને એવા આત્મા મળી આવતાં તેમને જરૂરી તાલીમ પણ આપતા. આવાં જૂથો સામાન્ય રીતે તો ગૂઢ યા તો ગુપ્ત રીતે જ પોતાનું કામ કરતાં. સામાન્ય માણસોને આ જાતની શક્તિઓ તથા પ્રવૃત્તિઓની સમજણા ભાગ્યે જ પડતી હોય છે, એવી વસ્તુઓ તેમને ડર પેદા કરે છે અને પરિણામે તે વસ્તુઓનું અસ્તિત્વ તેઓ ભાગ્યે જ સહન કરી શકે છે. પરંતુ માનવજાતિના ઇતિહાસનાં અમુક મહાન યુગોમાં આ ગુહ્ય વિદ્યાની દીક્ષા આપનારી સંસ્થાઓ જાહેર રીતે હસ્તી ધરાવતી હતી અને સ્વીકાર પણ પામેલી હતી. પ્રાચીન ઇજિપ્તમાં, કેલિયા અને હિંદુમાં, તેમ જ થોડેક અંશે ગ્રીસ અને રોમમાં પણ, આ વિદ્યાની ખૂબ જ કદર તથા સન્માન થતું

હતું. મધ્ય યુગના યુરોપમાં પણ આ ગુહ્ય વિદ્યાનું શિક્ષણ આપતી સંસ્થાઓ હતી. પણ એમને પોતાનું અસ્તિત્વ બહુ સાવધાનીથી ગુપ્ત રાખવું પડતું હતું. એ વખતનો રાજ્યાંશિત કિશ્ચન ધર્મ એમનો પીછો પકડતો, તેમના પર ત્રાસ ગુજરતો. એ વખતે જો અમુક જાણ, ખ્રી કે પુરુષ આવી વિદ્યાનો પ્રયોગ કરે છે એવી અક્ષમાત ખબર પડી જતી તો તે વ્યક્તિને પકડીને, મેલી વિદ્યાની ગુનેગાર ઠરાવી તેને ચિત્તા પર ચડાવી જીવતી બાળી દેવામાં આવતી. આજે હવે આ વિદ્યા, લગભગ નાનાય થઈ ગઈ છે. બહુ જ થોડા પાસે એ ટકી રહી હશે. તો પણ એક લાભ એ થયો છે કે એ વિદ્યાના જવા સાથે એની સામેની અસહિષ્ણુતા પણ ચાલી ગઈ છે. હા, આજના ઘણાખરા કેળવાયેલા લોકોને આવી કોઈ વિદ્યા જ નથી, યા તો એ એક ખાલી કદ્યના છે કે પછી પ્રપંચ પણ છે એવી એવી વાતો કરવાનું ગમે છે ખરું. પણ એનું કારણ તો એ છે કે આમ કહીને લોકો પોતાનું અજ્ઞાન જ પોતાની આગળથી સંતાડવા માગતા હોય છે. એ લોકોને જો એમ સ્વીકારવું પડે કે અમારા કાબૂમાં ન આવે તેવી શક્તિઓ પણ જગતમાં છે તો એ વાત તેમને બેચેન કરી દે તેવી હોય છે અને એ લોકોને આવી બેચેની ખપતી નથી હોતી, પણ કેટલાક લોકો આ વિદ્યાનો ઈન્કાર નથી કરતા હોતા તો તેમને આ વસ્તુઓ ખાસ ગમતી પણ નથી હોતી, કેમ કે આવી ચીજો તેમને કોઈ ને કોઈ પ્રકારે મૂળજવતી રહે છે, પછવતી રહે છે. પણ આ લોકો એટલું તો કબૂલ કરે જ છે કે આમાં કોઈ ગુનો નથી. આજે હવે ગુહ્ય વિદ્યાનો પ્રયોગ કરનારને કોઈ જેલમાં પૂરતું નથી કે જીવતાં બાળી દેનું નથી. તો હવે વળી એક બીજી વાત બનવા લાગી છે. આ વિદ્યાને ગુપ્ત રાખવાની હવે જરૂર ન રહેતાં એને જાણવાનો દાવો કરનાર લોકો વધી પડ્યા છે! જો કે એના સાચા જાણકારો તો જૂજ જ છે. વળી સમાજમાં કેટલાક અવિચારી એને મહૃત્વાકાંક્ષી લોકો પણ છે એને તેઓ, આ ગુહ્ય વિદ્યા ઉપર પહેલાં રહસ્યમયતાનો જે પરદો ટળેલો રહેતો તે ગુમતાના વાતાવરણનો લાભ લઈને એ વિદ્યાના નામે લોકોને આંજવાનું તથા છેતરવાનું કામ કરતા રહે છે. પણ એ લોકોનો આ વિદ્યાના જ્ઞાનનો દાવો પોકળ જ હોય છે. એવા લોકોના ઉપરથી આ વિદ્યા વિષે આપણે કોઈ નિર્ણય ન બાંધવો જોઈએ. માણસ જાતની બધી જ પ્રવૃત્તિઓમાં આવા લેભાગુ અને ઢોંગી લોકો હોય છે જ. એવા ખોટી બધાઈ મારનાર લોકોના પ્રપંચને લીધે એક સાચા વિજ્ઞાન ઉપર ખોટું દોખારોપણ થવા પામવું ન જોઈએ.

આટલા જ કારણસર, અમુક મહાન યુગમાં જ્યારે આ વિદ્યા ખૂબ ખીલેલી હતી તથા તેનો અભ્યાસ કરાવવા માટે જાણીતી સંસ્થાઓ પણ હતી ત્યારે આ વિદ્યા ભાગવા માગનારની પાસે લાંબા સમય સુધી, કેટલીક વાર તો વરસો સુધી એક ઘણી જ કડક સાધના કરાવવામાં આવતી હતી. એ સાધના બે પ્રકારની રહેતી, આત્મ-

વિકાસની તથા આત્મ-સ્વામિત્વની. એ સાધના પૂરી થયા બાદ જ વિદ્યાર્થીને એ વિદ્યામાં પ્રવેશ મળતો. આ સાધનામાં બે વસ્તુઓ ખાસ નક્કી કરવામાં આવતી. એક તો વિદ્યા ભાણનારમાં કેટલી સત્યનિષ્ઠા છે, કેટલી નિઃસ્વાર્થવૃત્તિ છે, તેના હેતુની કેટલી શુદ્ધતા છે, તેનામાં પોતાની જતને ભૂલી જવાની, પોતાનું વિસર્જન કરવાની કેટલી શક્તિ છે, બલિદાન અને પરમાર્થની કેટલી ભાવના છે એ બાબતની શક્ય તેટલી ચોકસાઈ મેળવવામાં આવતી અને એ રીતે તેની અભીપ્સામાં રહેલી ઉર્ચ્યતા તથા ઉમદાપણાની એક પરીક્ષા થઈ જતી. આ ઉપરાંત બીજું એ જોવામાં આવતું કે આ વિષયનો અભ્યાસ કરવા માગનારમાં તે માટેની જરૂરી શક્તિઓ છે કે નહિ, એ વિદ્યાનો પ્રયોગ તે કોઈ પણ જોખમ વિના કરી શકશે કે નહિ. આ તપાસવા માટે તેને અનેક કસોટીઓમાંથી પસાર કરવામાં આવતો. એ અંગે ખાસ તો તેણે પોતાની વાસનાઓ તથા ઈચ્છાઓ ઉપર કેટલો કાબૂ મેળવેલો છે, તેનામાં કેટલી અચલ સ્વસ્થતા સ્થપાયેલી છે, અને સૌથી વિશેષ તો તેનામાં કેટલી સંપૂર્ણ નિર્ભયતા આવી ગયેલી છે એ બાબતોની કસોટી કરવામાં આવતી. આ વિદ્યા તો એક મોટા સાઝસ જેવી છે, અનાં જોખમોમાંથી તમારે નિર્વિઘ્નપણે, સલામત રહી આગળ વધવું હોય તો તમારામાંથી ભય માત્ર નિર્મળ થઈ જવો જોઈએ.

એક રીતે જોતાં આ વિદ્યા એક પ્રકારનું રસાયનશાસ્ત્ર – કેમિસ્ટ્રી જ છે. આ એક શક્તિઓની લીલાની કેમિસ્ટ્રી છે, સૃષ્ટિઓ બાંધવી, આંતરિક દિઝાનો (dimensions) માં વ્યક્તિમય રૂપો બાંધવાં એ એમાં આવે છે. અને જડતત્ત્વની કેમિસ્ટ્રીમાં અમુક પદાર્થો સાથે કામ લેવામાં જોખમ હોય છે તેવું જ આ સૂક્ષ્મ જગતોમાં પણ હોય છે, અહીં અમુક શક્તિઓ સાથે કામ લેવું, તેમના સંપર્કમાં આવવું એ વસ્તુઓ પણ જોખમભરેલી હોય છે. તમારા ચિત્તને તમે જો એકદમ શાંત રાખી શકો, કોઈ પણ બાબતથી તમે લેશ પણ ગભરાઓ નહિ એવી સ્વસ્થતા તમારામાં આવી ગઈ હોય તો જ તમે એ શક્તિઓ સાથે વિના જોખમે કામ પાડી શકો છો.

અને એક બીજી રીતે આ વિદ્યા સાધકને માટે અજાણ્યા દેશોની એક શોધખોળ અને તપાસણી જેવી બની રહે છે. એ પ્રદેશોના કાયદા અને વ્યવહાર જાણવા માટે તમારે ઘણી વાર મોંધું મૂલ્ય ચૂકવવું પડે છે. નવાસવા સાધકને માટે કેટલાક પ્રદેશો તો ભય ઉપજાવે તેવા પણ હોય છે. એમાં દાખલ થતાં સાધકને પોતાની ચોમેર નવાં નવાં, તદ્દન આશધાર્યા એવાં સંકટો ઝડૂમી રહેલાં દેખાય છે. પણ એમાંથી મોટા ભાગની વસ્તુઓ ખાલી કલ્પનાની જ હોય છે. તમે નીડર રહી જો તેમનો સામનો કરો તો તેમાંની દેખાતી વાસ્તવિકતા ઘણીખરી ઓગળી જાય છે.

પરંતુ આમાં એક વાત નક્કી છે. આ વિષયનો અભ્યાસ તમારે એના કોઈ પાકા

જાણકારની પાસે જ આરંભવો જોઈએ. આ રીતની સલાહ આ વિષયમાં હુમેશાં અપાતી રહી છે. અને આ તમારો ગુરુ એવો હોવો જોઈએ કે તમને તે આ વિષયનો માર્ગ બતાવી શકે, ભયની સામે, પછી તે ખોટા હોય કે સાચા, તમને ચેતાવી શકે અને જરૂર પેડે ત્યારે તમને રક્ષણ આપી શકે.

આ રીતે તમે હવે જોઈ શકશો કે આ વિજ્ઞાનને વિષે અહીં વધુ વિગતો આપવામાં મુશ્કેલી રહેલી છે. આ અંગે માત્ર એક જ વાત કહી શકાય કે આ વિદ્યામાં પ્રવેશ કરવા માટે તમારે એ વાત સ્વીકારવાની રહે છે કે આંતરિક જગતો, તત્ત્વોની અનેક અવસ્થાઓ, એ બધી એક મૂર્ત અને વાસ્તવિક બાબત છે. આ આખી યે વિદ્યા માટેનો અનિવાર્ય પાયો આ છે. અને આ વસ્તુ તે ચતુર-દિઝાનના કે પછી અનેક-દિઝાનના સિદ્ધાંતને તમારે ચૈતસિક ક્ષેત્રમાં લાગુ પાડવાની વાત બને છે.

તો છેવટે ગુધ્ય વિજ્ઞાનની વ્યાખ્યા આપણે આ રીતે બાંધીશું : આધ્યાત્મિક વિદ્યાઓ જે સત્યોનો બોધ કેવળ ચૈતસિક દૃષ્ટિબિંદુથી કરે છે તે સત્યોને ઝૂપોની સૃષ્ટિમાં એક મૂર્ત આકાર રૂપે નિર્માણ કરવા એ ગુધ્ય વિજ્ઞાનનું કાર્ય છે. જગતમાં આત્મ-વિકાસની તથા પૂર્ણ કર્મની સંપૂર્ણતા સિદ્ધ કરવા માટે આ બંને વિદ્યાઓએ એકબીજાનાં પૂરક બનવાનું રહે છે. આધ્યાત્મિક વિદ્યા વિનાની એકલી ગુધ્ય વિદ્યા જો અશુદ્ધ દાથમાં જઈ પડે છે તો તેના વાપરનાર માટે તેમ જ બીજાઓ માટે પણ તે એક ભયંકર દથિયાર બની જાય છે. અને આધ્યાત્મિક વિદ્યા સાથે જો ગુધ્ય વિજ્ઞાનનું જ્ઞાન જોડાયેલું નથી હોતું તો એ વિદ્યામાં ચોક્કસતા અને નિશ્ચિતતા નથી આવતી. એવી અધ્યાત્મ વિદ્યા ફક્ત આંતરિક જગતમાં જ સર્વશક્તિમાન બની શકે છે. આ બંને વિદ્યાઓને તમે જ્યારે ભેગી કરી શકો, પછી તે કોઈ બાધ પ્રવૃત્તિ માટે હો કે આંતર પ્રવૃત્તિ માટે, ત્યારે એ બે ય મળીને એક પ્રચંડ અને અવિરોધ એવી વસ્તુ બની રહે છે અને અતિમાનસ શક્તિના અવતરણ માટે તે એક સુયોગ્ય કરણ બની શકે છે.

(બુલેટિન, એપ્રિલ ૧૯૫૪)

\*

## એક સ્વર્પન

પૃથ્વી ઉપર ક્યાંક એક એવું સ્થળ હોવું જોઈએ કે જેના ઉપર કોઈ પણ રાષ્ટ્ર પોતાની માલિકીનો દાવો ન કરે. એવા સ્થાનમાં જગતના સર્વ શુભ ભાવનાવાળા, સાચી અભીપ્સાવાળા માણસો જગતના નાગરિક તરીકે મુક્ત રહે. પોતાના ઉપર તેઓ માત્ર એક જ સત્તાની આણ સ્વીકારે, અને એ સત્તા તે પરમ સત્યની જ સત્તા હોય. એ એક શાંતિનું સ્થળ હશે, સુમેળ અને સંવાદનું સ્થળ હશે. માણસમાં રહેલી સર્વ લગાયક વૃત્તિઓનો ઉપયોગ ત્યાં માણસોનાં દુઃખો અને આપત્તિઓને જીતવા માટે, માનવની પોતાની દુર્બળતા અને અજ્ઞાનને જીતવા માટે, માનવની મર્યાદાઓ અને અશક્તિઓ ઉપર વિજય મેળવવાને માટે જ કરવામાં આવશે. એ સ્થળે માનવની દૃઢ્યાઓ અને કામનાઓના સંતોષ, સ્થૂલ આનંદોપભોગો અને આમોદ-પ્રમોદ એ વસ્તુઓને નહિ પણ આત્માની જરૂરિયાતોને, પ્રગતિ માટેની આતુરતાને પ્રથમ સ્થાન આપવામાં આવશે. આ સ્થળમાં બાળકો પોતાના આત્મા સાથે સંબંધ ગુમાવ્યા વિના મોટાં થતાં રહેશે અને એક સર્વાંગ એવો વિકાસ પામતાં રહેશે. ત્યાં સુધી કેળવાણી પરીક્ષાઓ પસાર કરવા માટે તેમ જ પ્રમાણપત્રો અને નોકરીઓ મેળવવા માટે નહિ પરંતુ માણસની અત્યારની શક્તિઓને વધુ સમૃદ્ધ કરવા માટે, તેનામાંની નવી શક્તિઓને બહાર લાવવા માટે અપાતી રહેશે. આ જગામાં દ્યલ્કાબો અને હોડાઓને બદલે માણસોને સેવા અને સંગઠન કરવાની તકો મેળવી આપવામાં આવશે. દરેક વ્યક્તિને તેના શરીરની જરૂરિયાતો એક સરખી રીતે પૂરી પાડવામાં આવશે. એ સ્થળે જેમની પાસે વધુ ઉચ્ચ પ્રકારની બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક શક્તિઓ હશે તેઓ એ શક્તિઓનો ઉપયોગ જીવનમાં વધુ આનંદો અને સત્તા મેળવવા માટે નહિ કરે, પણ તેવા લોકો પોતાના ઉપર વધુ મોટી ફરજો અને વધુ જવાબદારીઓ ધારણ કરશે. એ સ્થળે કળાનું સૌંદર્ય, તેનાં ચિત્ર, શિલ્પ, સંગીત, સાહિત્ય આદિ સર્વ પ્રકારનાં રૂપોમાં સૌ કોઈને એક સમાન રીતે સુલભ બનશે. હરેક વ્યક્તિને આ કળાઓમાંથી મળતો આનંદ માણવાની તક રહેશે. એ આનંદ માણવામાં જો કોઈ મર્યાદા હશે તો તે માણસની પોતાની શક્તિની જ મર્યાદા હશે, માણસ પોતાની સામાજિક કે આર્થિક સ્થિતિને કારણે કળાના આનંદથી વંચિત નહિ રહે. કારણ કે આ આદર્શ સ્થાનમાં પૈસાનું સ્થાન સર્વોપરી નહિ હોય. માણસની પાસેની સ્થૂલ સંપત્તિ કે સામાજિક દરજજા કરતાં તેનું પોતાનું જે વ્યક્તિત્વ હશે તેને અહીં વધુ મહત્વનું ગણવામાં આવશે. આ સ્થળે માણસો કામ કરશે તે જીવનનિર્વાહ

મેળવવા માટે નહિ પણ પોતાની જાતને વ્યક્ત કરવા માટે કરશે, પોતાની શક્તિઓને તથા શક્યતાઓને ખીલવવા માટે કરશે, અને સાથે સાથે કામ દ્વારા તેઓ આખા યે સમૂહની સેવા પણ કરતા રહેશે. એ કામના બદલામાં સમૂહ દરેક વ્યક્તિને તેના નિર્વાહનાં સાધનો પૂરાં પાડશે, તેને કામ કરવા માટેનું ક્ષેત્ર પૂરું પાડશે. અર્થાત્ એ સ્થળે માનવના સંબંધોના પાયામાં સામાન્ય રીતે જે હુરેફાઈ અને સંઘર્ષનાં તત્ત્વો રહેલાં હોય છે તે ચાલી જઈને સહકાર વૃત્તિ, વધુ સારું કાર્ય કરવાની વૃત્તિ કામ કરશે. બધા સંબંધો સાચા ભાતૃત્વના સંબંધો બની રહેશે.

બેશક, પૃથ્વી હજુ આવા આદરને સિદ્ધ કરી શકવા જેટલી તૈયાર નથી, કારણ કે માનવજાતિ પાસે હજુ આ આદરને સમજવા તથા સ્વીકારવા માટેનું જરૂરી જ્ઞાન નથી, તેમ જ એ આદરને અમલમાં મૂકવા માટે જોઈતી સજ્જાન શક્તિ પણ નથી, અને માટે જ આને હું એક સ્વખન તરીકે વર્ણવું છું.

અને છતાં, આ સ્વખન એક વાસ્તવિક ઘટના બનવાની તૈયારીમાં છે. આ જ વસ્તુ અમે શ્રી અરવિંદના આશ્રમમાં એક નાનકડા પાયા ઉપર, અમારી પાસેનાં અલ્ય સાધનોના પ્રમાણમાં સિદ્ધ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. બેશક, અમને આ બાબતમાં હજુ સંપૂર્ણ સિદ્ધિ તો નથી જ મળી, પરંતુ એ સિદ્ધિની દિશા અમારી પ્રગતિ છે. થોડો થોડો કરતાં અમે અમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ અને અમને આશા છે કે એક દિવસ અમે આખા જગતની સમક્ષ એ લક્ષ્યને રજૂ કરીને કહી શકીશું કે, જુઓ, અત્યારની અંધાધૂદીમાંથી નીકળીને એક વધુ સાચા, વધુ સંવાદમય, નૂતન જીવનમાં પહુંચવા માટે એક વ્યવહારુ, અને અસરકારક સાધન છે અને તે આ રહ્યું.

(બુલેટિન, ઓગસ્ટ ૧૯૫૪)

\*

## માનવજ્ઞતિને મદ્દ

પૂર્ણયોગના સાધકો માટે માનવજ્ઞતિનું કલ્યાણ એ સાધનાનું લક્ષ્ય હોઈ શકે નહિ. આ કલ્યાણ તો તેમની સાધનાના એક પરિણામ રૂપે, એક ફલ રૂપે બની આવશે. જગતમાં માનવજ્ઞતિની પરિસ્થિતિ સુધારવા માટે આજ સુધીમાં અનેક પ્રયત્નો થઈ ચૂક્યા છે. એ પ્રવૃત્તિને લીધે માણસમાં કેટલો યે ઉત્સાહ, ધગશ અને આત્મસમર્પણ પ્રગટેલાં છે અને છતાં એ બધા પ્રયત્નોને છેવટે તો એક કરુણ નિષ્ફળતા જ સાંપડી છે. આમ કેમ થયું હશે? એ થવાનું કારણ એ છે કે માનવના જીવનની પરિસ્થિતિમાં તમે જે રૂપાંતર લાવવા માગો છો તે સાધવા માટે પ્રથમ તો તમારે એક બીજું ગ્રાથ્યિક રૂપાંતર સાધવાનું રહે છે. એ રૂપાંતર તે માણસોની ચેતનાનું રૂપાંતર છે. અને આ રૂપાંતર આરંભમાં ભલે બહુ વ્યાપક ન હોય તોપણ થોડાક અસાધારણ આત્માઓમાં — જગતમાં એક વધુ વ્યાપક રૂપાંતરના પાયા નાખી શકે તેવી શક્તિ ધરાવતા અમુક આત્માઓમાં તો સધાઈ જવું જ જોઈએ.

પરંતુ આ વિષય ઉપર આપણે પછી આવીશું. એ વસ્તુ આપણા ઉપસંહારમાં આવશે. હુમણાં તો હું જગતમાં સાચા માનવકલ્યાણ માટે કામ કરી ગયેલા બે મહાપુરુષોની વાત કરીશ.

આ બે વિભૂતિઓ જીવનમાં જાણે કે સામસામેના છેડા પર ઊભેલી છે: તેમના વિચારો અને કાર્યો એકબીજાથી તદ્દન ઊલટી દિશાનાં રહેલાં છે. પરંતુ તેમના જીવનમાં એક આંતરિક સાધ્ય પણ છે. આ બંને પુરુષોને એક ઘણું જ સંવેદનશીલ અને કારુધ્યપૂર્ણ હંદ્ય મળેલું હતું, અને એ હંદ્ય દ્વારા જગતમાં બે સુંદરમાં સુંદર આત્માઓની અભિવ્યક્તિ બની આવી હતી. એ બંનેને માનવ-જ્ઞતિના દુઃખનો પરિયય થયો ત્યારે તેમના અંતરાત્માને એક જ સરખો આધાત લાઝ્યો હતો. એ બંને જણે પોતાના માનવ બંધુઓનાં દુઃખોના નિવારણનો ઈલાજ મેળવવા માટે પોતાનું આખું યે જીવન સમર્પિત કરી દીધું હતું અને એ બંને ય એમ માનતા હતા કે મને એ ઈલાજ જરી આવ્યો છે. પરંતુ આ પુરુષોએ શોધેલાં, એકબીજાથી તદ્દન ઊલટાં કહી શકાય તેવાં નિરાકરણો એકસરખાં નિષ્ફળ નીવહેલાં છે. કારણ કે એ દરેકનું નિરાકરણ પોતપોતાની રીતે અપૂર્ણ જ હતું, આંશિક જ હતું. અને તેથી, એ પુરુષો આટલું કરી ગયા છતાં માનવજ્ઞતિ હજી પોતાની યાતનામાંથી મુક્ત બની શકી નથી.

આ બે વિભૂતિઓમાંથી એક પૂર્વમાંથી આવેલી છે, બીજી પશ્ચિમમાંથી. પૂર્વની વિભૂતિ તે રાજકુમાર સિદ્ધાર્થ છે, જગતે પાછળથી તેમને ભગવાન બુદ્ધ કહ્યા.

પશ્ચિમની વિભૂતિ તે મોંસ્યો વેંસોં છે, એના મૃત્યુ પછી લોકો એને સેં વેંસોં દ પોલ (પોલના સંત વેંસોં) તરફે ઓળખવા લાગેલા. આ બે વ્યક્તિઓ પોતાની વરયે જાણે કે માનવ ચેતનાના બે છેડા પકડીને ઊભી હતી. તેમની માનવજ્ઞતિને મદદ કરવાની પદ્ધતિઓ એકબીજાથી સાવ ઊલટી હતી. છતાં તેઓ એટલું તો માનતા હતા કે માનવને આત્માની સહાય વડે, બુદ્ધિને અગમ્ય એવા કોઈ એક પરમ તત્ત્વની મદદ વડે મુક્ત કરી શકાશે ખરો. એ તત્ત્વને વેંસોએ પ્રભુ તરીકે ઓળખાવેલું, બુદ્ધે એને નિર્વાણનું નામ આપેલું.

વેંસોં દ પોલ એક મહા તીવ્ર શ્રદ્ધાવાળો આત્મા હતો. પોતાના અનુયાયીઓને તે કહેતો કે માણસે પોતાના આત્માને બચાવી લેવો જોઈએ. પરંતુ તેને જ્યારે માનવજ્ઞતિનાં દુઃખોનો પ્રત્યક્ષ પરિચય થયો ત્યારે તેને થોડી જ વારમાં સમજાઈ ગયું કે માણસે જો પોતાના આત્માને જાણવો હશે તો પ્રથમ તો તે માટે તેને કંઈ નહિ તો વખત તો મળવો જ જોઈશે. જગતમાં એવાં કેટલાં યે માણસો છે કે જેમને એક નાનીસરખી કમાણી કરવા માટે પણ સવારથી માંડી તે સાંજ સુધી મજૂરી કરવી પડે છે, અને ઘણી વાર તો સાંજથી માંડી સવાર સુધી પણ મહેનત કરવી પડે છે. અને આટલું કરવા છતાં યે તેમને પોતાના પોષણ પૂરતું મળતું નથી. આવા લોકોને પોતાના આત્મા વિષે વિચાર કરવાનો સમય કેવી રીતે મળવાનો? આ જોઈને એ ભલા ઉદાર માણસે એમ ઘટાવ્યું કે જે લોકો પાસે પોતાની જરૂર કરતાં વધારે સંપત્તિ હોય તેઓ જો આ અક્ષિયન લોકોને તેમના જીવનની ઓછામાં ઓછી જરૂરિયાતો જેટલું પણ મેળવી આપે તો પછી એ દુઃખી માણસોને વધુ ઉત્તમ જીવન ગાળવા માટેની ફરસદ મળી શકે. એ માનતો હતો કે સામાજિક કાર્યો કરવા, પોતાની દ્યાવૃત્તિને સક્રિય કરી ડેઠ જીવનની સ્થૂલ ભૂમિકા સુધી લઈ જવી એ ઘણી ઈછ અને લાભદાયક વસ્તુ છે. એને એમ પણ લાગતું કે તમે વધુ ને વધુ માણસોનાં દુઃખ દૂર કરતા જશો, જગતમાં બને તેટલી વધુમાં વધુ વ્યક્તિઓને રાહત પહુંચાડશો તો એમ કરતાં છેવટે જીવનમાંથી દુઃખમાત્રને નિર્મળ કરી શકાશે. પરંતુ એને ખબર ન હતી કે આ રીતે તો દુઃખનો માત્ર ઉપર ઉપરથી જ ઉપચાર થાય છે, રોગ તેના મૂળમાંથી નિર્મળ થતો નથી. આ પુરુષે ખૂબ જ સમર્પણ ભાવથી, અપૂર્વ ત્યાગપૂર્વક કેટલું યે કામ કર્યું અને એમાંથી આપણાને માનવના ઈતિહાસમાં એક અત્યંત હદ્યસ્પર્શી સુંદર ચારિત્યનું દર્શન મળે છે. પણ એમ છતાં ઓણે જે મહેનત કરી તેના પરિણામે જગતમાં દુઃખી અને દરિદ્ર માણસોની સંઘામાં ઘટાડો થવાને બદલે જાણે કે વધારો જ થયેલો છે. બેશક, એના આ સેવા-કાર્યનું એક નક્કર પરિણામ એ આવેલું છે કે અમૃત ધનિક લોકોના માનસમાં એક સ્પષ્ટ રીતની દાનવૃત્તિ જન્મી

શકી છે. અને આ રીતે, સંત વેંસોનું કાર્ય, જે લોકોને દાન મળવા લાગ્યું તેના કરતાં જે લોકો દાન આપતા થયા તેમને માટે વધારે લાભદાયક નીવેલું છે.

આની સામે હવે, ચેતનાના બીજા છેડા ઉપર આપણને બુદ્ધની પવિત્ર ભવ્ય કરુણાપૂર્ણ મૂર્તિનાં દર્શન થાય છે. બુદ્ધને એમ લાગતું હતું કે જીવન પોતે જ દુઃખનું કારણ છે, અને એ જીવનનો લય કરશો તો જ દુઃખનો લય થઈ શકશે. જીવન અને જગત તે જીવવા માટેની કામનાને પરિણામે અસ્તિત્વમાં આવેલાં છે, એ અવિદ્યાનું ફલ છે. આ કામનાનો નાશ કરી દો, અવિદ્યાને દફ્ફનાવી દો, જગત અલોપ થઈ જશે અને સાથે સાથે જગતનાં દુઃખ અને વેદના પણ ચાલ્યાં જશે. બુદ્ધમાં એક ઊર્જા આધ્યાત્મિક પ્રેરણા કામ કરતી હતી. તેમણે એક શાંત નીરવ એકાગ્રતામાં સ્થિર બની તેમાંથી પોતાની સાધનાનો માર્ગ તૈયાર કરેલો. જગતમાંથી મુક્ત થઈ જવા માગનારને માટે આના જેવી સમર્થ અને ઉન્નતિકારક સાધના બીજી એક નથી.

આ સિદ્ધાંતને અમલમાં મૂકી શકે તેવા લોકો તો જગતમાં બહુ ઓછા રહ્યા છે પરંતુ એ સિદ્ધાંતનો સ્વીકાર તો જગતમાં કરેઠો લોકોએ કરેલો છે. અને છતાં પૃથ્વી ઉપર જીવનની સ્થિતિ તો એવી ને એવી જ ચાલુ રહેલી છે. બુદ્ધ આટલું બધું મહા કાર્ય કરવા છતાં માનવજીતિની વ્યથાના સાગરમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી.

તોપણ આ મહાપુરુષો પ્રત્યે માનવજીતિએ કૃતજ્ઞતા અને અહોભાવ ધારણા કર્યા છે. વેંસોને લોકોએ સંતનું બિરુદ્ધ આપ્યું છે અને બુદ્ધને લોકોએ દેવની કોટીએ મૂકેલા છે. પરંતુ આ પુરુષોએ માનવજીતિને જે બોધ અને દૃષ્ટાંત આપેલાં છે તેને સાચેસાચ જીવનમાં ઉતારનાર માણસો તો જગતમાં બહુ ઓછા જ રહેલા છે, જો કે ખરી કૃતજ્ઞતા બતાવવાનો અસરકારક માર્ગ તો આ જ છે. પણ ધારો કે માનવજીતિએ આ પુરુષોના બોધને જીવનમાં ઉતારવા માટે પૂરેપૂરો પ્રયત્ન કર્યો હોત તોપણ તેથી માનવજીવનની સ્થિતિમાં કોઈ ખાસ સુધારણા થઈ જ હોત એમ કહી શકાય તેમ નથી. તમે દર્દમાં રાહત આપો, પણ તેથી દર્દ નિર્મળ થતું નથી, દુઃખમાંથી તમે નાસી છૂટો પણ તેથી દુઃખ ઉપર વિજય સધાતો નથી. ખરી વાત તો એ છે કે વેંસોએ આપેલા નિરકરણનો અમલ કરવાથી — માણસોને તેમના શારીરિક દુઃખમાંથી રાહત આપવાથી માનવજીતિની વ્યથા અને દુઃખનો અંત કદી આવી શકવાનો નથી. કારણ કે માણસના જીવનમાં જે જે દુઃખ આવી પેઢ છે તે તમામના મૂળમાં માત્ર બાધ દરિદ્રતા જ હોતી નથી અને એ દુઃખને તમે સ્થૂલ ઈલાજો દ્વારા મટાડી શકતા નથી. એવા પ્રયત્નો નિષ્ફળ જ જાય છે, માણસને તમે શારીરિક સુખસગવડ મેળવી આપો તોપણ એમાંથી તેને શાંતિ અને આનંદ મળો જ છે એવું નથી બનતું. વળી માણસના દુઃખનું મૂળ માત્ર ગરીબાઈ જ છે એવું પણ નથી. જગતના સર્વ દેશોમાં

અને સર્વ કાળમાં અનેક સંતો અને સાધુઓ સ્વેચ્છાપૂર્વક દરિદ્ર સ્થિતિમાં રહેલા છે અને એ દરિદ્ર અવસ્થામાં એમને પૂર્ણ શાંતિ અને સુખનો અનુભવ થતો રહ્યો છે. આથી ઊલાંડું તમને તમામ પ્રકારનાં દુન્યવી સુખો આવી મળે, સ્થૂલ સંપત્તિમાંથી મળી શકતાં તમામ સુખસગવડ, આનંદવિનોદ, બાધ તૃપ્તિ મળી રહે તોપણ તમે જોશો કે એ વસ્તુઓ તમને શોક અને સંતાપના હુમલામાંથી બચાવી શકવાની નથી.

આ જ પ્રમાણે બુદ્ધે સૂચ્યવેલા નિરાકરણમાંથી – નિર્વાણને માર્ગ પણ જગતનાં દુઃખોના પ્રશ્નનો વ્યવહારું ઉકેલ આવી શકે તેમ નથી. ધારો કે આપણે એમ સ્વીકારી લઈએ કે જગતમાંથી ઘણા બધા લોકો બુદ્ધની આ સાધનાનો સ્વીકાર કરી શકશો અને પોતે અંતિમ મુક્તિ મેળવી શકશે, તોપણ એ રીતે પૃથ્વી ઉપરથી દુઃખની હસ્તી મટી જવાની નથી જ. જે લોકોમાં નિર્વાણની સાધના કરવાની શક્તિ નથી તે લોકોને તો પોતાનાં દુઃખોમાંથી મુક્તિ નથી જ મળવાની. જગતમાંના મુક્ત થઈ ગયેલા લોકોની મુક્તિથી અન્ય માણસોનાં દુઃખો નિર્મજૂન થવાનાં નથી.

ખરું જોતાં તો સાચું સુખ એ એક એવી વસ્તુ છે કે માણસ ગમે તેવી પરિસ્થિતિમાં પણ તેનો અનુભવ કરી શકે છે. કારણ કે, આ સુખ એવા પ્રદેશોમાંથી આવતું હોય છે કે જેના ઉપર બાધ સંજોગો લેશ પણ અસર કરી શકતા નથી. પરંતુ આવું સુખ તો બહુ જ ઓછા માણસોને માટે સુલભ હોય છે. માનવજીતિનો મોટો ભાગ તો હજી પાર્થિવ સંજોગોને આધીન રહીને જ જીવી રહેલો છે. આ જોતાં, આપણે એમ કહી શકીએ કે આ પ્રશ્નના ઉકેલ માટે બે રીતે કામ થવું જોઈએ. પ્રથમ તો માનવની ચેતનાની અંદર જ એક સંદર્ભ પરિવર્તન બની આવવું જોઈએ અને બીજું પૃથ્વીના વાતાવરણમાં પણ એક સંપૂર્ણ ઝ્યાંતર આવી જવું જોઈએ. આ બંને પરિસ્થિતિ સિદ્ધ નહિ થાય ત્યાં લગી માનવ જીવનની સ્થિતિમાં તમે ખરેખરો ફેરફાર કરી શકવાના નથી. આ બંનેમાંથી ગમે તે કાર્ય હાથ ધરો, એમાં તમારે એક ઈલાજ અજમાવવાનો રહે છે : પૃથ્વી ઉપર તેમ જ માનવની અંદર એકીસાથે એક નવી ચેતનાનું પ્રકટ્ય થવું જોઈએ. આ જગતમાં અતિમાનસ ચેતના અવતરણ પામે અને તેની સાથે સાથે એક નવી શક્તિ, નવો પ્રકાશ અને નવું બળ અહીં પ્રગટ થાય તો જ માણસનો તેને ભીસી રહેલાં દુઃખો, પીડાઓ અને સંકટોમાંથી ઉદ્ધાર સંભવી શકે છે. આ અતિમાનસ ચેતનામાં જ માત્ર એવી શક્તિ છે કે જે વડે તે પૃથ્વી ઉપર એક ઉચ્ચતર કોટિની સ્વસ્થ દશા લઈ આવીને, એક વધુ વિશુદ્ધ અને સાચો એવો પ્રકાશ લઈ આવીને ઝ્યાંતરનો મહા ચમત્કાર સિદ્ધ કરી શકે તેમ છે.

આવા એક નવીન આવિભાવની દિશામાં પ્રકૃતિ આગળ વધી રહેલી છે. પણ પ્રકૃતિનો માર્ગ વાંકોચુંકો છે, તેની કૂચમાં કશી ચોક્કસતા નથી, એની ગતિ કેટલી યે

વાર અટકી પડતી હોય છે, પીછેહંદ કરતી હોય છે. અને આ બધાને કારણે પ્રકૃતિની ગતિના સાચા અર્થને સમજવો મુશ્કેલ બની જાય છે. પરંતુ એ વાત હવે વધુ ને વધુ સ્પષ્ટ બની રહી છે કે કુદરત અત્યારની માનવકોટિમાંથી હવે એક નવી માનવકોટિ, માનવની એક અતિમાનસ જીતિ ઊભી કરવા માગે જ છે. આ અતિમાનસ માનવજીતિ, માણસ અત્યારે પશુ કરતાં જેટલો આગળ વધેલો છે તેટલી જ આજના માણસ કરતાં આગળ વધેલી હશે. પણ આ નવી માનવજીતિનું સર્જન થાય, આ રૂપાંતર સિદ્ધ બને તે પૂર્વે સંભવ છે કે માનવજીતિએ કેટલાં યે વરસો સુધી, કેટલાં યે સૈકા સુધી પ્રયોગાની દરશામાં જ અટવાયા કરવું પડે, અંધારામાં જ બાથોડિયાં માર્યા કરવાં પડે. આમ છતાં માનવ જો આમાં પોતાનો બુદ્ધિપૂર્વકનો સંકલ્પ કામે લગાડી શકે તો આ પરિવર્તન તે બહુ ટૂંકા સમયમાં સિદ્ધ કરી શકે છે, એટલું જ નહિ, એ કાર્ય તે બહુ થોડા બગાડપૂર્વક અને બહુ થોડા નુકસાનપૂર્વક કરી શકશે.

અને આ કાર્યમાં પૂર્ણ યોગ બહુ જ ઉપયોગી સાધન નીવડી શકે તેમ છે, માનવના વિકાસમાં પોતે કેવો ભાગ ભજવી શકે તેમ છે તે બતાવી શકે છે. આ યોગની રચના એવી રીતે થયેલી છે કે એ દ્વારા તે માનવની શક્તિને ખૂબ જ એકાગ્ર કરીને પ્રયોજિત કરી આપે છે અને સામાન્ય રીતે કોઈ પણ આમૂલ પરિવર્તનની કિયામાં, નવસર્જનના કાર્યમાં કાળ તરફથી જે વિલંબનું તત્ત્વ દાખલ થાય છે તે વિલંબને તે મારી હઠાવે છે.

પૂર્ણયોગ આ સ્થૂલ જગતને તેની દુર્દર્શામાં જ પક્ષું રહેવા દઈને જગતમાંથી નીકળી જવાનો માર્ગ બતાવતો નથી, તેમ જ જગતના સ્થૂલ જીવનમાં કશ આમૂલ પરિવર્તનની આશા જ નથી, અથવા તો આ જગત એ પરમાત્માના સંકલ્પનું છેલ્લામાં છેલ્લાં વ્યક્ત રૂપ છે, હવે તેમાં પ્રભુના સંકલ્પનો કોઈ નવો આવિર્ભાવ થવો સંભવિત નથી એમ ગણી લઈને આ બાધ્ય જીવનને જેવું છે તેવું ને તેવું જ સ્વીકારી લેતો પણ નથી.

પૂર્ણયોગ વિશ્વમાં સામાન્ય મનોમય ચેતનાથી માંડીને એક અતિમાનસ અને દિવ્ય ચેતના સુધી ચૈતન્યની જે બધી સીડીઓ આવેલી છે તે તમામને ચહેવા માગે છે, અને પોતાનું આ આરોહણ જ્યારે સંપૂર્ણ બની રહે ત્યાર પણી પોતે એ રીતે સિદ્ધ કરેલી અતિમાનસ ચેતના અને શક્તિને પોતાની સાથે લઈ આવીને આ સ્થૂલ જગતમાં પાછો નીચે આવવા માગે છે, એ શક્તિ અને ચેતનાને આ જગતમાં ઓતપ્રોત કરવા માગે છે અને એ રીતે આ પૃથ્વીને કમે કમે તે એક અતિમાનસ અને દિવ્ય જગત રૂપે પલટી દેવા માગે છે.

આ યોગ ખાસ તો અમુક કોટિની વ્યક્તિઓ ઉપર જ પોતાની દૃષ્ટિ માડે છે.

જગતમાં કેટલાક માનવો એવા હોય છે કે જેમાણે માનવને જીવનમાં જે કંઈ પ્રાપ્ત થઈ શકે તેવું હોય છે તે પ્રાપ્ત કરી લીધું હોય છે અને છતાં તેમને પોતાની સિદ્ધિથી સંતોષ હોતો નથી. આવા પુરુષો જીવન પાસે કોઈ એવી વસ્તુ માગતા હોય છે કે જે આપવાની શક્તિ જીવન પાસે હોતી નથી. આ પુરુષો જગતના અદ્ઘાત તત્ત્વને માટે જંખતા હોય છે, કોઈ પૂર્ણતાને માટે આતુર હોય છે, પોતાની સમક્ષ ઉગ્ર પ્રશ્નો રજૂ કરતા રહેલા હોય છે. પરંતુ તેમને તેનો કશો નિશ્ચિત જવાબ જગતમાંથી મળેલો હોતો નથી. આવી જ વ્યક્તિઓ પૂર્ણિયોગ માટે તૈયાર હોય છે.

આ જગત અંગે વિચાર કરતાં કેટલાક મૂળભૂત પ્રશ્નો આપણી સમક્ષ ખડા થાય છે. જેને જેને માનવજીતિના ભાવિમાં રસ રહેલો હોય છે અને જગતની વર્તમાન વિચારસરણીઓ જેને સંતોષી શકેલી નથી તેવી દરેક વ્યક્તિ સમક્ષ આ પ્રશ્નો હારબંધ ખડા થઈને રહે છે. એ પ્રશ્નોને આ રીતે રજૂ કરી શકાય:

જન્મ લીધા પછી જો માત્ર મરવાનું રહે છે તો જન્મવું જ શા માટે જોઈએ?

જીવનમાં જો માત્ર દુઃખ જ વેઠવાનું છે તો પછી જીવન જ શા માટે નભાવી રાખવું જોઈએ?

પ્રેમના અંતે જો વિરહ જ રહ્યો છે તો પછી પ્રેમ જ શા માટે કરવો?

વિચારને અંતે જો માત્ર સ્ખલનો જ રહેવાનાં હોય તો વિચાર જ શા માટે કરવો?

કર્મ કરતાં જો માત્ર ભૂલો જ થવાની છે તો પછી કશું કર્મ જ શા માટે કરવું?

આ પ્રશ્નોનો જો કોઈ સ્વીકારી શકાય તેવો જવાબ હોય તો તે એ જ છે કે જગતમાં પરિસ્થિતિ હોવી જોઈએ તેવી આદર્શ રૂપની તો નથી જ. પરંતુ આ બધા વિરોધાભાસો જીવનમાં હોવા જ જોઈએ તેવું નથી. એ દરેક વિરોધાભાસનો ઈલાજ થઈ શકે તેમ છે અને એક દિવસ તે જગતમાંથી અદૃષ્ય થઈ જવાના છે. અત્યારે જગત જેવું છે તેવું ને તેવું જ રહેવાનું છે, તેમાં કંઈ જ સુધારો થવાનો નથી એવું નથી. પૃથ્વી અત્યારે એક સંકાંતિના કાળમાંથી પસાર થઈ રહી છે. માણસની અલ્ય આયુષ્યવાળી ચેતનાને આ સંકાંતિનો કાળ બહુ લાંબો લાગે છે પણ શાશ્વત ચેતનાની દૃષ્ટિમાં તો કાળ અત્યંત અલ્ય જ છે. પૃથ્વી ઉપર અતિમાનસ ચેતના પ્રગટ થતાં આ સંકાંતિ કાળ પૂરો થશે. અને ત્યારે જગતમાં રહેલા વિરોધાભાસો અદૃષ્ય થઈ જઈ તેને સ્થાને સંવાદિતતાઓની સ્થાપના થશે, વિરોધોનું સ્થાન સમન્વયો લેશે.

આ નવી સૃષ્ટિનું સર્જન, અતિમાનવોની જીતનું આગમન એ વિષયમાં ઘણા તર્કવિતર્કો અને વાદવિવાદો થયેલા છે. આ અતિમાનવ કેવો હશે એનો વિચાર કરવા

બેસતાં માનવની કલ્પના પોતાને રુચે એવાં જ ચિત્રો દોરતી રહી છે. પરંતુ સમાન વસ્તુ જ સમાનને જાણી શકે છે. દિવ્ય પ્રકૃતિમાં રહેલી ચેતનાને તેના મૂળ રૂપમાં તમે પ્રાપ્ત કરી શકો તો જ તમને ખ્યાલ આવી શકે કે એ દિવ્ય પ્રકૃતિ પોતાનો આવિર્ભાવ કેવા પ્રકારે કરશો. પરંતુ જે લોકોને આ ચેતનાનો પોતામાં સાક્ષાત્કાર થયો છે તેમને તો પછી એ ચેતનાનું વર્ણન આપવા માટે બહુ ઉત્સુકતા રહેતી નથી. તેઓ પોતે એ અતિમાનવ બનવા માટેના કામમાં જ લાગી જતા હોય છે.

આમ છતાં, આ વિષયમાં કોઈ ગેરસમજ ન ઉભી થાય એટલા માટે આ અતિમાનવમાં અમૃક વસ્તુઓ તો નહિ જ હોય એ વાત સ્પષ્ટ કરી દઈએ તો તે લાભદાયક નીવડશો. આ અંગે, દા. ત. મેં ક્યાંક વાંચેલું તેમાં એમ જણાવેલું કે અતિમાનવ જાતિનું મૂળભૂત લક્ષણ એ હશે કે તે કૂર અને કશા સંવેદન વિનાની હશે. આ અતિમાનવો પોતે દુઃખથી પર થઈ ગયેલા હશે એટલે એમને બીજાઓનાં દુઃખનું કશું જ મહત્ત્વ જણાશે નહિ. ઊલટું માણસો દુઃખી થાય તેને તેઓ એક અપૂર્ણતાનું, ઉત્તરતી કોટિના જીવનનું લક્ષણ ગણાશે. અતિમાનવ વિષે આ રીતે વિચાર કરનાર માણસો બેશક એમ જ વિચાર કરતા હોય છે કે માણસ પોતાથી નીચેની કોટિના માણસો સાથે, પ્રાણીઓ સાથે જે રીતનું વર્તન રાખે છે તેવો જ સંબંધ અતિમાનવ અને માણસ વચ્ચેનો હશે. પરંતુ અતિમાનવ જો આ રીતનું વર્તન કરે તો તે તેની શ્રેષ્ઠતાનું નહિ પણ અચેતનતા અને મૂર્ખતાનું જ લક્ષણ ગણાય. આપણે જોઈએ છીએ કે માણસ જ્યારે ચેતનાની કોઈ ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચે છે ત્યારે તો એને પોતાથી નીચેની કોટિના જીવો પ્રત્યે કારૂણ્યનો ભાવ પ્રગટે છે અને તે આ લોકોના જીવનને ઉન્નત કરવાનો પ્રયત્ન કરે છે. આમ છતાં, અતિમાનવ સાવ સંવેદન વિનાનો હશે એ રીતની કલ્પના પાછળ કંઈક સત્ય તો છુપાયેલું જ છે. એ સત્ય એ છે કે આ ઉચ્ચ કોટિની માનવજીતિમાં માનવો જેને દ્યાવૃત્તિ તરીકે ઓળખે છે તેવી રીતની કોઈ અહુકારમય, દુર્ભળ અને લાગણીપ્રધાન વૃત્તિ નહિ હશે. આ દ્યાવૃત્તિ હિત કરવા કરતાં અહિત જ વિશેષ કરતી હોય છે. અતિમાનવની જાતિમાં આ દ્યાવૃત્તિને બદલે એક આલોકિત અને પ્રબળ કારૂણ્યવૃત્તિ કામ કરતી હશે, અને એ કરુણા માનવજીતિના દુઃખને કાયમ માટે ટકાવી રાખવાનો નહિ પણ એ દુઃખનો સાચો ઈલાજ શોધી કાઢવા માટે જ પ્રવૃત્ત થતી રહેશે.

અતિમાનવ વિષેની આવી કલ્પના આપણાને ખરું જોતાં તો પૃથ્વી ઉપર પ્રાણમય સત્ત્વોની જાતિના શાસનનો આબેદૂબ ખ્યાલ આપે છે. આ પ્રાણમય સત્ત્વોની પ્રકૃતિ અમર હોય છે, તેમની શક્તિઓ માણસ કરતાં અનેકગાણી વિશેષ હોય છે. પણ સાથે સાથે આ સત્ત્વોની સંકલ્પશક્તિ હમેશાં પ્રભુના વિરોધમાં જ કામ કરતી

હોય છે. આ સત્ત્વોનું આજાનું કામ તો જગતમાં પરમાત્માના સાક્ષાત્કારને વધુ ને વધુ દૂર ઠેલવાનું જ હોય તેમ લાગે છે. અને એ સાક્ષાત્કારની સિદ્ધિ માટેનાં કરણો એટલે કે માનવો, હરેક પ્રકારનાં વિદ્ધનોને જીતી શકે તેટલાં વિશુદ્ધ અને બળવાન અને સંપૂર્ણ નહિ બનશો ત્યાં સુધી આ સત્ત્વોનું કાર્ય ચાલુ જ રહેવાનું છે. પૃથ્વી ઉપર આવાં સત્ત્વો પોતાનું દુષ્ટ શાસન જમાવી લે તેવી શક્યતા છે એ ચેતવણી જો આ દુઃખપીડિત પૃથ્વીને આપવામાં આવે તો તે કદાચ સાવ નિરર્થક તો નહિ જ નીવડે એવી આશા છે.

આ અતિમાનવ કેવો હશે તેની ખબર તો તે પોતે સદેહે આવીને માનવ સમક્ષ હાજર થશે ત્યારે જ આપણને પડી શકશે. અને એ ઘટના ન બને ત્યાં સુધી હરેક આદર્શપ્રિય માણસનું કર્તવ્ય એટલું જ રહે છે કે તે જીવન વિષે પોતાથી બને તેટલી એક સુંદરમાં સુંદર, ઉમદામાં ઉમદા, સાચામાં સાચી, શુદ્ધમાં શુદ્ધ, અત્યંત પ્રકારામય અને ઉત્તમોત્તમ એવી કલ્પના બાંધે અને એવી અભીસા સેવતો રહે કે તેના પોતાનામાં આ કલ્પના સિદ્ધ થાય અને તેના પરિણામે જગતનું અને સર્વ કોઈનું વધુમાં વધુ હિત સધાય.

(બુલેટિન, નવેમ્બર ૧૯૫૪)

\*

## સ્વીનો પ્રશ્ન

હું તમારી સાથે સ્વીના પ્રશ્ન વિષે થોડી વાતચીત કરવા માગું છું. દેખીતો રીતે તો આ પ્રશ્ન માનવજાતિ જેટલો જૂનો દેખાય છે, પરંતુ એના મૂળમાં જઈને જોશો તો તે તમને એથી પણ ઘણો જૂનો, અનંતગણો જૂનો જણાશો. આ વસ્તુનું નિયમન કયા નિયમને આધારે થાય છે, અને એનું નિરાકરણ કયા નિયમ પ્રમાણે થઈ શકે તેમ છે એ શોધવાનો તમે પ્રયત્ન કરશો તો તમને જણાશો કે તમારે આ આખા યે વિશ્ના ઠેઠ મૂળ સુધી જવું પડશો, અરે આ સૃષ્ટિથી પણ પાર ચાલ્યા જવું પડશો.

કેટલીક પ્રાચીન પરંપરાઓ, અને એ કદાચ સૌથી પ્રાચીન પણ હોય, એમ કહેતી આવેલી છે કે આ વિશ્બ પરમ પરમાત્માના સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલું છે. એ ચેતનાએ પોતાનો વસ્તુ રૂપે આવિર્ભાવ કરવાનો સંકલ્પ કર્યો અને એ વસ્તુરૂપ બનવાની કિયામાં પ્રથમ આ વિશ્બનું સર્જન કરતી ચેતના આવિર્ભાવ પામી. આ પ્રાચીન દર્શનો, બેશક, આ પરમ તત્વનો નરજાતિ તરીકે અને પેલી સર્જક ચેતનાનો નારીજાતિ તરીકે સામાન્ય રીતે ઉલ્લેખ કરતાં રહે છે, અને એ રીતે તેઓ છી અને પુરુષ વચ્ચેના બેદનું મૂળ ઠેઠ વિશ્નની પેલી આદિમ કિયામાં મૂકી આપે છે તેમ જ સાથે સાથે નારી કરતાં નરને પ્રથમ સ્થાને બેસાડે છે. આ બંને તત્ત્વો આ લોકોના કહેવા મુજબ આમ તો એક જ છે, એકરૂપ છે, વિશ્બનો આવિર્ભાવ થયો તે પહેલાંનાં સહસ્રિતિમાં રહેલાં છે, તથાપિ તેમના કહેવાનો અર્થ એ થાય છે કે વિશ્બસર્જન માટેનો નિર્ણય કરનાર પ્રથમ નરતત્ત્વ હતું અને એ નિર્ણયને પાર પાડવા માટે તેણે પોતામાંથી નારીતત્ત્વનો આવિર્ભાવ કર્યો. અર્થાત્, જો નારીતત્ત્વ વિના સૃષ્ટિનું નિર્માણ થતું નથી તો નરતત્ત્વ પોતે પ્રથમ નિર્ણય ન કરે ત્યાં સુધી નારીતત્ત્વનો આવિર્ભાવ પણ સંભવતો નથી.

આવી રીતના ખુલાસા અંગે એક પ્રશ્ન જરૂર કરી શકાય તેવો છે કે આ ખુલાસો શું વધુ પડતો માણસની રીતનો ખુલાસો નથી લાગતો. પરંતુ સાચું કહીએ તો માણસ પોતે જે કાંઈ ખુલાસા આપી શકે તેમ છે તે બધા, અથવા તો તેમનું સ્વરૂપ અનિવાર્ય રીતે માણસની રીતનું જ રહેવાનું. આ જગતમાં કેટલીક અસાધારણ વ્યક્તિઓ પોતાના આધ્યાત્મિક વિકાસમાં ઊંચે ચડતી ચડતી માનવ પ્રકૃતિથી ઉપર જઈ શકેલી છે અને પોતે જે તત્વને શોધતી હતી તેની સાથે એકરૂપ બની શકેલી છે. એ એક ઘણો ભવ્ય છતાં અમુક રીતે અવર્ગનીય એવો અનુભવ છે. આ અનુભવ જ્યારે તેઓ બીજાને આપવાને નીકળે છે ત્યારે ત્યારે તેમને એ અનુભવને

કાંઈક સ્વરૂપ તો આપવું જ પડે છે અને એ સ્વરૂપ બીજાઓને સમજાય તેવું બનાવવા માટે તેમને પોતાની વાણીને માનવ રીતની તથા એક સાર્કિટિક રૂપની કરવી પડેલી છે.

આમ હતાં આપણો એક પ્રશ્ન કરી શકીએ છીએ કે શું આવા અનુભવો તથા તેમાંથી પ્રગટ થતી વસ્તુઓમાંથી જ આ રીતનો પુરુષને સ્વી કરતાં પોતાની શ્રેષ્ઠતાનો હમેશાં રહેતો ભાવ જન્મેલો છે કે પછી જગતમાં આ રીતનો શ્રેષ્ઠભાવ આટલા બધા પ્રમાણમાં વ્યાપક છે તેને લીધે જ આ અનુભૂતિઓ આવા સ્વરૂપમાં ફળાઈ હશે?

ગમે તે હો, હૃકીકત આવી છે એમાં તો કોઈ શક નથી જ. પુરુષને એમ લાગે છે કે પોતે સ્વી કરતાં શ્રેષ્ઠ છે અને એ રીતે તે સ્વી ઉપર પોતાનો અધિકાર જમાવવા માગે છે. સ્વીને એમ થાય છે કે પોતાના ઉપર પુરુષ દમન ગુજારી રહેલો છે અને તે પુરુષ સામે પ્રગટ કે અન્ગટ રીતે બળવો કરતી રહે છે. અને આમ આ બે વચ્ચેનો કાયમ્ભી જગડો હરેક યુગમાં ચાલતો આવ્યો છે. અને આ સંધર્ઘનું મૂળ તત્વ તો એક જ છે હતાં તેનાં રૂપો અને છાયાઓ અનેક અનેક પ્રકારનાં બનતાં રહેલાં છે.

વળી એ વાત પણ સ્પષ્ટ છે કે આ પરિસ્થિતિનો આખો યે દોષ પુરુષ સ્વી ઉપર ઢોળતો રહે છે અને એ જ રીતે સ્વી પણ પુરુષ ઉપર આખો ને આખો દોષનો ટોપલો ઢોળતી રહે છે. પણ ખરી વાત તો એ છે કે આ દોષને સ્વી પુરુષ બંને વચ્ચે સરખે ભાગે વહેંચી દેવો જોઈએ અને સ્વી કે પુરુષ બેમાંથી એકે યે પોતાની શ્રેષ્ઠતાની બડાઈ મારતાં અટકી જવું જોઈએ. માનવજીતિમાંથી આ રીતનો શ્રેષ્ઠતા અને હીનતાનો ભાવ જ્યાં લગી નાબૂદ નહિ થાય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિ આ ગેરસમજૂતીનો અંત લાવી શકવાની નથી. માનજીતિમાં પડી ગયેલી આ બે સામસામી છાવણીઓ એવી ને એવી ટકી રહેશે અને આ પ્રશ્ન એવો ને એવો આણગિકલ્યો જ રહેશે.

આ વિષય ઉપર ઘણું ઘણું લખાયું અને કહેવાયું છે. એને અનેક જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી જોવામાં આવેલો છે. એ બધાનું નિરૂપણ કરવા માટે તો એક આખો ગ્રંથ લખવો પડે. આ અંગે સામાન્ય રીતે એમ કહી શકાય કે આ વિષયમાં રજૂ થયેલા સિદ્ધાંતો તો બધા ઘણી ઉત્તમ રીતના જ છે. એ દરેક સિદ્ધાંતમાં તેનો પોતાનો અમુક ગુણ રહેલો જ છે. પરંતુ એ સિદ્ધાંતોનો અમલ બહુ સુખદાયક બનેલો નથી. અને આ વિષયમાં માનવજીતિએ કેટલી પ્રગતિ સિદ્ધ કરી છે એ જોવા જઈશું તો પથ્થર યુગના લોકો કરતાં આપણો કાંઈ આગળ વધ્યા છીએ કે કેમ એ કહેવું મુશ્કેલ બની

જાય તેમ છે. આજે પણ સ્વી અને પુરુષ પોતાના પરસ્પર વ્યવહારમાં એકબીજા પ્રત્યે તદ્દન જુલમગાર માલિકની રીતે જ વર્તતાં હોય છે અને સાથે સાથે એકબીજાની કંઈક દ્યાજનક રીતની ગુલામી પણ કરતાં રહે છે.

હા, સ્વી-પુરુષ એકબીજાનાં ગુલામ જ છે. જ્યાં લગી તમારામાં કામનાઓ, રાગદ્રોષો અને આસક્તિઓ હશે ત્યાં સુધી તમે એ વસ્તુઓના ગુલામ જ હો છો તેમ જ આ બધાની તૃપ્તિ માટે તમારે જે વ્યક્તિના ઉપર આધાર રાખવો પડશે તેની તમારે ગુલામગીરી જ કરવાની રહેશે.

આ રીતે જોતાં સ્વી પુરુષની દાસ છે. તેને પુરુષ પ્રત્યે, પુરુષની શક્તિ પ્રત્યે આકર્ષણ છે. સ્વીને ‘ગૃહ’ જોઈતું હોય છે, એ ગૃહમાંથી ભળતી સલામતી તેને જોઈતી હોય છે. સૌથી વિશેષ તો સ્વીને માતૃત્વની આસક્તિ વળગેલી છે. આ બધી વસ્તુઓ સ્વીને પુરુષની દાસ બનાવી રાખે છે. એ જ રીતે પુરુષ પણ સ્વીનો દાસ છે. એનામાં સ્વામિત્વનો ભાવ રહેલો છે. તે સત્તા અને આધિપત્ય માટે તલસતો હોય છે, તેનામાં જીતીય સંબંધની ભૂખ છે. પરિણીત જીવનમાંથી ભળતી નાની મોટી સુખસગવડોમાં તેને આસક્તિ છે. અને આ બધું તેને સ્વીનો દાસ બનાવી રાખે છે.

વસ્તુસ્થિતિ આમ છે એટલે જ કોઈ પણ કાયદો સ્વીને મુક્ત કરી શકવાનો નથી. આ મુક્તિ સ્વીએ પોતે જ મેળવવાની છે. એ જ પ્રમાણે પુરુષો પણ, તેમને સ્વી ઉપર અમલ ચલાવવાની આટલી બધી ટેવ પડી ગયેલી છે છતાં સ્વીના દાસ મટી શકવાના નથી. તેઓ પોતાની આંતરિક ગુલામીમાંથી મુક્ત થશે ત્યારે જ તેમનું આ દાસત્વ ટળશે.

આમ સ્વી-પુરુષ વચ્ચે એક ગુપ્ત સંઘર્ષ ચાલી રહેલો છે. ઘણી વાર જો કે આ સંઘર્ષના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવતો નથી છતાં સારામાં સારી વ્યક્તિઓની બાબતમાં પણ એમની અવયેતનામાં તો એ સંઘર્ષ હુંમેશાં પેદ્લો હોય જ છે. માણસો જ્યારે પોતાની ચેતનામાંથી ઉપર જઈને પૂર્ણ ચેતના સાથે પોતાને એકરૂપ કરશે, પરમ સત્ય સાથે પોતાનું અદૈત સિદ્ધ કરશે ત્યારે જ આ સંઘર્ષ ચાલ્યો જશે. એમ નહિ થાય ત્યાં લગી એ અનિવાર્ય રીતે રહેવાનો જ છે. તમે જ્યારે આ ઊર્ધ્વ ચેતના પ્રાપ્ત કરો છો ત્યારે તમને દેખાય છે કે સ્વી અને પુરુષ વચ્ચેનો આ ભેદ છેવટે તો માત્ર શરીર પૂરતો જ ભેદ છે.

હા, પૃથ્વી ઉપર શરૂઆતમાં એક નરી શુદ્ધ પુરુષજ્ઞતિ તેમ જ શુદ્ધ સ્વીજ્ઞતિ અસ્તિત્વમાં રહેલી હોય એવો સંભવ છે ખરો, અને એ દરેક જીતિને પોતપોતાનાં સ્પષ્ટ રીતે બિન્ન લક્ષણો પણ હશે. પરંતુ વખત જતાં આ બંને યોનીઓ વચ્ચે

અનિવાર્ય રીતે ભિશ્રાણ થવા લાગ્યું, આનુવંશિકતાનું તત્ત્વ દાખલ થયું, છોકરાઓમાં પોતાની માતાનાં લક્ષણો આવવા લાગ્યાં, છોકરીઓમાં પિતાનાં લક્ષણો આવવા લાગ્યાં, આખો સમાજ પ્રગતિ કરવા લાગ્યો, સ્વી-પુરુષો એક જ સરખા ધંધામાં કામ કરવા લાગ્યાં — આ બધાને લીધે આજના યુગમાં કોઈ પણ જાતિને શુદ્ધ રૂપે જોવાની આશા અશક્ય જેવી બની ગઈ છે. તમામ પુરુષોમાં ઘણી ઘણી રીતે સ્વીઓનાં લક્ષણો આવી ગયેલાં છે, તેમ જ સ્વીઓમાં પણ, ખાસ કરીને આજના અર્વાચીન સમાજોમાં ઘણી ઘણી બાબતોમાં નરજાતિનાં લક્ષણો આવેલાં છે. પરંતુ આ બંને જાતિઓને એકબીજાની સાથે તકરાર કરવાની પેઢીટેવ, એ બંનેના શારીરિક દેખાવને કારણે, કમભાગ્યે ચાલુ જ રહી છે, અને આજના જગતમાં તો સ્પર્ધાની ભાવના તેમાં ઉમેરાતાં કદાચ એ વધુ ઉગ્ર પણ બનેલી છે.

સ્વી તથા પુરુષ બંને પોતાની ઉત્તમોત્તમ અવસ્થામાં તો આ જાતિનું તત્ત્વ ભૂલી જઈ શકે છે, પણ એ અંગેનું સહેજ અમયું પણ જો કોઈ ઉતેજન મળી આવે છે, તો એ તત્ત્વ પાતું જાગ્રત થઈ આવે છે. સ્વીને થવા લાગે છે કે હું સ્વી છું, પુરુષ જાણે છે કે હું પુરુષ છું. અને એમ પાછો આ જગડો, એક કે બીજા સ્વરૂપે, ખુલ્લી કે ઢાંકી રીતે, અનિશ્ચિત કાળ માટે પાછો શરૂ થઈ જાય છે. અને આ સંઘર્ષ જેમ વધુ ગૂઢ રીતનો, અસ્વીકૃત રીતનો હોય છે તેમ તેનું સ્વરૂપ વધુ કાતિલ હોય છે. અને આ જોતાં તો એમ જ પ્રશ્ન થાય છે કે આ સંઘર્ષનો કદી અંત આવશે ખરો? પુરુષ અને સ્વી પોતાના પુરુષ અને સ્વીપણામાંથી નીકળી જઈને, કેવળ આત્મારૂપ બની રહે અને પોતે બંને એક જ મૂળ તત્ત્વમાંથી આવેલાં છે એ વસ્તુનો એક તદન જાતિ વિનાના શરીરમાં આવિર્ભાવ કરી બતાવે ત્યાં સુધી આ સંઘર્ષ શું ચાલ્યા જ કરવું પડશે?

આપણું તો એક એવા જગતનું સ્વર્ણ છે કે જેમાં આ બધા વિરોધો આખરે અદૃષ્ય થઈ ગયેલા હશે. એ જગતમાં એક નવો માનવ હુસ્તીમાં રહી શકશે અને દિનોદિન વૃદ્ધિ પામતો જશે અને તેનામાં માનવના સર્જનમાં રહેલી સર્વ ઉત્તમોત્તમ વસ્તુઓનો સંવાદમય સમન્વય આવી બનેલો હશે. તેનામાં સંકલ્પ અને તેના અમલની કિયા, દર્શન અને તે મુજબનું સર્જન એ બંને એક જ ચેતના અને કિયામાં એકરૂપ બનેલાં હશે.

આ પ્રશ્નનું નિરાકરણ હિંદમાં આ રીતની સુખદ અને આમૂલ રીતે નહિ સધાય ત્યાં લગ્ની આ દેશ, બીજી ઘણી બાબતમાં બનતું રહેલું છે તે મુજબ આ બાબતમાં પણ એક ઘણા ઉગ્ર અને વિરોધાત્મક વિરોધોની ભૂમિ બની રહેશે. પરંતુ એ વાત તો ચોક્કસ છે કે આ સર્વ વિરોધોને એક મહા વિશાળ અને સંધારક એવા સમન્વયની

અંદર ઓગાળી દઈ શકાય છે.

આપણે જોઈએ છીએ કે આ હિંદમાં જ મા ભગવતીની એક અતિશાય તીવ્ર ભાવપૂર્વક, પરમ પ્રેમપૂર્વક પૂર્ણ આરાધના થઈ રહેલી છે. અને હિંદનું હદ્ય વિશ્વની વિધાત્રી તરીકે, શત્રુઓની વિજેત્રી તરીકે, સર્વ દેવો અને બ્રહ્માંડોની જનેતા તરીકે, સર્વ વરોની દાત્રી તરીકે આરાધે છે.

અને સાથે સાથે આપણે એ પણ જોઈએ છીએ કે આ જ હિંદની અંદર સ્વીતત્ત્વ પ્રત્યે એક મહા વિક્કારની અને તિરસ્કારની લાગણી પણ રહેલી છે. ક્રી તો પ્રકૃતિ છે, માયા છે, એક વિધ્વંસક ભાંતિ છે, સર્વ પતનો અને સંકટોનું મૂળ છે, એ મહા છેતરનારી, પાપમાં પાડનારી, પ્રભુથી માણસને દૂર દૂર લઈ જનારી વસ્તુ છે એમ કહેવાતું આવ્યું છે.

હિંદના આખા જીવનમાં આ રીતનો વિરોધ સર્વત્ર વ્યાપેલો છે. હિંદનું ચિત્ત તથા હદ્ય આ વિરોધથી કોરાઈ રહેલું છે. હિંદમાં સ્થળે સ્થળે દેવમંહિરોમાં દેવીઓની સ્થાપના છે અને એ દેવીઓ પાસેથી, અંબા અને દુર્ગા પાસેથી હિંદની પ્રજા પોતાના મોક્ષ અને મુક્તિની યાચના કરતી રહે છે. અને છતાં એક હિંદનો માણસ જ એમ કહે છે કે પ્રભુ સ્વીના શરીરમાં કદી પણ અવતાર લેવાના નથી. કેમ કે કોઈ પણ વિચારશીલ માણસ આ રીતે અવતાર પામેલા ભગવાનનો સ્વીકાર જ નહિ કરે ને! પણ સદ્ભાષ્ય, પ્રભુમાં આવો કોઈ સંકુચિત બેદભાવ હોતો જ નથી; અને તે કંઈ આવા ક્ષુદ્ર વિચારોથી પ્રેરાઈને ચાલતા નથી. પ્રભુ જ્યારે એક પાર્થિવ શરીરમાં પોતાનો આવિર્ભાવ કરવાને તૈયાર થાય છે ત્યારે પછી માણસો પોતાનો અવતાર તરીકે સ્વીકાર કરશે કે નહિ તેની તે લેશ પણ ફિકર કરતા નથી. અને એક બીજી વાત પણ છે કે પ્રભુએ જ્યારે જ્યારે અવતાર લીધેલો છે ત્યારે ત્યારે તેમણે પંડિત કરતાં બાળકો અને સરળ હદ્યનાં માણસો સાથે જ વધુ સંબંધ રાખવાનું પસંદ કરેલું છે.

તો આપણે આશા રાખીએ છીએ કે જગતમાં એક સમયે માનવમાં એક નવા વિચારનો અને એક નવી ચેતનાનો ઉદ્ય થશે. એ વિચાર અને ચેતના પ્રકૃતિને એક નવી માનવજીતિનું સર્જન કરવાની ફરજ પાડશે. એ માનવજીતિને પછી પશુધર્મની રીતે શરીરનું સર્જન કરવાની ફરજને વશ થવાપણું નહિ રહેશે. અને એ જાતિને એકબીજાની પૂર્તિ કરે તેવી બે યોનીઓ વચ્ચે વહેંચાઈ જવાની ફરજ નહિ પડશે. પરંતુ આવો સમય આવે ત્યાં સુધી આપણે એટલું તો કરીએ જ કે આ બંને જાતિઓને આપણે સંપૂર્ણ સમાનતાની રીતે જ જોતા થઈએ, બંનેને એક જ સરખી કેળવણી અને તાલીમ આપીએ, અને તે બંને સર્વ યોનીભેદોથી પર એવી એક હિદ્ય વાસ્તવિકતા સાથે સતત

સંપર્કમાં રહેતાં થઈને, જે મૂળ તત્ત્વમાંથી સર્વ શક્યતાઓ અને સંવાદિતાઓ પ્રગટ થાય છે તે તત્ત્વને પ્રાપ્ત કરે એવું જ્ઞાન તેમને શીખવીએ. અત્યારની માનવજાતિની પ્રગતિ માટે આપણે અત્યારે વધુમાં વધુ આટલું તો કરી જ શકીએ.

અને આમ થતાં કદાચ હિંદમાં જ, સર્વ વિરોધોની બનેલી આ ભૂમિમાં જ, માનવજીવનમાં નવા નવા સાક્ષાત્કારોની કલ્પના પ્રથમ તેના જ પારણામાં ઝૂલેલી છે તે મુજબ એ સર્વ સાક્ષાત્કારોની સિદ્ધિ પણ અહીં જ આવી બનશે.

(બુલેટિન, એપ્રિલ ૧૯૫૫)

\*

## વિભાગ - ૨

### સંદેશાઓ, પત્રો અને વાર્તાલાપો



## શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્ર

સને ૧૯૨૦ થી ૧૯૩૦ વર્ષેના સમયના ગાળામાં શ્રી માતાજી કેટલીક વ્યક્તિઓને ફેન્ચ શીખવતાં અને શિક્ષણના અન્ય વિષયોની બાબતમાં સામાન્ય રૂપનું માર્ગદર્શન આપતાં. તે સમયનું તેમનું શૈક્ષણિક બાબતોનું માર્ગદર્શન આટલા પૂરતું ભર્યાંદિત હતું. એક સામાન્ય નિયમ તરીકે, એ સમયે, બાળકોને આશ્રમમાં રહેવા આવવાની પરવાનગી અપાતી નહિ. ૧૯૪૦ પછીના ગાળામાં, આશ્રમમાં કેટલાંક કુટુંબોને પ્રવેશ અપાયો અને તેમનાં બાળકો માટે શિક્ષણનો પ્રબંધ શરૂ કરવામાં આવ્યો. તા. ૨ ડિસેમ્બર ૧૯૪૭ના રોજ, શ્રી માતાજીએ, આશરે વીસેક જેટલાં બાળકો માટે એક શાળાનું વિધિસરનું ઉદ્ઘાટન કર્યું. તેઓ પોતે પણ એક શિક્ષક તરીકે કામ કરતાં. ત્યાર પછીનાં સાત વર્ષોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધીરે ધીરે વધતી ગઈ.

તા. ૨૪ એપ્રિલ ૧૯૫૧ના રોજ શ્રી માતાજીએ એક સમારંભનું પ્રમુખસ્થાન સંભાળ્યું, ત્યાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે “એક આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠનું કેન્દ્ર” સ્થાપવું. તા. ૬ જાન્યુઆરી ૧૯૫૨ના રોજ, તેઓએ ‘શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ કેન્દ્ર’નું ઉદ્ઘાટન કર્યું. ૧૯૫૮માં તેનું નામ બદલીને ‘શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્ર’ રાખવામાં આવ્યું.

હાલમાં, આ શિક્ષણ કેન્દ્રમાં પૂરા અથવા અડધા સમય માટે કામ કરતા ૧૫૦ શિક્ષકો છે અને ૫૦૦ વિદ્યાર્થીઓ છે. એમાં બાલમંદિરથી માંડી ઉચ્ચતર શિક્ષણ સુધીની કક્ષાઓ આવી જાય છે. અભ્યાસકમાં વિનયન, ભાષાઓ, કલા, વિજ્ઞાન, સ્થાપત્ય, યંત્રકલા કૌશલ્ય અને ધંધાદારી કામગીરી માટેની તાલીમનો સમાવેશ થાય છે. આ સૌને માટે પુસ્તકાલયો, પ્રયોગશાળાઓ, ઉદ્યોગશાળાઓ અને નાટ્યકલા, નૃત્ય, સંગીત, ચિત્રકલા વગેરે માટે નાટ્યગૃહ અને સ્ટૂડિયોની સગવડ છે.

આ શિક્ષણ કેન્દ્રમાં કેવળ માનસિક તાલીમ આપવા પૂરતું જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું નથી. એથી ઉલ્લંઘન, વિદ્યાર્થીના વ્યક્તિત્વના દરેક પાસાને ખીલવવાનો ઉદેશ રાખવામાં આવે છે. આ કાર્ય માટે, જેને શ્રી માતાજી “સ્વતંત્ર પ્રગતિની પદ્ધતિ” કહે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં “જે પ્રગતિ કરવાની હોય છે તે આત્મા દ્વારા નિયંત્રિત હોય છે, અને એની ઉપર ટેવો, રીત-રિવાજો કે પૂર્વ નિર્ધારિત ઘ્યાલોનું કોઈ દબાણ લાદવાનું હોતું નથી.” દરેક વિદ્યાર્થી પોતે

પોતાની મેળે ભાણે એ માટે તેને ઉતેજન આપવામાં આવે છે. પોતાના વિષયો એણે પોતે જ પસંદ કરવાના હોય છે. અભ્યાસની ગતિ પણ તેને પોતાને અનુકૂળ લાગે તે રીતે નક્કી કરવાની હોય છે, અને છેવટે પોતાનો વિકાસ સાધવાનું કાર્ય તોણે પોતે જ પોતાના હૃથમાં લેવાનું રહે છે. શિક્ષકનું કાર્ય કોઈ માસ્તર જેવું નહિ પરંતુ એક માર્ગદર્શક અને માહિતી પૂરી પાડનારના જેવું હોય છે. વ્યવહારમાં, આ પદ્ધતિમાં, શિક્ષક અને વિદ્યાર્થી એ બંનેની ખાસિયતને અનુકૂળ આવે તે રીતની ગોઠવણી કરવામાં આવે છે. કેટલાકો હજી પણ પરંપરાગત શિક્ષણની પદ્ધતિ અપનાવે છે અને અમુક નક્કી કરેલા અભ્યાસક્રમ પ્રમાણે શિક્ષકનું માર્ગદર્શન મેળવે છે.


વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રોનો ફેન્ચ્યમાં અભ્યાસ કરવામાં આવે છે, બીજા વિષયો અંગ્રેજીમાં. દરેક વિદ્યાર્થીને પોતાની માતૃભાષા શીખવાનું ઉતેજન આપવામાં આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ ભારતની અને યુરોપની ભાષાઓ પણ શીખે છે.

આ શિક્ષણ કેન્દ્ર કોઈ ડિગ્રીઓ કે ડિપ્લોમાઓ આપતું નથી. આમ કરવાનું કારણ, વિદ્યાર્થીમાં જ્ઞાનપ્રાપ્તિના આનંદ પ્રત્યેની જાગૃતિ અને પ્રગતિ કરવાની અભીષ્ટા પેદા થાય એવો જે હેતુ છે તે સિદ્ધ કરવાનો છે. એમાં અન્ય કોઈ હેતુઓને ગૌણ ગણવામાં આવે છે.

\*

## સંદેશાઓ

શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્રના પ્રતીકની પાઇલ  
રહેલો સાકેતિક અર્થ



The effective manifestation of  
Ishwara and Ishwari in union.

— The Mother

પરમ ઈશ્વર અને ઈશ્વરી શક્તિના અકૃતનો સફળતાપૂર્વક  
આવિર્ભાવ કરવો.

— શ્રી માતાજી

\*

પોતાના કાર્યના વિકાસ માટે શ્રી અરવિંદ, જે સૌથી આધુનિક પદ્ધતિઓ  
ઉપલબ્ધ છે તેમાંથી એક એવી પદ્ધતિનો ખ્યાલ સેવતા હતા કે પોંડિયેરીમાં એક એવું  
આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠનું કેન્દ્ર સ્થાપવું જે આખી દુનિયાના વિદ્યાર્થીઓ માટે ખુલ્લું  
હોય.

એમ લાગે છે કે એમના નામને માટે સૌથી સુયોગ્ય સ્મૃતિચિહ્ન તે આ  
વિદ્યાપીઠની સ્થાપના બનશે. એના વડે તેમનું કાર્ય તેના જુસ્સામાં સહેજ પણ ઓટ  
આવ્યા વિના ચાલુ રહ્યું છે તેની એક સ્થૂલ અભિવ્યક્તિ બની રહેશે.

(૧૯૫૧)

\*

શ્રી અરવિંદ સ્મારક સંમેલન પ્રસંગે ઉદ્ઘાટન-સંદેશ

શ્રી અરવિંદ આપણી વચ્ચમાં હાજર છે અને પોતાની સર્જક પ્રતિભાના સર્વ  
સામર્થ્યપૂર્વક તેઓ આ યુનિવર્સિટી કેન્દ્રની રચનાના કાર્ય ઉપર અધ્યક્ષપદે વિરાજેલા

છે. તેઓએ જોયું હતું કે અતિમાનસનો પ્રકાશ આહીં આવીને આજની માનવજીતિમાં રહેલી ઉત્તમોત્તમ વ્યક્તિઓને એક નવી માનવજીતિના રૂપમાં પલટી આપશે અને એ રીતે પૃથ્વી ઉપર એક નવીન જ્યોતિનો, નવીન શક્તિનો અને નવા જીવનનો આવિર્ભાવ થશે. એ પ્રકાશને જીલવા માટે ભાવિની માનવ જીતિને તૈયાર કરવાનું એક ઉત્તમ સાધન તે આ રીતની યુનિવર્સિટી છે એમ તેઓ કેટલાયે વર્ષોથી વિચારતા હતા.

શ્રી અરવિંદના એક અતિપ્રિય આદર્શને સિદ્ધ કરવાના હેતુથી મળી રહેલા આ સંમેલનને હું શ્રી અરવિંદના નામે આજે ખુલ્લાં મુકું છું.

(૨૪ એપ્રિલ ૧૯૫૧)

\*

### વિદ્યાર્થીઓની પ્રાર્થના\*

અમારી અભીષ્ટા વીર યોગ્યા બનવાની છે. અમને તેવા બનાવો. જે ભૂતકાળ હજુ ટકી રહેવા મથામણ કરી રહ્યો છે તેની સામે અમે યુદ્ધ કરી વિજયી બનવા માગીએ છીએ કે જેથી, એ મહાયુદ્ધને પરિણામે જે ભાવિનો જન્મ થવાનો છે તે બની આવે, એમાંથી પછી નવીન વસ્તુઓનો આવિર્ભાવ થાય અને અમે એમને જીલી શકીએ.

(૬ જાન્યુઆરી ૧૯૫૨)

\*

મને સંપૂર્ણ ખાતરી છે, મને પૂરેપૂરો વિશ્વાસ છે, મારા મનમાં લેશમાત્ર શંકા નથી કે આ જે યુનિવર્સિટી આહીં સ્થપાઈ છે તે પૃથ્વી ઉપર જ્ઞાનની મહાન વિદ્યાપીડ બની રહેશે.

એમ થતાં પચાસ વર્ષ લાગે, સો વર્ષ લાગે, અને હું આહીં હોઈશ કે નહિ તે વિષે તમને શંકા થાય; હું હોઉં કે ન હોઉં, પરંતુ આ મારાં બાળકો મારું કાર્ય ચાલુ રાખવા માટે ઉપસ્થિત હશે.

અને આજે જે કોઈ આ દિવ્ય કાર્યમાં સહુકાર આપશે તેમને એક વિશિષ્ટ પ્રકારની સિદ્ધિમાં ભાગ લીધો હોવાનો આનંદ અને ગર્વ થશે.

(૨૮ મે ૧૯૫૩)

\*

\* શ્રી અરવિંદ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કેન્દ્રના ઉદ્ઘાટન સમયે અપાયેલી.

આપણે બીજાઓ જે કરી રહ્યા છે એ જ વસ્તુ (સહેજ વધારે સારી રીતે) અહીં કરવાની નથી.

આપણે તો, બીજાઓ જે કરી શકતા નથી, કેમ કે એ વસ્તુ થઈ શકે તેવી છે એવો એમને ખ્યાલ પણ નથી, એ અહીં કરવાની છે.

આપણે તો બાળક સમક્ષ, ભાવિનાં આ સંતાનો સમક્ષ, એ ભાવિનો માર્ગ ખોલી આપવાનો છે.

આ સિવાયની બીજી કોઈ વસ્તુ ખાતર મહેનત કરવા જેવી નથી, આ સિવાયની બીજી કોઈ વસ્તુ, શ્રી અરવિંદની સહાયને પાત્ર નથી. (૬ સપ્ટેમ્બર ૧૯૬૧)

\*

### વર્ગોનાં વાર્ષિક ઉદ્ઘાટનો માટેના સંદેશાઓ

એક બીજું વર્ષ પસાર થઈ ગયું, એની પાછળ એ કેટલાક ભારે તો કેટલાક દુઃખદાયી પદાર્થપાઠોનો બોજો પણ મૂકું ગયું છે.

અને હુવે એક નૂતન વર્ષ શરૂ થાય છે. એ એની સાથે પ્રગતિ અને સિદ્ધિની શક્યતાઓ લઈ આવ્યું છે. પરંતુ એ શક્યતાઓનો પૂર્ણપૂરો લાભ ઉઠાવી શકાય તે માટે, આપણે અગાઉના પદાર્થપાઠો પણ જાણી લેવા રહ્યા.

સૌથી અગત્યનું જ્ઞાન એ છે કે, તમામ પ્રકારના અક્સમાતો, અચેતનાનું પરિણામ હોય છે. તેમ છતાં, બાધ રીતે જોતાં, એમનાં કારણોમાં મુખ્ય તો અશિસ્ત, શિસ્ત પ્રત્યે એક પ્રકારની તિરસ્કારની ભાવના હોય છે.

આપણે એક અવિરત અને શિસ્તબદ્ધ પ્રયાસ કરીને એ વસ્તુ સાબિત કરી આપવાની રહે છે કે આપણે એક વધુ સયેતન અને વધુ સત્યપૂર્ણ જીવન માટે સત્યનિષ્ઠાપૂર્વકની અભીષ્ટા સેવીએ છીએ.

(૧૬ ડિસેમ્બર ૧૯૬૬)

સત્યને તમારો ગુરુ અને માર્ગદર્શક બનાવો.

આપણે આપણા સ્વરૂપમાં અને આપણાં કાર્યોમાં સત્યનો વિજય થાય તેવી અભીષ્ટા સેવીએ છીએ.

સત્ય માટેની અભીષ્ટા એ જ આપણા પ્રયત્નો પાછળની સક્રિય શક્તિ બની રહો. હું સત્ય! અમે તારું માર્ગદર્શન માળીએ છીએ. જગત ઉપર તારું રાજ્ય સ્થપાયો.

(૧૬ ડિસેમ્બર ૧૯૬૭)

જ્યારે આપણો સત્યમાં જીવન ધારણ કરતા હોઈએ છીએ ત્યારે સર્વ વિરોધાભાષોથી પર હોઈએ છીએ.

(૧૬ ડિસેમ્બર ૧૯૬૮)

તમે જે વસ્તુ શીખવવા દીચ્છતા હો તે તમે જીવી જાણી હોવી જોઈએ.

નૂતન ચેતના વિશે વાત કરવી હોય, તો એને તમારી અંદર પ્રવેશવા દો અને તેને એનાં રહસ્યો ખુલ્લાં કરવા દો કારણ કે ત્યારે જ તમે કોઈ વસ્તુ આધારભૂત રીતે કહી શકશો.

નૂતન ચેતનામાં આરોહણ કરવાની પહેલી શરત એ છે કે તમારું મન એટલું બધું નભે હોય કે તેને ખાતરી થયેલી હોય કે તમે જે બધું જાણો છો તે, હજુ જે જાણવાનું બાકી છે તેની સરખામણીમાં કાંઈ નથી.

જે કોઈ વસ્તુઓ તમે બાધ્ય રીતે શીખ્યા હો તે સર્વ તમને ઉર્ધ્વ જ્ઞાન પ્રત્યે આરોહણ કરવાના કેવળ એક પગથિયા સરખી લાગવી જોઈએ.

(૧૬ ડિસેમ્બર ૧૯૬૮)

જાણવાનું અને કરવાનું કામ નીરવતામાં જ થઈ શકે છે. જે કાંઈ કામ ઉશેરાટ અને હિંસક ભાવનાથી થતું હોય છે એ બધું ઉન્માદપૂર્ણ અને મૂર્ખમીભરેલું હોય છે.

આપણે અહીં અન્ય સ્થળો કરતાં વધુ સારું કાર્ય કરવા માટે અને અતિમાનસ ભવિષ્યને માટે છીએ. આ વસ્તુ કદ્દી પણ ભુલાવી જોઈએ નહિ. હું સૌ કોઈના અંતઃકરણની શુભેચ્છાની માગણી કરું છું કે જેથી આપણા આદર્શની સિદ્ધિ થાય.

(૧૬ ડિસેમ્બર ૧૯૭૧)

\*

## દિલહીની શ્રી માતાજીની આંતરરાષ્ટ્રીય શાળાને સંદેશા

પૃથ્વી ઉપર એક નવીન પ્રકાશ પ્રગટ થયો છે. આ જે નવી શાળાનું ઉદ્ઘાટન આજે થાય છે, તે એના વડે માર્ગદર્શન પામો.

આશીર્વાદ.

(૨૩ એપ્રિલ ૧૯૫૬)

સત્ય પ્રત્યેના અમારા પ્રયત્નોમાં અમે સાચી રીતે સત્યનિષ્ઠ બનીએ તેવું અમને શીખવો.

(૨૩ એપ્રિલ ૧૯૫૭)

ગઈ કાલનો સાક્ષાત્કાર આવતી કાલની સિદ્ધિ માટે કૂદકો લગાવવાનું પાટિયું બની રહે.

(૨૩ એપ્રિલ ૧૯૫૮)

પૃથ્વી ઉપર જે નૂતન જીવન આવિર્ભાવ પામી રહ્યું છે તેને માટે આપણે તૈયાર બનીએ.

(૨૩ એપ્રિલ ૧૯૫૯)

ઉત્તમ વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ હોય છે, ટેખાડો કરનાર નહિ.

(૨૩ એપ્રિલ ૧૯૬૦)

માતાજીની શાળા. સત્યનિષ્ઠા.

(૨૩ એપ્રિલ ૧૯૬૧)

સફળતાની માત્રા, સત્યનિષ્ઠાના પ્રમાણમાં હોય છે.

(૨૩ એપ્રિલ ૧૯૬૨)

ભાવિ આશાસ્પદ છે. એને માટે તૈયાર થાઓ.

(૨૩ એપ્રિલ ૧૯૬૩)

\*

અમદાવાદની મીરામિલકા હાઇસ્કૂલ માટેનો સંદેશ

શ્રીદ્રા અને સત્યનિષ્ઠા એ સફળતા માટેનાં જોડકાં છે.

આશિષ.

(૧૪ જૂન ૧૯૬૬)

\*

## લક્ષ્ય

### અમે અહીં શ્રી અરવિંદ આશ્રમમાં શા માટે છીએ?

કુદરતમાં એક વિકાસનો કમ ચાલી રહ્યો છે. એ વિકાસમાં કુદરત આગળ ને આગળ ઉંચે ગતિ કરતી રહેલી છે. એ રીતે કુદરત પથ્થરમાંથી વનસ્પતિમાં પહોંચી છે. વનસ્પતિમાંથી તે પ્રાણીમાં પહોંચી છે અને પ્રાણીમાંથી માણસમાં પહોંચી છે. આમ આ ઉંચે ચડી રહેલા વિકાસકર્મની ટોચ ઉપર આજે માનવ ઉભેલો છે. કુદરત ચડતી ચડતી માનવ આગળ અટકી છે. અત્યારે એ તેના ચડાવનું છેલ્લું પગથિયું છે. આ ઉપરથી માનવ એમ સમજે છે કે કુદરતના આ ચડાવની છેલ્લી હંદ હવે તેની આગળ જ આવી ગઈ છે. તે એમ માને છે કે પૃથ્વી ઉપર તેના કરતાં બીજી કોઈ વસ્તુ હોવાની નથી. પરંતુ આમ માનવામાં ભૂલ થાય છે. માણસ તેની બહારની સ્થૂલ પ્રકૃતિની અંદર હજી લગભગ પૂરેપૂરો પશુ જ રહેલો છે. હા, એ વિચાર કરી શકે છે, બોલી શકે છે. તોપણ તે પોતાની બાધ સ્થૂલ ટેવોની અંદર તેમ જ પોતાની વૃત્તિઓની અંદર પશુ જ છે. અને આવા અધૂરા પરિણામથી કુદરત સંતોષ પામીને અટકી જાય તે કદી બની શકે તેમ નથી. કુદરત તો એક એવા પ્રાણીનું સર્જન કરવા મથી રહી છે કે જે, માણસ અત્યારે પશુ કરતાં જેટલો આગળ વધેલો છે તેના જેટલું જ માણસ કરતાં આગળ વધેલું હશે. એ નવા પ્રાણીનો બાધ આકાર માણસના જેવો રહેશે ખરો, પણ તેની ચેતના મનોમય ચેતના કરતાં કેટલીયે આગળ વધેલી હશે, તેમ જ અવિદ્યાની ગુલાભીમાંથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલી હશે.

માનવોને આ સત્ય શીખવવા માટે શ્રી અરવિંદ પૃથ્વી ઉપર આવ્યા હતા. તેમણે માનવોને કહ્યું કે માણસ એ મનોની ચેતનામાં જીવનું એક વયલી અવસ્થાનું પ્રાણી છે. પરંતુ તે એક એવી નવી ચેતના મેળવી શકે તેમ છે કે જે એક ઋત-ચેતના હશે, સત્યની બનેલી ચેતના હશે. વળી તે એવું જીવન ગાળી શકે છે કે જેમાં સંપૂર્ણ સંવાદમયતા આવી રહેલી હશે, જે શુભ અને સુંદર હશે. એ જીવન સુખી હશે અને પૂરેપૂરું સંશોધન હશે. શ્રી અરવિંદ પૃથ્વી ઉપર રહ્યા તે દરમિયાન તેમણે પોતાનો સારો યે સમય પોતાની અંદર આ ચેતનાની સ્થાપના કરવા માટે આપ્યો હતો, અને એ ચેતનાનો સાક્ષાત્કાર કરવા માટે જે લોકો તેમની આસપાસ એકત્ર થયેલા હતા તેમને તે મદદ કરતા રહેલા હતા. આ ચેતનાને તેમણે અતિમનસ એવું નામ આપેલું છે.

તેમે બહુ નાની વયે આશ્રમમાં આવ્યાં છો એ તમારા માટે એક ઘણ્ણો જ

મોટો લાભ છે. અત્યારે તમે હજુ મુલાયમ છે, વાળ્યાં વાળી શકાય તેવાં છો અને તેથી આ નવા આદર્શ મુજબનો ઘાટ તમે લઈ શકશો અને પેલી નવી આવનારી માનવજીતિના તમે પ્રતિનિધિ બની શકશો. અહીંની આશ્રમની અંદર જે વાતાવરણ છે, અહીંનો જે પ્રભાવ છે, અહીંનું જે શિક્ષણ છે, અને તમારી આગળ અહીં જે જીવન દૃષ્ટાંત રૂપે રહેલું છે, તે બધું તમારા વિકાસ માટે એક સારામાં સારી પરિસ્થિતિ પૂરી પાડે છે. અને લીધે તમે આ અતિમનસ ચેતનાની અંદર જાગ્રત થઈ શકશો અને એ ચેતનાના નિયમ મુજબનો વિકાસ સાધી શકશો.

એટલે હવે તમારા ભાવિનો બધો આધાર તમારામાં જે રીતનો સંકલ્પ હશે અને તમારા હૃદયમાં જેટલી સચ્ચાઈ હશે તેના પર રહે છે. તમારો જો એ સંકલ્પ હશે કે તમારે હવે એક સામાન્ય માણસ જેવું કદી રહેવું નથી, થોડાક આગળ વધેલા એવા પ્રાણી રૂપે જ નથી રહેવું, પણ શ્રી અરવિંદે જે અતિમનસ ચેતનાનો આદર્શ આપેલો છે તેનો સાક્ષાત્કાર કરીને તમારે એક નવી માનવજીતિના મનુષ્યો બનવું છે, એક નવી પૃથ્વી ઉપર એક નવું અને ઉચ્ચ પ્રકારનું જીવન જીવવું છે, તે પછી તમારા એ ધ્યેયને સિદ્ધ કરવા માટે જે કાંઈ મદદની જરૂર હશે તે સધળી તમને અહીં મળી રહેશે, તમે આશ્રમાં આવીને રહ્યા છે તેનો પૂરોપૂરો લાભ ઉઠાવી શકશો અને છેવટે જગતને માટે તમે એક જીવતાજગતા દૃષ્ટાંત રૂપ બની રહેશો.

(૨૪ જુલાઈ ૧૯૫૧)

\*

આપણા શિક્ષણ કેન્દ્રનો સાચો હેતુ અથવા લક્ષ્ય શું છે? એમાં શ્રી અરવિંદની કૃતિઓ શીખવવાની છે; અને ફક્ત એટલું જ? અથવા એમાંની બધી કે થોડી કૃતિઓ? અથવા તો પછી એમ છે કે વિદ્યાર્થીઓને શ્રી અરવિંદ અને માતાજીનાં લખાણો વાંચી શકે તે માટે તૈયાર કરવા? એ હેતુ વિદ્યાર્થી ઓને આશ્રમ-જીવન માટે તૈયાર કરવાનો છે કે વધુમાં બીજા “બહુરના” ધંધાઓ માટે પણ? આ બાબતમાં વાતાવરણમાં બિન્ન બિન્ન અભિગ્રાહો પ્રવર્તે છે અને જે જૂના સમયના લોકો વિષે અમે એવી અપેક્ષા રાખી શકીએ કે તેઓ એ વસ્તુ જાણતા હશે, એવા લોકો પણ એવાં બિન્ન બિન્ન વિધાનો કરે છે કે શું માનવું અને શાના આધારે કાર્ય કરવું. જો અમારી પાસે સાચું ખાતરીપૂર્ણ શાન ન હોય તો અમે કયા પાચા ઉપર કાર્ય કરી શકીએ? માતાજી, મારી ગ્રાર્થના છે કે આપ અમને આ બાબતમાં માર્ગદર્શન આપો.

આમાં કોઈને આ કૃતિઓ કે તે કૃતિઓ વાંચવા માટે તૈયાર કરવાનો પ્રશ્ન જ નથી. આમાં ખરો પ્રશ્ન તો એ છે કે સામાન્ય માનવજ્ઞતિ જે ચીલાચાલુ વિચારો, લાગણીઓ અને કાર્યોમાં જકડાયેલી રહે છે તેમાંથી, જે લોકોમાં એવી શક્તિ હોય, તેમને બહાર ભેંચી કાઢવા, એમાં એ પણ છે કે જે લોકો અહીં છે તેમને સામાન્ય માનવજ્ઞતિની રીતના વિચારો અને કાર્યોની ગુલામીમાંથી મુક્ત કરવા; અને જે લોકો અમારી વાત સાંભળવા ઈચ્છુક હોય તેમને એ વસ્તુ શીખવવી એ જીવનના એવા રાહ કરતાં અન્ય અને વધુ સાચો માર્ગ અસ્તિત્વમાં છે; શ્રી અરવિંદે આપણે સાચા વ્યક્તિ સ્વરૂપ કેવી રીતે બની શકીએ અને એ સ્વરૂપમાં જીવન જીવી શકીએ એ આપણને શીખવેલું છે — અને છેવટે, અહીંના શિક્ષણનો હેતુ એ છે કે બાળકોને આ વસ્તુઓ માટે તૈયાર કરવાં અને એ મ્રકારના સાચા જીવન માટે યોગ્ય બનાવવાં.

બીજી બધી વસ્તુઓ માટે, સામાન્ય મનુષ્યની રીતે વિચારવા અને જીવવા માટે, દુનિયા ઘણી વિશાળ છે અને એમાં સૌ કોઈને માટે સ્થાન છે.

અમારે કોઈ અમુક સંખ્યા જોઈતી નથી — એમાં તો પસંદગી કરીએ છીએ; અમારે અહીં તેજસ્વી વિદ્યાર્થીઓ જોઈતા નથી, અમારે તો અહીં જીવંત આત્માઓ જોઈએ છે.

***It is not a number that we want – it is a selection,  
it is not brilliant students that we want, it is living  
souls.***

-The Mother

\*

એ વસ્તુ જાણીતી થવી જોઈએ અને આપણે ખુલ્લેખુલ્લાં એમ કહેતાં અયકાવું જોઈએ નહિ કે આપણી શાળાનો હેતુ તો એવા લોકોને શોધી કાઢીને ઉતેજન આપવાનો છે કે જેઓ એટલા પ્રમાણમાં સભાન બન્યા હોય કે તેમને પોતાના જીવનનું ઘડતર કરવા માટે પ્રગતિ કરવાની જરૂરિયાત સમજાઈ ગઈ હોય.

\*

અહીં થઈ રહેલા કામને દુનિયાની દૃષ્ટિએ જોઈએ, અથવા તો જેટલું પરિણામ સિદ્ધ થયું છે તે રીતે જોઈએ તો વસ્તુઓ હજુ પણ વધારે સારી રીતે થઈ શકે તેમ છે. પરંતુ હું તો અહીંના કાર્યની પાછળ જે શક્તિ રેડવામાં આવેલી છે, ‘શક્તિ’

શબ્દના ઉંડામાં ઉંડા અર્થમાં, તે વિષે વાત કરું છું. કામ એ પ્રભુને શરીર દ્વારા કરેલી પ્રાર્થના છે. અને હું તમને કહીશ કે, તમારા કામ પાછળ તમે જે શક્તિ ખરચેલી છે તેનાથી ભગવાન સંતુષ્ટ છે, તમારા કાર્યને પરમ ચેતનાની જે દૃષ્ટિ નિહાળી રહેલી છે તે એ જોઈને ખરેખર પ્રસન્ન છે. માણસની દૃષ્ટિએ જોતાં, આ વસ્તુઓ થઈ છે તે કરતાં પણ વધુ સારી ન થઈ શકે એમ તો નથી જ. પરંતુ અમારે માટે, અહીંની આ પ્રવૃત્તિ તે અમારી અનેક પ્રવૃત્તિઓમાંની એક છે, અમારી સાધનાની અનેક ગતિઓમાંની એક ગતિ છે. અમે બીજાં પણ અનેક કામો હાથ ધરેલાં છે. આ સમગ્ર કાર્યમાંની કોઈ એક વસ્તુને સંપૂર્ણતાએ લઈ જવી હોય તો તે માટે પછી વખતની જરૂર રહે છે, સાધનસંપત્તિની જરૂર રહે છે, અને તે બધું અમારી પાસે નથી. પરંતુ અમે કોઈ એક જ વસ્તુમાં સંપૂર્ણતા નિપાજાવવા માગતા નથી, અમારું લક્ષ્ય તો એક સમગ્ર પ્રકારની સિદ્ધિનું છે.

બાધ દૃષ્ટિએ જોતાં અહીં ઘણી વસ્તુઓ ટીકાપાત્ર, અને તે પણ ઘણી ઘણી ટીકાપાત્ર જણાશે, પરંતુ આંતરિક દૃષ્ટિએ જોતાં તો અહીં જે કાંઈ થયું છે તે સારી રીતે જ બનેલું છે. બાધ દૃષ્ટિએ જોવા જતાં તમે હુરેક રીતનાં મનોમય, બૌદ્ધિક ચણતરો લઈને આવો છો અને તમને લાગે છે કે અહીં જે થઈ રહ્યું છે તેમાં કશું અસાધારણ નથી. પરંતુ આ રીતે જોવા જતાં તમે અહીં બાધની પાછળ જે ચીજ આવી રહેલી છે — સાધના, અને જોવાનું ચૂકી જાઓ છો. પણ જો કોઈ ઉંડી ચેતના અહીં આવીને જોશે તો અને જણાશે કે અહીં એક એવા સાક્ષાત્કાર પ્રત્યે કૂચ થઈ રહેલી છે કે જે સાક્ષાત્કાર જગતના સર્વ સાક્ષાત્કારો કરતાં પણ મહાન છે. બહારની દૃષ્ટિ આધ્યાત્મિક જીવનને જોતી નથી, એ માત્ર પોતાની અલ્પતાના માપે જ માપતી રહે છે.

કેટલાક લોકો આપણી યુનિવર્સિટીમાં જોડાવા માટે લાખે છે અને પુછાવે છે કે અમે કઈ રીતના ડિપ્લોમા કે ડિગ્રી માટે વિદ્યાર્થીને તૈયાર કરીએ છીએ, કઈ રીતની કારકિર્દી વિદ્યાર્થીને માટે ખોલી આપીએ છીએ. એ લોકોને હું કહું છું કે તમારે એ જોઈતું હોય તો કૃપા કરી બીજે ક્યાંક જાઓ. બીજી ઘણી જગાઓ છે, અને તે અમારા કરતાં ઘણી વધારે સારી છે, અને આ વિષયો અંગે તો હિંદમાં પણ બીજી સંસ્થાઓ છે. અમારી પાસે એ સંસ્થાઓની સાધનસામગ્રી કે ભવ્યતા નથી. તમારે જોઈએ છે તેવી સફળતા તમને ત્યાં મળી રહેશે. અમે એ બધાં સાથે સ્પર્ધામાં ઊત્તરવા માગતા નથી. અમે એક જુદા ક્ષેત્રમાં, એક જુદી ભૂમિકા ઉપર જ કામ કરીએ છીએ.

પરંતુ આનો અર્થ એમ નથી કે તમે બીજાં માણસો કરતાં વધારે ઉચ્ચ કોટિના છો એવો ખ્યાલ તમારા મનમાં સેવવા લાગો. સાચી ચેતના પોતે બીજા કરતાં શ્રેષ્ઠ છે એમ માની શકતી જ નથી. માત્ર અલ્પ ચેતનાવાળા જ લોકો પોતે બીજા કરતાં

સારા છે એમ બતાવવા પ્રયત્ન કરે છે. અને આવા માણસ કરતાં તો એક બાળક પણ વધારે વિકાસ પામેલું હોઈ શકે છે, કેમ કે એની કિયાઓમાં એક સાહજિકતા રહેલી હોય છે. એટલે તમે હરેક રીતની અલ્પતામાંથી ઉપર ચાલ્યા જાઓ. તમારો ભગવાન સાથે જે સંબંધ છે, તમે પ્રભુને ખાતર જે કરવા માગો છો એમાં જ માત્ર રસ લો. એ સિવાયની બીજી કોઈ વસ્તુમાં તમારું મન પરોવશો નહિ. જગતમાં આ જ એક વસ્તુ સૌથી વધુ રસદાયક છે.\*

(૩૦ નવેમ્બર ૧૯૫૫)

\*

આપણે અહીંં એશારામભર્યુ જીવન ગાળવા માટે આવેલાં નથી. આપણે તો અહીંં પ્રભુને શોધવા, પ્રભુ બનવા, પ્રભુનો આવિર્ભાવ કરવાને માટે આવ્યાં છીએ.

આપણું શું થશે તે પ્રભુને જોવાનું છે, આપણે નહિ,

જગતની અને આપણી પ્રગતિ થાય તે માટે શું કરવું તે સારું, એ વિષે પ્રભુ આપણા કરતાં વધુ સારી રીતે જાણો છે.

(૨૩ ઓગસ્ટ ૧૯૬૭)

\*

સેવાની ભાવના કેળવવી એ પણ અહીંની તાલીમનો એક ભાગ છે, એને લઈને આપણું ભાણતર પૂર્ણ બને છે.

(૧૩ જૂન ૧૯૭૧)

\*

ધાર્મિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણને એક જ માનીને ગોટાળો ઊભો ન કરશો.

ધાર્મિક શિક્ષણ એ ભૂતકાળને લગતી વસ્તુ છે અને એનાથી પ્રગતિ રૂંધાય છે.

આધ્યાત્મિક શિક્ષણ એ ભવિષ્ય માટેનું શિક્ષણ છે — એ ચેતનાને ઉજજવળ કરીને ભવિષ્યના સાક્ષાત્કારો માટે તૈયાર કરે છે.

આધ્યાત્મિક શિક્ષણની કક્ષા ધાર્મિક શિક્ષણની ઉપરની છે, એ એક જગત-વ્યાપી સત્ય પ્રત્યે આગળ વધવા યત્ન કરે છે.

---

\* આ લખાણ, શ્રી માતાજીના કથનને એક સાધકે સ્મૃતિમાંથી નોંધી તૈયાર કરેલું અને શ્રી માતાજીએ એને પ્રસિદ્ધ કરવા માટે પરવાનગી આપેલી.

એ આપણને પ્રભુ સાથે સીધેસીધો સંબંધ બાંધતાં શિખવાડે છે.

(૧૨ ફેબ્રુઆરી ૧૯૭૨)

\*

શિક્ષણનો હેતુ કોઈ મનુષ્યને જીવન અને સમાજમાં સફળતા મળે તે માટે તૈયાર કરવાનો નથી, પરંતુ અને માટે શક્ય હોય તેટલા પ્રમાણમાં તેની પૂર્ણત્વ – ક્ષમતામાં વધારો કરવાનો છે.

\*

સફળતાનું લક્ષ્ય ન રાખો. આપણું લક્ષ્ય તો પૂર્ણતા છે. યાદ રાખો કે તમે એક નૂતન જગતના ઉભરે છો, તમે એના જન્મની કિયામાં અને એના સર્જનમાં ભાગ લઈ રહ્યા છો અને એક સાધનરૂપ બની રહ્યા છો, રૂપાંતર કરતાં કશું પણ વધુ અગત્યનું નથી. એથી વધુ રસ લેવા જેવી કોઈ બીજી ચીજ છે જ નહિએ.

\*

સામાન્ય રીતે કહીએ તો, શિક્ષણ, સંસ્કાર અને ઇન્ડિયોની સૂક્ષ્મગ્રાહિતા, મનુષ્યને તેની ગ્રામ્ય અંધપ્રેરણા, કામના અને લાલસાને શુદ્ધ કરવાનાં સાધનો તરીકે કામ લાગે છે – એ વસ્તુઓને ધ્વંસ કરવાથી એ સુધરતી નથી; એમ કરવાને બદલે આપણે તેમને કેળવવી જોઈએ, બુદ્ધિતત્ત્વવાળી અને સંસ્કારી બનાવવી જોઈએ. એમને સુધારવાનો સારામાં સારો માર્ગ એ જ છે. ચેતનાની પ્રગતિ અને વિકાસના પ્રમાણમાં તેમને પણ તેમનો વધુમાં વધુ વિકાસ સાધવા દેવો કે જેથી તમે સંવાદિતાની ભાવના અને સંવેદન અનુભવવામાં ચોકસાઈ પ્રાપ્ત કરી શકો – આ વસ્તુઓ પણ માનવ-સ્વરૂપની કેળવણી અને શિક્ષણના ભાગ રૂપે છે.

\*

## વિદ્યાર્થીઓને

તમે યુવાનો, આ દેશની આશારૂપ છો. આ અપેક્ષાને લાયક બનવા માટે તમે તમારી જાતને તૈયાર કરો.

આશીર્વાદ.

\*

એક વાતની ખાતરી રાખજો — તમારું ભાવિ તમારા જ હાથમાં છે. તમે જેવા મનુષ્ય બનવા ઈચ્છાતા હુશો તેવા તમે બની રહેશો. જેટલા પ્રમાણમાં તમારા આદર્શો અને અભીષ્ટાઓ ઉચ્ચ હુશો તેટલા પ્રમાણમાં તમે વધુ ઊંચી સિદ્ધિ હુંસલ કરી શકશો, પરંતુ તમારે તમારો નિશ્ચય દૃઢ રાખવો જોઈશો અને તમારા જીવનના સાચા ધ્યેયને કદી પણ વિસરવું જોઈશો નહિ.

(૨ એપ્રિલ ૧૯૬૩)

\*

યુવાન હોવું એટલે ભાવિમાં જીવવું.

યુવાન હોવું એટલે આપણે જેવા બનવું હોય તેવા થવા માટે, આપણે જેવા હોઈએ તેનો ત્યાગ કરવા તૈયાર રહેવું.

યુવાન હોવું એટલે જે સુધરી શકે તેવું ન હોય તેનો કદી પણ સ્વીકાર કરવો નહિ.

(૨૮ માર્ચ ૧૯૬૭)

\*

જે વર્ષો તમે નિરર્થક ગાળ્યાં હોય છે તે જ તમને વૃદ્ધ બનાવે છે.

નિરર્થક ગાળેલું વર્ષ એટલે કે તે દરમિયાન તમે કશી જ પ્રગતિ ન કરી હોય, ચેતનાનો વિકાસ ન કર્યો હોય, પૂર્ણતાની દિશામાં તમે આગળ ન વધ્યા હો.

તમારા પોતાના કરતાં કોઈ વધુ ઉચ્ચ અને વધુ વિશાળ વસ્તુને સિદ્ધ કરવા માટે તમારું જીવન સમર્પણ કરો અને જીવનમાં વહી જતાં વર્ષોનો ભાર તમને કદી નહિ લાગે.

(૨૧ ફેબ્રુઆરી ૧૯૫૮)

\*

તમે જેટલાં વર્ષ જીવ્યા હો છો તેટલાં વર્ષોની સંખ્યા તમને વૃદ્ધ બનાવતી નથી. વૃદ્ધ તો તમે ત્યારે બનો છો જ્યારે તમે પ્રગતિ કરવાનું બંધ કરો.

જ્યારે તમને લાગે કે તમારે જે કરવાનું હતું તે તમે કરી પરવાર્યા છો, જ્યારે તમને એવો વિચાર આવે કે જે કાંઈ જાણવાની જરૂર હતી તે જાણો લીધું છે, અને જ્યારે તમે એમ માનતા થાઓ કે તમે તમારા જીવનમાં પૂરતા પ્રમાણમાં કાર્ય કર્યું છે. અને તમને બેસીને આરામપૂર્વક તમારી મહેનતનું ફળ ભોગવવાનું મન થાય, ત્યારે તરત જ તમે વૃદ્ધ બની જાઓ છો અને તમારામાંથી જુસ્સો ઓસરવા લાગે છે.

આથી ઊલટું, તમને એમ જ લાગે કે તમારે જે જાણવાનું છે તેના પ્રમાણમાં તો તમે કાંઈ જ જાણતા નથી, જ્યારે તમને એમ લાગે કે જે કામ કરવાનું છે તેની તો તમે હજુ શરૂઆત જ કરી છે, જ્યારે તમને તમારું ભાવિ આકર્ષક સૂર્યના જેવું, સિદ્ધ કરવા જેવી અગાણિત શક્યતાઓથી ભરપૂર લાગે, ત્યારે તમે યુવાન હો છો; પછી પૃથ્વી ઉપર તમે ગમે તેટલાં વર્ષો વિતાવ્યાં હોય તેમ છતાં પણ તમે યુવાન અને આવતી કાલની સિદ્ધિની સમૃદ્ધિવાળા શ્રી-માન્દ હો છો.

અને તમારી દીદ્ધા એવી હોય કે તમારું શરીર તમને દગ્દો ન દે, તો તમે તમારી શક્તિઓનો વ્યર્થ ઉઝેરાટમાં બગાડન કરશો. તમે જે કાંઈ કરતા હો તે એક શાંત અને ધાવકાઈભરી રીતે કરો. શાંતિ અને મૌનમાં મહુાન બળ સમાયેલું છે.

(૨૧ ફેબ્રુઆરી ૧૯૬૮)

\*

એક સુખી અને કાર્યસિદ્ધ જીવન માટે સત્યનિષ્ઠા, વિનભ્રતા, ખંત અને પ્રગતિ માટેની એક અદ્ભુત તરસ હોય એ અત્યંત જરૂરી છે. સૌથી વધુ તો એ વાત છે કે, તમને એ વિષયની ખાતરી થઈ જવી જોઈએ કે જો પ્રગતિ કરવી હોય તો તેને માટેની શક્યતાઓનો કોઈ અંત નથી. પ્રગતિ જ યુવાની છે; સો વર્ષ ની ઉમરે પણ મનુષ્ય યુવાન હોઈ શકે છે.

(૧૪ જાન્યુઆરી ૧૯૭૨)

\*

જો ચેતનાના વિકાસને જ જીવનનું મુખ્ય ધ્યેય માનવામાં આવે તો ઘણીક મુશ્કેલીઓનો ઉકેલ આવી જાય.

વૃદ્ધ ન થવાનો ઉત્તમ રસ્તો એ છે કે પ્રગતિને જ જીવનનું ધ્યેય બનાવી લેવી.  
(૧૮ જાન્યુઆરી ૧૯૭૨)

\*

દરેક ક્ષાળે એક નૂતન જીવનમાં કેવી રીતે જન્મ પામતા રહેવું એ જાગ્રવામાં શાશ્વત ઘોવનની ચાવી રહેલી છે.

\*

તમારે કેવળ બુદ્ધિ વડે નહિ પરંતુ અંતઃકરણ વડે પણ ભાણવું જોઈએ, ચારિન્યની બાબતમાં પ્રગતિ કરવી જોઈએ; સદગુણો ખીલવીને ખામીઓમાં સુધારો કરવો જોઈએ; જે કોઈ વસ્તુ હોય તેનો પોતાને અજ્ઞાન અને અક્ષમતામાંથી ઉગાર કરનાર તરીકે ઉપયોગ કરી લેવો જોઈએ. જો આમ કરવામાં આવે તો જીવન અત્યંત રસભર્યું બની રહે છે અને એને ધારણા કરવાની મહેનત લેખે લાગે છે.

(૨૭ જાન્યુઆરી ૧૯૭૨)

\*

બાળક કદ્દી પોતાના વિકાસ માટે ચિંતા કરતું નથી, એ તે કેવળ વિકાસ પામ્યે જાય છે.

\*

બાળકના જેવા સરળ વિશ્વાસમાં એક મહાન શક્તિ રહેલી હોય છે...

(૧૭ નવેમ્બર ૧૯૫૪)

\*

જ્યારે કોઈ બાળક સ્વાભાવિક પરિસ્થિતિમાં જીવતું હોય છે ત્યારે તેનામાં એક એવો વિશ્વાસ સ્વયંભૂ હોય છે કે એને જે કાંઈ જોઈતું હશે તે આવી મળશે.

સમગ્ર જીવન દરમ્યાન આ વિશ્વાસ, વિચલિત થયા વિના, ટકી રહેવો જોઈએ. પરંતુ બાળકમાં તેની જરૂરિયાતો વિષેના જે મર્યાદિત, અજ્ઞાનમૂલક અને ઉપરછલા ઘ્યાલો હોય છે. તેમનું સ્થાન ઉત્તરોત્તર એક વિશાળ, ગહુન અને વધુ સત્યપૂર્ણ ઘ્યાલે લેવું જોઈએ. એને પરિણામે, એનામાં છેવટે જતાં પરમ જ્ઞાન અનુસાર એની જરૂરિયાતોનો સંપૂર્ણ ઘ્યાલ ઊપર્સી આવે છે. એ ઘ્યાલ અંતે એવી સમજણમાં

પરિણામે છે કે આપણી સાચી જરૂરિયાતો શું છે તે પ્રભુ જાણે જ છે અને એથી આપણે સર્વ વસ્તુઓ માટે એમના ઉપર આધાર રાખતા થઈ જઈએ છીએ.

(૧૯ નવેમ્બર ૧૯૫૪)

\*

સૌથી અગત્યની શરત તે વિશ્વાસ, એક બાળકના જેવો વિશ્વાસ, એક એવી પ્રતીતિપૂર્વકની લાગણી કે જે વસ્તુઓની જરૂરિયાત છે તે નિઃશંકપણે આવી મળશે જ. જ્યારે બાળકને કોઈ વસ્તુ જોઈતી હોય છે ત્યારે એને ખાતરી હોય છે કે એ આવી રહી છે. આ પ્રકારનો સરળ વિશ્વાસ અથવા નિર્ભરતા એ સૌથી અગત્યની શરત છે.

\*

બાળકોને કેમ બીક લાગે છે? કારણ કે તેઓ દુર્બળ હોય છે.

શારીરિક રીતે તેઓ તેમની આસપાસનાં મોટી ઉંમરનાં માણસો કરતાં દુર્બળ હોય છે. વળી પ્રાણુમાં અને મનમાં પણ તેઓ દુર્બળ હોય છે.

એક પ્રકારની કનિષ્ઠતાની લાગણીમાંથી ભય જન્મે છે, તેમ છતાં, એનાથી મુક્ત થવાનો એક માર્ગ છે; પ્રભુની કરુણામાં શ્રદ્ધા રાખવી અને હરેક સંજોગોમાં તેઓ તમારું રક્ષણ કરે તે માટે તેમના ઉપર આધાર રાખવો.

જેમ જેમ તમે મોટાં થતાં જશો તેમ તમે વધુ ને વધુ પ્રમાણમાં ભયની લાગણીમાંથી મુક્ત થતાં જશો — જો તમે તમારા અંતરાત્માને, એટલો કે તમારા સ્વરૂપના સત્યને, તમારી અંદર વિકાસ પામવા દેશો તો — અને જો તમે હુંમેશાં એવો પ્રયત્ન કરતા રહેશો કે તમે જે કાંઈ વિચારતા હો, જે કાંઈ બોલતા હો, જે કાંઈ કરતા હો એ બધુંય આ ગહન સત્યની અભિવ્યક્તિરૂપ હોય.

જ્યારે તમે એની અંદર સભાનાપણે જીવન ધારણા કરતા થશો ત્યારે પછી તમને કશાની બીક નહિ લાગે, તમારા સ્વરૂપના કોઈ પણ ભાગમાં ભય નહિ લાગે, કારણ કે આ વિશ્વને ચલાવી રહેલા વિરાટ સત્ય સાથે તમે એકરૂપ થયેલા હશો.

(૮ ઓગસ્ટ ૧૯૬૪)

\*

“મધુર માતાજી,

પોતે કોણ છે એ વસ્તુ, કોઈ બાળક તેનાં માતા-પિતા કે શિક્ષકની મદદ વિના કરી રીતે જાણી શકે?”

એ વસ્તુ તમારે તમારી જાતે શોધી કાઢવાની છે, પણ મન વડે નહિ.  
તમારામાંનું ચૈત્યસ્વરૂપ જ એ વસ્તુ તમને કહી શકશે.

“મા ભગવતી,

અમે જ્યારે નાનાં હોઈએ છીએ ત્યારે શું સારું અને શું ખરાબ, એ અમને શીખવવામાં આવે છે. એટલે અમે આખી જિંદગી “આ સારું છે, પેલું ખરાબ છે” એમ રટણ કર્યા કરીએ છીએ. પરંતુ હકીકતમાં શું સારું છે અને શું ખરાબ છે તેની જાણ અમને કઈ રીતે થઈ શકે?”

સાચું શું છે તે તો તમે પ્રભુ વિષે સભાન બનો ત્યારે જ ખબર પડે.

\*

“હું ભૂલ ન કરું, એવું કચારે બને?”

શું સાચું છે તે જાણો ત્યારે.

\*

પ્રભુ, અમે તને ગ્રાર્થીએ છીએ :

અમે અહીં શા માટે છીએ તે વધુ સારી રીતે સમજીએ,  
અમારે અહીં જે કાર્ય કરવાનું હોય તે સારી રીતે કરીએ,  
અમારે અહીં જેવા થવાનું હોય તેવા બનીએ,  
કે જેથી તારો સંકલ્પ સંવાદપૂર્ણ રીતે સિદ્ધ થાય.

(૧૫ જાન્યુઆરી ૧૯૬૨)

\*

દિવસ અને રાત સર્વ સમયે, અમારો પ્રયત્ન એ જ રહો કે અમે તને વધુ સારી રીતે સમજીએ, તારી વધુ સારી રીતે સેવા કરીએ.

(૧ જાન્યુઆરી ૧૯૭૩)

\*

હુ મધુર મા, એમ કર કે,

અત્યારે અને સદાકાળ માટે પણ,  
અમે તારાં,  
તારાં સરળ ચિત્ત બાળકો બનીએ,  
તને વધુ ને વધુ ચાહીએ.

\*

મારા હૃદયમાં એક મધુર નાનકડાં માતાજી બેઠેલાં છે. અમે બંને એક- બીજાની સાથે એટલાં બધાં સુખી છીએ કે અમે કદી વિભૂતાં નહિ પડીએ.

\*

**“મધુર માતાજી**

**જ્યારે જ્યારે હું તમને સાદ કરું છું ત્યારે ત્યારે તમે એ સાંભળો છો?”**

મારા વહુલા બાળક,

વિશ્વાસ રાખ કે જ્યારે પણ તું બોલાવે છે ત્યારે હું સાંભળું છું અને મારી મદદ અને શક્તિ સીધેસીધાં તારી પાસે આવી પહુંચે છે.  
આશિષ સાથે.

(૧ જૂન ૧૯૬૦)

**જન્મદિવસની શુભેચ્છા.**

હું મારા સમગ્ર હૃદય વડે તને આલિંગન આપું છું અને તારી ઊંચામાં ઊંચી અભીષ્ટા સિદ્ધ થાય એવા આશીર્વાદ આપું છું.

સપ્રેમ.

(૩૦ ઓગસ્ટ ૧૯૬૩)

**જન્મદિવસની શુભેચ્છા.**

અને સાથે ગુલાબો(સમર્પણ)નો એક મોટો ગુરુચ્છ, જેથી તારી અભીષ્ટા પરિપૂર્ણ થાય અને પોતાના આત્મા વિષે અને પોતાના જીવનના સાચા લક્ષ્ય વિશે સભાન એવું તું મારું આદર્શ બાળક બની રહે.

(૩૦ ઓગસ્ટ ૧૯૬૪)

\*

## વિદ્યાર્થીઓનાં બોર્ડિંગગૃહો માટે સંદેશા

### દોત્વર્ચ બોર્ડિંગનાં બાળકોને આપેલી ગ્રાર્થના

અમે સૌ અમારાં દિવ્ય માતાજીનાં સાચાં બાળકો બનવા ચાહીએ છીએ. પરંતુ એ માટે, મધુર માતાજી, અમને ધીરજ અને હિંમત, આજ્ઞાંકિતતા, શુભેચ્છા, ઉદારતા અને નિઃસ્વાર્થીપણું અને બીજા જે કોઈ સદ્ગુણોની જરૂર હોય, તે સર્વ વસ્તુઓ આપો.

અમારી ગ્રાર્થના અને અભીષ્ટા આ છે.

(૧૫ જાન્યુઆરી ૧૯૪૭)

\*

## મોટા છોકરાઓની બોર્ડિંગ માટે

આજનો દિવસ તમારા માટે એક નૂતન જીવનના પ્રારંભ સરખો બની રહો, જેમાં તમે વધુ ને વધુ પ્રમાણમાં સમજતા જાઓ કે તમે અહીં શા માટે છો અને તમારી પાસે શાની અપેક્ષા રાખવામાં આવે છે.

તમારાભાંથી સૌથી વધુ સંપૂર્ણ અને સૌથી વધુ સત્યપૂર્ણ પૂર્ણતા સિદ્ધ થાય એ માટેની અભીષ્ટામાં જ તમે હુંમેશાં જીવન ધારણ કરી શકો છો.

અને શકુંઘાત કરવા માટે, ગ્રામાણિક, સત્યનિષ્ઠા, સરળ ચિત્ત, ઉદાત્મ ભાવનાવાળા બનો અને કડક શિસ્ત અનુસાર વર્તન કરવા પ્રત્યે ધ્યાન આપો.

હું સદાય તમને સહાય કરવા અને માર્ગદર્શન આપવા હાજર હોઈશ

મારા આશીર્વાદ.

(૧૯૬૩)

\*

## દોત્વર્ચ બોર્ડિંગના વધારાના ભાગ માટે

આજે આપણે સૌ, જે એક સર્વસામાન્ય હાઈક સ્મૃતિમાં જોડાયેલાં છીએ તે સૌ, અભીષ્ટા સેવીએ કે આ ઉત્કટતા આપણામાં રહેલી સાચી એકતાનું પ્રતીક બની રહે અને એનો પાયો, વધુ સત્યપૂર્ણ અને વધુ સંપૂર્ણ સિદ્ધિઓ પ્રત્યેના સૌ કોઈના પ્રયત્ન ઉપર મંડાય.

(૧૫ જાન્યુઆરી ૧૯૬૮)

\*

## યુવાનો માટેની બોર્ડિંગને

તમારા આદરશને હંમેશાં વફાદાર રહો અને તમારા કર્તવ્યમાં સત્યનિષ્ઠ બનો.

\*

## અભ્યાસ

મારા વહુલા બાળક,

ગમે તે મારો થઈને જ્ઞાન આવે, પણ આપણે તેને પ્રાપ્ત કરી લેવા તૈયાર રહીએ, એ જ ખરું ડાપણ છે. આપણે આપણા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આપણે કોઈ કૂલ, કોઈ પ્રાણી, કોઈ બાળકમાંથી પણ ઘણી વસ્તુઓ શીખી શકીએ છીએ, કારણ આખા જગતમાં એક જ શિક્ષક છે — અને તે પ્રભુ, સર્વ વસ્તુઓ દ્વારા વ્યક્ત થાય છે.

મારા સધળા પ્રેમ સાથે.

(૯ માર્ચ ૧૯૬૭)

\*

સારું કામ કરી શકવા માટે તમારામાં સારી રસવૃત્તિ હોવી જોઈએ.

સારી રસવૃત્તિ, અભ્યાસ અને જે લોકોમાં એવી ઉત્તમ રસવૃત્તિ હોય તેમની સહાયથી કેળવાઈ શકે છે.

જાણવા માટે, સૌપ્રથમ તો તમને એ ઘ્યાલ હોવો જોઈએ કે તમે જાણતા નથી.

(૧૫ ડિસેમ્બર ૧૯૬૫)

\*

જ્યારે તમને લાગે કે તમે કંઈ પણ જાણતા નથી ત્યારે જ તમે શીખવાને માટે તૈયાર બનો છો.\*

(૧૫ ડિસેમ્બર ૧૯૬૫)

\*

આખો પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ તેમની શાળામાં તેમનું જ્ઞાન વધારવા અને સારું જીવન ગાળવા જે જાણવું જરૂરી છે તે શીખવા જાય છે — કે પછી તેઓ ડોળ કરવા

---

\* કલાકૌશલ્ય વિષેના અભ્યાસકમની શક્યાત્મક વખતે આપાયેલો સંદેશ.

જાય છે અને સારા માર્ક મેળવીને તેના વિષે મગદ્રીભરી બહાશ મારવા જાય છે.

શાશ્વત ચેતનાની સમક્ષ, અંતરની સચ્ચાઈનું એક બિંદુ, દંબ અને આત્મવંચનાઓના દરિયાથી વધુ મૂલ્યવાન હોય છે.

\*

જો, બેટા, કમનસીબી એ છે કે તું તારી જાતમાં વધુ પડતો ગૂંથાયેલો રહે છે. તારી ઉમરે હું સર્વ ભાવે મારા અભ્યાસમાં મન રહેતી હતી — માહિતી એકઠી કરતી, શીખતી, સમજતી, જાણતી. મારાં રસ અને કામના પણ એમાં જ સમાઈ ગયેલાં. મારી મા અમને — મારા ભાઈને અને મને — બહુ વહુલ કરતી, અમને કદી પણ બદમિજાજ કે અસંતુષ્ટ કે આળસુ થવા દેતી નહિ. જો અમે એની પાસે જઈને ગમે તે કોઈ વસ્તુ વિષે ફરિયાદ કરીએ કે આ અમને સંતોષ આપતું નથી તો તે હસતી અને ઠપકો આપતી : “આ શી મૂર્ખાઈ? આ રીતે હંસીપાત્ર ન બનો, જાઓ અને કામ કરો, અને તમારો મિજાજ ઠેકાણે છે કે નહિ તેના ઉપર કશું ધ્યાન ન આપો! એમાં મને લેશમાત્ર રસ નથી.”

મારી માનું વલણ તદ્દન સાચું હતું અને એણે મને જે શિસ્ત અને પોતાના કર્તવ્યમાં આત્મભાન ભૂલીને એકાગ્ર રહેવાની જરૂરિયાત વિષે જે શીખવ્યું છે તેને માટે હું તેની હમેશાની જાણી છું.

હું તમને આ બધું કહું છું તેનું કારણ એ છે કે જે ચિંતા વિષે તમે મને વાત કરો છો તેની પાછળ હુકીકત એ છે કે તમે તમારી જાતમાં વધુ પડતા કેદ થઈ ગયેલા છો. એના કરતાં, તમે જે કાંઈ કરી રહ્યા છો (ચિત્રકામ કે સંગીત) તમે વધુ ધ્યાન આપો તો વધુ સારું. તમારું મગજ હજુ બરાબર કેળવાયેલું નથી તેને ખીલવો, અને કોઈ અજ્ઞાની અને અસંસ્કારી મનુષ્ય બની રહેવું ન હોય તો જ્ઞાનનાં જે મૂળ તત્ત્વો તમારે જાહી લેવાં જોઈએ તેનો અભ્યાસ કરો.

જો તમે દરરોજ આઈ-નવ કલાક કામ કરશો તો તમને સારી રીતે ભૂખ લાગશે, તમે સારી રીતે ભોજન લેશશો, તમને શાંતભરી ઊંઘ આવશે અને તમારો મિજાજ ઢીક છે કે નહિ તે વિષે વિચારવાનો તમને વખત જ નહિ રહે.

આ વસ્તુઓ હું તમને હદ્યના પ્રેમપૂર્વક કહું છું અને હું આશા રાખું છું કે તમે તેમને એ રીતે સમજશો.

તમારી મા તમને ચાહે છે.

(૧૫ મે ૧૯૩૪)

\*

**“માતાજી, હું આપના જ સંકલ્પ અનુસાર વર્તવા માગું છું, બીજા કશા પ્રમાણે નહિએ.”**

તો પછી તમે જે માર્ગ લીધો છે તે હમણાં જ મૂકી દો — રખડવા અને છોકરીઓ જોડે વાતો કરવામાં સમય બરબાદ ન કરો. ફરીથી ઉત્સાહપૂર્વક કામે લાગી જાઓ, ભણો, અભ્યાસ કરો. તમારા મનને રસપ્રદ અને ઉપયોગી વસ્તુઓ પાછળ રોકો, અર્થહૃતીન ગાપ્યાં મારવામાં સમય ન બગાડો, અને તમારાં પ્રાણનાં આકર્ષણો માટે ખોટાં ખોટાં બહાનાં ન બતાવો. જો તમારી ઈચ્છા ખરા અંતરની હશે તો ખાતરી રાખજો કે વિજય પ્રાપ્ત કરવા માટે મારી શક્તિ તમને મળી રહેશે.

(૨૭ સપ્ટેમ્બર ૧૯૩૪)

**“જે દિવસોમાં હું અભ્યાસ નથી કરતો તે દિવસોમાં મને ઢીક નથી લાગતું, પરંતુ જ્યારે હું ભાગવાનું શરૂ કરું છું ત્યારે સુખ લાગે છે. મને આ ગ્રંથિયા સમજાતી નથી.”**

ગ્રંથિયા શબ્દથી તમે શું કહેવા માગો છો? એમાં કશી ગ્રંથિયા નથી. અભ્યાસમાં ચિત્ત પરોવવાને કારણો, સ્વાભાવિક રીતે જ ખરાબ લાગણી અદૃશ્ય થઈ જાય છે. અભ્યાસને લઈને, મનને એક તંદુરસ્ત પ્રવૃત્તિ મળે છે અને બીજું એ થાય છે કે તમારી ક્ષુદ્ર અહંકારના તમસમાં દૂબેલી વૃત્તિ બીજી બાજુએ ખેંચાઈ જાય છે.

(૩ ડિસેમ્બર ૧૯૩૪)

**“માતાજી, ‘દ’ જે ગુજરાતી કવિતા ઓલબેછે તેવાંચવા એને ત્યાં જવું સારું છે?”**

એનો આધાર એની તમારી ઉપર કેવી અસર થાય છે તેના ઉપર છે. જો તમે ત્યાંથી પાછા આવો ત્યારે વધુ શાંત અને સંતોષભરી અવસ્થામાં આવો તો કંઈ વાંધો નહિએ. એથી ઊલટું, એને લઈને તમે ઉદાસ અને અસંતુષ્ટ બની રહો, તો ત્યાં ન જવું તે વધુ સારું. તમારે આ રીતનું અવલોકન કરીને જોવું કે એની તમારા ઉપર કેવી અસર થાય છે અને પછી એને આધારે નિર્ણય કરવો.

(૧૩ ડિસેમ્બર ૧૯૩૪)

“મેં મારા સ્વર્ણમાં જોયું કે આપે લઘ્યું હતું, “મારા વહુલા બાળક, તે અભ્યાસ કરવાનું કેમ મૂકી દીધું છે?” આપે બીજું ઘણું ઘણું લખેલું હતું, અને જો શક્ય હોય તો એ બધું અહીં લખી આપો એવી આશા રાખું છું.”

હા, ગઈ રાત્રે મેં તને પૂછ્યું હતું કે તે અભ્યાસ કેમ કર્યો નથી અને કહ્યું હતું કે આવી રીતે, પ્રાણના આવેગોને વશ થઈ જવું એ તેની ઉપર કાબૂ મેળવવાની કોઈ રીત નથી. તારે તારી જાતે જ એક શિસ્તની પદ્ધતિ ઉપજાવી લેવી જોઈએ અને જો તારે તારા પ્રાણના દુષ્ટ સંકલ્પો અને મનોમય નિરાશાઓની અવસ્થાઓનો અંત આણવો હોય, તો તને ગમે તે ભોગે પણ તારી પોતાની ઉપર લાદવી જોઈએ. શિસ્ત વિના જીવનમાં કશું પણ નહિ થઈ શકે અને કોઈ પણ પ્રકારનો યોગ પણ શિસ્ત વિના ન થઈ શકે.

“શારીરિક કામ કરવાનું હોય છે ત્યારે તો શિસ્તની બાબતમાં મને વાંધો નડતો નથી પરંતુ જ્યારે મને સારું ન લાગતું હોય ત્યારે ભાણવાની બાબતમાં શિસ્તનું પાતન કરવું અધરું પડે છે. આમ છતાં, મેં નક્કી કર્યું છે કે જે દિવસે હું અભ્યાસ નહિ કરું તે દિવસે હું ભોજન નહિ લઉં.”

આ તે તારો કેવો વિચિત્ર ઘ્યાલ છે! પ્રાણમય સ્વરૂપે કરેલી ભૂલની શરીરને શિક્ષા! એ કંઈ વાજબી નથી.

(૨૨ ડિસેમ્બર ૧૯૩૪)

“આજે આ સવારે જ હું અત્યંત નિરાશામાં ઢૂબી ગયો છું એટલે અભ્યાસ કરવો અશક્ય લાગે છે.”

એ નહિ ચાલે.

“ઓ મા, તો હું શું કરું?”

તારી જાત ઉપર જોર કરીને પણ અભ્યાસ કરવા માંડ એટલે તારી નિરાશા ભાગી જશે. તને કલ્પના આવે છે કે કોઈ વિદ્યાર્થી એની શાણમાં જઈને એના શિક્ષકને એમ કહી શકે : “સાહેબ, આજે હું ગૃહકાર્ય કરી લાવ્યો નથી કારણ કે હું નિરાશામાં

કૂબી ગયો હતો?”

શિક્ષક એને ભરાબર શિક્ષા કરે.

(૧૬ જાન્યુઆરી ૧૯૩૪)

“હું ધારું છું કે એક વાત નકી છે, હું અભ્યાસ કરવામાં ધ્યાન નથી આપતો  
તે આપને કંઈ ખાસ ગમતી વાત નથી.”

અભ્યાસ કરવાથી મન બળવાન બને છે અને પ્રાણની કામનાઓ અને આવેગો  
પ્રત્યેથી એનું ધ્યાન અન્ય સ્થળે કેન્દ્રિત કરે છે. મન અને પ્રાણને વશ કરવા માટે  
અભ્યાસ કરવો એ એક ધણો શક્તિશાળી ઉપાય છે, માટે જ અભ્યાસ કરવો એ  
અગત્યનું કામ છે.

(૨૮ જાન્યુઆરી ૧૯૩૪)

“મને લાગે છે કે, હું મારો અભ્યાસ સારી રીતે કરતો નથી એટલે મારું મન  
શાંતિ નથી અનુભવતું. મને ભણવામાં કંઈ આનંદ નથી આવતો.”

ભણવાનું કંઈ મજા કરવા માટે નથી — ભણવા અને પોતાના મનને ખીલવવા માટે  
અભ્યાસ કરવો જરૂરી છે.

(૧ ફેબ્રુઆરી ૧૯૩૪)

“મારે માટે અભ્યાસ કરવો અશક્ય છે. કારણ કે જડતા આવી ગઈ છે.”

તું ભણશો નહિ તો તારી જડતા વધતી જશે.

(૪ માર્ચ ૧૯૩૪)

“મારે મારો સમય કઈ રીતે ગાળવો, મને કશામાં કોઈ સમજણ પડતી  
નથી.”

અભ્યાસ કર. સમજવા માટે એ જ સારામાં સારો રસ્તો છે.

“આપ મને અભ્યાસ કરવાનું કહો છો, પણ મને ભણવાનું ગમતું નથી.”

તું અભ્યાસને માટે પૂરતો સમય આપતો નથી એટલે જ તને એમાં રસ પડતો નથી. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ વસ્તુ કાળજીપૂર્વક કરે છે ત્યારે તેને રસ પડ્યા વિના રહેતો નથી.

(૧૦ એપ્રિલ ૧૯૩૫)

**“મારે કયો માર્ગ લેવો? પ્રયત્ન કરવા માટે યોગ્ય અને સાચો રસ્તો કયો છે?”**

મેં ગઈ કાલે કહ્યું હતું તેમ કર — તારા મગજને પદ્ધતિસર અને નિયમિત રીતે અભ્યાસ કરવાના કામે લગાડ. પછીના જે કલાકમાં તું અભ્યાસ નહિ કરતો હોય ત્યારે તારું મગજ, તેણે પૂરતા પ્રમાણમાં કામ કરેલું હોઈ આરામ લઈ શકશો અને તું તારા હંદયના ઊંડાળમાં એકાગ્રતા કરીને ચૈત્ય ઓતને ખોળી શકશો. અને લઈને તારામાં કૃતક્ષતા અને સાચા સુખ પ્રત્યેની સભાનતા આવશે.

(૨૨ મે ૧૯૩૫)

**“સતત નિરાશાને કારણે મારો અભ્યાસ બગડે છે.”**

મેં તને કહ્યું છે જ કે અભ્યાસ કરીને જ તું નિરાશાને દૂર કરી શકીશા.

(૨૭ જુલાઈ ૧૯૩૫)

**“મારે જાણવું છે કે સામાન્ય નિયમ તરીકે, નાનાં બાળકો આખો વખત રમ્યા કરે તે સારું છે કે કેમ?”**

બાળકો માટે, કામ અને અભ્યાસ માટે અને રમવા માટે નક્કી કરેલો સમય જાળવવો જોઈએ.

(૧૬ નવેમ્બર ૧૯૩૬)

**“આપને લાગે છે કે મારું મન વિકાસ પામી રહ્યું છે?”**

નિયમિત અભ્યાસ એને ખીલવ્યા વિના રહે જ નહિ.

(૭ ડિસેમ્બર ૧૯૩૬)

“હું અભ્યાસ માટે વધુ ને વધુ સમય ગાળતો જાઉ છું અને સાધના પ્રત્યે ઓછું ધ્યાન આપું છું, મને ખબર નથી પડતી કે આ ઈરણવા યોગ્ય કહેવાય કે નહિ?”

બધું બરાબર છે, અભ્યાસ પણ સાધનાનો એક ભાગ હોઈ શકે.

(૮ ડિસેમ્બર ૧૯૩૬)

“જે કોઈ મને શીખવતું હોય તે મારી સાથે તાદાત્મ્ય સાથે, મારી ઉપર એકાગ્રતા કરે, એવું જરૂરી છે?”

એકાગ્રતા વિના કોઈ કશું પામી શકતું નથી.

(૧૮ મે ૧૯૩૭)

“આપને એમ લાગે છે કે વધુ પડતું માનસિક કામ કર્યાથી થાક લાગે છે?”

ના, એ મનોમય તમસ્ક્રમાંથી આવે છે.

(૨૧ જાન્યુઆરી ૧૯૪૧)

(એક શિક્ષકે લખ્યું કે તે વિદ્યાર્થીઓ બરાબર અભ્યાસ કરતા નથી.)

ધીરજપૂર્વક મંડચા રહો — એમાં અમુક પ્રકારનું મનોમય તમસ્ક હોય છે; એક દિવસે એમાં જાગૃતિ આવશે.

\*

“બાળકો પાસે તેમનાં પુસ્તકો હોવા છતાં તેમના પાઠ ભાડી શકતાં નથી.”

બાળકો સાથે કામ કરવામાં ખૂબ ધીરજ હોવી જોઈએ, એકની એક વસ્તુ તેમને વારંવાર સમજાવવી જોઈએ, અનેક પ્રકારે સમજાવવી જોઈએ. પછી ધીરે ધીરે કરીને એ તેમના મગજમાં પ્રવેશો છે.

\*

કામ નિયમિત રીતે થાય તેના કરતાં બુદ્ધિ અને સમજશક્તિ ઘણાં વધુ અગત્યના છે – પાછળથી નિયમિતતા પ્રાપ્ત થઈ શકે.

\*

“માતાજી, અમારામાંથી આળસુપણું કઈ રીતે જાય?”

નિર્બણતા અને રસના અભાવને લઈને આળસ આવે છે. નિર્બણતાને દૂર કરવા માટે બળવાન બનવું જોઈએ.

રસ પડે તે માટે કોઈ રસપ્રદ વસ્તુ કરવી જોઈએ.

\*

“મધુર માતાજી,

આપે મને કહ્યું કે નિર્બણતા દૂર કરવા બળવાન બનવું જોઈએ. માતાજી, મને કહેશે કે મારાથી કઈ રીતે બળવાન બની શકાય?”

સૌપ્રથમ તો એ વસ્તુ તમારે સર્વભાવે માગવી જોઈએ અને પછી, જે કાંઈ જરૂરી હોય તે કરવું જોઈએ.

\*

“મનોમય જડતાને કઈ રીતે દૂર કરવી?”

એનો ઈલાજ મનને જાગ્રત કરવામાં નથી. પરંતુ એને અચંચળ અને નીરવ બનાવીને શાંત અભીષ્ટાપૂર્વક ઉર્ધ્વમાં અંતઃપ્રકાશની જ્યોતિના પ્રદેશ પ્રત્યે વાળવું, અને એ રીતે નીરવતાપૂર્વક વાટ જોવી. ત્યારે પછી પ્રકાશ નીચે ઊતરી આવશે, તમારા મગજને તરબોળ કરી ઢેશો, અને ધીરે ધીરે કરીને આ પ્રભાવને જાગ્રત કરશે. એને લઈને એનામાં અંતઃસ્કુરણાને ઝીલવાની અને વ્યક્ત કરવાની શક્તિ આવશે.

પ્રેમ અને આશિષ.

(૨૬ સપ્ટેમ્બર ૧૯૬૭)

\*

“મધુર માતાજી,

આ વર્ષે શું થયું છે તે કંઈ સમજાતું નથી. અમે અમારા અભ્યાસમાં કે ખેગ્રાઉન્ડ ઉપર, કયાંચ પ્રગતિ કરી શકતા નથી. અમારાં ભગજ હુંમેશાં ચંચળ અને દુઃખી છે. અમે અમારી એકાગ્રતા ગુમાવી દીધી છે. અમે અમારો સમય ગાપાં મારવામાં અને બૂર્ઝી વસ્તુઓ વિષે વિચાર કરવામાં બરબાદ કરી રહ્યા છીએ. અમે અમારામાંની ક્ષતિઓને સુધારી શકતા નથી. મધુર મા, અમે આપની પ્રાર્થના કરીએ છીએ કે આ દુઃખદ સ્થિતિમાંથી અમને ઉગારી લો. અમારે આગળ વધવું છે. અમારે આપનાં સાચાં બાળકો બનવું છે. અમને માર્ગ-દર્શન આપો. સ્વ.

રૂદ્ધન કર્યે કશું નહિ વળે.

જે કંઈ પ્રયત્ન કરવાની જરૂર છે તે માટેનો તમારામાં સંકલ્પ હોવો જોઈએ.

\*

“સંકલ્પશક્તિ બળવાન બનાવવા શું કરવું?”

એને કેળવવી, એનો ઉપયોગ કરીને જેમ તમે તમારા મસલ્સને ખીલવો છો — એવી રીતની કસરત કરો છો તેવી રીતે કરવું.

(૨૩ માર્ચ ૧૯૩૪)

\*

મસલ્સની જેમ જ એકાગ્રતા અને સંકલ્પબળનો વિકાસ સાધી શકાય છે. નિયમિત તાલીમ અને કસરત વડે વિકાસ થાય છે.

\*

“માતાજી, અમે અમારું સંકલ્પબળ કરી રીતે શક્તિશાળી બનાવી શકીએ?”

કસરત વડે.

\*

કોઈ પણ વસ્તુ શીખવા માટે થોડાક માસ કરતાં વધુ સમય જોઈએ છે. પ્રગતિ કરવા માટે ચીવટપૂર્વક કામ કર્યે જવું જોઈએ.

(૧૨ નવેમ્બર ૧૯૫૪)

\*

“હું અભ્યાસ કરવા માટે આટલું બધું દબાણ અનુભવું છું તે એક ગતાનુગતિક વેગ છે.”

જ્યાં લગી તમારે તમારું ઘડતર કરવાનું હશે, તમારા મગજનું ઘડતર કરવાનું હશે, ત્યાં સુધી તમારામાં અભ્યાસ માટેનો આ તીવ્ર આવેગ ટકી રહેશે. પરંતુ જ્યારે મગજ બરાબર ઘડાઈ જશે ત્યારે અભ્યાસ કરવાનો રસ ધીરે ધીરે ઘટી થઈ જશે.

\*

“આપણા જીવનમાં બુદ્ધિનો શો ઉપયોગ છે?”

બુદ્ધિ ન હોય તો મનુષ્ય જીવન અસંબદ્ધ અને અનિયમિત બની જાય; આપણે આવેગોને વશ એવાં પશુઓ કે સમતુલ્ય વિનાના ગાંડાઓ જેવાં બની જઈએ.

(૬ એપ્રિલ ૧૯૬૧)

\*

“માતાજી, જ્ઞાન અને બુદ્ધિ શું છે? એમને અમારા જીવનમાં કોઈ અગત્યનો ભાગ ભજવવાના છે?”

જ્ઞાન અને બુદ્ધિ, ખાસ કરીને મનુષ્યમાં રહેલા ઉદ્ઘર્વ મનના ગુણો છે, જે એને પશુથી જુદો પાડે છે.

જ્ઞાન અને બુદ્ધિ વિના કોઈ વ્યક્તિ મનુષ્ય નાણિ પણ મનુષ્યના સ્વરૂપમાં પશુ હોય છે.

આશિષ.

(૩૦ ડિસેમ્બર ૧૯૬૬)

\*

“આપે વાર્તાલાપોમાં કષું છે કે સાચા જ્ઞાન અને તેની અહીં ચરિતાર્થતા, એ બે વર્ચેના દૂત તરીકેનું સ્થાન બુદ્ધિનું છે. એનો અર્થ એવો થાય ખરો કે સાચું જ્ઞાન શોધવા સારું મનની ઉપર ઊઠવા માટે બૌદ્ધિક કેળવણી અનિવાર્ય છે?”

એક સુંદર મનોમય કરણા, વિશાળ, નમનીય અને સમૃદ્ધ સાધન તૈયાર કરવા માટે બૌદ્ધિક કેળવણી અનિવાર્ય છે, પણ એના કાર્યનો એટલે જ અંત આવે છે.

મનથી ઉપર ઊઠવાની બાબતમાં તો એ કોઈ રીતની સહાય કરતાં, ઘણુંઘરું બાધારૂપ નીવડે છે, કારણ કે, સામાન્ય રીતે, એક સૂક્ષ્મગ્રાહી અને સંસ્કારી મનને પોતાનાથી જ સંતોષ વળી જાય છે અને પોતાને નીરવ બનાવવા કે પોતાની ઉપર જવાનું ભાષ્યે જ શોધે છે.

\*

તમે જે કાંઈ જાણતા હુશો, એ ગમે તેટલું સુંદર હશો, તોપણ તમે જો અન્ય પદ્જતિઓનો ઉપયોગ કરીને જાણી શકો તેની સરખામણીમાં કશું નહિ હોય.

\*

સમજશક્તિ પ્રાપ્ત કરવાનો સૌથી ઉત્તમ માર્ગ એ છે કે, ચેતનામાં તમે એટલા પ્રમાણમાં ઊંચે ચડો કે તમે ત્યાંથી સર્વ પ્રકારના વિરોધાભાસી ઘ્યાલોનો સંવાદપૂર્ણ સમન્વય કરી શકો.

અને સાચું વલાગુ આ રીતનું છે: તમારે એક દૃષ્ટિબિંદુથી બીજા દૃષ્ટિબિંદુ ઉપર નમનીય થઈને પહુંચયું, પ્રભુને આત્મસમર્પણ કરવાના અને તેમની સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કરવાના તમારા લક્ષ્ય પ્રત્યેની તમારી દૃષ્ટિ એક ક્ષાળ માટે પણ કૃષ્ણ થવી ન જોઈએ.

(૨૮ એપ્રિલ ૧૯૬૪)

\*

એ જાણી લેવું અગત્યનું છે કે એકમેવ પ્રભુને જાણવા, એ મનની શક્તિની બહાર છે. માટે જ, એમના વિષે જે કાંઈ કહેવાય છે કે વિચારવામાં આવે છે તે કાં તો જાળાવાળા જેવું અને અંદાજી હોય છે. એટલે એમાં સ્વાભાવિક રીતે અનેક પ્રકારના અપરિદ્દાર્ય વિરોધી ભાવો પણ હોય છે.

એટલા માટે હુંમેશાં એમ શીખવવામાં આવે છે કે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનની જ નીરવતા અનિવાર્ય છે.

(૩૧ ઓગસ્ટ ૧૯૬૫)

\*

સ્પષ્ટ સમજણા, દર્શન અને યોગ્ય કાર્ય માટે તદ્દન નિઃસ્પંદ મન એ અનિવાર્ય જરૂરિયાત છે.

\*

“કૃપા કરીને મને વિચારોના પરપોટાઓ અને જરૂરિયાતોના આંતર દર્શન વચ્ચે ભેદ કરવામાં સહાય કરો.”

ઉદ્ઘંમાંથી કોઈ પ્રેરણા આવી શકે તે માટે તમારું મન નિઃસ્પંદ અને નીરવ બનવું જોઈએ.

\*

આવિભાવ પૂર્ણ રીતે થઈ શકે તે માટે એનામાંથી જે શક્તિ વહી આવતી હોય તેને માર્ગ કરી આપવાને માટે મને તદ્દન શાંત બની રહેવું જોઈએ.

\*

“વિદ્યાર્થીને યોગ્ય રીતે વિચારતાં કઈ રીતે શીખવાય?”

નીરવ ધ્યાનમાં મનની ક્ષમતાનો વિકાસ થાય છે.

(૨૩ માર્ચ ૧૯૬૬)

\*

“હું સહુજ-સ્કુરણાની મદદ વહે કામ કરવા પ્રયત્ન કરીશ. મને મારા પ્રયત્નોમાં સહાય કરજો.”

પ્રાણે શાંત કરો.

મનને નીરવ કરો.

મગજને નીરવ કરો અને છતાં એની સપાટી જાણે ઉર્ધ્વ પ્રત્યે અને ધ્યાન માંડીને બેઢી હોય એવી રીતની જાળવી રાખો.

અને રાહ જુઓ...

(૨૮ સપ્ટેમ્બર ૧૯૬૭)

\*

મનની ગડમથલ વે તમે મનને શાંત નહિ કરી શકો. તમારે જોઈતી મદદ તો એક ઉર્ધ્વતર અને ગણુનતર સ્તર ઉપરથી આવશો, અને એ બંનેની પ્રાપ્તિ નીરવતામાં જ થઈ શકે છે.

(૧૮ ડિસેમ્બર ૧૯૭૧)

\*

**“મનમાં ચાલતી ચર્ચાઓ કઈ રીતે બંધ કરવી?”**

પહેલી શરત તો એ છે કે બને તેટલી વાતો ઓછી કરવી.

બીજું એ કે તમે તત્કષણો જે કાંઈ કરી રહ્યા છો તેનો જ વિચાર, કરો, તમારે જે કરવાનું છે અને તમે આ અગાઉ કર્યું હોય તેનો વિચાર ન કરો.

ભૂતકાળમાં જે કાંઈ બન્યું હોય તેનો આણગમો ન અનુભવો અને શું થશે તેની કલ્પનાઓ ન બાંધો.

વિચારોમાં બને તેટલા ઓછા નિરાશાવાદી રહો અને જાણી જોઈને આશાવાદ અપનાવો.

\*

“માતાજી, એક સ્વતંત્ર, શાંત, નીરવ મન હોય એ ઘણી સારી વસ્તુ છે; મારામાં ઓ વધુ પ્રમાણમાં હોય એવું હું ઈચ્છું છું. મારી અંદર સતતપણે આવતા વિચારો અને ઉર્ભિઓના વંટોળિયાઓથી હું છુટકારો ચાહું છું, એમને લઈને હું એક રમકડાની માફક ફંગોળાતો રહું છું.”

આ વસ્તુ કમે કમે બને છે.

બળજબરી ન કરશો.

નિઃસ્પંદ અને શ્રદ્ધાવાન બની રહો.

(૧૨ માર્ચ ૧૯૭૩)

\*

હુવે, જે વસ્તુ બુદ્ધિને સમજાઈ છે તે તમારા બાકીના સ્વરૂપને પણ સાક્ષાત્કારવા દો. મનોમય જ્ઞાનનું સ્થાન પ્રગતિની શક્તિ-જ્વાળાએ લેવું જોઈએ.

\*

### વાચન

“મધુર માતાજી, આપે કહ્યું છે કે હું બરાબર રીતે વિચાર કરતો નથી. અમે અમારા વિચારોને કઈ રીતે ખીલવી શકીએ?”

તમારે એવાં પુસ્તકો વાંચવાં જોઈએ કે જેમાં તમારે વિચાર કરવો પડે. એવાં પુસ્તકો તમારે ખૂબ ધ્યાન અને એકાગ્રતાપૂર્વક વાંચવાં. નવલકથાઓ કે નાટકો વાંચવાં નહિ. તમે જે કોઈ વાંચ્યું હોય તેનું મનન કરવું અને એ વિચાર તમે બરાબર સમજી જાઓ ત્યાં સુધી તેના ઉપર ચિંતન કર્યા કરવું. વાતો ઓછી કરવી, શાંત અને એકાગ્ર બન્યા રહીને જ્યારે અનિવાર્ય હોય ત્યારે જ બોલવું.

(૩૧ મે ૧૯૬૦)

\*

“હું એક મોટરકાર વિષેનું પુસ્તક વાંચ્યું છું, પરંતુ હું એ ઝડપથી વાંચ્યું છું, હું એમાં જે ગ્રંચવણાભર્યા યંત્રરચનાનાં વર્ણનો હોય છે તે છોડી દઉં છું.”

જો તમારે કોઈ વસ્તુ બરાબર શીખવી ન હોય, ચીવટપૂર્વક અને બધી વિગતો સાથે એ જાણવી ન હોય, તો એને હાથમાં ન લેવી એ વધુ સારું. તમે એમ માનતા હો કે કોઈ પણ વસ્તુનું થોડુંક ઉપરચોટિયું અને અધૂરું જ્ઞાન તમને કશા પણ ખપમાં લાગશો, તો એ તમારી ભૂલ છે. એનાથી ફક્ત તમે ભિથ્યાભિમાની બની શકો છે, અને જ્યારે હકીકતમાં તમે કશું પણ જાણતા ન હો ત્યારે જાણે બધું જ જાણતા હો એવી કલ્પના સેવો છો.

\*

તમે જે કાંઈ વાંચો તે સંભાળપૂર્વક વાંચો. બરાબર ન સમજાયું હોય તો ફરીથી વાંચો.

\*

‘ય’એ હુમણાં મને લખ્યું હતું કે તમે ઘણી બધી નવલકથાઓ વાંચી છે. મને નથી લાગતું કે આ પ્રકારનું વાચન તમારા માટે સારું હોય — અને તમે જેમ મને કહેલું તેમ, જો તમારે એમાંથી લેખનશૈલીનો અભ્યાસ કરવો હોય તો કોઈ સારા લેખકના એક જ સારા પુસ્તકનો કાળજીપૂર્વકનો અભ્યાસ, આ રીતના ઉતાવળિયા અને ઉપરયોટિયા વાચન કરતાં વધુ શીખવી શકે છે.

“નવલકથાઓ વાંચવા પાછળ મારા બે હેતુઓ હતા. શબ્દો અને શૈલી બંને શીખવાં.”

શીખવું હોય તો તમારે કાળજીપૂર્વકનો અભ્યાસ કરવો જોઈએ અને જે વાંચવાનું હોય તેની પણ કાળજીપૂર્વકની પસંદગી કરવી જોઈએ.

(૨૫ ઓક્ટોબર ૧૯૩૪)

“આપને એમ લાગે છે કે મારે ગુજરાતી સાહિત્ય વાંચવાનું બંધ કરવું જોઈએ?”

એ સર્વનો આધાર, એ સાહિત્યની તમારી કલ્પના ઉપર કઈ રીતની અસર થાય છે તેની ઉપર રહે છે. જો એને કારણે, તમારું મન અનિયછનીય ઝ્યાલો અને તમારી પ્રાણમય કામનાઓથી ભરાઈ જતું હોય, તો એ પ્રકારનું પુસ્તક ન વાંચવું એ વધુ સારું.

(૨ નવેમ્બર ૧૯૩૪)

“કેન્ય નોવેલો વાંચવામાં કંઈ વાંદો ખરો?”

નોવેલો વાંચવાથી કદી પણ ફાયદો થતો નથી.

(૨૪ એપ્રિલ ૧૯૩૭)

\*

“જ્યારે કોઈ ગંદુ સાહિત્ય વાંચે છે, કોઈ બીભત્સ નવલકથા વાંચે છે ત્યારે શું એમ નથી બનતું કે પ્રાણમય વિભાગ મનની દ્વારા આનંદ લે છે?”

મનમાં પણ વિઝૃતિઓ હોય છે. જો કોઈને આવી વસ્તુઓમાં આનંદ આવતો હોય તો એમ જરૂર માનવું કે તેનો પ્રાણ તદ્દન ગ્રામ્ય અને અસંસ્કૃત કક્ષાનો છે.

\*

જેમનાં મગજનું ઘડતર થયેલું નથી હતું એવા લોકો તો જે કાંઈ વાંચે છે તેના મૂલ્ય વિષે કશો વિચાર કરતા નથી એટલે પછી એ વસ્તુ જાણે કે સત્ય જ હોય એવી રીતની છાપ તેમના મગજ ઉપર પડી જાય છે. એવા લોકોને આપણે કાંઈ વાંચવા આપીએ ત્યારે એમ કરવું સલાહભર્યું ગણાય કે એવી કાળજી રાખીએ કે જે કાંઈ સત્યપૂર્ણ અને તેમના ઘડતરને માટે ઉપયોગી હોય તેમ જ તેમના હાથમાં જાય.

(૩ જૂન ૧૯૩૮)

\*

હું આ પ્રકારના સાહિત્યના વર્ગોને પસંદ કરતી નથી કે જેમાં દેખીતી રીતે જ્ઞાનના (?) માટે એ લોકો એવા માનસિક કીચડમાં આળોટે છે કે જે વસ્તુને માટે અહીં કોઈ સ્થાન નથી અને જે કોઈ પણ પ્રકારે આવતી કાલ માટેની ચેતના ઘડવામાં સહાયભૂત થઈ શકે તેમ નથી. ગઈ કાલે, તમારા પત્રને અનુલક્ષીને મેં ‘ક્ષ’ પાસે આ વસ્તુનું પુનર્કથન કરેલું અને એને ટૂંકામાં સમજાવેલું કે, જે હતું અને જે હશે, એ બે વચ્ચેના વચ્ચગાળાના સમય પ્રત્યે મારી દૃષ્ટિ ક્યા પ્રકારની છે.

જો આપણે અહીં કે ત્યાં, કોઈ સાચા હદ્દયની અને જ્યોતિપૂર્ણ અભીષ્ટા શોધી કાઢી શકીએ, તો એને આપણે અભ્યાસ માટેની તક બનાવી લઈ શકીએ અને એ વસ્તુ એક રસપ્રદ ગ્રવૃત્તિ બની રહે.

તમે ભેગા ભળીને આ વસ્તુ તપાસી જગે અને તમે શું નિર્ણય કરો છો તે મને જણાવજો.

ગમે તેમ થાયઃ હવે સાહિત્યના વર્ગો તો નહિ જ.

(૧૮ જુલાઈ ૧૯૫૮)

\*

## “સાહિત્યનું મૂલ્ય કેટલું?”

એનો આધાર તમારે કેવા બનવું છે અથવા શું કરવું છે તેની ઉપર રહે છે. જો તમારે કોઈ સાહિત્યકાર થવું હોય તો, તમારે ખૂબ ખૂબ સાહિત્ય વાંચવું જોઈએ. એટલે પછી, જે વસ્તુઓ વિષે લખાઈ ગયું હશે તેનો તમને ઘ્યાલ આવશે અને જૂની વસ્તુઓનું તમે પુનરાવર્તન નહિ કરો — તમારે તમારું મન અચળ રાખવું પડશે અને તમે જે કાંઈ કહેતા હો તે અસરકારક બને તે રીતે કહેવું જોઈએ.

પરંતુ જો તમારે સાચું જ્ઞાન જોઈતું હશે, તે એ તમને સાહિત્યમાંથી નહિ મળે. મને તો લાગે છે કે સાહિત્યમાત્ર ખૂબ ખૂબ નીચો કક્ષાનું હોય છે — મોટા ભાગે તો એ સર્જક પ્રાણનું કાર્ય હોય છે અને ઊંચે જતાં પણ એ ગળાના કેન્દ્ર, બાધ અભિવ્યક્તિ કરનાર મન સુધી જ પહોંચે છે. આ મન, તમને બહુરની વસ્તુઓના સંપર્કમાં મૂકે છે. અને એની કિયાત્મક પ્રવૃત્તિમાં, સાહિત્ય એટલે વિચારો સાથે વિચારો, શાબ્દો અને વિચારો, એક શાબ્દ અને બીજા શાબ્દ, એ બધાને બંધબેસતા કરવાની રમત માત્ર હોય છે. એને લઈને મનમાં અમુક રીતની કુશળતા, ચર્ચા કરવાની ક્ષમતા; વાર્ણન કરવાની મનોરંજન કરવાની અને રમૂજ ઉપજાવવાની આવકઠ આવે છે.

મેં અંગેજુ સાહિત્ય બહુ વાંચ્યું નથી, — મેં બસો ત્રાણસો ચોપડીઓ ફેરવી જોઈ છે, પરંતુ ફેન્ચ સાહિત્યને હું બરાબર જાણું છું — મેં એની એક આખી લાયબેરી વાંચેલી છે, અને હું કહી શકું છું કે સત્યની અપેક્ષાએ એનું કશું મૂલ્ય નથી. સાચું જ્ઞાન મનની ઉપરથી આવે છે. સાહિત્ય તો કેવળ સામાન્ય અને ક્ષુદ્ર વિચારની રમતની રજૂઆત કરે છે. એમાં કોઈક વાર જ કોઈ ઉદ્ધરનું કિરાણ આવે છે. તમે પુસ્તકોને હજારોની સંખ્યામાં જોઈ જાઓ તો તમને અહીં કે તહીં બહુ જ થોડી માત્રામાં પ્રેરણા જેવું જણાશો. બાકીનું બધું અર્થહીન હોય છે.

હું એમ નથી કહી શકતી કે શ્રી અરવિંદને સમજવા માટે સાહિત્ય વડે કોઈને ઉપયોગી સામગ્રી મળી રહે. એથી ઊલટું, એનાથી અવરોધ નડવા વધુ સંભવ છે. કારણ કે શાબ્દો તો એના એ જ વાપરવામાં આવે છે, પણ શ્રી અરવિંદ એમનો જે હેતુ માટે ઉપયોગ કર્યો હોય તેના કરતાં સાહિત્યમાં કોઈક જુદી જ વસ્તુ હોય છે. એટલે શ્રી અરવિંદ જ્યારે એવા શાબ્દોનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આપણે પેલા બિન્ન પ્રકારના ઉપયોગના સંસ્કારને લઈને અડે રસ્તે દોરવાઈ જવાનો સંભવ રહે છે. શ્રી અરવિંદનો પ્રકાર જીલવા માટે આપણે સાહિત્યે જે કાંઈ કદ્યું-કથ્યું હોય તે બધાથી મનને ખાલી કરી દેવાનું રહે છે. આપણે ભીતરમાં જઈને એક ગ્રહણશરીરલ

નીરવતામાં ઊર્ધ્વ પ્રત્યે વળેલા રહેવાનું હોય છે. એમ થાય તો જ આપણે કોઈ વસ્તુને યોગ્ય રીતે જીલી શકીએ. સૌથી બદતર તો એ છે કે સાહિત્યના અભ્યાસને કારણે લોકો મૂર્ખ અને વિકૃત બની જાય છે અને શ્રી અરવિંદના અંગેજીની તુલના કરવા અને તેમના વ્યાકરણમાં ભૂલો શોઘવા લાગે છે!

પરંતુ એ ખરું છે કે, હું સાહિત્ય શીખવવાની બાબતનો સંદર્ભ કરતી નથી. આપણાં ઘણાં બાળકોનાં મગજ કાચાં છે અને સાહિત્ય વડે એમનું કાંઈક અંશે ઘડતર થઈ શકે છે. એમનામાં થોડી નમનીયતા આવી શકે છે. એમનામાં ઘણે ડેકાણે કોતરકામ કરવાની જરૂર હોય છે. એમને વિશાળ, સક્રિય અને સ્ક્રીટિવંત બનાવવાની જરૂર છે. સાહિત્ય એમને એક પ્રકારનો વ્યાયામ પૂરો પાડી શકે છે અને તેમને હાલતા-ચાલતા કરીને તેમનામાં બુદ્ધિતત્ત્વ ખીલવી શકે છે.

હું ઉમેરીશા કે શિક્ષકોની વચ્ચે, સાહિત્યના મૂલ્ય વિષે જે વિવાદ ઊભો થયો છે તે ‘રજનું ગજ’ કરવા બરાબર છે. ખરું જોતાં તો શિક્ષણના પાયાનો જે પ્રશ્ન છે તેનો એક ભાગ માત્ર છે. આપણો શાળાના દરેક વિભાગમાં જે કાંઈ ચાલી રહ્યું છે તેના મૂળમાં મને એક જ પ્રશ્ન દેખાય છે. દરેક સ્થળે હું શિક્ષણ પદ્ધતિને નિછાળું છું ત્યારે મને પેલા યોગી જેવી લાગણી થાય છે કે જેને એક દીવાલ સામે બેસીને ધ્યાન કરવાનું કહેવામાં આવેલું. મને પણ મારી સામે ઓવી દીવાલ જ દેખાય છે. એ એક ભૂખરા રંગની દીવાલ છે, એની ઉપર થોડીક ભૂરા રંગની રેખાઓ આમતેમ દોરાયેલી છે — આ છે શિક્ષકોના કંઈક મૂલ્યવાન વસ્તુ કરવાના પ્રયત્નો — પરંતુ બધું જ ઉપરછલ્લે કરવામાં આવે છે અને એની પાછળ આ અહીં જે દીવાલ ઉપર મારો હાથ પછાડું છું તેના જેવું છે. એ કઠણ અને અવેદક છે, સાચા પ્રકારને એ બહાર બંધ કરી દે છે. કોઈ બારણું નથી — આપણે એની આરપાર પ્રવેશ કરીને પેલા પ્રકાશમાં પહોંચી શકતા નથી.

જ્યારે યુવાન વિદ્યાર્થીઓ આવીને તેમના કામ માટે કહે છે, ત્યારે, જ્યારે પણ હું કંઈ ઉપયોગી વસ્તુ કહેવા ઈચ્છતી હોઉં છું ત્યારે એ જ કઠણ ઘણ જેવી દીવાલ મારો માર્ગ અવરોધી રહે છે.

મારે કેળવાણીનો પ્રશ્ન હાથ ઉપર લેવો છે, હું એને માટે તૈયારી કરી રહી છું. એમ કરતાં મને બે વર્ષ લાગશે. પરંતુ મેં પવિત્રને ચેતવણી આપી છે કે હું જ્યારે હસ્તક્ષેપ કરીશ અને વસ્તુઓને ફરીથી આકાર આપીશ ત્યારે એ ઝંઝાવાત જેવું થઈ જશે. લોકોને લાગશે કે એમના પગ પણ જમીન ઉપર ઠરતા નથી! ઘણી ઘણી વસ્તુઓ ઊંઘીચતી થઈ જશે. પ્રથમ તો બધી બાજુઓથી બધા જ બાધા જેવા થઈ જશે. પરંતુ ઝંઝાવાતને પરિણામે દીવાલ તૂટી પડશે અને સાચો પ્રકાશ ફૂટી

નીકળશે.

મને એમ લાગ્યું કે ધરમૂળના ફેરફારો આવી રહ્યા છે એ વસ્તુ પહેલેથી કહી મૂકવી સારી. એ રીતે, શિક્ષકો એને માટે તૈયાર રહી શકશે.

સાહિત્યના શિક્ષકોમાં રહેલી શુભ ભાવનામાં મને શંકા નથી અને તે મારી નજર બહાર પણ નથી. કેટલાક જૂના શિક્ષકો એમનાથી બને તેટલું સારું કામ કરે છે. હું એ સર્વની કદર કરું છું. અને મારો નિર્ણય કરતી વેળાએ શાળા તરફથી મારી સમક્ષ રજુ કરવામાં આવેલા વિકલ્પો પણ મેં લક્ષમાં લીધા છે. પરંતુ હું ફરી વાર કહીશા કે આ આખી યે ચર્ચા, નાહિકની ઉંઘેરાટભરી બની ગઈ છે જેને આપણે કીડીઓનું યુદ્ધ અથવા ફેન્ચમાં કહેવાય છે તેમ “બિલાડીને પાટુ મારવાથી શો ફાયદો” એના જેવું છે.\*

\*

એક એવું સૂક્ષ્મ જગત છે જ્યાં તમે ચિત્રકળા, નોવેલો, વિવિધ પ્રકારનાં નાટકો અને ચલચિત્રો માટેના બધા જ શક્ય વિષયો જોઈ શકો છો.

મોટા ભાગના લેખકોની પ્રેરણા ત્યાંથી આવતી હોય છે.

\*

(એક શિક્ષકે એવું સૂચન કરેલું કે જે પુસ્તકમાં ગુનાખોરી, દિંસા અને બેફામ વર્તનના વિષયો હોય તેવાં પુસ્તકો યુવાનો અને બાળકોના હાથમાં ન આવે તેમ થવું જોઈએ.)

એમાં કેવળ વિષય-વસ્તુનો જ પ્રશ્ન નથી પણ જીવન વિષેના વિચારોની બાબતમાં મનની ગ્રાભ્યતા, સંકુચિતતા અને સ્વાર્થપોષક વ્યવહારલક્ષિતાને કોઈ પણ પ્રકારની કળા, મહાનતા કે સંસ્કારિતા વગર રજૂ કરવામાં આવે છે, એ મુખ્ય વસ્તુ છે. એવા સાહિત્યને નાના કે મોટાં બધાં જ બાળકોના વાચનમાંથી કાળજીપૂર્વક દૂર કરવું જોઈએ, જે કાંઈ ચેતનાને હુલકી કોટિએ ઉતારે છે તે સર્વનો ત્યાગ કરવો જોઈએ.

(૧ નવેમ્બર ૧૯૫૯)

\*

---

\* મૂળમાં આ વસ્તુ શ્રી માતાજીએ સ્વમુખે કહેલી. પાછળથી સાધકે પોતાના સ્મરણના આધારે એનો પાઠ લખી કાઢેલો. શ્રી માતાજીએ એને મંજૂર કરીને પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપેલી.

“પુસ્તકોની પસંદગી કાળજીપૂર્વક કરવી પડશે. કેટલાંક પુસ્તકોમાંના વિચારો, આપણાં બાળકોને નીચલી કક્ષાએ ઉતારે તેવા છે. કેવળ એવાં જ પુસ્તકોની ભલામણ કરવી જોઈએ જેમને આપણા આદર્શ સાથે કોઈ રીતનો સંબંધ હોય અથવા જેમાં ઐતિહાસિક કથાઓ, સાહસગાથાઓ અથવા સંશોધનના વિષયો હોય.”

ઝેરી અસર કરે તેવાં પુસ્તકોની બાબતમાં જેટલી વધુ કાળજી લેવાય તેટલું વધુ સારું. આશીર્વાદ.

(૧૭ એપ્રિલ ૧૯૬૭)

\*

“હું રામાયણ અને મહાભારતની કથાઓ અને કબીર, મીરાં વગેરેનાં ભજનો ઉપર ઘણો ભાર મુકું છું. જૂની વસ્તુઓ ચાલુ રાખવા બાબતના આપના માર્ગથી એ વિરુદ્ધનું છે?”

જરા પણ નહિ — એમાં અગત્યની વસ્તુ તે વલાણ છે. ભૂતકાળ એ ભાવિ પ્રત્યે કૂદકો મારવાનું પાટિયું બનવું જોઈએ, આગળ વધતાં અટકાવનાર બેડી નહિ. મેં જેમ કષ્યું તેમ, સર્વ કંઈ ભૂતકાળ પ્રત્યેના વલાણ ઉપર આધાર રાખે છે.

“કેટલાક ઉત્તમ કવિઓ અને સંતોષે, રાધા અને કૃષ્ણનો પ્રેમ શારીરિક પ્રેમ હોય એ રીતનું લખેલું છે.”

મને એમ લાઝું છે કે એમાં એ લોકો યોગ્ય શાબ્દો અને સાચી ભાષા શોધી કાઢવામાં સકળ નહિ થયા હોય.

\*

આ બધો કચરો વાંચવાનું બંધ કરો. પુસ્તકોમાં લખેલી ગુણવિવિધા એ પ્રાણમય રીતની અને અત્યંત ભયંકર હોય છે.

\*

જગતમાં શું બની રહ્યું છે તે તમારે જાણવું હોય તો કોઈ પણ પ્રકારનાં

વર્તમાનપત્રો ન વાંચશો કારણ કે એ અસત્યથી ભરેલાં હોય છે.

વર્તમાનપત્ર વાંચવું એટલે વિશાળ સમૂહગત અસત્યમાં ભાગ લેવો.

(૨ ફેબ્રુઆરી ૧૯૭૦)

\*

“માતાજી,

જો અમે પેપરો ન વાંચીએ તો બીજા દેશોમાં અને આપણા દેશમાં શું બની રહ્યું છે તેની અમને કઈ રીતે ખબર પડે? એમાં અમને કર્દિક તો ખ્યાલ આવે છે, નહિ? કે પછી અમે પેપરો બિલકુલ ન વાંચીએ એ જ યોગ્ય છે?”

મેં તમને પેપરો વાંચવાની ના નથી કહી. મેં તમને કહેલું કે જે કાંઈ વાંચો તે આંખો મીંચીને સાચું માની ન લેશો. તમારે જાણી લેવું જોઈએ કે સત્ય એ તદ્દન જુદી વસ્તુ છે.

આશીર્વાદ.

(૪ ફેબ્રુઆરી ૧૯૭૦)

\*

“હું જોવા માગું છું કે હું વાંચવાનું બિલકુલ બંધ કરી દઉં તો શું થાય છે?”

એક જ વસ્તુ ઉપર મનને હુંમેશાં રોકી રાખવું મુશ્કેલ છે અને જો એને કામે લગાડવા માટે પૂરતા પ્રમાણમાં કામ ન આપવામાં આવે તો એ ચંચળ થઈ ઊડે છે. એટલે હું એમ માનું છું કે વાંચવાનું બિલકુલ બંધ કરવા કરતાં પોતે વાંચવાનાં પુસ્તકો કાળજીપૂર્વક પસંદ કરવાં વધુ સારાં.

\*

(શ્રી માતાજીના પ્રાર્થના અને ધ્યાન પુસ્તકની એક ગ્રતમાંની એક ચબરકી ઉપરનું લખાણ.)

જો તમારે આ પુસ્તક અનુસારનું આચરણ ન કરવું હોય તો વાંચશો નહિ.

\*

લાયબ્રેરી એક એવું બૌદ્ધિક સુરક્ષિત સ્થાન હોવું જોઈએ જ્યાં તમે પ્રકાશ અને પ્રગતિની પ્રાપ્તિ કરવા જઈ શકો.

\*

## વર્તીશૂક્ર

**બાળકે આ હુંમેશાં યાદ રાખવું જોઈએ:**

આપણામાં સંપૂર્ણ સર્વાઈ હોવી જોઈએ.

આપણે એ દૃઢ વિશ્વાસ રાખીએ કે સત્યનો અંતે વિજય જ છે.

જો આપણે સફળ થવાનો સંકલ્પ ટકાવી રાખીશું તે આપણે સતતપણે આગળ વધી શકીશું.

\*

## આદર્શ બાળક

**પ્રસન્ન હોય છે.**

બધું જ્યારે પોતાની વિરુદ્ધમાં જતું દેખાય કે પછી ચુકાદાઓ પોતાની તરફેણમાં ન આવે ત્યારે તે ગુસ્સે થતો નથી.

**ઘેલાદિલ હોય છે.**

એ જે કંઈ કામ કરે છે તે પોતાની સર્વ શક્તિ વાપરીને કરે છે અને પોતાને નિષ્ઠળતા મળશે એમ લગભગ ચોક્કસ દેખાય તો પણ તે કામ કરતો જ રહે છે. તે હુંમેશાં સીધી રીતે વિચારે છે અને સીધી રીતે વર્તે છે.

**સત્યવક્તવા હોય છે.**

એ સત્ય કહેતાં કદી ડરતો નથી, પછી ભલે ગમે તે પરિણામો આવે.

### ધીરજવાન હોય છે.

પોતાના પ્રયત્નોનું પરિણામ જોવા તેને ખૂબ રાહું જોવી પડે તો પણ તે ઉત્સાહ ગુમાવતો નથી.

### સહનશીલ હોય છે.

જીવનમાં જે મુશ્કેલીઓ અને દુઃખ અનિવાર્ય રીતે આવતાં હોય છે તેનો તે કશી ફરિયાદ વિના સામનો કરી લે છે.

### ખંતીલો હોય છે.

પોતાનો પ્રયત્ન તેણે ભલે ગમે તેટલો સમય ચાલુ રાખવો પડે પણ એ પ્રયત્નને તે કદી મંદ થવા દેતો નથી.

### સ્વસ્થ હોય છે.

સફળતામાં તેમ જ નિષ્ફળતામાં તે સમતા જાળવે છે.

### હિંમતવાન હોય છે.

અને ભલે અનેક પરાજ્યો મળે તો પણ તે છેવટના વિજય માટે હુંમેશાં લડતો જ રહે છે.

### આનંદી હોય છે.

હુરેક પરિસ્થિતિમાં કેવી રીતે હસતા રહેવું અને હદ્યને પ્રસન્ન રાખવું એ તે જાપો છે.

### નભ હોય છે.

પોતાના વિજય ઉપર તે કુલાઈ જતો નથી, તેમ જ એને એમ પણ થતું નથી કે પોતાના સાથીઓ કરતાં પોતે વધારે ઉંચ્ય છે.

### ઉદાર હોય છે.

બીજાઓના ગુણોની તે કદર કરે છે અને અન્ય માગસને સફળ થવામાં મદદ કરવા તે સદા તૈયાર હોય છે.

ન્યાયી અને આજ્ઞાંકિત હોય છે.

શિસ્તનું તે પાલન કરે છે અને હંમેશાં ગ્રામાંશિક હોય છે.

(બુલેટિન, ઓગસ્ટ ૧૯૫૦)

આદર્શ બાળક બુદ્ધિમાન હોય છે.

એને જે કાંઈ કહેવામાં આવે છે તે એ સમજુ લે છે, પોતાના પાઠ ભાખ્યા વિના પણ જાણી લે છે અને જે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તેનો ઉત્તર આપે છે.

\*

એનામાં ભાવિમાં આવનાર સુંદર અને પ્રકાશવંત સફળતાઓથી સમૃદ્ધ એવા ભવિષ્ય માટે વિશ્વાસ હોય છે.

બાળપણ એ ભાવિનું પ્રતીક છે અને આવનારા સર્વ વિજ્યોની આશા છે.

\*

### આદર્શ બાળક

.... શાળામાં હોય છે ત્યારે તેને અભ્યાસ કરવો ગમે છે,  
 .... રમતના મેદાનમાં હોય છે ત્યારે એને રમવું ગમે છે,  
 .... જમવાને વખતે તેને ખાવાનું ગમે છે,  
 .... સૂવાને વખતે તેને ઊંઘવાનું ગમે છે,  
 .... અને હંમેશાં તેને પોતાની આસપાસનાં સર્વ માટે પ્રેમ હોય છે,  
 .... પ્રભુની દિવ્ય કરુણામાં તેને પૂર્ણ વિશ્વાસ હોય છે,  
 .... પ્રભુ પ્રત્યે તેનામાં ઊંડું માન હોય છે.

\*

### બાળકને શીખવવાની વસ્તુઓ

- (૧) સચ્યાઈ અત્યંત જરૂરી ગુણ છે.
- (૨) સત્યનો અંતે વિજય જ છે એવી શક્ષા.
- (૩) પ્રગતિ કરવા માટેનો સંકલ્પ કરવો અને શક્ય છે તેમ ગણવું.

ખુશમિજાજ, ન્યાયીપણું, સર્વ્યાઈ.  
ધીરજ, સહનશીલતા, ખંત.  
સમતા, હિંમત, આનંદીપણું.

\*

“અગીઆરથી તેર વર્ષ સુધીનાં બાળકોના શિક્ષણની બાબતમાં ખાસ કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ?”

સૌથી અગત્યની વસ્તુ એ છે કે તેમને તદ્દન સત્યનિષ્ઠ થતાં શીખવવું.

જરા જેટલું અસત્ય પણ સ્વીકારવું નહિ.

એમને અવિરતપણે આગળ વધતાં શીખવવું કારણ કે જેવા તમે પ્રગતિ કરતા અટકી જાઓ છો કે તરત જ પાછા પડવા માંડો છે અને એ રીતે વિકૃતિની શરૂઆત થાય છે.

\*

જે કાંઈ જોઉં છું અને જાણું છું, તે પ્રમાણે, એક સામાન્ય નિયમ તરીકે, ૧૪ વર્ષની ઉમરનાં બાળકોને સ્વતંત્ર છોડી દેવા જોઈએ અને તેઓ પૂછે તો જ સલાહ આપવી જોઈએ.

એમને જાણ હોવી જોઈએ કે તેમના જીવનની વ્યવસ્થાની જવાબદારી તેમના ઉપર છે.

\*

તમે જે વિચારો અને ભાવનાઓ હમણાં રજૂ કરી છે તે સાંભળીને મને ઘણી ખુશી થઈ છે અને હું તમને આશિષ આપું છું. હું કેવળ એટલી આશા રાખ્યું છું કે તમારા એ વિચારો અને ભાવનાઓ કેવળ આદર્શ જ નહિ રહે પણ સિક્ક થયેલી હકીકતો બની રહેશે. તમારા આદર્શને તમારા જીવન અને ચરિત્રમાં સકાર કરો એ વાતનું તમારે પણ લક્ષ રાખવું જોઈએ. પરંતુ હું તમને જે એક વસ્તુ કહેવાનો લાંબા સમયથી વિચાર કરી રહી હતી તે આ પ્રસંગે હું કહેવા ઈચ્છા છું. એ વસ્તુ તમારા અભ્યાસને લગતી છે. સ્વાત્માવિક રીતે, અપવાદો તો હોય, પરંતુ અપવાદોને લઈને જ નિયમને તેનું બળ મળે છે. દાખલા તરીકે, તમે આજે રજા માગેલી. મને એમ નહોતું લાગતું કે તમારે કોઈ વધુ આરામની જરૂર હોય. તમારું જીવન જ એવી રીતે ગોઠવાયેલું છે કે જેમાં સતત આરામ આવતો રહે એવો ઢાળ પડી ગયો છે. તેમ

છતાં મેં તમારી વિનંતી માન્ય રાખી. પરંતુ તમે જે પ્રકારે એ “સારા સમાચાર”ને વધાવી લીધા એથી મને વેદના થઈ. તમારામાંના કેટલાકને તો જાણો કોઈ વિજય મેળવ્યો હોય એમ લાયું હોય એમ જણાતું હતું. પરંતુ હું પૂછું છું કે શાનો વિજય, શાની ઉપર વિજય? વધુ ને વધુ શીખવા અને જાણવાના આનંદ ઉપર અચેતનાનો વિજય? વ્યવસ્થા અને નિયમિતતા ઉપર સ્વેચ્છાચારનો વિજય? પ્રગતિ અને આત્મજય માટેના પ્રયત્ન ઉપર અજ્ઞાન અને છીછા સંકલ્પનો વિજય?

તમારે જાણી રાખવું જોઈએ કે આ વસ્તુ એ તદ્દન સામાન્ય રીતના જીવન અને શિક્ષણની વ્યવસ્થામાં રહેતા હોય તેવા લોકોની ગતિ છે. પરંતુ તમારે માટે તો, જો તમે આપણા લક્ષ્ય રૂપી જે મહાન આર્દ્ધ છે તેને સિદ્ધ કરવા માગતા હો, તો જે સામાન્ય લોકો, સામાન્ય જીવનની આંધળી અને અજ્ઞાની પરિસ્થિતિમાં રહેતા હોય છે, તેમના તદ્દન સામાન્ય અને નિરર્થક પ્રત્યાઘાતોથી સંતુષ્ટ થઈને બેસી રહો તે યોગ્ય નથી.

જ્યારે હું આમ કહું છું ત્યારે તમને લાગશે કે હું અત્યંત ઝડિયુસ્ત છું. છતાં મારે કહેવું જોઈશે કે તમારે બહારના પ્રભાવો અને સામાન્ય ગણાતી ટેવો વિશે અત્યંત સાવધ રહેવું જોઈશે. તમારું જીવન અને તમારો માર્ગ એ વસ્તુઓ દ્વારા ઘડાવો ન જોઈએ. બહારના અને વિદેશના વાતાવરણમાંથી જે કાંઈ આવે તેને તમારી અંદર કૂદકો મારીને પેસી જવાની પરવાનગી ન આપવી જોઈએ — એ બધું ક્ષુલ્લક અને અજ્ઞાનમૂલક છે. જો તમારે નૂતન માનવજીતના કુટુંબના સભ્ય બનવું હોય તો આજનાં અને ગઈ કાલનાં બાળકોની દ્યાપાત્ર નકલ ન કરશો. દૃઢિયતા, બળવાન અને શ્રદ્ધાપૂર્ણ બનો, તમે જેને “મહાન વિજય” પ્રાપ્ત કરવાનો કહો છો તેને માટે વિજેતા બનવા લડત આપો. મને તમારા ઉપર વિશ્વાસ છે અને હું મારો મદાર તમારા ઉપર બાંધું છું.

મેં તમને યુનિવર્સિટીના વાર્ષિક હિન નિમિતે જે કહેલું તે હજુ પ્રસિદ્ધ કર્યું નથી. મેં આશા રાખેલી કે તમને જે પદાર્થ પાઠ મળે તેનો તમે લાભ લેશો અને તમારી રીતિ-નીતિ સુધારશો. પરંતુ અત્યંત નિરાશા સાથે મને એ વસ્તુની નોંધ લેવાની ફરજ પડે છે કે પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી : એમ લાગે છે કે કેટલાક વિદ્યાર્થીઓએ તેઓ જ્યારે તેમના વર્ગમાં હોય તે સમયે જ તેમનામાંની બૂરામાં બૂરી વસ્તુઓ બહાર લાવવાનું પસંદ કર્યું છે, એ લોકો રસ્તાનાં રખેલ છોકરાની માફક વર્તે છે, એ લોકો એમને જે શિક્ષક આપવામાં આવ્યા હોય છે તેમનો લાભ તો ઉઠાવતા નથી, એટલું જ નહિ પણ, બીજાઓ એમના પાઠનો લાભ નથી ઉઠાવી શકતા, એમાંથી કોઈ તોફાન કર્યાનો આનંદ લે છે.

આપણે જગતને એ બતાવવું છે કે આવતી કાલના નૂતન માનવો કેવા હશો. શું

આપણે તેમની સમક્ષ આ રીતનો દાખલો રજૂ કરવા માગીએ છીએ?\*

(એપ્રિલ ૧૯૫૩માં પ્રસિદ્ધ કરેલ)

\*

(શિક્ષકોની એક સભાની કાર્યવાહીની નોંધમાંથી અવતરણ): “સભામાં એ વસ્તુ પ્રત્યે ચિંતા વ્યક્ત કરવામાં આવેલી કે વિદ્યાર્થીઓમાં શિસ્તનો, સારી રીતભાતનો અને યોગ્ય પ્રકારના વર્તનનો અભાવ જણાય છે.”

સારી રીતભાત માટે મારો ખાસ આગ્રહ છે. મને નથી લાગતું કે ગટરની જવાતો જેવી રીતભાતમાં કશું ભવ્ય હોય!

(૪ માર્ચ ૧૯૬૦)

\*

સાચું બળ અને રક્ષણા, હદ્યમાં રહેલી પ્રભુની હાજરીમાંથી આવે છે.

જો આ હાજરી તમારામાં સતતપણે બની રહે એવી તમારી ઈચ્છા હોય, તો બોલવામાં, વર્તનમાં અને કર્મમાં સર્વ પ્રકારની ગ્રામ્યતાથી દૂર રહો.

સ્વતંત્રતા મળી એટલે સ્વેચ્છાચારનો પરવાનો મળી ગયો એમ ન માનશો અને મુક્તિ મળી એટલે બૂરી રીતભાત ચાલે એવું ન માની બેસશો: તમારા વિચારો શુદ્ધ હોવા જોઈએ અને અભીપ્સા અંતરની હોવી જોઈએ.

(૨૬ ફેબ્રુઆરી ૧૯૬૫)

\*

“અહું અમને જે ભરપૂર સ્વતંત્રતા આપવામાં આવે છે, તે જે લોકો હજી જાગ્રત નથી અથવા તો હજી પણ અભાન છે તેમને માટે ભયજનક ન ગણાય? આ રીતનું જે સદ્ભાગ્ય અમને સાંપડયું છે તેને માટેની પાત્રતા અમે કઈ રીતે જાણી શકીએ?”

સર્વ પ્રકારની આગેકૂચિયમાં ભય અને જોખમ તો સમાપેલાં જ હોય છે. જો એમ ન

\* મૂળમાં આ કથન શ્રી માતાજીએ સ્વમુખે કહેલું. પાછળથી સાધકે સ્મરણમાંથી એનો પાઠ તૈયાર કરેલો. શ્રી માતાજીએ એને મંજૂર કરી પ્રસિદ્ધ કરવા પરવાનગી આપેલી.

હોય તો કોઈ વસ્તુ લેશમાત્ર ગતિ ન કરે; વળી, જે લોકો પ્રગતિ કરવા ઈચ્છતા હોય છે તેમને માટે, તેમના ચારિત્યના ઘડતર માટે પણ આ વસ્તુઓ અનિવાર્ય છે.

(૧૩ એપ્રિલ ૧૯૬૬)

\*

બે વસ્તુઓ કરવી જોઈએ. બાળકોને શીખવવું કે :

(૧) પરિણામ ગમે તે આવે, પણ કદી જૂદું ન બોલવું;

(૨) ઉગ્રતા, કોધ અને હિંસક વૃત્તિઓને અંકુશમાં રાખવી.

જો આ બે વસ્તુઓ થઈ શકે તો એમને પરમ માનવત્વ પ્રત્યે દોરી જઈ શકાય.

એવો એક ઘ્યાલ પ્રવર્તે છે કે જો તેઓ રીતરિવાજો અને પ્રતિબંધોનો ભંગ કરે છે તો એનું કારણ એ કે તેઓ સામાન્ય માનવજીતિની મર્યાદાઓથી મુક્ત છે. આ એક ખોટો ઘ્યાલ છે.

જેને ‘અતિમાનવ’ કહી શકાય તેવા બની શકાય તે માટે પેલી બે વસ્તુઓ સિદ્ધ થવી જોઈએ; જૂદું ન બોલવું અને પોતાની જાતને વશમાં રાખવી.

છેલ્લી શરત એ છે કે પ્રભુ પ્રત્યે સંપૂર્ણ ભક્તિભાવ રાખવો, પરંતુ એમ થઈ શકે તે પહેલાં પણ પેલી બે વસ્તુઓ તો કરવી જ જોઈએ.

(૧૮ જુલાઈ ૧૯૭૧)

\*

જો આપણે માણસ બનવું હોય તો આપણામાં શિસ્ત તો હોવી જ જોઈએ. જ્યાં શિસ્ત નથી હોતી ત્યાં મનુષ્ય એક માણસ નહિ પણ જાનવર હોય છે. તમારે તમારામાં પરિવર્તન સિદ્ધ કરવું હોય અને શિસ્ત સ્થાપવી હોય તો તેને માટે હું તમને બે અઠવાડિયાનો સમય આપું છું. જો તમે શિસ્તબદ્ધ અને આજ્ઞાપાલક બની રહેશો તો હું તમને બીજી તક આપીશ. પરંતુ કોઈ પ્રકારની છેતરર્પોડી કરવાનો પ્રયત્ન ન કરશો... મને જો તમારી સત્યનિષ્ઠામાં લેશ-માત્ર ખામી જણાશો તે પછી હું તમને કાઢી મૂકીશ.

મનુષ્ય માત્ર, જ્યારે તે સાચા અને ઉચ્ચતર જીવન માટે અભીષ્ટા સેવે છે અને રૂપાંતર માટેની જરૂરી શિસ્તને સ્વીકાર કરે છે ત્યારે જ તે સાચા અર્થમાં મનુષ્ય બને છે.

આમ થઈ શકે તે માટેમતમારે તમારી નિઝ પ્રકૃતિ ઉપર અને કામનાઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ.

(૮ માર્ચ ૧૯૭૨)

\*

## વિદ્યાર્થીઓને

વર્ગમાં ધોંઘાટ કરવો એ એક સ્વાર્થપૂર્ણ મૂર્ખતા છે.

જો તમારામાં શાંતિ અને ધ્યાનપૂર્વક વર્ગમાં હાજરી આપવાની ઈચ્છા ન હોય તો તમે ન આવો તે જ બહેતર છે.

\*

શાળામાં, વર્ગમાં, પલે ગ્રાઉન્ડ ઉપર, રસ્તામાં કે ઘરમાં (પછી એ તમારાં મા-બાપનું હોય કે બોર્ડિંગ હોય) સર્વ સ્થળે મારામારી કરવાની સખ્ત મનાઈ છે.

બાળકોને હુર સ્થળે અને હુંમેશાં, એકબીજા સાથે લડવાડ કરવાની મના છે. જ્યારે જ્યારે તમે અન્ય બાળકને મારો છો ત્યારે ખરી રીતે તો તમારા આત્મા ઉપર પ્રછાર કરી રહ્યા હો છો.

(૧૫ જાન્યુઆરી ૧૯૬૩)

\*

આ બાબતમાં, હું જ્યારે નાની હતી અને મારે મારા ભાઈબંધો સાથે બેદિલી થતી ત્યારે હું જે નુસખો અજમાવતી હતી તેની જ તમને ભલામણ કરવા માગ્યું છું. એ વખતે, તમે અત્યારે જેવાં છો તેવી જ હું લાગણીપ્રધાન હતી. એટલે જ્યારે એ લોકો, અને ખાસ કરીને જેમના પ્રત્યે મેં હુંમેશાં સહાનુભૂતિ અને માયાળુપણું બતાવેલું હોય તેવા લોકો પણ જ્યારે મને ગાળો આપતા ત્યારે મને બહુ મારું લાગતું, પરંતુ એવે વખતે હું મારી જાતને આમ કહેતી : “આને લઈને મારે શા માટે દીલાગીર કે દુઃખી થવું જોઈએ? જો એ લોકો જે વસ્તુ કહે છે તે સાચી હોય તો મારે ખુશ થવું જોઈએ કે મને પદાર્થ પાઈ મળ્યો અને એનાથી મને મારી જાતને સુધારવાની તક મળી; જો એ લોકો ખોટા હોય, તો પણ મારે એની ચિંતા શા માટે કરવી — દુઃખી થવાનું તો એમને માટે, કારણ કે એમારે આ ભૂલ કરી છે. આ બેમાંથી ગમે તે પરિસ્થિતિ હોય, પણ આમાં સૌથી વધુ શોભાસ્પદ વસ્તુ તો એ છે કે મારે બળવાન, શાંત અને અવિચિલિત બની રહેવું.”

હું જ્યારે આઈ વર્ષની હતી ત્યારે મારી જાતને આ પ્રકારનો બોધ આપતી અને તેનું અનુસરણ કરવા પ્રયત્ન કરતી. એ વસ્તુ, એના જેવા બધા જ પ્રસંગોમાં હજી

પણ સાચી છે.

(૧૭ એપ્રિલ ૧૯૩૨)

\*

### બાળકોને બે બોલ :

- (૧) જો તમારી ઈચ્છા હોય કે કોઈ તમારી મજાક ન કરે તે તમારે પણ કોઈની કદી પણ મજાક ન ઉડાવવી.
- (૨) જો બીજાઓ તમને માન આપે તેવું તમે ઈચ્છાતાં હો તો તમે પણ બીજાઓ સાથે માનબર્યો વ્યવહૃત કરો.
- (૩) જો સૌ કોઈ તમને ચાહે એવી તમારી ઈચ્છા હોય તો તમે પણ સૌને ચાહો.

\*

અહીં આપણે છોકરાઓ અને છોકરીઓને સાથે રાખીને ભગ્નાવીએ છીએ એટલે એ બાબતનો આગ્રહ રાખીએ છીએ કે એમની વચ્ચેના સંબંધો કોઈ પ્રકારની જાતીય લાગણી કે કામુકતા વિનાની સામાન્ય મિત્રતાવાળા હોવા જોઈએ. એમાં સર્વ પ્રકારની આસક્તિઓથી દૂર રહેવું જરૂરી છે. કોઈએ એકબીજાના રૂમાં જવું નહિ તેમ જ કોઈ ખાનગી મુલાકાતો ગોઈવવી નહિ. આ વસ્તુ સૌ કોઈને સ્પષ્ટ કરી દેવામાં આવેલી છે. અને જો આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે કોઈ રીતની દુઃખદાયક ઘટના બનવા પામે નહિ.

(૧૬ ઓગસ્ટ ૧૯૬૦)

\*

“જ્યોતિષીઓ એમ કહે છે કે જે લોકોનો જન્મ નવેમ્બર માસમાં થયેલો હોય છે તેઓ કામાંધ નીવે છે.”

જ્યોતિષીઓ જે કહે છે એને તમે માનો છો શા માટે? તમારી માન્યતા જ મુજ્જેલીને નોતરી લાવે છે.

શ્રી અરવિંદ કહે છે કે મનુષ્ય પોતે પોતાને જેવો માનતો હોય છે તેવો જ બને છે.

આ વસ્તુનો પ્રયોગ તમે એવી ધારણાપૂર્વક જ કરો કે તમે એક સારા બાળક છો અને તમે જાતીય વાસનાથી મુક્ત બનશો.

આ પદ્ધતિને તમે પાંચ વર્ષ સુધી ખંતપૂર્વક વળણી રહીને અમલમાં મૂકો, કોઈ

પણ પ્રકારની શંકા કે નિરુત્સાહને તમારામાં દાખલ ન થવા દો, અને પછી, પાંચ વર્ષ પછી મને તેનું પરિણામ તમે કહેશો.

એ પરિણામ વિષે કોઈ પ્રકારની શંકા સેવશો નહિ.

(૧૯૬૫)

\*

તમે આ જાતીય બાબતને વધુ પડતી અગત્યતા આપી રહ્યા છો.

એના વિષે કશો વિચાર જ ન કરશો. જે પ્રવૃત્તિઓ વધુ રસદાયક છે એમાં જ રસ લો, જ્ઞાન અને ચેતનામાં વિકાસ પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહ્યો. જ્યારે પણ કામવાસનાને લગતો વિચાર કે આવેગ આવતો લાગે ત્યારે એને લાત મારી દો-ત્યાર પછી તમે મારા એક સૈનિક બની રહેશો.

(૧૯૬૫)

\*

મેં તમને સૌને પહેલેથી જ કહી મૂક્યું છે કે તમે પોતે કોઈ છોકરા કે છોકરી છો એવો વિચાર જ ન કરવો, પરંતુ એટલો ભાવ જ રાખવો કે પ્રભુની શોધ કરવા, પ્રભુ બનવા અને પ્રભુનો આવિર્ભાવ કરવા પ્રયત્ન કરી રહેલાં માનવ સ્વરૂપો જ છો.

(૧૬ ફેબ્રુઆરી ૧૯૬૬)

\*

“જો જાતીય વિષયની બાબતમાં તદ્દન અજ્ઞાનીપણું હોય તે એનાથી ગંભીર મુશ્કેલી ઊભી થવા સંભવ છે. એટલે જે બાળકોને હું ઓળખું છું તેમને હું એ વિષયમાં થોડી માછિતી આપવા ધારું છું.”

જો આ વિષયમાં તદ્દન સાદું વૈદ્યકીય જ્ઞાન આપવામાં આવે તો એ ઉપયોગી થઈ શકે, કારણ કે એને લઈને આ મૂર્ખાભીભરી જુનવાળી રીતની શરમની લાગણી પ્રવર્તતી હોય છે તે દૂર થાય અને એને લઈને વિકૃતિઓ ઊભી થતી અટકે.

“વિદ્યાર્થીઓ એમ કહે છે કે અમે એક એવા સમાજના નિર્માણની રાહ જોઈએ છીએ જેમાં કોઈ રીતની જાતીયતા હોય જ નહિ અને એથી કરીને અમારે ભાષામાં પણ શા માટે જાતિના ઉપયોગની માથાકૂટ કરવી જોઈએ?”

આ એક ભજક છે... અથવા તો એક માનસિક રીતની ગુલાંટ છે અને એ રીતે, જે વસ્તુની શિખામાણ આપવામાં આવી છે તે વસ્તુને સમજવાનો ઈનકાર કરવાની ચાલાકીભરી રીત છે.

**“કેટલાક સારા વિદ્યાર્થીઓ, પૈસાને એટલું બધું મહુત્ત્વ આપે છે કે એથી આપણાને આંચયકો લાગે. અમે એ વિષયની ચર્ચા કરી શકીએ?”**

હા, પ્રયત્ન કરો — એની ઘણી જરૂર છે. આજકાલ પૈસો એ સર્વોપરી ભગવાન બની બેઠો છે. સત્ય વસ્તુ પશ્ચાદભૂમિકામાં હડસેલાઈ ગઈ છે, અને પ્રેમ તો નજરે પણ પડતો નથી!

આ પ્રેમ શબ્દ વેઠે હું ભાગવત પ્રેમની વાત કરું છું, કારણ કે લોકો જેને પ્રેમ સમજે છે એ તો પૈસાનો ઘણો સારો સોબતી છે.

જ્યારે કોઈ બાળક તમારી આગળ તેના કુંદંબના પૈસાની વાતો કરીને છાપ પાડવાનો પ્રયત્ન કરે ત્યારે તમારે મુંગા ન રહેવું. તમારે એ વસ્તુ સ્પષ્ટ કરવી કે દુન્યવી પૈસાની અહીં કોઈ ગણતરી નથી, ફક્ત જે પૈસાનું પ્રભુને અર્પણ કરવામાં આવે છે તેની જ કંઈક કિંમત છે; અને કોઈ મોટા બંગલાઓમાં રહેતું હોય, ફસ્ટ કલાસમાં પ્રવાસ કરતું હોય અને ઉડાઉપાણો પૈસા વાપરતું હોય તેથી એ મહાન બની જતું નથી. વળી એ પણ સમજાવવું કે તમારે જો તમારું મહુત્ત્વ વધારવું હોય તો એ માટે સત્યભાષી, સત્યનિષ્ઠ, આજ્ઞાપાલક અને કૃતજ્ઞ બનતાં શીખવું જોઈએ.

\*

મેં કહેલું છે કે પંદર વર્ષથી નાનાં બાળકોએ રાત્રીના નવથી મોડા સૂઈ જવું નાહિ, અને એ વસ્તુ હું ભારપૂર્વક કહું છું — જેઓ એમ નથી કરતાં તેઓ આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને એ વસ્તુ ખેદજનક છે.

\*

**“માતાજી, મધ્યરાત્રી પછીના કલાકો કરતાં તેની આગળના કલાકો ઊંઘને માટે સારા છે એમ કેમ હશે?”**

કારણ કે પ્રતીકાત્મક રીતે જોતાં, મધ્યરાત્રી સુધી, સૂર્ય આથમતો જતો હોય છે, જ્યારે મધ્યરાત્રી પછીના પહેલા કલાકથી જ એ ઊગતો જાય છે.

આશીર્વાદ.

(૨૨ ઓગસ્ટ ૧૯૬૬)

“માતાજી, વહેલા સૂર્ય જઈને વહેલા ઉઠવું એ સારું કેમ ગણાતું હુશે?”

જ્યારે સૂર્ય આથમે છે, ત્યારે પૃથ્વી ઉપર એક પ્રકારની શાંતિનું અવતરણ થાય છે અને આ શાંતિ ઊંઘને માટે સહાયક હોય છે.

જ્યારે સૂર્ય ઉંગે છે ત્યારે એક જોરદાર શક્તિ પૃથ્વી ઉપર ઉત્તરી આવે છે અને એ શક્તિ કામ કરવા માટે સહાય કરે છે.

જ્યારે તમે મોડા સૂર્યને મોડા ઉઠો છો ત્યારે તમે કુદરતના કાયદાથી વિરુદ્ધ વર્તન કરો છો અને એ વસ્તુ કાંઈ ડહાપણ ભરેલી ન ગણાય.

આશિષ.

(૨૧ ડિસેમ્બર ૧૯૬૬)

“માતાજી, અહીંના અમારા શિક્ષકો અને કેપ્ટનો પ્રત્યે અમારું વલાણ કેવું હોવું જોઈએ?”

તમારું વલાણ આજાપાલક, ઋજુ અને પ્રેમપૂર્ણ હોવું જોઈએ. એ તમારાં મોટાં ભાઈબેનો તમારે માટે ઘણી ઘણી મહેનત કરતાં હોય છે.

આશીર્વાદ.

(૧ ફેબ્રુઆરી ૧૯૭૦)

\*

## રજાઓ

“રજાઓની બાબતમાં આશમમાં બે ગ્રકારની અફ્વાઓ ચાલે છે: ‘એકમાં એવું છે કે આપ આ વખતે રજાઓમાં અમને બહુાર જવા દેનાર છો, પણ પછીના વર્ષે નહિ. બીજુ અફ્વા એવી છે કે આપ અમને બહુાર જવા દેવા માગતાં નથી.’ આમાંની કઈ અફ્વા સાચી છે તે મારે જાણવું છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓએ રજાઓમાં બહુાર જવા માટે આપની પાસેથી પરવાનગી મેળવી લીધી છે.”

બેમાંથી એકે ય સાચી નથી, બેમાંથી એકે ય ખોટી નથી.

એ બંને અને બીજુ અનેક અફ્વાઓ મારા સંવાદસાધક અને સમન્વયાત્મક સંકલ્પની વિકૃત રજૂઆત છે.

દરેક વ્યક્તિને માટે, એ જો સત્યનિષ હોય છે તો એની જરૂરિયાત મુજબ મારો ઉત્તર હોય છે.

(૧૭ ઓક્ટોબર ૧૯૬૪)

\*

“માતાજી, બહુાર જવાથી અમારી આધ્યાત્મિક સમૃદ્ધિ ગુમાવી બેસીએ છીએ એનું શું કારણ હુશે અને એ કેવી રીતે ખોવાઈ જતી હુશે? અમે અમુક સભાન રીતનો પ્રયત્ન કરી શકીએ છીએ અને આપની હાજરી પણ હુંમેશાં ઉપરિથત તો હોય છે જ, ખરું કે નહિ?”

પોતાનાં મા-બાપ પાસે જવામાં, ઘણખરું બીજા કોઈ પણ જાતના પ્રભાવ કરતાં તમે વધુ બળવાન પ્રભાવ હેઠળ આવો છો: તમારા આધ્યાત્મિક વિકાસમાં તમને તમારાં મા-બાપ સહાય કરે એવું વિરલ પ્રસંગે જ બને છે, કારણ કે સામાન્ય રીતે એ લોકોને ભૌતિક પ્રાપ્તિમાં વધુ રસ હોય છે.

જે મા-બાપને આધ્યાત્મિક સિદ્ધિમાં વધુ રસ હોય છે તેવાં મા-બાપ, સામાન્ય રીતે તેમનાં બાળકોને તેમને મળવા બોલાવતાં નથી.

આશીર્વાદ.

(૮ નવેમ્બર ૧૯૬૬)

\*

જે વિદ્યાર્થીઓ શાળાનું વર્ષ ૧૬મી ડિસેમ્બરે શરૂ થાય છે તે દિવસે હાજર નહિ હોય તેમને આખું યે વર્ષ તેમના વર્ગોમાં હાજરી આપવા દેવામાં નહિ આવે.

(૮ નવેમ્બર ૧૯૬૬)

\*

## રજાઓ\*

આપણે પવિત્ર દિવસો કહીશું? એ બે પ્રકારના છે. શાસ્ત્રકથન પ્રમાણે પ્રભુએ આ સૃષ્ટિનું નિર્માણ કરવા માટે છ દિવસ (અથવા યુગો) સુધી કર્મ કર્યું અને સાતમો દિવસ તેમણે આરામ, એકાગ્રતા અને ધ્યાન કરવામાં ગાળ્યો. આને આપણે પ્રભુનો દિવસ કહી શકીએ.

બીજો પ્રકાર આવો છે: મનુષ્યો અને પ્રાણીઓ તેમના અંગત હેતુઓ માટે અને અહંમૂલક કામનાઓ સિદ્ધ કરવા માટે છ દિવસ કામ કરે છે અને સાતમે દિવસે તેઓ આરામ લે છે અને અંતરમાં કે ઉર્ધ્વમાં દૃષ્ટિનાખે છે, પોતાના અસ્તિત્વ અને ચેતનાના મૂળ જ્ઞાતનું ધ્યાન ધરે છે, તેમાં દૂબકી લગાવીને પોતાની શક્તિઓને સતેજ કરે છે.

આ શાબ્દ અથવા વસ્તુને સમજવાની આધુનિક પદ્ધતિ વિષે કંઈ કહેવાની ભાષ્યે જ જરૂર પડે, એટલે કે, એમાં તો આનંદપ્રમોદની પ્રાપ્તિ માટેના વ્યર્થ પ્રયત્નો કરીને સમય બગાડવાપણું જ હોય છે.

\*

“ઓરોવિલખમાં રહેનાર જે લોકોને સાચા સેવકો બનવું છે તેમને માટે રવિવાર એ રજાનો દિવસ છે ખરો?”

શરૂઆતમાં, કામની વ્યવસ્થા એવી રીતે ગોઈવેલી કે દરેક વ્યક્તિ, પોતે જે સમૂહમાં રહેતી હોય તેના માટે છ દિવસ કામ કરે અને સાતમો દિવસ પ્રભુની આંતરિક ખોજ માટે અને પોતાના સ્વરૂપનું પ્રભુને સમર્પણ કરવા માટે જુદો રાખેલો. એટલે રવિવારને આરામનો દિવસ રાખવા પાછળનો સાચો અર્થ અને કારણ આ જ છે.

સિદ્ધ પ્રાપ્ત કરવા માટે સત્યનિષ્ઠા તો હોવી જ જોઈએ, એમાં કાંઈ કહેવાનું ન હોય; અસત્ય ગમે તે પ્રકારનું હોય, પણ એ છેવટે તો એક અધઃપાત જ છે.

(૨૫ ઓક્ટોબર ૧૯૭૧)

\*

---

\* અંગ્રેજમાં શાબ્દ Holy day છે.

## આશ્રમની બહુર અભ્યાસ

મારો દૂરાદો એવો હતો કે એ વિષયમાં કાંઈ પણ કખા વિના તમને અભ્યાસ માટે ઈંજલેન્ડ જવા દેવા, કારણ કે દરેક વ્યક્તિને પોતાના પસંદ કરેલા માર્ગનું અનુસરણ કરવાની સ્વતંત્રતા છે. પરંતુ તમે જ્યારે લઘ્યું જ છે ત્યારે મને એમ લાગે છે કે તમને ઉત્તર આપવાની મારી ફરજ છે.

એમાં કોઈ શંકા નથી કે બાધ્ય દૃષ્ટિબંધુથી જોતાં, ઈંજલેન્ડમાં તમને એવી બધી જ સગવડો મળી રહેશે કે જેથી લોકોમાં જેને જ્ઞાન ગણવામાં આવે છે તે તમને પ્રાપ્ત થાય. પરંતુ સત્ય અને ચેતનાની દૃષ્ટિએ જોતાં, અહીં જે વાતાવરણમાં તમે રહો છો તેવું બીજે કોઈ ઠેકાણે નહિ મળે. અન્ય સ્થળે તમને ધાર્મિક કે આધ્યાત્મિક ભાવના પણ મળી આવે, પરંતુ સાચી આધ્યાત્મિકતા, પ્રભુનો સીધો સંપર્ક, એમને જીવન, મન અને કર્મભાં સાક્ષાત કરવાની અભીષ્ટા, — આ વસ્તુઓ જગતમાં જવલ્લે જ અને ગણીગાંઠી વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે અને કોઈ યુનિવર્સિટી તે ગમે તેટલું આગળ વધેલી હોવાનો દાવો કરતી હોય પણ એની પાછળ એ વસ્તુઓ એક જીવંત હકીકત તરીકે નહિ હોય.

વ્યાવહારિક રીતે, જ્યાં સુધી તમને લાગેવળું છે ત્યાં સુધી, અહીં તમને જે અનુભૂતિ પ્રાપ્ત થઈ છે તેનાથી દૂર ખેંચાઈ જવાનું મોટું જોખમ ઊભું થશે અને તમારું શું થશો તે તમે જાણી શકશો નહિ,

મારે આટલું જ કહેવાનું હતું — હવે પસંદગી કરવાનું અને નિર્ણય લેવાનું હું તમારી ઉપર છોટું છું.

(૨૨ ઓક્ટોબર ૧૯૫૨)

\*

“અમે અહીં બાળપણથી રહેલા કેટલાક લોકોને આશ્રમ છોડીને કોઈ વ્યવસાય અર્થે અથવા તો અભ્યાસ માટે જતાં જોઈએ છીએ. જ્યારે એવા લોકોને આશ્રમ છોડીને જતા જોઈએ છીએ ત્યારે ખાસ કરીને અમારામાંના કુમળી વયના લોકોમાં અમૃત પ્રકારની અનિશ્ચિતતા ઊભી થાય છે અને એ લોકો બીતાં બીતાં એમ કહે છે કે, “કોણ જાણે કો’ક દિવસ મારો પણ આવો વારો ન આવે?” મને લાગે છે કે આ બધા પાછળ કોઈ બળ કામ કરી રહ્યું છે, એ શું દશો?”

આ પ્રકારની અનિશ્ચિતતાની લાગણી અને વિદ્યાય લેવાની ઘટનાઓની પાછળ એક એવી નિઝન પ્રકૃતિનું કાર્ય રહેલું છે કે જે યોગશક્તિના પ્રભાવમાં બાધા નાખે છે અને પ્રભુના કાર્યના વેગને ધીમો પાડવા માગે છે. એની પાછળ કોઈ રીતની અશુભ ભાવના રહેલી નથી પરંતુ એવી ખાતરી કરી લેવી હોય છે કે ધ્યેયને પહુંચવાની ઉત્તાવળમાં કશું પણ રહી ન જાય અથવા ભૂલી ન જવાય. અહીં ભણનારાં ઘણાં બાળકોને, તેઓ પ્રભુના કાર્ય માટે તૈયાર થાય તે પહેલાં જીવનની જવાબદારીઓનો સામનો કરવાનો આવે છે અને એટલે તેઓ સામાન્ય જીવનની કસોટીએ ચડવા આશ્રમ છોડીને જાય છે.

(૧૧ નવેમ્બર ૧૯૬૪)

\*

(એક બાળકને કલકત્તામાં એક વ્યવહૃત રીતે ઉપયોગી કોર્સ માટે આમંત્રણ મળેલું તેના સંબંધમાં.)

જે લોકોને શીખવાની ખરા હૃદયની જંખના છે, તેમને માટે અહીં સર્વ પ્રકારની શક્યતાઓ રહેલી છે. અહીં જે વસ્તુ નથી અને બહાર છે તે વસ્તુ એ છે કે બાધ શિસ્તનું નૈતિક બંધન.

અહીં તમે સ્વતંત્ર છો અને જે કાંઈ બંધન છે તે તમે જ્યારે સત્યનિષ્ઠ બની પોતાની મેળે પોતાની ઉપર મૂક્યું હોય છે એટલું જ છે.

હુવે નિર્ણય તમારે કરવાનો છે.

(૩ ઓગસ્ટ ૧૯૬૬)

\*

“જે છોકરાઓ અને છોકરીઓ અમને એમ કહે છે કે તેઓ અહીં ભણવા આવેલાં છે, યોગ કરવા નહિ, એટલે તેઓ મનમાં આવે તે કરી શકે છે — આ વસ્તુ મૃત્યે અમારે કયું વલાણા રાખવું?”

એમને કહી દેવું કે એમણે અહીં રહેવું ન જોઈએ. આપણે એમની ઉપર યોગસાધના લાદતા નથી; પરંતુ એ લોકોએ ચોખાઈભરી અને સુધા જિંદગી ગાળવી જોઈએ. જો એમને એમ ન કરવું હોય તે બીજે ગમે ત્યાં જઈ શકે છે.

## “માતાજી, એમને અહીંથી કાઢી મૂકી શકાય?”

આવા લોકોમાંથી જેનો અભ્યાસ નબળો હોય એવી એક વ્યક્તિને મારી પાસે મોકલજો. હું અમુક રીતનો અખતરો કરીશ. જો એ સફળ નીવડે તો તમે બીજાને પણ મારી પાસે લાવજો.

\*

(એક શિક્ષકે લઘેલું કે કેટલાક વિદ્યાર્થીઓને શિક્ષણ કેન્દ્ર પ્રત્યે અસંતોષ છે.)

તમે એમને કહી શકો છો કે જો તેઓને એમ ન લાગતું હોય કે જે વસ્તુ બીજે શીખવા ન મળે તે વસ્તુ એમને અહીં શીખવા મળે છે, તો પછી બીજી કોઈ શાળામાં જઈ શકે છે. આપણાને એમની ખોટ વર્તાવાની નથી.

ચીલાચાલુ વ્યક્તિઓના સમૂહ કરતાં ચૂટેલાં થોડાંક બાળકો રાખવાં વધુ સારું છે.

\*

(એક વિદ્યાર્થીને એનો અભ્યાસ લગભગ પૂરો કર્યો હતો. એ નિર્ણય કરી શકતો ન હતો કે એણે યુનાઇટેડ સ્ટેટ્સમાં કોલેજમાં દાખલ થવું કે આશ્રમમાં રહીને જીવન ગાળવું અને કાર્ય કરવું. એણે શ્રી માતાજીને નિર્ણય કરવાનો અનુરોધ કરેલો.)

હું તમને સીધેસીધું કહી દઈ શકું હું કે સર્વ વસ્તુઓનો આધાર તમે જીવનમાંથી શાની અપેક્ષા રાખો છે તેની ઉપર છે. જો તમારે સામાન્ય જીવન અથવા એથી વધુ તો લોકોમાં ગણાતી જૂની રીતની સફળતાપૂર્વકનું જીવન ગાળવું હોય, તો બેશક, અમેરિકા જાઓ અને તમારાથી થાય એટલો લાભ ઉઠાવવા પ્રયત્ન કરો.

એથી ઉલટું, જો તમારે ભાવિ માટે તૈયાર થવું હોય અને જે નૂતન સર્જનની એ તૈયારી કરી રશ્યું છે તેને માટેની અભીષ્ટા સેવતા હો તો અહીં જ રહો અને જે વસ્તુ આવનાર છે તેને માટે તૈયારી કરો.

(૧૭ જાન્યુઆરી ૧૯૬૬)

\*

આપણે અહીં એવાં જ બાળકો જોઈએ છે જેઓ નૂતન જીવન માટે તૈયારી કરવા માગતા હોય અને જીવનની સામાન્ય સફળતા કરતાં પ્રગતિને વધુ મહત્ત્વ આપતાં હોય. આપણે એવાં બાળકો જોઈતાં નથી જેઓ દુનિયામાં કમાણી કરવા માટે તૈયાર થવા માગતા હોય અને જેમને દુનિયવી રીતની સફળતા જોઈતી હોય. એ લોકો બીજે ગમે ત્યાં જઈ શકે છે.

બાળકો પાસેથી આપણે જે વસ્તુની અપેક્ષા રાખીએ છીએ તેઓ દસ વર્ષ કરતાં મોટી ઉંમરનાં હોવાં જોઈએ — એમાંનાં જે કોઈ નવીન સાહસ માટે તૈયાર હોય, જેમને નૂતન જીવન જોઈતું હોય, જેઓ ઉચ્ચતર સિદ્ધિ માટે તૈયાર છે, જેમને આ જગત બદલવાની દૃઢા છે અને જેવું ચાલે છે એમ ને એમ લાંબો સમય ચાલવા દેવું નથી એવાં બાળકને આપણે આવકારીએ છીએ.

આપણે તેમને સહાય કરીશું.

(જાન્યુઆરી ૧૯૭૨)

\*

આવજે, મારા બાળક, તારી જે અનુભૂતિ હતી તેને કદ્દી પણ ભૂલીશ નહિ અને બહારના અંધકારને તારી ચેતનાને આવરી દેવા અગર ભેદવા દઈશ નહિ. હું તારી સાથે છું.

\*

આવજો, મારાં બાળકો, હું આશા રાખું છું કે જીવન તમારે માટે સુખમય બને, અને એક દિવસ તમે જ્યોતિ અને સત્યમાં પુનર્જન્મ પામો.

\*

## શિક્ષકોને

ભાગતર પ્રત્યે, હુમેશાં અને સર્વ સ્થળે શીખવામાં રસ જાગે, એ બાળકને આપી શકાય તેવી ઉત્તમ ભેટ છે.

\*

પોતાની જાત વિષે જ્ઞાન મેળવતાં અને પોતાની જાત ઉપર કાબૂ રાખતાં શીખવું એ દરેક જીવંત સ્વરૂપની મૌંઘી મૂરી છે. પોતાની જાતને જાણવી એટલે પોતાનાં કાર્યો અને પ્રતિકાર્યો પાછળના હેતુઓ વિષે, પોતાની અંદર જે કાંઈ બને છે તે કેમ અને કેવી રીતે બને છે તે વિષે જ્ઞાન પ્રાપ્ત કરવું. પોતાની જાત ઉપર કાબૂ રાખવો એટલે પોતે જે વસ્તુ કરવાનો નિર્ણય કર્યો હોય તે કરવી, એના સિવાય બીજું કાંઈ ન કરવું અને આવેગો, કામનાઓ કે તરંગો પ્રત્યે ધ્યાન ન આપવું અને તેમનું અનુસરણ ન કરવું.

એક નાના બાળકને નીતિના નિયમ શીખવવા એ કાંઈ આદર્શ વસ્તુ નથી. પરંતુ એમ કર્યા સિવાય ચલાવી લેવું પણ ધાણું મુશ્કેલ છે. જેમ જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ તેને સર્વ નૈતિક અને સામાજિક નિયમોમાં રહેલી સાપેક્ષતા શીખવી શકાય, જેથી કરીને તે પોતાની અંદરથી જ એક ઉધ્વર્તર અને વધુ સત્ય નિયમ શોધી શકે. જે લોકો માનવનિયમોનો અસ્વીકાર કરે છે અને પોતાના સ્વાતંત્ર્ય અને “પોતાનું જીવન પોતાની રીતે જીવવા”ના નિર્ણયની ઘોષણા કરે છે તેમાંના મોટા ભાગના લોકો કેવળ પોતાની પ્રાણમય ગતિઓને આધીન થઈને એમ કરે છે. એમને તે પોતાની નહિ તો બીજાની નજરથી સંતાપવા અને વાજબી હરાવવા પણ પ્રયત્ન કરે છે. એ લોકો નીતિમતાને લાત મારે છે કારણ કે એ વસ્તુ એમની અંધ પ્રેરણાઓને સંતોષવામાં આડે આવે છે.

જ્યાં સુધી તમે નૈતિક અને સામાજિક નિયમોની ઉપર પોતાનું સ્થાન લીધું ન હોય ત્યાં સુધી તેમની યોગ્યાયોગ્યતાની તુલના કરવાનો કોઈને અધિકાર નથી. આપણે એ નૈતિક અને સામાજિક નિયમોને બદલે કોઈ ઉચ્ચતર વસ્તુ સ્થાપી શકતા ન હોઈએ — જે કરવું સહેલું નથી — તો એથી એમનો ત્યાગ કરવો યોગ્ય નથી.

ગમે તે પ્રસંગે, જો કોઈ બાળકને ઉત્તમમાં ઉત્તમ ભેટ આપવાની હોય તો એ ભેટ તેને પોતાની જાતનું જ્ઞાન પામતાં શીખવવામાં અને પોતાની જાત ઉપર કાબૂ રાખતાં શીખવવામાં રહેલી હોય છે.

(જુલાઈ ૧૯૩૦)

\*

## સફળ શિક્ષકના વ્યક્તિત્વનાં પાસાં\*

૧. સંપૂર્ણ આત્મસંયમઃ તમે કોઈ પણ રીતે ગુરુસો ન બતાવો એટલું જ નહિ, પણ કોઈ પણ સંયોગો હેઠળ તમારે સંપૂર્ણ શાંત અને અક્ષુભ્ય રહેવું જોઈએ.

૨. આત્મવિશ્વાસઃ આ પરતે તમને એ પણ ભાન રહેવું જોઈએ કે તમારું મહત્ત્વ સાપેક્ષ પ્રકારનું છે.

સૌથી વિશેષ તો એ કે શિક્ષકને એ જ્ઞાન હોવું જોઈએ કે તે જો પોતાના વિદ્યાર્થીઓ પ્રગતિ કરે એમ ઈચ્છાઓ હોય તો તેણે પોતે જ હંમેશાં પ્રગતિ કરતા રહેવું જોઈએ. પોતે જે કંઈ હોય યા પોતે જે કંઈ પણ જાણતો હોય તેટલા માત્રથી સંતુષ્ટ ન રહેવું જોઈએ.

૩. પોતાના વિદ્યાર્થીઓ કરતાં પોતામાં કોઈ તાત્ત્વિક રીતનું ચઢિયાતાપણું છે એવી કોઈ વૃત્તિ તેનામાં ન હોવી જોઈએ; તેમ જ વિદ્યાર્થીઓમાંથી કોઈ અમુક પ્રત્યે વધુ પડતી પસંદગી કે આસક્તિ ન હોવી જોઈએ.

૪. તેણે જાણવું જોઈએ કે આધ્યાત્મિક રીતે બધા સમાન છે અને અન્ય પ્રત્યે માત્ર સહિષ્ણતાનો ભાવ જ ન રાખતાં તેણે એક વિશ્રદ્ધ દૃષ્ટિ યા સમજણ ધારણ કરવો જોઈએ.

૫. “મા-બાપ તથા શિક્ષક એ બંનેએ બાળક પોતે પોતાની જાતને કેળવતું થાય, પોતાની બૌદ્ધિક, નૈતિક, રસાત્મક અને વ્યવહારું શક્તિઓ વિકસાવે અને પોતે એક પૂર્ણ વ્યક્તિ તરીકે મુક્તપણે વિકાસ સાધે એ રીતનો વિકાસ કરવાની શક્તિ તેને મેળવી આપવાની છે તથા તેમાં સહાય કરવાની છે. બાળક કોઈ નિર્જવ માટીનો લોંઘો છે એમ માની તેને ગુંડી ગુંડીને ઘાટ આપવાનો હોતો નથી” (શ્રી અરવિંદ, વ્યુભન સાયકલમાં).

(પ્રસિદ્ધ : જૂન ૧૯૫૪)

\*

એ કદી ન ભૂલશો કે એક સારા શિક્ષકે સર્વ પ્રકારના અહુંકારનો ત્યાગ કરવાનો હોય છે.<sup>1</sup>

(૧૦ ડિસેમ્બર ૧૯૫૮)

\* શિક્ષકોને એક કંલેજ તરફથી શિક્ષણ કેન્દ્રને આ વિષય ઉપર એક પ્રશ્નાવલી મોકલવામાં આવેલી તે શ્રી માતાજીને બતાવવામાં આવેલી. એ સમયે શ્રી માતાજીએ આ પ્રકારની ટિપ્પણી કરેલી.

1. શિક્ષકોની વાર્ષિક સભા માટેનો સંદેશ.

અને શ્રી અરવિંદે આપણને આપેલા અતિમાનસ સત્ય પ્રમાણેનું શિક્ષાણ આપવા માટે આપણામાંથી અહુંકારે તો વિદ્યાય જ લેવી જોઈએ.\*

(૩૧ સપ્ટેમ્બર ૧૯૬૦)

સર્વ પ્રકારના અભ્યાસના વિષયો, અને કંઈ નહિ તો મોટા ભાગના અભ્યાસના વિષયોમાં ભૂતકાળ વિશે જ્ઞાન મેળવવાનું આવે છે અને એમાંથી એવી આશા રાખવામાં આવે છે કે તમે વર્તમાનને વધુ સારી રીતે સમજી શકશો.

પરંતુ વિદ્યાર્થીઓ ભૂતકાળને ચીટકી રહે અને ભાવિ પ્રત્યે નજર નાખવાનો ઇનકાર કરે તે ભયને નિવારવાની આપણી ઈચ્છા હોય તો આપણે વિદ્યાર્થીઓને સારી રીતે કાળજી રાખીને સમજાવવું જોઈએ કે ભૂતકાળમાં જે કંઈ બનેલું છે તેણે વર્તમાનને તૈયાર કર્યો છે અને એ વર્તમાને ભાવિને માટેનો એવો માર્ગ તૈયાર કર્યો છે, જે ખરેખર સૌથી વધુ અગત્યની વસ્તુ છે અને તેનું અનુસરાણ કરવા માટે આપણે તૈયાર થવાનું છે.

પોતાની અંદર અંતઃપ્રશ્નાની બિલવણી કરીને જ આપણે આપણી જાતને ભાવિ માટે તૈયાર કરી શકીએ છીએ.

(૧૮ સપ્ટેમ્બર ૧૯૬૭)

\*

ભૂતકાળ કરતાં ભાવિ વિષે વધુ વિચાર કરો.\*

(૧૫ ડિસેમ્બર ૧૯૭૨)

\*

## શિક્ષાણ

શાળા એ શિક્ષક તેમ જ વિદ્યાર્થી, બંને માટે પ્રગતિ કરવાની શક્યતાનું સ્થાન હોવું જોઈએ. દરેકને પોતપોતાની રીતે વિકાસ સાધવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

શિક્ષાણની કોઈ પદ્ધતિ પોતે જ શોધી કાઢી હોય તો તેના કરતાં બીજી કોઈ

\* શિક્ષકોની વાર્ષિક સભા માટેનો સંહેશ.

પદ્ધતિ વધુ સારી રીતે લાગુ કરી શકતી નથી. એમ નથી હોતું ત્યારે એ આખીએ વસ્તુ, શિક્ષક તેમ જ વિદ્યાર્થી, બંનેને માટે કંટાળાજનક બની રહે છે.

\*

એક વસ્તુ મારે ભારપૂર્વક કહેવી જોઈએ. બહારની યુનિવર્સિટીઓ જે કરે છે તેનું અનુસરણ કરવા પ્રયત્ન ન કરશો. વિદ્યાર્થીઓમાં ફક્ત આંકડા અને માહિતીનો બંડાર ઠાંસીને ભરવાનો પ્રયત્ન ન કરશો. એમને એટલું બધું લેસન ન આપશો કે જેથી એમને બીજું કાંઈ કરવા માટે સમય જ ન રહે. આપણે કોઈ ટ્રેન પકડવાની ઉતાવળમાં નથી. વિદ્યાર્થીઓ જે શીખે છે તે તેમને સમજવા દો. એ જ્ઞાન એમને આત્મસાત્ત કરવા દો. આપણે નક્કી કરેલો અભ્યાસક્રમ પૂરો કરી નાખવો છે એવા લક્ષ્યપૂર્વક કામ ન કરો. તમારે તમારો કાર્યક્રમ એવી રીતે ગોઠવવો કે વિદ્યાર્થી ઓને જે વિષયો શીખવા હોય તેને માટે તેમને સમય મળે. એમને શારીરિક કસરતો માટે પૂરતો સમય રહેવો જોઈએ. હું ઈચ્છતી નથી કે એ લોકો વિદ્યાર્થી તરીકે સારા પણ ઝીક્કા, દૂબળા અને પીળા પરી ગયેલા હોય. કદાચ તમે એમ કહેશો કે આમ કરીશું તો એમને અભ્યાસ કરવા માટે પૂરતો સમય જ નહિ રહે. તો પછી એમ કરવું પડશો કે અભ્યાસક્રમને માટે સમયમર્યાદા લંબાવવી પડશો. અમુક કોર્સને પૂરો કરવા માટે ચાર વર્ષ લેવાને બદલે ભલે છ વર્ષ લાગે. એમના માટે એમ થાય તો વધુ લાભદારી નીવહણો. એ લોકો અહીંના વાતાવરણને વધુ પ્રમાણમાં આત્મસાત્ત કરી શકશો અને એમની પ્રગતિ બીજી વસ્તુઓને ભોગે એક દિશામાં જ નહિ થાય. આ રીતે એમની પ્રગતિ સવદિશીય બનશે.

(૧૦ સપ્ટેમ્બર ૧૯૫૩)

\*

“જો હાયર કોર્સના વિદ્યાર્થીઓને ઓછું લેસન આપવાનું હશે અને એમનું ઘોરણ પણ જાળવવું હશે તો પછી, જે લોકોને એમ લાગતું હોય કે એમને વધુ પડતું લેસન અપાય છે એમને થોડાક વિષયો છોડી દેવાનું કહેવું પડશો. એ રીતે, એ લોકો જે વિષયો લેવા માગતા હશે તેની ઉપર તેમનો સમય અને શક્તિ, વધુ પ્રમાણમાં એકાગ્ર રીતે વાપરી શકશે. એમના અભ્યાસક્રમને વધુ હળવો બનાવવા કરતાં આમ કરવું વધુ સારું રહેશો, એ કારણે એને લઈને અન્ય વિદ્યાર્થીઓ માટે તેમનું જે મૂલ્ય છે તે ઓછું નહિ થાય. એ તો સ્વાતાન્ત્રિક છે કે આપણા કેટલાક વિદ્યાર્થી

ઓને કુદરતી બાક્ષિશ છે એટલે એ લોકો અભ્યાસકરને પહુંચી વળે છે, પણ બીજા કેટલાકને એવી કુદરતી બાક્ષિશ ન હોય તેઓ એટલી ઝડપને પહુંચી ન વળે. એવા બીજા પ્રકારના વિદ્યાર્થીઓ, અમૃક વિષયોને હુમણાં પૂરતા બાકી રાખે અને પાછળથી એક વર્ષ વધુ લઈને પૂરા કરે. આ ઉકેલ બરાબર છે?"

આ વસ્તુ સાપેક્ષ રીતની છે. આ બાબતમાં કોઈ સર્વસામાન્ય નિયમ ન બનાવી શકાય. એમાંના ઘણાખરાને આથી લાભ નહિ થાય. એ લોકો એવી કક્ષાએ પહુંચેચા નથી કે જેથી એ લોકો થોડા વિષયો લે તો વધુ વિષયોમાં કરી શકે તેના કરતાં થોડાક વિષયો ઉપર વધુ પ્રમાણમાં એકાગ્રતા કરી શકે. આનું પરિણામ તો એ આવશે કે એ લોકો એકાગ્રતા કરવાને બદલે ઢીલાશ કરશે — અને એ તો સમયનો બગાડ કર્યા બરોબર થશે.

આનો ઉકેલ અહીં નથી. તમારે જે કરવાનું છે તે એ કે પોતે જે કાંઈ કરતાં હોય તેમાં બાળકોને રસ લેતાં કરવાં — એમ કરવું અને વિદ્યાર્થીઓમાં રસ જાગ્રત કરવો એ બંને એક વસ્તુ નથી! તમારે એમનામાં જ્ઞાન માટેની, પ્રગતિ માટેની જંખના જાગ્રત કરવી જોઈએ. કોઈને જો પ્રગતિ કરવી હોય છે તો એ ગમે તે વસ્તુ દ્વારા કરી શકે છે. ઉ. ત. કોઈ રૂમને સાફસ્કૂફ કરીને પણ — પરંતુ આ વસ્તુ એકાગ્રતાપૂર્વક, એક અનુભવ ખાતર, પ્રગતિ કરવા માટે અને વધુ સભાન બનવા માટે કરવી જોઈએ. મારી પાસે જે વિદ્યાર્થીઓ આવીને મને કહે છે કે તેમના શિક્ષક સારા નથી. એમને માટે આ વાત અનેક વાર કહેવી પડે છે. ભલે એમને શિક્ષક પ્રત્યે નાપસંદગી હોય, કદાચ એ એમને નકામી વસ્તુઓ કહેતા હોય, કદાચ એ જોઈએ તેટલી ઊંચી કક્ષાના ન હોય, તો પણ તેઓ તેમના વર્ગમાંથી લાભ ઉઠાવી શકે, કોઈ અત્યંત રસદાયી વસ્તુ શીખી શકે છે અને ચેતનામાં પ્રગતિ કરી શકે છે.

મોટા ભાગના શિક્ષકોને સારા વિદ્યાર્થીઓ જોઈએ છે: સારા વિદ્યાર્થીઓ એટલે જેઓ ખંતપૂર્વક ધ્યાન આપતા હોય, જેમની સમજશક્તિ સારી હોય, જેઓ ઘણું જાણતા હોય અને પ્રશ્નોના ઉત્તરો સારી રીતે આપતા હોય, આને લઈને બધું વાણસી જાય છે. વિદ્યાર્થીઓ તેમની ચોપડીઓ વાંચવા લાગી જાય છે, ભાણવા અને શીખવામાં લાગી જાય છે. આ રીતે તો તેઓ કેવળ પુસ્તકો ઉપર અથવા બીજા લોકો જે કાંઈ કહેતા હોય કે લખતા હોય છે તેની ઉપર ધ્યાન આપે છે અને અંતઃપ્રશ્નાને લઈને જ્ઞાન મેળવનાર જે અતિ ચેતન ભાગ છે તેની સાથેનો સંપર્ક

ગુમાવી દે છે. નાનાં બાળકોમાં આવો સંપર્ક ઘણુંખરું હોય છે ખરો, પરંતુ અભ્યાસ દરમ્યાન એ ચાલ્યો જાય છે.

વિદ્યાર્થીઓ સાચી દિશામાં પ્રગતિ કરે તે માટે શિક્ષકો આ વસ્તુ સમજી લે એ ખાસ જરૂરી છે અને એ માટે એમણે વસ્તુઓને જોવાની અને શીખવવાની જૂની રીતોમાં પરિવર્તન કરવું પડશે એ તે સ્પષ્ટ છે. જો એમ નહિ થાય તો મારું કામ અટકી પડશે.

(૧૬ ડિસેમ્બર ૧૯૫૮)

\*

(ઉચ્ચ કક્ષાના સાહિત્યના અભ્યાસક્રમમાં અંગ્રેજી સાહિત્યને ફરજિયાત વિષય રાખવો કે મરજિયાત, એ વિષે શિક્ષકોમાં મતભેદ હતો. જ્યારે આ વસ્તુ શ્રી માતાજી પાસે નિર્ણય માટે રજૂ કરવામાં આવી ત્યારે તેમણે આ પ્રમાણે (ઉત્તર આપ્યા.)

### શિક્ષકોને :

વસ્તુ વ્યવસ્થા પ્રત્યેનું વલાણ જેટલું અગત્યનું છે તેટલી તેની વિગતોની અગત્ય નથી.

એમ લાગે છે કે શિક્ષકો પોતે જ જો બૌદ્ધિક કક્ષાથી ઉપર નહિ જઈ શકે તો તેઓ તેમની ફરજ બજાવવામાં અને તેમનું કાર્ય સિદ્ધ કરવામાં મુશ્કેલી અનુભવશે.

(૧૦ ઓગસ્ટ ૧૯૬૦)

\*

તમે વસ્તુઓને એકસરખી કરીને એકતા નહિ સ્થાપી શકો.

કાર્યક્રમો અને પદ્ધતિઓને એકસરખી કરવાથી શિક્ષણામાં એકતા નહિ આવે.

એકતાની પ્રાપ્તિ માટે, આપણો જે મધ્યવર્તી આદર્શ છે, જે કેન્દ્રસ્થ શક્તિ કે જ્યોતિ છે, જે આપણા શિક્ષણનો હેતુ અને ધ્યેય છે તેના પ્રત્યે — સતતપણે, પ્રસંગાની જરૂર પ્રમાણે શાંત રહીને કે અભિવ્યક્તિ દ્વારા — નિર્ભરતા રાખવાની જરૂર છે.

જે સાચી એકતા છે તે પોતાને વિવિધતામાં અભિવ્યક્ત કરે છે. કેવળ માનસિક તાર્કિકતા જ એકસરખાપણાની માગણી કરે છે. વ્યવહારું રીતે, દરેકે પોતાની આગવી પદ્ધતિ શોધી કાઢીને, તે પોતે જેને સમજતો અને અનુભવતો હોય તેનો

ઉપયોગ કરવો જોઈએ. જો આમ કરવામાં આવે, તો જ શિક્ષણનું કામ અસરકારક બની શકશે.

(૧૩ ઓક્ટોબર ૧૯૬૦)

\*

“માતાજી, આપ થોડા શબ્દોમાં આપ જેને તત્ત્વતः “સ્વતંત્ર પ્રગતિ” કહો છો તેની વ્યાખ્યા આપશો?”

જે પ્રગતિનું માર્ગદર્શન આત્મા દ્વારા થતું હોય, જે આદતો, રિવાજો કે પૂર્વધારિત વિચારો પર આધાર ન રાખતી હોય.

\*

(અનેક શિક્ષકોને શ્રી માતાજીને એક એવો રિપોર્ટ મોકલ્યો જેમાં વિદ્યાર્થી ઓના અનિયમિત અભ્યાસ અને વર્ગોમાંની અનિયમિત દ્વારા વિષે ઉંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. શિક્ષકોના અભિપ્રાય પ્રમાણે ગાયુણાંકચા વિદ્યાર્થીઓ જ સંતોષજનક રીતે અભ્યાસ કરતા હતા. આના ઉકેલ તરીકે તેમાણે એવું સૂચન કરેલું કે વર્ગોની વ્યવસ્થા વધુ કડક રીતની થવી જોઈએ. શ્રી માતાજીએ આ પ્રમાણે ટિપ્પણી કરેલી :)

### પ્રથમ તો શિક્ષકોને:

રિપોર્ટમાં આપેલા આંકડાઓથી મને સંતોષ છે. કોઈ ગમે તેમ માનતું હોય છતાં ઉત્તમ વિદ્યાર્થીઓનું પ્રમાણ સંતોષજનક છે. જો ૧૫૦ વિદ્યાર્થીઓમાંથી ૭ વિદ્યાર્થીઓ સાચી ગુણવત્તાવાળા હોય તો એ ઘણી સારી વાત છે.

### દૂરે વ્યવસ્થા વિષે :

બધા વર્ગોની એવી પુનઃવ્યવસ્થા કરવી જોઈએ કે જેથી કરીને મોટા ભાગના વિદ્યાર્થીઓ માટેની જરૂરિયાતો સંતોષાય, એટલે કે, જે વિદ્યાર્થીઓ ઉપર બહુરથી દબાણ ન લાવવામાં આવેકે ઉપરથી શિસ્ત લાદવામાં ન આવે ત્યાં સુધી સારી રીતે કામ ન કરતા હોય અને કશી પણ પ્રગતિ ન કરતા હોય તેમને માટે જરૂરી વ્યવસ્થા ગોડવાય.

પરંતુ એ વસ્તુ અગત્યની છે કે શિક્ષણ વિષયની નવા વર્ગોની હાલની વ્યવસ્થા ચાલુ રહેવી જોઈએ કે જેથી કરીને આગળ પડતા વિદ્યાર્થીઓ તેમની મહત્વાપૂર્વક કરી શકે અને સ્વતંત્રપણે તેમનો વિકાસ સાધી શકે. આપણું સાચું ધ્યેય એ જ છે. આ વસ્તુ જાણો લેવી જોઈએ — અને એ વસ્તુ જાહેર રીતે કહેતાં અચકાવું જોઈએ નહિ — કે આપણી શાળાનો ઉદેશ એ છે કે જેમનામાં પ્રગતિ કરવા માટે જરૂરિયાતની લાગણી એટલે અંશે સભાનપણે પ્રગટી હોય કે જેને લઈને તેમને તેમની જિંદગીનું માર્ગદર્શન મળે, એવા લોકોને ઉતેજન આપવું. સ્વતંત્ર પ્રગતિના વર્ગોમાં દાખલ થવાની હકીકત એ એક વરદાનસમ ગણાવી જોઈએ.

અમુક નિયમિત સમયના ગાળાના અંતરે (ઉ.ત. દરેક મહિને) તારવણીનું કાર્ય થવું જોઈએ અને જે લોકો વિશિષ્ટ શિક્ષણનો લાભ ન લઈ શકતા હોય તેમને પાછા તેમના સામાન્ય પ્રવાહમાં મોકલી આપવા જોઈએ.

આ રિપોર્ટમાં જે ટીકાઓ કરવામાં આવી છે તે જેટલી વિદ્યાર્થીઓને લાગુ પડે છે તેટલી શિક્ષકોને પણ લાગુ પડે છે. ઉત્તમ લાયકાતવાળા વિદ્યાર્થી માટે, તેના વિષયમાં સંપૂર્ણ રીતે જાણકાર શિક્ષક પૂરતો છે — અરે એક સારું પાઠ્યપુસ્તક અને તેની સાથે સર્વજ્ઞાન સંગ્રહનો કોશ અને શબ્દકોશ હોય તો પણ પૂરતું છે. પરંતુ આ કમમાં આપણે ઉત્તરતી ક્ષમતાવાળા વિદ્યાર્થીઓ તરફ જઈએ, ત્યારે જરૂર પડે છે વધુ ને વધુ ક્ષમતાવાળા શિક્ષકોની : એવા શિક્ષકમાં શિસ્ત, આત્મસંયમ, એકાગ્રતા, મનોવૈજ્ઞાનિક સમજશક્તિ, લગની લગાડે તેવો ઉત્સાહ, વિદ્યાર્થીમાં જે ભાગ સુષુપ્ત હોય તેને જગ્રત કરવાની ક્ષમતા જેમાં જ્ઞાનપ્રાપ્તિનો સંકલ્પ, પ્રગતિ માટેની અને આત્મસંયમની જરૂરના, વગેરે આવી જાય — એ બધું હોવું જરૂરી છે.

આપણે જેમ આપણી શાળાની વ્યવસ્થા એવી રીતે કરીએ છીએ કે જેને લઈને આગળ પડતા વિદ્યાર્થીઓ જડી આવે અને આપણે તેમને સહાયભૂત થઈએ તેવી જ રીતે વર્ગોની જવાબદારીઓ પણ ઉત્તમ શિક્ષકોને સૌંપવી જોઈએ.

આ કારણસર હું દરેક શિક્ષકને એમ કહું છું કે તેણે શાળામાંના તેના કાર્યને યોગ કરવાની ઉત્તમમાં ઉત્તમ અને શક્ય તેટલી વધુ ઝડપી પદ્ધતિ ગણીને કરવાનું છે. આ ઉપરાંત, હરેક મુશ્કેલી અને દરેક મુશ્કેલીદાયક વિદ્યાર્થી સાથે પાનું પાડવાનું આવે ત્યારે તેણે એમ સમજવાનું છે કે એ પ્રશ્નનો કોઈ દિવ્ય રીતનો ઉકેલ શોધવાની તેને તક આપવામાં આવી છે.

(૫ ઓંગસ્ટ ૧૯૬૩)

“માતાજી, મારા વિદ્યાર્થીઓએ મને એમ કહ્યું છે કે શ્રી ‘જ’ એમને એમ કહેતા હતા કે પોતાની અંદર રહેલી ગુપ્ત શક્તિઓને પદ્ધતિસરના વ્યાયામ દ્વારા વિકસાવી શકાય છે અને આપે એ વ્યાયામની પદ્ધતિઓ તેમને શીખવી છે. તેમણે એમ પણ કહ્યું કે આપણે આપણા શિક્ષણ કેન્દ્રમાં એ વસ્તુનો પ્રયોગ કરવો જોઈએ.”

જ્યારે ‘જ’ એ બહુ આગ્રહ કર્યો ત્યારે મેં તેને પહેલો પાઠ શિખવાહેલો — પરંતુ એનાં પરિણામ ધાર્યા કરતાં નિરાશાજનક આવેલાં, એટલે પછી મારે એ બંધ કરવું પેલું.

જ્યારે સમય આવે છે ત્યારે આવી બધી વસ્તુઓ સ્વાભાવિક રીતે, સ્વયંભૂપૂરે પ્રગાટ થાય છે અને માટે, આ વિષયમાં કોઈ ઉત્તાવળ કરીને નિર્ણય ન લેવો સારો.

“આપણે અહીં જે શિક્ષણ આપીએ છીએ તે અત્યારે તો બહાર અપાતા શિક્ષણ કરતાં બહુ ઓછું જુદું પડે છે. આટલા માટે જ, આપણે વિદ્યાર્થીઓની આધ્યાત્મિક અને ગુપ્ત શક્તિઓ ખીલવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ આપણે આ વસ્તુ આપણી શાળામાં કરી રીતે કરી શકીએ?”

આ વસ્તુ ભાવ પદ્ધતિ દ્વારા થઈ શકતી નથી. આ વસ્તુ લગભગ સર્વાંગી શિક્ષકના વલાણ અને ચેતના ઉપર આધાર રાખે છે. જો તેનામાં પોતામાં તે જ આંતરિક દૃષ્ટિ અને જ્ઞાન ન હોય તો વિદ્યાર્થીઓને કઈ રીતે આપી શકે?

સાચું કહું તો આપણે આપણી આસપાસના વાતાવરણમાં આવી રહેલી સર્વવ્યાપી, ઘોતક, આધ્યાત્મિક શક્તિ ઉપર આધાર રાખીએ છીએ, જો કે એ દેખાતી કે અનુભવાતી ન હોય તે પણ એની અસર તો ચાલુ જ છે.

(૨૦ એપ્રિલ ૧૯૬૬)

\*

### શિક્ષકને અને વિદ્યાર્થીઓને :

“પ્રગતિગામી” વર્ગો\* શ્રી અરવિંદના ઉપદેશ પ્રમાણેના છે.

---

\* સ્વતંત્ર પ્રગતિ પદ્ધતિના પાયા ઉપર રચવામાં આવેલા વર્ગોના સમૂહને શ્રી માતાજીએ આ નામ આપેલું (Vers Ida Perfection).

આ વર્ગો સત્યની ગ્રાપ્તિ પ્રત્યે દોરી જાય છે.

જે લોકો આ વસ્તુ સમજી શકતા નથી તેઓ, ભવિષ્ય પ્રત્યે પૂંઠ ફેરવી રહ્યા છે.  
(સપ્ટેમ્બર ૧૯૬૬)

\*

(એક શિક્ષકે એવી ફરિયાદ કરી કે અગત્ય વિનાની અને નાની વસ્તુઓ શીખવવામાં આવે છે — ઉ. ત. ભાષાના વર્ગના વિદ્યાર્થીઓને મૂર્ખતાપૂર્ણ વાર્તાઓ વાંચવાનું કહેવામાં આવે છે અને જુદા જુદા લોકોનાં જીવન અને રીતરિવાજો વિષે મહત્ત્વહીન વસ્તુઓ ભાણવવામાં આવે છે.)

તમારી મુશ્કેલીનું મૂળ એ હડીકિતમાં છે કે તમારામાં હજુ એવી જૂની માન્યતાઓ રહેલી છે કે જીવનમાંની કેટલીક વસ્તુઓ ઊંચી છે અને કેટલીક ઉત્તરતી કક્ષાની છે. આ પ્રકારની ગણતરી વાજબી નથી. કોઈ વસ્તુઓ કે પ્રવૃત્તિઓ ઊંચી કે નીચી નથી, કેવળ એ કરનારની ચેતના જ સાચી કે ખોટી હોય છે.

જો તમે તમારી ચેતનાનું પરમ ચેતના સાથે તાદાત્મ્ય સાધશો અને તેને જ અભિવ્યક્ત કરશો તો, તમે જે કાંઈ વિચારતા હશો, અનુભવતા હશો કે કરતા હશો તે સર્વ પ્રકાશિત અને સત્યપૂર્ણ બની રહેશો. આમાં જે બદલવાની, જરૂર છે તે શિક્ષણના વિષયને નહિ પરંતુ જે ચેતના દ્વારા તમે ભાણવો છો. તેને — એટલે કે તેને પ્રકાશિત બનાવવાની છે.

(૩૧ જુલાઈ ૧૯૬૭)

\*

“મને એ પણ બબર નથી કે મારે આત્મા છે કે નહિ પરંતુ હું શિક્ષક છું એટલે મારી પાસે એ વસ્તુની અપેક્ષા રહે છે કે “વિદ્યાર્થીઓ તેમના આત્માનો વિકાસ સાધે” એ વિષયમાં આગાહ રાખવો — થોડો પ્રકાશ જોઈએ છે.”

આ વિરોધાભાસ એ કારણે ઉભો થાય છે કે તમે વસ્તુઓને ‘મનોમય’ રૂપ આપવા માગો છો — અને એમ કરવું શક્ય નથી. આ તો તમારા દૃષ્ટિબિંદુને લગતી, મુખ્યત્વે કરીને તો તમારા આંતરિક વલાણને લગતી બાબત છે — જેના વડે તમારું બાધ્ય કર્મ શક્ય તેટલા પ્રમાણમાં દોરવાનું છે. આ વસ્તુ શીખવવા કરતાં જીવી આણવાની અગત્ય વધુ છે.

\*

“આપણો જે કોઈ નવીન વસ્તુ અપનાવવાની હોય તો તે કઈ?”

એ વસ્તુ શિક્ષકની ક્ષમતાના પ્રમાણમાં શક્ય તેટલી સારી રીતે અમલમાં મૂકવામાં આવશે.

(૨૫ જુલાઈ ૧૯૬૭)

\*

(એક શિક્ષકે ઓવું સૂચન કરેલું કે અમુક વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની પુનર્વ્યવસ્થા કરવી. એમની સલાહ એવી હતી કે નક્કી કરેલા વગ્ઝાની સંખ્યામાં ઘટાડો કરવો; શિક્ષકોએ વિદ્યાર્થીઓને સવારમાં વ્યક્તિગત રૂપે માર્ગદર્શન આપવું અને બપોર પછીના સમયમાં વર્ગના રૂપમાં તેમને મળવું. એમના પત્રને અંતે તેમણે જણાવેલું કે:)

“ઘણા શિક્ષકોને એમ લાગે છે કે “ક્ષ” ના વગ્ઝા અને જેને ‘જૂની પદ્ધતિ’ કહેવામાં આવે છે એ બે વચ્ચે બેદ રાખવો ઈચ્છવા યોગ્ય નથી. અમે જે રીતના પુનર્ગઠનનું સૂચન કરીએ છીએ તેને લઈને આ પ્રકારનો બેદ મહદ્દ અંશો ઘટી જશે. આપને એમ લાગે છે કે આ બેદ ચાલુ રાખવો? એ વિલીન થઈ જાય તેની અમારે રાહુ જોવી?”

જે બેદ છે એ તરત જ અદૃશ્ય થઈ જાય એ ખૂબ ખૂબ અગત્યનું છે. તમે જે સૂચન કર્યું છે તે કેટલું અસરકારક નીવડશે એ તો અનુભવે ખબર પડશે. એટલે એ ઈચ્છવા યોગ્ય છે કે પરિણામો જણાતાં વાર લાગે તો એક આખું વર્ષ સુધી આ પ્રયોગ કરી જોવો, જો પરિણામ ત્રાણેક માસમાં જણાય તો શું કરવું એ તરત નક્કી થઈ શકશે.

અંતરની સચ્ચાઈ અને સંજોગોને અનુકૂળ થવાની લાગણી રાખશો તો આ પ્રશ્ન ઉક્લી જશે.

(૬ નવેમ્બર ૧૯૬૭)

\*

“તા. ૬ નવેમ્બર ૧૯૪૬ના રોજ ઉચ્ચતર અભ્યાસક્રમના શિક્ષકોની સભા મળી હતી અને તેમાં એ અભ્યાસક્રમમાં ફેરફાર કરવાના કોઈ સૂચનો હોય તે અંગો વિચારણા કરવાનો હેતુ હતું. એક એવી દરખાસ્ત રજૂ કરવામાં

આવી કે ઉચ્ચતર અભ્યાસક્રમની નીચે મુજબ પુનર્વ્યવસ્થા કરવી:<sup>\*</sup>

૧. અભ્યાસનો વિષય વિદ્યાર્થીએ સ્વતંત્રપણે નક્કી કરવો. એ એની સાચી અને ગંભીરપણે કરાતી શોધને અનુલક્ષીને હોવો જોઈએ;
૨. આ રીતે જે મુદ્દો નક્કી કરવામાં આવે તે અંગેની યોજના, તે મુદ્દાના પ્રકાર અનુસાર, લાંબા કે ટૂંકા ગાળાની હોવી જોઈએ;
૩. આ યોજનાનું સંશોધન કરવામાં, વિદ્યાર્થીએ પોતે જે શિક્ષક કે શિક્ષકો એ વિષયને હૃદાથ ધરી શકે તેવી ક્ષમતાવાળા હોય તેમની સહાય લેવી;
૪. આ વિષયમાં કોઈ મૌખિક વર્ગો નક્કી નહિ કરવામાં આવે, પરંતુ વિદ્યાર્થીઓની સંમતિથી શિક્ષકો, જ્યારે જ્યારે જરૂર લાગે ત્યારે, મોટા ભાગે, બપોર પછીથી, મૌખિક વર્ગો લઈ શકે;
૫. વિદ્યાર્થીએ જે વિષય પસંદ કર્યો હોય તે વિષયમાં કેટલું કામ કરેલું હોવું જોઈએ તેનું કોઈ પ્રમાણ નક્કી થઈ શકે નહિ. પરંતુ પોતે એ કોર્સ પૂરો કર્યાના પ્રમાણ તરીકે વિદ્યાર્થીએ સતત પ્રયત્ન કર્યાનું, પોતાની શક્તિઓનો વિકાસ કર્યાનું, પોતાના વિષય વિષેની જાણકારીનું, અને એની ઉપરના પ્રશ્નોના ઉત્તર લેખિત તેમ જ મૌખિક રીતે આપી શકવાનું પ્રમાણ બતાવી આપવું જોઈએ. એમાં પૂરતી રૂપાંશીતા અને ચોકસાઈ હોવી જોઈએ. કામના પ્રમાણ કરતાં તેની ગુણવત્તા વધુ અગત્યની ગણવી પરંતુ કામનું પ્રમાણ પણ સાવ નજીવું ન હોવું જોઈએ, એની ઉચ્ચ કક્ષાને ન્યાય થાય એટલા પ્રમાણમાં હોવું જોઈએ.

ઉપરની દરખાસ્ત, થોડાક અપવાદો સિવાય સામાન્યપણે મંજૂર કરવામાં આવી હતી અને એવું નક્કી કરવામાં આવેલું કે આ વસ્તુ શ્રી માતાજી સમક્ષ રજૂ કરી તેમનું આ બાબતમાં માર્ગદર્શન માગવું.”

ઉપરની દરખાસ્તો બરાબર છે. હવે અગત્યની વસ્તુ એ બધું સત્યનિષ્પત્ત અને

---

\* હવે પછી શ્રી માતાજીએ જવાબ આપેલો છે તે મૂળ ૧૪ દરખાસ્તો વિષેનો છે; તેમાંની પાંચ અત્રે રજૂ કરી છે.

અસરકારક રીતે અમલમાં મૂકવું એ છે.  
આશીર્વાદ.

(નવેમ્બર ૧૯૬૭)

\*

“‘ક્ષ’ એ એમ કહું છે કે પ્રોજેક્ટ મેથડ પ્રમાણે દરેક વિદ્યાર્થીને જે એક કે બે વિષયો લઈને એ વિષયોનો સધાન અને સંશોધનાત્મક અભ્યાસ કરવાની સાથે તેમાણે જ્ઞાનની અગત્યની શાખાઓનું વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એક વધુ વ્યાપક રીતનો કાર્યક્રમ હુથ ધરવો કે નહિ, તે બાબતમાં શ્રી માતાજીને પૂછી જોવું.”

School is just a preparation to make the students capable of thinking, studying, progressing and becoming intelligent if they can – all that must be done during the *entier life* and not only in school.\*

શાળા તો કેવળ વિદ્યાર્થીઓને વિચાર કરતાં, અભ્યાસ કરતાં, પ્રગતિ કરતાં શીખવાનું અને જો તેમનાથી બને તો બુદ્ધિમાન થવા માટેનું સ્થાન છે – આ વસ્તુ કેવળ શાળામાં નહિ પણ આખાયે જીવન દરમ્યાન કુર્યે જવાની છે.

(નવેમ્બર ૧૯૬૭)

\*

“એમ માનવામાં આવે છે કે માધ્યમિક કક્ષા સુધી તો બાળકો બટું નાનાં હુઈને તેઓ યોગ વિષે જાણવા માગે છે કે કેમ અને તેઓ યોગ કરવા માગે છે કે કેમ તે તેઓ જાણી ન શકે. એટલે તેમને માટે તો કેળવણી એટલે ભાણવાનું, બીજું કાંઈ નહિ.

પરંતુ હું ધારું છું કે ઉચ્ચતર કોર્સના વિદ્યાર્થીઓને આપણે સ્પષ્ટ કરી દેવું જોઈએ કે જેઓ યોગ માટે અહીં આવ્યા હોય તેમને માટે જ એ કોર્સ છે — તો જ, શિક્ષણ એ યોગ બની શકે.

જો માતાજી આ વિષયમાં તેમનું માર્ગદર્શન આપે તો અમારે માટે વસ્તુઓ ઘણી સ્પષ્ટ બની રહે.”

\* મૂળ ગ્રંથમાં આટલો ઉત્તર શ્રી માતાજીના પોતાના હુસ્તાક્ષરોની છબીના રૂપમાં છે.

સાવ એવું તો નથી. પ્રાથમિક, માધ્યમિક તેમ જ ઉચ્ચ કક્ષાના વર્ગોમાંનાં બાળકોએ, તેમના શિક્ષણની બાબતમાં યોગની પદ્ધતિનું અનુસરણ કરવાનું છે અને નૂતન જ્ઞાન માટેની તૈયારી કરીને તેનું અવતરણ કરવાવાનું છે. એટલે એમ કહી શકાય કે બધા જ વિદ્યાર્થીઓ યોગ કરે છે.

પરંતુ યોગ કરનારાઓ અને સાધકો વચ્ચેનો ભેટ સમજવાની જરૂર છે. સાધક બનવા માટે, વ્યક્તિએ પોતાનું સમર્પણ કરવાનું રહે છે અને એમ કરવા માટેનો નિર્ણય સંપૂર્ણ અને સ્વયંભૂ હોવો જોઈએ. જ્યારે સાદ આવે ત્યારે આમ કરવાનો નિર્ણય વ્યક્તિએ પોતે લેવાનો હોય છે, એ બાબતમાં કોઈ દબાણ કરી શકાય નહિ.

આશીર્વાદ.\*

(૧૬ નવેમ્બર ૧૯૬૭)

\*

### (ગણિતના વર્ગો માટેનાં પાઠ્યપુસ્તકોની પસંદગી વિષે.)

આમાં મને તો ફેન્ચ પુસ્તક જ વાજબી જાણાય છે — અન્ય પુસ્તકો આણગમો ઉપજાયે તેવાં અને આપણને કામ કરવાનું ન ગમે એવાં લાગે છે.

પરંતુ આ ફેન્ચ પુસ્તક તમે વિદ્યાર્થીઓને આપો તેવી મારી સલાહ નથી. ખરૂં જોતાં તેમને પુસ્તકોની જરૂર જ નથી. શિક્ષક અથવા શિક્ષકોએ, એ પુસ્તક ઉપરથી, વિદ્યાર્થીઓને જે જ્ઞાન માફક આવે તેવું હોય, જે તેમની ક્ષમતા અને જરૂરિયાતોને પૂર્ણ પાડે તેવું હોય, તેનો ઉપયોગ કરીને જુદાજુદા પાઠ બનાવી લેવા જોઈએ. કહેવાનો હેતુ એ છે કે, પુસ્તકના વિષયને શિક્ષકોએ સારી રીતે શીખી લેવો જોઈએ અને તેનું રૂપાંતર કરીને, થોડે થોડે કરીને, વિદ્યાર્થીઓને સમજાવવો જોઈએ. આમ કરવા માટે, કોઈ એક સમયે થોડોક ભાગ હાથ ઉપર લઈને તેની ઉપર જુદાં જુદાં સ્પષ્ટીકરણો, ટીકાઓ અને વ્યવહારુ દાખલા આપવા જોઈએ જેથી કરીને, વિદ્યાર્થી ઓને એ કોઈ મૂત્રવત્ત, શુષ્ક થિયરી લાગવાને બદલે સમજાય તેવો, આકર્ષક અને વ્યવહારક્ષમ વિષય લાગે.

(૩ ડિસેમ્બર ૧૯૬૭)

\*

---

\* શ્રી માતાજીએ તેમની ટિપ્પણીને આ રિપોર્ટ વાંચ્યા પછી “આશીર્વાદ” શબ્દ લખી તેની નીચે પોતાની સહી કરેલી.

**“મધુર માતાજી,**

ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમ માટે અમે એકાદ અઠવાડિયાથી અમારો નવો પ્રયોગ શરૂ કર્યો છે. અને એમાંથી કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. એ વિષયમાં આપ માર્ગદર્શન આપો અને પ્રકાશ પાડો એવી વિનંતી કરું છું.

શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંબંધોનું સંયોજન અને કાર્યક્રમ એવી રીતે ગોઠવ્યાં છે કે જેને લઈને વ્યક્તિગત વિકાસ અને પ્રગતિ માટે સ્વતંત્રતા મળી રહે, તેને પ્રાથમિક અગ્રતા મળે.

**૧. કેટલાક શિક્ષકો એમ કહે છે કે સત્ત્વશીલ વિદ્યાર્થીઓ માટે તો આ બધું બરાબર છે પણ સામાન્ય અથવા સાધારણ કક્ષાના વિદ્યાર્થીઓને માટે તેમ નથી.**

પરંતુ માતાજી, અમારે શું એવો પ્રયત્ન ન કરવો કે જેથી સામાન્ય વિદ્યાર્થીઓ ધીરે ધીરે કરીને સત્ત્વશીલ બની રહે? અને જો એમ કરવું બરાબર હોય તો પછી અમે એમ કરીએ કે સત્ત્વશીલ વિદ્યાર્થીઓની કેળવણી ઉપર વધુ ભાર મૂકીએ અને સામાન્ય વિદ્યાર્થીઓને અવારનવાર જરાક ઓછાવતો પણ વધુ સમય આપીએ, થોડીક છૂટછાટ મૂકીએ—અને તેમ છતાં છેવટનું ધ્યેય એવું રાખીએ કે આવી છૂટછાટ મૂકવાનું અંતે બંધ કરી શકાય?”

આપણે તો અહીં સત્ત્વશીલ ગણાય એવાં જ બાળકો જોઈએ છે. વ્યવસ્થા એમને માટે ગોઠવાની છે. જે બાળકો એમાં બંધબેસતાં ન થઈ શકે તેમણે એક વર્ષની તાલીમ લીધા પછી જ જવું જોઈએ.

**“૨. કેટલાક શિક્ષકોનું એમ કહેવું છે કે વ્યક્તિગત પ્રગતિ અને એ વ્યક્તિ જેનો ભાગ છે તે સમૂહની પ્રગતિ માટેની જરૂરિયાતો વચ્ચે વિસંવાદ તો રહેવાનો જ. તો આ વિસંવાદનો શો ઉકેલ?**

એવી દલીલ કરવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તેના ગ્રૂપ સાથે ઓછાવતા અંશે પણ રહી શકે તો તેને એ ગ્રૂપના અનુભવોનો, ચર્ચાઓનો અને સામૂહિક અભ્યાસનો લાભ મળી શકે.”

એ બધી નકારી વાતો છે — જો કોઈ વ્યક્તિ પોતાનાથી બને તેટલી વધુ પ્રગતિ કરે

તો, એનો લાભ અનિવાર્યપણે સમૂહને મળે છે. જો વ્યક્તિને, ગ્રૂપ માટેની શક્યતા અને ક્ષમતાને આધીન છોડી દેવામાં આવે છે તો તેને લઈને તેની સર્વાંગીણ પ્રગતિ થવાની તક એળે જાય છે.

(૨૨ ડિસેમ્બર ૧૯૬૭)

\*

“થોડા સમય પહેલાં મને ‘ક્ષ’એ પૂછેલું કે હું સ્વતંત્ર પ્રગતિના વર્ગોમાં કામ કરવા તૈયાર છું કે નહિ. અત્યારે હું જે વર્ગોમાં કામ કરું છું તે જેમને જૂની રીતના કહેવાય છે તેવા વર્ગો છે.

માતાજી, મને કહોકે હું જ્યાં છું ત્યાં જ રહું કે સ્વતંત્ર પ્રગતિના વર્ગોમાં કામ કરું?”

શિક્ષણની જૂની પદ્ધતિનો સમય ચાલ્યો ગયો છે અને ધીરે ધીરે આખા જગતમાંથી તેનો ત્યાગ કરવામાં આવશે.

પરંતુ સાચ્યું કહું તો, દરેક શિક્ષકે આધુનિક વિચારોમાંથી પોતાની પ્રેરણા મેળવવી જોઈએ અને પોતાને જે પદ્ધતિ ઉત્તમમાં ઉત્તમ અને પોતાની પ્રકૃતિને સૌથી વધુ અનુકૂળ હોય તે અપનાવવી જોઈએ. જો એને પોતે શું કરવું તેની સમજ ન પહતી હોય તો તેણે તેના વર્ગોને ‘ક્ષ’ના વર્ગ સાથે જોડવા જોઈએ.

\*

સામાન્ય રીતના વર્ગો એ ભૂતકાળની ઘટનાઓ છે અને તેઓ ધીરે ધીરે વિલીન થઈ જશે. હવે એકલા કાર્ય કરવું કે ‘પ્રગતિગામી વર્ગો’માં દાખલ થવું તે તમારા ઉપર આધાર રાખે છે. કારણ કે આવા વર્ગમાં શીખવવા માટે થિયરી અને બૌદ્ધિક તર્કો કરતાં તમારે સંપૂર્ણ વિગતો સાથેના વ્યવહારુ ઉપયોગની યોજના ઘડવાની અને અમલમાં મૂકવાની રહે છે.

વર્ગ લેવાની સાથે પોતે પણ ભાણતા જવું એ ભાવિ શિક્ષક માટે ઘણું સારું રહે છે પરંતુ વિદ્યાર્થીઓને એથી ઓછો લાભ મળે છે.

‘પ્રગતિગામી વર્ગો’માં દાખલ થવાથી, શક્યાત કરનારને એક એવી સારી તાલીમ મળે છે કે જેથી એ શિક્ષણની વ્યવહારુ બાજુને સારી પેઠે શીખી શકે છે.

પસંદગી તમારે કરવાની છે.

\*

“મેં જોયું કે મારી અંદર બે પરસ્પર વિરોધી પ્રકારના વિચારો રહેલા છે : એક રીતે જોતાં વ્યક્તિગત કામ સારું લાગે છે, બીજી રીતે જોતાં સામૂહિક કાર્ય સારું લાગે છે.”

એમ ન થઈ શકે કે વળને (જરૂરિયાત પ્રમાણે સરખા ભાગે કે ઓછાવતા ભાગે) જુદા જુદા વિભાગમાં વહેંચીને બંને પદ્ધતિઓનો અમલ કરવો? આ રીતે શિક્ષાશર્માં વૈવિધ્ય આવશે અને વિદ્યાર્થીઓનું અને તેમની ક્ષમતાઓનું અવલોકન કરવાનું વધુ વિશાળ ક્ષેત્ર મળી શકશે.

\*

(આ નીચે ૧૪ થી ૧૮ વર્ષનાં બાળકોનાં બે જૂથોને લગતા પ્રશ્નોનો સારાંશ આપ્યો છે. આમ તો એ બંને જૂથોનો પાયો ‘સ્વતંત્ર પ્રગતિની પદ્ધતિ’ ઉપર હુતો, તેમ છતાં આગેકદમ પદ્ધતિ, પૂર્ણ પ્રગતિ’ પ્રકારના વર્ગો કરતાં વધુ નિશ્ચિત વ્યવસ્થાવાળી હતી.)

“૧. આપણી શાળામાં કઈ દિશામાં જવું એ સંબંધે શિક્ષકોમાં જુદાજુદા અભિપ્રાયો પ્રવર્તે છે. આ વિસંવાદને કઈ રીતે દૂર કરવો?

૨. શું એમ કરવું કે ૧૪ વર્ષથી નીચેની ઉમરનાં બાળકો માટે નિશ્ચિત કાર્યક્રમ અને નિશ્ચિત પ્રકારના વર્ગો રાખવા કે એમને પણ આપણે પોતાના કાર્યની માગરિખા જાતે જ પસંદ કરવા દેવી અને તેમને પણ તેમનાથી શક્ય હોય એટલી ઝડપે પ્રગતિ કરવા સ્વતંત્ર રાખવાં?

૩. આપણા કાર્યનો જરૂરી પાયો એ છે કે નહિં, કે બાળકનો અંતરાત્મા આગળ આવીને પોતાનો વિકાસ કરવાનું માર્ગદર્શન દઈ શકે એમ શક્ય બનાવવું?

૪. આપણો એવી કદ્યપના કરી શકીએ કે ભવિષ્યમાં આગેકદમ અને ‘પૂર્ણ પ્રગતિ’નાં બે જૂથોને ભેગાં કરીશું?”

એ બધાં સાચાં પણ છે અને ખોટાં પણ છે.

પ્રથમ વાત તો એ કે સાત વર્ષની ઉંમર પછી જેમનો આત્મા જીવંત હોય છે તે એવાં જાગ્રત હોય છે કે, જો તેમને મદદ કરવામાં આવે તો તેઓ એને શોધી શકે. સાત વર્ષ નીચેની ઉંમરનામાં આવું જવલ્લે જ બને છે.

આપણાં બાળકોમાં ઘણું વૈવિધ્ય છે. પ્રથમ તો એવાં છે, જેમનો આત્મા જીવંત છે. તેમને માટે કોઈ પ્રશ્ન નથી. આપણે કેવળ તેમને એ શોધી કાઢવા માટે સહાય કરવાની છે.

પરંતુ બીજાં કેટલાંક એવાં છે કે જાણે તેઓ નાનાં ગ્રાણીઓ હોય. જો તેઓ બહારનાં બાળકો હોય અને તેમનાં માબાપ તેમને શિક્ષણ આપવામાં આવે એવું દૃષ્ટાતા હોય તો એમને માટે ‘આગેકદમ’ વર્ગો માફક આવે તેવા છે. એની કશી અગત્ય નથી.

આમાં પ્રશ્ન કોઈ વર્ગો કે કાર્યક્રમ પસંદ કરવાનો નથી. પ્રશ્ન છે બાળકોની પસંદગીનો.

સાત વર્ષની ઉંમર સુધી બાળકોએ મજા માણવી જોઈએ. શાળા પણ રમત જેવી હોવી જોઈએ અને રમતાં રમતાં તેઓએ ભાણવું જોઈએ. જેમ જેમ તે રમતાં જરો તેમ તેમ તેઓને ભાણવાનો અને જીવનને જાણવાનો અને સમજવાનો રસ જાગશે. એમાં કઈ પદ્ધતિ અપનાવીએ એ કોઈ અગત્યની વસ્તુ નથી. એમાં ફક્ત શિક્ષકનું વલાણ જ અગત્યનું છે. એમ ન બનવું જોઈએ કે શિક્ષક એવો હોય જેને બાળકોએ નાશ્ટકે દખાણ હેઠળ નિભાવી લેવો પડતો હોય. શિક્ષકે હુમેશાં એવા મિત્ર બની રહેવું જોઈએ જે બાળકોને મજા કરાવતો હોય અને મદદ કરતો હોય.

સાત વર્ષ ઉપરની ઉંમરનાં માટે, જો તેઓ તૈયાર હોય તો તેમને માટે નવી પદ્ધતિ અપનાવી શકાય. પરંતુ એ ઉપરાંત બાકીનાં બીજાં સામાન્ય રીતે કાર્ય કરી શકે તેવો વર્ગ પણ હોવો જોઈએ. એવા વર્ગના શિક્ષકમાં એવી પ્રતીતિ હોવી જોઈએ કે પોતે જે પદ્ધતિનો ઉપયોગ કરે છે તે યથાર્થ છે અને પોતાને કોઈ હલકી કક્ષાનું કામ કરવા ઉતારી પાડવામાં આવ્યો નથી.

જ્યારે લોકોમાં સંમતિ નથી હોતી ત્યારે તેમની ક્ષુદ્રતા અને સંકુચિતતાને કારણે જ તેઓ સંમતિ સાધી શકતા નથી. એમનો ખ્યાલ સાચો હોઈ શકે... પરંતુ જો તેમનામાં જરૂરી ખુલ્લાપણું નહિ હોય તો તેઓ એનો વ્યવહારું ઉપયોગ સાચી રીતે નહિ કરતા હોય.

આ સર્વ વસ્તુઓમાં વ્યક્તિગત મહત્ત્વનો ખ્યાલ ન રાખવો જોઈએ. આ બે વસ્તુઓનું મિશ્રણ થવા દેવું એ ભૂલ છે. કોઈએ પોતાના મહત્વ વિષેના ખ્યાલો સેવવા ન જોઈએ.

આપણે કેટલીક વસ્તુઓ કરી શકતા નથી. ઉદાહરણ તરીકે, આપણે જો સર્વ બાળકોને નવી પદ્ધતિ પ્રમાણે ઉછેરવા માગતા હોઈએ તો આપણે એ બધાને એક કે બે માસ માટે કસોટી ઉપર મૂકવાં જોઈએ. એમાંથી કેટલાંક બાળકો નવી પદ્ધતિનું અનુસરણ કરી શકે તે શોધી કાઢવું જોઈએ, અને બીજાં બધાને તેમનાં કુટુંબોમાં મોકલી દેવા જોઈએ, આમ બની શકે તેમ નથી.

એટલે પછી આપણે આનો ઉકેલ અંતરમાં શોધવાનો રહે છે. કેટલાંક બાળકોને નવી પદ્ધતિ નથી ગમતી — એમને જવાબદારીની ચિંતા રહે છે. બાળકો તરફથી આવતા પત્રોમાં મને આ વસ્તુનો ઉલ્લેખ થતો જણાયો છે. આપણે એમને જેવાં છે તેવાં જ છોડી દેવા પડશે.

નિરપવાદ રૂપે દરેકે જાણી લેવું જોઈએ, — આમાં કોઈનો અપવાદ નથી, — કે પોતે કોઈ જ્ઞાની વ્યક્તિ હોઈ પોતે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરે છે. એવું નથી. પોતે કેવા હોવું જોઈએ તેવા બનતાં અને પોતે શું કરવું જોઈએ તે કરતાં ધીરે ધીરે પ્રયત્ન કરીને શીખી રહ્યું છે.

(૧૬ નવેમ્બર ૧૯૬૮)

\*

તમે જે કામ કરો છો તે વિષે વાંચીને સંતોષ અનુભવું છું અને તમારા પોતાના કાર્યમાં મારી મંજૂરી છે.

પરંતુ તમારે સમજી રાખવું જોઈએ કે અન્ય શિક્ષકોનો, તેમના કામ વિષેનો ઘ્યાલ જુદી રીતનો હોઈ શકે અને છતાં, તેઓ પણ સાચા હોય એમ બની શકે.

તમે ‘થ’ વિષે જે ટીકા કરી છે તેથી મને નવાઈ લાગે છે, કારણ કે હું એને જે રીતનો અને જેવા વલણવાળો જાણું છું તેની સાથે એ બંધબેસતી થતી નથી.

આ પ્રસંગે હું તમને ખાતરી આપું છું કે તમારી પ્રગતિ અને સત્યની સેવાનો આધાર સંવાદ ઉપર છે, વિસંવાદ અને ટીકાખોરી ઉપર નહિ.

(૨૫ નવેમ્બર ૧૯૬૮)

\*

પ્રગતિ વિશાળતામાં છે, સંકુચિતતામાં નહિ.

દરેક દૃષ્ટિબિંદુઓને ભેગાં કરીને તેમને તેમનું યર્થાર્થ સ્થાન આપવું જોઈએ. એમાંથી કોઈ એકનો, બીજાને ભોગો, આગ્રહ ન રાખવો.

સાચી પ્રગતિ આત્માને વિશાળ કરવામાં અને મર્યાદાઓની વાડોને તોડવામાં છે.

(૨૨ ઑક્ટોબર ૧૯૭૧)

\*

જે ચેતનાની જરૂરિયાત છે તેમાં શિક્ષકોનો વિકાસ થવો જોઈએ, કામ કરવાના પ્રત્યક્ષ અનુભવ ઉપર ભાર મુકાવો જોઈએ અને બાળકના મનમાં કામ અને રમત વરચે ભેદ ન રહેવો જોઈએ — બધું જ આનંદ અને રસદાયી હોવું જોઈએ. રસ ઉત્પન્ન કરવાનું કામ શિક્ષકનું છે.

જો રસવૃત્તિ હાજર હશે તો યોગ્ય કાર્ય આપમેળે બની આવશે.

(૧ નવેમ્બર ૧૯૭૧)

\*

“આજે ‘ર’ વર્ગમાં હાજર ન હતો. વર્ગ પૂરો થયા પછી મને ખબર પડી કે એને આપે મારા વર્ગમાં આવવાને બદલે સુથારીકામ કરવાની પરવાનગી આપેલી છે.”

એણે મને કહેલું કે અભ્યાસ કરવા કરતાં શારીરિક મહેનતનું કામ કરવું એને વધુ ગમે છે. મને લાગ્યું કે એની લાગણી ખરા અંતરની હતી અને એણે જે પસંદગી કરી હતી તે એની પ્રકૃતિને સર્વથા અનુકૂળ હતી. એટલે એણે માગેલી પરવાનગી મેં એને આપેલી.

(૨૬ માર્ચ ૧૯૮૬)

\*

તમે જે વિષયો શીખવતા હો તેના પાઠ બેવડાઈ ન જાય તેની કાળજી રાખવી. તમારા વિષયો એકબીજા સાથે સંબંધ રાખનારા છે એટલે જ્યારે કોઈ બે શિક્ષકો એક જ મુદ્દા ઉપર કહે ત્યારે બનવાજોગ છે કે એમાં દૃષ્ટિબિંદુઓનો ફેર હોય. એકની એક જ વસ્તુ જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી જોતાં જુદી જ દેખાય છે. આમ થશે તો વિદ્યાર્થીઓનાં કુમળાં મગજોમાં ગુંચવણો ઊભી થશે, તેઓ શિક્ષકોની સરખામણી કરવા લાગશે અને એ વસ્તુ ખાસ ઈચ્છવા યોગ્ય નથી. એટલે દરેકે પોતાના જ વિષયની ઉપર ધ્યાન આપવું અને વિષયાંતર ન થઈ જાય તેની કાળજી રાખવી.

(૧૦ સપ્ટેમ્બર ૧૯૮૩)

\*

હું શિક્ષકો પાસે એવી અપેક્ષા રાખું છું કે જ્યારે તેઓ વિદ્યાર્થીઓને પૂછવાના પ્રશ્નો નક્કી કરે ત્યારે શબ્દો વડે નહિ પણ તેમની પાછળના ભાવ વડે વિચાર કરે.

અને થોડા સમય પછી જ્યારે તેમને ભાવ દ્વારા વિચાર કરવાનું સાહજિક બની રહે ત્યારે હું એમની પાસે એથી પણ વધુ આગળની મહત્તર અને નિશ્ચયાત્મક પ્રગતિની આશા રાખીશ કે જેમાં તેઓ ભાવ દ્વારા નહિ પરંતુ અનુભૂતિઓ વડે વિચાર કરતા થાય. જ્યારે કોઈ એમ કરી શકે છે ત્યારે જ તેનામાં જ્ઞાનનો ઉદ્ઘય થાય છે.

\*

“આપે શિક્ષકોને શબ્દોને બદલે ભાવ વડે વિચાર કરવાનું કહ્યું છે. આપે એમ પણ કહ્યું છે કે પાછળથી આપ અનુભૂતિઓ દ્વારા વિચાર કરવાનું કહેવાનાં છો, તો આપ આ વિચાર કરવાની ગ્રણોય પદ્ધતિઓ ઉપર વધુ પ્રકાશ પાડશો?”

આપણા મકાનને એક મોટો ટાવર છે, એ ટાવરની છેક ટોચ ઉપર એક ઝાકજમાળ ચોખ્ખો ઓરડો છે. અને ત્યાંથી આપણે ખુલ્લી હવામાં અને ભરપૂર પ્રકાશમાં જઈ શકીએ તેવું છે.

કેટલીક વાર આપણને નવરાશ હોય છે ત્યારે આપણે એ પ્રકાશપૂર્ણ ઓરડામાં જઈએ છીએ અને જો આપણે અત્યંત શાંત અવસ્થા જાળવી રાખીએ છીએ તો એક કે વધુ મુલાકાતીઓ આવી પહોંચે છે; કેટલાક ઉંચા તો કેટલાક નીચા, કેટલાક એકલા તો કેટલાક ટોળે મળીને આવે છે — એ બધાય જ્યોતિવંત અને કમનીય હોય છે.

સામાન્ય રીતે એવું બને છે કે એ લોકો જ્યારે આવે છે ત્યારે આપણે તેમનું સારી રીતે સ્વાગત કરવાની ઉત્તાવળમાં આપણી સ્વસ્થતા ગુમાવી બેસીએ છીએ અને ભૂસ્કો મારીને આ ટાવરના ભૌંયતળિયે આવેલા વિશાળ ખંડમાં જઈ પડીએ છીએ — જ્યાં શબ્દોનો ભંડાર હોય છે. અહીં આપણે ઓછાવતા પ્રમાણમાં પણ ઉશેરાટભરી સ્થિતિમાં, આપણને મળવા આવેલા એક કે બીજા મુલાકાતીનું વર્ણન કરવાનો પ્રયત્ન કરવા માટે આપણે આપણી પાસે જે હૃથ લાગે તે શબ્દોને આમતેમ ફંક્ષનીને પસંદ કરીએ છીએ, છોડી દઈએ છીએ, ભેગા કરીએ છીએ, છૂટા પાડીએ છીએ કે ફરી ફરીને ગોઠવીએ છીએ. પરંતુ આમ કરવાથી એ મુલાકાતીનું જે ચિત્ર આપણે બનાવીએ છીએ એ તેની ખરી આકૃતિ કરતાં દઢ્ઢાચિત્ર જેવું વધુ પ્રમાણમાં હોય છે.

અને છતાં આપણામાં જરા ઉહાપણ હોય છે તો આપણે એ ટાવરની ટોચ ઉપર તદન શાંત અને આનંદમન અવસ્થામાં બેસી રહીએ છીએ. પછી, થોડો સમય ગયા

પછી, આપણે જોઈશું કે એ મુલાકાતીઓ પોતે જ ધીરે ધીરે, સભ્યતાપૂર્વક, શાંતિથી, તેમના સૌન્દર્ય કે કમનીયતામાં કશી કમી ન આવે રેવી રીતે નીચે ઉત્તરે છે અને જ્યારે તેઓ પેલા શબ્દોના સંગ્રહસ્થાનમાંથી પસાર થાય છે ત્યારે આપમેળે કશી મથામણ કર્યા વિના, પોતાને ભૌતિક મકાનમાં પણ પ્રગટ થવું હોય તો જે રીતની જરૂર હોય રેવાં શબ્દરૂપી વખો પરિધાન કરી લે છે.

આને હું ભાવના દ્વારા વિચાર કરવાનું કહું છું.

જ્યારે આટલી પ્રગતિ તમને કોઈ ચમત્કારિક વસ્તુ નહિ લાગે ત્યારે હું તમને સમજાવીશ કે અનુભૂતિઓ દ્વારા વિચાર કરવો એટલે શું.

(૩૧ મે ૧૯૬૦)

\*

તમે જ્યારે શબ્દો વડે વિચાર કરતા હો છો ત્યારે તમે જે કાંઈ વિચારતા હો છો તેને શબ્દો દ્વારા જ વ્યક્ત કરી શકો છે. પરંતુ ભાવના વડે વિચાર કરવો એટલે એ એક જ ભાવનાને જુદી જુદી રીતના શબ્દોમાં વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવવી. શબ્દો જુદી જુદી ભાષાઓના પણ હોઈ શકે — જો તમને એક કરતાં વધુ ભાષાઓ આવકતી હોય તો. ભાવનાઓ વડે વિચાર કરવાની બાબતમાં આ વસ્તુ સૌથી પાયાની વસ્તુ છે.

જ્યારે તમે અનુભૂતિ વડે વિચાર કરો છો ત્યારે તમારે વધુ ગહરાઈમાં જવું પડે છે અને ત્યારે તમે એકની એક જ અનુભૂતિને અનેક પ્રકારની ભાવનાઓ દ્વારા વ્યક્ત કરી શકો છો. એમ બને ત્યારે પછી, વિચારનું રૂપ, આ કે તે ભાષામાં ગમે તે રીતનું હોય તે છતાં તાત્ત્વિક રીતે એની પાછળ રહેલી નિરપેક્ષ અનુભૂતિમાં કશો પણ ફેર પડતો નથી.

\*

જો તમારે કોઈને ખાતરી કરી આપવી હોય છે તો બોલવું જોઈએ છે — પરંતુ એવે વખતે તમારે ભાવના દ્વારા નહિ પણ અનુભૂતિઓ દ્વારા વિચારવું જોઈએ.

\*

તમે ‘ક’ સાથે શિક્ષકોની મીટિંગમાં ગયેલા? એ લોકો એટલા માટે મળેલા કે અભ્યાસની ઉપરાંત એ લોકો દરેકને અમુક વિશિષ્ટ કામ સોંપવા માગતા હતા. એ લોકો, વૈજ્ઞાનિકો હવે જે વસ્તુ શોધવા લાગ્યા છે કે — “પાણી શું છે?”, “ખાંડ

પાણીમાં કેમ ઓગળે છે?” — અને એવી બધી વસ્તુઓ કે જેથી વૈજ્ઞાનિકો એવા નિર્ણય ઉપર પહોંચ્યા છે કે તેઓ ખરેખર કશું જ આણતા નથી.

એટલે મેં તેમને પૂછ્યું કે, “મૃત્યુ શું છે?”

આ ખાસ અગત્યની વાત છે. સેંકડો વર્ષોથી લોકો આ વસ્તુ પૂછી રહ્યા છે. એમને ખબર પડતી નથી.

વિદ્યાર્થીઓ કહેશે કે મૃત્યુ શું છે તેની તેમને જાણ નથી પણ તેઓ તપાસ કરીને શોધી કાઢશે. આ સમજવા માટે તમારે આ (શ્રી માતાજી જુદી જુદી દિશાઓ પ્રત્યે આણસાર કરે છે) વસ્તુ જાણાવી પડશે, અને ત્યાર પછી જે જ્ઞાન પ્રાપ્ત થશે તે એક સીધી સપાટ લીટી કરતાં વધુ બૃહત્તર — વિશાળ હશે.

જ્યારે તમે નીરવ હો છો ત્યારે તમે સત્ય સાથે સંપર્કમાં આવો છો. પાછળથી જ્યારે ભાવના નીચે ઉત્તરે છે ત્યારે એ શબ્દોના “પુસ્તકાલય”માંથી પસાર થાય છે અને જે શબ્દો સૌથી વધુ બંધબેસતા હોય છે તેમને ચૂંટી લે છે. શરૂઆતમાં એ વસ્તુ અસ્પષ્ટ હોય છે. એ વસ્તુ જ્યાં સુધી તદ્દન સ્પષ્ટ બને ત્યાં સુધી મંડ્યા રહેવું જોઈએ. તમને ઠીક લાગે તો એ વસ્તુ નોંધી લેવી, પરંતુ તમારે શાંત બન્યા રહીને મંડ્યા રહેવું જોઈએ. જો તમે એમ કરશો તો તમને બરાબર જોઈતો શબ્દ મળી આવશે. ત્યારે પછી જે શબ્દ આવશે, તેની દ્વારા, જે તાત્ત્વિક અર્થ હશે તે — અને નહિ કે ચીલાચાલુ વસ્તુ — રજૂ થશે.

એ સર્વાંશે સત્ય તો નથી હોતું. કેવળ એ શબ્દો મૂળ સત્યની સૌથી વધુ નિકટના હોય છે. શિક્ષકોએ એ કરવું જોઈએ. (માથામાં ગોળ ગોળ ફરતા રહેવાનો અભિનય) — આના કરતાં એ વધુ ઉપયોગી નીવડશે.

### (મૌન)

મને ખબર નથી કે તમે મનોમય નીરવતા પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો છે કે કેમ? તમે એમ કરવામાં આખી જિંદગી ખર્ચી નાખી શકો અને છતાં લગભગ કાંઈ જ ન મળે એવું બને. એના કરતાં આ વસ્તુ વધુ રસદાયક છે.

સૌપ્રથમ તો કશું થતું નથી. તમે એમ જ બન્યા રહો છો — સક્રિયપાણે નહિ — પ્રભુ પ્રત્યે અભીષ્ટુ બન્યા રહો છો. આમ કરવામાં મનમાં કશી હિલચાલ ન થવી જોઈએ; એમાં સમર્પણ પણ નથી હોતું... આત્મદાન અને આત્મત્યાગની વચ્ચેની કોઈ વસ્તુ અને મન જો પોતાની આ પ્રકારની અવસ્થાનું અર્પણ કરે છે તો પછી, એક દિવસ આપોઆપ ઉત્તર મળી આવે છે. એ પ્રકારની માફક આવી પડે છે.

તમે જેટલા વધુ નિશ્ચલ, જેટલા વધુ શ્રદ્ધાવાન, જેટલા વધુ તત્પર હશો,

ટેલલા પ્રમાણમાં એ વસ્તુ ચોખ્ખી જાળાઈ આવશે. એવો સમય પણ આવે છે જ્યારે તમારે આટલું જ (ખુલ્લા થવાનો અભિનય) કરવાનું રહે છે... વિદ્યાર્થી પ્રક્રિયા પૂછે છે. તમે બસ આમ (ખુલ્લા થવાનો એનો એ જ અભિનય)...

અને સૌથી વધુ તો એ કે તમારે કશો સક્રિય રીતનો વિચાર જ ન કરવો : “મારે જાણવું છે કે... મારે એને શું કહેવું?”... ના!

ત્યારે પછી તમને વિદ્યાર્થી માટેનો ઉત્તર મળી રહેશે. કદાચ એ ઉત્તર એના પ્રશ્નનો નહિ હોય પરંતુ એને જેની જરૂર હશે તે પ્રકારનો હુશે. અને — આ તો હંમેશાં રસ પડે તેવું હોય છે....

ત્યાં ઉપર, તમે જાણતા હો છો. જ્યારે તમે એમ માનતા થાઓ છો કે મનમાં કશી શક્તિ નથી, એને કશાનું જ્ઞાન નથી, ત્યારે તમે શાંત થઈ જાઓ છો. તમને વધુ ને વધુ પ્રમાણમાં એવી ખાતરી થતી જાય છે કે ત્યાં એક એવી ચેતના છે કે જેની પાસે જ્ઞાન ઉપરાંત શક્તિ પણ છે, એ જીણામાં જીણી વિગતને જાણે છે અને પરિણામે તમે એ વિદ્યાર્થીની જરૂરિયાતને જાણો છો, અને તેના જવાબ પણ તમને મળી રહે છે. જ્યારે તમને આની ખાતરી થઈ જાય છે ત્યારે તમે તમારી અંગત દખલ કરવાનું બંધ કરી દઈને કહો છો, “મારું સ્થાન તું સંભાળ.”

(૩૧ જુલાઈ ૧૯૬૭)

\*

“મેં આ ત્રણોય વિદ્યાર્થીઓને તેમની રમતોનો “નશો” કરવા દીધો કે જેથી તેઓ એમાંથી વધુ ઝડપથી બહાર નીકળી આવે.

અને હુકીકતમાં, એ જ વસ્તુ, ત્રીજા અઠવાડિયાની શક્તાત્માં બની આવી : એ ત્રણોય બાળકો પોતાનાં નામ વ્યક્તિગત રમતો માટે નોંધાવી રહ્યાં છે અને એમની ઘોંઘાટભરી રમતો ભૂલી ગયાં છે.

હું એમ કરવાનું ચાલું રાખું? : ‘નિશાળ બહાર, રહેવા’ના ગૂમડાને વધવા દઈને ફાટી જવા દઉ? — એમાં ગમે ટેલલો સમય જાય અને શૈક્ષણિક દૃષ્ટિબંદુથી જોતાં સમયનો બગાડ ગણાય તેમ થવા દઉ?

જરૂર, એ જ ઉત્તમ કાર્ય છે.

“આપણી શાળાના માળખામાં રહીને, ‘શાળાની બહાર’ની અભૂક પ્રકારની રમતો, જેવી કે સંતાકૂકડી, ગેડીદા (કિકેટ), ઘર બનાવવું... એવું બધું

કરવા દઈએ? બાળકોને એમ કરવા માટે આકુળવ્યાકુળ થતાં જોઈને અમને એમ લાગ્યું કે એ લોકો અમુક પ્રકારની પ્રવૃત્તિથી અલગ પડી ગયાં છે : કો'કવાર તદ્દન સ્વતંત્રપણે કોઈ કોઈ બાગમાં રમવાની! શું બાળકોની આ જરૂરિયાત સાચી હુશે?”

બેશક.

(૨૩ સપ્ટેમ્બર ૧૯૬૦)

\*

કોઈ એક બાળકને માટે કઈ રમતો ઉપયોગી અને લાભદાયક નીવહશે તેની પસંદગી કરવી એ ઘણું અધરું કામ છે. એમાં ઘણી વસ્તુઓ લક્ષમાં લેવી પોડે છે અને ખૂબ વિચાર કરવો પોડે છે. અને જો આપણે કોઈ વસ્તુ વગર વિચાર્યે કરીએ છીએ તો તેનાં પરિણામો દુઃખદાયી આવે છે.

\*

જો બાળકો ખૂબ નાનાં હોય, તો પણ જો તેમને વસ્તુઓને વ્યવસ્થિત રીતે મૂકવાનું શીખવવામાં આવે, વસ્તુઓને તેમના પ્રકાર પ્રમાણે વર્ગીકરણ કરવાનું શીખવવામાં, વગરે, તો એમને એમ કરવું ખૂબ ગમે છે અને તેઓ એમ કરતાં સારી રીતે શીખે છે. સુવ્યવસ્થા અને સુધરતા શીખવવાની અહીંં અદ્ભુત તક રહેલી હોય છે. આમાં વ્યવહારું અને અસરકારક શિક્ષણ રહેલું હોય છે, કેવળ થિયરી નહિએ.

પ્રયત્ન કરી જુઓ. મને ખાતરી છે કે બાળકો તમને વસ્તુઓ ગોઠવવામાં મદદ કરશે.

પ્રેમ અને આશિષ.

(૧૪ ડિસેમ્બર ૧૯૬૩)

\*

“એવું ધ્યાનમાં આવ્યું છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ચોગ્ય રીતે બેસતા કે લખતા નથી. જ્યારે તેઓ લખે છે ત્યારે તેઓ તેમની નોટબૂક તેમની સામે સીધી નહિ પણ ર૪ કે ૮૦ અંશને ખૂણો હોય છે.”

કદાચ સૌપ્રથમ તો શિક્ષકો પોતે જ લખતી વેળાએ યોગ્ય રીતે બેસતાં શીખે તો વધુ સારું.

આશીર્વાદ સાથે.

\*

“શ્રી અરવિંદે તેમના એક પત્રમાં યુવાનો અને સાધના માટેની તેમની તૈયારી વિષે લખેલું છે. એ પત્રની એક નકલ હું આપને જોવા માટે મોકલું છું. શ્રી અરવિંદે એ પત્રમાં, યુવાનોને આધ્યાત્મિક જીવન વિષેના વિચારો અને લાગણીઓનો ઉત્સાહપૂર્વક સ્પર્શ કરાવવા સામે જે ચેતવણી આપેલી છે તેને અમારે અમારો વર્ગ લેતી વેળાએ ધ્યાનમાં રાખવી કે કેમ તે વિષે હું આપની પાસેથી જાણવા માગું છું. શ્રી અરવિંદ અહું જેમ કહે છે તેમ, એમાં એક નકલી બનાવટી અભિન્દિત કરવાના ભયનો ઉદ્દેશ કરવામાં આત્મો છે તેવો ભય ખરો?

શ્રી અરવિંદનો પત્રઃ સામાન્ય રીતે એમ કહી શકાય કે લોકોને અને ખાસ કરીને કુમળી વયના યુવાનોને સાધનાપથમાં ખેંચવામાં અતિઉત્સાહ દાખવવો એ ડાહાપણાનું કામ નથી. આ યોગમાર્ગમાં આવનાર સાધકને સાચો સાદ થયેલો હુંવો જોઈએ અને સાચો સાદ થયો હોય તેમ છતાં પણ યોગમાર્ગ અધરો તો છે જ. પરંતુ જ્યારે કોઈ ઉત્સાહમાં આવી જઈને પ્રચારલક્ષી ભાવનાથી લોકોને ખેંચવા લાગે છે ત્યારે ભય એ રહે છે કે એ લોકોમાં એક નકલી અને બનાવટી દેવતા પ્રગટ થાય છે, સાચો અભિન નહિએ; અથવા તો એમ બને છે કે જે દેવતા પ્રગટ થાય છે તે અદ્વાયુષી હોય છે, ટકી શકતો નથી અને પ્રાણનાં મોજાંની ભરતીના ઊભરામાં દટાઈ જાય છે. ખાસ કરીને આ વસ્તુ એવા યુવાનોને વધુ લાગુ પડે છે જેઓ મુલાયમ હોય છે અને જેઓ તેમને બીજા તરફથી આપવામાં આવેલી અને પોતાની નહિ એવી લાગણીઓ અને વિચારોમાં સહેલાઈથી પકડાઈ જાય છે – પાછળથી પછી, પ્રાણ તેની અતૃપ્ત માગણીઓ સાથે જાગ્રત થાય છે અને ત્યારે તેઓ બે પરસ્પર વિરોધી શક્તિઓ વરચે ઝોલાં ખાતાં, સામાન્ય જીવનના પ્રાકૃતિક ખેંચાણને, કાર્યોને અને કામનાની તૃપ્તિ કરવા પત્યે સહેલાઈથી ખેંચાઈ જાય છે અને એમ થવું એ યુવાનીની પ્રકૃતિનો સામાન્ય ઢાળ પણ હોય છે. નહિ તો પછી એવું બને છે જે આધારમાં યોગ્ય ક્ષમતા નથી હોતી, જે સાદને માટે તે તૈયાર નથી હોતો, અથવા તો

તત્કાળ પૂર્તું તો તૈયાર નથી જ હોતો, એ આધાર પેલા સાદના દબાણ હુદાળ યાતના અનુભવે છે. જ્યારે વ્યક્તિમાં પોતાનામાં સાચી વસ્તુ હોય છે ત્યારે તો એ પોતે સાંસરો ચાલ્યો જાય છે અને છેવટે સાધનાના માર્ગને પૂર્ણપણે અપનાવી લે છે. પરંતુ એવું કરી શકનારાની સંખ્યા લઘુમતીમાં હોય છે. એના કરતાં વધુ સારું તો એ છે કે જે લોકો આપમેળે આવતા હોય, અને એમાં પણ જે સાદ થયેલ હોય તે તેમના અંતરનો હોય અને સતતપણે થતો રહેતો હોય તેવા લોકોનો જ સ્વીકાર કરવો?"\*

આ અવતરણ અદ્ભુત અને ઘણું ઘણું ઉપયોગી છે.

જે યુવાન લોકો પોતાનું મગજ સહેલાઈથી બઢલે તેવા હોય તેમની સાથે વાત કરતાં પહેલાં શ્રી અરવિંદે આપેલી આ ચેતવણી ચુસ્તપણે ધ્યાનમાં રાખવી.

વર્ગમાં તમારે તદ્દન નિર્લેપ બની રહેવું જોઈએ.

આશીર્વાદ.

(૨ જૂન ૧૯૬૭)

\*

"ઉપરના ઉત્તરમાં આપે જે 'નિર્લેપ' શર્દ વાપર્યો એથી આપ ચોક્કસ રીતે શું કહેવા દઈશ્યો છો તે જ્ઞાનવાની મારી દઈશ્યા છે. આપનો કહેવાનો અર્થ એ છે કે શ્રી અરવિંદનાં અને આપનાં સાધનાને લગતાં દૃષ્ટિબિંદુઓને સમજાવતાં અમારા વિચારો અને વાણીમાં કોઈ રીતની વ્યક્તિગત લાગણી ન આવવા દેવી?"

દા, એમ જ.

તમારે વિષે કે તમારા અનુભવ વિષે કાંઈ ન કહેવું.

(૫ જૂન ૧૯૬૭)

\*

વર્ગના સમયે અને દિવસે શિક્ષકે ગેરહાજર ન રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિને શાળાના સમયમાં બહુરની પ્રવૃત્તિઓ હોય તો એ શિક્ષક નહિ થઈ શકે.

(૧૧ માર્ચ ૧૯૭૦)

\*

\* લેટર્સ ઓન યોગ, શતાબ્દી ગ્રંથમાળા, વોલ્યુમ ૨૪, પૃષ્ઠ ૧૬૧૫-૧૬.

## શિસ્ત

કડક અંકુશ એ શિક્ષણનો કોઈ ઉત્તમ કે અસરકારક સિદ્ધાંત નથી. સાચ્યું શિક્ષણ એને હેઠેવાય જે આ ખીલે રહેલાં સ્વરૂપોમાં પહેલેથી જ રહેલું છે તેને ખોલીને પ્રગટ કરે. જેમ પુષ્પો સૂર્યના તડકામાં ખીલે છે તેમ જ બાળકો આનંદમાં ખીલે છે. સ્પષ્ટ છે કે આનંદ એટલે નભળાઈ, ગેરવ્યવસ્થા અને ગોટાળિયાપણું નાથિ, — પરંતુ એક એવી જાજવલ્યમાન કરુણાશાલીતા જે સારી વસ્તુને ઉતેજન આપે છે અને જે બૂરી વસ્તુ હોય છે તેને કડકપણે ટેકો આપતી નથી. ન્યાય કરતાં કરુણા, સત્યથી વધુ નજીક હોય છે.

\*

“માતાજી, વર્ગમાં જ્યારે કોઈ બાળક શિસ્તપાલનનો ઈનકાર કરે તો શું કરવું? એને જેમ ગમે તેમ વર્તવા દેવું?”

સામાન્ય રીતે કહીએ તો, બાર વર્ષથી વધુ ઉમરનાં બાળકોને શિસ્તની જરૂર છે.

“કેટલાક શિક્ષકો માને છે કે આપ શિસ્તની વિરુદ્ધ છો?”

એવા લોકો શિસ્તને એવી રીતની વસ્તુ તરીકે સમજે છે કે જે કોઈ મનસ્વી નિયમ હોય અને બાળકો ઉપર ઢોકી બેસાડવાનો હોય, પણ પોતે તેનું પાલન ન કરવાનું હોય.

“એટલે એનો અર્થ એ કે બાળકે પોતે જ શિસ્તનો નિયમ પોતાની મેળે અપનાવવો જોઈએ. અમે એવી જ જીર્ણિયાત વિષે તેને સ્વીકાર મળે તે માટે શું કરી શકીએ? અમે એ શિસ્તપાલન કરે તેમાં કઈ રીતે માફદરૂપ થઈ શકીએ?”

ઉદાહરણ એ ઉત્તમ શિક્ષક છે. જે શિસ્તપાલન માટે તમે પ્રયત્ન ન કરતા હો એવી શિસ્તની બાળકો પાસે કદી માગાણી ન કરતા. શાંતિ, સમતા, વ્યવસ્થા, ધોરણસર વર્તન, નિરથ્યક શાખાનો ઉપયોગ ન કરવો, એ સર્વ વસ્તુઓ જો બાળકમાં દાખલ કરવી હોય તો શિક્ષકે પોતે તેમનું સતત પાલન કરતા રહેવું જોઈએ.

શિક્ષકે સમયસર વર્તવું જોઈએ. વર્ગ શરૂ થતાં પહેલાં થોડી મિનિટો વહેલાં આવવું અને વ્યવસ્થિત રીતનાં કપડાં પહેરવાં. અને પોતાના વિદ્યાર્થીઓ જૂં બોલે નહિ તે માટે તેણે પોતે કદી જૂં બોલવું નહિ. વિદ્યાર્થીઓ તેમનું ભગજ ગુમાવે નહિ તે માટે શિક્ષકે તેમની ઉપર કદી ગુસ્સો કરવો નહિ. અને તેમને એ સાચી રીતે કહી શકે કે, ‘તોછડાઈભર્યા વર્તનને અંતે રડવું પડે છે’ તે માટે તેણે કદી બાળકો ઉપર હુથ ઉગામવો નહિ.

આ તદ્દન પ્રાથમિક અને પાયાની વસ્તુઓ છે અને કશા અપવાદ સિવાય બધી શાળાઓમાં વવાવી જોઈએ.

\*

જ્યારે તમે પોતે તમારી પ્રકૃતિને વશમાં રાખેલી હોય ત્યારે જ તમે બાળકોનાં મન ઉપર કાબૂ ધરાવી શકો.

(૧૬ જુલાઈ ૧૯૬૩)

\*

પ્રથમ તો તમારે શું શિખવાડવાનું છે તે બરાબર જાણી લો. તમારા વિદ્યાર્થીઓ અને તેમની વિશિષ્ટ જરૂરિયાતોને સારી પેઠે સમજી લો.

ખૂબ શાંત અને ધીરજવાન રહો, કદી ગુસ્સે ન થાઓ; જો તમારે બીજાઓ ઉપર પ્રભુત્વ રાખવું હોય તો તમારી જાત ઉપર તમારો કાબૂ હોવો જોઈએ.

(૭ ડિસેમ્બર ૧૯૬૪)

\*

જો તમારે સત્તાનો ઉપયોગ કરવો પડે તેમ હોય તો પ્રથમ તો તમારી જાત ઉપર સત્તા વાપરો. જો તમે બાળકોમાં શિસ્ત જાળવી ન શકો તો ક્ષુબ્ધ થઈ જઈ ઘાંટા ન પાડો કે તેમને માર મારો નહિ — એમ કરવાની રજા નથી. ઉપરથી સ્થિરતા અને નીરવતાને બોલાવી લાવો. એમની હાજરીથી પરિસ્થિતિ સુધરશે.

\*

“અને માતાજી, નાનાં બાળકોનું અમારે શું કરવું?”

ઓહ, નાનાં બાળકો તો અદ્ભુત હોય છે! હું ઘણાં નાનાં બાળકોને મળું છું. લોકોને તેમને મારી પાસે લાવવાની ટેવ પડી છે. અને બે વર્ષથી પણ નાનાં બાળકોમાં જે ચેતના હોય છે તે તો અદ્ભુત હોય છે. એ લોકો સભાન હોય છે. એ લોકો પોતાને વ્યક્ત કરી શકતાં નથી, એમની પાસે શબ્દો નથી હોતા, પણ એ લોકો બરાબર સભાન હોય છે. એટલે એક બાળકને ધમકાવવું એવું લાગે છે...!

પેલે દિવસે એક બાળકને મારી પાસે લાવવામાં આવેલું. બાળક નારાજ હતું અને મા પણ.... એટલે મેં એને એક ગુલાબ આપ્યું: ‘જો! આ તારા માટે છે!’ અલાદત, એને શબ્દો તો સમજાયા નહિ, પણ એણે ગુલાબને લઈને આમતેમ ફેરવ્યું અને શાંત થઈ ગયું. નાનાં બાળકો અદ્ભુત હોય છે. એમની આસપાસ બધી વસ્તુઓ મૂકીને રમતાં મૂકવાં. અનિવાર્ય ન હોય ત્યાં સુધી એમનામાં ખલેલ ન કરવી. એમને રમવા દેવાં અને એમને કદી ધમકાવવાં નહિ.

(૩૧ જુલાઈ ૧૯૬૭)

\*

તું એક સારો શિક્ષક છે પણ તારા વિદ્યાર્થીઓ સાથેનો વર્તાવ વાંધાજનક છે.

બાળકોને પ્રેમ અને કરુણાના વાતાવરણમાં ભણાવવાં જોઈએ.

માર્પીટ કદી નહિ.

ધમકાવવાનું કદી નહિ.

હુમેશાં એક મૃદુ માયાળુપણું રાખવું. પોતાનાં બાળકો જે સદગુણો અપનાવે એવી અપેક્ષા હોય તેવા ગુણો શિક્ષકે સૌપ્રથમ કેળવીને એક જીવંત ઉદાહરણ બની રહેવું.

બાળકોને શાળાએ જતાં ખુશી ઊપજવી જોઈએ. ભણાવવાં ખુશી ઊપજવી જોઈએ. અને શિક્ષકે તેમના એક એવા ઉત્તમ મિત્ર થઈ રહેવું જોઈએ જે પોતે તેમણે અપનાવવા લાયક ગુણોનું જીવંત ઉદાહરણ હોય.

અને સર્વનો આધાર કેવળ શિક્ષક ઉપર જ છે. એ પોતે શું કરે છે અને કઈ રીતે વર્તે છે તેની ઉપર બધો આધાર છે.

\*

“વિદ્યાર્થીઓ વર્ગમાં એટલી બધી વાતો કરે છે કે મારે ઘણી વાર તેમને ધમકાવવા પડે છે.”

બાળકો ઉપર કઠોરતાથી નહિ પણ આત્મસંયમ વે જ કાબૂ આવે છે.

મારે તેમને કહેવું જોઈએ કે જે શિક્ષકને માન જોઈતું હોય તો તોણે પોતે માનને લાયક બનવું જોઈએ. તમે આજ્ઞાપાલન માટે હિંસાનો ઉપયોગ કરો છો એવી કેવળ ‘ક્ષ’ની જ ફરિયાદ નથી; આથી વધુ શરમાવા જેવી વસ્તુ બીજી કોઈ નથી. તમારે પ્રથમ તો તમારી જાત ઉપર કાબૂ રાખતાં શીખવું જોઈએ અને તમારી ઈચ્છા લાદવા માટે પાશવી બળનો પ્રયોગ બંધ કરવો જોઈએ.

જ્યારે વિદ્યાર્થીઓમાં અશિસ્ત જણાતી ત્યારે મને હુંમેશાં લાગતું કે એમના શિક્ષકના ચારિત્રયમાંની કોઈ વસ્તુ અને માટે કારણભૂત હોવી જોઈએ.

“હું આશા રાખું છું કે મારા વર્ગમાં વ્યવસ્થા રાખવા માટે આપ મને સ્પષ્ટ સૂચનાઓ આપશો.”

સૌથી અગત્યનું તો એ છે કે તમારે તમારી જાતને અંકુશમાં રાખવી અને કઢી પડા ભિજાજ ગુમાવવો નહિ જો તમે તમારી જાત ઉપર જ અંકુશ નહિ રાખી શકતા હો તો બીજાને અંકુશમાં રાખવાની આશા કઈ રીતે રાખી શકશો અને તે પણ બાળકો ઉપર — જેમને તરત જ ખબર પડે છે કે આ વ્યક્તિનો પોતાની જાત ઉપર કાબૂ નથી.

\*

## નાનાં બાળકોના વર્ગશિક્ષકોને

એક નિયમનું કડકપણે પાલન કરવું :

બાળકોને મારવાની સખ્ત મનાઈ છે — બધા પ્રકારના પ્રહારો, ભલે તે નાનકડો ઘઘો હોય અથવા તો ભિત્રાચારીભરી ચીમટી હોય. બાળક પોતાની આજ્ઞાનું પાલન ન કરતું હોય અથવા સમજતું ન હોય અથવા તો એ બીજાઓને ખલેલ પહુંચાડતું હોય તો એનો અર્થ એ કે શિક્ષકનો પોતાની જાત ઉપર કાબૂ નથી અને એ વસ્તુ શિક્ષક અને વિદ્યાર્થી બંનેને હાનિકર્તા છે.

જરૂર હોય તો શિસ્તપાલન માટેનાં પગલાં લેવાં, પરંતુ સંપૂર્ણ શાંત અવસ્થામાંથી અને વ્યક્તિગત પ્રતિકાર્યને કારણે નહિ.

\*

“વર્ગમાં નીરવ વાતાવરણ રાખવા માટે મારે શું કરવું?”

તમે પોતે નીરવ બની રહો.

તમારી સાથે એક પુંદ્ર લેતા જાઓ, લગભગ એક મીટર લાંબું. એના ઉપર ખૂબ મોટા અક્ષરે સફેદ રંગ ઉપર ખૂબ ખૂબ મોટા કાળા અક્ષરે લખવું:

### શાન્તિ

(આથી પણ મોટા અક્ષરો વાપરવા) અને જ્યારે બાળકો વાતો કરવા માડે ત્યારે તમારી સામે એ પાઠિયું મૂકવું.

આશીર્વાદ.

\*

સાચ્યું જ્ઞાન ગ્રાપ્ત કરવા માટે જે વસ્તુ ભૂલી જવાની જરૂર હોય તેના વિષે બાળકને કદ્દી કાંઈ કહેશો નહિ. જ્યારે બાળક મોદું થાય ત્યારે તેણે ન કરવા જેવું હોય તેવું તેની સમક્ષ કદ્દી ન કરવું.

\*

કદ્દી પણ ભૂલશો નહિ કે છ વર્ષથી નાનું બાળક, તે બોલી શકે છે તેથી વધુ સમજે છે.

\*

## ગૃહકાર્ય

“સૌ વિદ્યાર્થીઓ એવી ફરિયાદ કરે છે કે હુરેક શિક્ષક પોતાના વિષયનો જ વિચાર કરે છે અને ગૃહકાર્ય આપે છે. એ દરેક એમ માને છે કે પોતે બધુ થોડું ગૃહકાર્ય આપે છે, પરંતુ તેઓ એમ સમજતા નથી કે આવા બધા નાના નાના ટુકડાઓ ભેગા મળીને ઘણું બધું ગૃહકાર્ય બની રહે છે.”

હું તેઓ ખોટા છે એમ નથી કહી શકતી.

જે શિક્ષકો વિદ્યાર્થીઓના અમુક ગ્રૂપને ગૃહકાર્ય આપતા હોય તેમણે એકબીજા સાથે સમજૂતી કરી એવી રીતે ગૃહકાર્ય સોંપવું કે જેથી વિદ્યાર્થીઓ ઉપર વધુ પડતો કામનો બોજો ન પડે અને એમને માટે અનિવાર્ય એવો આરામ અને હળવા થવાનો સમય તેમને મળી રહે.

હું કોઈ ઉપયોગી સલાહ આપી શકું તે પહેલાં આવી સામૂહિક તૈયારીએ આકાર લેવો જોઈએ.

વિષયોની બાબતમાં એમ કહી શકાય કે એવા વિષયોની પસંદગી કરવી અનિવાર્ય છે કે જે શિક્ષકોના અંગત અનુભવો સાથે મેળ ખાતા હોય અને જેમના વે આંતર નિરીક્ષણ, અવલોકન અને પોતાની ઉપર પડતી છાપોનું પૃથક્કરણ કરવામાં ઉત્સાહ પ્રગટે.

(ડિસેમ્બર ૧૯૫૮)

\*

(ગણિતના એક શિક્ષકે પૂછેલું કે તેણો તે સમયની એવી નીતિ કે દસ વર્ષથી નીચેના બાળકને ગૃહકાર્ય ન આપવું તેનું ચુસ્ત-પણે પાલન કરવું કે કેમ. એને થોડાક વિદ્યાર્થીઓએ ઘેર ગણવા માટે દાખલાઓની માગણી કરી હુતી. શ્રી માતાજીએ લખ્યું :)

આ ગૃહકાર્ય એક કાંટાળો વિષય છે. એમ કરો કે જેમને ગૃહકાર્ય કરવું હોય તેઓ મને બારોબાર લખે.

(૧૯૬૦)

\*

“અમારા ગણિતના વર્ગમાં અમને થોડુંક ગૃહીકાર્ય કરવા મળવું જોઈએ.”

તમે જો ફેન્ચ જરા વધુ સારી રીતે લખી શકતા હોત તો કેવું સારું!

તમારી ઈચ્છા હોય તો તમે ગૃહીકાર્ય કરો — પરંતુ બહુ કામ લઈને બેદરકારી અને બિનઅન્દેકાગ્રતાપૂર્વક તે કરવું તેના કરતાં થોડું કામ પણ સારી રીતે થાય તે વધુ સારું.

જો તમારે કોઈ પણ વસ્તુ કરી શકવાની શક્તિ પ્રાપ્ત કરવી હોય તો તમારે તમારી જાતને શિસ્તમાં રાખતાં અને એકાગ્રતા કરતાં શીખવાની જરૂર છે.

(૨૮ જૂન ૧૯૬૦)

\*

બાળકોએ તેમને ઘેર ગૃહીકાર્ય કરવાની બાબતમાં હું સંમત નથી. તેમને ઘેર તેમને જે કરવું હોય તે કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

આ પ્રશ્નનો ઉકેલ “નીરવતા બંડ”માંથી મળી રહેશે.\*

(૧૪ સપ્ટેમ્બર ૧૯૬૭)

\*

ધ્યાં બાળકો અને માતાપિતાઓ તરફથી ધ્યાં ધ્યાં કાગળો દ્વારા એવી ફરિયાદ કરવામાં આવી છે કે ગૃહીકાર્યને લઈને બાળકો મોઢાં સૂઈ જાય છે અને પૂર્તી ઊંઘ ન મળવાને કારણે થાકેલાં રહે છે અને તેના પછી આ વસ્તુ આવી છે.

હું જાણું છું કે આ બધી ફરિયાદો અતિશયોક્તિવાળી છે. પરંતુ એથી એમ પણ દેખાય છે કે પરિપાટીમાં કાંઈક સુધારો થવો જરૂરી છે.

આ યોજનાને તમામ વિગતો સાથે સંપૂર્ણ નમનીયતા અને મુલાયમતા સાથે કાર્યબદ્ધ કરવાની છે.

હું એવા મતની નથી કે બધાં જ બાળકોની સાથે એકસરખો વર્તાવ કરવો જોઈએ. એને લઈને એકતરફી કક્ષાવાળું ધોરણ તૈયાર થાય છે, જેને લઈને જેઓ પાછળ પડતાં હોય છે તેમને ફાયદો થાય છે અને જેઓ સામાન્ય કક્ષાથી ઊંચે ઊરી શકે છે તેમને માટે નુકસાનકારક નીવડે છે.

જેઓ કામ કરવા અને ભાગવા માગતા હોય તેમને ઉતેજન આપવું, પરંતુ

\* એક રૂપ કે જ્યાં બાળકો નીરવતાપૂર્વક બેસે છે અથવા અભ્યાસ કરે છે.

જેમને ભાગું ન ગમતું હોય તેમની શક્તિઓને બીજી દિશામાં વાળવી જોઈએ.

બધી વસ્તુઓને સુવ્યવસ્થિત ગોઠવવાની છે. એનો અમલ કરવાનું પછી નક્કી થશે.

આશીર્વાદ.

(૨૬ સપ્ટેમ્બર ૧૯૬૭)

\*

## પરીક્ષાઓ

“માતાજી, ઘણી વાર મને આપને પૂછવાનું મન થાય છે કે નવા વર્ષમાં આ વર્ગોના પુનર્ગંડન પાછળ આપનો શો હેતુ છે, એમાં પછી પરીક્ષાઓ હોય કે ન હોય.”

મને પરીક્ષા તદ્દન જરૂરી વસ્તુ લાગે છે. ગમે તેમ પણ, ફેન્ચ માટેની એક પરીક્ષા તો રહેશે જ.

સ્પ્રેમ આશીર્વાદ

(૨૮ ઑક્ટોબર ૧૯૪૬)

\*

કોઈ વર્ગો માટેના વિદ્યાર્થીઓની પસંદગી ચીલાચાલુ રીતની પરીક્ષાઓ વે નહિ થઈ શકે. એ તો કેવળ પોતાની મનોવૈજ્ઞાનિક દૃષ્ટિનો વિકાસ કરવાથી થઈ શકશે.

જે બાળકોને અભ્યાસ કરવો હોય તેમની પસંદગી કરજો, નહિ કે જેઓ પોતાને ધક્કો મારીને આગળ કરવા માગતાં હોય.

(૨૮ ઑક્ટોબર ૧૯૬૫)

\*

## (પરીક્ષાઓમાં ચોરી કરવા વિષે)

“મારે શું કરવું? જેમ બણાર કરવામાં આવે છે તેમ કરવું—એક ખંડમાં ત્રણ શિક્ષકોને તપાસ કરવા મૂકવા? અહીં આશ્રમમાં આ રીતે કરવાનું શિક્ષકોને ગમતું નથી..”

કે પછી આપણે પરીક્ષાઓ લેવાનું બંધ કરવું? મને આ દરખાસ્ત પણ શંકાસ્પદ લાગે છે કારણ કે ગૃહુકાર્ય અને નિબંધોની બાબતમાં પણ આમ જ બને છે.

ગમે તેમ હોય તો પણ આ પ્રશ્ન ખડો રહે છે જ, અને સાચો ઉકેલ લાવવા માટે અમારે સમજવું જોઈશો કે બાળકો આમ કેમ વર્તન કરે છે?

કૃપા કરીને મને આ ગેરવર્તણૂકની પાછળનાં કારણો આ પ્રશ્નનો ઉકેલ સમજાવશો.”

આમાં વાત સાદી છે. મોટા ભાગનાં બાળકો ભાણે છે કારણ કે તેમનાં કુટુંબો તેમને રિવાજો અને પ્રચલિત વિચારોને કારણે ભાણવાની ફરજ પાડે છે. પોતાને શીખવું હોય અને જ્ઞાન પામવું હોય તેવા કારણસર તેઓ ભાણતાં નથી. જ્યાં લગી તેમના ભાણવાનો હેતુ સુધરશે નહિ, જ્યાં સુધી તેઓ જ્ઞાનપ્રાપ્તિ માટે કાર્ય નહિ કરે, ત્યાં સુધી તેઓ પોતાનું કામ સરળ કરવા માટે અને ઓછા પ્રયત્ને પરિણામ પ્રાપ્ત કરવા બધી જાતની યુક્તિ-પ્રયુક્તિઓ વાપરશે.

(જૂન ૧૯૬૭)

\*

(શ્રી માતાજીએ એવો નિર્દેશ આપેલો કે નીચે લખેલા વક્કયનું જો બાળકો એક દિવસમાં સો કે હુજાર વખત રટણ કરશો અને જ્યાં સુધી એ એક સજીવ આંદોલન બને ત્યાં સુધી એમ કર્યા કરશો તો એ વિદ્યાર્થીમાં ભાણવા માટેનો સાચો સંકદ્દ્ય અને હેતુ મગટ થશે.)

સર્વે વિદ્યાર્થીઓને રોજ પાઠ કરવા માટે:

અમે અમારા કુટુંબ માટે, કોઈ સારો હોદ્દો મેળવવા માટે, પૈસા કમાવા માટે, કોઈ ઉપાય મેળવવા માટે ભાગતા નથી.

અમારે વિશ્વનો અભ્યાસ કરવો છે, જાણવું છે, સમજવું છે, અને એ જ્ઞાનના આનંદને ખાતર અમે ભાણીએ છીએ.

(જૂન ૧૯૬૭)

\*

આનો ઉકેલ માત્ર આ પરીક્ષા નાખૂં કરવામાં છે અને બધું થઈને રહેશે. તમે બધાં પેપરોનું એક બંડલ બનાવીને રાખો — જાણો કે એ વસ્તુ બની જ ન હોય — અને શાંતિથી તમારા વર્ગો ચાલુ રાખો.

વર્ષના અંતે તમે વિદ્યાર્થીઓને તેમના વિષેની તમારી નોંધ આપજો. તેમાં આધાર તેમની પરીક્ષાની ઉત્તરવહીઓ ઉપર ન રાખશો. પરંતુ તેમનાં વર્તન, એકાગ્રતા, નિયમિતતા, સમજવાની ઝડપ અને તેમની બુદ્ધિની વિશ્વાસી વિષેની નોંધ આપજો.

તમારે પોતાને માટે આ વસ્તુ પોતાના આંતરિક સંપર્ક, સૂક્ષ્મ નિરીક્ષણ અને નિષ્પક્ષ દૃષ્ટિબિંદુ કેળવવાની તાલીમ રૂપે ગણાજો.

વિદ્યાર્થીઓ માટે એ વસ્તુ જે કાંઈ તે શીખતાં હોય તેઓ સાચી રીતે ભાગવાની જરૂરિયાતરૂપ અને નહિ કે પોતે જે વસ્તુ ન સમજ્યા હોય તેને પણ પોપટની માફક બોલી નાખવાની વસ્તુ બની રહેશે.

અને આ રીતે શિક્ષાણમાં એક સાચી પ્રગતિ બની આવશે.

આશીર્વાદ સહ.

(૨૧ જુલાઈ ૧૯૬૭)

\*

મને સમજાય છે કે વિદ્યાર્થીઓ બુદ્ધિશાળી, તત્પર અને ધ્યાન આપનારા છે કે નહિ તે જાણવા માટે પરીક્ષાની પદ્ધતિ કોઈ પણ રીતની ઉપયોગિતા વિનાની અને બિનજરૂરી બની રહી છે.

એક મૂર્ખ, યંત્રવત્ પણ સમૃતિ-શક્તિ ધરાવનાર મન વડે પરીક્ષાના ઉત્તરો સારી રીતે આપી શકાય પરંતુ એ ગુણો વડે ભવિષ્યના માનવીનું સર્જન ન થાય.

જૂની ટેવોને સહન કરી લેવાની મારી ક્ષમતાને કારણે મેં એવી સંમતિ આપેલી કે જેમને પરીક્ષા આપવી હોય તે આપી શકે છે. પરંતુ હું આશા રાખું છું કે

ભવિષ્યમાં આવી ઉદારતાની જરૂરિયાત નહિ રહે.

જો પરીક્ષાઓને નાબૂદ કરવામાં આવે તો કોઈ વિદ્યાર્થી સારો છે કે નહિ તે જાણવા માટે શિક્ષકમાં થોડોક વધુ આંતરિક સંપર્ક અને મનોવૈજ્ઞાનિક જ્ઞાન જોઈશ. પરંતુ આપણા શિક્ષકો પાસે તો યોગ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, એટલે આ વસ્તુ એમને માટે બહુ મુશ્કેલ ન બનવી જોઈએ.

(૨૨ જુલાઈ ૧૯૬૭)

\*

એ તો સ્વાભાવિક છે કે કોઈ વિદ્યાર્થી અમુક વસ્તુ શીખ્યો છે કે શીખ્યો છે અને પ્રગતિ કરી છે કે નહિ તે જાણવા માટે શિક્ષકે વિદ્યાર્થીની કસોટી કરવી જોઈએ. પરંતુ પરીક્ષા વ્યક્તિગત અને દરેક વિદ્યાર્થીને માફક આવે તેવી હોવી જોઈએ — બધા જ વિદ્યાર્થીઓને માટેની કોઈ સર્વસામાન્ય પરીક્ષા ન હોવી જોઈએ. એ પરીક્ષા સ્વયંભૂ અને આણધારી રીતે લેવાવી જોઈએ જેથી એમાં કોઈ પ્રકારના ડોળ કે અસત્યતાને સ્થાન ન રહે. સ્વાભાવિક રીતે આમ કરવું શિક્ષકને માટે પણ વધારે અધરું છે પરંતુ વધુ જીવંત અને અસરકારક છે.

મને તમારા વિદ્યાર્થીઓ વિશેના અભિપ્રાયોમાં રસ પડ્યો. એનાથી સાબિત થાય છે કે તમારે તેમની સાથે વ્યક્તિગત સંબંધ છે — અને સારા શિક્ષણ માટે એ વસ્તુ પાયાની જરૂરિયાત છે.

જે સત્યનિષ્ઠા વિનાના છે તેમને સાચે જ કંઈ શીખવું નથી પણ સારા માર્ક અને શિક્ષકની શાબાશી જોઈએ છે — તેમનામાં કંઈ રસ પે તેવું નથી.

(૨૫ જુલાઈ ૧૯૬૭)

\*

“આપણા સ્વતંત્ર પ્રગતિના વર્ગોમાં ઈનામો આપવા માટે કયું ધોરણ રાખવું?”

ઈનામો આપવાનો આધાર હુક્કાઈમાં મળેલા ગ્રેડ ઉપર તો ન જ રાખવો.

કદરદાનીના પ્રતીક તરીકે એકસરખી કિંમતવાળું ઈનામ જેઓ અમુક કક્ષા સુધીની (૧) ક્ષમતા વત્તા (૨) શુભેચ્છામાં અને નિયમિત પ્રયત્નમાં આગળ વધેલા હોય તેમને આપવું.

ઈનામને પ્રાપ્ત ગણવા માટે આ બંને વસ્તુઓ હાજર હોવી જોઈએ.

\*

## અભ્યાસક્રમ

### શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં પુસ્તકોનો અભ્યાસ

“મધુર માતાજી, અમારે આપનાં અને શ્રી અરવિંદનાં પુસ્તકો કઈ રીતે વાંચવાં કે જેથી તેમનામાંની વસ્તુ કેવળ મન વડે સમજવાને બદલે અમારી ચેતનામાં પ્રવેશ કરે?”

મારાં પુસ્તકો વાંચવાં એ કોઈ અધરી વસ્તુ નથી કારણ કે તે સરળ ભાષામાં, લગભગ બોલાતી ભાષામાં લખાયેલાં છે. એમનો લાભ ઉઠાવવા માટે એટલું પૂરતું છે કે તમે એમને ધ્યાન અને એકાગ્રતાપૂર્વક વાંચો, તમારામાં આંતરિક શુભત્વની લાગણી જાળવી રાખો અને જે કાંઈ શીખવવામાં આવ્યું હોય તેને ગ્રહણ કરીને જીવનમાં ઉત્તરવાની કામના રાખો.

શ્રી અરવિંદનાં લખાએ વાંચવાં વધુ અધરાં છે કારણ કે તેમની પ્રસ્તુત કરવાની છટા ઉચ્ચ્યતમ બુદ્ધિશક્તિવાળી હોય છે અને ભાષા પણ સાહિત્યની અને તત્ત્વજ્ઞાનની હોય છે. એમનાં લખાએ સમજવા માટે મગજમાં તૈયારી હોવી જોઈએ છે અને સામાન્ય રીતે, એ રીતની તૈયારી કરતાં સમય લાગે છે, સિવાય કે તમારામાં ખાસ પ્રકારની આંતરિક અંતઃસ્કુરાણાની સ્વાભાવિક રીતની બિક્ષિણ હોય.

ગમે તેમ હોય, પણ મારી સલાહ એવી છે કે જે વાંચો તે થોડું થોડું કરીને વાંચો. તમારા મનને બને તેટલું શાંત રાખો, સમજવા માટેની મથામણ ન કરો, પણ મસ્તકને બને તેટલું નીરવ રાખીને, પોતે જે વાંચતા હો તેમાં રહેલી શક્તિ પોતાની અંદર ઊંડાણમાં ઉત્તે તેમ થવા દો. એ શક્તિ તદ્દન અશુભ અવસ્થામાં જ ઝીલી શકાય છે. જો તમારામાં નીરવતા હશે તો એ એનું પ્રકાશનું કાર્ય કરશે અને જરૂર હશે તો સમજણ માટે તમારા મગજમાં જરૂરી કોષોની રચના પણ કરશે. આમ, જ્યારે તમે એની એ જ વસ્તુ થોડાક માસ પછી વાંચશો તે તમને જાણાશો કે એ લખાણમાં વ્યક્ત કરવામાં આવેલો વિચાર વધુ સ્પષ્ટ અને નજીકનો બનેલો છે, અને કેટલીક વાર તો તમને એ તદ્દન સ્વાભાવિક પ્રકારનો અને જાણીતો લાગશે.

રોજ નિયમિતપણે, શુદ્ધ હોય તો અમુક નિશ્ચિત સમયે થોડું થોડું વાંચવું. એમ કરવાથી મગજમાં જીલવાની શક્તિ ઉત્પન્ન થવાનું કાર્ય સરળ બને છે.

(૨ નવેમ્બર ૧૯૫૮)

“મધુર માતાજી, શ્રી અરવિંદનાં પુસ્તકો વાંચવાં અધરાં લાગે છે અને હું સમજી શકતો નથી તો મારે તેમને કેવા ભાવપૂર્વક વાંચવાં? દાખલા તરીકે: લાઈફ ડિવાઈન, સાવિત્રી.”

એક વખતે બેસીને થોડુંક વાંચો, ફરીને તમને સમજાય ત્યાં સુધી વાંચો.

(૨૩ મે ૧૯૬૦)

\*

“શ્રી અરવિંદનાં લખાણો વાંચવાનો સાચો માર્ગ કરો?”

સાચી પદ્ધતિ એક વખતે થોડુંક વાંચવાની છે: એકાગ્રતાપૂર્વક, મનને બને તેટલું શાંત રાખીને, સમજવા માટે બહુ સક્રિય રીતની મથામણ કર્યા વિના, નીરયતાપૂર્વક ઊદ્ઘર્ષ પ્રત્યે વળેલા રહીને જ્યોતિ માટે અભીષ્ટા સેવતા જઈને. ધીરે ધીરે સમજાણ પડતી જશે.

અને પાછળથી, એક કે બે વર્ષમાં, તમે એની એ જ વસ્તુ ફરીથી વાંચશો ત્યારે તમને ખબર પડશેકે તમારો પ્રથમ સંપર્ક અસ્પષ્ટ અને અપૂર્ણ હતો, અને સાચી સમજ પાછળથી, જ્યારે એ વસ્તુને તમે અમલમાં મૂકી હોય છે ત્યારે આવે છે.

(૧૪ ઓક્ટોબર ૧૯૬૭)

\*

**તમે** આ પૃથ્વી ઉપર તમારું પોતાનું જ્ઞાન પ્રાપ્ત કરવા આવ્યા છો.

શ્રી અરવિંદનાં પુસ્તકો વાંચો અને તમારી ભીતરમાં જેટલે ઉંચ જવાય. તેટલા ઉંડાણમાં દૃષ્ટિ નાખો.

(૪ જુલાઈ ૧૯૬૮)

\*

“શ્રી અરવિંદના આ શતાબ્દી વર્ષમાં અમે વિદ્યાર્થીઓ અને શિક્ષકો, શ્રી અરવિંદની કંઈ રીતે સેવા બજાવી શકીએ તે અમને કહું.”

પ્રથમ તો, શ્રી અરવિંદ કેળવણી વિષે જે કંઈ લખ્યું છે તે વાંચો. ત્યારે પછી તમને એ વસ્તુ અમલમાં મૂકવાનો માર્ગ જડશે.

(૧૯૭૨)

\*

શ્રી અરવિંદ આ પૃથ્વી ઉપર, અતિમાનસ જગતનો આવિર્ભાવ જાહેર કરવા આવ્યા હતા. એમણે કેવળ એ આવિર્ભાવની જાહેરાત જ નથી કરી પરંતુ અતિમાનસ શક્તિનો અંશ પોતાના દેહમાં ધારણ કર્યો હતો અને પોતાના ઉદાહરણથી બતાવી આપ્યું હતું કે એને આવિર્ભાવ કરવા માટે તૈયાર થવા માટે વ્યક્તિએ શું કરવું જરૂરી છે. આપણે માટે સારામાં સારી વસ્તુ એ છે કે તેમણે જે કહેલું છે તે સર્વનો અભ્યાસ કરવો, તેમના દાખલાનું અનુસરણ કરવું અને આપણી જાતને નૂતન આવિર્ભાવ માટે તૈયાર કરવી.

આને લઈને જીવનને ખરો અર્થ મળો છે અને આપણને સૌ પ્રકારના અવરોધોને ઓળંગવામાં સહાય થાય છે.

આપણે નૂતન સર્જન માટે જીવીશું તો આપણે યુવાન અને ગ્રાતિશીલ રહીને વધુ ને વધુ બળવાન બનતા જઈશું.

(૩૦ જાન્યુઆરી ૧૯૭૨)

\*

“શ્રી અરવિંદની શતાબ્દી માટે હું વ્યક્તિગત રીતે શ્રી અરવિંદને માટે કયું કાર્ય કરું?”

તમારા મનનું સર્વ સત્યનિષ્ઠા સાથે સમર્પણ કરો.

(૧૩ નવેમ્બર ૧૯૭૦)

\*

“હું શ્રી અરવિંદને પૂરેપૂરી સત્યનિષ્ઠા સાથે મારા મનનું સમર્પણ કરી શકું તે માટે મારામાં એકાગ્રતા કરી શકવાની બળવાન શક્તિનો વિકાસ સાધવાનું જરૂરી ખરું કે નહિ? આપ મને કહેશો કે હું આવી મૂલ્યવાન શક્તિ કર્ય રીતે ખીલવી શકું?”

દિવસનો એક એવો સમય નક્કી કરો કે જે સમયે તમે દરરોજ શાંત રહી શકો.

પછી શ્રી અરવિંદનું એક પુસ્તક લો. એક કે બે વાક્યો વાંચો. પછી નીરવતાપૂર્વક એકાગ્ર થઈને એની ભીતરમાં રહેલો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. એટલી ઊંડી એકાગ્રતા કરો કે જેથી મન નીરવ થઈ જાય. આ રીતે દરરોજ કરતા રહો કે જેથી તેનું ધારેલું પરિણામ આવશે.

તમે નિદ્રામાં પડી ન જાઓ એ તો જોવાનું જ છે.

(૩ ફેબ્રુઆરી ૧૯૭૨)

\*

જો કોઈ શ્રી અરવિંદના લખાણોને ધ્યાનપૂર્વક વાંચે છે તો તેને જે કાંઈ જાણવું હોય છે તેના ઉત્તરો મળી રહે છે.

(૨૫ ઓક્ટોબર ૧૯૭૨)

\*

શ્રી અરવિંદ બધા જ વિષયો ઉપર લખેલું છે. એ વાંચવાથી તમને આ દુનિયાની બધી જ વસ્તુઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે.

\*

“માતાજી, અમે બુદ્ધિમાન કરી રીતે થઈ શકીએ?”

શ્રી અરવિંદના લખાણો વાંચ્યો.

\*

શ્રી અરવિંદની વાણી પુસ્તકોના કમથી વાંચવાની નથી. એમનાં લખાણો વિષયવાર વાંચવાનાં છે — એમણે પ્રભુ વિષે, એકતા વિષે, ધર્મ વિષે, ઉત્કાન્તિ વિષે, કેળવણી વિષે, આત્મસિદ્ધિ વિષે, અતિમનસ વિષે, વગેરે વિષયોમાં જે કહેલું છે તે રીતે વાંચવાનું જરૂરી છે.

\*

“અંગ્રેજુ ભાષા અંગેની સમિતિએ જે માની લીધું છે કે શાળાના કાર્યક્રમમાં શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં પુસ્તકોનો, સમાવેશ કરવો તે બારાબર છે?”

ઉ.

“આમાં આખાં પુસ્તકોને પરંપરા જોઈએ કે જુદાં જુદાં લખાણોનાં અવતરણો?”

શાળાને માટે અવતરણો વધુ યોગ્ય છે.

“યોગ વિષેનાં લખાણોમાંથી અવતરણો લેવાં?”

બહુ સાદી વસ્તુઓ — જેવી કે, “યોગનાં મૂળ તત્ત્વો.”

“અંગ્રેજુ ભાષાના અભ્યાસ માટે આ પુસ્તકો કે અવતરણોનો કઈ રીતે ઉપયોગ કરવો? એમનાં સપદીકરણ આપવાં કેવળ વાંચી જ જવાં? ખાસ કરીને શ્રી માતાજીએ યોગ વિષેનાં લખાણોની બાબતમાં અનુમતિ આપી છે તો એમનો અભ્યાસ કઈ રીતે કરવો?”

યોગની દૃષ્ટિએ નહિ.

“આ અવતરણોની પસંદગી” દરેક શિક્ષકે વ્યક્તિગત રીતે\* વર્ગની જગ્યારિયાત જોઈને, સમિતિની (યુનિવર્સિટી બોર્ડ સાથે સલાહ-મસલાત કરીને) મંજૂરી લઈને કરવી?

કે પછી એમ કરવું કે સમિતિએ (યુનિવર્સિટીના બોર્ડની સલાહ લઈને) જુદા જુદા શિક્ષકોએ ભલામણ કરેલાં અવતરણોમાંથી વર્ગીકૃત અને કુમબદ્વારા પસંદગી કરવી જોઈએ?”

ના, કારણ કે એમ કરવું જરૂર પડ્યે પૂરતા પ્રમાણમાં વળાંક આપી શકાય તેવું નહિ બને.

“દરેક વર્ગમાં એક અઠવાડિયામાં પાંચ પિરિયડ અંગ્રેજુ માટે રાખેલા છે. આમાંથી કોઈ એક કે વધુ પિરિયડ શ્રી અરવિંદ અને માતાજીનાં લખાણો માટે જ નક્કી કરવા જોઈએ?”

હા,

આ માટે કોઈ વધારાનો પિરિયડ કે સમય આપવો જોઈએ?

\* શ્રી માતાજીએ આ શબ્દો નીચે લીટી દોરીને માર્ગનમાં ‘દા’ લખેલું.

ના.

ભાષાને લગતો કોઈ એવો સ્તર છે કે જ્યાં આ લખાણોનો વર્ગમાં ઉપયોગ ન કરવો? જો એમ હોય તો અંગેજુ ગ્રૂપમાંથી કયાં ગૂપનો આમાં સમાવેશ ન કરવો?

આનો આધાર કેવળ વિદ્યાર્થીઓની ક્ષમતા ઉપર છે.

\*

ઉચ્ચ શિક્ષણના કોર્સના પ્રોફેસરો માટેની નોંધ :

ઉચ્ચ શિક્ષણના વર્ગમાં, શ્રી અરવિંદનાં લખાણોના અભ્યાસ માટે, શ્રી માતાજીએ નીચે મુજબની પદ્ધતિનું અનુસરણ કરવાનું સૂચયવું છે:

(૧) શિક્ષકે સૌંગધરી એક વિષય લઈને એ અંગેની માહિતીનાં મૂળ તત્ત્વો વિદ્યાર્થીઓને સમજાવવાં.

(૨) પછી તેમણે કશી ટીકા-ટિપ્પણી કર્યા વિના શ્રી અરવિંદનાં લખાણમાંથી એ વિષય સાથે સંબંધ ધરાવતો સૌથી વધુ સૂચક પેરેગાફ વિદ્યાર્થીઓને આપીને તેનું તેઓને વાચન અને ચિંતન કરવા કહેવું.

(૩) પછી, મૌખિક રીતે બીજા વર્ગમાં અથવા કોઈ ટૂંકા નિબંધના રૂપમાં વિદ્યાર્થીઓને તેઓ જે કાંઈ સમજ્યા હોય કે નિર્ણય ઉપર તે આવ્યા હોય તે જણાવવા વિનંતી કરવી.”

(૨૫ ઓક્ટોબર ૧૯૫૮)

“ઉપરના પૈકી મુદ્દા નં. ૧ વિષે : શું માતાજીનો આશય એવો છે કે પોતાનો વિષય પ્રસ્તુત કરતી વેળાએ શ્રી અરવિંદનાં લખાણમાંથી કશું વાંચ્યા વિના જ એનો અમલ કરવો?”

જ્યારે શિક્ષકને એમ લાગે કે શ્રી અરવિંદનું લખાણ વાંચવું લાભદાયક નીવડશે ત્યારે જરૂર એમ કરવું.

“બીજા મુદ્દા વિષે: શિક્ષકે પોતાના મુદ્દાની રજૂઆત કર્યા પછી એણે કેવળ પુસ્તકમાંના ફકરાઓનો જ ઉદ્દોભ કરવો પરંતુ એમાંથી કાંઈ વર્ગમાં વાંચવું

નહિ? જો સમય હોય તો શિક્ષક, તેના વિદ્યાર્થીઓને એ ફકરાઓ વર્ગમાં વાંચવાનું કહી શકે? કે પછી તેણે એમને ઘેર જ વાંચવા કહેવું?”

શિક્ષક પોતે વાંચે, અથવા વિદ્યાર્થીઓને વર્ગમાં જ મોટેથી કે મનમાં વાંચવાનું કહે; વર્ગમાં કે ઘેર, એ સર્વનો આધાર સમય અને સંજોગો ઉપર રહે છે. અગત્યની વસ્તુ એ છે કે શ્રી અરવિંદનાં લખાણોને ચાવીને લગભગ પચી જાય તેવા ખોરાકના સ્વરૂપમાં વિદ્યાર્થીઓને આપવાં નહિ. શિક્ષક એમાં જે વખાણવાલાયક તત્ત્વો હોય તે વિષે જરૂર કહે, પરંતુ વિદ્યાર્થીઓને જે સંપર્ક ગ્રાપ્ત કરવાનો છે, જ્ઞાનજ્યોતિની પ્રાપ્તિનો આનંદ લેવાનો છે તે તેમની જાતે જ લેવા દેવો. શિક્ષકે, શ્રી અરવિંદની મહાન ચેતના અને વિદ્યાર્થીઓનાં ભગજ વચ્ચેની ગળાણીનું સ્થાન ન લેવું જોઈએ.

“ત્રીજા મુદ્દા વિષે : શું માતાજીનો આશય એમ છે કે, વિદ્યાર્થીઓ જે સમજ્યા હોય તે તેમણે તે જ વર્ગમાં કે પછીના વર્ગમાં મૌખિક કે લેખિત સ્વરૂપમાં રજૂ કરવું? જો કોઈ મુદ્દો કે પ્રકરણ એક વર્ગના સમય કરતાં વધુ સમય લે તેમ હોય તો શું એમ થઈ શકે કે જ્યારે એ આખા ય મુદ્દાને કે પ્રકરણને પૂરું કરવામાં આવે ત્યારે તેઓ તેમની સમજણા જણાવે?”

આ વસ્તુ સ્વાભાવિક રીતે જ શિક્ષક ઉપર છોડવી સારી.

“કેટલાક વિષયો એવા છે કે જેમને, શ્રી અરવિંદનાં લખાણો સમજવાના કાર્યની પૂર્વભૂમિકા તરીકે દાખલ કરવામાં આવ્યા છે. આવી રીતે પ્રાથમિક વિષયોને અલગ લેવા કરતાં શું એમ ન થઈ શકે કે શ્રી અરવિંદનું લખાણ અને એ વિષયોને સાથે જ લેવામાં આવે અને જ્યારે જ્યારે શ્રી અરવિંદના વિચારો રજૂ કરવામાં આવે ત્યારે પ્રાથમિક વિષયોના જરૂરી મુદ્દા પરત્વે વિદ્યાર્થીઓને નિર્દેશ કરવામાં આવે?”

તમને જે વધુ પસંદ હોય તેમ કરો. પરંતુ જેમ અગાઉ કંબું છે તેમ, કાળજી એ વાતની રાખવી કે વિદ્યાર્થીઓ પાસે શ્રી અરવિંદ આવે ત્યારે એમની પાસે જરૂરી માહિતી અને તૈયારી હોય અને સર્વ પ્રકારની તાજગી અને શક્તિ હોય.

“જ્યારે શિક્ષકે શ્રી અરવિંદનું કોઈ અમુક પુસ્તક હાથ ધર્યું હોય ત્યારે તે શ્રી અરવિંદનાં એ જ વિષય ઉપરનાં અન્ય પુસ્તકોભાગાંનાં લખાણોમાં રજૂ કરેલાં

દૂષિંબદુઓનો સમાવેશ કરી શકે? એવી જ રીતે શિક્ષક, શ્રી માતાજીનાં લખાણોમાંથી પણ અવતરણો લઈ શકે?”

તમે અચકી અચકીને તમારી ઉપર મર્યાદા શા માટે બાંધો છે? તમે શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં અન્ય લખાણો ટાંકી શકો છો.

(૧૦ નવેમ્બર ૧૯૫૮)

\*

(‘ભારતનો આધ્યાત્મિક ઈતિહાસ’ના વિષયના અભ્યાસની રૂપરેખા શ્રી માતાજીને વાંચી બતાવવામાં આવી ત્યારે તેમણે આ પ્રમાણો ટિપ્પણી કરેલીઃ)

ના! એમ નહિ ચાલે, એ રીતે ન થાપ, તમારે ધૂમ-ધડાકા-ધડાકા સાથે શરૂઆત કરવી જોઈએ!

તમે ઈતિહાસનું સાતત્ય બતાવવાનો પ્રયત્ન કર્યો છે, અને શ્રી અરવિંદ એના પરિપાક રૂપે ચરિતાર્થ સ્વરૂપે આવ્યા છે એમ બતાવો છો.

શ્રી અરવિંદ ઐતિહાસિક વ્યક્તિ નથી; તેઓ તો ઈતિહાસથી બહાર, પેલે પાર છે.

શ્રી અરવિંદના જન્મ સુધી, ધર્મો અને આધ્યાત્મિક પંથોનું કેન્દ્ર હુંમેશાં ભૂતકાળનાં સ્વરૂપોમાં રહેતું, તેઓ ‘લક્ષ્ય’ તરીકે પૃથ્વી ઉપરના જીવનનો ઈનકાર કરતા. એટલે તમારે બે વિકલ્પોમાંથી પસંદગી કરવાની રહેતીઃ કાં તો —

— આ જગતની અંદર રહેવું, તેનાં નાનાં નાનાં સુખ-દુઃખ, આનંદો અને વેદનાઓમાં ગોળ ગોળ ફર્યા કરવું, અને જો તમે યોગ્ય માર્ગે ન ચાલો તો તમારે માટે નક્કમાં જવાનો ભય ઊભો જ રહે, અથવા તો —

— કોઈ અન્ય જગતમાં ચાલ્યા જવું, સ્વર્ગ, નિર્વાણ, મોક્ષ....

આ બંનેમાંથી એકેય પસંદગી કરવા લાયક નથી. બંનેમાં એકસરખી બુરાઈ છે.

શ્રી અરવિંદ આપણને કહ્યું છે કે આ એક એવી પાયાની ભૂલ હતી જેને લઈ ભારત કેમ દુર્ભળ અને પતનગામી બન્યું તેનો ઘ્યાલ આવે છે. બૌદ્ધમત, જૈનમત, મિથ્યાવાદ — એ બધાં, આખા યે દેશની શક્તિનો રસ ઉડાડી દે તે માટે પૂરતાં હતાં.

એ ખરું કે, ભારત એ જગતમાનો એક જ એવો દેશ છે જ્યાં હુજુ પણ એવી સભાનતા છે કે જરૂર તત્ત્વ કરતાં બીજી કોઈ વસ્તુ અસ્તિત્વ ધરાવે છે. બીજા બધા

દેશો તો એ વસ્તુ ભૂલી ગયા છે: યુરોપ, અમેરિકા અને બીજે બધે... માટે જ તેની પાસે એક એવો આદેશ છે જે તેણે સાચવી રાખવાનો અને અન્ય સૌને પ્રબોધવાનો છે. પરંતુ અત્યારે તો એ કીચડમાં આમતેમ ભટક્યા કરે છે.

શ્રી અરવિંદે બતાવ્યું છે કે, પાર્થિવ જીવનમાંથી ભાગી જવામાં સત્ય નથી પણ એની વચ્ચમાં રહેવામાં છે. એનું રૂપાંતર કરવાનું છે, હિંદ્ય કરવાનું છે. જો એમ થાય તો જ પ્રભુ અહીં આ ભૌતિક જગતમાં પ્રગટ થઈ શકે.

તમારે આ વસ્તુ પહેલા જ વર્ગમાં કહેવી જોઈએ. તમારે તદ્દન સ્પષ્ટવક્તા અને ખરું કહી દેનારા થવું જોઈએ... આમ! (શ્રી માતાજી તેમના હાથ વડે ટેબલ ઉપર એક ચોરસની નિશાની કરે છે.)

પછી જ્યારે આ વસ્તુ ભારપૂર્વક અને સ્પષ્ટપણે કહી દો કે એમાં કશી શંકાને સ્થાન ન રહે, ત્યારે — અને ત્યારે જ — તમે પછી આગળ જઈને તેમને ધર્મોના ઈતિહાસ, ધર્મો અથવા ધાર્મિક નેતાઓના ઈતિહાસ કહી મજા કરાવી શકો છો.

ત્યારે — અને ફક્ત તો જ — તમે બતાવી આપી શકશો કે એમણે જે દુર્ભળતા અને અસત્યનું બીજ સંઘરી રાખેલું અને જાહેર કરેલું તે ત્યાં છે.

ત્યારે — અને તો જ — વખતોવખત, જુદાંજુદાં સ્થળોએ તમને એક એવી ‘અંતઃપ્રક્ષાં’નું ભાન થશે કે જેથી તમને જણાઈ આવશે કે બીજી કોઈ વસ્તુ શક્ય છે : ઉદાહરણ તરીકે વેદોમાં (પણીઓની અંધારી ગુફામાં ઊરે ઉત્તરવાનો આદેશ); તંત્રોમાં પણ... એક જ્યોતિ જલી રહી છે.

(૩૧ માર્ચ ૧૯૬૭)

\*

શ્રી અરવિંદ ભૂતકાળની કે ઐતિહાસિક વ્યક્તિત્વા નથી.

શ્રી અરવિંદ તો પોતાની સિદ્ધિને માર્ગ ગતિ કરતું ભવિષ્ય છે.

આ રીતે આપણે શાશ્વત યૌવનને ઝડપી આગેકૂચ માટે ઇત્ત આપવું કે જેથી રસ્તે જતાં આળસુ ને રખેલ ન થઈ જવાય.

(૨ એપ્રિલ ૧૯૬૭)

\*

“કોઈ પણ વિષયને ફરજિયાત\* ન બનાવવાની જે દરખાસ્ત છે તે બાબતમાં

\* “અભ્યાસનો વિષય વિદ્યાર્થીએ સ્વતંત્રપણે નક્કી કરવો. એમાં એની સાચી અને ગંભીર ગણાતી હોય એવી જરૂરિયાત પ્રતિબિંબિત થવી જોઈએ”. (દરખાસ્ત નં. ૧ આગળ પૃ. ૨૦૪ પર આપેલી છે.)

‘જી’નું કહેવું એમ છે કે માતાજીને પૂછી જોવું કે એમાં શ્રી અરવિંદનાં લખાણોનો પણ સમાવેશ થાય છે કે કેમ?’

છ.

“એણો એમ કહ્યું કે થોડાં વર્ષો ઉપર ઉચ્ચ કક્ષાનો કોર્સ દાખલ કરવામાં આવ્યો ત્યારે માતાજીનો મુખ્ય આશય એ હતો કે બધા જ વિદ્યાર્થીઓમાં શ્રી અરવિંદના ઉપદેશ વિષેનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અને એટલા જ માટે માતાજીએ સામાન્ય કોર્સ સૌને માટે ફરજિયાત કરેલો. આપણું શિક્ષણ કેન્દ્ર મૂળમાં તો શ્રી અરવિંદના ઉપદેશનું શિક્ષણ આપવા અને પચાવવા માટે છે, તો પછી એ વિષયને મરજિયાત કરી રીતે રાખી શકાય? ખરું જોતાં, આપણા કેન્દ્રના કોઈ વિદ્યાર્થીને શ્રી અરવિંદનાં લખાણોનો અભ્યાસ કરવામાં રસ ન હોય તો એ એક વિચિત્ર વસ્તુ કહેવાય. અને જે વિદ્યાર્થીને આવો રસ ન હોય તે આપણા કેન્દ્રનો વિદ્યાર્થી કરી રીતે હોઈ શકે.”

છા, જેઓ શાળામાં ભાણવા માગે છે તેમને માટે, પણ જેઓ એકલા અભ્યાસ કરવા માગે છે તેમને માટે નહિ.

(નવેમ્બર ૧૯૬૭)

\*

“એવું એક સૂચન છે કે શ્રી માતાજીના વાર્તાલાપો અને બુલોટિનમાંના અગત્યના લેખો કે જે મૂળમાં તો શિક્ષણ કેન્દ્રનાં બાળકો માટે છે, તેમને વર્ગમાં વાંચવા અને સમજાવવા. આ માટે એવું સૂચન છે કે એક મહિનામાં એક-બે પિરિયડ આને માટે જ નક્કી કરવા. આમાં કરી ભાષામાં વર્ગ લેવા એ વસ્તુ શ્રી માતાજીએ નક્કી કરવાની છે.”

જો તમે મારા લેખો કે વાર્તાલાપોનો ઉપયોગ કરવા માગતા હો તો ફેન્ચ ભાષા વાપરવી.

(૨૭ જુલાઈ ૧૯૫૮)

\*

શ્રી અરવિંદનાં લખાણ અગેજુમાં અને મારાં લખાણ ફેન્ચમાં વાંચવાં.

(૪ માર્ચ ૧૯૬૬)

\*

“આપે કહેલું કે શ્રી અરવિંદને સમજતાં એક કે બે વર્ષ લાગશે. તો પછી શિક્ષકોએ અમને વર્ગમાં શ્રી અરવિંદનાં પુસ્તકોમાંથી શીખવ્યું હોય તેના ઉપરથી પ્રશ્નો પૂછે તે બારાબર કહેવાય?”

મેં એમ કહેલું કે યોગ્ય રીતે સમજતાં વર્ષો જશે. પરંતુ જો તમે બુદ્ધિશાળી હશો તો કોઈક વસ્તુ તો તરતજ સમજી જશો; અને શિક્ષક તમારી બુદ્ધિની કસોટી કરવા માગે છે.

(૭ અપોક્ટોબર ૧૯૬૭)

\*

“મારું કામ એ પ્રકારનું છે કે મારે સતતપણે વાંચવું, લખવું અને વિચારવું પડે છે – પરિણામે હું મોટાભાગો મારા મનમાં જ જીવું છું. આ પ્રકારની સતત મનોમય પ્રવૃત્તિને કારણો મારા ચૈત્ય કેન્દ્રના ખૂલ્લા થવામાં બાધા આવે છે. એને લઈને મારું જીવન પણ શુષ્ક અને બોજાવાળું બની ગયું છે. આપે બુલેટિનમાં કહ્યું છે કે આ પ્રકારની સતત મનોમય પ્રવૃત્તિ જે નવીન ચેતના અત્યારે આવિર્ભાવ પામી રહી છે તેને ગ્રહણ કરવા માટે સારી નથી. પરંતુ મારે જે કાર્ય કરવાનું છે તેમાં એની જ જરૂર પડતી હોય તો મારે શું કરવું?”

તમે ભૂલી ગયા લાગો છો કે શ્રી અરવિંદે આખું ‘આર્થ’\* વખો સુધી સંપૂર્ણ મનોમય નીરવતામાંથી અને ઊર્ધ્વમાંથી આવતી પ્રેરણા તેમના હૃથમાં થઈને સીધે-સીધી ટાઈપરાઈટર ઉપર જાય એવી અવસ્થામાંથી લખ્યે રાખેલું.

(૭ માર્ચ ૧૯૬૬)

\*

‘આર્થ’નો અભ્યાસ કરવો એ સાચે જ એક સારો ઘ્યાલ છે. તમે તમારી જાતે જે કંઈ થોડું સરખું પણ સમજો તે બીજાઓ તમને સમજાણનો આખો દરિયો ભરી આપે

\* એક માસિક પત્ર જેમાં શ્રી અરવિંદનાં મુખ્ય ગઘ લખાણો. સન ૧૯૭૪-૧૯૭૧ માં સૌ પ્રથમ પ્રસિદ્ધ થયેલાં.

તેના કરતાં વધુ સારું છે.

\*

તમે શરીરશાખ શીખવતાં જતાં પણ લાભ પામી શકો છો. સાથે સાથે તમે શ્રી અરવિંદનો તમારો અભ્યાસ પણ ચાલુ રાખજો.

તમે જે કાંઈ કરતા હો તે બરાબર અને અત્યંત ગંભીરપણે કરતા રહો તે ઉત્તમ ગણાય. પછી તમે તમારી ગ્રવૃત્તિઓને વિકસાવી શકો છો.

એક સારા શિક્ષક બનવું એ કોઈ સહેલું કામ નથી, પરંતુ એમાં મજા પડે છે અને પોતાની જાતનો વિકાસ પ્રાપ્ત કરવાની તક સાંપ્રે છે.

શ્રી અરવિંદનાં લખાણો વાંચવાની બાબતમાં તો એમ કહેવું પડે કે તેમની દ્વારા આપણે માટે ભાવિનાં દ્વાર ખૂલ્લાં કરવાઈ રહ્યાં છે.

(૧૬ નવેમ્બર ૧૯૭૨)

\*

“અમે જે કાંઈ વાંચીએ છીએ, શીખીએ છીએ કે જેનો પણ, અભ્યાસ કરીએ છીએ એ બધું શ્રી અરવિંદનાં લખાણો વાંચતાં ખોટું લાગે છે. તો પછી એમની પાછળ સમયનો વ્યય કરવાથી શો લાભ?”

હું ધારું છું કે એ માનસિક વ્યાયામ છે!

\*

“મારાં પિય માતાજી, મારે તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ક્રનો વ્યવસ્થિત અભ્યાસ કરવો છે. હું ‘લાઈફ ડિવાઈન’ વાંચવાનો વિચાર કરું છું.”

જો તમે તત્ત્વજ્ઞાન અને ધર્મશાસ્ક્રો વાંચવા માગતા હો તો ભલે એમ કરો. પરંતુ એ વસ્તુ કેવળ તમારા ભગજને માટે માનસિક વ્યાયામ કરવાનો હોય એ ભાવે કરો, કદી પણ ભૂલશો નહિ કે જ્ઞાનનો સ્રોત ત્યાં નથી અને સાચું જ્ઞાન પામવા માટે એ પદ્ધતિ નકામી છે. સ્વાભાવિક રીતે, આ વસ્તુ “લાઈફ ડિવાઈન” પુસ્તકને લાગુ પડતી નથી.

\*

મને એમ લાગે છે કે બાંધકામ વિભાગના કામ ઉપરાંત તમને કંઈ ભાણવાની

ઇચ્છા થતી હોય તો એ ઇચ્છવાયોઽય છે કે, કશી પણ ઉતાવળ કર્યા વિના, શ્રી અરવિંદનાં લખાણો તમે ગંભીરપણે અને કાળજીપૂર્વક વાંચો. તમારી સાધના માટે, બીજુ કોઈ પણ વસ્તુ કરતાં એનાથી વધુ મદદ મળી રહેશે.

(૮ માર્ચ ૧૯૪૧)

\*

“શ્રી અરવિંદના કયા પુસ્તકથી મારે શરૂઆત કરવી?”

‘લાઈફ ડિવાઈન’થી.

આશિષ.

(૧૧ માર્ચ ૧૯૪૧)

\*

(એક અભ્યાસ વર્તુળ માટે શ્રી માતાજીએ નીચે મુજબનો કાર્યક્રમ લખ્યો આપેલો.)

૧. પ્રાર્થના (શ્રી અરવિંદ, માતાજી — આપનું શિક્ષણ સમજવાના અમારા પ્રયત્નમાં સહાયરૂપ થાઓ.)

૨. શ્રી અરવિંદના પુસ્તકમાંથી વાચન.

૩. એક કાળ માટે નીરવતા.

૪. જે કાંઈ વાંચવામાં આવ્યું હોય તેની ઉપર જે કોઈને પ્રશ્ન પૂછવો હોય તે એક પ્રશ્ન પૂછો.

૫. પ્રશ્નનો ઉત્તર.

૬. કોઈ સર્વસામાન્ય ચર્ચા નહિ.

આ કોઈ વર્તુળની સભા નથી પરંતુ શ્રી અરવિંદનાં પુસ્તકોનો અભ્યાસ કરવાનો વર્ગ છે.

(૩૧ ઓક્ટોબર ૧૯૪૨)

\*

## ભાષાઓ

પૂર્વ અને પશ્ચિમની એકતા માટે, બનેમાં જે ઉત્તમ અંશો છે તે એક-ભીજાને આપે અને એક સાચો સમન્વય સાથે એ માટે સર્વ પ્રકારના અભ્યાસો માટે એક યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. આપણી શાળા એ યુનિવર્સિટીનો બીજાંકુર બનશે.

આપણી શાળામાં શિક્ષણના માધ્યમ તરીકે મેં ફેન્ચ ભાષા રાખી છે. એમાં એક કારણ એ છે કે વિશ્વની સૌ ભાષાઓમાં ફેન્ચ એ સૌથી વધુ સંસ્કારી ભાષા છે. બાળકો પાછળથી ભારતીય ભાષાઓ શીખી શકશે. જો અત્યારને તબક્કે ભારતીય ભાષાઓ ઉપર વધુ ભાર મૂકવામાં આવશે તો એવું બનશે કે ભારતીય મગજનું સ્વાભાવિક વલણ, પુરાતન કાળના સાહિત્ય, સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે વળશે. તમે બહુ સારી રીતે જાણો છો કે પુરાતન કાળના ભારતની વસ્તુઓ વિષેનું મૂલ્ય આપણે સ્વીકારીએ છીએ, પરંતુ આપણે અહીં કોઈ નવીન વસ્તુનું સર્જન કરવું છે, પૃથ્વી માટે કોઈ તદ્દન તાજી વસ્તુ ઉત્તારી લાવવા માણીએ છીએ. આ રીતનો પ્રયત્ન કરવામાં, જો તમારું મન, પુરાતન વસ્તુઓ સાથે બંધાઈ રહેશે તો એ આગળ વધવાનો ઈનકાર કરશે. ભૂતકાળના અભ્યાસને તેનું પોતાનું સ્થાન છે જ. પરંતુ એનાથી જે ભવિષ્યને લગતું કાર્ય છે તેમાં બાધા આવવી જોઈએ નહિ.

\*

“ફેન્ચને એક એવી વિશિષ્ટ ભાષા ગણીએ કે જેનાથી બાળકને સૌમ્યમ આપની સાથે સંપર્કમાં મૂકવામાં આવે અને પછી સૌંદર્યનાં અમુક આંદોલનનો સંપર્ક કરાવવામાં આવે?”

એવું જ કાંઈક.

હું ફક્ત એટલું જ કહી શકું કે આપણી અહીંની શાળા ભારતમાં ફેન્ચ શીખવનારી ઉત્તમ શાળાઓ પૈકી એક છે — કદાચ સૌથી ઉત્તમ છે — અને એ પ્રકારની સ્વીકૃતિને લાયક બનવું એ મને લાગે છે કે સારી વસ્તુ છે.

બાળકો સાથેના અહીંના મારા સંબંધોમાં હું હુંમેશાં તેમની સાથે ફેન્ચમાં જ વાતચીત કરું છું.

\*

## “વિજ્ઞાન શા માટે ફેન્ચમાં ભાષાવવું જોઈએ?”

અનાં ઘણાં કારણો છે અને જે ગહન કારણો છે તે તમને કહેવામાં આવે તેના કરતાં તમારે તમારા હદ્યમાંથી જાણી લેવા જોઈએ.

બાધ્ય કારણોમાં હું કહી શકું કે ફેન્ચ એક ચોક્કસ ભાષા છે અને તેથી એ વિજ્ઞાનના શિક્ષણ માટે વધુ સારી છે જેમ અંગેજ ભાષા કાવ્યને માટે ચઠિયાતી છે એમ.

આમાં કેટલાંક વ્યવહાર કારણો પણ છે. એમાં એક હકીકત તો એ છે કે જે સર્વને મોટાં થયે પોતાને માટે કમાવું પડશે તેમાંથી જેમને ફેન્ચ બરાબર આવડતું હશે એ લોકોને સહેલાઈથી નોકરી મળી રહેશે.

આશીર્વાદ.

(૯ ફેબ્રુઆરી ૧૯૬૬)

\*

ફેન્ચ એ સાચે જ એક અત્યંત ચોક્કસ અને સ્પષ્ટ ભાષા છે. પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિબિંદુથી જોતાં એ વસ્તુ સાચી નથી કે ફેન્ચ ભાષાનો જઉપયોગ કરવો એ ઉત્તમ વસ્તુ ગણાય. કારણ કે અંગેજ ભાષામાં જે નમનીયતા છે, જે પ્રવાહિતા છે એ ફેન્ચમાં નથી. અને જે વસ્તુ મનોમય અભિવ્યક્તિ દ્વારા રજૂ કરવામાં આવે તેના કરતાં અનુભવની દૃષ્ટિએ વધુ વિસ્તૃત અને સર્વગ્રાહી છે તેને માટે આ પ્રકારની નમનીયતા અનિવાર્ય છે.

(જાન્યુઆરી ૧૯૫૦)

\*

## ભાષાંતરો અંગે

Bonte (બોંટે) — માયાળુપણું અને શુભચેષ્ટા; Bienvéillance (બીંબેલાંસ) એકલે દરેક વસ્તુની સારી બાજુ જોવી. એમાં કેવળ એવો આશાવાદ નથી જે બૂરી વસ્તુઓ પ્રત્યે આંખ આડી કરે છે. એ એક એવી ચૈતસિક્ષદૃષ્ટિ છે, જે સર્વ સ્થળે પ્રભુના સ્વરૂપને નિહાળે છે.

એવા ઘણા શબ્દો છે જેનું ભાષાંતર થઈ શકે તેમ નથી. શ્રી અરવિંદની દ્વારા સભારી અને માર્મિક વાણીનું ફેન્ચમાં ભાષાંતર ન થઈ શકે. અંગેજ ભાષાની

મર્મવાણીનું જ્યારે ફેન્ચમાં ભાષાંતર કરવામાં આવે છે ત્યારે એ મોણું અને મૂર્ખાઈભર્યું લાગે છે. ફેન્ચ ભાષાની હાયરસની વાણીનું જ્યારે અંગેજમાં ભાષાંતર કરવામાં આવે છે ત્યારે એ કૂર અને અર્થહીન લાગે છે. આ બંને ભાષાઓ આમ તો એકસરખી લાગે છે, છતાં તેમની પાછળ રહેલી મેધા શક્તિ અલગ પ્રકારની છે.

(૪ જુલાઈ ૧૯૫૬)

\*

હું તમને એ ચોપડી (ફેન્ચમાં ‘પ્રાર્થનાઓ અને ધ્યાન’) આવતી કાલે મોકલીશ. પરંતુ તમે જે વાંચતા હો તેને યોઝ રીતે સમજવું હોય તો તમારે વ્યાકરણ ભરાબર શીખવવું પડશે.

(૨૦ જૂન ૧૯૩૨)

\*

“હું સારી ફેન્ચ સ્ટાઇલ કયાંથી શીખી શકું?”

એ વસ્તુ, ઉચ્ચ કક્ષાના વ્યાકરણના વર્ગોમાં શીખવવામાં આવે છે. તદ્દ્પરાંત એને માટે ખાસ પુસ્તકો પણ છે. સ્ટાઇલ બાબતમાં મુખ્ય નિયમ એ છે કે ગાંધી ફકરામાં, જ્યાં સુધી તદ્દન અનિવાર્ય ન હોય ત્યાં સુધી “હું” શબ્દનો ઉપયોગ ન કરવો. અને જ્યારે બે પૂરક વાક્યોની શરૂઆત કરવાની હોય ત્યારે ગમે તેમ હોય તો પણ વાક્યની શરૂઆત “હું”થી ન કરવી. આ ઉપરથી તમને ઘ્યાલ આવશો કે તમારે તમારો રોજનો રિપોર્ટ આપતી વેળાએ કેવી સ્ટાઇલ વાપરવી.

(૨૦ જુલાઈ ૧૯૩૩)

\*

ફેન્ચ ભાષા સરળ અને સ્પષ્ટ રીતે લખવી જોઈએ.

(૨૮ સપ્ટેમ્બર ૧૯૩૩)

\*

ફેન્ચ ભાષાને જ્યારે સરળ અને સ્પષ્ટ રૂપમાં લખવામાં આવે છે ત્યારે ખીલી ઊઠે છે. જ્યારે એમાં ગુંચવાડાભરી છાયાઓ એકઢી કરવામાં આવે છે ત્યારે એની સ્ટાઇલ કૃત્રિમ બની જાય છે.

\*

મારા મધુર સ્મિત,

તારું કહેવું તદન સાચું છે. મને સમજાતું નથી કે રસભરી વસ્તુ વાંચવાને બદલે શા માટે તારે કંટાળાજનક વસ્તુઓ કરવા માંગવી જોઈએ.

ભાષા શીખવા માટે તો તમારે વાંચવું, વાંચ્યે જવું, બસ વાંચ-વાંચ જ કરવું — અને બને તેટલું બોલવું.

સપ્રેમ.

(૧૦ જુલાઈ ૧૯૩૫)

\*

“મારે ફેન્ચનો અભ્યાસ, ખાસ કરીને વાતચીત થઈ શકે તે માટે ફરી શરૂ કરવો છે. મને કાંઈક સૂચનાઓ મળી શકશે?”

સારામાં સારી વાત તો એ છે કે તક મળે કે તરત... હિંમતપૂર્વક બોલવું.

\*

“માતાજી, મને કોઈ એવા સારા લેખકોનાં નામ આપશો જેમનાં પુસ્તકો હું વાંચી શકું?”

જો તમારે ફેન્ચ ભાષા શીખવી છે તો તમારે ફેન્ચ સાહિત્યનું કોઈ પુસ્તક લઈને અભ્યાસ કરવો અને પાઠ્યપુસ્તકમાં જાણાવેલ દરેક લેખકનાં એક કે બે પુસ્તકો વાંચવાં. શરૂઆત, અગાઉના લેખકોથી કરવી.

(૨૨ સપ્ટેમ્બર ૧૯૩૬)

\*

“જો આપને ઢીક લાગે તો મને ગમતું હોય એવું એક પુસ્તક લઈ અને બીજું એક સૌથી જૂના લેખકોમાંથી, આપની સલાહ હોય તો લઈ.”

મેં એમ નહિ કહેલું કે તમારે કેવળ જૂના લેખકોનાં લખાણો જ વાંચવાં; મેં એમ કહેલું કે સાહિત્યમાં જેમનો ઉલ્લેખ થયો હોય એવા દરેક લેખકનાં એક-બે પુસ્તકો વાંચવા અને શરૂઆત અગાઉના જૂના લેખકોથી કરવી.

(૨૪ સપ્ટેમ્બર ૧૯૩૬)

\*

“માતાજી, મેં ફેન્ચ પુસ્તકો વાંચવાની શરૂઆત કરી છે — ‘સ’ એ મને એક લિસ્ટ આપ્યું છે.”

તમે ફેન્ચમાં ઘણું વાંચો છો એ સારી વાત છે. એનાથી તમને લખતાં સારું આવડશે.  
(૭ ઓપ્રિલ ૧૯૬૬)

\*

“આજે મેં ‘ઈ-પ’ વર્ગ લીધેલો અને તેમાં એમે શ્રી “માતાજીની વાણી”નું વાચન અને સ્પષ્ટીકરણ ચાલુ રાખેલું. જો કે હું “વાણી”માં રહેલા ભાષાના સૌનંદર્ય પ્રત્યે સતતપણે ધ્યાન દોરું છું છતાં હું એ વસ્તુ પ્રત્યે પણ સભાન છું કે હું અંગેજુ શીખવવા કરતાં એમાં રહેલાં સ્પષ્ટીકરણ ઉપર વધુ ભાર મૂકું છું.”

એ બરાબર છે. કારણ કે એથી એમને અંગેજુમાં વિચાર કરવાની ટેવ પડશે અને કોઈ પણ ભાષા શીખવી હોય તો એ જ સાચી રીત છે.

(૨ મે ૧૯૬૬)

\*

“‘ક્ષ’ એ એના બે પુત્રોના શિક્ષણ સંબંધે ઊભી થયેલી મુશ્કેલી સંબંધે આપનું માર્ગદર્શન માર્યું છે. એણે એક પુત્રને મુંબઈમાં ઈટાલિયન મિશનની સ્કૂલમાં મૂકેલો છે — ત્યાં અંગેજુ માધ્યમ છે અને એની ઈચ્છા બીજા પુત્રને પણ ત્યાં જ મૂકવાની છે. પરંતુ દાલ ભાષાની બાબતમાં ભારતમાં જે વિવાદ ઊભો થયો છે એને લઈને એ મુંગાયો છે કારણ કે એને માટે એ વસ્તુનો નિર્ણય કરવો મુશ્કેલ છે કે ઓણે એનાં બાળકોને અંગેજુ માધ્યમ દ્વારા કેળવણી આપવી કે પછી માતૃભાષાના માધ્યમ દ્વારા — એમ હોય તો મરાઠી ભાષાની શાળામાં એમને બદલવા પડે. એ આપની આ બાબતમાં સલાહ મારો છે.”

માતૃભાષા સારી છે પણ જેને આગળ અભ્યાસ કરવો હોય તેને માટે અંગેજ અનિવાર્ય છે.

આશીર્વાદ.

૩ નવેમ્બર ૧૯૬૭)

\*

“અત્યારે આપણા ઉચ્ચ ઘોરણના વર્ગના વિદ્યાર્થીઓ કોઈ પણ એક ભાષાને એટલી સારી રીતે નથી જાણતા કે જેની દ્વારા તેઓ તેમના વિચારો અને લાગણીઓને પૂર્ણપણે અને ભાવનાપૂર્વક રજૂ કરી શકે. માતાજી, આની જરૂર ખરીકે નહિ? અને એટલે એમણે કઈ ભાષા શીખવી? એ કોઈ સામાન્ય અથવા આંતરરાષ્ટ્રીય\* ભાષા હોવી જોઈએકે તેમની માતૃભાષા?”

કેવળ એક જ ભાષા જાણો એ વધુ સારુ.

\*

“ઉપરોગિતાની દૃષ્ટિએ આપણા કેટલાક વિદ્યાર્થીઓને સાહિત્યિક હિંદી ભાષા શીખવી નથી.”

બંને શીખવો, સાચી ભાષા અને જે સ્વરૂપ બન્યું છે તે — એ ઠીક ઠીક રસપ્રદ બનશે — અને સૌથી સારું તો એ થશે કે ખરાબ રીતનું હિંદી બોલવાની એમની ટેવ જશે.

વિદ્યાર્થીઓનો આણગમો હોવા છતાં હું હિંદી શીખવવાનું ચાલુ રાખું એવી આપની અપેક્ષા છે?

કશા ખચકાટ વિના ચાલુ રાખો...

અમૃતા કહે છે કે એના તામિલના વર્ગની દશા હિંદીના વર્ગ કરતાં બૂરી છે. એ કહે છે કે વિદ્યાર્થીઓ નહિ આવે તો પણ એ ભણાવવાનું ચાલુ રાખશે — એ પોતાને ભણાવશો!

(૩૦ સપ્ટેમ્બર ૧૯૬૮)

\*

\* શ્રી માતાજીએ આ શબ્દો હેઠળ લીટી કરી તેમના ઉત્તરમાંથી એક તીર ચીતરીને તેમની પસંદગીનો નિર્દેશ કરેલો.

## શ્રી માતાજીના જુદી જુદી ભાષામાં હસ્તાક્ષર

આ પછીનાં આડ પૃષ્ઠમાં, નીચે મુજબની ભાષામાં શ્રી માતાજીના હસ્તાક્ષરો  
છે :

સંસ્કૃત (ઈશોપનિષદ્ધ, ફેન્ય ભાષાંતર સાથે).

હિન્દુ.

કિનીશિયન.

ચાઈનિઝ.

જાપાનિઝ

બંગાળી.

ઇશાવાસ્યોપનિષત्.

હરિ: ॐ ।

ઇશા વાસમિદઃ સર્વ યત્કિંચ જગત્યાં જગત् ।

au Seigneur pour qui il habite, tout lui et chaque chose universellement dans  
c'universel mouvement

તેન તત્કેન ભુલીથા મા ગૃધ: કસ્પ સ્વિદ્ધનમ् ॥ १ ॥

en tout cela d'ailleurs l'on et fourni . En <sup>reconnait pas</sup> aucun bien que n'approfondit les hommes ne connaît .

કુર્વન્નેવેહ કર્માણિ જિજીવિચ્છતઃ સમા: ।

Faisant verser ici les œuvres ici on doit donner voire certains

एવं ત्वयि નાન्यથેતોऽस્તि ન કર્મ લિપ્યતે ન રે ॥ २ ॥

Ainsi pour lui et non autrement en est-il. L'action n'en gèle pas l'homme.

असुर्या नाम ते लोका अन्धेन तमसाऽवृताः ।

sans soleil s'appellent ces mondes enveloppés de ténèbres aveugles

ताऽ स्ते प्रेत्याभिगच्छन्ति ये के चाऽत्महनीजाः ।

où j'ici parties vont compagnement leur être gens

अनेजदेकं मनसो जबीयो नैनद्वे वा आनुदन्पूर्वमर्षत् ।

Unique sans mouvement plus prompt les deux mêmes ne peuvent l'atteindre tous les deux  
qui depuis lequel

तद्रावतोऽन्यान्यत्येति तिष्ठत्स्मिन्नपो मातरिश्चा दधाति ॥ ३ ॥

ela dans la stabilité des deux les  
autres qui émanent

॥ तदेजति तत्त्वेजति तद्वरे तद्वन्निके ।

ela en mouvement élaction  
mouvement elle est  
loin et elle aussi est proche

तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥५॥  
 cela au dedans de ce tout échappe mais hors de tout est

यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति ।  
 mais alors qui partout les devenirs dans l'Être perçoit

सर्वभूतेषु चाऽत्मानं ततो विजुगुप्तते ॥६॥  
 tous les devenirs dans l'être celui-là ne le voit plus.

यस्मिन्सर्वाणि भूतान्यात्मेवाभूद्विजानतः ।  
 pour qui connaît toutes les choses obéissantes l'Être même est devenu pour qui l'est

तत्र को मोहः कः शोक एकत्वमनुपश्यतः ॥७॥  
 qui où douleur ou qui l'âme qui prend

स पर्यगच्छक्रमकायमवृणमन्नाविरः शुद्धपापविद्धम् ।  
 here s'est effacé, lumineux, au corps, sans défaut, sans organes, pur, inégalable au vrai.

कर्विमनीषी परिभूः स्वयंभूर्याथातथ्यतोऽथन्यदधा -  
 il voit le Pensant séparément, qui existe en soi, a ordonné les choses selon

-च्छाश्वतौभ्यः समाभ्यः ॥८॥  
 leur être depuis les ages  
 in finis

अन्धं तमः प्रविशन्ति येऽविद्यामुपासते ।  
 ou d'avoir des ténèbres autant temps que l'ignorance de vivant

ततो भूय इव ते तमो य उ विद्यायाः रताः ॥९॥  
 et comme en plus de l'âge, c'est à la connaissance, voulus.

अन्यदेवादुर्विद्ययाऽन्यदादुरविद्यया ।  
 Bien autre chose a-t-il dit pour la connaissance, bien autre chose a-t-il dit pour l'ignorance

इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥ १० ॥

Ainsi avons-nous appris des âges qui nous ont cela révélé.

विद्यां चाविद्यां च यस्तद्वेदोभयः सह ।

Connaissance et ignorance celiq;ue celle connaît comme les deux à la fois

अविद्यया मृत्युं तीर्त्वा विद्ययस्मृतमशुते ॥ ११ ॥

Par l'ignorance la mort ayant peuni par la connaissance de l'immortalité pourit.

अनधं तमः प्रविशन्ति येऽसंभूतिमुपासते ।

Les autres ténèbres entrent ceux qui au bout devient le vraiement

ततो भूय इव ते तमो य उ संभूत्यः रताः ॥ १२ ॥

Et comme en plus de l'ombre ceux qui au bout sont adorés.

अन्यदेवाऽऽहुः संभवादन्यदाहुरसंभवात् ।

Bien autre chose a-t-il dit par la devenir la meilleure chose a-t-il dit par l'autre devenir.

इति शुश्रुम धीराणां ये नस्तद्विचचक्षिरे ॥ १३ ॥

Ainsi avons-nous appris des âges qui nous ont cela révélé.

संभूतिं च विनाशं च यस्तद्वेदोभयः सह ।

Devenir et dissolution celiq;ue celle connaît comme les deux à la fois

विनाशेन मृत्युं तीर्त्वा संभूत्याऽस्मृतमशुते ॥ १४ ॥

par la dissolution la mort ayant peuni par le devenir de l'immortalité pourit

हिरण्येन पात्रेण सत्यस्यापिर्व्वर्तं मुसम् ।

de la Vérité

तत्रं पूषनपावृणु सत्यधर्माय दृष्टये ॥ १५ ॥

la loi été le Evoluteur pour la loi de la Vérité pour la Vérité

**पूरुषकर्त्ते यम सूर्य प्राजापत्य व्यद् रथीक्षमूर्ह ।**

Evolutus unigenitus Nishi Recteur Illuminatur Fite de l'arc des étoiles disposer ranenble

**तेजो यते रूपं कल्याणतम तते पश्यामि योऽ**

reductio de toniforme l'éclat belle la question de personnes qui

**सावसौ पुरुषः सोऽहमस्मि ॥१६॥**

advertisant a Purusha ~~qui~~ je suis

**वायुरनिलम मृतमथेदं भग्नान शरीरम् ।**

Souffle haleine immortelle voici

**ॐ क्रतो म्यर कृतः स्मर क्रतो म्यर कृतः स्मर॥१७॥**

Om laurie de faire souvent les décauville fait souvent la laurie immortelle lorsque la laurie est faite

**अग्ने नय सुपथा राये अस्मान्विक्षानि देव वयुनानि**

Agne par la laurie de la flèche voulent - nous à Dieu tout le temps

**विद्वान् ।**

qui connaît

**युथोध्यमज्जुहुराणमेनो भूयिष्ठं ते नमग्रिं विधेम् ॥१८॥**

élément

à la réflexion nature nous offrons

pour la connaissance

**इत्युपनिषद् ॥ इति वाजसनेयसंहितोपनिषत्संपूर्ण ॥**

**ॐ पूर्णमदः० रिष्टते ॥**

**ॐ शान्ताः शान्तिः शान्तिः ॥.**

—

א aleph	a	1
ב beth	b	2
ג ghimel	g gh:	3
ד daleth	d	4
ה hé	e hé	5
ו waw	o oo u	6
ז zain	z	7
ח heth	h hé ch	8
ט teth	t	9
יך iyye	i	10
כ caph	kh	20
ל lamed	l	30
מ mem	m	40
נ nun	n	50
ס samek	s	60
ע haïn	ho wh	70
פ phè	phif	80
צ zad	z	90
ק kaph	k	100
ר resh	r	200
ש shin	sh	300
ת thao	th	400

Hébreu -

# n m l y z ⊕ ॥ ॥ T Y ॥ ॥ ॥  
 x s n m e k i Th ॥ ॥ + W ॥ ॥ ॥  
 T S K ॥ ॥ ॥

### Mein cire

ફ	flame
એ	car
ચ	chariot
સ	chivots
ફ	fear
બ	bouche
પ	peche
ફ	peche

池	イケ	圖	ズ	花	ハナ	力	チカラ	喜	ヨロコ	寒	サム
供	トモ	多	オウ	原	ハラ	猿	サル	歌	ウタ	暖	アタマ
村	ムラ	皆	ミナ	貞	テイ	雉	キジ	雲	クモ	笑	ワラ
丸	マル	魚	ウオ	壽	ジユ	夕	ソト	天	テン	答	コタエ
紙	カミ	鯉	コイ	金	カネ	内	ウチ	話	ハシ	知	シ
神	カミ	頭	タマ	物	モノ	忍	オソ	書	カ	高	タカ
岡	オカ	正	タダ	町	マチ	第	ダイ	讀	ヨ	風	カゼ
河	カワ	蟲	ムシ	習	ナラ	居	イ	桃	モモ	吹	フ
銀	ギン	食	タバ	次	ツギ	松	マツ	流	ナガ	强	ツヨ
青	アオ	形	カタ	音	オン	林	ヤシ	男	オトコ	系	イト

**ପାଞ୍ଚାହିଟଙ୍କି ଶ୍ଵେତଶ୍ଵର**  
**ଶ୍ଵେତଶ୍ଵର ଏଣ୍ଡାଇ**  
**ଓଟାନୁ**

<b>ମାନୁଷ</b>	(manush)	man
<b>ଘୋଡ଼ା</b>	(ghora)	horse
<b>ବଲାଦ</b>	(balad)	ox
<b>ଗାଧା</b>	(gadha)	ass
<b>ହାମଳ</b>	(chhagal)	goat
<b>ତେଡ଼ା</b>	(thera)	sheep
<b>କୁକୁର</b>	(kukur)	dog
<b>ବେରାଳ</b>	(beral)	cat
<b>ହରିଣ</b>	(harin)	deer
<b>ଇନ୍ଦୂର</b>	(indur)	rat
<b>ବେଶ</b>	(lung)	frog
<b>ପିଂପଜା</b>	(pingpoja)	ant
<b>ହାରପୋକା</b>	(charupoka)	bug
<b>ଡକ୍କୁନ</b>	(dakun)	louse
<b>ଶୁକର</b>	(shukar)	swine
<b>କାକ</b>	(kako)	crow
<b>ପେଂଚା</b>	(pencha)	owl
<b>ମୋରଗ</b>	(moriga)	cock
<b>ପାଥୀ</b>	(pathi)	bird
<b>ପତ୍ର</b>	(patra)	least
<b>ଶାପ</b>	(shap)	snake
<b>ଗୋକା</b>	(rokā)	worm
<b>ମାଛି</b>	(machhi)	fly

જે લોકો, હિંદીભાષી પ્રાંતના છે તેએ માટે જ હિંદી સારી છે. બધા જ ભારતીયો માટે સંસ્કૃત સારી છે.

મને ભારતીય ભાષાઓ પ્રત્યે ઊંડો આદર છે અને જ્યારે સમય મળે ત્યારે સંસ્કૃત શીખવાનું ચાલુ રાખું છું.

\*

સંસ્કૃત જ ભારતની રાષ્ટ્રીય ભાષા બનવી જોઈએ.  
આશીર્વાદ.

(૧૮ એપ્રિલ ૧૯૭૧)

\*

“કેટલાક મુદ્દાઓ ઉપર આપે અને શ્રી અરવિંદ ચોડ્યા ઉત્તર આપેલા છે ત્યાં અમે (શ્રી અરવિંદ કર્મધારા) પણ નિશ્ચયાત્મક હોઈએ છીએ, ઉ.ત. ... ભાષાના મુદ્દા ઉપર આપે દેશને માટે કહેલું છે કે (૧) પ્રાંતીય ભાષા અભ્યાસનું માધ્યમ હોવી જોઈએ, (૨) સંસ્કૃત ભાષા રાષ્ટ્રભાષા હોવી જોઈએ, અને અંગ્રેજી ભાષા આંતરરાષ્ટ્રીય ભાષા હોવી જોઈએ.

અમે આ વિષયના પ્રશ્નોના આ પ્રમાણે ઉત્તર આપીએ તો બરાબર છે ?”

ઉ.ઠ.

આશીર્વાદ.

(૪ ઑક્ટોબર ૧૯૭૧)

\*

(ઓરોવિલમાં શીખવાની ભાષાઓ)\*

(૧) તામિલ

(૨) ફેન્ચ.

\* ઓરોવિલની એક શાળાના ઉદ્ઘાટન પ્રસંગે લખાયેલ. એ શાળા માટે શ્રી માતાજીનો સંદેશ હતો કે જ્ઞાન માટે અને પ્રગતિ માટે સાચો સંકલ્પ.

- (૩) ભારતમાં હિંદીનું સ્થાન લઈ શકે તેવું સરળ કરેલું સંસ્કૃત.  
 (૪) આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી.

(૧૫ ડિસેમ્બર ૧૯૭૦)

\*

## કલા

સ્થૂલ ભૂમિકા ઉપર પ્રભુ સૌન્દર્ય દ્વારા જ પોતાને પ્રગટ કરે છે.

\*

સ્થૂલ ભૂમિકા ઉપર, સૌ વસ્તુઓમાં સૌન્દર્ય જ પ્રભુને ઉત્તમ રીતે અભિવ્યક્ત કરી શકે છે. સ્થૂલ ભૂમિકા એ રૂપોની સૃષ્ટિ છે અને રૂપની સંપૂર્ણતા એટલે સૌન્દર્ય. જે શાશ્વત છે તેને રૂપાત્તરન્યાસથી સૌન્દર્ય પ્રગટ કરે છે. આવિર્ભૂત કરે છે. સૌન્દર્ય આ આવિર્ભૂત પ્રકૃતિને, રૂપની સંપૂર્ણતા દ્વારા સંવાદ અને કોઈ ઉચ્ચતમ આદર્શ પ્રત્યે દોરી જનારી લાગણી દ્વારા શાશ્વત સાથે સંપર્કમાં મૂકવાનો ભાગ ભજવે છે.

\*

સૌન્દર્યને તમારો શાશ્વત આદર્શ બનાવો.

આત્માનું સૌન્દર્ય.

લાગણીનું સૌન્દર્ય.

વિચારનું સૌન્દર્ય.

કર્મની ગતિનું સૌન્દર્ય.

કાર્યનું સૌન્દર્ય.

એમ કરીને તમે એવું કરો કે તમારા હાથમાંથી જે કાંઈ બહાર આવે તે શુદ્ધ અને સંવાદપૂર્ણ સૌન્દર્ય ન હોય.

અને પ્રભુની કૃપા હુંમેશાં તમારી સાથે રહેશો.

\*

પરમ કલા સૌન્દર્યને પ્રગટ કરીને તમને દિવ્ય સંવાદપૂર્ણતા સાથે સંપર્કમાં લાવે છે.

\*

જો સૌન્દર્યે દિવ્ય જીવનમાં કોઈ સર્જન કરવું હશે તો એક વિશાળ અને જાજવત્યમાન શાંતિએ પણ પોતાને પ્રગટ કરવી પડશે.

\*

આધ્યાત્મિક સૌન્દર્ય એક એવી શક્તિ છે.

\*

સૌન્દર્ય એ પ્રકૃતિનું આનંદપૂર્ણ સમર્પણ છે.

\*

સાચી કલા એટલે ભૌતિક જગતમાં સૌન્દર્યનો આવિજ્ઞાર, જે જગતનું સંપૂર્ણ પણ રૂપાંતર થઈ ગયું હોય, એટલે કે જે સંપૂર્ણ રીતે દિવ્ય સત્યને પ્રગટ કરતું હોય, તેમાં કલાએ તેના દિવ્ય સૌન્દર્યને જીવનમાં પ્રગટ કરનાર શિક્ષક તરીકે કાર્ય કરવાનું છે.

\*

કલામાં પણ આપણે ઉચ્ચ અવસ્થામાં રહેવું જોઈએ.

\*

ઉત્તમ રસવૃત્તિ એ કલાનું ઉમદાપણું છે.

\*

## ચિત્રકલા

સાચી ચિત્રકલા, સામાન્ય સત્ય કરતાં કોઈ વધુ સૌન્દર્યપૂર્ણ વસ્તુનું સર્જન કરે છે.

(૩ એપ્રિલ ૧૯૩૨)

\*

“હું કેટલીક વાર પણીઓ કે ગ્રાણીઓનાં ચિત્ર ચીતરું તે આપને ગમશે?”

જો તમને ઠીક લાગે તો, પરંતુ પ્રકૃતિમાંથી ચિત્ર કરવાં એ શીખવવા માટે ઉત્તમ છે.

(૨૩ ડિસેમ્બર ૧૯૩૨)

\*

“આપે મને ગઈ કાલે મોકલેલા ચિત્રની નકલ કરવા આજે મેં પ્રયત્ન કર્યો હતો.”

શીખવા માટે એ ચિત્રની મોટી નકલ કરવી એ વધુ સારું, કારણ કે એથી એની વિગતો પ્રગટ થઈ શકે.

(૫ જાન્યુઆરી ૧૯૩૩)

\*

“મેં આ ચિત્ર કોઈની પણ સહાય વિના બનાવ્યું છે, કેવું લાગે છે? આપને લાગે છે કે મને આવડશો?”

શીખવું એટલે કોઈ પણ ચિત્ર બનાવતાં પહેલાં ઘણા ઘણા મહિનાઓ સુધી અભ્યાસ જ કરવો. પ્રકૃતિના વિષયના આધારે ઘણા સમય સુધી નકલ કરી ચિત્રો બનાવવાં, ત્યાર પછી જ ચિત્રો બનાવી શકાય.

જો તમે નિયમિતપણે મહેનત કરીને અભ્યાસ કરવા માગતા હો તો તમે શરૂઆત કરી શકી છો, નહિ તો પછી એ બાબતમાં પ્રયત્ન ન કરવો સારો.

(૬ જાન્યુઆરી ૧૯૩૩)

\*

“હું જાણવા માગું છું કે ચિત્રો સામે જોવું નુકસાનકારક છે કેમ?”

કુદરતી રીતે, એ શેનાં ચિત્રો છે એના ઉપર આધાર રહે છે. મોટા ભાગે એ સામાન્ય જીવન ઉપરનાં ચિત્રો હોય છે અને એથી ચેતના એના પ્રત્યે ખેંચાય છે.

(૧૦ ડિસેમ્બર ૧૯૩૪)

\*

“કયુબિગુમ” અને અન્ય અત્યાધુનિક ચિત્રો

જો આ ચિત્રો પાછળ કોઈ સત્ય હોય, જો એમારે પોતાને થતી લાગણીઓ અને થતાં દર્શનોનું ચિત્રણ કર્યું હોય તો આવાં ચિત્રો કેવળ એક ગોટાળાભર્યા મગજ અને નિર્ઝકૃત પ્રાણનું સૂચન કરે છે. પરંતુ, હુંખની વાત છે કે, આના

ચિત્રકારો સત્યનિષ્ઠ નથી હોતા અને આ ચિત્રો બીજું કંઈ નહિ પણ એક અસત્ય, કૃત્રિમ કલ્પના પર હોય છે અને જેનો પાયો કંઈક વિચિત્ર સર્જવાનો અને લોકોને આકર્ષણી તેમને ગુંચવાડમાં નાખી દેવાના લક્ષ્યવાળો હોય છે. આને સૌન્દર્ય સાથે કશી લેવાદેવા નથી હોતી.

(૨૭ માર્ચ ૧૯૫૫)

\*

પુષ્પોનાં ચિત્રોમાંથી જે મોટું ચિત્ર છે તે સર્વોત્તમ છે કારણ કે એ વધુ સ્વયંભૂ અને સ્વતંત્ર છે. તમને જેનું સંવેદન થતું હોય તે વસ્તુ તમારે ચીતરવી અને એ કામ આનંદપૂર્વક કરવું.

ઘડી સૌન્દર્યવાન વસ્તુઓને ચીતરો, પરંતુ એમાં પણ વધુ ધ્યાન તો એની પાછળ રહેલા સંવેદન, વસ્તુઓમાં રહેલા ગહુન જીવનને પકડવા યત્ન કરજો.

(૧૨ ઓગસ્ટ ૧૯૬૨)

\*

“આપને મારી મુશ્કેલી સ્પષ્ટ થાય તે માટે હું આપને મારાં બે હમણાં જ ચીતરેલાં ચિત્ર મોકલું છું. એક મેં પૂરું કરેલું છે, પરંતુ મને એનાથી સંતોષ થયો નથી. બીજામાં કેન્દ્રથાન અપૂર્ણ છે; ત્યાં શું કરવું છે તે હું જાણું છું, પરંતુ મારાથી એ થઈ શકતું નથી. મારે એ પૂછવું છે હું પેરોસમાં અભ્યાસ કરીને વધુ મગતિ કરી શકીશ કે હું અહીં જ રહું તે વધુ સારું. આપ જે નિર્ણય કરશો તેનું હું આનંદપૂર્વક પાલન કરીશ.”

મારા પ્રિય બાળક,

મેં તારાં ચિત્રો જોયાં છે — એ લગભગ પૂર્ણ છે. પરંતુ એમાં ટેક્નિકની ખામી નથી — ચેતનાની છે. જો તું ચેતનાનો વિકાસ કરીશ તો પોતાને વ્યક્ત કરવાની રીત તને આવડી જશે. એ વસ્તુ તને કોઈ પણ, ખાસ કરીને જાણીતા શિક્ષકો પણ નહિ શીખવી શકે.

એટલે અહીંથી છોડીને બીજે ક્યાંક “કલાનિકેતનો”માં જવું એટલે પ્રકાશને છોડીને અંધકાર અને અચેતનાના ગર્તમાં ડગલાં માંડવાં.

તમે કોઈ ચુક્કિત-પ્રચુક્કિત કરીને કલાકાર નહિ બની શકો — એ તો એના જેવું થાય કે જેમાં તમે ધાર્મિક વિધિઓની નકલ કરીને પ્રભુને પ્રાપ્ત કરવા જાઓ.

સૌથી વધુ અને ઉંમેશને માટે અગાત્યની વસ્તુ સત્યનિષ્ઠ છે.

તમે તમારા આંતર સ્વરૂપનો વિકાસ કરો — આત્માની ખોજ કરો, અને એની સાથે જ તમને સાચી કલાત્મક અભિવ્યક્તિ મળી આવશે.  
મારા આશીર્વાદ સાથે.

(૨૫ મે ૧૯૬૩)

\*

તમારે વિગતો શા માટે ચીતરવી છે? એની બિલકુલ જરૂર નથી. ચિત્રકામ કંઈ કુદરતની નકલ કરીને થતું નથી, પરંતુ કુદરતનું સૌન્દર્ય જોતાં આપણી અંદર જે છાપ પડે છે, જે સંવેદનની અનુભૂતિ થાય છે તેને વ્યક્ત કરવા દ્વારા થાય છે. એ વસ્તુ જ રસદાયક છે અને એને જ વ્યક્ત કરવાની છે, અને તમારામાં આમ કરવાની શક્યતા છે માટે જ હું તમને ચિત્રકામ કરવામાં ઉતેજન આપું છું.

(૧૯૬૩)

\*

મેં તમારાં ચિત્રો જોયાં છે અને સાચે જ એમાં ગયા વર્ષ કરતાં વધુ પ્રગતિ દેખાય છે.

આધુનિક કલા એવો અખતરો છે, હજુ તો એ અસ્પષ્ટ અવસ્થામાં છે, એમને કેવળ સાદી ભૌતિક અનુભૂતિ કરતાં કોઈ ભીજી વસ્તુ વ્યક્ત કરવી હોય છે. આ એક સારો વિચાર છે — પરંતુ જે વસ્તુ વ્યક્ત કરવામાં આવે છે તેનું મૂલ્ય તેની પાછળથી શું વ્યક્ત કરવાનો દીરાદો છે તેની ઉપર રહે છે.

અત્યારે તો લગભગ બધા જ કલાકારો હુલકી કોટિના ગ્રાણામાં અને મનોમય ચેતનામાં રહેલા છે એટલે એમાં ચિત્ર પણ હુલકી કોટિનાં હેય છે.

તમે તમારી ચેતનાની બિલવણી કરો, તમારા આત્માની શોધ કરવા પ્રયત્ન કરો, અને ત્યારે જ તમે કંઈક સાચું રસપ્રદ સર્જન કરી શકશો.

આજથી ચાલુ થતા વર્ષ માટે હું તમને આ કાર્યક્રમ આપું છું.

(૧૨ ઓગસ્ટ ૧૯૬૩)

\*

મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે આ ચિત્રોમાં ગયા વર્ષ કરતાં કોઈ સુધારો દેખાતો નથી. એમાં અંતરની સચ્ચાઈનો અને સ્વાભાવિકતાનો અભાવ જણાય છે; એ વસ્તુ જે દેખાય છે તેમાં નથી, પરંતુ વિચારમાં છે — એક બાલિશ વિચાર. મેં જે

ગઈ સાલ કહેલું તે હજુ પામવાનું છે. ચેતનાનો જ્યોતિ અને સત્યમાં વિકાસ થવો જોઈએ અને આંખોએ કલામય રીતે જોતાં શીખવું જોઈએ.

(૧૨ ઓગસ્ટ ૧૯૬૪)

\*

હું આજ સુધી ચિત્રો જોઈ શકી ન હતી. જરૂર એની પાછળ પ્રયત્ન થયેલો વ્યક્ત થાય છે, અને જે ફેમમાં મહેલું છે તે આંખોને આનંદ ઉપજાવે છે. પરંતુ તમે જોવા કરતાં વિચારો છો વધુ. બીજા શાખોમાં, જે દૃષ્ટિ છે તે સાચી નથી, સ્વયંભૂ કે સીધી નથી. પરિણામે જે ચિત્રો બન્યાં છે તે હજુ પણ ચીલાચાલુ રીતના છે, એમાં કોઈ નૈસર્જિકતા દેખાતી નથી — બીજાની નકલ દેખાય છે.

આ સર્વની પાછળ, સર્વ વસ્તુઓની પાછળ એક દિવ્ય સૌદર્ય છે, એક દિવ્ય સંવાદિતા છે; આપણે સંપર્ક એનો સાધવાનો છે; આપણે એને અભિવ્યક્ત કરવાનું છે.

(૧૨ ઓગસ્ટ ૧૯૬૪)

\*

## સંગીત

આજે જે સૌઅં આજના ગાન અને સંગીતમાં ભાગ લીધેલો તે સૌને : શ્રી અરવિંદ અને મને લાગ્યું છે કે આ વખતે ઘણી પ્રગતિ થઈ છે. એ વસ્તુ કેવળ વ્યક્ત કરવાની બાધ્ય રીતમાં ન હતી, પરંતુ આંતરિક વલણ અને ભીતરમાં રહેલી એકાગ્રતાના લક્ષ્યમાં રહેલી હતી. આજનો દિવસ સૌને માટે આશીર્વાદરૂપ બની રહે.

(૨૪ એપ્રિલ ૧૯૭૨)

\*

મને ખબર નથી કે કોણ એવી અફવા ફેલાવી રહ્યું છે કે મને સંગીત ગમતું નથી. એ વાત જરા પણ સાચી નથી — મને સંગીત ખૂબ ગમે છે, પરંતુ એનું શ્રવણ એક નાના વર્તુળમાં થવું જોઈએ, બહુ બહુ તો પાંચ કે છ માણસો માટે જ. જ્યારે કોઈ ટોળું એકદું થાય છે ત્યારે ઘણું ખરું એ એક સામાજિક મેળાવડો બની રહે છે, અને જે વાતાવરણ પેઢા થાય છે તે સારું નથી હોતું.

\*

તમારી જાતને સંગીત અને લેખન કાર્યમાં મજન રાખો એ સારી વાત છે. કારાણ કે એમાં તમારી પ્રકૃતિને તમારી જન્મજાત પ્રવૃત્તિ મળી રહે છે. અને એ રીતે તમારી ગ્રાણી શક્તિ અને સમતુલ્ય સચ્ચવાઈ રહે છે.

સાધનાના વિષયમાં હું પૂછું છું કે સંગીત દ્વારા જ સાધના શા માટે ન કરવી? સ્પષ્ટ છે કે કેવળ ધ્યાન જ સાધના કરવાનો એકમાત્ર માર્ગ નથી. તમારા સંગીત દ્વારા ભક્તિ અને અભીષ્ટાનો વિકાસ થઈ શકે છે અને સાક્ષાત્કાર માટે પ્રકૃતિને તૈયાર કરી શકે છે.

જો ધ્યાન અને એકાગ્રતાની ક્ષણો એમની મેળે આવતી હોય તો બરાબર છે; પરંતુ અને માટે કોઈ બળજબરી કરવાની જરૂર નથી.

(૨૩ જાન્યુઆરી ૧૯૩૮)

\*

પૃથ્વી ઉપરની સર્વ વस્તુઓનો નિયમ સંગીતને પણ લાગુ પડે છે — જો તે પ્રભુ પ્રત્યે વળેલી ન હોય તો એ દિવ્ય ન બની શકે.

(૨૫ મે ૧૯૪૧)

\*

“હું જ્યારે એમ કહું છું કે જ્યારે શ્રી માતાજી ઓર્ગન વગાડે છે ત્યારે સંગીતના અમુક સૂરો શ્રી માતાજી જેમને પૃથ્વી ઉપર સ્થાપિત કરવા માગે છે તે ઉર્ધ્વ શક્તિના અવતરણ માટે જરૂરી આંદોલનો પેદા કરે છે તે સાચું છે?”

જ્યારે કોઈ વ્યક્તિ ઉચ્ચ ચેતનામાં વસતી હોય છે ત્યારે એ વ્યક્તિ જે કાંઈ કરે, કહે કે વિચારે તેમાં આ ઉર્ધ્વ શક્તિનાં આંદોલનો વ્યક્ત થાય છે. આ વસ્તુની હાજરીને કારણે આ પ્રકારનાં ઉચ્ચતર આંદોલનો પ્રગટ થાય છે.

આશીર્વાદ.

\*

“આપના સંગીતમાં જે સૂરની વારંવાર પુનરાવૃત્તિ થાય છે તેની પાછળ શું સેકેત છે?”

તમે નોંધ્યું હશે કે આ સૂર ત્યારે આવે છે કે જ્યારે તેની અગાઉ કોઈ મુશ્કેલી કે ગૂંચવાણ વ્યક્ત કરવામાં આવી હોય. એ સૂર, પેલા પ્રશ્નના ઉત્તર રૂપે આવે છે. એનો અર્થ ચેતનામાં આગેકદમ, પ્રગતિ, એક ડગલું આગળ ભરાયું એવો થાય છે. એ એક આવિષ્કાર રૂપે થાય છે. મારું સંગીત સાધનાની આંતરિક ગતિને અનુરૂપ હોય છે. કેટલીક વાર કોઈ મુશ્કેલી, ગૂંચવાણ, કોઈ પ્રશ્ન, કોઈ ખોટી રીતની ગતિ, જેના ઉપર વિજય પ્રાપ્ત થયેલો માનેલો તે વધુ જોરથી હલ્લો કરે છે. પછી એના પ્રત્યુત્તર અને સહાય તરીકે, પ્રગતિ રૂપે, ચેતનાના આવરણના ભંગ તરીકે — અને છેવટના જ્યોતિર્દર્શન રૂપે કાંઈક પ્રગટ થાય છે.

આ સંગીતને સમજવું ઘણું મુશ્કેલ છે — ખાસ કરીને પાશ્ચિમાત્ય મગજને માટે — પશ્ચિમના લોકોને એમાં કંઈ લાગતું નથી; અને એ લોકો એમની અંદર સામ્ય ધરાવતી કોઈ ગતિની લાગણી પણ અનુભવતા નથી. મુખ્યત્વે કરીને જે લોકો ભારતીય રાગોની કદર કરી જાણે છે તેમને એ ગમે છે; કારણ કે એમાં એ રાગોને મળતું કંઈક હોય છે. પરંતુ એમાં પણ બાહ્ય રૂપ તો, સંગીતના સર્વ નિયમો અને માન્યતાઓનું ખંડન જ થતું હોય છે.

(૩૦ ઑક્ટોબર ૧૯૫૭)

\*

“અમે જ્યારે આપના સંગીત સાથે પ્લેગ્રાઉન્ડ ઉપર ધ્યાન કરતા હોઈએ ત્યારે અમારે શું કરવા પ્રયત્ન કરવો જોઈએ?”

આ સંગીત અમુક ઊંડી લાગણીઓ જાગ્રત કરવાના હેતુવાળા હોય છે.

એ સાંભળવા માટે તમારે બને તેટલા શાંત અને બિનસક્કિય બની રહેવું. અને જો મનની નીરવતામાં, સ્વરૂપનો કોઈ ભાગ એક એવો સાક્ષીભાવ ધારણ કરી શકે કે જે કોઈ જાતની પ્રતિક્રિયા કર્યા વિના કે પ્રવાહમાં ટસડાયા વિના સ્થિર રહી શકે, તો પછી એ વ્યક્તિ આ સંગીત તેની લાગણીઓ અને ઊર્ભિઓ ઉપર જે અસર ઉપજાવે છે તેનું માપ કાઢી શકે. અને જો એમાંથી કોઈ ગહન શાંતિ અને લગભગ સમાધિ જેવી અવસ્થાએ પહોંચાય તે તો ઘણું જ સરસ.

(૧૫ નવેમ્બર ૧૯૫૮)

\*

“મધુર માતાજી, જે સંગીત બીજું કોઈ વગાડતું હોય તેનાં સંવેદનોમાં અન્ય વ્યક્તિ કઈ રીતે પ્રવેશ કરી શકે?”

જેમ તમે કોઈ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ રાખતા હો કે તેની પ્રત્યે ઓછાવતા પ્રમાણમાં ઉંચું મમત્વ હોય છે ત્યારે જેમ તેની લાગાણીઓમાં ભાગ લો છો તે રીતે અથવા તો એક એવી એકાગ્રતા કરીને કે જે અંતે તદકારતામાં પરિણામે. જ્યારે કોઈ વ્યક્તિ મગજમાંના બધા ધોંઘાટને બંધ કરીને પૂર્ણ નીરવતા સાથે એક તીવ્ર અને સધન ધ્યાનપૂર્વક સંગીતનું શ્રવણ કરે છે ત્યારે આ તદકારતાની અવસ્થા પ્રાપ્ત થાય છે. એમાં પછી ટીપે ટીપે કરીને સંગીતના સૂરો ટપકે છે અને છેવટે કેવળ સંગીતનો ધ્વનિ જ અવશિષ્ટ રહે છે. એમાં સર્વ પ્રકારની લાગાણીઓનો ધ્વનિ, ઊર્ભિઓની સર્વ પ્રકારની લીલાઓ જોવાય છે, અનુભવાય છે, જાણો કે પોતાની અંદરથી જ પ્રગટ થતી હોય એમ લાગે છે.

(૨૦ ઓક્ટોબર ૧૯૫૮)

“‘ક્ષ’ અને હું સાથે બંસરી વગાડીએ છીએ. અમને એક ચોપડી મળી આવી છે જેની અંદરનાં ગીતો અત્યંત સુંદર, સરળ અને સાદા સૂરોમાં વગાડી શકાય તેવાં છે. અમે જાણવા માણીએ છીએ કે પ્રેમ અને મૃત્યુને લગતાં કાવ્યો કે જે આ શ્રમના આદર્શ સાથે મેળમાં નથી એના સૂરમાં કોઈ ભૂરી લાગાણી હોય કે કેમ? કેથોલિક ચર્ચમાં વગાડવામાં આવતા સંગીતના સૂરો પણ શું ભૂરા ગણાય છે? એ એમ હોય તો અમે પછી જંગલી શબ્દોવાળાં કે ધાર્મિક સૂર રચનાવાળાં ગીતો ન વગાડીએ.”

બંને પ્રસંગે તમારે શબ્દો દૂર કરીને કેવળ સંગીત જ જાળવી રાખવું.

જો તમને સ્વરલિપિ લખતાં આવડતી હોય તો તમારે વગાડવાના સૂરોની (શબ્દો વાપર્યા વિના) નકલ તૈયાર કરો. જો તમને એ ન આવડતું હોય તો, ‘જો’ જેવા બીજા કોઈને તમને લખી આપવાનું કે લખતાં શીખવવાનું કહી શકો છો.

એ પુસ્તકો તમારી પાસે ન રાખશો. એવાં પુસ્તકોની માઠી અસર થવા સંભવ છે.

(૧૯૫૮)

“અમારે સંગીતમાં શાની શોધ કરવી?  
 સંગીતની ચીજની ગુણવત્તા કઈ રીતે માપવી?  
 સંગીત માટે કઈ રીતે રસ કેળવવો?  
 હળવા સંગીત (સિનેમાના, જાગ્ના — જે આપણાં બાળકોને .....  
 બહુ ગમે છે તે — વિષે આપ શું ધારો છો?”

સંગીતનું કાર્ય ચેતનાને આધ્યાત્મિક ઊંચાણો પ્રત્યે ઉઠાવી લઈ જવાનું છે.  
 જે કાઈ ચેતનાને હુલકી કક્ષાએ ઉતારે છે, કામનાઓને ઉતેજે છે, અને  
 આવેગોને ઉશ્કેરે છે, એ સર્વ, સંગીતના સાચા લક્ષ્યથી વિરુદ્ધનું છે અને એનાથી  
 બચતા રહેવું.

આમાં નામનો સવાલ નથી, પ્રેરણાનો છે — અને આની તુલના તો ત્યાંની  
 આધ્યાત્મિક ચેતના જ કરી શકે.

(૨૨ જુલાઈ ૧૯૬૭)

\*

### (એક મધ્યકાલીન કવિતા વિષે)

આના શબ્દો હાસ્યાસ્પદ અને અસભ્ય રસવાળા છે. જ્યારે આપણે કોઈ ગીતનો  
 અભ્યાસ કરતાં હોઈએ ત્યારે એમાંનાં ઉર્ભિગીતો જો અયોગ્ય હોય તો એમને બદલી  
 નાખીને કેવળ સંગીતને જ રાખવું.

જે કોઈને છંદ-તાલની સમજ હોય તે બહુ સહેલાઈથી એમ કરી શકે છે.

(ફેબ્રુઆરી ૧૯૬૮)

\*

(ગોય સંગીતના કાર્યક્રમ ઉપર “હુલ્લે લુઈઆ” અને “ડોન નોબિસ પાસેમ”  
 વાંચીને :)

બરાબર છે, પણ એ શરતે કે એ એકપક્ષીય ન હોય અને બીજા ધર્મોનું પ્રતિનિધિત્વ  
 પણ એમાં હોય.

(માર્ચ ૧૯૬૮)

\*

## કવિતા

કવિતા એ આત્માનો શૃંગાર છે.

\*

મારે માટે કવિતા એ તત્ત્વજ્ઞાનથી પર છે, સૌ પ્રકારનાં સ્પષ્ટીકરણોથી પર છે.

\*

## ફોટોગ્રાફી

આધુનિક ફોટોગ્રાફી એક કલા બની ગઈ છે અને અન્ય સૌ કલાની જેમ, એ આત્માને અને અંતરની લાગણીઓને, સૌન્દર્યના સાચા ઘ્યાલ સાથે રજૂ કરી શકે છે.

\*

ફોટોગ્રાફર કલાકાર હોય ત્યારે ફોટોગ્રાફી એક કલા બની રહે છે.

\*

## સિનેમા

“આજકાલ અમે ઘણી ફિલ્મો જોઈએ છીએ અને મને સમજાતું નથી કે એમનાથી અમને શું શિક્ષણ મળે છે?”

જ્યારે તમારું વલણ સાચું હોય છે ત્યારે દરેક વસ્તુ, કાંઈ ને કાંઈ શીખવાનું સાધન બની રહે છે.

ગમે તેમ તોય, આ પ્રકારની વધુ પડતી પ્રવૃત્તિથી તમને સમજાવું જોઈએ કે કેટલાક લોકોમાં ફિલ્મો જોવાની જે અદ્ભુત કામના છે તે બીજી સર્વ કામનાઓની જેવી રોગી દશાવાળી છે.

(૧૧ મે ૧૯૬૩)

\*

આપણે બાળકોને, જીવન કેવું હોવું જોઈએ તેવી ફિલ્મો બનાવવા શક્યમાન બનવું જોઈએ. પરંતુ આપણે એ બિંદુએ પહોંચવાથી ઘણાં દૂર છીએ. આવી ફિલ્મો તો હજુ બનાવવી પડશે. અત્યારે તો, ઘણીખરી વાર તો સિનેમામાં જે ફિલ્મો બતાવવામાં આવે છે તેમાં જીવન જે પ્રકારનું ન હોવું જોઈએ તે જ બતાવવામાં આવે છે, અને એથી જીવન ઉપર ત્રાસ ઊપછે છે.

આ પણ એક તૈયારી કરવા માટે ઉપયોગી વસ્તુ છે.

આશ્રમમાં ફિલ્મ બતાવવામાં આવે છે તે કેળવાણી અર્થે, આનંદ-પ્રમોદ માટે નહિ. એટલે આપણી સમક્ષ શિક્ષણનો પ્રશ્ન ઊભો થાય છે.

જો આપણે એમ માનતા હોઈએ કે બાળકો એવું જ શીખે અને જાણો કે જેને લઈને તેઓ દરેક નિભન, અપરિપક્વ અને અધોગામી ગતિથી દૂર રહે, તો આપણે એક જ સપાટે બીજા બધા માનવ સમાજથી તેમને જુદા પાડી લેવાં પડે. એની શરૂઆત તરીકે આ બધી યુદ્ધો અને ખૂનોની, ઈતિહાસને નામે પ્રચારાતી મારામારી અને ડગાઈની વાતો બંધ કરવી જોઈએ. એમના અત્યારના તેમના કુટુંબ, સગાંઝો અને ભિત્રો સાથેના સંબંધો બંધ કરવા જોઈએ. આપણે તેમના સ્વરૂપના પ્રાણમય આવેગો ઉપર અંકુશ સ્થાપવો જોઈએ.

કોન્વેન્ટના મઠોની અથવા ગુફાઓ કે જંગલોના નિવાસની પાછળ આ જ ઘ્યાલ રહેલો હતો.

પરંતુ આ દીલાજ અસરકારક ન નીવડ્યો અને માનવજીતને કાદવમાંથી ભહાર કાઢી ન શકાઈ.

શ્રી અરવિંદના કથન પ્રમાણે ઉપાય તદ્દન જુદ્દો છે.

આપણે જીવનનો સમગ્રપણો સામનો કરવો જોઈએ. એમાં વિરૂપતા, અસત્ય અને જે કૂરતા હજુ સુધી છે તે સર્વનો સામનો કરવાનો છે. પરંતુ સાથે સાથે આપણી અંદર રહેલા સર્વ શુભત્વ, સૌન્દર્ય, જ્યોતિ અને સત્યનો સ્વોત શોધી કાઢવાનો છે કે જેથી આપણે જગતને તેમનો સ્પર્શ આપી તેનું રૂપાંતર કરી શકીએ.

નાસી છૂટવા કે પછી જાણો કે જોવું ન પડે તે માટે આપણી આંખો ઢાંકી દેવી તેના કરતાં આ અનંત ગણો મુશ્કેલ માર્ગ છે, પરંતુ એ જ સાચી રીતે અસરકારક માર્ગ છે — એ માર્ગ શૂરાઓનો, શુદ્ધ લોકોનો અને સત્યનો આવિર્ભાવ કરવાની ક્ષમતા રાખનારાઓનો છે.

(૨૮ મે ૧૯૬૮)

“માતાજી, અમારે ફિલ્મ કઈ દૂષિષ્ટે જેવી? જો અમે એમાંનાં પાત્રો સાથે એકરૂપ થઈ જઈએ છીએ અને એ જો કોઈ કરુણ કે જાસૂસીને લગતી ફિલ્મ હોય છે તે એટલું બધું એકાગ્ર થઈ જવાય છે કે રડી પડાય છે કે બીક લાગે છે. અને જો અમે નિર્લોપ રહીએ છીએ તે એની કદર કરી શકતા નથી. ત્યારે શું કરવું?”

આમાં જેના ઉપર અસર થાય છે અને જે સક્રિય બને છે તે ગ્રાણમય તત્ત્વ છે.

જો તમે મનોમય રીતે જોશો, તો રસ એની એ જ રીતનો નાહિ રહે, તમે વિચલિત કે દુઃખી થવાને બદલે એ ફિલ્મનું મૂલ્ય સ્વસ્થ ભાવે સમજી શકશો. એ બરાબર રીતે બનાવી છે કે કેમ, અભિનય સારો છે કે કેમ, અને એમાંનાં ચિત્રોમાં કશું કલાનું મૂલ્ય ધરાવતું છે કે કેમ.

પ્રથમના પ્રકારમાં તમે “સારા જોનારાઓ” હો છો; બીજા પ્રકારમાં તમે વધુ શાંત હો છો. આશિષ.

(૩૦ જાન્યુઆરી ૧૯૭૦)

\*

### (ઓરોવિલમાં સિનેમા વિષે)

પંદર વર્ષ નીચેનાં બાળકોએ કેવળ શૈક્ષણિક ફિલ્મ જ જોવી.

ઓરોવિલમાં બતાવાતી ફિલ્મો વિષે કાળજી રાખવી.

જે કોઈ નિઝન પ્રવૃત્તિઓ અને કાર્યોને ઉત્તેજિત કરે તેવી હોય તેમનો ત્યાગ કરવો.\*

(૨૫ ફેબ્રુઆરી ૧૯૭૨)

### નીરવ બનતાં શીખવું

સિનેમા એ લોકોને માટે છે જેમને ચિત્ર જોવાં ગમે છે, સંગીત અને શબ્દો સાંભળવા ગમે છે અને એમને એ રીતે શાંતિપૂર્વક જોવાનો હુક છે.

---

\* પ્રથમના બે પેરેગ્રાફ શ્રી માતાજીએ કરેલી ટીકાને આધારે છે. જ્યારે એ નોંધ તેમને બતાવવામાં આવી ત્યારે છેલ્લો ફકરો તેમણે પોતે લખેલો.

જેઓ વાતો કરવાનું, કચ કચ કરવાનું, હુસવાનું, ધોંઘાટ કરવાનું અને આમતેમ દોડાદોડ કરવાનું બંધ ન રાખી શકે તેમણે ત્યાં જવું જ નહિ કારણ કે તેઓ જે કાંઈ કરી રહ્યાં હોય છે તે વસ્તુઓ બીજે સ્થળે પણ, બીજાઓ કે જેમને ચિત્રો ગમતાં હોય છે તેમની મજામાં ભંગ પાડ્યા સિવાય કરી શકે છે.

એટલે નિર્ણય આ પ્રમાણે છે:

શાંત પ્રેક્ષકો — નહિ તો સિનેમા નહિ.

(૧૨ ઓક્ટોબર ૧૯૬૨)

\*

### “ઓર્ડનો જાહુગાર”\*

આજે રાત્રે જે ચિત્ર બતાવવાનું છે તેનું ટૂંકમાં આપેલું વર્ણન તમારા રસમાં જરૂર વધારો કરશો.

આ ચિત્ર ત્રણ ભાગમાં છે. બે ભાગ બ્લેક એન્ડ વહાઈટમાં છે અને ત્રીજો વિસ્તૃત ભાગ રંગીન છે. બે બ્લેક એન્ડ વહાઈટ ભાગ (પહેલો અને છેલ્લો) સ્થૂલ જગતમાં વસ્તુઓ કેવી રીતની દેખાય છે તે બતાવે છે; જે રંગીન ભાગ છે તે એ જ પ્રકારના ઘટનાક્રમ અને વ્યક્તિઓને પ્રાણમય જગતમાં બતાવે છે. જ્યારે શરીર ઊંડી નિદ્રામાં હોય છે ત્યારે આપણે આપણા દેહની બહાર નીકળીને જે પ્રાણમય જગતમાં જઈએ છીએ તેને બતાવે છે. જ્યાં સુધી તમારે સ્થૂલ દેહ હોય છે ત્યાં સુધી પ્રાણમય જગતની કોઈ હાનિ તમને સાચેસાચી અસર કરતી નથી કારણ કે સ્થૂલ દેહ એક પ્રકારના રક્ષક કવયનું કાર્ય કરે છે અને તમે જ્યારે ઈચ્છો ત્યારે એમાં પાછા ફરી શકો છો. આ વસ્તુને આ ચિત્રમાં કલાત્મક રીતે બતાવવામાં આવી છે. તમે જોશો કે એક નાનકડી બાળકી તેના પગ ઉપર કોઈ જાહુઈ માણેક રંગી લાલ રંગની સપાટો પહેરે છે અને જ્યાં સુધી એણે એ સપાટો પહેરી રાખી હોય છે ત્યાં સુધી અનું કશું બૂરું થતું નથી. જે માણેકના જેવા લાલ રંગની સપાટો છે તે ભૌતિક દેહ સાથેના પ્રતીક અને નિશાની રૂપ છે અને જ્યાં લગી એ સપાટો એના પગ ઉપર હોય, ત્યાં સુધી એ ઈચ્છે ત્યારે પોતાના દેહમાં પાછી ફરીને તેમાં આશ્રય મેળવી શકે છે.

બે બીજી વિગતો નોંધવી રસપ્રદ છે. એક તો બરફ પડવાની ઘટના છે કે જેને લઈને પેલી ડાકણની મલીન વિદ્યા તેમને શુભકારી પ્રાણશક્તિના મણિમય કિલ્લા

---

\* જ્યારે આશ્રમના પણ ગ્રાઉન્ડ ઉપર આ ફિલ્મ બતાવવામાં આવી ત્યારે આ પછી લખેલું વકતવ્ય શ્રી માતાજીએ લાઉઝસ્પીકર દ્વારા આપેલું.

પ્રત્યે જતાં રોકવા માગે છે. તેનાથી તેમનું રક્ષણ થાય છે. ગ્રાણમય જગતમાં, બરફ એ નિર્મળતાનું પ્રતીક છે. એમની લાગણી અને દુરાદુરોમાં રહેલી નિર્મળતા જ તેમને મહુાભ્યમાંથી રક્ષણ આપે છે. એ પણ નોંધવા જેવું છે કે પેલા શુભ લક્ષ્યાવાળા જાદુગરના કિલ્લા ઉપર પહુંચવા માટે તેમણે સોનાની હિંટોના વિશાળ માર્ગ થઈને, જ્યોતિર્મય શ્રદ્ધા અને આનંદના માર્ગ થઈને પ્રયાણ કરવાનું છે.

બીજો અગત્યનો મુદ્દો આ છે: જ્યારે ડોરોથી પેલા ઘાસના બળતા માણસને સળગી ભરવામાંથી બચાવવા પાણી રેણુ છે ત્યારે એમાંનું થોડુંક જળ પેલી દુષ્ટ ડાકણા મુખ ઉપર પડે છે અને એ તરત જ ઓગળીને મરી જાય છે. પાણી એ શુદ્ધિનું પ્રતીક છે અને કોઈ વિરોધી સ્વરૂપ કે શક્તિ, જો એ પાણીની શુદ્ધિની શક્તિનો શુભ સંકલ્પ અને સત્યનિષ્ઠાપૂર્વક પ્રતિકાર કરે છે તો એનો પ્રતિકાર કરી શકતી નથી.

છેવટે, જ્યારે પેલી સારી પરી પેલી નાનકડી બાળાને તેને ઘેર પાછાં જતાં જતાં પોતાની સપાટો એકબીજા સાથે ખખડાવતાં જવાનું કહે છે, ત્યારે તે કહે છે કે ઘર કરતાં બીજી કોઈ વસ્તુ સારી નથી; “ઘર” શબ્દથી એ ભૌતિક જગતનું સૂચન કરે છે જે સંરક્ષણ અને સિદ્ધિનું સ્થાન છે.

તમે જોશો કે આ ચિત્રનો વિષય રસપ્રદ છે અને એમાં જ્ઞાનનો અભાવ નથી. દુઃખની વાત છે કે એની રજૂઆત જેટલી સૌન્દર્યપૂર્ણ અને સંવાદી રીતે થવી જોઈતી હતી તેટલી થઈ નથી. એની ગોઈવાણીમાં કેટલીક ગંભીર ભૂલો અને અનેક અનિયણીય અભદ્ર વસ્તુઓ છે.

(૧૪ સપ્ટેમ્બર ૧૯૫૨)

\*

## અન્ય વિષયો

કોઈ એક સંઘમાં કે સમાજમાં રહેવા માટે લખતાં-વાંચતાં, કંઈ નહિ તો એકાદ ભાષા પણ સાચી રીતે બોલતાં, થોડુંક સામાન્ય ભૂગોળનું જ્ઞાન, આધુનિક વિજ્ઞાનનું સાધારણ જ્ઞાન અને રીતભાતના સામાન્ય નિયમો જાણી લેવા — એ જરૂરી વસ્તુઓ છે.

\*

મને એમ લાગે છે કે યોગ વિનાનું મનોવિજ્ઞાન ચેતનવિહીન છે.

મનોવિજ્ઞાનનો અભ્યાસ અનિવાર્યપણે યોગ પ્રત્યે – જો વ્યવહારું નહિ તો તાર્કિક યોગ પ્રત્યે તો દોરી જવો જોઈએ.

(૨૩ ડિસેમ્બર ૧૯૬૦)

\*

જે એક છે તેમાં બેદ ઊભો ન કરો. વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું લક્ષ્ય એક જ છે – પરમ હિવ્યતા. બે વચ્ચે જે બેદ છે તે એ કે આધ્યાત્મિકતા પાસે જ્ઞાન છે, વિજ્ઞાન પાસે નથી.

(ડિસેમ્બર ૧૯૬૨)

\*

“મધુર માતાજી, કેટલીક વસ્તુઓ એવી છે જે મારે માટે સારી છે પણ મને એમનામાં બહુ રસ પડતો નથી. ઉદાહરણ તરીકે, ગણિત એ એક સારો વિષય છે પણ મને તેના પ્રત્યે ભાવ નથી. કૃપા કરીને કહું કે જે વસ્તુઓ પ્રત્યે મને આકર્ષણ નથી તેમનામાં હું કઈ રીતે રસ લેતો થાઉં?”

એવી ઘણી વસ્તુઓ છે જે આપણે જાણવી જોઈએ, અને તે આપણને બહુ રસપદ લાગતી હોય તેટલા માટે નહિ પરંતુ તેઓ બહુ ઉપયોગી અને કદાચ અનિવાર્ય પણ છે; ગણિત એક એવી વસ્તુ છે.

આપણી પાસે જ્ઞાનનું સારું એવું ભાથું હોય તો જ આપણે જીવનનો સફળતાપૂર્વક સામનો કરી શકીએ.

\*

ઇતિહાસ-ભૂગોળમાં એવાં મગજો ધરાવનારાઓને રસ પે છે કે જેમને પોતે જે પૃથ્વી ઉપર રહે છે તેના વિષે જાણવું હોય છે.

આ બે વિષયોમાં તમે રસ લેતા થાઓ તે પહેલાં તમારે તમારા જ્ઞાનની તૃખાનાં ક્ષિતિજો વિશાળ કરવાં જોઈએ અને ચેતનાનું ક્ષેત્ર પણ વિસ્તૃત કરવું જોઈએ.

\*

“ગાણિત, ઈતિહાસકે વિજ્ઞાન દ્વારા મને આપની જાણ કરી રીતે થઈ શકે?”

એ વિષયો અનેક પ્રકારે સહાયક થઈ શકે :

૧. સત્યની જોતિને જીલવા અને ધારણ કરવાનું સામર્થ્ય પામવા માટે મનોબળ મજબૂત, વિશાળ અને નમનીય હોવું જોઈએ. આ વિષયોના અભ્યાસ વડે આ ધ્યેય પામી શકાય છે.

૨. જો તમે વિજ્ઞાનનો પૂરતા પ્રમાણમાં ઉંડો અભ્યાસ કરશો તો તમને દેખાવોના મિથ્યાત્વનું ભાન થશો અને એ વસ્તુ તમને આધ્યાત્મિક સત્ય પ્રત્યે દોરી જશો.

૩, ભૌતિક પ્રકૃતિનાં સર્વે પાસાંઓ અને ગતિઓના અભ્યાસ દ્વારા તમે વિશ્વમાતા સાથે સંબંધમાં આવશો અને એ રીતે તમે મારી નજીક આવશો.

(૧૭ ડિસેમ્બર ૧૯૬૬)

\*

ગાણિતના વિષયની બાબતમાં મને લેખિત કરતાં વ્યવહારું ગાણિત વધુ પસંદ છે. એમાં મન વડે ગણાતરી કરી શકવાની શક્તિ ઉપર ભાર મૂકવો જોઈએ. એમ કરવું મુશ્કેલ વધુ છે પરંતુ એને લઈ આંતરદૃષ્ટિ અને તર્ક-શક્તિ ખીલવવામાં અત્યંત લાભ થાય છે. ગોખણપણી કરીને પ્રાપ્ત કરેલા જ્ઞાન કરતાં સાચી બુદ્ધિ ખીલવવાનો એ સૌથી વધુ અસરકારક માર્ગ છે.

જ્યારે તમને મનોમય ગાણિત આવડે અને ગાણિતની સમજ આવે, ત્યારે પછી લેખિત ગાણિત સમજતાં વાર નથી થતી.

એક સરખા પદાર્થો લઈને તમે નાનાં બાળકોની નાની નાની સંઘ્યાઓની ગણાનાની શરૂઆત કરી શકો. પછી જ્યારે દસકા અને સેંકડાની વાત આવે ત્યારે કંકરા અને વજનિયાંનો ઉપયોગ કરી શકાય.

આ રીતે થોડી મહેનત લો તો તમે, ગાણિતની રીતો તર્કબદ્ધ પ્રકારે શીખવી શકો અને બાળકો માટે એ વસ્તુઓને સાચી, જીવંત અને એક વાસ્તવિક અર્થવાળી બનાવી શકો.

\*

## રાષ્ટ્રીય કેળવણી

આપણો ઉકેલ કેવળ ભારત માટે જ કોઈ રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિ ઊભી કરવાનો નથી પરંતુ આપણે તો સમગ્ર જગત માટેની કેળવણીની તૈયારી કરીએ છીએ.

\*

“મધુર માતાજી, આપણું લક્ષ્ય કેવળ ભારત માટે રાષ્ટ્રીય કેળવણીની પદ્ધતિ તૈયાર કરવાનું નથી પરંતુ સમગ્ર માનવજાત માટે તાત્ત્વિક અને પાચાનું શિક્ષણ તૈયાર કરવાનું છે. પરંતુ, માતાજી, એ પણ શું સાચું નથી કે (એના ભૂતકાળના પ્રયત્નો અને સિદ્ધિઓને પરિણામે) ભારતમાં એ વિષયની વધુ લાયકાત છે અને એને પરિણામે એ વિષયમાં એનો અધિકાર અને ઉત્તરાધિત્વ, પોતાના પ્રત્યે અને જગત પ્રત્યે વધુ ગ્રમાણમાં છે? ગમે તેમ હોય, પરંતુ આ તાત્ત્વિક શિક્ષણ એ ભારત માટે રાષ્ટ્રીય કેળવણી છે. હુકીકતમાં તો હું આ રાષ્ટ્રીય કેળવણીને દરેક મહાન રાષ્ટ્ર માટેની (તેની વિશિષ્ટતાને અનુલક્ષીને કરાતા ફેરફાર સાથેની) કેળવણી ગણું છું. હું વિચારું છું કે આ સાચું હશે અને શ્રી માતાજી એને અનુમોદન આપશે કે કેમ?”

હા, આ તદ્દન સાચું છે અને જો મને તમારા પ્રશ્નોના ઉત્તર આપવાનો સમય મળ્યો હોત તો મેં જે કહ્યું હોત તેના એક ભાગરૂપ છે.

ભારત પાસે આત્માનું જ્ઞાન હતું, પરંતુ એણે ભૌતિક તત્ત્વ પ્રત્યે ઉદાસીનતા સેવી અને તેથી અને સહન કરવું પડ્યું.

પદ્ધિમ પાસે પદાર્થ તત્ત્વનું જ્ઞાન છે પરંતુ એ આત્મતત્ત્વનો ઇનકાર કરે છે અને એથી એ અત્યંત દુઃખી છે.

એક એવી સંપૂર્ણ કેળવણી હોવી જોઈએ, જે થોડાક ફેરફારો સાથે, સૌ રાષ્ટ્રો અપનાવી શકે, જેના વડે સંપૂર્ણપણે વિકસિત અને ઉપયોગક્ષમ બનેલા પદાર્થતત્ત્વ ઉપર આત્માની આણ વર્તે.

મારે જે કહેવાનું હતું તે ટૂંકાણમાં આ છે.

આશીર્વાદ સાથે.

## ભારતના કેળવણી\* અંગોના પાયાના મશ્રો

**“૧. રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જીવનના વર્તમાન તથા ભાવિને દૃષ્ટિમાં રાખતાં ભારતે કેળવણીની બાબતમાં કયું લક્ષ્ય રાખવું જોઈએ?”**

ભારતનાં બાળકોને અસત્યનો ઈનકાર અને સત્યનો આવિર્ભાવ કરવા માટે તૈયાર કરવાં.

**“૨. આ ઉચ્ચ લક્ષ્યને સિદ્ધ કરવા માટે દેશે કયાં પગલાં લેવા જોઈએ? એ દિશામા આરંભ કેવી રીતે થઈ શકે?”**

જડતત્ત્વને આત્માનો આવિર્ભાવ કરવાને તૈયાર કરીને.

**“૩. હિંદની સાચી પ્રતિભા શી છે અને તેનું ભાવિ શું છે?”**

જગતને એ વસ્તુ શીખવવી કે જડતત્ત્વ આત્માના આવિર્ભાવ રૂપે જો નહિ બને તો તે એક ખોટી અને દુર્બળ વસ્તુ જ રહેશે.

**“૪. હિંદમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં જે પ્રગતિ થઈ રહી છે તે વિષે આપ શું ધારો છે? આ વિજ્ઞાન અને ટેકનોલોજી આત્માની વૃદ્ધિ માટે શું ફાળો આપો શકે?”**

આ વસ્તુઓનો માત્ર એટલો જ ઉપયોગ છે કે તે જડતત્ત્વની ભૂમિકાને આત્માના આવિર્ભાવને માટે વધારે બળવાન, વધારે સંપૂર્ણ અને વધારે અસરકારક બનાવી આપે છે.

\* ઓગસ્ટ ૧૯૬૫માં ભારત સરકારના એજ્યુકેશન કમિશને આશ્રમના શિક્ષણ કેન્દ્રમાં અપનાવવામાં આવેલા આદર્શો અને શિક્ષણ પદ્ધતિનું મૂલ્યાંકન કરવા માટે મુલાકાત લીધેલી. એ સમયે શિક્ષકોના એક સમૂહે શ્રી માતાજીને આ પ્રશ્નાવલી આપેલી.

“૫. દેશને રાષ્ટ્રીય એકતાનો પ્રશ્ન ખૂબ જ મૂંજવે છે. આપનું આ બાબતમાં શું દર્શાન છે? ભારત પોતાના પ્રત્યેનું તથા જગત પ્રત્યેનું કર્તવ્ય કરી રીતે અદા કરશો?”

સર્વ રાષ્ટ્રોની એકતા એ જગતનું અનિવાર્ય ભાવિ છે. પરંતુ સર્વ રાષ્ટ્રોની એકતા શક્ય બને તે માટે પહેલાં તો દરેક રાષ્ટ્ર તેની પોતાની એકતા સિદ્ધ કરવી જોઈએ.

“૬. ભાષાનો પ્રશ્ન ભારતને ઢીક ઢીક પજવી રહ્યો છે. આ બાબતમાં આપણું વલાણ શું દુંગું જોઈએ?”

એકતા એ એક જીવતી હુકીકત રૂપે હોવી જોઈએ. એ કોઈ યથેચુ રીતે ઘાયેલા નિયમ તરીકે લદાવી ન જોઈએ. ભારત જ્યારે એક થશે ત્યારે તેને સૌ કોઈ સમજી શકે તેવી ભાષા આપોઆપ મળી આવશે.

“૭. કેળવણી એ સામાન્ય અક્ષરજ્ઞાન અને સામાજિક પ્રતિજ્ઞાની વસ્તુ બની ગઈ છે — આ શું રોગિશ વલાણ નથી? તો પછી કેળવણીમાં તેનું આંતરિક મૂલ્ય તથા તેની નૈસર્જિક આનંદમયતા કેવી રીતે લાવી શકાય?”

રૂઢ વસ્તુઓમાંથી બહાર નીકળી આવો અને આત્માના વિકાસ ઉપર ભાર મૂકો.

“૮. આજની કેળવણી ઉપર કયા કયા ભ્રમો અને ભ્રાન્તિઓ સવાર થયેલાં છે? એમાંથી આપણે કેવી રીતે બચી શકીએ?”

(અ) સફળતા, કારકિર્દી અને પૈસૌઃ આ વસ્તુઓને લગભગ સંપૂર્ણ મહત્ત્વ આપવામાં આવે છે તે. (બ) આત્માની સાથે સંપર્ક સધાવો જોઈએ તથા માણસના સ્વરૂપના સત્યની વૃદ્ધિ અને આવિભાવ થવો જોઈએ, -આ વસ્તુઓનું જે પરમ મહત્ત્વ છે તેના ઉપર ભાર મૂકો.

“૧. (અ) મારા શરીરના લોહીમાં અને પ્રત્યેક કોષોમાં હજુ અસત્ય ટકી રહેલું છે ત્યારે — (બ) અહુંકારપ્રધાન અને કામનામય પ્રકૃતિને અસત્ય પ્રત્યે રહેલી આસક્તિ વધુ ને વધુ બળવાન થતી જાય છે ત્યારે — બાળકોને અસત્યનો ઈનકાર કરવા કેવી રીતે તૈયાર કરવાં?”

૨. (અ) વ્યક્તિમાં પોતામાં એકતા નથી હોતી તો —  
 (બ) કુટુંબનાં બે માણસો વચ્ચે એકતા નથી હોતી તો —  
 (ક) ઓક મંડળ કે સંસ્થામાં એકતા નથી હોતી તો —

દરેક રાષ્ટ્રની એકતા કેવી રીતે સિદ્ધ કરી શકાય?

૩. એક આશ્રમવાસી વ્યક્તિ પણ જો અંગત ઈરછાઓને સંતોષવા માટે સામાજિક દરજાનો ચેપ ફેલાવતી હોય છે તો પછી ઝૂઠ વસ્તુઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય અને આત્માની વૃદ્ધિ ઉપર ભાર મૂકી શકાય?

૪. જ્યારે બધા જ માણસો પોતાના અહુંકાર અને અંગત મહુત્વનું પ્રદર્શન કરવા માટે તથા તેને તૃપ્ત કરવા માટે પૈસા પાછળ ઢોડી રહ્યા છે ત્યારે સફળતા, કારકિર્દી અને પૈસો એ વસ્તુઓને લગભગ સંપૂર્ણ એવું મહુત્વ કેવી રીતે ન આપવું?\*\*

દરેક માણસને આ કાર્ય કરવા માટે એક શરીર આપવામાં આવેલું છે, કારણ કે આ વસ્તુઓ પોતાની અંદર સિદ્ધ કરીને જ માણસ તેમને પૃથ્વી ઉપર સિદ્ધ કરવામાં માનવજીતિને મદદરૂપ બને છે.

શિક્ષક પોતાના વિદ્યાર્થી પાસે જે ગુણો અને ચેતના મેળવવાની માગણી કરે છે તે તેણે પોતે સંપૂર્ણ પણે પ્રાપ્ત કરવાં જોઈએ.

\*

હું ઈરછું છું કે તેઓ (સરકાર) યોગનો એક કેળવાણી તરીકે સ્વીકાર કરે, કેવળ

---

\* એક શિક્ષકે પૂછેલા આ ચાર પ્રશ્નોના ઉત્તરો શ્રી માતાજીએ તા. ૫ મી ઓગસ્ટ ૧૯૬૫ના આગણના પત્રમાં જે ઉત્તરો આપેલા તે પર આધારિત છે.

આપણા માટે નહિ, પરંતુ એ વસ્તુ દેશને માટે સારી છે એ માટે.

પદાર્થતત્ત્વનું રૂપાંતર થશે. એ એક સ્થળ પાયો બનશે. ગ્રાણ દિવ્ય બનશે. આમાં ભારતે આગેવાની લેવાની છે.

\*

## પોંડિયેરીમાં ફેન્ચ ઇન્સ્ટિટ્યુટના ઉદ્ઘાટન પ્રસંગે સંદેશ

કોઈ પણ દેશમાં, બાળકોને જે શિક્ષાણ આપવાનું હોય છે તેમાં તેમને દેશ શું છે, એના ગુણો શું છે, એનું કાર્ય શું છે, ઓઝે જગતમાં ક્યો ભાગ ભજવવાનો છે અને પૃથ્વીના વૃંદવાનમાં એનું સાચું સ્થાન કર્યું છે તે શીખવવાનું હોય છે. એમાં પછી અન્ય દેશોએ શો ભાગ ભજવવાનો છે, એ અંગે પણ વિશાળ સમજૂતી આપવી જોઈએ. પરંતુ એમાં કોઈની નકલ કરવાની વૃત્તિ ન હોવી જોઈએ અને પોતાના દેશની મેધા પ્રયેથી દૃષ્ટિ હઠવી ન જોઈએ. ફાન્સનો અર્થ, ભાવનાની ઉદારતા, વિચારોમાં નૂતનતા અને શૂરાપણું, અને કર્મમાં આભિજાત્ય એવો થતો હતો. એ ફાન્સ સૌને માટે માન અને આદરપાત્ર હતું; આ સદ્ગુણોને લઈને જ એ વિશ્વ ઉપર આધિપત્ય ભોગવતું હતું.

એક ઉપયોગિતાવાઈ, ગણતરીભાજ, વેપારીવૃત્તિવાળું ફાન્સ હવે ફાન્સ નથી રહ્યું. આ વસ્તુઓ તેની સાચી પ્રવૃત્તિ સાથે મેળ ખાતી નથી અને એમને કિયાશીલ કરવામાં એ જગતમાંનું પોતાનું ઉમદા સ્થાન ગુમાવી રહ્યું છે.

આજનાં બાળકોને આ વસ્તુ શીખવવી જોઈએ.

(૪ એપ્રિલ ૧૯૫૫)

\*

## શ્રી અરવિંદ આશ્રમ

### શારીરિક શિક્ષણ વિભાગ

આ વિભાગની સ્થાપના ૧૯૪૫માં થયેલી એની દ્વારા શિક્ષણ કેન્દ્રના વિદ્યાર્થી ઓ, શિક્ષકો અને આશ્રમના સાધકો માટે શારીરિક શિક્ષણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. એની પ્રવૃત્તિઓની દેખરેખ અને સંકલન એક શિક્ષકોના મંડળ દ્વારા — જેમને કેટનો કહેવામાં આવે છે — થાય છે. આ કેટનો પહેલવાની (જેમાં ક્ષેત્રની તેમ જ રમતના મેદાનની પ્રવૃત્તિઓ પણ આવી જાય છે), તરવાનું, વ્યાયામ, રમત-ગમતો, હરીકાઈઓ અને આસનો શીખવવામાં આવે છે. આખા વર્ષનો કાર્યક્રમ ચાર ઝડુઓમાં વહેંચી નાખવામાં આવેલો છે. પહેલા ત્રણમાં તાલીમ અને છેવટે હરીકાઈઓ હોય છે; વર્ષને અંતે, ભાગ લેનારાઓ એક શારીરિક કેળવાણીને લગતો વાર્ષિક પ્રદર્શનનો કાર્યક્રમ ગોઠવે છે. એ તા. ૨૪ ડિસેમ્બરના રોજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ઉપર યોજવામાં આવે છે. આ વિભાગને માટે પુસ્તકાલય, અખાડો, રમત-ગમતનું મેદાન, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, સ્વીમિંગપુલ, જુડો હોલ અને ટેનિસ કોર્ટની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

શ્રી માતાજીએ શારીરિક શિક્ષણ વિભાગના વિકાસમાં સક્રિય રસ લીધેલો અને એના કાર્યક્રમોને ઘાટ આપવાનું કાર્ય કરેલું. ઘણાં વર્ષો સુધી તેઓ બપોર પછીનો અને સાંજનો સમય, જેઓ જુદાં જુદાં ક્ષેત્રોમાં શારીરિક શિક્ષણની પ્રવૃત્તિ કરતા તેમની સાથે ગાળવાનું ચાલુ રાખેલું.

\*

## યૌવન

યૌવનનો અર્થ એ નથી કે માણસની વય કેટલી ઓછી છે. યૌવન એટલે વિકાસ અને પ્રગતિ માટેની શક્તિ. પોતાની શક્તિઓની, પોતાનાં ગૂઢ બળોની વૃદ્ધિ કરવી એ છે વિકાસ, પોતે આજ સુધીમાં મેળવેલી શક્તિઓને વિના અટક્યે પૂર્ણતાએ પહોંચાડવી એ છે પ્રગતિ. ઉમરનો વધારો એ ઘડપણ નથી. માણસનું વય ખૂબ વધે એટલે તે વૃદ્ધ થયો એમ નહિ કહેવાય. ઘડપણ તો માણસમાં ત્યારે આવે છે કે જ્યારે તે પોતાનો વિકાસ કે પ્રગતિ કરવા માટેની શક્તિ ગુમાવી બેસે છે, પોતે વિકાસ કે પ્રગતિ કરવાનો ઈન્કાર કરી દે છે. મેં એવાં માણસો જોયાં છે જે ૨૦ વર્ષની ઉંમરે પણ ઘરડાં થઈ ગયાં હોય, અને ૭૦ વર્ષની વયે પણ જુવાન રહેલાં હોય. માણસને એમ થવા લાગે કે ચાલો, હવે તો જીવનમાં કરીને સ્થિર બેસી જવું છે, ભૂતકાળની મહેનતના ઉપર હવે આરામ કરવો છે; માણસને એમ થાય કે આપણે તો જીવનમાં કરવા જેવું બધું હવે કરી લીધું; પામવા જેવું બધું પામી લીધું; અર્થાત् માણસ આગળ ગતિ કરતો અટકી ગયો, પૂર્ણતા તરફ તેનાં પગલાં થંભી ગયાં, ત્યાં સમજવું કે હવે એની પીછેહઠ શરૂ થઈ ગઈ છે, એને ઘડપણ બેસવા લાગ્યું છે.

શરીર પરત્વે પણ આપણે જોઈ શકીશું કે એની શક્તિઓના વિકાસની કે પ્રગતિની કોઈ સીમા નથી. હા, એ ખરું છે કે વિકાસ અને પ્રગતિ માટેની સાચી પદ્ધતિ હાથ આવવી જોઈએ તથા તે માટે યોઝ્ય પરિસ્થિતિ મળવી જોઈએ. અમે જે ઘણા પ્રયોગો કરવા માગીએ છીએ તેમાંનો એક પ્રયોગ તે આ છે. એ પ્રયોગ દ્વારા અમે શરીર અંગો માનવજીતિમાં જે સામુદ્દરિક સૂચન પેઢલું છે તેને તોડવા માગીએ છીએ અને જગતને એ બતાવવા માગીએ છીએ કે માનવમાં રહેલી શક્યતાઓ આપણે સેવેલી તમામ કલ્પનાઓ કરતાં પણ વધુ આગળ જઈ શકે છે.

(૨ ફેબ્રુઆરી ૧૯૪૮)

\*

## એકાગ્રતા અને બહુમુખતા

રમત-ગમતોમાં સફળ થવા ઈચ્છનારાઓ પોતાને ગ્રચિકર હોય તેમ જ પોતાની પ્રકૃતિને અનુકૂળ હોય તેવો વિષય યા તો પ્રવૃત્તિની દિશા પસંદ કરે છે. તે પછી પોતાના એ વિષય યા તો પ્રવૃત્તિ ઉપર પોતાની શક્તિ એકાગ્ર કરે છે, અને એ શક્તિ અન્ય દિશામાં વહેંચાઈ ન જાય તે માટે ખૂબ સાવધાન રહે છે. જીવનમાં જેવી રીતે હરેક માણસ પોતા માટે એક કારકિર્દી પસંદ કરી લે છે અને પોતાનું બહું ધ્યાન તે પાછળ જ ખર્યે છે તેવી રીતે ખેલાડી પણ પોતાની એક ખાસ પ્રવૃત્તિ પસંદ કરીને તે દિશામાં શક્ય તેટલી પૂર્ણતા મેળવવા માટે પોતાની સર્વ શક્તિને એકાગ્ર કરે છે. ખેલાડી પોતે લીધેલા વિષયની કિયાઓનું સતત પુનરાવર્તન કરતો રહે છે. એમાંથી એ કિયા અંગે તેનામાં એક સાહજિક કિયાશક્તિનો જન્મ થાય છે. અને એ સાહજિક કિયાશક્તિ જ તેને સામાન્ય રીતે તે વિષયની પૂર્ણતા તરફ લઈ જાય છે. પરંતુ આ સાહજિક કિયાશક્તિને સ્થાને એક બીજી શક્તિને પણ વધુ લાભકારક રીતે સ્થાપી શકાય છે. એ શક્તિ છે એકાગ્ર ધ્યાનની શક્તિ. આપણે કેવળ બૌદ્ધિક પ્રવૃત્તિઓમાં જ ધ્યાનની એકાગ્રતા કરીએ છીએ એવું નથી. જીવનની બધી પ્રવૃત્તિઓમાં આ શક્તિ કામ કરે જ છે. આ એકાગ્રતા મેળવવા માટે આપણે શક્તિઓ ઉપર જ્ઞાનપૂર્વક કાબૂ ગ્રાપ્ત કરવાનો રહે છે.

માણસમાં એકાગ્રતાપૂર્વક ધ્યાન આપવાની જેટલી શક્તિ હોય છે તે મુજબ જ તેનું મૂલ્ય અંકાય છે એ તો સુવિદિત છે. જેટલી એકાગ્રતા વધુ તેટલું જ તેનું પરિણામ પણ વધુ ઉત્કૃષ્ટ. એટલું જ નહિ, માણસ જો લેશ પણ ચૂક વિના સંપૂર્ણ એકાગ્રતાથી કામ કરી શકે છે તો તેના હાથે જે વસ્તુનું સર્જન થાય છે તે એક પ્રતિભાયુક્ત સર્જન જેવું જ બની રહે છે. અને માનવજીવનની અન્ય પ્રવૃત્તિઓની પેઢે રમત-ગમતોની અંદર પણ પ્રતિભાને સ્થાન હોઈ શકે છે તો પછી આ એકાગ્રતાની શક્તિને સંપૂર્ણ કરવા માટે માણસ એક જ કાર્યની અંદર પોતાને મર્યાદિત કરી રાખે એ સલાહબરેલું ગણાય કે કેમ એ આપણે વિચારવાનું રહે છે.

આવી મર્યાદા સ્વીકારવામાં કેટલાક જાણોતા લાભ પણ છે, પરંતુ સાથે સાથે એમાંથી કેટલાક ગેરલાભ પણ થાય છે તે ધ્યાનમાં રાખવાનું છે. આવી એકદેશીય એકાગ્રતાને લીધે વ્યક્તિમાં સંકુચિતતા આવે છે, પોતે લીધેલા વિષય સિવાય બીજા વિષયમાં તે કશી શક્તિ બતાવી શકતો નથી. અને આ પરિણામ કંઈ ઈચ્છવાયોગ્ય ન ગણાય — આપણે તો એક પૂર્ણ વિકસિત અને સુસંવાદિત માનવનો આદર્શ સેવીએ છીએ. અને આ એકદેશી એકાગ્રતામાંથી આવતું પરિણામ તો તેથી ઊલદું

છે. એટલે પ્રશ્ન એ થાય છે કે આ બે વિસુદ્ધ દિશામાં જતી દેખાતી વસ્તુઓ — એકાગ્રતાનો અને સર્વાંગપૂર્ણતાનો મેળ કરી રીતે બેસાડવો.

આ પ્રશ્નનું એક જ નિરાકરણ દેખાય છે કે કસરતબાજ જેવી રીતે એક શાસ્ક્વીય અને કભિક તાલીમ દ્વારા પોતાના સ્નાયુઓનો પદ્ધતિસર વિકાસ સાધે છે તેવી જ રીતે ધ્યાનની એકગ્રતાને પણ એક પદ્ધતિસરની તાલીમ વડે વિકસાવી શકાય છે. એવી તાલીમને અંતે વ્યક્તિ ગમે તે વિષય ઉપર અને ગમે તે પ્રવૃત્તિમાં પોતાના ઈચ્છાનુસાર એકાગ્રતા સાધી શકે છે. આ એકાગ્રતાની તાલીમ શારીરિક તાલીમથી જુદી રીતે લેવાની હોય છે. શારીરિક તાલીમમાં તો એકની એક કિયાઓનું ધીરી અને મક્કામ રીતે પુનરાવર્તન કર્યે જવાનું હોય છે. અને એ કાર્ય એક અવયેતન અવસ્થામાં જ થતું રહે છે. એકાગ્રતાને વિકસાવવા માટે આ પ્રમાણે ન કરતાં આપણી સંકલ્પશક્તિને આપણે યોજેલા કે નક્કી કરેલા હરકોઈ વિષય ઉપર સંજ્ઞાનપાણો એકાગ્ર કરવાની છે, તે વિષય ઉપર આપણું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ એકાગ્રતાની શક્તિ એ એક તદ્દન સ્વતંત્ર વસ્તુ છે, એ કોઈ પણ આંતર કે બાધ પરિસ્થિતિના ઉપર અવલંબતી નથી. એવી શક્તિ મેળવવી મુશ્કેલ તો જણાય છે જ, પરંતુ તે અશક્ય તો નથી જ. જેનામાં ખંત અને નિશ્ચયબળ હશે તે આ શક્તિ અવશ્ય મેળવી શકશે. અને સફળતા માટેના અનિવાર્ય ગુણો તો આ બે જ છે. માણસ પોતાના વિકાસ માટે ગમે તે પદ્ધતિનો આશ્રય લે, પણ આ બે ગુણો વિના, ખંત અને નિશ્ચયબળ વિના તે કંઈ પણ નહિ સાધી શકે.

અહીંની તાલીમમાં અમે આ એકાગ્રતાના તત્વનો વિકાસ સાધવા માગીએ છીએ. એ વિકાસ એવી રીતે થવો જોઈએ કે વ્યક્તિ હરકોઈ પ્રવૃત્તિ લે, એ પ્રવૃત્તિ ઉપર ઈચ્છાનુસાર પોતાનું ધ્યાન એકાગ્ર કરી શકે, અને તેમાં શક્તિની લેશ પણ ઊણાપ ન આવવા હે, દા. ત. એ શારીરિક પ્રવૃત્તિના ક્ષેત્રમાં કામ કરવા જતાં ગમે તે રમત ઉપર કે પ્રવૃત્તિ ઉપર તે પોતાનું ધ્યાન એકાગ્ર કરી શકે છે, એક રમત કે એક પ્રવૃત્તિ પૂરી કર્યા પછી તે બીજી રમત કે પ્રવૃત્તિ એકસરખી એકાગ્રતાથી હાથ લઈ શકે છે, અને દરેકમાં તે એકસરખી સફળતા પામી શકે છે.

વ્યક્તિ જ્યારે કોઈ રમત-ગમત અથવા તે શારીરિક પ્રવૃત્તિ — ઉતોલન, કૂદગુલાંટ, મુક્કાબાજી, દોડ, ઈત્યાદિમાં અત્યંત એકાગ્રતાપૂર્વક, પોતાની તમામ શક્તિ વાપરીને કામ કરવા લાગે છે, ત્યારે જ તેને તે વિષયમાં સફળતા અને સંપૂર્ણતા મળે છે. એ કિયાઓ દરમિયાન અને એક શારીરિક રોમાંચક આનંદનો અનુભવ પણ થાય છે. પરંતુ સામાન્ય રીતે આ સફળતાનું કારણ એ હોય છે કે ખેલાડીને પોતે લીધેલા વિષયમાં ખાસ રસ રહેલો હોય છે. એ વિષય તેણે કોઈ

ખાસ સંકલ્પપૂર્વક, કે બીજી કોઈ રીતે નક્કી કરીને લીધેલો હોતો નથી. એમાં ઓઝે મેળવેલી સફળતા એ કોઈ સુનિયંત્રિત કિયાને પરિણામે આવી મળેલી હોતી નથી. પરંતુ વ્યક્તિને જો ધ્યાનને એકાગ્ર કરવાની તાલીમ આપી શકાય તો પછી પોતાની દૃઢાધ્યા થતાં અથવા કહ્યો કે તેની પાસે માગાળી થતાં વેંત તે હરકોઈ કિયા કરી શકે છે અને એ દરેકમાં તે હંમેશાં સફળ રીતે પાર પડે છે.

અમારા શારીરિક શિક્ષણ વિભાગમાં અમે આ જ વસ્તુનો પ્રયોગ કરવા માણીએ છીએ. શારીરિક શિક્ષણની પ્રચલિત પદ્ધતિ કરતાં આ પ્રક્રિયા દ્વારા પરિણામ આવતાં વધુ વખત લાગે એ શક્ય છે. પરંતુ આ વિલંબના બદલામાં બેલાડીના કાર્યની અંદર એક સભરતા અને સમૃદ્ધ અવશ્ય પ્રગટશે એમાં શંકા નથી.

(બુલેટિન, એપ્રિલ ૧૯૪૮)

\*

## અમારો ધ્વજ અને અમારું પુંકું

‘બુલેટિન’ના કવર ઉપર જે ધ્વજ મૂક્વામાં આવેલો છે તેની રચના આ પ્રમાણે છે. એક રૂપેરી ભૂરા રંગના ચોરસની અંદર બરાબર મધ્ય ભાગમાં એક પૂરું ખીલેલું સોનેરી કમળ મૂક્વામાં આવેલું છે. એ કમળની પાંદડીઓ બે હારમાં મુકાપેલી છે. અંદરની હાર ૪ પાંદડીની અને બહારની હાર ૧૨ પાંદડીની બનેલી છે.

આ ભૂરો રંગ એ આત્માના ભૂરા રંગનો સૂચક છે, સોનેરી રંગ એ વિશજનની મા ભગવતીનો રંગ છે. ધ્વજની આસપાસ આવેલા પંછાનો રંગ લાલ છે, તે આલોકિત બનેલી શારીરિક ચેતનાનો વાચક છે.

આ ધ્વજ પ્રથમ તો આશ્રમના કીડાદેવના\* ધ્વજ તરફિકે વાપરવા માટે યોજાયો હતો. પરંતુ પછીથી, ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો દિવસ અહીં (૧૫ મી ઓગસ્ટ ૧૯૪૭એ) ઉજવવામાં આવ્યો ત્યારે એમ લાયું કે એ ધ્વજ આખા યે ભારતના આધ્યાત્મિક ધ્યેયને પણ વ્યક્ત કરી રહ્યો છે, એટલે અમારે માટે એ ધ્વજ એક પુનર્જીવિત થયેલા, અખંડ અને વિજયી ભારતના પ્રતીકરૂપ બની રહેલો છે. એ ભારત પોતાની સદીઓ – જૂની ગાઢ નિદ્રામાંથી જાગી રહ્યું છે. ગુલામીની જંજુરોને દૂર ફેરી દઈને તથા એક નવ જન્મની સઘળી યે પ્રસ્વ વેદનામાંથી પસાર થઈને તે પોતાના ભાવિ તરફ ગતિ આદરી રહ્યું છે. આ ભારત હવે એક વાર ફરીથી જગતમાં એક મહાન અને અખંડ રાષ્ટ્ર તરફિક ઉત્થાન પામશે, અને જગતને તથા જગતની માનવતાને ઉચ્ચયાં ઉચ્ચયાં આધ્યાત્મિક આદર્શો પ્રત્યે દોરી જશે.

આવા પ્રતીકથી ભરેલો ધ્વજ ગ્રાપ્ત કરવા માટે અમે અમારું ઘણું અહોભાય્ય સમજુએ છીએ. અને અમે એને અતિ ભાવપૂર્વક સેવીએ છીએ.

(બુલેટિન, એપ્રિલ ૧૯૪૮)

\*

---

\* જ્યનેસે સ્પોર્ટિવ દ લા'શ્રમ શ્રી ઓરોબિન્દો.

## અક્ષય શક્તિ

ખેલાડી પાસે એક ગ્રશ્મ પહેલો હોય છે કે પોતાની શક્તિઓને કેવી રીતે તાજી રાખવી, કેવી રીતે સદા ટકાવી રાખવી. આ બાબતમાં યોગસાધના ખેલાડીને ઘણી જ સમર્થ મદદ આપી શકે છે, યોગ તેને જગતમાં રહેલી વિશ્વરૂપ શક્તિના એક અખૂટ મૂળની સાથે જોડી આપે છે, અને તેમાંથી શક્તિ કેવી રીતે મેળવવી તેનું જ્ઞાન આપે છે.

અર્વાચીન વિજ્ઞાને શરીરના પોષણની કળામાં ઘણી જ મોટી પ્રગતિ કરી છે. અત્યારે ખેલાડી માટે પોતાની શક્તિઓને તાજી કરવાનું સૌથી વધુ જાણીતું સાધન તો આ જ છે. પરંતુ આ પદ્ધતિ ઘણી જ અચોક્કસ છે તેમ જ તેમાં અનેક પ્રકારની મર્યાદાઓ રહેલી છે. એ વિષય પૂરતો ચર્ચાઈ ગયેલો હોવાથી તે વિષયમાં અમે અર્દીં ઉંડા ઉત્તરવા માગતા નથી. પરંતુ એ વસ્તુ તો બધા સ્વીકારે છે કે જ્યાં સુધી જગત તથા મનુષ્યો તેમની અત્યારની સ્થિતિમાં છે તેવાં ને તેવાં જ રહેશે. ત્યાં સુધી શરીરની પુષ્ટિને માટે ખોરાકનું તત્ત્વ અનિવાર્ય જ રહેવાનું. યોગવિદ્યા પાસે શક્તિ મેળવવા માટે આ સિવાય બીજાં સાધનો પણ છે. એમાંથી અમે અતે બે મહિત્તાવનાં સાધનોનો ઉલ્લેખ કરીશું.

એમાંથી પહેલું સાધન આ છે. આ જડ તેમ જ પાર્થિવ જગતની અંદર જે શક્તિઓ એકત્રિત થયેલી છે તેની સાથે આપણે સંબંધમાં આવવું જોઈએ અને એ અક્ષય મૂળમાંથી મુક્તપણે શક્તિનું ગ્રહણ કરતા થવું જોઈએ. આ જડ પ્રકારની શક્તિઓ અંધકારમય છે, અર્દી અચેતન છે. તેમને લીધે માણસમાં પશુભાવને ઉતેજન મળે છે, પણ સાથે સાથે માનવશરીર અને જડ પ્રકૃતિ વચ્ચે એક પ્રકારનો સુમેળભર્યો સંબંધ પણ સ્થાપિત થાય છે. જે લોકો પાસે આ શક્તિઓ જીલવાનું અને તેમનો ઉપયોગ કરવાનું જ્ઞાન હોય છે તેઓ જીવનમાં સામાન્ય રીતે સફળ જ નીકે છે. તેઓ જે કંઈ કામ હાથ ધરે છે, તે પાર પડે છે. આમ છતાં આ માણસોએ મુખ્ય આધાર તો પોતાના જીવનની પરિસ્થિતિ ઉપર તેમ જ પોતાના આત્માયની અવર્થા ઉપર રાખવાનો રહે છે. આ લોકોના જીવનમાં રચાયેલો સુમેળ હુંમેશાં સલામત જ રહેતો નથી. તેના ઉપર હુમલા થઈ શકે છે. વિપરીત સંજોગો હેઠળ એ સુમેળ સામાન્ય રીતે અલોપ પણ થઈ જાય છે. બાળક આ વિશ્વરૂપ શક્તિને આપોઆપ જ જડ પ્રકૃતિમાંથી મેળવતું રહે છે. કશી પણ ગાણતરી કર્યા વિના, કેવળ આનંદપૂર્વક, પોતાની બધી જ શક્તિઓ તે છુટે હાથે વેરતું રહે છે અને સાથે સાથે તે વખતે તે કુદરત તરફથી પ્રાપ્તિ પણ કરતું રહે છે. પરંતુ ઘણાખરા

માણસોમાં ઉમર વધવાની સાથે આ શક્તિ લુપ્ત જેવી થઈ જાય છે. જીવનની ચિંતાઓનો બોજો વધતો જાય છે, માણસની ચેતનામાં માનસિક પ્રવૃત્તિઓ પ્રધાન સ્થાન લેવા લાગે છે. અને વિશ્વપ્રકૃતિ સાથેનો તેનો સંબંધ રૂઘાઈ જાય છે.

પણ જગતમાં આ જડ શક્તિ ઉપરાંત એક બીજી શક્તિ પણ આવેલી છે. એક વાર જો તેનું મૂળ દાય લાગે તો પછી માણસ ગમે તે સંઘેગોમાં, ગમે તેવી સ્થૂલ પરિસ્થિતિમાં પણ તે શક્તિને મેળવી શકે છે. એ શક્તિનું જરણ કદી સુકાઈ જતું નથી. આ શક્તિને આપણે આધ્યાત્મિક શક્તિ તરીકે વાર્ષાવી શકીએ. એ શક્તિ આપણને નીચેની દિશામાંથી, અચેતનાના ઊંડાણમાંથી નહિ, પરંતુ ઉપરના ઊર્ધ્વ પ્રદેશમાંથી મળે છે. એ ઊર્ધ્વ પ્રદેશમાં માનવોનું અને જગતનું પરમ આદિમૂલ રહેલું છે. ઉપરિચેતનાનો એ પ્રદેશ સર્વ સામર્થ્યપૂર્ણ અને શાશ્વત પ્રકાશથી ભરેલો છે. એ ઉપરિચેતના આપણી આસપાસ સર્વત્ર આવી રહેલી છે, દરેક વસ્તુની અંદર તે આરપાર પ્રવેશી રહેલી છે. એની સાથે સંપર્કમાં આવવા માટે, તેને પોતામાં જીલવા માટે આપણે સાચા દિલથી જંખના કરીએ, તેના પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ખુલ્લા થઈએ તેટલું જ જરૂરી છે. એમ કરતાં આપણે આપણી ચેતનાને વિશાળ કરીને વિશ્વરૂપ ચેતના સાથે તેને તદ્વાપ કરી શકીએ છીએ.

આ વસ્તુ કરવી શકું શક્તિમાં કદાચ મુશ્કેલ લાગવા સંભવ છે. પરંતુ તે અશક્ય તો નથી જ. આપણે આ વસ્તુનો સહેજ ઊંડાણથી વિચાર કરીશું તો જણાશે કે જે માનવચેતના નૈસર્જિક રીતે વિકાસ પામી છે તેને માટે આ વિશ્વરૂપ ચેતના એ કોઈ દૂર દૂરની, કોઈ વિજાતિય વસ્તુ નથી. ખરું જોતાં તો જગતમાં એવું કોઈ ભાષ્યે જ હશે કે જેને, કંઈ નહિ તો જીવનમાં એક વાર પણ એ પરમ ચેતનાનો સંપર્ક ન થયો હોય. એ સંપર્ક થતાં માણસ જાણો કે પોતાની જાતથી કંચાંય ઉપર ઉપર ચાલ્યો જાય છે, કોઈ અણાધારી અને અસાધારણ શક્તિ તેનામાં ઊતરી આવી તેને સભર ભરી દે છે. એમ થતાં તે કંઈ નહિ તો થોડીક વખત માટે પણ જગતમાં કોઈ પણ વસ્તુ, કહો કે એકેએક વસ્તુ કરી શકે તેવી શક્તિ ધરાવતો થઈ જાય છે. એવી કણોમાં માણસને કશું જ કઠિન દેખાતું નથી. એવે વખતે ‘અશક્ય’ શબ્દ અર્થરહિત બની રહે છે.

આ અનુભવ, ભલે પછી તે ગમે તેટલો ક્ષણિક રવ્યો હોય તો પણ, માણસને ઊર્ધ્વ શક્તિ સાથે સંપર્ક કેવો હોય તેની અલ્પ ઝાંખી પણ કરાવી આપે છે. યોગની સાધના કરવાથી આ ઊર્ધ્વ શક્તિ સાથે આપણો સંબંધ જોડાય છે અને સ્થાયી બની રહે છે.

આ સંપર્ક ગ્રાપ્ત કરવાની પ્રક્રિયા અને કંઈ લખવું બહુ શક્ય નથી. વળી

યોગસાધના એક તદ્દન વ્યક્તિગત વસ્તુ છે, દરેક વ્યક્તિને માટે એ સાધના જુદી જુદી હોય છે. આ સાધના, માણસ જીવનમાં જ્યાં ઊભો છે ત્યાંથી તેને આગળ ઉપાડે છે. હરેક મનુષ્ય માટે તેની વ્યક્તિગત જરૂરિયાતો મુજબ એ સાધના પોતે રૂપ લે છે અને તેને એક કદમ આગે જવામાં મદદ કરી આપે છે. આ માર્ગ લાંબો છે, કદીક ધીમો પણ છે. પરંતુ એમાંથી જે પરિણામો આવે છે તે જોતાં જગ્યાશે કે તેની પાઇળ લીધેલી બધી મહેનત સાર્થક છે. આ એક સર્વ સમર્થ શક્તિને તેના શુદ્ધ જ્યોતિર્ભવ સ્વરૂપે તેના અસીમ મૂળમાંથી હરકોઈ સંજોગો હેઠળ અને આપણો ઈચ્છાનુસાર પ્રાપ્ત કરવાની શક્તિ જો આપણને મળી આવે તો તેનાં કેવાં પરિણામ આવી શકે તે આપણે સહેલાઈથી કલ્પી શકીએ છીએ. તે પછી, થાક, શ્રમ, માંદગી, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ પોતે પણ માત્ર માર્ગ પરનાં વિઘ્નો રૂપ જ રહે છે. એક સ્થિર સંકલ્પબળ દ્વારા એ બધાંને અવશ્ય પાર કરી શકાય છે.

(બુલેટિન, ઓગસ્ટ ૧૯૪૯)

\*

## સાચી નિર્ણયશક્તિ

રમત-ગમતોની હરીકાઈઓમાં એક મોટો પ્રશ્ન ચુકાદાના ન્યાયીપણા વિષેનો રહે છે.

આવી પ્રવૃત્તિઓમાં ઊભા થતા મતભેદો તથા ઝગડાઓને દૂર રાખવા માટે એક વસ્તુ કાયમને માટે નક્કી કરી દેવામાં આવી છે કે હરીકોએ કશી પણ ચર્ચા વિના પંચ્યોએ આપેલા નિર્ણયને સ્વીકારી લેવો. એમ ન થાય તો — તકરારો થયા વિના રહે જ નહિ. આ પદ્ધતિને લીધે જેમનો ન્યાય તોળવામાં આવે છે તેમનો પ્રશ્ન તો ઊકલી જાય છે, પરંતુ જેમણે ન્યાય તોળવાનો હોય છે તેમને માટે તો પ્રશ્ન ઊભો જ રહે છે. એ નિર્ણયકો જો સત્યનિષ્ઠ હોય તો તેમના ઉપર જેટલો વધુ વિશ્વાસ મુકાય તેટલા જ વધુ તેમણે પોતાના નિર્ણયોને સંપૂર્ણ રીતે સાચા બનાવવા માટે સાવધાન રહેવાનું રહે છે. આ રીતે જોતાં, અમુક પ્રસંગોમાં, રમત-ગમતોની સાથે જેને કશો જ સંબંધ નથી તેવાં ઈતર કારણોસર જ્યાં પહેલેથી જ નિર્ણયો લેવાઈ ચૂકેલા હોય છે તે પદ્ધતિને હું વિચારણામાંથી તદ્દન બાતલ જ રાખું છું. એ એક કમનસીબી છે કે, આ પદ્ધતિનો ઉપયોગ ઘણી વાર થતો રહે છે, છતાં એ બાબતમાં તે બધા સંમત થશે કે આ એક નીચ વસ્તુ છે અને મનુષ્યનું ગૌરવ એ માગી લે છે કે આવી વસ્તુ બિલકુલ બંધ થવી જ જોઈએ.

સામાન્ય રીતે એમ માની લેવામાં આવે છે કે પંચ પોતાનો નિર્ણય જો તે તે વસ્તુ અંગેના પોતાના ઊંડા વિશિષ્ટ જ્ઞાનને આધારે અને પૂરતી તટસ્થતા જગાવીને કરતું હોય તો તો બધું બરાબર જ ગણાય. આવો નિર્ણય વ્યક્તિ પોતાની ઈન્દ્રિયોના જ્ઞાનને આધારે કરતી હોય છે. સામાન્ય રીતે એ જ્ઞાન વિષે તો કોઈ ભાષ્યે જ શંકા ઉઠાવે છે. પરંતુ હકીકત તો એ છે કે જ્ઞાનની આ પદ્ધતિ હંમેશાં ક્ષતિરહિત જ હોય છે એવું નથી. માણસની ઈન્દ્રિયો તેની માનસિક અવસ્થાના સીધા પ્રભાવ હેઠળ જ કામ કરતી હોય છે. અને તેથી વ્યક્તિ પોતે જે વસ્તુ જોતી હોય છે તે પરત્યે તેને સારી કે નરસી જે પ્રકારની લાગણી હોય છે તે મુજબ જ તેની ઈન્દ્રિયો તે વસ્તુને જુએ છે, અને તે પ્રમાણે તેના એ દર્શનમાં પણ ફેરફાર, વિકૃતિ કે અસત્યનો પ્રવેશ થાય છે.

ઉદાહરણ તરીકે, જે પંચો અમુક સંસ્થાનાં કે સમૂહનાં અંગભૂત હોય છે તેઓ પોતાના સમૂહના લોકો તરફ કાં તો અતિ ઉદાર હોય છે કાં તો અયોધ્ય રીતે અતિકર્તક પણ હોય છે. સત્યની કસોટીએ જોતાં તો આ પ્રકારની ઉદારતા કે કઠોરતા બંને સરખી વસ્તુઓ છે. એ બંને પ્રસંગોમાં વ્યક્તિએ લીધેલો નિર્ણય લાગણીને

આધારે થયેલો હોય છે, તેની પાછળ હકીકતનું એક વસ્તુનિષ્ઠ અને આસક્તિયુક્ત દર્શન નથી હોતું. આ તો જાણે કે બહુ સ્પષ્ટ વાત જ છે, પરંતુ આવી તદ્દન છેલ્લી હંદની વાત ન લઈએ તો પણ આપણે જોઈશું કે કોઈ પણ માનવ વ્યક્તિ, સિવાય કે તે યોગી હોય, આવાં આકર્ષણો અને વિરુદ્ધ ભાવોથી મુક્ત હોતી નથી. આ વસ્તુઓ જો કે વ્યક્તિની સક્રિય ચેતનામાં કામ કરતી ભાવ્યે જ પકડી શકાય છે છતાં ઈન્દ્રિયોની કિયાઓ ઉપર તેમને ઘણી જ મોટી અસર પડતી હોય છે.

જે માણસ ગમા અને આણગમાથી, ઈચ્છાઓથી અને અભિરૂચિઓથી પર થઈ શક્યો હોય તે જ સંપૂર્ણ નિષ્પક્ષ રીતે વસ્તુઓ જોઈ શકે છે. એવી વ્યક્તિની ઈન્દ્રિયો, કોઈ અત્યંત નાજુક અને સંપૂર્ણ યંત્રની માફક, કેવળ શુદ્ધ વસ્તુનિષ્ઠ ભાવથી કાર્ય કરતી હોય છે, અને યંત્ર કરતાં તેમને એક વધુ લાભ એ હોય છે કે તેની પાછળ એક જીવંત ચેતનાની સ્પષ્ટ દૃષ્ટિ ઉમેરાયેલી હોય છે.

આ બાબતમાં પણ યૌનિક સાધના આપણી મદદમાં આવી શકે છે અને તેની સહાયથી આપણે એવી ઉન્નત કોટિનું ચારિન્ય સરળ શકીએ છીએ કે જેને લઈને વ્યક્તિઓ સત્યના કરણ તરીકેનો ભાગ ભજવી શકે છે.

(બુલેટિન, નવેમ્બર ૧૯૪૮)

\*

## ઓલિમ્પિકની કડીઓ

ઓલિમ્પિકના પ્રતીક ચિહ્નમાંની પાંચ કડીઓ વિષે, એવી વિધિસરની જાહેરાત કરવામાં આવી છે કે એ કડીઓ જગતના પાંચ ખંડોની વાયક છે. પરંતુ એ કડીઓના રંગ સાથે કોઈ ખાસ અર્થ જોડવામાં આવ્યો નથી તેમ જ દરેક ખંડને માટે તેને કોઈ ખાસ રંગ નક્કી કરી આપવાનો હેતુ રખાયો નથી.

આમ છતાં આ રંગોનો અભ્યાસ એ રસિક વિખ્ય બની શકે તેમ છે, આપણે જોઈએ કે આ રંગોની પાછળ શું રહસ્ય હોઈ શકે અને એમાંથી કોઈ સંદેશ મળી શકે કે નહિ.

એ વાત તો ઠીક ઠીક જાણીતી છે કે દરેક રંગને તેનું પોતાનું રહસ્ય હોય છે. પરંતુ એ રહસ્ય ઘટાવનાર જુદા જુદા લોકોએ રંગોને જે અર્થ આપેલા છે તે બહુ જુદી જુદી જતના છે અને કેટલીકવાર એક બીજાથી ઉલટા પણ છે. આ રંગોનાં રહસ્યોનું એક સર્વમાન્ય વર્ગીકરણ હજી જોવામાં આવતું નથી. રંગોના આમ વિવિધ અને વિરુદ્ધ અર્થો ઊભા થવાનું કારણ એ છે કે સામાન્ય રીતે રંગોને મનના દૃષ્ટિબિન્દુથી જ જોવામાં આવે છે, કંઈ નહિ તો એ રહસ્યશોધન ઉપર અર્થ ઘટાવનારના મનની છાયા તો પેલી હોય છે જ. પરંતુ આપણે જો મનથી ઉપર આવી રહેલા સાચા ગૂઢ પ્રદેશમાં જઈ શકીએ, તો પછી દરેક રંગ પાછળનો સાચો અર્થ, એ રંગોને સીધેસીધા સમજી શકનાર સૌ કોઈને માટે એક જ પ્રકારનો પ્રગટ થશે. કેવળ રંગોની બાબતમાં જ નહિ, પણ આધ્યાત્મિક તેમ જ ગૂઢ પ્રકારના સર્વ અનુભવોને અંગે પણ આ વાત સાચી છે. જુદા જુદા કાળના તથા સ્થળના રહસ્ય-દ્રષ્ટાઓને જે આધ્યાત્મિક અનુભૂતિઓ મળેલી છે તે બધાની અંદર આપણે જોઈએ છીએ કે એક ઘણું જ ધ્યાન ખેંચે તેવું સાચ્ય રહેલું છે.

એટલે જો ઓલિમ્પિક પ્રતીક ચિહ્નની કડીઓના રંગોને આ દૃષ્ટિથી જોવામાં આવે તો તેમનો સાચો ગૂઢ અર્થ મળી શકે તેમ છે અને એ રંગો જગતના ખંડોને કેવી રીતે લાગુ પડે છે તેનો અભ્યાસ પણ કરી શકાય છે.

લીલો રંગ એક વિશાળ અને શાંતિપ્રધાન ભાવનો સૂચક છે. કુદરતની સાથે એનો એક ઘણી જ સુસંવાદિત રીતે સીધો સંબંધ છે, તે એક વિશાળ ખુલ્લા પ્રદેશવાળા ખંડનો વાયક બની શકે છે. તેમાંની પ્રજા કુદરત તેમ જ ધરતીની સાથે ઘણા નિકટના સંબંધમાં રહેનારી છે, તેમ જ ભિથ્યા વિચારસરણીથી દૂષિત બનેલી હોતી નથી.

લાલ એ શારીરિક તેમ જ સ્થૂલ જડ તત્ત્વનો રંગ છે, એટલે જે પ્રજાએ સ્થૂલ પદાર્થો ઉપર ખૂબ ગ્રાન્યુન્યુ હોય તેને એ રંગની કડી આપી શકાય. વળી આ

ભौતિક સફળતાને લીધે તે પ્રજાને બીજુ પ્રજાઓ ઉપર કઈ રીતે આધિપત્ય મળ્યું છે તે પણ આ રંગ સૂચિત કરે છે. કંઈ નહિ તો એ રંગ અતિ સ્થૂલ અને ભौતિક પદાર્થો વિષે આગ્રહ સેવતી પ્રજાનો વાચક તો છે જ.

એથી ઊલદું, ભૂરો રંગ એક ઊછરતી જુવાન પ્રજાના ખંડનો સૂચક છે. એ પ્રજા પાસે હજુ મોકણું ભાવિ પેઢલું છે, તેને માટે ઘણી ભાવિ શક્યતાઓ રહેલી છે. પરંતુ એ પ્રજા હજુ ઘણી જ અપકવ છે અને હજુ તો તે વિકાસના તબક્કાઓમાંથી જ પસાર થઈ રહેલી છે.

આ કઢીઓમાં કાળા રંગની પસંદગી સૌથી કમનસીબ વસ્તુ છે. એ રંગ એક ગાઢ અંધકારમાં વેગપૂર્વક ગરક થઈ રહેલી પ્રજાના ખંડનો જ સૂચક બની શકે. એક અવનતિ પામી રહેલી પ્રજા કાળી વિસ્મૃતિની અંદર ઊતરી રહી છે એમ જ તે સૂચવે છે.

આથી ઊલદું, પીળો રંગ એ સૌથી વધુ ઉજજવલ રંગ છે. એ છે પ્રકાશનો સુવર્ણ રંગ. સર્વ પદાર્થના મૂળ રૂપ અને આરેબ રૂપ એવા તત્ત્વમાંથી એ પ્રકાશ આવી રહેલો છે અને પોતાના કરુણાળું હસ્ત વડે, વિકાસ પામી રહેલી માનવતાને તેના આદિ દિવ્ય સ્વરૂપ તરફ તે પાછો દોરી જવાનો છે.

આ કઢીઓની ગોઠવણી પાછળ પણ એક રહસ્ય છે. આ બધાંમાં કાળો રંગ વચ્ચેના ભાગમાં આવી રહેલો છે. અને તે બીજા રંગોને આધાર આપી રહેલો છે. આ ખરેખર બહુ જ સૂચક છે. આજે જગતમાં એક કાળી અંધાધુદી વ્યાપી રહેલી છે, અવિદ્યાના અંધારા સમુદ્રો ઉપર માનવજીતના વહૃણને દોરવા માટે આજે જેઓ ઝૂઝી રહેલા છે તે આજે અંધકારગ્રસ્ત છે. અને એ સ્થિતિ આ કાળા રંગની મધ્યરસ્ય કરી દ્વારા બરાબર વ્યક્ત થાય છે.

અમારી એ આશા છે કે ભવિષ્યમાં આ કાળી કઢીને સ્થાને એક સફેદ કડી મુક્વામાં આવશે. જગતમાં માનવજીવનના પ્રવાહુમાં એક નવો પલટો આવશે, એક નૂતન પ્રકાશની ઉધા આવીને અંધકારના ઓછાયાઓને ઓગાળી નાખશે. એ પ્રકાશ તે એક નૂતન ચેતનાનો તેજસ્વી, ધવલ, સ્વયં પ્રકાશિત પ્રકાશ હશે. અને તે વખતે જગતની નૌકાના સુકાન ઉપર એવી વ્યક્તિઓ હશે કે જેઓ એ ઝળહળતા પ્રકાશની સામે મીટ માંડીને જોઈ શકતી હશે, અને એ સ્વર્ગીય ભૂમિના કિનારે પહુંચેવા માટેનો સાચો પંથ દર્શાવી શકતી હશે.

(બુલેટિન, નવેમ્બર ૧૯૪૮)

## જય ચંદ્રક

આશ્રમ કીડા દલની આ સત્ર દરમિયાન યોજાયેલી રમતગમતોની સ્પર્ધાઓમાં, દરેક પેટા દલમાં નેતા બનેલ વ્યક્તિને ઈનામ રૂપે એક જય ચંદ્રક આપવામાં આવેલો.

આ ચંદ્રક એક સુનેરી કાચબાના રૂપનો છે. એના કેન્દ્રમાં એક સંપૂર્ણ લાલ વર્તુળ છે અને એ વર્તુળમાંથી બાર સફેદ કિરણો પ્રસરી રહેલાં છે. એ ચંદ્રકની છબી અહીં નીચે આપવામાં આવી છે. આ ચંદ્રકના આકાર અને રંગ પાછળ એક ગૂઢ રહસ્ય રહેલું છે અને તેનો અર્થ નીચે મુજબ ઘટાવી શકાય છે.

કાચબો એ સૃષ્ટિગત અમૃતત્વનું, એટલે કે આ પૃથ્વી ઉપર પ્રગટેલી શરીરધારી ચેતનાના અમૃતત્વનું પ્રતીક છે. એમાંનો કેન્દ્ર રૂપ લાલ ભાગ આલોકિત બનેલા જડ તત્ત્વના પ્રતીક રૂપે છે અને એની અંદરથી પરમ સત્યના સર્વાંગ પૂર્ણ પ્રકાશનાં બાર સફેદ કિરણો પ્રસરી રહ્યાં છે. કિરણોની વાંકી રેખાઓ એ સૂચવે છે કે આ પ્રકાશ ગતિરીલ પ્રકારનો છે અને તે સક્રિય બનેલો છે.

કાચબાનો પોતાનો સોનેરી રંગ પણ એ સૂચવે છે કે આ સૃષ્ટિગત અમૃતત્વને આધાર આપી રહેલું તત્ત્વ તે અતિમાનસ પોતે જ છે અને જે રૂપાંતર સધાવાનું છે તે માત્ર તે જ સાધી આપી શકે તેમ છે.

(બુલેટિન, નવેમ્બર ૧૯૪૯)

\*

## સ્પર્ધાઓ

જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ માસ આપણે માટે રમતગમતની સ્પર્ધાઓના માસ છે. નાનાંમોટાં સૌ કોઈ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લે છે, પરંતુ મારે કહેવું જોઈએ કે તેઓ સામાન્ય હરીકોની ભાવનાપૂર્વક એમ કરતાં નથી. કારણ કે આપણે હમેશાં, કેવળ જીતવાને માટે જ નહિ, પરંતુ આપણાથી જેટલી સારી રમત રમી શકાય તેટલી રીતે રમવા અને એ રીતે એક નવીન પ્રગતિનો માર્ગ ખુલ્લો કરવા રમીએ છીએ.

આપણે સફળતા વાંદ્ધતા નથી. આપણે પૂર્ણતા જોઈએ છે.

આપણે કીર્તિ કે લોકમાન્યતા જોઈતી નથી; આપણે હિવ્ય આવિર્ભાવ માટે તૈયાર થવું છે. માટે જ આપણે નિર્ભયતાથી કહી શકીએ છીએ કે, દેખાવા કરતાં બનવું વધુ સારું છે. આપણા અંતરમાં પૂર્ણ સચ્ચાઈ હોય તો સારા દેખાવાનો તોળ કરવાનો જરૂર નથી. અને પૂર્ણ સચ્ચાઈ શાખ વડે આપણે એમ કહેવા માગીએ છીએ કે આપણા સર્વ વિચારો, લાગણીઓ, સંવેદનો અને કર્મોએ આપણા સ્વરૂપના કેન્દ્રસ્થ સત્ય કરતાં બીજું કાંઈ પ્રગટ ન કરવું જોઈએ.

(બુલેટિન, એપ્રિલ ૧૯૫૦)

\*

## યુવક કિડાદલની\* પ્રાર્થનાઓ અને ઉત્તરો

**દલ એ :** મધુર માતાજી, આપે અમારે માટે અપાર શ્રમપૂર્વક એક માર્ગ રચ્યો છે. એ મહાસમર્થ પંથ છે, એને અંતે ધ્યેયની ગ્રાપ્તિ અવશ્ય આવવાની જ છે. આપે અમારા માટે એ માર્ગ નિષ્કંટક બનાવી દીધો છે. બધી મુજ્જેલીઓ, બધાં જોખમો હઠાવી લીધાં છે, જ્યારે અંતિમ વિજય પ્રાપ્ત થશે ત્યારે એ માર્ગ અમને ઠેઠ અનંતતા સુધી લઈ જશે.

માતાજી, અમને હુમેશાં ગ્રાણવંત રાખો કે જેથી તમે બાંધેલા માર્ગ પર અમે વગર અટક્યે આગળ વધ્યે જ જઈએ.

**શ્રી માતાજી :** મારાં નાનકડાં બાળકો, તમે જગતની આશા છો, જગતનું ભાવિ છો. આ યૌવન હુમેશાં જાળવી રાખો. એ યૌવન જ પ્રગતિનું સાધન છે. તમારે માટે ‘અશક્ય’ શબ્દનો કશો અર્થ નહિ રહે.

(૨૨ એપ્રિલ ૧૯૪૮)

\*

**દલ બી :** મધુર માતાજી, અમે આપના વફાદાર સૈનિક થવા માગીએ છીએ. અમે આપના અંતિમ વિજય સુધી લડતા રહીશું. જ્ય હો, મધુર માતાજીનો.

**શ્રી માતાજી :** મારા બહુદુર નાનકડા સૈનિકો, મારી તમને સલામ છે. લો આ મારો કોલઃ હું તમને વિજયના મોરચા પર મળીશ.

(૩ એપ્રિલ ૧૯૪૮)

\*

**દલ સી :** પ્રભુ, તારા પરમ સેવકોમાંથી તમામ અજ્ઞાનને દૂર કર. એમની વિશુદ્ધિના ધ્વજને ટૂંકમાં ટૂંક માર્ગ થઈ સાક્ષાત્કારના ઉંબર ઉપર પહોંચાડ. તારી દીરછા સફ્લ થાઓ, અમારી નહિ.

**શ્રી માતાજી :** જેમાણે પોતાની અંદરની તમામ પશુતા ઉપર વિજય મેળવ્યો હશે અને એ પશુતાને વટાવી ગયા હશે તેમને જ પ્રભુ ‘પરમ સેવકો’નું બિરુદ આપશો. હુમણાં તો આપણે પ્રભુના વફાદાર અને સાચા સેવક બનીએ ઓટલું જ માગીએ. આ નાનકડો કાર્યક્રમ આપણે પરો કરી લઈશું ત્યાર પછી આપણે વધુ

\* આ દલોની સંબંધા મૂળમાં હતી તે પ્રમાણેની છે. ત્યાર પછી તેમનું પુનર્ગંઠન કરવામાં આવેલું છે.

મોટા સાક્ષાત્કારો માટે યોગ્ય બનીશું.

(૨૩ એપ્રિલ ૧૯૪૯)

\*

**દલ ડી :** મધુર માતાજી, અમે ઈચ્છીએ છીએ આપના પરાક્રમી યોગ્ય બનવા અમે ઠેઠ અંતિમ વિજય સુધી આપની પાછળ પાછળ ચાલ્યા આવીશું.

**શ્રી માતાજી :** આપણે સૌ સાચા દિલથી વિજય તો માગીએ છીએ. પરંતુ એ વિજય ક્રમે ક્રમે જ આવી શકે છે. અને એ માટેનું પ્રથમ પગથિયું છે સંપૂર્ણ શિસ્ત. તમારો નવો ગણવેશ એ શિસ્તના સેકેતર્યપ બની રહો.

(૧૭ એપ્રિલ ૧૯૪૯)

\*

**દલ ડી-જી :** મધુર માતાજી, અમે આપના નાનાં બાળકો છીએ, આપના સર્વશક્તિમાન પ્રકાશને ઝંખી રહ્યાં છીએ. અને મધુર માતાજી, આપે અમને અંતિમ વિજયનું અભય વચન આપ્યું છે. આપનો એ સંકલ્પ છે કે અમે આપના વફાદાર, સાચા બહાદુર અને શિસ્તબદ્ધ સૈનિકો બનીએ.

મધુર માતાજી, તો લો આ અમારું વચન. અમે આપના આવા સૈનિકો બનવાની પ્રતિજ્ઞા કરીએ છીએ. આપના હૃથમાં અમારી જાત સર્વ ભાવે સોંપી દઈએ છીએ. અમારા નિર્ણયને પાર પાડવાની શક્તિ આપો.

**શ્રી માતાજી :** તમારું વચન હું સ્વીકારી લઉં છું. તમારી પ્રતિજ્ઞા પૂર્ણ કરવામાં તમને મારી સહાય હંમેશાં મળતી રહેશે. ઘડપણ તો જેઓ ઘરડા થવાનું પસંદ કરે છે તેમને માટે જ હોય છે.

આગેકદમ, સદાય આગેકદમ. ભય અને સંકોચ તજી દો, અને ચાલ્યા જાઓ આગે, આગે.

(૨૨ એપ્રિલ ૧૯૪૯)

\*

**દલ ડી-કે :** મા ભગવતી, આ છે અમારી પ્રાર્થનાઃ અમને તારા આજ્ઞાધીન અને સાચા સૈનિકો બનાવ. આસુરી બળો સામે લડી લેવા માટે, તારો વિજય મેળવવા માટે તારી શક્તિ અમારી મદદે આવો. જ્ય હો માતાજીનો!

**શ્રી માતાજી :** સદાય વફાદાર રહો, ખંતીલા રહો. તમને પણ અંતિમ

સાક્ષાત્કારમાં તમારો હિસ્સો મળશે.

(૨૨ એપ્રિલ ૧૯૪૯)

\*

**દલ ઈ :** અમારી આ ઠચ્છા છે, તારે અમને જે બનાવવા હોય તે બનાવ.

**શ્રી માતાજી :** તમારી શુભ ભાવનામાં મને સંપૂર્ણ વિશ્વાસ છે. મારી સહાયમાં તમે વિશ્વાસ રાખો.

\*

**કપ્તાનોનું દલ :** શારીરિક શિક્ષણના કપ્તાનો:

**શ્રી માતાજી :** તમારે ચુનંદા સૈનિકો બનવું જોઈએ અને બની શકશો પણ ખરા. હું એમ વિચારતી હતી કે આશ્રમમાં એવી સર્જ કેન્દ્રસ્થ નાભિ હોવી જોઈએ જે આસપાસ સર્વ કાંઈ રચાય. આ શારીરિક શિક્ષણના કપ્તાનો આવું કેન્દ્ર બની શકે તેમ છે. તેમની સંખ્યા ભલે મોટી ન હોય, પરંતુ, એમને ચૂંટીને પ્રથમ કક્ષાના, અતિમાનવત્ત્વ માટેના ઉમેદવારો ગણવા જોઈએ. તેઓએ પોતાની જાતનું સર્વશો સમર્પણ કરી દેવા તૈયાર રહેવું જોઈએ, પ્રભુના કાર્ય માટે કાંઈ પણ પોતાને માટે બચાવી રાખવું જોઈએ નહિ. હું તમારી પાસેથી આની અપેક્ષા રાખું છું, તમારો કાર્યક્રમ આ હો.

(માર્ચ ૧૯૬૧)

\*

**“મધુર માતાજી :** અમે સૌ મળીને આપે અમારા માટે જે લક્ષ્ય બાંધી આપ્યું છે તે માટે કાર્ય કરવાની અભીપ્સા સેવીએ છીએ. અમને જરૂરી ચીવટ, દિંમત, ખંત અને શુભેચ્છા આપો કે જેથી આ ઉમદા કાર્ય કરી શકીએ. અમારી અંદર એવી જ્યોતિ પ્રગટાવો કે જે સર્વ અવરોધોને બાળી નાખે અને અમને આપના વફાદાર સેવકો બનાવે.”

મારાં બાળકો,

આપણે સૌ એક જ લક્ષ્યની પ્રાપ્તિ માટે જોડાયેલાં છીએ, આપણે એક જ સિદ્ધ જોઈએ છે — એક અનન્ય અને નૂતનકાર્ય કે જે પ્રભુની કૃપા વડે જ સિદ્ધ થઈ શકે. હું આશા રાખું છું કે તમે આ કાર્યની અસાધારણ અગત્યને વધુ ને વધુ

પ્રમાણમાં સમજતા થશો અને એ કરી શકવામાં જે ઉમદા આનંદ પ્રાપ્ત થાય છે તેનો તમને અનુભવ થશે.

પ્રભુનું બળ તમારી સાથે છે — એની હાજરીને વધુ ને વધુ અનુભવતા થાઓ અને કદ્દી પણ એની અવજ્ઞા ન થાય તેની કાળજી રાખો.

તમે નૂતન જગતની સિદ્ધિ માટેનાં નવાં સ્વરૂપો બની રહો તે માટેની લાગણી, આકાંક્ષા અને કર્મને સેવો અને એ કાર્યમાં મારા આશીર્વાદ હુંમેશાં તમારી સાથે રહેશે.

(૨૪ એપ્રિલ ૧૯૬૧)

\*

## સ્પર્ધાઓ પ્રસંગે સંદેશા

### કુસ્તી ૧૯૫૮

સ્થૂલ આંખ જે કાંઈ જોઈ શકે છે તેની પાછળ એક એવું સત્ય છે જે વધુ સધન અને ટકાઉ છે. આજે હું એ સત્યમાં તમારી સાથે છું અને આખી યે સૌઝન દરમ્યાન રહેનાર છું. શક્તિ, બળ, જ્યોતિ અને ચેતના તમારી વચ્ચમાં રહેશે. એ સતતપણે દરેકને તેની ગ્રહણશીલતા પ્રમાણે તેના પ્રયત્નોમાં સફળતા આપશે અને સર્વ સાચા દિલના પ્રયત્નો શિરમોર પરિણામ રૂપે જે પ્રગતિ પ્રાપ્ત કરવાની છે તે પ્રાપ્ત કરાવશે.

(૧૯ જુલાઈ ૧૯૫૮)

\*

### વ્યાચામ ૧૯૫૮

આજે મેં જે વસ્તુ કુસ્તીના પ્રસંગે કહી તે જ વસ્તુ વ્યાચામની દરીફાઈઓને લાગુ પડશે. હું આખા યે પ્રસંગ દરમ્યાન તમારી સાથે રહીશ અને તમારા પ્રયત્નોમાં સહાય કરતાં કરતાં તમારી કસરતો જોવાનો આનંદ લઈશ.

મારા આશીર્વાદ સાથે.

(૧૬ ઓક્ટોબર ૧૯૫૮)

\*

### કુસ્તી ૧૯૬૦

મારી શક્તિ, સહાય અને આશિષ સાથે લઈને આનંદ અને વિશ્વાસપૂર્વક સૌ પોતાથી બનતું સારામાં સારું કાર્ય કરે.

(૨૧ ઓગસ્ટ ૧૯૬૦)

\*

### કુસ્તી ૧૯૬૨

પ્રથમ આવવાની મહત્વાકાંક્ષાને સ્થાને પોતાથી શક્ય તેટલું ઉત્તમ કરવાને મૂકો.

વિજયને સ્થાને પ્રગતિ માટેની આકાંક્ષા મૂકો.

ક્રીતિની લાલસાને સ્થાને પૂર્ણતાની અભીષ્ટા મૂકો.

શારીરિક શિક્ષણનો હેતુ શરીરમાં ચેતના અને કાબૂ શિસ્ત, પ્રભુત્વ અને બીજી ઊર્ધ્વ જીવનને માટે જરૂરી વસ્તુઓ આણવાનો છે.

એ સર્વને ધ્યાનમાં રાખો, ખરા હૃદયથી પ્રેક્ટિસ કરો અને તમે એક ઉત્તમ પહેલવાન બનશો; સાચા મનુષ્ય બનવાના માર્ગનું આ પ્રથમ સોપાન છે.

આશીર્વાદ.

(૧૫ જુલાઈ ૧૯૬૨)

\*

### કુસ્તી ૧૯૬૩

જે કોઈ લોકો પોતાના દેહને દિવ્ય જીવન માટે તૈયાર કરવા ઈરછતા હોય તેમને મારો આ સંદેશ છે કે તમને મળેલી આ કુસ્તીની હરીફાઈની ઉત્તમ તકને ચૂકશો નહિ અને કદી પણ ભૂલશો નહિ કે આપણે જે કાંઈ કરતા હોઈએ તેમાં પૂર્ણતા માટેની અભીષ્ટા રાખવાની છે. કારણ કે પૂર્ણતા માટેની આ જંખના જ, ગમે તે મુશ્કેલીઓ હશે તો પણ, આપણને આપણા પ્રત્યે દોરી જશે.

આશીર્વાદ.

(૨૧ ઓગસ્ટ ૧૯૬૩)

\*

### કુસ્તી ૧૯૬૪

આપણે અહીં એક નૂતન જગતનું સર્જન કરવા માટે આવ્યાં છીએ.

કુસ્તીમાં સફળ થવા માટે જે કોઈ ગુણ અને કુશળતાની જરૂર પડે છે, બરાબર તેવા જ ગુણોની દેહધારી મનુષ્યને નૂતન શક્તિને જીલવા અને અભિવ્યક્ત કરવા માટે જરૂર પડે છે.

હું અપેક્ષા રાખું છું કે આ જ્ઞાન અને ભાવના સાથે તમે આ હરીફાઈઓમાં ઉત્તરશો અને સફળતા પ્રાપ્ત કરશો.

મારા આશીર્વાદ તમારી સાથે છે.

(૨૪ ઓગસ્ટ ૧૯૬૪)

\*

### વ્યાયામ ૧૯૬૪

૧૮મી ઓક્ટોબર સારો દિવસ છે.

વ્યાયામ એ એક સારી કળા છે.  
અને તમે સારા કસરતબાજો બનશો.  
આશીર્વાદ.

(૧૮ એપ્રિલ ૧૯૬૪)

\*

### હરીકાઈઓ ૧૯૬૬

એ વસ્તુ યાદ આપવી ઠીક રહેશે કે આપણે અહીં એક વિશિષ્ટ કાર્ય માટે આવેલાં છીએ. એ કાર્ય એવું છે જે બીજે કોઈ ઠેકાગે થતું નથી.

આપણે પરમ ચેતના અને વિશ્વ ચેતનાના સંપર્કમાં આવવું છે, આપણે એમને આપણી અંદર ઉતારી લાવીને વ્યક્ત કરવી છે. પરંતુ તેમ થઈ શકે તે માટે આપણો પાયો ખૂબ મજબૂત જોઈએ. આપણો પાયો તે ભૌતિક સ્વરૂપ યા શરીર છે. માટે આપણે એવું શરીર રચવું છે જે સુદૃઢ, તંદુરસ્ત, ટકાઉ, ચપળ, કુશળતાપૂર્ણ અને મજબૂત હોઈ દરેક વસ્તુને માટે તૈયાર હોય. શારીરિક વ્યાયામ કરતાં બીજો કોઈ માર્ગ દેહને તૈયાર કરવા માટે ઉપયોગી નથી : રમત ગમતો, વ્યાયામ, કુસ્તી અને જે બીજી બધી રમતો આપણા દેહને વિકસાવે અને બળવાન બનાવે તે.

માટે આજથી શરૂ થતી હરીકાઈઓમાં હું તમને સાદ કરીને કહું છું કે ખરા હૃદયપૂર્વક અને તમારી સર્વ સંકલ્પશક્તિ એકઠી કરીને પાર પડો.

(૧ એપ્રિલ ૧૯૬૬)

\*

### હરીકાઈઓ ૧૯૬૭

શારીરિક શિક્ષણ અને રમતગમતની પ્રવૃત્તિઓના પ્રસંગે :

મારે ફરી એક વાર તમને કહેવું જોઈએ કે આપણા માટે આધ્યાત્મિક જીવન એટલે પાર્થિવતત્વ પ્રત્યે તિરસ્કાર નથી પરંતુ એને દિવ્ય બનાવવાની ભાવના છે. આપણે દેહને પડતો ભૂકવો નથી પણ એનું ઝૂપાંતર કરવું છે. આ કાર્ય માટે શારીરિક કેળવાણી સૌથી સીધી અસર ઉપજાવનારૂં સાધન છે.

માટે હું તમને આજથી શરૂ થતા કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ આપું છું, શિસ્ત અને ઉત્સાહ સાથે આવો, શિસ્ત – કારણ કે વ્યવસ્થા માટેની એ અનિવાર્ય જરૂરિયાત છે; ઉત્સાહ – કારણ કે સફળતા માટેની એ અનિવાર્ય શરત છે.

આશીર્વાદ.

(૧ એપ્રિલ ૧૯૬૭)

\*

### હરીફાઈઓ ૧૯૬૮\*

શક્તિની પ્રાપ્તિ માટેની પ્રથમ શરત આજ્ઞાપાલન છે.

શરીર દ્વારા શક્તિની અભિવ્યક્તિ થઈ શકે તે પહેલાં તેણે આજ્ઞાધારક થતાં શીખવું જોઈએ. અને શારીરિક શિક્ષણ એ શરીરને માટેની ઉત્તમ અને સંપૂર્ણ શિસ્ત છે.

એટલે તમારા શારીરિક શિક્ષણના પ્રયત્નોમાં તત્પર અને સાચિદિલ બનજો કે જેથી તમને એક શક્તિશાળી દેહ પ્રાપ્ત થાય.

મારા આશિષ તમારી સાથે છે.

(૧ એપ્રિલ ૧૯૬૮)

\*

### હરીફાઈઓ ૧૯૬૯

આ વર્ષની શરૂઆતથી આ પૃથ્વી ઉપર એક નવીન ચેતના, મનુષ્યોને નૂતન સર્જન માટે તૈયાર કરવા માટે કિયાશીલ છે. એ નૂતન સર્જન એટલે અતિમાનવ. આ સર્જન સફળ બની શકે તે માટે, મનુષ્યના દેહમાંનો પદાર્થ ઘણો ઘણો પરિવર્તિત થવો જોઈએ, અને એ ચેતનાને વધુ ઝીલી શકવું જોઈએ અને એ ચેતનાની કિયા પ્રત્યે વધુ નમનીય બનવું જોઈએ.

શારીરિક કેળવણી દ્વારા જ આ ગુણો પ્રાપ્ત થઈ શકે છે.

એટલે આપણે આ શિસ્તનું એવા પરિણામને નજરમાં રાખીને પાલન કરીશું તો આપણને ખાતરી છે કે આપણને અત્યંત રસદારી પરિણામ પ્રાપ્ત થશે.

સૌને મારા આશિષ, પ્રગતિ માટે, પ્રાપ્તિ માટે.

(૧ એપ્રિલ ૧૯૬૯)

\*

\* મૂળ અંગ્રેજ પુસ્તકમાં આ સંદેશ શ્રી માતાજીના હસ્તાક્ષરનો બ્લોક બનાવીને છાયો છે.- અનુવાદક.

## હરીકાઈઓ ૧૯૭૦

આપણે આપણાં વિકાસ પામતાં શરીરો કરતાં બીજી કઈ વધુ સારી બેટ પ્રભુને ધરી શકીએ?

આપણે આપણા પ્રયત્નોને પૂર્ણતા પ્રત્યે સમર્પિત કરી દઈએ, અને શારીરિક કેળવણી આપણે માટે એક નવીન અર્થ અને એક મહત્તર મૂલ્ય ધારણા કરશે.

જગત એક નૂતન સર્જન માટે તૈયારી કરી રહ્યું છે, આપણે શારીરિક કેળવણી દ્વારા એમાં સહાયભૂત થઈએ. આપણે એ માટે આપણા દેહને બળવાન બનાવીએ, વધુ ગ્રહણશીલ કરીએ, વધુ નમનીય કરીએ અને શારીરિક રૂપાંતરને માર્ગ આગળ વધીએ.

(૧ એપ્રિલ ૧૯૭૦)

\*

## હરીકાઈઓ ૧૯૭૧

આપણે અત્યારે “પ્રભુની પળો”ના એક એવા ગાળામાં છીએ જ્યારે જૂના પાયાઓ હચમચી જાય છે અને ચારે તરફ ગુંચવાડો ફેલાઈ જાય છે, પરંતુ જે લોકોને આગેકૂચ કરવી હોય છે તેમને માટે આ અદ્ભુત તક હોય છે. પ્રગતિ કરી શકવા માટેની અપવાદરૂપ શક્યતા પ્રાપ્ત હોય છે.

આનો લાભ લેનારામાંના તમે એક નહિ હો?

આ મહાન પરિવર્તન માટે શારીરિક કેળવણી દ્વારા તમારા દેહને તૈયાર કરો.  
સૌને મારા આશિષ.

(૧ એપ્રિલ ૧૯૭૧)

\*

## હરીકાઈઓ ૧૯૭૨

આ વર્ષે આપણે આપણા દેહની પ્રવૃત્તિઓ શ્રી અરવિંદને સમર્પિએ.

(૧ એપ્રિલ ૧૯૭૨)

\*

## શારીરિક કેળવણીનાં વાર્ષિક પ્રદર્શનોના પ્રસંગોના સંદેશાઓ

**૧૯૬૦**

શાબાશા! જે કોઈએ ગઈ કાલની પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ તે સૌને.<sup>૧</sup> એ અદ્ભુત હતું. સૌને મારાં અભિનંદન. બધું જ યોગ્ય રીતે યોજાયું અને કાર્યબદ્ધ કરાયું હતું. સૌને પ્રેમ અને આશિષ.

(નવેમ્બર ૧૯૬૦)

\*

**૧૯૬૩**

ગઈ કાલે આખો વખત હું તમારી સાથે, મારી સર્વ શક્તિ અને ચેતના સાથે તમને મદદ કરવા અને ટેકો આપવા હાજર હતી. મને ખબર હતી કે વરસાદરૂપી કસોટી તમારે પાર કરવાની હતી.

તમે એ વસ્તુ વિજયી રીતે કરી છે અને હું એ બાબતમાં ખુશી છું.

મારા સંતોષની સૌને જાણ કરજો. આશીર્વાદસહ.

(૩ ડિસેમ્બર ૧૯૬૩)

\*

**૧૯૬૪**

પ્રદર્શનોમાં ભાગ લેનાર સૌને મારા આશિષ જેથી તેઓ તેમની ક્ષમતાના શિખર ઉપર રહે.

(૨ ડિસેમ્બર ૧૯૬૪)

\*

**૧૯૬૬**

હિંમતવાન, ખડતલ, સાવધ અને સૌથી વધુ તો સત્યનિષ બનો, સંપૂર્ણપણે પ્રમાણિક રહો. ત્યારે તમે સૌ મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમારો વિજય થશો.

(૨ ડિસેમ્બર ૧૯૬૬)

\*

૧. પ્રદર્શનના રિઝર્સલની બાબતમાં.

૧૯૬૭

### શરીરના કોષાણુઓની પ્રાર્થના<sup>૧</sup>

હવે જ્યારે અમે પ્રભુકૃપાના પ્રભાવને કારણે ધીરે ધીરે કરીને અચેતનામાંથી બહાર આવીને સચેતન જીવ પ્રત્યે જાગ્રત થઈ રહ્યા છીએ ત્યારે એક આર્ત પ્રાર્થના અમારી અંદર વધુ પ્રકાશ, વધુ ચેતના માટે જાગે છે:

“વિશ્ના હે પરમ સ્વામી, અમે તને પ્રાર્થિએ છીએ કે અમને બળ, સૌન્દર્ય અને સંવાદપૂર્ણ પૂર્ણતા આપ કે જેથી અમે તારાં પૃથ્વી ઉપરનાં દિવ્ય કરણો બની રહીએ.”

(૨ ડિસેમ્બર ૧૯૬૭)

\*

---

૧. મૂળ અંગ્રેજ પુસ્તકમાં આ સંદેશ શ્રી માતાજીના હુસ્તાક્ષરોનો જ્લોક બનાવીને છાપ્યો છે.  
— અનુવાદક.

## સામાન્ય સંદેશાઓ અને પત્રો

તમારા દેહના સ્વામી બનો — એ તમને સ્વતંત્ર બનાવશે.

\*

શરીરની ચેતનાનો વિકાસ કરવા માટે શારીરિક કેળવણી એ એક ઉત્તમ ઉપાય છે. અને દેહ જેટલો વધુ સભાન હુશે તેટલા પ્રમાણમાં એ અત્યારે એનું રૂપાંતર કરવા અને નવીન માનવજીતને પ્રગટ કરવા માટે ગતિશીલ શક્તિઓને જીવી શક્વા શક્તિમાન થશે.

\*

**(વ્યાયામ કરનારાઓ માટેના એક રૂમ વિષે)**

આ રૂમમાં જોઈતી હવા અને ઉજાસ છે? હવા અને ઉજાસ વિનાના રૂમમાં કરેલી કસરતો, લાભને બદલે નુકસાન વધુ કરે છે. (૫ ઓક્ટોબર ૧૯૪૫)

\*

આ એક તાકીદની અને અનિવાર્ય શીખ છે. ટીમ-સ્પિરિટ અને રમતની શિસ્ત વિના કોઈ ઉપયોગી વસ્તુ પ્રાપ્ત થતી નથી.

(૧૫ જાન્યુઆરી ૧૯૪૭)

\*

**“અમે અત્યારે રમત-ગમતોની જે હુરીફાઈઓમાં ભાગ લઈએ છીએ તે પ્રત્યે અમારે કેવો ભાવ રાખવો?”**

આ સાથેની પુસ્તિકા<sup>૧</sup> વાંચી જાઓ — એમાંથી તમને ઉત્તર મળશે. વળી બુલેટિનમાંનો શ્રી અરવિંદનો સંદેશ<sup>૨</sup> પણ વાંચી જાઓ. (૨ જૂન ૧૯૪૮)

\*

૧. કોઈ ઓફ સ્પોર્ટ્સમેનશિપ.

૨. શ્રી અરવિંદ આશ્રમ યુવા કિડાફલને શ્રી અરવિંદનો સંદેશ. અતિમાનસ આવિર્ભાવ (ગુજરાતીમાં). અંગ્રેજીમાં શતાબ્દી વોલ્યુમ ૧૬, પૃ. ૧-૪.

તમે જે લખ્યું છે તે મને સારી રીતે સમજાયું હોય તો એનો અર્થ એ છે કે જ્યારે તમે શરીરની પ્રવૃત્તિઓ ઉપર એકાગ્રતા કરો છો ત્યારે મનની પ્રવૃત્તિઓ બંધ થઈ જાય છે અને એને લઈને દેહની ચપળતામાં વધારો થાય છે. આ સાચું છે પણ જો તમારી એકાગ્રતા સંપૂર્ણ હોય તો. અને એવું બહુ ઓછું બને છે. આશીર્વાદ.

(૨ જૂન ૧૯૪૯)

\*

(એક કેપ્ટન જે દસથી અગિયાર વર્ષનાં બાળકોના સમૂહને વ્યાયામ શીખવતા હૃતા તેમણે શ્રી માતાજીને પૂછ્યું કે હૃથ ધરવાની પ્રવૃત્તિની જોઈ યોજના બનાવવી કે કેમ? શ્રી માતાજીનો ઉત્તર : )

યોજના સારી વસ્તુ છે. પરંતુ બાળકો કરતાં એ વધુ તો તમારે માટે. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે તમે શું કરવા માગો છો તેનો તમને ખ્યાલ હોવો જોઈએ અને એ રીતે તમારા કાર્યક્રમને યોજાવો જોઈએ. પરંતુ તમારી પદ્ધતિનો બહુ કડકપણે અમલ ન કરતા, કારણ કે બાળકોને તેમની પ્રવૃત્તિઓમાં સ્વતંત્ર અને આપોઆપ બની આવતી વસ્તુઓ વધુ ગમે છે અને તેમના વિકાસ માટે આ પ્રકારનું સ્વાતંત્ર્ય એ સારી વસ્તુ છે.

મારા પ્રેમ અને આશિષ.

(૬ જૂન ૧૯૫૦)

\*

### સોવિયેટ કસરતબાજોને\*

અમે જે શારીરિક પૂર્ણતા જંખીએ છીએ તેને માર્ગ ઘણા આગળ વધેલા બંધુઓ તમને અમારા સલામ.

અમારી વચ્ચમાં, આશ્રમમાં તમે ભલે પધાર્યા. અમને એ વસ્તુની ખાતરી થાય છે કે મહાન માનવ કુટુંબની એકતા પ્રત્યે આજે એક ડગલું આગળ ભરાયું છે.

(૩ એપ્રિલ ૧૯૫૬)

\*

---

\* સોવિયેટ કસરતબાજોએ તા. ૨ અને ૩ એપ્રિલ ૧૯૫૬ના રોજ તેમનું અંગ-પ્રદર્શન ગોઠવેલું તે પ્રસંગે સંદેશ.

તમારી અંદર સંપૂર્ણ સંવાદ સ્થાપો કે જેથી સમય આવ્યે તમારા દેહ દ્વારા સંપૂર્ણ સૌન્દર્યની અભિવ્યક્તિ થાય. (૧૯૫૮)

\*

### હુઠયોગ વિષે

અમારા અનુભવ ઉપરથી અમને એ જણાયું છે કે અમુક જાતના જ વ્યાયામને યોગની રીતનો કહેવાય અને અમે એવું ખાતરીપૂર્વક નથી કહી શકતા કે એ કસરતો દ્વારા જ તંદુરસ્તી પ્રાપ્ત થઈ શકે — કારણ કે તેઓ યોગની કસરતો છે.

વ્યક્તિની જરૂરિયાત અને ક્ષમતા અનુસાર અપનાવેલી કોઈ પણ તર્ક-સંમત વ્યાયામ પદ્ધતિને અનુસરવાથી તેમાં ભાગ લેનારની તંદુરસ્તી સુધરી શકે છે. કોઈ પણ સુયોગ્ય રીતે યોજવામાં આવેલી અને વૈજ્ઞાનિક ફળે ગોઠવેલી કસરતોનો કાર્યક્રમ, જો યોગના દૃષ્ટિબિંદુથી અપનાવવામાં આવે તો એ કસરતો યોગની કસરતો બની શકે છે અને જે વ્યક્તિ એમાં ભાગ લેતી હોય તે શારીરિક તંદુરસ્તી અને આધ્યાત્મિક ઉન્નતિની દૃષ્ટિએ સંપૂર્ણ લાભ પામી શકે છે.

(બુલેટિન, એપ્રિલ ૧૯૫૮)

\*

“મારે તો ફક્ત સુંદર થવું છે.”

તમે ખરા હંદ્યપૂર્વક થોડીક શારીરિક કસરત કરશો તો સરળ થશો. (૧૯૬૫)

\*

ઇ વર્ષથી નીચેના બાળકોને સમુદ્રસ્નાન માટે લઈ જવાં એ મને ખાસ ડાયાશભર્યું લાગતું નથી. એ પાણી એમને માટે વધુ પડતું કરક પડશે.

(૮ ફેબ્રુઆરી ૧૯૬૬)

\*

(એક કેપ્ટને એવું લખેલું કે તેણે બાળકોને એવું કહેલું કે જો તેઓ તેમના ગુપ્તની શિસ્તનું પાલન કરશો તો માતાજીને ખુશી ઊપજશે. માતાજીનો ઉત્તરઃ)

તમારો ઉત્તર સાચો છે.

જ્યારે કોઈ વ્યક્તિ શિસ્તને અનુસરવામાં અસમર્થ હોય છે ત્યારે એ એના જીવનમાં પણ કોઈ સ્થાયી વસ્તુ કરવાને માટે અસમર્થ હોય છે.

(૧૬ ફેબ્રુઆરી ૧૯૬૭)

\*

(એક કેપ્ટને માતાજીને જણાવ્યું કે એને મન અને શરીરથી નંખાઈ ગયો હોવાનો અનુભવ થાય છે.)

ચિંતા ન કરો — થોડીક સારી અને નિયમિત કસરતો અને મારા આશીર્વાદ વડે બધું બરાબર થઈ જશે. પ્રેમ અને આશિષ.

(૧૪ માર્ચ ૧૯૬૭)

\*

“મને ત્રણ વાર ઘૂંટણમાં ઈજા થઈ છે અને ત્રણેય વાર હું સાજો થયો છું.

મા, એમ કરો કે હવે ફરી ઈજા ન થાય કે જેથી હું મારા ગ્રૂપની પ્રવૃત્તિઓ ખોઈ ન બેસું.”

વધુ સભાન બનો અને તો પછી તમને ઈજા નહિ થાય.

(૮ જુલાઈ ૧૯૬૮)

\*

“માતાજી, મેં જોયું છે કે હું મારા શરીરની સ્વાભાવિક શક્તિ કરતાં તેની પાસેથી વધુ કામ લઈ શકતો નથી. મારે જાણવું છે કે મારે તેની ઉપર બળ કઈ રીતે વાપરવું? માતાજી, શરીર ઉપર જોર કરવું તે સારું?”

ના.

શરીરમાં પ્રગતિ કરવાની શક્તિ છે અને એ જે ન કરી શકતું હોય તે કરવાની શક્તિ એનામાં ધીરે ધીરે આવે છે. પરંતુ એની પ્રગતિ કરવાની ક્ષમતા, પ્રાણની પ્રગતિની કલ્પના અને મનના સંકલ્પ કરતાં ધીમી હોય છે. અને જો મન અને પ્રાણને કર્મના સ્વામી બનાવવામાં આવે છે. તો તેઓ કેવળ શરીરને દેરાન કરે છે.

એને અસ્વસ્થ્ય કરે છે અને તંદુરસ્તીમાં બગાડ કરે છે.

માટે તમારે ધીરજ રાખવી અને પોતાના શરીરના લયને અનુસરવું; શરીરમાં વધારે સમજશક્તિ હોય છે, અને પોતે શું કરી શકશો અને શું નહિ કરી શકે તે બરાબર જાણો છે.

સ્વાભાવિક રીતે, કેટલાંક શરીર તમોગ્રસ્ત હોય છે અને એમને પ્રગતિ કરાવવા માટે થોડાં હંદોળવાં પડે છે.

પરંતુ સર્વ વસ્તુઓમાં અને સર્વ પ્રસંગોમાં પોતાની સમતુલ્યા તો જગતી જ રાખવી.

આશીર્વાદ.

(૧૩ ઑક્ટોબર ૧૯૬૬)

\*

માતાજી, અમારે રમતગમતોનાં ગ્રદર્શનો અને હરીફાઈઓમાં શા માટે ભાગ લેવો જોઈએ?

કારણ કે એને લઈને વધુ પ્રયત્ન કરવાનો પ્રસંગ આવે છે અને એથી વધુ પ્રગતિ થાય છે. આશીર્વાદ.

(૧૬ નવેમ્બર ૧૯૬૬)

\*

(રમતગમતોમાં અક્સમાતો વિષે.)

મને નથી લાગતું કે બહુર થાય છે તેથી વધુ અક્સમાતો અહીં થતા હોય. ઓછા થવા જોઈએ એ તો ચોક્કસ. પરંતુ એમ થઈ શકે તે માટે જે બાળકો અહીં છે તેમણે ચેતનામાં વિકાસ પ્રાપ્ત કરવો જોઈએ (એ વસ્તુ એ લોકો બીજા કોઈ સ્થળ કરતાં અહીં વધુ સહેલાઈથી કરી શકશો). દુર્ભાગ્યે, એમાંનાં બહુ ઓછાં એમ કરવાની તસદી લે છે. એ રીતે એ લોકોને જે સરસ તક મળી છે તેને ગુમાવે છે.

(૨૨ ડિસેમ્બર ૧૯૬૬)

\*

**“માતાજી, રમતગમતો અને શારીરિક શિક્ષણમાં શું ફેર?”**

રમતગમતો એટલે રમતો, હરીફાઈઓ, સ્પર્ધાઓ વગેરે. બધી જ વસ્તુઓ હરીફાઈ ઉપર આધાર રાખે છે અને પરિણામ કમ અને ઈનામોમાં આવે છે.

શારીરિક શિક્ષણ એટલે મુખ્યત્વે કરીને સર્વ પ્રકારની કસરતોને એકત્રિત કરવી કે જેથી શરીર સ્વસ્થ રહે અને વિકાસ કરે.

સ્વાભાવિક છે કે અહીં આપણે એ બંને કામ સાથે કરીએ છીએ. પરંતુ ખાસ કરીને તો એમ કરવાનું કારણ એ કે મનુષ્યો, ખાસ કરીને તેમના નાનપણમાં, કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવા માટે થોડુંક પ્રોત્સાહન માગે છે.

આશીર્વાદ.

(૧૪ જાન્યુઆરી ૧૯૭૦)

\*

રમતો શરીરને ઝૃપાંતર માટે તૈયાર કરે છે.

(૩૦ સપ્ટેમ્બર ૧૯૭૨)

\*

(ગેરીભસ ટૂર્નામેન્ટ જીતનારને આપવાના માનપત્રના સ્કેચ વિષે.)

વિજેતાના કાઈ ઉપર આપવામાં આવેલું ચિત્ર મૂળ ચીક કાંસ્ય ચંદ્રક ઉપરથી બનાવેલું છે. એની પાછળનો સંકલ્પ એવો છે કે ભૌતિક બળ દ્વારા કામનાના કાળા મહિષનું દમન કરવું.

\*

(ગેરીભસ ટૂર્નામેન્ટમાં બીજે નંબરે આવનાર માટેના માનપત્ર માટેના ચિત્ર વિષે.)

રોડીનનું આ ચિત્ર બીજે નંબરે આવનારાઓને વધુ સારું પરિણામ લાવવા માટેનાં સાધનો યોજવા માટે વિચાર કરતા કરવા માટે છે.

\*

(ગુસ્તાવ મોરોના ઓડિપસ અને સ્ફિંક્સના ચિત્રનો કુસ્તીની હરીફાઈઓના માનપત્રમાં ઉપયોગ કરવા વિષે.)

### જગતની સમસ્યા.

જે તમે ઉકેલી શકશો તો અમર બનશો, પરંતુ જો નિષ્ફળ જશો તો નાશ પામશો.

\*

## સ્ત્રીઓને – તેમના શરીર વિષે

(કેટલાક પ્રશ્નોના ઉત્તરો)

૧. ખરેખર, તમે છોકરો છો કે છોકરી એ વાત શું ભૂલી શકતા નથી અને એક માણસ રૂપે જ બની રહેવાનો પ્રયત્ન નથી કરી શકતા?
૨. પ્રત્યેક વિચાર (અથવા તો વિચારસરણી) એના પોતાના સમય અને સ્થળ પૂરતી સાચી હોય છે. પરંતુ એ જો પોતે જ એકમાત્ર સાચી વસ્તુ છે એમ બનવાનો પ્રયત્ન કરે, અથવા તો એને સમય પૂરો થઈ જાય ત્યારે પણ જો ટકી રહેવાનો પ્રયત્ન કરે તો તે પછી સાચી રહેતી નથી.

(શ્રી માતાજી)

“વિદ્યાર્થીઓને શારીરિક શિક્ષણ આપતી વખતે અમારે વિદ્યાર્થીની બાળાઓ અંગે કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. એમાંના ઘણાખરા પ્રશ્નો તો એમને મિત્રો તરફથી કે મોટી ઉભરની છોકરીઓ તરફથી અથવા તો માબાપો અને ડોક્ટર તરફથી મળેલાં સૂચનોમાંથી ઊભા થયેલા હોય છે. તો આપ કૃપા કરી અમોને નીચેના પ્રશ્નો અંગે ગ્રકાશ આપશો તો અમારી જવાબદારીને વધારે સારી રીતે પાર પાડવામાં અમને ઘણી મદદ થશે.

૧. બાળાએ પોતાને આવતા માસિક કાળ તરફ કેવું વલણ લેવું જોઈએ?
૨. માસિક કાળ દરમિયાન એણે શારીરિક શિક્ષણના રોજિંદા કાર્યક્રમ-માં ભાગ લેવો જોઈએ ખરો?

૩. કેટલીક છોકરીઓ પોતાના માસિક કાળ દરમિયાન એકદમ ઢીલી થઈ જતી હોય છે અને તેમને પીડના નીચેલા ભાગમાં તથા પેઢુમાં પીડા થતી હોય છે તો કેટલીકને સહેજ જ અગવડ અનુભવાતી હોય છે અથવા તો જરા પણ અનુભવાતી નથી એમ કેમ હશે?

૪. માસિક કાળ વખતે થતી પીડા અથવા દુઃખાવાને કેવી રીતે મટાડી શકાય?

૫. છોકરાઓ અને છોકરીઓ માટે જુદી જુદી કસરતો હોવી જોઈએ એમ આપ ધારો છે? જેને મરદાની રમતો ગણવામાં આવે છે એવી રમતો રમવાથી છોકરીના જનન અવયવોને હાનિ થાય ખરી?

૬. છોકરી જો સખત વ્યાયામ કરે તો તેથી શું તેનો દેખાવ બદલાઈ જાય ખરો? અને તેનું શરીર પુરુષના જેવું સ્નાયુવાળું બની તે કદરૂપી થઈ જાય એમ બને ખરું?

૭. છોકરીએ જો લગ્ન કરવું હોય તો તે જો સખત મહેનતવાળી કસરતો કરે તો તેને લીધે બાળકને જન્મ આપવામાં મુશ્કેલી ઊભી થાય ખરી અને પછી તેને બાળકો થાય ખરાં?

૮. છોકરીની જાતિને ધ્યાનમાં લેતાં તેને માટે શારીરિક શિક્ષણનો આદર્શ કેવો હોવો જોઈએ?

૯. આપણા નૂતન રીતના જીવનમાં પુરુષે અને સ્ત્રીએ શો ભાગ ભજવવો જોઈએ? એ બેની વર્ચ્યેનો સંબંધ કેવો હોય?

૧૦. સ્ત્રીના શારીરિક સૌંદર્યનો આદર્શ શો હોવો જોઈએ?"

તમારા પ્રશ્નોનો જવાબ આપું તે પહેલાં હું તમને થોડુંક કહેવા દઈછું છું. બેશક, તમે એ જાણો તો છો જ, પણ તમારે જો જીવનને જ્ઞાનમય કેવી રીતે બનાવવું એ શીખવું હશે તો એ વસ્તુ તમારે કદી ભૂલવી ન જોઈએ એવી છે.

એ વાત સાચી છે કે આપણે આપણા આંતર સ્વરૂપમાં એક આત્મતત્ત્વ છીએ, એક જીવતા આત્મા રૂપે છીએ. એ આત્મા પોતાની અંદર પ્રભુને ધારાણ કરીને બેઠેલો છે અને એ પ્રભુ રૂપ બની રહેવું, એ પ્રભુનો પૂર્ણ આવિભર્વાવ કરવો એ તેની અભીષ્ટા હોય છે. પણ તો આ વસ્તુ પણ એટલી જ સાચી છે, અને કાંઈ નહિ તો અત્યાર પૂર્તી તો સાચી છે જ કે, આપણા અત્યંત બહુારના સ્થૂલ સ્વરૂપમાં, આપણા શરીરમાં આપણો હજુ એક પશુ જ છીએ, એક સ્તનપાયી ગ્રાણી છીએ. બેશક, આપણે એક ઘણી ઊંચી કક્ષાનું ગ્રાણી છીએ તો પણ આપણી બનાવટ પશુ તરીકે થયેલી છે અને આપણે પશુ પ્રકૃતિના નિયમોને આધીન રહેતા હોઈએ છીએ.

તમને એ વસ્તુ તો શીખવવામાં આવી છે જ કે આ સ્તનપાયી ગ્રાણીઓનું એક ખાસ લક્ષણ એ છે કે એમાં માદા બચ્ચાને પોતામાં ગર્ભ રૂપે ધારાણ કરે છે, પોતામાં તેને ગર્ભ રૂપે મોટું થવા દે છે અને તેને બંધાવા દે છે. એ બચ્ચું પૂરેપૂરું આકાર પામી લે ત્યારે માના શરીરમાંથી તે બહુાર આવે છે અને સ્વતંત્ર રીતે જીવવા લાગે છે.

આ કાર્યને માટે કુદરતે સ્ત્રીને વધારે પ્રમાણમાં લોહી આપેલું છે અને તેનામાં બાળક બનતું હોય છે ત્યારે એ લોહી એ માટેના કામમાં આવે છે. પણ આ વધારાના લોહીની જરૂર સતત પડતી નથી હોતી, એટલે જ્યારે સ્ત્રીના શરીરમાં બાળક બનતું નથી હોતું ત્યારે એ વધારાનું લોહી શરીરમાં વધુ પડતું ન થઈ જાય

તેમ જ એક ટેકાણે જામી ન જાય એટલા માટે તેને બહાર કાઢી નાખવાનું રહે છે. સ્વીને જે માસિક કાળ આવતું હોય છે તેનું કારણ આ છે. આ એક સાદી કુદરતી કિયા છે, સ્વીને જે રીતે બનાવવામાં આવી છે તેનું આ પરિણામ છે અને શરીરની બીજી કિયાઓને આપણે જેટલું મહત્વ આપીએ છીએ તેથી વધુ મહત્વ આને આપવાની કોઈ જરૂર નથી. આ કોઈ રોગ નથી, અને એટલે એમાંથી કોઈ નબળાઈ કે ખરી બેચેની ઊભી થઈ શકતી નથી. એટલે એક સ્વાભાવિક જીવન ગાળનાર સ્વીએ, એ જો હસવા જેવી લપદ્ધય કરનારી ન હોય તો, આ બાબતમાં સ્વચ્છતાની દૃષ્ટિએ જરૂરી હોય તેટલી સાવયેતી લઈ લેવી જોઈએ અને પછી એ વસ્તુને વધુ વિચાર ન કરતાં પોતાના કાર્યક્રમમાં કશો ફેરફાર કર્યા વિના રોજની પેઠે બધું જ કામકાજ કરતાં રહેવું જોઈએ. શરીરનું આરોગ્ય સારી રીતે જાળવવા માટે આ જ સારામાં સારો રસ્તો છે.

વળી આપણે એ વાત સ્વીકારી લઈએ કે આપણા શરીરમાં આપણે હુજુ ખૂબ જ પશુ જેવા છીએ તો પણ એનો અર્થ એમ નહિ કરવો જોઈએ કે આ પશુભાગ, એ આપણે ઘણો સધન અને વાસ્તવિક ભાગ છે એટલે આપણે તેને તાબે થવાની ફરજ છે તેમ જ આપણા ઉપર આપણે તેને રાજ કરવા દેવું જોઈએ, પણ કમનસીબે જીવનમાં ઘણી વાર આ જ બનતું હોય છે અને માણસો પોતાના શરીરના સ્વામી ન બનતાં, ઘણા પ્રમાણમાં એના ગુલામ જ હોય છે. પણ થવું જોઈએ તો આથી તદ્દન ઊલટું જ, કેમ કે આપણા જીવનનું સત્ય પણ આ કરતાં કાંઈ જુદું જ છે.

આપણી અંદર એક બુદ્ધિનું તત્ત્વ રહેલું છે અને એ બુદ્ધિમાં થોડું ઘણું જ્ઞાન હોય છે જ. આ બુદ્ધિ આપણા ચૈત્ય પુરુષનું પ્રથમ સાધન છે. આપણે આ બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે અને એ બુદ્ધિ દ્વારા આપણે પશુ તરીકે નહિ, પણ એક મનુષ્ય તરીકે, દિવ્યતાના ઉમેદવાર તરીકે જીવન ગાળતાં શીખવું જોઈએ.

અને આ સાક્ષાત્કારમાં પહુંચ્યેવા માટેનું પહેલું પગથિયું એ છે કે આપણે શરીરના એક નિર્બળ ગુલામ ન બની રહીએ પણ તેના સ્વામી બનીએ.

આ હેતુ સાધવા માટેનું એક અત્યંત અસરકારક સાધન તે શારીરિક તાલીમ છે.

પ્રાચીન કાળમાં લોકોને આ વિષયનું ઘણું જ્ઞાન હતું, પણ પછીથી તે થોડું ઘણું લુપ્ત થઈ ગયું હતું. એ જ્ઞાન હવે છેલ્લાં સોએક વરસથી ફરીથી તાજું થવા લાગ્યું છે અને આજના વિજ્ઞાનની પ્રગતિની સાથે સાથે એ જ્ઞાન ઘણું વધી રહ્યું છે તેમ જ ખૂબ મહત્વનું પણ બની રહ્યું છે. આ જ્ઞાન આપણને સમજાવે છે કે સ્થૂલ શરીર એ શું છે, અને તેને જો એક સમજાણભરી અને પદ્ધતિસરની શારીરિક કેળવણી આપવામાં આવે તો તે રીતે તેના ઉપર અસાધારણ કાબૂ મેળવી શકાય છે.

આ જ્ઞાનનો જે પુનરુદ્ધય થયો છે તે એક નવી શક્તિ અને પ્રકાશ પૃથ્વી ઉપર કાર્ય કરવા લાગેલાં છે તેને લીધે બન્યું છે. એ પ્રકાશ અને શક્તિ પૃથ્વી ઉપર પથરાઈ ગયાં છે અને નજીકના ભાવિમાં અહીંં જે મહાન રૂપાંતરો અવસ્થ બની આવવાના છે તે માટે પૃથ્વીને તૈયાર કરી રહ્યાં છે.

એટલે આપણે આ શારીરિક કેળવણીને સૌથી પ્રથમ સ્થાન આપવામાં જરાકે સંકોચ રાખવાનો નથી. પૃથ્વી ઉપર આ જે નવી શક્તિ પોતાનો આવિર્ભાવ કરવાને પ્રયત્ન કરી રહી છે એ શક્તિને આપણું શરીર જીલી શકે તથા તેને વ્યક્ત કરી શકે એ હેતુ માટે જ આ શારીરિક કેળવણી આપણે આપીએ છીએ.

આટલું કહી હવે તમે પૂછીલા પ્રશ્નોનો જવાબ આપીશ.

**૧. “બાળાએ પોતાને આવતા માસિક કાળ તરફ કેવું વલાણ લેવું જોઈએ?”**

એ એક તદ્દન સ્વાભાવિક વસ્તુ છે અને અનિવાર્ય છે એમ તેને ગાળવી જોઈએ. આ વસ્તુને બને તેટલું ઓછામાં ઓછું મહત્વ આપો અને એને લીધે તમારા રોજના જીવનમાં કંઈ ફેરફાર ન કરતાં બધાં કામ હુમેશાની માફક કર્યે જાઓ.

**૨. “માસિક કાળ દરમિયાન એણે શારીરિક શિક્ષણના રોજિંદા કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ ખરો?”**

જરૂર, જો એ શારીરિક કસરત હુમેશાં કરતી હોય તો આને લીધે તેણે તે બંધ કરવાની જરૂર નથી. સ્વી પોતાનું સામાન્ય નિત્ય જીવન જો હુમેશાં ચાલુ રાખવાની ટેવ પાડે તો પછી થોડા વખતમાં માસિકની હાજરીનો ઘ્યાલ પણ તેને રહેશે નહિ,

**૩. “કેટલીક છોકરીઓ પોતાના માસિક કાળ દરમિયાન બઢુ જ ઢીલી થઈ જતી હોય છે તથા તેમને પીઠાના નીચલા ભાગમાં તથા પેઢુમાં પીડા થતી હોય છે તેકેટલીકને જરૂર જ અગવડ અનુભવાતી હોય છે અથવા તો જરા પણ અનુભવાતી નથી એમ કેમ હશે?”**

આનો આધાર દરેકના સ્વભાવ ઉપર તેમ જ મોટે ભાગે તેની કેળવણી ઉપર રહે છે. છોકરીને જો નાનપણથી જ થોડી સરખી બેયેની ઉપર પણ ખૂબ જ ધ્યાન આપવાની ટેવ પડી ગઈ હશે અને નાનામાં નાની અગૂવડ ઉપર પણ તે જો મોટી

ઘમાલ કરી મૂકૃતી હશે તો પછી તેનામાં જરાકે સહનશક્તિ આવશે નહિએ, હરકોઈ વસ્તુ તેને બેચેન બનાવી મૂકશે. અને માબાપો પોતે પણ પોતાનાં બાળકોને જે કાંઈ થાય તે વિષે જો સહેજમાં ચિંતાતુર બની જાય તો પણ આમ થાય. જીવનમાં આપણને નાની મોટી અગવડો તથા અકસ્માતો તો હંમેશાં ઊભા થતા રહેવાના જ. એટલે આ બધા વિષે બાળક બહુ ગભરાઈ ન જાય પણ થોડું વધુ ખડતલ બને, સહનશીલ બને એ વસ્તુ એને શીખવવી જોઈએ. કોઈ પણ અગવડ ભરેલી પ્રતિકૂળ વસ્તુને આપણે શાંત ભાવે સહન કરી લેતાં શીખીએ અને બાળકોને પણ એમ કરતાં શીખવીએ એ જ ઉત્તમ વસ્તુ છે.

એ એક ઘણી જાણીતી હુકીકત છે કે આપણે જો એમ કલ્પના કરવા લાગીએ કે મને અમુક પીડા થશે તે એ પીડા જરૂર થાય છે અને એ પીડા ઉપર તમે વળી જો એકાગ્રતા કરશો તો પછી એ વધુ ને વધુ થતી જશે અને છેવટે જતાં તો જેને ‘અસાધ્ય’ કહેવામાં આવે છે એવી થઈ જશે. પણ ખરી વાત તો એ છે કે આપણે જો થોડુંક સંકલ્પબળ વાપરીએ અને હિંમત રાખીએ તો ભાય્યે જ એવું કરી દરદ હોય છે કે જે આપણે સહન ન કરી શકીએ.

#### ૪. “માસિક કાળ વખતે થતી પીડા અથવા દુઃખાવાને કેવી રીતે મટાડી શકાય?”

આને માટે કેટલીક કસરતો હોય છે. એ કરવાથી પેઢું મજબૂત બની શકે છે તથા લોહીના ભ્રમણમાં સુધારો કરી શકાય છે. આ કસરતો નિયમિત રીતે કરતા રહેવું જોઈએ તથા દુઃખાવો ચાલી જાય તે પછી પણ તે ચાલુ રાખવી જોઈએ. મોટી ઉમરની છોકરીઓને આવો દુઃખાવો લગભગ જાતીય ઈચ્છાઓને લીધે જ થઈ આવતો હોય છે. આ ઈચ્છાઓને જો આપણે દૂર કરી દઈ શકીએ તો એ દુઃખાવો પણ ચાલ્યો જાય છે. અને ઈચ્છાઓને દૂર કરવાના બે રસ્તા છે. એક રસ્તો છે ઈચ્છાની તૃપ્તિ (અથવા જેને તૃપ્તિ કહેવામાં આવે છે તે, કેમ કે ઈચ્છાની બાબતમાં તૃપ્તિ જેવું કાંઈ હોતું જ નથી). અને એ સામાન્ય રીત છે. આ રીત અજમાવવી, એટલે કે તમારે સામાન્ય રીતનું મનુષ્ય પશુશ્રય જીવન ગાળવું – લઝ, બાળકો અને બીજું બધું.

અને બીજો રસ્તો પણ છે જ, અને તે વધારે સારો રસ્તો છે – એ છે સંયમ પ્રભુત્વ, રૂપાંતર, આ રીત વધારે ગૌરવભરેલી છે અને વધારે અસરકારક પણ છે.

૫. “છોકરાઓ અને છોકરીઓ માટે જુદીજુદી કસરતો હોવી જોઈએ એમ આપ ધારો છો? જેને મરદાની રમતો ગણવામાં આવે છે એવી રમતો રમવાથી છોકરીના જનન અવયવોને હાનિ થાય ખરી?”

છોકરાઓ તથા છોકરીઓ બંનેને તેમની શક્તિ અને બળને ધ્યાનમાં રાખીને કમે કમે કસરતો આપવી જોઈએ. ઓછી શક્તિવાળો વિદ્યાર્થી એકીસાથે અધરી અને ભારે કસરતો કરવાનો પ્રયત્ન કરે તો ઓની એ મૂર્ખતા માટે એને સહન કરવું પણ પડે. પણ બાળકને જો કમે કમે વધતી જાય એવી રીતે તથા સમજણ-પૂર્વક જો તાલીમ આપવામાં આવે તો છોકરાઓ તથા છોકરીઓ બંને બધી રીતની કસરતોમાં ભાગ લઈ શકે છે અને એ રીતે પોતાની શક્તિ અને આરોગ્યમાં વધારો કરી શકે છે.

તમે સશક્ત અને તંદુરસ્ત બનો તો તેથી શરીરને કદી પણ હાનિ થાય નહિ, પછી એ સ્વીનું શરીર પણ ભલે હોય!

૬. “છોકરી જો સખત વ્યાયામ કરે તો તેથી શું તેનો દેખાવ બદલાઈ જાય ખરો? અને તેનું શરીર પુરુષના જેવું સ્નાયુવાળું બની તે કદરૂપી થઈ જાય એમ બને ખરું?”

દુર્બળતા અને નાજુકતા એ વિકૃત માનસને જ આકર્ષક લાગી શકે છે, પણ દુર્બળ હોવું કે નાજુક હોવું એ કાંઈ પ્રકૃતિનું સત્ય નથી તેમ જ આત્માનું સત્ય પણ નથી.

તમે જો કદી સ્વી કસરતભાજોની છબીઓ જોશો તો તમને ખબર પડશો કે તેમનાં શરીર કેટલાં સર્વોંગ-સુંદર હોય છે, અને છતાં એ શરીર સ્નાયુબદ્ધ હોય છે એની તમે ના નહિ પાડી શકશો!

૭. “છોકરીએ જો લાગ્ન કરવું હોય તો તે જો સખત મહેનતવાળી કસરતો કરે તો તેને લીધે બાળકને જન્મ આપવામાં મુશ્કેલી ઊભી થાય ખરી અને પછી તેને બાળકો થાય ખરાં?”

આવો કોઈ દાખલો મારો જોવામાં આવ્યો નથી, ઉલટું, જે સ્વીઓ સખત કસરતો કરવાની તાલીમ પામેલી હોય છે તથા જેમનું શરીર સ્નાયુબદ્ધ હોય છે તેઓ ગર્ભ-ધારણાની તથા બાળકને જન્મ આપવાની કસોટીમાંથી બહુ સહેલાઈથી અને વગર પીડાએ પસાર થઈ જાય છે.

આફિકમાં ઘણી સ્થીઓ માથે ઘણો ભાર લઈને માઈલો સુધી ચાલતી હોય છે. આવી એક સ્થીની એક સાચી વાત મેં સાંભળી હતી. અને ગર્ભ હતો અને તે એક દિવસે આવી રીતે જતી હતી ત્યાં અને પ્રસ્તુતિનો સમય આવી ગયો. અને એ રસ્તાની પડખે જઈને એક ઝાડ નીચે બેસી ગઈ, બાળકને જન્મ આપ્યો, અર્ધોએક કલાક બેઠી અને પણી એ નવા જન્મેલા બાળકને પોતાના સામાન બેગું મૂકીને, જાણે કાંઈ બન્યું નથી એમ શાંતિથી ચાલતી થઈ. સ્થી જો સંપૂર્ણ રીતે તંદુરસ્ત અને સશક્ત હોય છે તો તે શું કરી શકે તેનું આ ખૂબ જ સરસ દૃષ્ટાંત છે.

ડૉક્ટરો કહેશો કે આજની સુધરેલી દુનિયામાં, માનવજીતિએ આટલી બધી કહેવાતી પ્રગતિ સાધી છે તેમાં પણ આવી વસ્તુ બની શકે તેમ નથી. પણ તો આપણે એ વાતની પણ ના પાડી શકીએ તેમ નથી કે, શારીરિક રીતે જોતાં, આજની સંસ્કૃતિઓને લીધે લોકોમાં જે આળપંપાળ આવી ગઈ છે, તથા જે વેદનાઓ અને ગૂંઘવાડા ઊભા થયા છે તેના કરતાં આ સ્થિતિ ઘણી જ વધારે આનંદદાયક છે.

વળી, સામાન્ય રીતે ડૉક્ટરો જે અસાધારણ દાખલાઓ હોય છે તેમાં જ રસ લેતા હોય છે અને એ જ દૃષ્ટિબિંદુથી બધું વિચારતા હોય છે. પરતું આપણે માટે વસ્તુ જુદી રીતની છે. આપણે એક સ્વાભાવિક સાધારણ સ્થિતિમાંથી એથી વધુ ઊંચી સ્થિતિમાં જઈ શકીએ છીએ, અસમધારણમાંથી નહિ. આવી અસમધારણતા એ તો હંમેશાં વિકૃતિ અને લઘુતાનું જ લક્ષણ હોય છે.

#### ૮. છોકરીની જાતિને ધ્યાનમાં લેતાં તેને માટે શારીરિક શિક્ષણનો આદર્શ કેવો હોવો જોઈએ?

છોકરીઓ માટે છોકરાઓ કરતાં શારીરિક શિક્ષણનો આદર્શ કોઈ ખાસ જુદો શા માટે હોવો જોઈએ એ હું સમજી શકતી નથી.

માણસના શરીરની બધી જ શક્યતાઓને વિકસાવવી, એટલે કે તેમાં સંવાદિતતા, શક્તિ, મુલાયમતા, હોશિયારી, ચપળતા, સહનશક્તિ એ બધાં તત્ત્વો બને તેટલાં વધુમાં વધુ વિકસાવવાં, શરીરના અવયવો તથા અંગોની કિયાઓ ઉપનો કાબૂ વધારવો, અને શરીર તે એક સભાન સંકલ્પશક્તિના હાથમાં એક સંપૂર્ણ કરણ બની રહે એ શારીરિક શિક્ષણનો આદર્શ છે. આ કાર્યક્રમ બધાં જ માણસો માટે સરખી રીતે ઉત્તમ છે. છોકરીઓ માટે આનાથી જુદો આદર્શ રાખવાની કાંઈ જરૂર નથી.

૬. “આપણું નૂતન રીતના જીવનમાં પુરુષે અને સ્ત્રીએ શો ભાગ ભજવવો જોઈએ? એ બેની વર્ચેનો સંબંધ કેવો હોય?”

એ બેની વર્ચે ભેદ જ શા માટે કરો છો? બધાં જ મનુષ્યો સરખી રીતે છે અને પોતાની જાતિ, નાતજાત, પંથ તથા રાષ્ટ્રીયતાથી પર બનીને, પ્રભુના કાર્ય માટે સુયોગ્ય કરાણો બનવાનો પ્રયત્ન કરી રહેલાં છે. બધાં એક જ અદિતિ માતાનાં બાળકો છે અને એક જ શાશ્વત પરમાત્માને મેળવવા જરૂરી રહેલાં છે.

૧૦. “સ્ત્રીના શારીરિક સૌંદર્યનો આદર્શ શો હોવો જોઈએ?”

શરીરનાં પ્રમાણોમાં એક સંપૂર્ણ સંવાદિતતા હોય, શરીરમાં ચપળતા અને શક્તિ હોય, ચારુતા અને બલ, મુલાયમતા અને સહનશક્તિ હોય, અને સૌથી વિશેષ એક સ્થિર ફેરફાર ન પામે તેવી ઉત્તમ તંદુરસ્તી હોય તે. આ બધું માણસમાં એક પવિત્ર આત્મા હોય, માણસને જીવનમાં એક પ્રસન્ન વિશ્વાસ હોય અને પ્રભુની કૃપામાં એક અવિચલ શ્રદ્ધા હોય તેને પરિણામે મળી આવતું હોય છે.

અને છેલ્લે એક શબ્દ :

મેં આ બધું કહ્યું છે તે તમારે જીણવાની જરૂર હતી માટે મેં કહ્યું છે. પાણ આમાંથી તમે કોઈ જડ સિદ્ધાંતો ન બનાવી દેશો. એમ કરશો તો આમાંનું સત્ય ચાલ્યું જશે.

(સપ્ટેમ્બર ૧૯૬૦માં પ્રસિદ્ધ કરેલ)

\*

## નવયુગ મંડળ

શ્રી અરવિંદ આશ્રમ આંતરરાષ્ટ્રીય શિક્ષણ કેન્દ્રના ઉચ્ચ કક્ષાના વર્ગના વિદ્યાર્થીઓની વાણીને વાચા આપવાના મંચ તરીકે આ મંડળની સ્થાપના ૧૯૬૪માં કરવામાં આવેલી.

વાંચનારની સહાય માટે ત્રિમાસિક સભાઓ અને સાતમા અને આઠમા શિબિરના વિષયો જોઈ જે નિશાનીઓ મૂકવામાં આવી છે તેની કૂંચી નીચે પ્રમાણે છે :

૧ = શ્રી માતાજીએ સૂચવેલ વિષય.

૨ = શ્રી માતાજીએ તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલા વિષયમાં પસંદ કરેલો વિષય.

૩ = શ્રી માતાજીએ અનુમતિ આપેલો વિષય.

એ એવો સ્વતંત્ર વાર્તાલાપ જ્યાં વ્યક્તિ પોતે જે વિચારતી કે અનુભવતી હોય તેને વાચા આપી શકે.

(૧૯૬૪)

\*

**ઉદ્ઘાટન પ્રસંગ : ૧૨ જુલાઈ ૧૯૬૪**

તમે બધું જાણો છો તેમ કદી માનો નહિ.

અધિક સારું જાણવા પ્રયત્ન કરો. આશિષ.

(૧૨ જુલાઈ ૧૯૬૪)

\*

**પ્રથમ શિબિર : ૬ ઓગસ્ટ ૧૯૬૪**

સામાન્ય મનોમય સક્રિયતાની ઉપર ઉઠવાનો શો માર્ગ છે ?

મારો ઉત્તર : નીરવ રહો.

\*

**બીજો શિબિર : ૨૨ નવેમ્બર ૧૯૬૪**

**દિવ્ય જીવન માટેની આપણી અભીપ્તસામાં અવિચલ અને સત્યનિષ્ઠ કઈ રીતે બની રહેવાય?\***

એમ ગણો કે દિવ્ય જીવન જ સૌથી વધુ અગત્યની પ્રાપ્ત કરવા લાયક વસ્તુ છે.

\*

**ત્રીજો શિબિર : ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૫**

**કર્મના આવેગોમાં સત્ય અને અસત્ય વચ્ચે કઈ રીતે વિવેક કરવો?\***

જેમની ઈચ્છા સત્યનો પ્રકાશ અંધકાર અને અસત્યની શક્તિઓ ઉપર કાબૂ પ્રાપ્ત કરે તેમાં સહાય કરવાની હોય તેઓ આ વસ્તુ પોતાની અંદર ઊઠતા આવેગોની ગતિઓ અને કર્માનું નિરીક્ષણ કરીને, તેમાંના કયા સત્યમાંથી આવે છે અને કયા અસત્યમાંથી આવે છે તે વચ્ચેનો ભેટ પારખી શકે છે જેથી તેઓ પ્રથમની વસ્તુનું પાલન કરી શકે અને અન્યને વેગથી ફેંકી દે.

પૃથ્વીના વાતાવરણમાં સત્યની જ્યોતિના આગમનની પ્રથમ નિશાની આ પ્રકારની વિવેકશક્તિ છે.

જો સત્યે આપેલી આ વિવેકશક્તિની ખાસ બક્ષિસ ન હોય તે સત્યના અને અસત્યના આવેગો વચ્ચેનો ભેટ પારખવો ખરે જ મુશ્કેલ છે.

પરંતુ શરૂઆત કરનાર પોતાને માટે એક માર્ગદર્શક નિયમ બનાવી લઈ શકે કે જે વસ્તુની શરૂઆત અથવા સર્જન શાંતિ, શ્રદ્ધા, આનંદ, સંવાદ, વિશાળતા, એકતા અને આરોહક વિકાસથી થતી હોય તે સત્યમાંથી આવતી હોવી જોઈએ. જ્યારે જે વસ્તુ તેની સાથે ચંચળતા, શંકા, અશ્રદ્ધા, દિલગીરી, વિસંવાદ, સ્વાર્થી સંકુચિતતા, જડતા, નિરાશા અને અવસાદ લાવતી હોય તે સીધેસીધી અસત્યમાંથી આવતી હોય છે.

(૨૨ જાન્યુઆરી ૧૯૬૫)

\*

ચોથો શિબિર : ૨૫ એપ્રિલ ૧૯૬૫

પોતાના અભ્યાસને સાધનાનું નિમિત્ત કઈ રીતે બનાવાય? <sup>૨</sup>

\*

પાંચમો શિબિર : ૮ ઓગસ્ટ ૧૯૬૫

પોતાની મુશ્કેલીઓને પ્રગતિની તકોમાં કઈ રીતે બદલી શકાય? <sup>૨</sup>

\*

છૃદ્દો શિબિર : ૨૧ નવેમ્બર ૧૯૬૫

૧. માનવજીતની પ્રગતિ થાય તેનો ઉત્તમ માર્ગ કયો? <sup>૩</sup>

૨. સ્વતંત્રતા શું છે અને તે કેવી રીતે પ્રાપ્ત થાય? <sup>૩</sup>

૧. પોતાની જાતે પ્રગતિ કરીને.

૨. આ) અહુંકારથી મુક્ત થવાથી.

બ) અહુંકારને વિદ્યાય આપો.

(૧૩ ઓક્ટોબર ૧૯૬૫)

\*

સાતમો શિબિર : ૨૦ ફેબ્રુઆરી ૧૯૬૬

સત્યની સેવા કઈ રીતે કરવી? <sup>૩,\*</sup>

\*

આઠમો શિબિર : ૧૪ ઓગસ્ટ ૧૯૬૬

મનુષ્યનું ભાવિ શું? <sup>૨</sup>

\*

---

\* આ વિષયનો આધાર શ્રી માતાજીના ૧૯૬૬ના સંદેશને અનુલક્ષીને છે: ‘આપણે સત્યની સેવા કરીએ.’

## નવમો શિબિર : ૨૭ નવેમ્બર ૧૯૬૬

સાચો પ્રેમ શું છે અને તે કઈ રીતે મળો? <sup>૨</sup>

તમે જાપુશો છો કે સાચો પ્રેમ શું છે?

સાચો પ્રેમ એક માત્ર ગ્રભુમાંથી આવતો પ્રેમ છે જે મનુષ્યોમાં ગ્રભુ ગ્રત્યે પ્રેમ પ્રગટાવે છે.

આપણે એમ કહીશું કે ગ્રભુની પ્રકૃતિ જ પ્રેમ કરવાની છે.

\*

## દસમો શિબિર: ૧૯ ફેબ્રુઆરી ૧૯૬૭

પસંદગી કેમ અનિવાર્ય છે ? <sup>૨,\*</sup>

કારણ કે શ્રી અરવિંદે કહેલું તેમ આપણે ‘ગ્રભુની પળ’ના સમયમાં છીએ – અને જગતના રૂપાંતરની ઉત્કાન્તિએ એક ઝડપી અને સધન સ્વરૂપ લીધું છે.

\*

## અગિયારમો શિબિર : ૩૦ એપ્રિલ ૧૯૬૭

હુલના સમયે શું કરવાની અગત્ય છે? <sup>૨</sup>

સત્યનિષ્ઠા.

ગ્રભુને છેતરવાનો પ્રયત્ન ન કરો.

\*

\* (આ વિષય શ્રી માતાજીના ૧૯૬૭ના નૂતન વર્ષના સંદેશને અનુલક્ષીને હતો, જેમાં કહેલું : “મનુષ્યો, રાષ્ટ્ર, ભૂખંડો! પસંદગી અનિવાર્ય છે: સત્ય અથવા ખીણ”.).

બારમો શિબિર : ૧૩ ઓગસ્ટ ૧૯૬૭

શ્રી અરવિંદ અને નવયુગ.<sup>૨</sup>

\*

ચોથી વાર્ષિક સભા : ૧૦ સપ્ટેમ્બર ૧૯૬૭

જૂના રીતરિવાજોથી અલગ પડી જવું અને જરીપુરાણા નિયમોને ન અનુસરવું એ સારી વાત છે – પરંતુ તે એક શરતે કે તમને તમારી અંદર કોઈ ઉચ્ચતર અને વધુ સાચી ચેતના મળી આવી હોય કે જે સંવાદ, શાંતિ ઉપરાંત એક વધુ વિશાળ અને ગ્રાગતિશીલ ઉત્તમોત્તમ વ્યવસ્થાને અભિવ્યક્ત કરતી હોય.

(૨૬ ઓગસ્ટ ૧૯૬૭)

\*

તેરમો શિબિર : ૨૬ નવેમ્બર ૧૯૬૭

કેળવણી મત્યે નૂતન દૃષ્ટિબિંહુ<sup>૩</sup>

કેળવણીના નૂતન આદર્શ માટેના કયા માર્ગદર્શક સિદ્ધાંતો હોવા જોઈએ?

સત્ય, સંવાદ, સ્વાતંત્ર્ય.

\*

ચૌદમો શિબિર : ૨૫ ફેબ્રુઆરી ૧૯૬૮

અમે શ્રી માતાજી પાસેથી શાની અપેક્ષા રાખીએ છીએ.<sup>૧</sup> અમારે આપની પાસેથી કઈ વસ્તુ માગવી યોગ્ય ગણાય?

બધી જ.

“આપના નૂતન કાર્યની સિદ્ધિ માટે સમગ્ર માનવજ્ઞતિ પાસેથી અને અમારી પાસેથી શાની અપેક્ષા રાખો છો?”

કશાની નહિ.

“આપના સાઈ ઉપરાંત વર્ષના લાંબા અનુભવને અંતે શું આપને એમ લાગ્યું છે કે આપ અમારી પાસેથી અને માનવજ્ઞતિ પાસેથી જે ની અપેક્ષા રાખતાં હતાં તે પૂરતા પ્રમાણમાં મળ્યું છે?”

હું કશાની અપેક્ષા ન રાખતી હોઈ આ પ્રશ્નનો જવાબ આપી શકતી નથી.

“આપના કાર્યની સિદ્ધિનો આધાર અમે અને માનવજ્ઞતિ આપની અપેક્ષાઓ પૂરી પાડીએ તેના ઉપર આધાર રાખે છે?”

સદ્ભાષ્ય, ના.

(૨૦ ફેબ્રુઆરી ૧૯૬૮)

\*

પંદરમો શિબિર : ૨૮ એપ્રિલ ૧૯૬૮\*

૧. યુવાન કેવી રીતે રહેવું?²
૨. અંતહીન પ્રગતિનું રહુસ્ય શું ?²

“૧. શરીરમાં જે નબળા થતા જવાની અને વિકૃતિઓ ઊભી થવાની પ્રક્રિયાઓને કારણે વૃદ્ધાવસ્થા આવે છે તે જ મૃત્યુની શરૂઆતકૃપ છે. તો મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યા વિના વૃદ્ધાવસ્થા ઉપર વિજય પ્રાપ્ત થઈ શકે? અતિમાનસ આનંદ શરીરના કોષોનું સંપૂર્ણ રૂપાંતર ન કરે ત્યાં સુધી શરીરને સતત પણે યુવાન રાખી શકાય?”

\* (આ પ્રશ્નો શ્રી માતાજીના ૧૯૬૮ના નૂતન વર્ષના સંદેશ હંમેશાં યુવાન રહો, પ્રયત્ન કરવામાં પાછી પાની ન કરોને અનુલક્ષીને છે.)

જ્યાં સુધી પૃથ્વી ઉપર અતિમનસનો આવિર્ભાવ થયો નથી ત્યાં સુધી આ પ્રશ્નોનો ઉત્તર કઈ રીતે આપી શકાય?

(૨૫ એપ્રિલ ૧૯૬૮)

“ર. આપના ઉત્તરનો અર્થ એવો ખરોકે હજી સુધી પૃથ્વી ઉપર અતિમનસનો આવિર્ભાવ થયો નથી? અથવા તો આપ એ ઘટનાનો ઉદ્દેશ કરો છો કે જ્યારે અતિમનસનો આવિર્ભાવ છેક અચિતનાં મૂળ સુધી થયો હોય? આપે ર૧૯ ફેબ્રુઆરી ૧૯૬૬નો દિવસ અતિમાનસ આવિર્ભાવની શક્યાત્તના દિવસ તરીકે જાહેર કરેલ છે. એટલે આપનો ઉત્તર સંપૂર્ણ આવિર્ભાવને અનુલક્ષીને હુશે. આ બાબતમાં સંદેહને દૂર કરશો?”

હું એવા અતિમાનસ આવિર્ભાવની વાત કરું છું જે સૌને — અજ્ઞાનીઓને પણ સ્પષ્ટપણે દેખાતો હોય — જેમ, મનુષ્યત્વના આવિર્ભાવ વડે જે બનેલું તે સૌની જાણમાં આવેલું છે તેમ.

(૨૬ એપ્રિલ ૧૯૬૮)

\*

સોણમો શિબિર : ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૬

૧. ધર્મોના પ્રભુ અને એક માત્ર પ્રભુ.<sup>૨</sup>

૨. ત્યાગ અને સાચી ત્યાગભાવના.<sup>૩</sup>

“ભૂતકાળમાં અને હાલમાં જુદા જુદા ધર્મોમાં જે દેવોનાં વિવિધ સ્વરૂપોની ભક્તિ કરવામાં આવે છે તેમના પ્રત્યે શ્રી અરવિંદના યોગના સાધકોનું વલણ કયા પ્રકારનું હોવું જોઈએ?”

એક શુભેચ્છાભર્યો ઔદ્ઘર્યભાવ — સૌ ભક્તો પ્રત્યે.

સર્વ ધર્મો પ્રત્યે જ્ઞાનજ્યોતિપૂર્ણ તટસ્થતા.

અધિમનસનાં સ્વરૂપોને લાગેવળગે છે ત્યાં સુધી, જો કોઈને આમાંના કોઈ સ્વરૂપ સાથે ચાલુ સંબંધ હોય તો દરેક કેસમાં આગવો ઉકેલ હોઈ શકે.

“અતિમાનસ યુગમાં જુદા જુદા ધર્મોના દેવોનું શું સ્થાન હશે? શું તેઓ અતિમાનસ સત્યની પૃથ્વી ઉપર સ્થાપના કરવામાં અને પાર્થિવ તત્ત્વના રૂપાંતરના કાર્યમાં સહાયરૂપ બની શકે?”

આ પ્રશ્ન કવખતનો છે.

(૧૯ ફેબ્રુઆરી ૧૯૬૬)

\*

સત્તરમો શિબિર : ૨૭ એપ્રિલ ૧૯૬૬

૧. આપણો યોગ કઈ રીતે એક મહાન સાહસ છે?<sup>૧</sup>

૨. શ્રદ્ધાની શક્તિ.<sup>૨</sup>

“૧. આપણો યોગ કયા અર્થમાં મહાન સાહસ કર્મ છે?”

તમે અને સાહસ કહી શકો છો કારણ કે પ્રથમવાર જ એક યોગમાં રૂપાંતરનું અને ભૌતિક જીવનને દિવ્ય બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે — એમાંથી નાસી ધૂટવાનું નહિ.

“૨. યોગમાં શ્રદ્ધાની શા માટે અત્યંત અગત્ય છે?”

કારણ કે આપણો કોઈ એવી તદન નવીન વસ્તુને લક્ષ્ય સ્થાને રાખેલી છે જે આ અગાઉ કદ્દી કરવામાં આવેલી નથી.

“૩. એની નિર્ણાયક શક્તિનો આધાર શો છે?”

તમારી શ્રદ્ધા તમને પરમ પ્રભુના રક્ષણ હેઠળ મૂકે છે અને તેઓ સર્વશક્તિમાન છે.

(૨૬ એપ્રિલ ૧૯૬૬)

\*

## ઇદ્દી વાર્ષિક સભા : ૧૭ ઓગસ્ટ ૧૯૬૬

શબ્દોથી પર, વિચારોથી પર થઈને એક જ્યોતિર્મંત નીરવતામાં અભીપ્સાપૂર્વ  
શ્રદ્ધા સાથે તમારી જાતને સંપૂર્ણપણે, અશોષપણે, નિતાંત-ભાવે, સૌ અસ્તિત્વોના  
પરમ સ્વામીને તમારી જાત સોંપી દો અને તમારે જે કરવું છે તે તેઓ કરશો.

પ્રેમ અને આશિષ સાથે.\*

\*

## અદારમો શિબિર : ૨૩ નવેમ્બર ૧૯૬૬

આ વિષય લો.

“જગતની મુક્તિ એકતા અને સંવાદમાં છે. તમે આ એકતા અને સંવાદનો  
કેવો ઘ્યાલ સેવો છો? આશીર્વાદ.”<sup>૧</sup>

\*

## ઓગાણીસમો શિબિર: ૨૨ ફેબ્રુઆરી ૧૯૭૦

એવી કઈ મહુાન તક છે જેને માટે જગત તૈયારી કરી રહ્યું છે? અમે એમાં કઈ  
રીતે સહાયભૂત થઈ શકીએ?<sup>૨</sup>

(આ વિષય ૧૯૭૦ના નૂતન વર્ષના સંદેશને અનુલક્ષીને છે. “જગત  
એક મહુાન પરિવર્તનની તૈયારી કરી રહ્યું છે. તમે મદદ કરશો?”)

“૧. કયા મહુાન પરિવર્તન માટે જગત તૈયારી કરી રહ્યું છે?”

ચેતનાનું પરિવર્તન. અને જ્યારે આપણી ચેતનાનું પરિવર્તન થશે ત્યારે એ પરિવર્તન  
શું છે તે સમજશે.

“૨. અમે એ પરિવર્તન બની આવે તેમાં કઈ રીતે મદદરૂપ થઈ શકીએ?”

\* આ સંદેશો બીજા એક સાધકને અન્ય પ્રસંગે આપવામાં આવેલો અને આ પ્રસંગે તેને  
અપનાવવાની અનુમતિ મળેલી.

એ પરિવર્તન આપણી સહાયની રાહ જોઈ રહ્યું નથી. પરંતુ આપણે આપણી ચેતનાને ખુલ્લી રાખવી જોઈએ કે જેથી જ્યારે એ આવે ત્યારે આપણા માટે એ નકામી ન નીવડે.

(૧૯ ફેબ્રુઆરી ૧૯૭૦)

\*

## વીસમ્બો શિબિર : ૨૬ એપ્રિલ ૧૯૭૦

શું સુખી થવું એ જીવનનું લક્ષ્ય છે ?<sup>૨</sup>

આ વસ્તુ, હકીકતોને ઊલટી કરીને મૂકવા બસાબર છે.

માનવજીવનનું લક્ષ્ય પ્રભુની શોધ અને તેમની અભિવ્યક્તિ છે. સ્વાભાવિક રીતે, આ શોધ આપણાને સુખ પ્રત્યે લઈ જાય છે. પરંતુ આ સુખ તો એક પરિણામ રૂપ છે, પોતે જ લક્ષ્યરૂપ નથી. અને જીવનના લક્ષ્યના પરિણામે મળી આવતી વસ્તુને લક્ષ્ય સ્થાને સ્થાપવાની ભૂલ જ કારણે જ મનુષ્ય જાતિને પીડી રહેલી અનેક યાતનાઓના કારણ રૂપ છે.\*

(૨૮ માર્ચ ૧૯૭૦)

\*

## સાતમી વાર્ષિક સભા : ૧૬ ઓગસ્ટ ૧૯૭૦

શ્રી અરવિંદના સ્વખનનું ભારત.<sup>૩</sup>

“આપે આપના એક સંદેશામાં કહ્યું છે કે, ‘પ્રથમ મશ્વ તો ભારતે પોતાનો આત્મા શોધવાનો છે.’”

આ આત્માને કઈ રીતે શોધવો ? ”

તમારા ચૈત્ય સ્વરૂપ વિષે સભાન બનો. તમારા ચૈત્ય સ્વરૂપને ભારતના આત્મા પ્રત્યે સઘન રસ લેવા દો અને એના પ્રત્યે એક સેવાની ભાવના સાથે અભીષ્ટા સેવો; અને જો તમે સાચા દિલથી એમ કરશો તો સર્ફળ થશો.

(૧૫ જૂન ૧૯૭૦)

\*

---

\* મૂળ પુસ્તકમાં આ લખાણનો શ્રી માતાજીના હસ્તાક્ષરનો બ્લોક છે.

## એકવીસમો શિબિર : ૨૧ નવેમ્બર ૧૯૭૦

જગતના પ્રશ્નોનો ઉકેલ ચેતનાના પરિવર્તનમાં રખાયેલો છે. આપનો આ પરિવર્તન વિષેનો જ્યાલ શું છે અને તે કઈ રીતે બની આવે?²

જે ચેતનાનો આવિર્ભાવ કરવાનો છે તે અત્યારે પૃથ્વીના વાતાવરણમાં છે જ. હવે એ કેવળ ગ્રહણશીલતાનો પ્રશ્ન છે.

(૧૮ નવેમ્બર ૧૯૭૦)

\*

## ભાવીસમો શિબિર : ૨૮ ફેબ્રુઆરી ૧૯૭૧

ભાવિ પ્રત્યે કઈ રીતે કૂદકો મારવો?²

(આ પ્રશ્નનો આધાર ૧૯૭૧ના નૂતન વર્ષના સંદેશમાં છે: “ધન્ય તેમને જેઓ ભાવિ પ્રત્યે કૂદકો લગાવી શકે છે.”), આપના અગાઉના એક નૂતન વર્ષના સંદેશમાં આપે એક ‘અનિવાર્ય પસંદગી’ કરવા જણાવ્યું હતું. આ વર્ષે હવે આપ કૂદકો મારવાનું કહો છે. આ ‘પસંદગી’ અને ‘કૂદકા’ વરચે શું તફાવત છે?”

પસંદગી મનની હોય છે. કૂદકો આખાયે સ્વરૂપનો હોય છે.

“આ કૂદકો કઈ રીતે મારવો?”

સૌઅ પોતપોતાની રીતે.

“આપે આ વર્ષના સંદેશમાં બાઈબલની ભાષા વાપરીને ધન્ય છે તેઓને એમ કહ્યું છે. આની પાછળ કોઈ સેકેત છે?”

‘ધન્ય છે’ એ કાંઈ બાઈબલની આગવી મિલકત નથી.

(૨૪ ફેબ્રુઆરી ૧૯૭૧)

\*

## તેવીસમો શિબિર : ૨૫ એપ્રિલ ૧૯૭૧

સર્વાગ સંપૂર્ણતાનો આપણો આઠર્ચ શો? <sup>૨</sup>

પ્રભુ સાથે સભાન એકતા.

(૨૮ માર્ચ ૧૯૭૧)

\*

## આઠમી વાર્ષિક સભા : ૨૨ ઓગસ્ટ ૧૯૭૧

શ્રદ્ધાવાન અને સત્યનિષ્ઠ બનો.

આશીર્વાદ.

(૨૨ ઓગસ્ટ ૧૯૭૧)

\*

## ચોવીસમો શિબિર : ૨૮ નવેમ્બર ૧૯૭૧

શ્રી અરવિંદનો યૌવનને સાદ. <sup>૨</sup>

“શ્રી અરવિંદનો યુવાનનોને શો સાદ છે?”

અતિમાનસ ચેતનાના પ્રકાશમાં એક વધુ ઉત્તમ ભાવિની રચના કરનાર બનવું.

(૨૭ નવેમ્બર ૧૯૭૧)

\*

## પચીસમો શિબિર : ૨૭ ફેબ્રુઆરી ૧૯૭૨

શ્રી અરવિંદની શતાબ્દીને લાયક કઈ રીતે બનવું? <sup>૩</sup>

(આ વિષય ૧૯૭૨ના નૂતન વર્ષના સંદેશને અનુલક્ષીને છે. “આપણો સૌ શ્રી અરવિંદની શતાબ્દી ઊજવવાને લાયક બનીએ.”)

“આ વર્ષની પહેલી જાન્યુઆરીએ આપે કહેલું : “શ્રી અરવિંદના શતાબ્દી વર્ષ માટે એક વિશિષ્ટ સહાય પૃથ્વી ઉપર આવી છે.” આપ એ

સહાયના પ્રકાર અને કર્મ વિષે કઈ ઝેંઘાણી આપશો? અને અમે એનો લાભ કઈ રીતે ઉઠાવીએ તે જણાવશો?

જે લોકોએ તેમના ચૈત્ય સ્વરૂપ દ્વારા તેમના અહુંભાવ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હશે તેઓ આ સહાયને જીલી શકવા સમર્થ બનશે, તેમને એ સહાય શું છે તેની જાગુણ થશે અને તેમને તેનો પૂર્ણ લાભ મળશે.

(૨૪ ફેબ્રુઆરી ૧૯૭૨)

\*

છાચ્ચીસમો શિબિર : ૨૩ એપ્રિલ ૧૯૭૨

શિક્ષણ અને યોગ.<sup>૨</sup>

“યોગ માર્ગના પાલનની તાલીમ રૂપે જ્યારે શિક્ષણને અપનાવવામાં આવે ત્યારે એની પાછળ કયા પ્રકારનો ભાવ હોવો જોઈએ?”

શ્રી અરવિંદનાં લખાણો વાંચ્યો.

(૧૬ એપ્રિલ ૧૯૭૨)

\*

નવમી વાર્ષિક સભા : ૧૨ ઓંગસ્ટ ૧૯૭૨

શ્રી અરવિંદ ભવિષ્યનો આવિર્ભાવ કરે છે.<sup>૧</sup>

“આપના બીજુ જાન્યુઆરી ૧૯૭૨ના સંદેશમાં આપે કહ્યું છે કે “તેમના આ શતાબ્દી વર્ષમાં એમની સહાય હજુ પણ વધુ બળવાન બનશે. એની પ્રત્યે ખુલ્લા રહ્યીને તેનો લાભ લેવાનું આપણા હૃથમાં છે. ભવિષ્ય તેમનું છે જેમનો આત્મા એક શૂરવીરનો હોય.”

આ સંદેશમાં જે ‘શૂરવીર’ શબ્દ છે તેનો અર્થ સમજાવશો?

એક શૂરવીર કશાથી બીતો નથી, કોઈ વસ્તુની ફરિયાદ કરતો નથી અને કદી પણ નમતું મુક્તો નથી.

\*

## સત્તાવીસમો શિબિર : ૨૫ ફેબ્રુઆરી ૧૯૭૩

પ્રભુના કાર્યમાં સંપૂર્ણ સત્યનિષ્ઠા સાથે એવો કેવી રીતે સહકાર કરી શકાય  
કે જગતને બતાવી આપી શકાય કે મનુષ્ય સાચો સેવક બની શકે છે. <sup>૨૪</sup>

પ્રભુના સાચા સેવક બનીને.

(૨૪ ફેબ્રુઆરી ૧૯૭૩)

\*

## અદ્વાવીસમો શિબિર : ૨૨ એપ્રિલ ૧૯૭૩

સમાજની એકતા અને વ્યવસ્થાની જરૂરિયાત સાથે વ્યક્તિની સ્વતંત્રતાની  
માગણીનો કઈ રીતે મેળ પાડવો? <sup>૩</sup>

સ્વતંત્રતા એ ગેરવ્યવસ્થા અને ગોટાળાથી દૂરની વસ્તુ છે.

તમારામાં આંતરિક સ્વાતંત્ર્ય હોવું જોઈએ, અને એ જો હશે તો અને કોઈ લઈ  
જઈ શકશે નહિ?

(૨૮ માર્ચ ૧૯૭૩)

\*

(ઓક્ટોબર ૧૯૭૭માં કેટલાક વિદ્યાર્થીઓ શિબિરોમાં બોલતી વેળાએ  
અચકાતા હતા. તેનું કારણ માનસિક તમોગ્રસ્તતા, અને શરમ, અને કોઈ  
સભા સમક્ષ બોલતાં અનુભવાતો ક્ષોભ હતું. આ મુશ્કેલીઓ શ્રી માતાજી  
સમક્ષ રજૂ કરતાં તેઓએ આ પ્રમાણે જવાબ આપેલો : )

આ પ્રકારની પ્રવૃત્તિની પાછળનો મુખ્ય હેતુ જ તેઓ જે મુશ્કેલીઓ રજૂ કરે છે તે  
દૂર કરવાનો છે — આણસ, શરમ, તમોગ્રસ્તતા, વગેરે.

\*. (આ વિષય ૧૯૭૮ની નાતાલના સંદેશને અનુસરીને છે : “આપણે જગતને બતાવી  
આપવા માગીએ છીએ કે મનુષ્ય પ્રભુનો સાચો સેવક બની શકે છે. આ કાર્યમાં કોણ સંપૂર્ણ  
સત્યનિષ્ઠા સાથે સહકાર આપશો?”)

અને આટલા માટે જ મેં આ કાર્યક્રમ વર્ષમાં ચાર વાર ગોઠવવા કહેલું.

વિદ્યાર્થીઓ અહીં લહેરી જીવન ગાળવા આવ્યા નથી પણ દિવ્ય જીવનની તૈયારી કરવા આવ્યા છે.

જો તેઓ પ્રયત્ન કરવાનું ટાળે, આળસુ અને ‘તામસિક’ બની રહે તો તૈયારી કઈ રીતે કરશે?

(૩૦ ઓક્ટોબર ૧૯૬૭)

\*

## શાળામાં શ્રી માતાજીના કાર્યની જાંખી

(૧)

### આશ્રમ અને શાળામાં ફેન્ચ

(બે ગ્રામ શિક્ષકો આશ્રમની શાળામાં ઉપયોગમાં લેવાના શિક્ષણ માટેની ભાષાના માધ્યમ વિષે ચર્ચા કરી રહ્યા હતા. આ ચર્ચા શ્રી માતાજી સમક્ષ આ નોંધ સાથે રજૂ કરવામાં આવેલી : “શ્રી અરવિંદે તેમના કેળવણી ઉપરના પુસ્તકમાં કહેલું છે કે બાળકનું શિક્ષણ તેની માતૃભાષામાં થવું જોઈએ.”)

શ્રી અરવિંદે એમ કહેલું અને બીજી ઘણી વસ્તુઓ કહેલી જેને લઈને એમની સલાહ સંપૂર્ણ બને, મતાગ્રહીપણું ઊભું થવાની શક્યતા ન રહે. શ્રી અરવિંદે ઘણી વાર કહેલું કે જો તમે એક વસ્તુનું પ્રતિપાદન કરતા હો તો એથી વિરુદ્ધના વસ્તુનું પ્રતિપાદન કરતાં પણ આવડવું જોઈએ, નહિ તો તમે સત્યને સમજી નહિ શકો.

(એ જ પત્રમાં એક શિક્ષકે આશ્રમમાં ફેન્ચના ભાવિ વિષે શંકા ઉપસ્થિત કરેલી.)

આશ્રમમાં ફેન્ચનું શિક્ષણ ચાલુ રહેશે. કંઈ નહિ તો હું જ્યાં સુધી અહીં છું ત્યાં સુધી, કારણ કે શ્રી અરવિંદ ફેન્ચને બહુ ચાહુતા અને સારી પેઠે જાણતા હતા અને એને ભાષાઓના જ્ઞાનમાં મહત્વનો ભાગ ગણાતા હતા.

(૨૩ ઓગસ્ટ ૧૯૬૫)

(ફેન્ચ ભાષા સંબંધે વાતચીત કરતાં એક શિષ્યે શ્રી માતાજીનું ધ્યાન દોરીને કહ્યું કે હવે તો ઘણા ફેન્ચ લોકો, ખાસ કરીને નવા આવનારાઓ, જેઓ ફેન્ચ સારી પેઠે જાણતા હોય છે તેમની સાથે પણ અંગેજમાં વાતચીત કરે છે. શ્રી માતાજીએ પણભર એકાગ્રતા કરીને કહ્યું : “એ એમનું કમનસીબ કહેવાય.” પછી એ શિષ્યે પૂછ્યું કે તેઓ આ બાબતમાં કોઈ સંદેશ આપશો

કે કેમ? તેમણે નીચેનો સંદેશો લખ્યો અને સૂચયબું કે એને આશ્રમમાં અને શાળામાં મૂકવો અને એની એક નકલ ‘ચૂંટેલાં પુસ્તકોનું પુસ્તકાલય’માં મૂકવી. એ માટે એ સંદેશની ફોટો કોપીઓ કરાવવામાં આવેલી.)

શ્રી અરવિંદ ફેન્ચને બહુ ચાહેતા હતા. તેઓ કહેતા હતા કે એ એક ચોક્કસ અને સ્પષ્ટ ભાષા છે, અને એને લઈને મનની સ્પષ્ટતા વધે છે. ચેતનાના વિકાસ માટે એ કિંમતી છે. ફેન્ચ ભાષામાં આપણે કાંઈ કહેવાનું હોય તે ચોક્કસપણે કહી શકીએ છીએ.

આશીર્વાદ.

(૧૮ અક્ટોબર ૧૯૭૧)

\*

(૨)

## ફેન્ચ વર્ગોમાં કાર્યવ્યવસ્થા

(શિક્ષકોનું એક જૂથ અમુક વર્ગોનું પુનર્ગંઠન કરવા માગતું હતું. એમાંના એકે શ્રી માતાજીને પૂછેલું કે તેમને કાંઈ વાંધો છે કે કેમ.)

કાંઈ વાંધો નથી. આવી બધી વસ્તુઓ તમારે તમારી અંદર સ્વતંત્રપણે ગોઠવી લેવી.

(અન્યુઆરી ૧૯૬૧)

(બે શિક્ષકો વચ્ચે કામની બાબતમાં જરા ઉગ્ર ચર્ચા થયેલી એમાંના એકે શ્રી માતાજી પાસે એ મશ્શની રજૂઆત કરી અને તેમનો અભિપ્રાય માર્ગ્યો.)

સાચું કહું તો મારો કોઈ અભિપ્રાય નથી. સત્ય દૃષ્ટિ અનુસાર બધી વસ્તુઓ ભયંકર રીતે બેળસેળ થઈ ગયેલ છે; ઓછાવતા અંશો એ પ્રકાશ અને અંધકારનું, સત્ય અને અસત્યનું જ્ઞાન અને અજ્ઞાનતાનું સદ્ભાષ્પૂર્ગ મિશ્રાગ છે. અને જ્યાં સુધી નિર્ણયો લેવામાં અને કામ કરવામાં અભિપ્રાયોનો આધાર હશે ત્યાં સુધી એમ જ ચાલશો.

આપણે એક સત્ય દર્શનની ઉપર આધારિત કાર્યનું ઉદાહરણ રજૂ કરવા માગીએ છીએ પરંતુ દુર્ભાગ્યે આપણે હજી એ આદર્શ પ્રાપ્ત કરવાથી ઘણા દૂર છીએ; અને કદાપિ સત્ય દર્શનને પ્રગટ કરવામાં આવે છે તો પણ એનો અમલ કરવામાં વિકૃતિ દાખલ થઈ જાય છે.

એટલે અત્યારે વસ્તુસ્થિતિ જે પ્રકારની છે તે જોતાં શું સાચું અને શું ખોટું, શું લક્ષ્યથી દૂર લઈ જાય છે અને શું લક્ષ્યની નજીક લઈ જાય છે તે કહેવું અશક્ય છે.

દરેક વસ્તુને પ્રગતિના કામમાં ઉપયોગી કરી શકાય છે, દરેક વસ્તુનો ઉપયોગ થઈ શકે, જો માણસને તેનો ઉપયોગ કરતાં આવડતું હોય તો.

અગત્યની વાત તો એ છે કે તમારે જે લક્ષ્યને સિદ્ધ કરવું છે તે કદી પણ તમારી નજર બહાર જવું ન જોઈએ અને દરેક સંજોગોનો ઉપયોગ આ હેતુને લક્ષ્યમાં રાખીને કરવો જોઈએ.

છેવટે, કોઈ વસ્તુથી વિરુદ્ધમાં નિર્ગય બાંધી ન લેવો, પરંતુ સંજાગો જે પ્રમાણે વિકાસ પામતા જાય તે જોતા રહેવું, એક સાક્ષીભાવ જાળવી રાખવો અને એવો વિશ્વાસ રાખવો કે સર્વ ઉહાપણના બંદારદ્દુપ પ્રભુ જે ઉત્તમ અને જરૂરી હશે તે કરશો.

(જુલાઈ ૧૯૬૧)

(એક શિક્ષકે તેના પ્રશ્નો અંગે શ્રી માતાજીએ આપેલા અંગત ઉત્તરો અનેક સાક્ષીઓને બતાવ્યા હતા. પાછળથી એને એ બદલ બેદ થવાથી એણો શ્રી માતાજીને એ બાબતમાં તરત જાણ કરેલી.)

તમે જે કહેલું તેનો કોઈ વાંધો નહિ. કારણ કે તમે જાણો છો કે, હું દરેક વ્યક્તિને, ખરા અંતરથી કહી શકું છું કે “હું સંમત છું.” ખરું જોતાં એ એક એવી વસ્તુ છે જે તમારે સૌને માટે ગળે ઉતારવી મુશ્કેલ છે, કારણ કે મન વડે એનો ભાગ્યે જ સ્વીકાર થાય. પરંતુ દરેક દૃષ્ટિબિંદુની પાછળ એક એવું પાસું, કેટલીક વાર તદ્દન નાનકુંદું પાસું, એવું હોય છે જે સત્યદ્ર્દુપ હોય છે, અને હું એ પાસા સાથે હંમેશાં સંમત થતી હોઉં છું — અલબત્ત એમાં શરત એટલી છે કે એ એક જ વસ્તુને અન્યને જુદી પાડીને સાચી માનવામાં આવે તેવી માગાણી સ્વીકારી શકાય નહિ.

અને હું એક એવી પદ્ધતિની શોધ કરી રહી છું જેમાં આ સૌ પાસાંને કે તેમના યથાસ્થાને અને એકબીજાને હરકત ન કરે તેવી રીતે વ્યક્ત કરી શકાય. જે દિવસે મને એ જડશો, તે દિવસથી હું શાળાની પુનર્વ્યવસ્થા કરવાની શરૂઆત કરીશા. ત્યાં સુધી

તમે તમારા વિચારોને વાચ્યા આપી શકો છો; જ્યાં સુધી તમે મતાગ્રહી ન હો, પોતાને જ સાચા ન માનતા હો, ઉગ્ર ભાવ સેવતા ન હો અને કદી પણ લડતા ન હો, ત્યાં સુધી એમ કરવું એ તંદુરસ્ત પ્રાણાલિકા છે.

(ઓંગસ્ટ ૧૯૬૧)

\*

(૩)

### કેન્ચ શીખવનાર ભારતીય શિક્ષકોને કેન્ચનું શિક્ષણ

આભ્યાસ માટેનાં પાઠ્યપુસ્તકની પસંદગી

(એક યુવાન ભારતીય શિક્ષિકાને તેનું કેન્ચ સુધારવું હતું એટલે એણો શ્રી માતાજીને આલબાટ કેમસના પુસ્તક લા પેસ્ટે વિષે તેમનો અભિપ્રાય પૂછ્યો)

યુરોપિયનો જાડી ચામડીના હોય છે એટલે એમનામાં સાચી કરુણાની લાગણી જગાવવા અમુક વસ્તુઓ તેમને માટે સારી હોય છે. પરંતુ અહીં ભારતમાં તેની જરૂર નથી. અને વધુમાં, જીવન જેટલું તમોગ્રસ્ત છે જેથી વધુ અંધકારભર્યું ચિત્ર લેવાની જરૂર પણ નથી.

(શ્રી માતાજીએ જુલે રોમાંએ લખેલ રેશર્ચ દયુન એલિજનું સૂચન કરીને એ શિક્ષકને પોતાની પાસેની એ પુસ્તકની નકલ કેન્ચ શિક્ષિકાને મોકલી. એ શિક્ષકને એ પુસ્તકનાં અમુક પ્રકરણો આધાતજનક લાઘ્યાં અને એણે પોતાની લાગણીઓ શ્રી માતાજી સમક્ષ કરક શર્દોમાં જણાવી. શ્રી માતાજીએ કહ્યું:)

રેશર્ચ દયુન એલિજ પુસ્તક મારી પસંદગીનું હતું. જુલે રોમાં એક મહાન લેખક છે અને એનું કેન્ચ ઉચ્ચ કોટિનું છે. જ્યારે મેં અમુક ભાગ કાપી કાઢવાના કહેલા\* ત્યારે મેં એ કારણસર કહેલું કે એમાંના અમુક ફકરા યુવાન ખીના મગજ માટે સારા

\* આ અગાઉના પત્રમાં શ્રી માતાજીએ લખેલું કે કેટલાક ભાગ કાપી કાઢવામાં આવે તો જુલે રોમાંએ પુસ્તકો સારાં છે, ખાસ કરીને રિશર્ચ દયુન એલિજ.

નથી. પરંતુ એવા ભાગ છોડી દેવાનું કામ સરળ હતું, બાકીનો ભાગ સારો છે.

(એ ફેન્ચ શિક્ષકે પાઠ્યપુસ્તક માટેની એની શોધ ચાલુ રાખીને માર્ક બ્લાંક-પેના પુસ્તક લા ફાંસ દ'ઓજુદ' ઉઈનું સૂચન કરેલું.)

હું એ પુસ્તકને રસપૂર્વક વાંચી રહી છું. આ વખતે, આ સારું પુસ્તક છે.

(મે ૧૯૬૦)

\*

### કામ માટેના કાર્યક્રમની શોધ

(એ ફેન્ચ શિક્ષિકાએ એના વિદ્યાર્થીઓ પૈકી એક ભારતીય શિક્ષકે અભ્યાસના વિષય તરીકે સંસ્કૃતિના ઇતિહાસની શ્રપ્તેખાનો કાર્યક્રમ શ્રી માતાજી પાસે રજૂ કરેલો.)

હા, આ કામ રસ પે તેવું બનશે પણ એ શરતે કે એનો પાયો શ્રી અરવિંદના દ્વારા સાયકલ ઉપર આધાર રાખતો હોય (એ બુલેટિનમાં પ્રસિદ્ધ થઈ ગયું છે). કારણ કે એ પુસ્તકમાં માનવ ઉત્કાંતિના સર્વ ગ્રંથો ઊભા કરવામાં આવ્યા છે તેમ જ તેમનો ઉકેલ પણ બતાવવામાં આવ્યો છે. જ્યારે જ્યારે શ્રી અરવિંદ કોઈ સંસ્કૃત અથવા કોઈ દેશનો ઉલ્લેખ કરતા હોય ત્યારે તેને અનુરૂપ ઐતિહાસિક તથ્યોનો અભ્યાસ કરવાથી આ કામ રસપ્રાપ્ત બનશે.

(સપ્ટેમ્બર ૧૯૬૦)

\*

“ફેન્ચના એક વર્ગમાં ભારતીય વિદ્યાર્થીઓ આધુનિક લેખકોનું સાહિત્ય વાંચવા ઈચ્છે છે કારણ કે એમાંની ભાષા જૂના મહાગ્રંથો કરતાં વધુ આધુનિક છે. શ્રી માતાજીનું શું માનવું છે?”

આધુનિક લેખકો વિશે હું જે કાંઈ જાણું છું તેને લઈને તેમને વિષે કાંઈ વધુ વાંચવાની મારી ઈચ્છા જ મરી ગઈ છે.

જાણી જોઈને કાઢવામાં શા માટે ઊતરવું? એથી શો ફાયદો? પશ્ચિમના જગતનું

જ્ઞાન અત્યારે કાદવમાં આગેટી રહ્યું છે. એની ભાષે જ જરૂર હોય. આના ઉકેલ તરીકે, સાવધાનીપૂર્વક પસંદ કરેલા, ચૂટેલા ફકરાઓ વધુ સારા પડશે.

(મે ૧૯૬૩)

(એક એવા શિક્ષકને અંગે આ વાત છે જેને ફેન્ચ શીખવવા માટે એ ભાષાનો સઘન અભ્યાસ કરવાનો રહેતો અને સાથે સાથે ઓણે શાળાના કંઈક ભારે એવા સમયપત્રકને પણ અનુસરતા રહેવાનું રહેતું.)

હું સંપૂર્ણ પણે સંમત છું. ‘ક્ષ’ને ફેન્ચ સારી પેઠે આવડી જાય એટલો સમય મળવો જોઈએ અને શિક્ષણનો કાર્યક્રમ એવી રીતે ગોડવવો જોઈએ કે જેથી જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી એ તમારી પાસેથી શિક્ષણ લેવાનું ચાલુ રાખી શકે.

(સપ્ટેમ્બર ૧૯૬૬)

\*

(૪)

### વિદ્યાર્થીઓને ફેન્ચ શીખવવા વિષે

“અમે બાળકોની જોડણી કઈ રીતે સુધારી શકીએ?”

સામાન્ય રીતે, જોડણી માટે આપણે આપણી આંખોની મદદ લેવી જોઈએ. એમ થવું જોઈએ કે દરેક શાબ્દની બાબતમાં આંખની દૃષ્ટિએ અમુક આકાર હોવો જોઈએ, જે તે યાદ રાખી શકે. દૃષ્ટિ સ્મરણશક્તિ, મનોમય સ્મરણશક્તિ કરતાં વધુ બળવાન હોય છે. તમારે ખૂબ ખૂબ વાંચવું જોઈએ — જુઓ, જુઓ, પાટિયા ઉપર, પુસ્તકોમાં, ચિત્રોમાં.

અને શૈલી, જાતિ અને વ્યાકરણની બાબતમાં પણ સારામાં સારી વસ્તુ તે ખૂબ ખૂબ વાંચવું તે છે. આ રીતે આ બધું અવચેતનામાં જાય છે. શીખવા માટેનો આ જ માર્ગ ઉત્તમ છે.

(જાન્યુઆરી ૧૯૬૨)

## પરીક્ષાઓ વિષે

પરીક્ષાઓ તમને કોઈ બાળકનું શૈક્ષણિક મૂલ્ય જાણવામાં ઉપયોગી નીવડશે પરંતુ એથી એનું સાચું મૂલ્ય નહિ પરખાય.

બાળકને સાચા મૂલ્યની બાબતમાં કોઈ અન્ય વસ્તુ શોધવી પડશે. એ હવે પછી જોઈશું. એ વસ્તુ તદન બિન્ન પ્રકારની હશે.

હું સાચા મૂલ્ય અને શૈક્ષણિક મૂલ્યની વિરોધી તુલના કરતી નથી; એ બંને એક જ વ્યક્તિમાં એક સાથે હોઈ શકે, પરંતુ એ એક એવી અસામાન્ય ઘટના છે જે બહુ જ ઓછા લોકોની બાબતમાં બને છે.

(૧૯૬૨)

(શાળામાં શીખવાતા ફેન્ચ વિષેના એક શિક્ષકના પત્રના હંસિયામાં શ્રી માતાજીની ટીકાઓ. એ વિદ્યાર્થીઓ કામની નોંધવહી રાખતા હતા.)

“બાળકો ફેન્ચમાં પ્રગતિ ન કરવાનાં કારણોમાંનું એક તો એ છે કે શિક્ષકો તેમની ભૂલ સુધારતા નથી.”

તદન સાચું.

“નોંધવહીઓ સાથે કામ કરવું અસરકારક બનવા માટે સુધારાઓ કરું જોઈએ.”

તદન સાચું.

“મેં શિક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ માટે બધાં જ મનોયતનો સુધારીને તૈયાર કરવા માંડ્યાં છે.”

ધણું સરસ.

“શિક્ષકોએ આ સુધારેલા પાઈ એકાઈ વાર તો વાંચી જવા જોઈએ...”

એક કરતાં પણ વધુ વાર.

...જેથી તેમને પોતાની ભૂલોનું ભાન થાય.”

હા, તેમને એની ઘણી જરૂર છે.

“બાળકની પાસે આ સુધારેલો પાઠ હોય તે વધુ સારું જેથી એ પોતાના લેખન સાથે સરખાવી શકે.”

હા, એ ઘણું ઉપયોગી છે.

“કેવળ ભૂલો નીચે લીટીઓ કરવાથી બાળકને કશું પણ શીખવાનું મળતું નથી.”

સાચું.

“મને ભય છે કે હું શિક્ષકો માટે જે સુધારેલા પાઠ તૈયાર કરું છું તેમને અદભૂત્વક ટેબલના ખાનામાં રાખવામાં આવશે.”

પ્રભુ બચાવે!

“જો એમ બનશો તો બાળકો એક આખું વર્ષ કશા અર્થ વિનાની મહેનત કર્યા કરશો.”

તમારું કહેવું ખરું છે. થોડાક અપવાદને બાદ કરતાં લગભગ બધા જ શિક્ષકો આળસું છે. — તેમના વિદ્યાર્થીઓ કરતાં પણ વધારે.

“મને લાગે છે કે હું આપને આ ફેન્ચ દ્વારા હેરાન કરી રહી છું.”

ના, તમે મને હેરાન નથી કરતાં. તમારું કહેવું તદ્દન ખરું છે.

“મને એમ લાગે છે કે ઘણી બધી શુભેચ્છાનો દુર્વ્યય થાય છે. બાળકોની શુભેચ્છા એળે જાય છે કારણ કે વર્ગોમાં સારું વાતાવરણ હોવા છતાં, જે કામ થાય છે તે અસરકારક નથી અને જરૂરી કામ થતું નથી.”

દ.

(૨૫ ડિસેમ્બર ૧૯૬૨)

\*

(૫)

### પસંદ કરેલાં પુસ્તકોનું પુસ્તકાલય

(એક શિક્ષકના ધ્યાનમાં એવું આવ્યું કે જો આ પુસ્તકાલયને તેના નામને અનુરૂપ બનાવવું હોય તો એમાંનાં મોટા ભાગનાં પુસ્તકો ત્યાં ન હોવાં જોઈએ. એણે શ્રી માતાજીને અનેક મુલાકાતો દરમ્યાન આ વિષે વાત કરેલી. તેનું પરિણામ આ મુજબ : )

પસંદ કરેલાં પુસ્તકોના પુસ્તકાલય સંબંધે શ્રી માતાજીની સલાહ\*

બધી નવલકથાઓ કાડી નાખો.

કેવળ તત્વજ્ઞાન, કલા, વિજ્ઞાન વગેરેનાં અભ્યાસપૂર્ણ પુસ્તકો રાખો.

સારી વસ્તુ તે એ છે કે એ પુસ્તકોની યાદી બનાવીને થોડો થોડો કરીને શ્રી માતાજી પાસે રજૂ કરવી જેથી તેમને ખબર પડે કે તેમાં શું છે.

આ એક અગત્યની બાબત છે.

(શિક્ષકે અભ્યાસપૂર્ણ પુસ્તકો શબ્દનો અર્થ પૂછ્યો. શ્રી માતાજીનો ઉત્તર : )

જે કોઈ પુસ્તકોનો હેતુ કંઈક શીખવવાનું હોય તે.

આ પુસ્તકાલય પાછળનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ સારું ફેન્ચ શીખે અને ફેન્ચ ચિંતનમાં જે કાંઈ ઉત્તમ છે તે શીખે.

\*. આ નોંધ શ્રી માતાજી બોલ્યાં કે તરત જ લખી લેવામાં આવેલી અને જ્યારે તેમને વાંચી બતાવવામાં આવી ત્યારે તેમણે તરત જ એની ઉપર ‘મંજૂર’ શબ્દો લખી આપેલા.

એમાં કેવળ અભ્યાસપૂર્ગ પુસ્તકોનો જ સમાવેશ થવો જોઈએ એટલે કે જે પુસ્તકો શિક્ષાશાન્તમક હોય, જેમ કે તત્ત્વજ્ઞાન, કલા, વિજ્ઞાન વગેરે.

એમાં બહુ ઓછી નવલક્ષયાઓ હોવી જોઈએ (વિદ્યાર્થીઓ નવલક્ષયાઓ વધુ પડતી વાંચે છે), અને આધુનિક નવલક્ષયાઓ તો બિલકુલ નહિ, સિવાય કે તેઓ કોઈ ખાસ સારી ગુણવત્તા ધરાવતી હોય.

આ પુસ્તકાલયમાં સાહિત્યને સ્થાન છે, કારણ કે વિદ્યાર્થીઓને સાહિત્ય શું છે તેનું ભાન થાય.

પુસ્તકો પસંદ કરતી વેળાએ સૌથી અગત્યની વસ્તુ લક્ષમાં રાખવાની એ છે કે એની ભાષા અને શૈલી ઉત્તમ કક્ષાની હોવી જોઈએ,<sup>૧</sup> જેમ ફ્લોબર્ટમાં છે તેમ કોઈ “અદ્ભુત” વસ્તુ હોય. કોઈ ભાષાંતરો ન રાખવા, સિવાય કે તે બહુ વિઘ્નાત પુસ્તકોનાં હોય — એ બહુ ઓછાં છે એટલા કારણે જ આપણે એમને ઉત્તમ ગ્રંથો ન ગણી શકીએ?<sup>૨</sup>

(પસંદગીનાં પુસ્તકોના પુસ્તકાલયમાં કાઢી નાખવાનાં પુસ્તકો વિષે, શ્રી માતાજીએ કહેલ્યું :)

એમને એક ખાસ સ્થળો, એક ખાસ રૂમમાં મૂકવાં, અને “ખરાબ પુસ્તકો” એવું નામ આપવું એટલે જેમને એમાં શું છે તેનો અભ્યાસ કરવો હોય ત્યારે કરી શકે.

જ્યારે પુસ્તકો મંગાવો ત્યારે ઘણી કાળજી રાખવી.

‘પસંદગીનાં પુસ્તકોના પુસ્તકાલય’નો ગ્રન્થ અગત્યનો છે.

**પસંદગીનાં પુસ્તકોના પુસ્તકાલય માટે સંદેશ**

આ પુસ્તકાલયનો હેતુ સારું ફેન્ચ શીખવવાનો છે.

૧. પુસ્તકો સારી શૈલીમાં લાખાયેલાં હોવાં જોઈએ.

૨. શિક્ષાશાની દૃષ્ટિએ રસપ્રદ હોય તેવાં પુસ્તકોને પ્રથમ પસંદગી આપવી.

૩. નવલક્ષયાઓ ખાસ વિશિષ્ટ પ્રકારના સારા લખાણવાળી હોય તો જ

૧. આ શિક્ષકે વાર્તાલાપને નોંધી લઈને શ્રી માતાજીને વાંચી સંભળાવતાં તેઓએ મંજૂરીની સહી કરેલી.

૨. આ સંદેશ શ્રી માતાજીએ લખાવીને સહી કરેલી.

રાખવી.

૪. બહુ જ થોડાં ભાષાંતરો – પ્રાણ્યાત પુસ્તકોનાં જ.
૫. બાકીનાં બીજાં બધાં મોટા પુસ્તકાલયમાં મોકલી આપો : એવી નોંધ સાથે કે આ પુસ્તકો ભલામણપાત્ર નથી.<sup>૧</sup>

(૧૯૭૧)

(એ શિક્ષકે એક પત્ર શ્રી માતાજીને વાંચી સંભળાવ્યો જેમાં અન્ય વસ્તુઓ સાથે આ ગ્રમાણે લાખેલું હતું : “મને લાગે છે કે પસંદગીની ચોપડીઓના પુસ્તકાલયમાંનાં ઘણાંઘરાં પુસ્તકો બદલી શકાય તેમ છે કે જેથી તેમનું ઘોરણ જરા ઊંચું આવે. આપ કહો કે આપ આમ કરવાને અનુમોદન આપો છો કે કેમ કે જેથી હું તેમ કરવા પ્રયત્ન કરું”. શ્રી માતાજીએ ભારપૂર્વક, મૌખિક ઉત્તર આપેલોઃ)

મારું સંપૂર્ણ અનુમોદન છે. એમ કરવું અનિવાર્ય છે. આપણે આવી કક્ષાએ ઉત્તરી પણ્યાં છીએ! દરેક વસ્તુમાં! આહ, હું સંપૂર્ણપણે સંમત છું.

(૧૯૭૨)

\*

(૬)

દસથી બાર વર્ષનાં બાળકોના વર્ગમાં શ્રી માતાજીનું કાર્ય

“આપણે નાનાં બાળકોને ફેન્ચ કરી રીતે શીખવવું?”

સારામાં સારું એ કે એમને બહુ સાદા શબ્દો અને વાક્યો વાપરીને એમને સમજાય તેવી રીતે કોઈ વાર્તા કહેવી (નાની વાર્તા, રસ પે તેવી કે રમૂજ), અને પાછળથી તેમને તેમણે જે સાંભળ્યું હોય તે લખી લાવવા વર્ગમાં કહેવું.

“હા, પણ બાળકો બહુ ઘોંઘાટ કરે છે.”

૧. આ સંદેશ શ્રી માતાજીએ લખાવી ચકાસીને સહી કરેલી.

થોડી શાંતિ જરૂરી છે. હું જાણું છું કે અત્યંત તોફાની બાળકો ઘણુંખરું ઘણાં બુદ્ધિશાળી હોય છે. પણ તેઓ આજ્ઞાપાલક બને તે માટે તેમના ઉપર કોઈ એવી બુદ્ધિનું દબાણ લાગવું જોઈએ કે તેમના પોતાના કરતાં વધુ હોય. અને એમ કરી શકાય માટે તમારે છેક તેમની કક્ષા સુધી નીચે ન ઊતરવા શક્તિમાન હોવું જોઈએ ઉપરાંત વધુમાં તેઓ જે કાંઈ કરતાં હોય તેથી અવિચિત્ર રહેતાં આવડવું જોઈએ. હુકીકતમાં આ એક યોગને લગતો પ્રશ્ન છે.

**“જો શિક્ષકમાં શાંતિ હોય તો આ સર્વ પ્રશ્નોનો ઉકેલ આવે?”**

હા, પરંતુ એમ થઈ શકે તે માટે સ્વરૂપના સર્વ ભાગોમાં એવી સંપૂર્ણ શાંતિ હોવી જોઈએ કે એની શક્તિ એની મારફત વ્યક્ત થઈ શકે.

(બાળકોની નોટબુકો શ્રી માતાજીને તપાસવા મોકલેલી.)

મેં કોઈ જાતનું વર્ગીકરણ કર્યા વિના, બાળકોનાં પુસ્તકોમાં માર્ક મૂક્યા છે. આ પ્રકારનું વર્ગીકરણ જરૂરી છે? દરેકમાં જુદી જુદી આવડત હોય છે અને એનું વર્ગી કરણ કરવું મુશ્કેલ છે.

(જૂન-જુલાઈ ૧૯૬૦)

\*

(એક શિક્ષકના પત્રમાંથી અવતરણાઃ) “આપ મારા પર વિશ્વાસ રાખો છો અને આપને લઈને હું પણ બાળકો ઉપર વિશ્વાસ રાખું છું; મને પોતાને લાગે છે ત્યાં સુધી, હું કાંઈ જાણુતો નથી તેમ જ મારે કંઈ જોઈનું નથી, સિવાય કે જે વસ્તુની આપ મારી પાસેથી અપેક્ષા રાખતાં હો. કેવળ એટલું જ માગું છું કે મારે દરેક ડગલે આપ મને બતાવતાં રહ્યો કે મારે શું ઉત્તર આપવા. અમને આપ દોરવાણી આપો કે જેથી કરીને અમે નીરવપણે અમારાં હદ્દયોનાં ઊડાણોમાંથી આપનું અનુસરણ કરતાં રહ્યીએ પછી એનું બાધ્ય પરિણામ જે આવવાનું હોય તે ભલે આવે. કેવળ બાળકોને આપની શાંતિ અને પ્રેમમાં ખીલવા દો અને અમને સૌને આપની સાથે રાખો.”)

વર્ગ, બાળકો, તમે અને મારી વચ્ચે જે સંબંધ સ્થપાયેલો છે એ સાચે જ અત્યંત

અગત્યનો છે અને ગમે તે મૂલ્ય ચૂકવવું પડે તો પણ એને જાળવી રાખવો જોઈએ. પરંતુ એનો આધાર બાધ રચનાઓ કે સ્થળ વ્યવસ્થાઓ કરતાં અંતરના વલાણ ઉપર વધુ આધાર રાખે છે. ખરું જોતાં, આવું જ વલાણ આખી યે શાળામાં, વર્ગોમાં, સૌ શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં હજાર હોવું જોઈએ. આ વસ્તુ પ્રાપ્ત કરવી જોઈએ. અને એને માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ.

(વર્ગમાં ઘણો સુધારો થયો હતો; શિક્ષકે લખ્યું :)

“આ સર્વ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે તેનું કારણ આપનું અમારી અંદર થતું કાર્ય છે, ખરું ને?”

ઉદ્દેશ્ય.

(શિક્ષકે પૂછ્યું કે શ્રી માતાજી સાથે જે પ્રયોગ ચાલી રહ્યો હતો તે જોતાં, પછીના વર્ષમાં પણ બીજાં બાળકોનું ગ્રૂપ લેવા કરતાં એનાં એ જ બાળકો ચાલુ રાખવાં સારું ખરું કે નહિ.)

આ એક પ્રયોગ હોય તો એવો હોવો જોઈએ કે જે નમનીય હોય અને બાળકોનાં અલગ અલગ ચારિત્રયને અનુસરીને વિગતોમાં જે કાંઈ ફેરફાર કરવા પડે તે કરવાની ક્ષમતા સાથે સૌ બાળકોને લાગુ પાડી શકાય તેવો હોવો જોઈએ. એટલે તમે ખાતરી રાખજો કે આ પ્રયોગ ચાલુ રહેશો — કેવળ બાળકો એનાં એ નહિ હોય.

(શિક્ષકે બાળકોમાં કાર્યકારી જીથોની ગોઠવણ કરી હતી. એનાં પરિણામો અલગ અલગ આવ્યાં અને વર્ગમાં ધોંઘાટ થવા લાગ્યો. શિક્ષકે પૂછ્યું કે તેમણે આમ ને આમ ચાલુ રાખવું કેમ.)

એમનો પ્રયોગ ચાલુ રાખવા દો. ધીરે ધીરે પરિસ્થિતિ થાળે પડશે અને પરિણામોમાં સુધારો આવશે.

(એક ઉત્તમ ગાળા પછી, બાળકો સાથેનું કાર્ય મુશ્કેલ બન્યું.)

આ દીલાશ આવવાનું કારણ બેશક આગામી રજાઓ છે.

(અક્ટોબર ૧૯૬૦)

\*

(૭)

### સાતથી નવ વર્ષનાં બાળકોના વર્ગમાં શ્રી માતાજીનું કાર્ય

(બાળકોએ જે વિચારો વ્યક્ત કર્યા તે ઉપરથી શ્રી માતાજીએ વર્ગનું નામ  
ઓજસ્વી તરું એવું પાહચું. તેમણે કહ્યું :)

વૃક્ષ એટલે જીવનતત્ત્વ, જે અભીપ્સાપૂર્વક વિકાસ પામે છે. સૂર્ય એ સત્યનો પ્રકાશ  
છે.

બુદ્ધિના ઠંડા તેજવાળા વૃક્ષથી જીવનરૂપી વૃક્ષને વિકસવા અને પ્રફુલ્લિત  
થવામાં સહાય મળતી નથી, એ કામ તો સત્યની જ્યોત વે થાય છે, એ સૂર્ય છે,  
જે પોતાનાં આનંદપૂર્ણ કિરણણો પૃથ્વી ઉપર રેલાવે છે.

(શિક્ષકે જુદી જુદી જાતની પ્રવૃત્તિઓ ગોઠવેલી, જેવી કે, બગીચાકામ,  
પંદ્રામાંથી પ્રાણીઓનો બાગ બનાવવો, કોશોટાનું નિરીક્ષણ કરવું વગેરે.  
બાળકોને આમાં મજા પડી પરંતુ પછીથી તેઓ એથી આગળ જઈ કોઈ  
બુદ્ધિનો ઉપયોગ માગી લે તેવું કામ કરવામાં પાછાં પડવા લાગ્યાં)

શરૂઆત સારી છે. એમાંથી કુદરતી રીતે બૌદ્ધિક પ્રવૃત્તિઓનો વિકાસ થશે, અને  
વચ્ચાળાના સમયમાં જે કાંઈ કામ કાળજીથી કરવામાં આવે તે કંઈ ને કંઈ શીખવાની  
તકરૂપ ગણવું.

(એ જ વ્યવહારુ પ્રશ્નોના ઉત્તર.)

૧. બાળકોને વર્ગમાં રમવા માટે પણ પૂરી ન મૂક્વાં.

૨. શાંતિ અને એકાગ્રતાની એક કારણ સૌ બાળકો માટે સારી છે. પરંતુ પ્રાર્થના  
કરવાનું ફરજિયાત દોષું જોઈએ. જેમને એ કરવી હોય તેમને ઉતેજન આપવામાં

આવશે. મારું સૂચન છે કે તમે વર્ગમાં મોટા અક્ષરે લખેલું આ પ્રમાણેનું બોર્ડ મૂકો.

“શ્રી માતાજી અહીંથી આપણને સહાય કરવા અને માર્ગદર્શન આપવા સહાય હુાજર છે.”

ધારણાં બાળકો સમજશે, અને કેટલાકનામાં તે અનુભવી શકવાની ક્ષમતા પણ છે.

(ડિસેમ્બર ૧૯૬૦)

\*

(શિક્ષકને જાણાયું કે તેના બાળકો તોફાની, આણસુ અને પોપટની માફક બોલ બોલ કરતાં હતાં. તેણે પૂછ્યું : ) એમને અભ્યાસ કરવા પ્રત્યેનું વલાણ નથી એટલે આમ થતું હુશે?

ઉં.

“વર્ગમાં શાંતિ જળવાય અને બાળકો કંઈ કામ કરી શકે તે માટે અમે શું કરીએ?”

અસરકારક વસ્તુ કેવળ એ જ છે કે એમનામાં અભ્યાસ પ્રત્યે સાચો રસ ઊભો કરવો, ભાણવાની અને જ્ઞાનપ્રાપ્તિની જરૂરિયાત પ્રત્યે રસ ઊભો કરવો અને તેમની જિજ્ઞાસા વૃત્તિને જગ્યાત કરવી.

(શિક્ષકે કંઈ પરિણામ ન આવ્યાની ફરિયાદ કરી..)

મહિનાઓ અને વર્ષો સુધી આ પ્રમાણે ચીટકી રહીને, નિયમિત અને મરણિયા પ્રયત્નો કર્યા પછી કોઈ સાચી રીતે (ત્યારે પણ?) કહી શકે કે આવો પ્રયત્ન નકામો છે.

“શું કરવું ?”

ફરજ પાડવી એ કેળવણીનો કોઈ ઉત્તમ કે અસરકારક સિદ્ધાંત નથી.

સાચું શિક્ષણ એ કહેવાય જે વિકાસ પામતાં સ્વરૂપોમાં પહેલેથી જ હોય તેને પ્રગાટ

કરે અને તેને ખીલવા હે. જેવી રીતે પુષ્પો સૂર્યના તડકામાં ખીલે છે તેવી જ રીતે બાળકો આનંદમાં ખીલે છે. એ તો કદ્યા વિના પણ સમજાય તેવું છે કે આનંદ એટલે નિર્ભળતા, અવ્યવસ્થા અને ઘોંઘાટ તો નહિ જ. પરંતુ એક એવી જજવલ્યમાન માયાળુતા કે જે સારી વસ્તુને ઉતેજન આપે અને જે બૂરી હોય તેની પાસે આગ્રહ ન રાખે.

**કૃપા, ન્યાય કરતાં સત્યની વધુ નજીક છે.**

**“શ્રી માતાજી વર્ગમાં કાર્ય કરી શકે તે માટે શું કરવું?”**

કોઈ પણ પદ્ધતિ કે પ્રક્રિયા પોતાની રીતે ખોટી નથી, દરેક વસ્તુ તે કયા ભાવપૂર્વક કરવામાં આવે છે તેના ઉપર આધાર રાખે છે.

જો તમારે મારી મદદ જોઈતી હોય તો, કાર્ય કરવાનો એક સિદ્ધાંત સ્વીકારીને અને બીજાનો અસ્વીકાર કરીને પ્રાપ્ત નહિ કરી શકો, પરંતુ વર્ગની શરૂઆત કરતાં પહેલાં એકાગ્રતા કરીને, તમારા હદ્યમાં (અને બને તો મસ્તકમાં પણ) નીરવતા અને શાંતિ સ્થાપીને, અને મારી દ્વારા સાચા અંતરની અભીષ્ટપૂર્વક બોલાવીને એમ કરી શકશો. એમાં હું તમારા સર્વ કાર્યોની પાછળ હોઉં, તમે જે માનતા હો કે હું આમ કરું તેમ નહિ (કારણ કે એ પાયા વિનાનો અભિપ્રાય હોઈ શકે અને ખોટો જ હોય) પણ નીરવતા અને નિશ્ચલતા અને અંતરના સ્વયંભૂ ભાવપૂર્વક અભીષ્ટ રાખો. તમારી મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ આ જ છે.

અને જ્યાં સુધી તમે આ સિદ્ધ કરી શકો ત્યાં સુધી, શાંતિ અને ખંતપૂર્વક, તમારી પોતાની ક્ષમતા અને સંજોગો પ્રમાણે, સરળતાથી અને કુલ્ય થયા વિના તમારાથી બને તેટલી ઉત્તમ રીતે કાર્ય કરતા રહો.

જેને સારી રીતે કરવું હોય છે તેને માટે કૃપા હુંમેશાં ઉપલબ્ધ હોય છે.

**“શ્રી માતાજી ‘ખંત’ રાખવાનું કહે છે તે બાળકો સાથેના કામમાં કર્દી રીતે લાગુ પાડી શકાય?”**

મેં નોટબુકમાં જે વસ્તુ કહી તેનો ભાવાર્થ એ હતો કે જ્યાં સુધી અંતરનો મનોવૈજ્ઞાનિક ફેરફાર બહારનું પરિવર્તન સરળપણે સિદ્ધ ન કરે ત્યાં સુધી પોતે જે કરતા હોઈએ તે શાંતિપૂર્વક કર્યે જવું. આને હું ખંત કહું છું.

(અન્યુઆરી ૧૯૬૧)

“કામ અને શિસ્ત ઢીલાં પડતાં જાય છે. એનું કારણ શિક્ષકોનો પ્રાણ હડતાલ પર ગયો છે એવું હુશે?”

જરૂર એમ જ. પ્રાણ જ્યારે સહકાર આપતો બંધ થાય છે ત્યારે શક્તિ મંદ પડે છે અને કામ પણ ઢીલું થાય છે. બાળકો એટલાં બંધાં મનમાં જીવતાં નથી કે જેથી તેઓ જે મનોમય સંકલ્પને પ્રાણની શક્તિનો પાયો ન હોય તેને અનુસરી શકે. પ્રાણમય શક્તિની અસર તો તેની હાજરી માત્રથી થાય છે. એને માટે કોઈ બાધ્ય દેખાવની જરૂર નથી પડતી. જ્યારે પ્રાણનો સહકાર હોય છે ત્યારે મારી શક્તિ એની મારફત કાર્ય કરે છે અને એની પ્રાણમાં હાજરી હોવા માત્રને લઈને આપોઆપ વ્યવસ્થા સ્થપાઈ જાય છે.

જે મનોમય શક્તિ ઉપર પ્રાણમય આવરણ ન હોય તેની પ્રત્યે નાનાં બાળકો બહુ સંવેદનશીલ હોતાં નથી. અને પ્રાણમય શક્તિ ધારણ કરવા માટે તમારે પોતે જ સંપૂર્ણપણે શાંત બન્યા રહેવું જોઈએ.

(શિક્ષકે એવી દરખાસ્ત મૂકી કે આ બાળકોને જેમાં રસ પડતો હોય તેવા કાર્યક્રમથી શરૂઆત કરવી.)

હા, એ એક સારો વિચાર છે. એક ભિત્રતાભર્યું સહકારી વાતાવરણ હોય તે ઉત્તમ વસ્તુ છે.

(ફેબ્રુઆરી ૧૯૬૧)

\*

“એક મુશ્કેલીભર્યો સમય શરૂ થઈ રહ્યો છે. શિક્ષકનું વલાણ કેવું હોવું જોઈએ?”

કેવળ ચૈતસિક પ્રેરણા જ સાચી હોય છે. જે કાંઈ પ્રાણ અને મનમાંથી આવતું હોય છે. તે હુંમેકાં અહુંકારથી મિશ્રિત અને પાયા વિનાનું હોય છે. તમારે બાધ્ય સંપર્ક પ્રત્યેના પ્રતિકાર્ય દ્વારા કામ ન કરવું જોઈએ, પણ એક પ્રેમ અને શુભેચ્છાની અવિચલિત દૃષ્ટિ રાખવી જોઈએ. બીજું બધું કેવળ મિશ્રણ હોય છે અને એનાં પરિણામો ગોટાળાભર્યા અને મિશ્રિત આવે છે અને એને લઈને ગેરવ્યવસ્થા વધે છે.

(એક શિક્ષકના પત્રમાંથી અવતરણઃ) “મને એમ લાગે છે કે હું મનોમય આવેગોના બળ હેઠળ જ કામ કરું છું અને પરિણામે લક્ષ્યને ચૂકી જવાય છે. માટે જ, હું બધું ઓછો હુસ્તક્ષેપ કરું છું છતાં મને લાગે છે કે એ ખરી વસ્તુ નથી. અને હું ધારું છું કે હું આપની પાસેથી શીખ્યો છું કે બાધ્ય હુસ્તક્ષેપ કરતાં અંદરની શાંતિ વધુ અસરકારક હોય છે.

વળી એમ પણ લાગે છે કે હું એક અનુભૂતિમાંથી પસાર થઈ રહ્યો છું, કદાચ બાળકો માટે પણ એ વસ્તુ સાચી હન્શે, અને હકીકતમાં અમે સૌ સાથે આ અનુભૂતિમાંથી પસાર થઈ રહ્યા છીએ, અમે એક જ નાવમાં મુસાફરી કરીએ છીએ અને એનો અર્થ અને પરિણામ પ્રભુને હૃથમાં છે.”\*

પ્રશ્ન જેટલો પ્રથમ દૃષ્ટિએ જાણાય છે તેથી વધુ દૂરગામી છે. હકીકતમાં એ બાળકોની પ્રાણશક્તિઓનો સર્વ પ્રકારની શિસ્ત અને બંધન સામેનો બળવો છે. સામાન્ય અને સહજ વસ્તુ તો એ થાય છે કે શિસ્ત વિનાનાં બાળકોને શાળામાંથી કાઢી મૂકવાં અને ‘સારા’ને જ રાખવાં. પરંતુ આ તો એક હાર અને દિરિક્રતા કહેવાય.

જો, નિતાંત શાંતિપૂર્વક, અંતરની શક્તિ વહાવીને તમે આ બળવાને છેવટે કાબૂમાં લઈ શકશો તો એ એક પરિવર્તન અને સાચી સમૃદ્ધિ બનશે. હું એ માટે જ પ્રયત્ન કરું છું અને આશા રાખું છું કે મારા કાર્ય સાથે સહકાર કરવાનો ચાલુ રાખવાનું તમારે માટે શક્ય બનશે. અને જ્યારે હવે તમને સમજાયું છે કે મારે શું કરવું છે, અને કાર્યની પ્રક્રિયા અને પદ્ધતિ પણ તમે જાણો છે એટલે મને આશા છે કે આપણે સફળ થઈશું. આપણે પાછા પડવાની તૈયારી રાખવી જોઈએ અને એથી નિરુત્સાહ ન થવું જોઈએ.

જે બાળકોમાં બુદ્ધિનો વિકાસ ખાસ નથી થયો હુંતો તેમની પ્રાણમય શક્તિઓ, જ્યોતિનો સ્વીકાર કરતાં પહેલાં જક્કીપણે લે જાય છે અને ત્યાર પછી જ પોતાનું તેની દ્વારા પરિવર્તન થવા દે છે. પરંતુ અંતે વિજય તો નિશ્ચિત છે, આપણે રાહું જોતાં અને સહન કરતાં શીખી લેવું જોઈશે.

(શિક્ષકે શ્રી માતાજી સાથે સહકાર થઈ શકે તે કરણે વર્ગ માટે જરૂરી પ્રકાશ,  
પ્રેમ, નમનીયતાની પ્રાર્થના કરી.)

આ બધું સતતપણે તમારી સાથે છે. ખુલ્લા રહ્યો અને એને કાર્ય કરવા દો.

(માર્ચ ૧૯૬૧)

\*. શ્રી માતાજીએ આ અવતરણ નીચે લીટી કરીને લખેલું: “આ ખરું છે.”

(શિક્ષકની યોજના બાળકોનાં જૂથો બનાવી કાર્ય કરવાની હતી. પ્રશ્ન એ હતો કે તેણે એ જૂથો પોતે, એ બાળકોનાં ધોરણોને અનુલક્ષીને બનાવવા કે બાળકોને જેમની સાથે મેળ બેસે તે પ્રમાણે તેમને જ તેમનાં જૂથ ગોઠવવા દેવા.)

બાળકોને તેમની સ્વાભાવિક પરસ્પરની લાગણીઓ અનુસાર જૂથો ગોઠવવા દો.

“જો શિક્ષકનામાં પોતામાં શાંતિ હોય તો અનિવાર્યપણે વર્ગમાં એવી શાંતિ આવી જ જાય જેમાં એક શાંત વાતાવરણમાં દરેક વ્યક્તિ પોતાના લય અને ક્ષમતા અનુસાર, ઘોંઘાટ કે ચંચળતા વિના, અધીરાઈકે આગસ વિના કાર્ય કરી શકે...?”

જો તમારી ભીતરની શાંતિ સર્વગ્રાહી, આંતર તેમ જ બાધ્ય હશે, એનો પાયો પ્રભુની હાજરીના સંવેદન ઉપર હશે, એમાં ફેરફાર થતો નહિ હોય, એટલે કે સર્વ સંજોગોમાં એ સતત અને ફેરફાર વિનાની હશે તો નિઃશંકપણે એ સર્વ શક્તિમાન હશે, બાળકો ઉપર તેમની અનિવાર્યપણે અસર થશે, અને વર્ગમાં તમારે જે વસ્તુ જોઈએ છે તે સ્વયંભૂ અને લગભગ આપોઆપ સ્થપાઈ જશે.\*

(એપ્રિલ ૧૯૬૧)

\*

(શિક્ષકને એમ લાગતું કે બાળકોમાં કામ કરવાનું ગમવાની અને એમાં આનંદ લેવાની વૃત્તિ ખીલવી જોઈએ. શ્રી માતાજીએ કહ્યું:)

તમે શાળા, વર્ગ અને કામ વિષે જે કહો છો તે ખરું છે અને મારી અનુમતિ છે અને તમે જે વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરો છો તેને મારી સંપૂર્ણ મંજૂરી છે.

(શ્રી માતાજીએ બાળકોને પણ આ બે સંદેશ મોકલેતા.)

\* આ સંદેશ અપાયા પછી વર્ગમાં નિશ્ચિતપણે શાંતિની પુનઃ સ્થાપના થઈ ગયેલી.

જો તમને કામ કરવું નહિ ગમતું હોય તો હુંમેશાં જીવનમાં દુઃખી થશો. જીવનમાં સુખી થવું હોય તો કામ કરવા પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ.

(જુલાઈ ૧૯૬૧)

\*

આ વર્ગનાં બાળકોને ઉદેશીને લખાયેલા શ્રી માતાજીના અન્ય સંદેશાઓ

મારાં વહાલાં બાળકો, કામ કરવા પ્રત્યે પ્રેમ રાખો અને તમે સુખી થશો. ભાગવા પ્રત્યે પ્રેમ રાખો અને તમે પ્રગતિ કરશો.

(બાળકોએ તેમના શિક્ષક સાથે આખા વર્ષ માટે એક કાર્યક્રમ નક્કી કર્યો. ફેન્ચયમાં બોલવું, સારી રીતે વાંચવું. ભૂલો વિનાનું ફેન્ચ લખવું, બરાબર ગણતાં શીખવું, ગણિતના દાખલા સમજવા, સરવાળા-બાદબાકી-ગુણાકાર-ભાગાકાર શીખવા. શ્રી માતાજીએ વર્ગની નોંધપોથીમાં લખ્યું :)

મારા વહાલાં બાળકો, મેં તમારો પત્ર વાંચ્યો છે અને હું એ વિષયમાં સંમત છું કે જો વર્ષને અંતે તમે યાદી કરેલી સર્વ વસ્તુઓ શીખી લીધી હોય તો ઘણું સારું થાય. પરંતુ એક મુદ્દા પ્રત્યે હું તમારું ધ્યાન દોરવા માગું છું કારણ કે એ કેન્દ્રસ્થ મુદ્દો છે અને સૌથી અગત્યનો છે. તમે વર્ગમાં કેવું વલાણ રાખો — છો, કયા પ્રકારની મનોદશા સાથે તમે શાળામાં આવો છો.

તમે વર્ગમાં રોજ હાજરી આપો છો તેનો ફાયદો ઉઠાવવો હોય તો તમારે ત્યાં એક ખરા અંતરથી શીખવાની ઈચ્છા સાથે જવું જોઈએ. પરંતુ ધ્યાન આપવું જોઈએ, એકચિન રહીને તમારા શિક્ષક જે કહેતા હોય તે સાંભળવું જોઈએ અને શાંતિથી ગંભીર ભાવે કાર્ય કરવું જોઈએ.

જો તમે અભાન અને ખરાબ રીતભાતવાળાં બાળકોની જેમ તમારો સમય બૂમ-બરાદા પાડવામાં, ગભરામણમાં અને દરેક વસ્તુને ઊંઘીયતી કરવામાં ગાળશો, તો તમારો સમય બરબાદ થશો, તમારા શિક્ષકનો સમય બગડશો અને તમને કશું પણ નહિ આવે. વર્ષને અંતે મારે કહેવું પડશો કે તમે ખરાબ બાળકો છો અને ઉપર વર્ગમાં મોકલવા લાયક નથી.

તમારે વર્ગમાં આવવાનું હોય તો ભાગવાનો સંકલ્પ લઈને આવવું, નહિ, તો એ સમયનો દુર્વ્યય છે, કારણ કે તમારા એકલાની ગેરવર્તાણૂકથી બીજા બધાને

ગરબદ પહુંચશે. એટલે તમે આ પ્રકારનો નિર્ણય લો એવી મારી દૃઢા છે. સારા ભનીએ, શાંત, એકાગ્ર ચિત્ત અને સખત પરિશ્રમ કરીએ. આ નોટબુકમાં તમે મને એમ કરવાનું વચ્ચન આપો.

અને તમે દરેક પોતાની સર્વ શુભેચ્છા સાથે લખી રહો ત્યારે આ નોટબુક મને પાછી મોકલજો કે જેથી હું તમને મારા આશીર્વાદ આપી શકું.

(૧૯૬૧ની શક્તિઆતને ગાળો)

(બાળકો ટટાર બેસ્તાં નથી અને તેમના અક્ષર સારા નથી. શ્રી માતાજીએ લખ્યું :)

સીધા બેસવું અને કંઈંગી રીતે બેસવું બંનેમાં સરખો શ્રમ પડે છે. જ્યારે તમે સીધા બેસો છો ત્યારે શરીરનો વિકાસ સંવાદપૂર્વ રીતે થાય છે. જ્યારે તમે કંઈંગી રીતે બેસો છો ત્યારે શરીર બેડોળ અને બદસૂરત થાય છે.

સારા અક્ષર લખવા અને અગંબગં લીટા દોરવા એ બંનેમાં મહેનત તો એકસરખી પડે છે. પરંતુ જ્યારે તમારું લખાણ સ્વચ્છ હોય છે ત્યારે વાંચવામાં મજા પડે છે. જ્યારે બાહુ ખરાબ રીતે લખાયેલું હોય છે ત્યારે વંચાતું જ નથી.

પ્રગતિનો પાયો આપણો જે કાંઈ કરતાં હોઈએ તે કાળજીપૂર્વક કરવામાં છે.

(૧૯૬૧)

દિવસો, અઠવાડિયાંઓ, મહિનાઓ અને વર્ષો પસાર થઈ રહ્યાં છે, સમય ભૂતકાળમાં વહી રહ્યો છે. અને પાછળાથી જ્યારે એ લોકો મોટાં થશે અને જ્યારે તેમની પાસે બાળપાણનો ભારે લાભ નહિ હોય ત્યારે તેમણે પોતે બગાડેલા સમયનો અફસોસ કરશે અને દુઃખી થશે કે કેવી રીતે જીવનું તે જાણવા માટે જે વસ્તુઓની જરૂર હોય છે તે તેઓ શીખી શક્યા હોત.

(માર્ચ ૧૯૬૧)

\*

(૮)

## સોળથી અઠાર વર્ષનાં બાળકોના વર્ગમાં શ્રી માતાજીનું કાર્ય

૧૯૬૮માં જ્યારે શાળાની પુનર્વ્યવસ્થા થઈ રહી હતી ત્યારે શ્રી માતાજીએ જાહેર કર્યું કે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જે વિષયમાં રસ હોય તેવા કોઈ પણ ગ્રન્થનો તેઓ જવાબ આપશે. જ્યારે શ્રી માતાજીને પોતાને એવો વિષય પસંદ કરવા જણાવવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું ‘મૃત્યુ’.

આ દરખાસ્ત બધાં બાળકોને કરવામાં આવેલી. આ નીચેનું કાર્ય, એક ફેન્ચ વર્ગો શ્રી માતાજીની દરખાસ્તના પ્રત્યુત્તર રૂપે કરેલું તેનો નમૂનો છે.

દરેક ગ્રસંગો વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે ગ્રન્થો તૈયાર કરી શ્રી માતાજીને મોકલતા.

(વિદ્યાર્થીઓએ માતાજીને લઘ્યું કે તેઓ તેમની સામે જ મૃત્યુના વિષય ઉપરના અભ્યાસ અંગો કામ કરવા માગે છે. શ્રી માતાજીએ શિક્ષકને આ પ્રમાણે મૌખિક સૂચનાઓ આપેલી.)

વિષય છે : મૃત્યુ શું છે?

તમે કઈ રીતે શરૂઆત કરશો? તમે તમારી ભીતરમાં નજર નાખો. પુસ્તકો વાંચીને કે ગ્રાણ અને મનમાં શું ચાલે છે તેને વડે કશું જાણવા પ્રયત્ન ન કરો : તમને મૃત્યુ વિષે શું લાગે છે? તમે શું ધારો છો?

આ સંશોધન કેવળ ભौતિક ભૂમિકા ઉપર જ ચાલવું જોઈએ. સ્થૂલ દૃષ્ટિએ જોતાં મૃત્યુ શું છે ?

તમારે એકાગ્રતા કરીને તમારી અંદરથી જ એના ઉત્તરો શોધી કાઢવા. તમે જેટલા વધુ બુદ્ધિમાન હશો તેટલા ઓછા શબ્દોમાં તમે વ્યક્ત કરી શકશો.

(૨૭ એપ્રિલ ૧૯૬૮)

\*

(“ભૌતિક દૃષ્ટિબિંદુથી જોતાં મૃત્યુ શું છે? એ વિષય ઉપર વિદ્યાર્થીઓના ઉત્તરો:

“મગજના કોષાળું ઓમાં લોહીના પરિભ્રમણનું બંધ થવું.”

“જ્યારે મગજ કામ કરતું બંધ થઈ જાય અને દેહ સડવા લાગે ત્યારે મૃત્યુ થયું કહેવાય.”

“શક્તિના ચોત અથવા આત્માની ગેરહાજરીને કારણે જ્યારે સર્વ પ્રકારની સ્થૂલ કામગીરી બંધ થઈ જાય તે.”

“મૃત્યુની ખરેખરી હકીકત મને એક એવા અનુભવનો ઘ્યાલ આપે છે કે જેમાં વ્યક્તિ વધુ ને વધુ બળપૂર્વક અવકાશમાં ધકેલાઈ જાય છે.”

શ્રી માતાજીએ વર્ગને લખ્યું :)

તમે લખેલું મેં રસપૂર્વક વાંચ્યું અને આ મારો ઉત્તર છે : સ્થૂલ દેહ બનવામાં આધારરૂપ કોષાળું ઓ વિકેન્દ્રિત થઈને ફેલાઈ જાય એ ઘટના તે મૃત્યુ છે.

ચેતના, એની સ્વાભાવિક પ્રકૃતિને કારણે અમર છે, અને ભૌતિક જગતમાં પોતાનો આવિર્ભાવ કરવા માટે એક ઓધાવતા પ્રમાણમાં ટકે તેવાં સ્થૂલ રૂપ ધારણ કરે છે.

સ્થૂલ પદાર્થ એક એવા રૂપાંતર પ્રત્યે ગતિ કરી રહ્યો છે જેને લઈને તે અનેક રૂપધારી અને વધુ ને વધુ સંપૂર્ણ રીતનું અને ટકાઉ સ્વરૂપનું ચેતના — શક્તિના આવિર્ભાવનું સાધન રહે.

(૧૮ મે ૧૯૬૮)

\*

(આ વખતે શ્રી માતાજીએ અલગ અલગ જવાબો લખીને શિક્ષકને મોકલેલા.)

વિદ્યાર્થીઓના પ્રશ્નોના મારા આ ઉત્તરો છે. હું આશા રાખું છું કે તેઓ સમજ શકશે.

“જો કોઈ કોષાળું પોતાની વ્યક્તિત્વા વિષે સભાન બને, તો એવું ન બને કે એ પોતાના સ્વાર્થ માટે જ કાર્ય કરે અને સામૂહિક હિત માટે કાર્ય ન કરે?”

એક કોષાણુનો સ્વાર્થ શો હોય!

\*

“વિકેન્દ્રીકરણાની કિયા એક જ સપાટે થાય છે કે કમે કમે કરીને?”

સર્વ વસ્તુઓ એકદમ વિભેરાઈ જતી નથી, એમ થતાં લાંબો સમય લાગે છે.

પ્રથમ ઘટના તો એ બને છે કે ભૌતિક દેહની કેન્દ્રસ્થ સંકલ્પશક્તિ સર્વ કોષાણુઓને એકસાથે રાખવાનો સંકલ્પ જતો કરે છે. એ એક યા બીજા પ્રકારે વિચ્છેદને સ્વીકારી લે છે. મહૃત્ત્વનાં કારણોમાંનું એક એ છે કે એક એવી લાગણી ઊભી થાય છે કે શરીર ઊભો થયેલો કોઈ વિસંવાદ હવે સુધરે તેમ નથી. બીજું કારણ એવું હોય છે કે સતતપણે સંકલન અને સંવાદ જાળવી રાખવાના કાર્યો પ્રત્યે કંટાળો ઊપજે છે. હકીકતમાં આમાં અસંખ્ય કારણો હોય છે. પરંતુ જો કોઈ ભયંકર અકસ્માતની ઘટના ન હોય તો આમાં ગમે તે કારણસર કે કારણ વિના પણ એકસૂરતા જાળવી રાખવાનો આ કેન્દ્રસ્થ સંકલ્પ છૂટી ગયો હોય છે, પછી એને અંતે મૃત્યુ અનિવાર્ય બની રહે છે.

“શું દરેક કોષે તેની કેન્દ્ર સાથેની એકતા વિષે સભાન રહેવું જોઈએ?”

એમ નથી. એ હજુ સુધી અર્ધસામૂહિક ચેતનાવસ્થા છે, એમાં કોષોની વ્યક્તિગત ચેતના નથી હોતી.

\*

“વિકેન્દ્રીકરણ હુમેશાં મૃત્યુ પછી આવે છે કે એ તે પહેલાં પણ શરૂ થાય છે?”

ઘણી વાર એ પહેલેથી શરૂ થાય છે.

“કોષાણુઓ અવકાશમાં વિભરાઈ જાય છે કે શરીરમાં જ? જો તેઓ અવકાશમાં વિભરાઈ જતા હોય તો કોષોની સાથે દેહ પણ અદૃશ્ય થઈ જવો જોઈએ.”

કુદરતી રીતે, શરીરનું વિઘટન મૃત્યુ પછી જ થાય છે અને એ પણ લાંબો સમય લે છે.

\*

“કોષાણુઓનું વિભરાઈ જવું “એનો કોઈ વિશિષ્ટ અર્થ નથી? જો હોય તો કયો?”

કોષાણુઓનું વિભરાઈ જવું એ શબ્દો મેં અત્યંત સ્થૂલ અર્થ માં વાપરેલા.

જ્યારે દેહને આકૃતિ આપનાર એકાગ્રતાનો અંત આવે છે ત્યારે દેહનો અંત આવે છે અને દેહનું વિઘટન થાય છે. જે કોષાણુઓનો વિશિષ્ટ રીતનો વિકાસ કરવામાં આવ્યો હોય છે અને જેમને ભીતરમાંની દિવ્ય ઉપસ્થિતિ વિષે સભાનતા પ્રાપ્ત થઈ હોય છે તેઓ ધૂટા પડી જાય છે અને અન્ય પ્રકારનાં જોડાણો ઊભાં કરે છે અને એમની અંદર પોતાને ચેપ લગાડીને પોતાને ગ્રાપન થયેલી દિવ્ય ચેતના જાગ્રત કરે છે. અને આ પ્રકારે, એકાગ્રતા, વિકાસ અને વિઘટનની પ્રક્રિયા વેરે, સમગ્ર પદાર્થતત્ત્વ ઉત્કાન્તિ પામે છે અને ચેપ વેરે શીખે છે, ચેપ વેરે વિકાસ પામે છે અને ચેપ વેરે અનુભૂતિ પામે છે.

કુદરતી રીતે કોષાણુ તો દેહની સાથે વિઘટન પામી જાય છે. પરંતુ એ કોષાણુઓમાંની ચેતના હોય છે તે બીજાં જોડાણો સાધતી હોય છે.

(૫ જૂન ૧૯૬૮)

\*

“જ્યારે ભૌતિક દેહની સંકલ્પશક્તિ કોઈ કારણ વિના વિદાય લે છે ત્યારે કોઈ ભૌતિક કારણ વિના કે બિલકુલ કોઈ કારણ વિના?”

ભૌતિક ચેતના ભૌતિક રીતે જ સભાન હોય છે. ભૌતિક સ્વરૂપનો સંકલ્પ જેનાથી તે સભાન ન હોય તેવા કોઈ પણ કારણ સિવાય — વિદાય લઈ શકે છે.

“સ્થૂલ દેહ એકસૂરતા અને સંવાદ માટે પ્રયત્ન કરવામાં કંટાળો અનુભવે તેનું શું કારણ હોય છે?”

સામાન્ય રીતે આવો કંટાળો ત્યારે આવે છે કે જ્યારે સ્વરૂપનો કોઈ અગત્યનો —

પ્રાણમય કે મનોમય — ભાગ પ્રગતિ કરવાનો સાફ ઈનકાર કરે છે. એટલે, ભૌતિક રીતે, આ વસ્તુ સમયાંતરે જે સડો ઉત્પન્ન થાય છે તેની સામે પ્રતિકાર્ય કરવાની મહેનત કરતી નથી.

“ભૌતિક દેહની કેન્દ્રસ્થ સંકલ્પશક્તિ અને કોષાણુઓનું જોડાણ કયાં સ્થપાયેલું હોય છે? અને કેવી રીતનું હોય છે?”

કોષાણુઓમાં એક આંતરિક ઘડતર અથવા માળખું હોય છે, જે વિશ્વના માળખાને અનુરૂપ હોય છે. એટલે બાધ અને આંતરિક અવસ્થાઓ વચ્ચે કરી સ્થપાયેલી રહે છે... એ કોઈ બાધ વસ્તુ હોતી નથી, પરંતુ વ્યક્તિ માટે એ “બાધ” હોય છે. એટલે કે, કોષ, તેના આંતરિક ઘડતરમાં અને મળતા આવતા સમગ્રતાના આંદોલનને જીલે છે. દરેક કોષાણુ બિન્ન બિન્ન પ્રભાઓનો બનેલો હોય છે, એના કેન્દ્રમાં સર્વથા જ્યોતિર્મય કેન્દ્ર હોય છે, અને જ્યોતિ અને જ્યોતિ વચ્ચે જોડાણ હોય છે. એટલે કે સંકલ્પ અથવા કેન્દ્રસ્થ જ્યોતિ અને અનુરૂપ પ્રકાશોના સ્વરૂપના એક આંતરિક સ્પર્શ વડે સ્પર્શ કરીને કોષાણુઓ ઉપર કાર્ય કરે છે. દરેક કોષાણુ, સમગ્ર વિશ્વને અનુરૂપ એક સૂક્ષ્મ કદના વિશ્વ સરખો હોય છે.

(૧૫ જુલાઈ ૧૯૬૮)

\*

“કાલાંતરે જે વિકૃતિ ઉત્પન્ન થાય છે તેને અટકાવવા માટે પ્રગતિ કરવા માટેનો સંકલ્પ પૂર્તો છે? ભૌતિક દેહ આવી વિકૃતિને કરી રીતે અટકાવી શકે?”

દેહનું રૂપાંતર એટલે એ જ વસ્તુ છે : સ્થૂલ કોષાણુઓએ કેવળ સભાન થવાનું નહિ પરંતુ સાચી ચેતનાશક્તિ પ્રત્યે ગ્રહણશીલ બનવાનું હોય છે; એટલે કે તેમણે આ ઊર્ધ્વ ચેતનાને માર્ગ કરી આપવાનું હોય છે. એ કાર્ય જ રૂપાંતરનું કર્ય છે.

“સંકલ્પશક્તિ, એટલે કે કેન્દ્રસ્થ સંકલ્પશક્તિ જે ભૌતિક સ્વરૂપની નથી હોતી તે કોષાણુઓના જડ પદાર્થતત્ત્વ ઉપર કરી રીતે કાર્ય કરે છે?”

આ તો એના જેવું છે કે “સંકલ્પબળ, પદાર્થ તત્ત્વ ઉપર કરી રીતે કામ કરે છે?”

આખું જીવન એવું છે. તમારે આ બાળકોને સમજાવવું કે તેમનું આખું અસ્તિત્વ જ આ સંકલ્પને આભારી છે, જો એ સંકલ્પબળ ન હોત તો પદાર્થતત્ત્વ સંજ્ઞાહીન અને અચેતન જ રહેત અને કેવળ સંકલ્પશક્તિનું આંદોલન પદાર્થ તત્ત્વ ઉપર કાર્ય કરે છે એને લઈને જ જીવન શક્ય બને છે. નહિ તો કોઈ જીવન હોત જ નહિ. જો તેમને વૈજ્ઞાનિક ઉત્તર જોઈતો હોય અને એમ કઈ રીતે બને છે તે જાણવું હોય તો એ વધુ મુજલે છે, પણ હકીકત મોજૂદ છે અને આ હકીકત પ્રતિ સેકડે જોઈ શકાય છે.

(૨૦ જુલાઈ ૧૯૬૮)

\*

**“વ્યક્તિ, પોતાના સ્વરૂપ વિષે કઈ રીતે સભાન બની શકે?”**

લગભગ સમસ્ત માનવજાતિ, કેવળ તેના સ્થૂલ સ્વરૂપ વિષે જ સભાન હોય છે. શિક્ષાજીનો ફેલાવો થવાની સાથે, પોતાનાં મનોમય અને ગ્રાણમય સ્વરૂપો વિષે – સભાન એવાં મનુષ્યોની સંખ્યા વધતી જાય છે, જ્યારે પોતાના ચૈત્ય સ્વરૂપ વિષે સભાન એવા મનુષ્યોની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી છે.

જો તમારો એમ પૂછવાનો આશય હોય કે “વ્યક્તિ પોતાના સ્થૂલ સ્વરૂપની ચેતનામાં જાગૃતિ કઈ રીતે લાવી શકે?” તો એનો ઉત્તર એ કે શારીરિક કેળવાણીનો ઉદ્દેશ જ એ છે. શારીરિક કેળવાણી વહે જ કોખાણુંઓ જાગ્રત થતાં શીખી શકે છે. પરંતુ મગજની ખિલવાણી માટે તો અભ્યાસ, અવલોકન, બુદ્ધિની કેળવાણી, સૌથી વધુ તો અવલોકન અને તર્કશક્તિ પર્યાપ્ત છે. અને જો ચારિરિયની દૂષિષ્ઠે સમગ્ર ચેતનાની કેળવાણી કરવાની હોય તો એ યોગ વહે જ થઈ શકે છે.

**“ભૌતિક સ્વરૂપના કેન્દ્રસ્થ સંકલ્પનું કોઈ નિશ્ચિત સ્થાન સ્થૂલ દેહમાં હોય છે ખરું?”**

મગજમાં.

**“જાતે મર્યાદિતા મૃત્યુનો અનુભવ મળી શકે ખરો?”**

અવશ્ય. તમે યોગિક રીતે મૃત્યુને અનુભવી શકો, શારીરિક રીતે પણ, જો ટૂંકા ગાળાને માટે હોય તો મૃત્યુનો અનુભવ થઈ શકે. ટૂંકા ગાળા માટે – કારણ કે નહિ

તો ડૉક્ટરો તમને ભરેલા જાહેર કરી દેશે.

“મૃત્યુ પછી સવરૂપના કચા ભાગને ભાન થાય છે કે પોતાનું મૃત્યુ થયું છે?”

જે કોઈ ભાગ ટકી રહ્યો હોય તેને ભાન થાય છે કે હવે દેહ રહ્યો નથી. એનો આધાર વ્યક્તિ ઉપર છે.

“કોઈ કેવી રીતે નિશ્ચિતપણો કહી શકે કે સ્થૂલ શરીર મરણ પામ્યું છે?”

જ્યારે એમાં સડો દાખલ થાય ત્યારે.

“આપણો વિકૃતિની ઘટના ઉપર કાબૂ કરી રીતે પ્રાપ્ત કરી શકીએ અને એમ થતું કરી રીતે નિવારી શકીએ?”

કાળજીપૂર્વક શારીરિક સમતુલા જાળવી રાખીને.

“જ્યારે વ્યક્તિ મરણ પામે છે ત્યારે એને શારીરિક પીડા થાય છે?”

એમ અનિવાર્યપણે બનતું નથી.

(૨૮ સપ્ટેમ્બર ૧૯૬૮)

\*

“અમારે અમારા દૈનિક જીવનમાં મૃત્યુની કિયાને અટકાવવા શું કરવું જોઈએ?”

એની રીત એવી છે કે ચેતનાને દેહથી અલગ કરી લઈને વધુ ઊંડાણમાં રહેલા જીવન ઉપર એની એકાગ્રતા કરવી કે જેથી એ ગહુનતર ચેતના દેહમાં લાવી શકાય.

“જો ‘હું-ભાવ’ની લાગણી, જીવન દરમ્યાન મન સાથે વધુ એકરૂપ બનેલી હોય તો શું આ ‘હું-ભાવ’ની લાગણીને જ મૃત્યુ પછીના અનુભવો થાય છે? એટલે કે એજ હું-ભાવ પોતાની સાથે જીવનની સમૃતિઓ જાળવી રાખે

છે? હું મન, વિષે આ પૂછું છું કારણ કે અન્ય ભાગો કરતાં, મૃત્યુ પછી એ થોડું વધુ સમય ટકી રહે છે.”

એમ કહેવું સાચું નથી કે મન વધુ ટકાઉ છે. ચૈત્ય ચેતનાએ સ્થૂલ સ્વરૂપના જે નાનકડા ભાગ સાથે એકતા કરેલી હોય છે, તે આ સ્થૂલ દેહને ત્યજી દે છે. જેટલા અંશો એ ચેતનાએ, જીવનને ઘાટ આપ્યો હોય છે તેટલા અંશો એણે પોતે જેને ઘાટ આપ્યો હોય છે તેની તેને સમૃતિ રહે છે. એ સમૃતિ, ઘટનાઓ સાથે જોડાપેલા ચૈત્ય સ્વરૂપના અનુભવોની સમૃતિ હોય છે. જ્યારે પાણ, ચૈત્ય ચેતનાએ ઘટનાઓમાં ભાગ લીધો નથી હોતો ત્યારે તેવી ઘટનાઓની સમૃતિ નથી રહેતી. અને કેવળ ચૈત્ય સ્વરૂપ જ ટકી રહે છે. સમૃતિને ટકાવી રાખનાર વસ્તુ મન નથી હોતું; મન સમૃતિને ઘારણ કરે છે એ કહેવું તકન ખોટું છે.

(૧ ફેબ્રુઆરી ૧૯૬૬)

(થોડાક હિવસો પછી, આ વિદ્યાર્થી વિષે એના શિક્ષક સાથે વાર્તાલાપ દરમ્યાન શ્રી માતાજીએ કહ્યું:)

હકીકતમાં, મૃત્યુ છે જ નહિ.

\*

## એ સ્વી મોનિટરને ઉત્તરો

**સૂત્રો**

- (૧) કશી મહિત્ત્વાકંક્ષા ન રાખીશ, અને ખાસ તો કશી પણ બાબતોનો દંભ ન કરીશ, પણ તું જે કાંઈ બની શકે તેમ હો તે પ્રત્યેક ક્ષાણે વધુમાં વધુ બની રહે.

(૨૫ ફેબ્રુઆરી ૧૯૫૭)

- (૨) આ વિશ્વના આવિર્ભાવમાં તારું સ્થાન શું છે એ બાબત તો કેવળ પરમાત્મા જ તારે માટે નક્કી કરશે.

(૨ મે ૧૯૫૭)

- (૩) આ વિશ્વના વૃંદસંગીતમાં તારું સ્થાન શું છે એ તે પરમાત્માએ અફર રીતે નક્કી કરી દીઘેલું છે. એ સ્થાન ભલે ગમે તે હો, પણ બીજા સૌની પેઠે તને પણ અતિમાનસ સુધીનાં પરમોચ્ચ શુંગો સુધી ચડવાનો તેમના જેટલો જ હક્ક છે.

(૧૭ મે ૧૯૫૭)

- (૪) તું તારા સ્વરૂપના સત્યમાં શું છે એ વાત તો એક અફર રીતે નક્કી થઈ ચૂકેલી છે. એ વસ્તુ બની રહેવામાં તને કોઈ પણ વસ્તુ, કોઈ પણ માણસ અટકાવી શકે તેમ નથી. પરંતુ એ સ્થિતિમાં પહુંચવા માટે તારે ક્યો માર્ગ લેવો એ તારી મુક્ત પસંદગીની વાત છે.

(૧૮ મે ૧૯૫૭)

- (૫) ઉધ્વરમાં જઈ રહેલા વિકાસકમના પથે આગળ વધવામાં માણસે કઈ દિશા લેવી એ પસંદ કરવાની હરેકેને સ્વતંત્રતા રહેલી છે : સત્યના શિખરો તરફ, પરમ સાક્ષાત્કાર તરફ જતી આરોહણની ઝડપી અને સીધાં ચડાણની દિશા લેવી કે પછી એ શિખરો તરફ પૂંક કરી દઈને,

અનેકાનેક જન્મજન્માંતરોવાળી અંતહીન આડીઅવળી ગતિમાં લઈ જતી સહેલા ઉત્તરાણની દિશા લેવી — આ તારે પોતે પસંદ કરવાનું છે.

(૨૩ મે ૧૯૫૭)

(૬) કાળના વહેતા પ્રવાહુમાં તેમ જ તારા અત્યારના જીવનમાં પણ તું તારે પોતાને માટેનો એક આખરી નિર્ણય, એક અફર નિર્ણય લઈ શકે છે અને પછી તો માત્ર તારે હરેક નવા નવા પ્રસંગે એ નિર્ણયને વધુ ને વધુ દૃઢ કરવાનો રહે છે. અથવા એમ પણ બને કે તું આરંભમાં આખરી નિર્ણય ન લે અને તે પછી તો તારે હરેક પણે અસત્ય અને સત્ય વચ્ચે પસંદગી કરવાની રહેશે.

(૨૩ મે ૧૯૫૭)

(૭) પણ તેં આરંભમાં આખરી નિર્ણય ભલે ન પણ લીધો હોય છતાં જો તારા સદ્ભાચ્ચે, સૃષ્ટિના ઈતિહાસની એ અસાધારણ ક્ષાણો, પૃથ્વી ઉપર જ્યારે પ્રભુ-કૃપા અવતાર લઈને હાજર રહી હોય એવે સમયે તને જન્મ મળ્યો હશે તો એ કૃપા તને ફરી એક વાર, કોઈ અસાધારણ ક્ષાણોમાં, પાછી આખરી પસંદગી કરી લેવાની શક્યતા મેળવી આપશો અને એ પસંદગી તને સીધો લક્ષ્ય પ્રત્યે લઈ જશે.

(૨૩ મે ૧૯૫૭)

\*

## પત્રવ્યવહાર

“શિક્ષણ કેન્દ્રના વિધાર્થીઓને ડિપ્લોમા તથા સર્ટિફિકેટો કેમ આપવામાં આવતા નથી?”

લગભગ એક સદીથી માનવજીતિ એક રોગનો ભોગ બની રહેલી છે. એ રોગ વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે અને અત્યારે એણે ઘણું જ ભયંકર રૂપ ધારણ કર્યું છે. એ રોગ તે ‘ઉપયોગિતાવાદ’ છે. અત્યારે જગતની વસ્તુઓને અને માણસોને, સંજોગો અને પ્રવૃત્તિઓને કેવળ આ દૃષ્ટિથી જ — ઉપયોગિતાની દૃષ્ટિથી જ જોવામાં આવે છે અને એ રીતે જ તેમનું મૂલ્ય આંકવામાં આવે છે. વસ્તુનો કોઈ ઉપયોગ દેખાય

છે તો જ તેને ઉપયોગની ગણવામાં આવે છે. હા, જે વસ્તુ ઉપયોગી દેખાતી હોય તો નિરૂપયોગી દેખાતી વસ્તુ કરતાં સારી તો છે જ, પણ પ્રશ્ન એ છે કે ઉપયોગી એટલે શું – કોને માટે ઉપયોગી, શા ઉપયોગની, શા માટે ઉપયોગી – આ આપણે પહેલું સમજવાનું છે.

હા, જગતની જે પ્રજાઓ પોતાને સુધરેલી ગણે છે તેઓ તો જે વસ્તુઓમાં પૈસા મળે, પૈસો પ્રાપ્ત થાય તેને જ વધુ ને વધુ ઉપયોગી ગણે છે. દરેક વસ્તુનો વિચાર આ પૈસાના દૃષ્ટિકોણથી જ કરવામાં આવે છે. આને હું ઉપયોગિતાવાદ કહું છું. અને આ રોગ ઘણો જ યેપી છે, બાળકો પણ એમાંથી બચી શકતાં નથી.

તમારી જે ઉમરે સૌન્દર્ય અને મહત્ત્વ અને પૂર્ણતાનાં સ્વભનો સેવવાં જોઈએ, તે વખતે તમે પૈસાનાં સ્વભનો સેવતા થઈ જાઓ છો, પૈસા કેવી રીતે કમાવા તેની ચિંતા કરતા થઈ જાઓ છો. આ બધી વસ્તુઓ – સૌન્દર્ય, મહત્ત્વ, પૂર્ણતા, એ કદાચ સામાન્ય બુદ્ધિના માણસને માટે વધારે પડતી ભવ્ય, અગ્રાહ જેવી હુશે, પણ આ ડાહુડરી શુઝ સામાન્ય બુદ્ધિ કરતાં તો તે વધારે સારી વસ્તુઓ છે જ એમાં શંકા નથી.

એટલે અત્યારે હવે બાળકો જ્યારે પોતાના અભ્યાસ વિષે વિચાર કરે છે ત્યારે સૌથી પહેલું એ વિચારે છે કે કઈ વસ્તુનો અભ્યાસ અને ઉપયોગી નીવડશે. અમે જે કાંઈ ભાણીએ તેમાંથી અમે મોટા થઈએ ત્યારે અમને ખૂબ ખૂબ કમાણી થાય એવું હોવું જોઈએ.

અને પછી આ બાળકો માટે એક જ વસ્તુ અગત્યની બની રહે છે. સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી દેવી. એમને જે કાંઈ ડિપ્લોમા મળશે, સર્ટિફિકેટો કે ઈલ્કાબો મળશે એને આધારે જ એમને સારી સારી જગાઓ મળવાની છે અને ખૂબ ખૂબ પૈસો મળવાનો છે.

આવાં બાળકો માટે અભ્યાસનો કોઈ બીજો હેતુ હોતો નથી, એ સિવાય અભ્યાસમાં એમને કાંઈ રસ નથી હોતો.

પણ ખરું જોતાં તો તમે જે ભાણતા હો છો તે તમારે જ્ઞાનને ખાતર ભાણવાનું છે, પ્રકૃતિનાં અને જીવનનાં ગૂઢ રહસ્યો જાણવા માટે તમારે અભ્યાસ કરવાનો છે, તમારી ચેતનામાં વૃદ્ધિ થાય એટલા માટે તમારી જાતને કેળવવાની છે. તમારી જાતનો તમે સ્વામી બની શકો, તમારી અશક્તિ અને અજ્ઞાનને તમે જીતી શકો એટલા માટે તમારે તમારી જાતને કસવાની છે, તમે કોઈ એક વધુ ઉમદા, વધુ વિશાળ, વધુ ઉદાર અને વધુ સત્ય એવા ધ્યેય તરફ જીવનમાં ગતિ કરી શકો એટલા માટે તમારે તમારી જાતને તૈયાર કરવાની છે... વિદ્યાર્થીઓ આ વસ્તુઓનો

ભાગે જ વિચાર કરતા હોય છે. આ બધું તો તેમને એક સ્વખસૂષિ જેવું લાગે છે. જીવનમાં તેમને એક વસ્તુ અગત્યની લાગે છે — વ્યવહારુ બનવું, પૈસા કમાવા માટે પોતાની જતને તૈયાર કરવી, એ વિદ્યા જાણી લેવી.

જે બાળકો આ રીતના રોગમાં સપદાયેલાં છે તેમનું સ્થાન આશ્રમના શિક્ષણ કેન્દ્રમાં નથી. બાળકોને આ વસ્તુ સમજાવવા માટે જ અમે તેમને કોઈ વિધિસરની પરીક્ષા કે સ્પર્ધા માટે તૈયાર કરતાં નથી તેમ જ બહારની દુનિયામાં તેમને કામ આવે તેવા ડિલ્પોમા કે ઈલકાબ આપતા નથી.

અમે તો બાળકોમાં એક વધુ ઉચ્ચા, વધુ ઉત્તમ જીવનની અભીષ્ટા હશે, જ્ઞાન અને પૂર્ણતા માટેની જંખના હશે, જેમને એક વધુ સંપૂર્ણ રીતનું સાચું જીવન જોઈતું હશે એવાં બાળકોને જ અહીં લેવા માગ્યોએ છીએ.

બીજાઓને માટે દુનિયામાં અનેક દરવાજા ઉઘાડા છે.

(૧૭ જુલાઈ ૧૯૬૦)

\*

### "મધુર માતાજી,

આપે શારીરિક કેળવણીના વિભાગમાં એવી સર્વ વ્યવસ્થાઓ કરી છે જેને લઈને અમે અમારાં શરીરનો સર્વ શક્ય પ્રકારનો વિકાસ કરીને સર્વાંગીણ રૂપાંતરના કાર્યમાં ભાગીદાર થવાની તૈયારી કરી શકીએ.

અમે અનેક વર્ષોથી રમતગમતો અને અનેક પ્રકારનું શારીરિક શિક્ષણ આપી રહ્યાં છીએ પણ અમને લાગે કે અમારા વિદ્યાર્થીઓ એ સર્વની પાછળની ભાવનાને સમજી શકતા નથી. સામાન્ય રીતે એ લોકોનું ધ્યાન આનંદ કરવામાં, ઉશ્કેરાટ અને આવેગભર્યા વલણોમાં અને અનેક પ્રકારના ગમાણણગમામાં આડે રસ્તે દોરાઈ જતું હોય છે. એટલે પરિણામ એમ જાણાય છે કે સમગ્ર રીતે જોતાં, જે શિસ્ત, સંકલ્પ, નિશ્ચય, સખત કામ અને સાચું વલણ અમારી પ્રગતિ માટે અનિવાર્ય છે તેમનો અભાવ છે. કોઈ ફટબોલની રમત હોય છે કે એના જેવી બીજી ઉશ્કેરાટ ઊભો કરે તેવી રમત હૌંય છે તો એને માટે અત્યંત ઉત્સાહ જાગ્રત થાય છે પરંતુ અમારી શારીરિક ગુણવત્તા ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે કોઈ ખંતપૂર્ણ અને એકાગ્રતા માગ્યી લેતું કામ કરવાનું હોય છે તો એને માટે કોઈ ખાસ આતુરતા દેખાતી નથી. નાના મોટાં લગભગ મોટાભાગના સૌ વિદ્યાર્થીઓ આવી રૂગણ અવસ્થા ભોગવે છે. શારીરિક કેળવણીને યોગ્ય વલણ સાથે અપનાવનાર બધું થોડા

છે. આ વસ્તુ અમારી સામાન્ય કાર્યવાહી બની રહે તેવું અમે કઈ રીતે શીખી શકીએ?"

ચેતનાનાં તત્વો બદલાવાં જોઈએ, ચેતનાનો સ્તર ઉચ્ચગામી થવો જોઈએ. ચેતનાની ગુણવત્તા પ્રગતિશીલ બનવી જોઈએ.

વસ્તુસ્થિતિ તમે જણાવો છો તેવી જ છે કારણ કે મોટા ભાગનાં બાળકોની ચેતનાનું કેન્દ્ર સ્થૂલ ભાગમાં છે અને એ ભાગ તામસિક હોઈ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવાને આનાકાની કરતો હોય છે. એમને આસાયેશાભરી જિંદગી જોઈએ છે અને કોઈ રમત કે હરીકાઢિને કારણે ઉજ્ઝેરાટ અનુભવવાનો હોય છે કે ચડસાચડસી કરવાની હોય છે ત્યારે જ કશો પ્રયત્ન કરવા પૂરતો રસ તેમનામાં જાગ્રત થાય છે. આમ કરવા માટે તેમના સંકલ્પને તીવ્ર બનાવવો પડે છે અને એને માટે કોઈ પ્રાણમય આવેગની જરૂર પડે છે.

પ્રગતિ કરવાનો ઘ્યાલ ચિંતનશીલ બુદ્ધિના કાર્યક્ષેત્રમાં આવે છે. એ તો કેવળ, જે થોડાક લોકોને પોતાના ચૈત્ય પુરુષનો સંપર્ક હોય છે તેમનામાં જ સક્રિય હોય છે. પછીથી, જે લોકોનું મન કંઈક વધુ પ્રમાણમાં વિકાસ પામેલું હોય છે અને જેઓ પોતાનો વિકાસ કરવાની અને પોતાની જાતને વશમાં રાખવાની જરૂરિયાત સમજતા થાય છે તેમનામાં જાગ્રત થાય છે.

મેં કહેલું છે કે આનો ઈલાજ એ જ છે કે તમે તમારી ચેતનાને વધુ ઉચ્ચ કક્ષાએ લઈ જાઓ. પરંતુ સ્વાભાવિક રીતે જ આમ કરવાની શક્યાત્ત તો કેંપનો અને તાલીમ આપનારાઓની ચેતનાની કક્ષાથી જ થવી જોઈએ.

સૌ પ્રથમ તો, તેઓ જેમને માટે જવાબદાર છે તેમની પાસેથી તેઓ શું ગ્રાન્ટ કરવા ઈચ્છે છે તે વિષે, તેમને સ્પષ્ટ ઘ્યાલ હોવો જોઈએ, અને એટલું કંઈ પૂરતું નથી. એમણે એમની પોતાની જાતમાં, તેઓ બીજાઓ પાસેથી જેની અપેક્ષા રાખતા હોય, તે સિદ્ધ કરેલું હોવું જોઈએ. આ ગુણો ઉપરાંત, તેઓએ તેમના ચારિત્ર્ય અને વર્તનમાં ખૂબ ખૂબ પ્રમાણમાં ધીરજ, સહનશીલતા, માયાળુપણું, સમજદારી અને નિષ્પક્ષપાતીપણું વિકસાવેલું હોવું જોઈએ. એમનામાં કોઈ ગમા-આણગમા કે આકર્ષણ કે જુગુપ્સાની વૃત્તિઓ ન હોવી જોઈએ.

આટલા માટે જ, કેંપનોનું જે નવું જૂથ છે તે એક ઉચ્ચ સ્તરનું ગ્રૂપ હોવું જોઈએ જેમનો દાખલો વિદ્યાર્થીઓને માટે આદર્શ સરખો હોય. એમ બને ત્યારે જ તેઓ વિદ્યાર્થીઓ પાસેથી સાચા વલાણની અપેક્ષા રાખી શકે.

માટે હું બધાને કહું છું: ખરા હદ્યથી કામે લાગી જાઓ અને વહેલા મોડા પણ

આ વિરોધો દૂર થઈ જશે જ.

(૫ જુલાઈ ૧૯૬૧)

**“મધુર માતાજી,**

શારીરિક શિક્ષણાના આપણા કાર્યક્રમમાંની કેટલીક પ્રવૃત્તિઓ, અન્ય પ્રવૃત્તિઓ કરતાં વધુ ગંભીર પ્રકારની અને વધુ એકાગ્રતા માણી લે તેવી છે; બાળકોને આવી પ્રવૃત્તિઓ કંટાળા જનક લાગે છે. તો કેટનોએ શું એમ કરવું કે તેઓ જે ગ્રૂપો ગોઠવે તે એવી રીતના હોયકે તેમાં તેઓ જે કાંઈ શીખવતા હોય તે રસ પડે તેવું અને આનંદદાયક લાગે, કે પછી તેઓ એ એમ કરવું કે જે કાંઈ શીખવવામાં આવે તેમાં રસ લેતાં શીખવાનું કામ બાળકો ઉપર છોડી દેવું?”

બંને વસ્તુઓ અનિવાર્ય છે અને શક્ય હોય ત્યાં સુધી હંમેશાં અપનાવવી જોઈએ.

રિષ્કડોએ થોડીક કલ્પનારાશક્તિ અને નવું શોધવાની આવડતનો ઉપયોગ કરીને વસ્તુઓને એવી રીતે સાનુક્ષળ લાગે તેવી બનાવવી કે જેથી તેઓ જે કાંઈ શીખવતા હોય તે આહ્લાદક અને નૂતન પ્રકારનું લાગે.

બાળકોએ, તેમના પક્ષે, તેમનામાં ગ્રાગતિ માટે એવું સંકલ્પબળ અને વલાણ કેળવવું જોઈએ કે પોતે જે કાંઈ કરતાં હોય છે, તેમને માટે સતતપણે રસદાયક બની રહે.

વચ્ચાળાના સમયમાં કેટનોએ બાળકોને તેમની કસરતોને તેઓ પોતે જ ગોઠવી લે તે બાબતની જવાબદારી થોડાક અંશે સોંપી શકે, અને એમ કરવામાં તેમને જે કાંઈ મૌલિક વિચારો સૂક્ષે તેમનો ઉપયોગ કરી શકે.

જો બાળકોમાં સહયોગ અને જવાબદારીની લાગણી જગ્રત કરવામાં આવશે, તો તેઓ પોતે જે કાંઈ કરતાં હશે તેમાં રસ લેશે અને આનંદપૂર્વક કરશે.

(૨૧ જુલાઈ ૧૯૬૧)

**“મધુર માતાજી,**

અમે અમારું ગ્રૂપ મળે ત્યારે અને છૂટાં પડીએ તે પહેલાં અને પછીની એક એક મિનિટ માટે એકાગ્રતા કરીએ છીએ. અમારે આ એકાગ્રતાના સમયે શું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ?”

શરૂઆતની એકાગ્રતા કરતી વેળાએ, તમે જે કાંઈ કરવાના છે તેનું પ્રભુને સમર્પણ કરજો કે જેથી એ આત્મદાનની ભાવનાપૂર્વક થઈ શકે.

પછીના ભાગની એકાગ્રતા કરતી વેળાએ, પ્રભુને એવી પ્રાર્થના કરજો કે તમારામાં પ્રગતિ કરવાનો સંકદ્ય બળવાન બને, અને તમારી ઈન્દ્રિયો પ્રભુની સેવા કરવાને માટે વધુ ને વધુ પ્રમાણમાં શક્તિમાન બને.

વળી, શક્ષાત કરતાં પહેલાં તમે પ્રભુને તમારી જાતનું નીરવપણે સમર્પણ પણ કરી શકો છો.

અને અંતે, તમે નીરવતાપૂર્વક પ્રભુને આભાર પણ માની શકો છો.

મારો કહેવાનો અર્થ એ છે કે આ સર્વ વસ્તુઓ, કોઈ પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યા વિના, હદ્યની એક ગતિઝ્યે થવી જોઈએ.

(૨૪ જુલાઈ ૧૯૬૧)

માનવજીવનમાં સર્વ પ્રકારની મુશ્કેલીઓ, સર્વ પ્રકારના વિસંવાદો સર્વ પ્રકારનાં નૈતિક દુઃખોનું કારણ એ છે કે સૌ કોઈની અંદર, તેમની કામનાઓ અને ગમા-અણણમાં સાથેના અહુંકારનું અસ્તિત્વ હોય છે. જ્યારે કોઈ તદ્દન નિષ્કામ કર્મ કરવાનું હોય અને અન્યને સહાય કરવાની હોય ત્યારે પણ જ્યાં સુધી તમે તમારા અહુંકાર અને તેની માગણીઓની ઉપરવટ જતાં નહિ શીખો, જ્યાં સુધી તમે અહુંકારની ઉપર બળ કરીને તેને એક ખૂણણમાં ચૂપચાપ બેસાડતાં નહિ શીખો, ત્યાં સુધી એને જે કાંઈ નહિ ગમતું હોય તેની પ્રત્યે એ પ્રતિકાર્ય કરતા રહેશો, અંતરમાં એક એવું તોફાન ઊભું કરશે જે સપાઠી ઉપર આવીને સર્વ વસ્તુઓને બગાડી મૂકશે.

અહુંકારને વશ કરવાનું આ કામ, લાંબા ગાળાનું, ધીમું અને મુશ્કેલ છે; એમ કરવા માટે સતત જાગૃતિ અને અવિરત પ્રયાસની જરૂર રહે છે. આ રીતનો પ્રયત્ન કોઈને માટે સહેલો તો કોઈને માટે મુશ્કેલ હોય એમ બની શકે છે.

આપણે અહીં આ આશ્રમમાં ભેગાં મળીને શ્રી અરવિંદના જ્ઞાન અને શક્તિની સહાય વડે આ કાર્યને સિદ્ધ કરવા માગીએ છીએ. એક એવો પ્રયત્ન કરવા માગીએ છીએ કે આપણો સમૂહ વધુ સંવાદપૂર્ણ, વધુ એકતાવાળો અને પરિણામે જીવનમાં ઘણો ઘણો અસરકારક નીવડે.

જ્યાં સુધી હું તમારી સૌની વચ્ચે સદેહે હાજર રહેતી હતી ત્યાં સુધી તો મારી એ હાજરી તમને તમારા અહુંકાર ઉપર પ્રભુત્વ મેળવવામાં મદદ કરતી રહેતી હતી અને એટલે મારે તમને વ્યક્તિગત રીતે અને વારંવાર એ વિષયમાં કંઈ કહેવાની જરૂર રહેતી નહિ.

પરંતુ હવે, આ પ્રકારનો પ્રયત્ન કરવો એ દરેક વ્યક્તિના અસ્તિત્વના પાયાર્ય બની રહેવું જોઈએ — ખાસ કરીને તમારામાંના જેઓની સ્થિતિ જવાબદારીવાળી છે

અને જેમને અન્યની કાળજી લેવાની છે તેમને તો આ વસ્તુ, વિશેષ રૂપે લાગુ પડે છે. જેઓ આગેવાનો હોય તેમણે પોતે જ ઉદાહરણરૂપ બની રહેવું જોઈએ; પોતાની સંભાળ હેઠળના લોકો પાસે તેઓ જે સદ્ગુણોની અપેક્ષા રાખતા હોય તેવા સદ્ગુણોનો તેમણે પોતે જ અમલ કરવો જોઈએ; આ આગેવાનોએ સમજદાર, ધીરજવાન, સહનશીલ, સહાનુભૂતિપૂર્ણ મૈત્રીભરી અને ઉભા આપનારી શુભચેષ્ટાવાળા બની રહેવું જોઈએ. આ વસ્તુ તેમણે પોતાના માટે મિત્રો ઊભા કરવાના અહંમૂલક હેતુથી કરવાની નથી, પરંતુ બીજાઓને સમજુને તેમને સહાય કરવાની ક્ષમતા મેળવવા માટેની ઉદારતાના ભાવ સાથે કરવાની છે.

જો તમારે સાચા નેતા બનવું હોય તે પોતાની જાતને અને પોતાના ગમા-આણગમા અને પસંદગીને ભૂલી જવું અનિવાર્ય છે.

અત્યારે હવે તમારી પાસે હું આ વસ્તુની માગણી કરી રહી છું કે જેથી તમે તમારી જવાબદારીઓને યોઝ રીતે, પૂર્ણ કરી શકો. અને એમ કરશો તો તમને જણાશો કે તમને જે ગેરવ્યવસ્થા અને અનૈક્ય જણાતાં હૃતાં તે અદૃષ્ટ થઈ ગયાં છે અને તેમનું સ્થાન, સંવાદ, શાંતિ અને આનંદ લીધેલું છે.

તમે જાણો છો કે હું તમને ચાહું છું, હંમેશાં તમારી સાથે રહીને તમને ટેકો આપી રહી છું, મદદ કરી રહી છું અને તમને માર્ગદર્શન આપી રહી છું.

આશીર્વાદ.

(૨૬ ઓગસ્ટ ૧૯૬૬)

**“મધુર માતાજી,**

ઘણા બાળકો મને પૂછે છે કે તેઓ માટે તેમના રજાના દિવસો અહીં ગાળવા માટેની ઉત્તમ રીત કઈ છે.”

એ સમયમાં તેમને કોઈ રસદાયક કાર્ય કરવાની, કંઈક નવું શીખવાની, પોતાની પ્રકૃતિમાંના કોઈ નબળા ભાગને વિકસિત કરવાની અથવા અભ્યાસ કરવાની ઉત્તમ તક મળી રહે છે.

વળી એ સમયમાં તેઓ સ્વતંત્રપણે કોઈ કાર્યની પસંદગી કરીને પોતાના સ્વરૂપની સાચી શક્તિઓની પિછાણ મેળવી શકે છે.

આશીર્વાદ.

(૧ નવેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

વિદ્યાર્થીઓ તેમની રજાઓમાં તેમને ઘેર કે બીજે કોઈ ડેકાએ જાય તે તેમને પસંદ છે?”

એના કરતાં એમ કહીએ તો વધુ સારું કે વિદ્યાર્થીઓ તેમની રજાઓ દરમ્યાન શું પ્રવૃત્તિ કરે છે તેના ઉપરથી તેઓ કેટલામાં છે અને અહીંના વસવાટનો કેટલો લાભ ઉકાવી શકે તેમ છે તે જણાઈ આવે છે. એટલે, દરેક વિદ્યાર્થીનો કેસ જુદો હોય છે અને તે જે પ્રકારે વર્તે છે તેના ઉપરથી તેના ચારિઅનો પ્રકાર જણાઈ આવે છે.

સાચું કહું તો, બીજું કાંઈ કરવાને બદલે જે વિદ્યાર્થીઓ રજાઓમાં અહીં જ રહે છે તેઓ તેમની અહીંની કેળવણીનો લાભ પામવાને માટે અને જે આદર્શ તેમની સમક્ષ રાખવામાં આવ્યો છે તેને સંપૂર્ણપણે સમજવા માટે વધુ લાયક હોય છે.

આશીર્વાદ.

(૨ નવેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

આનો અર્થ શું એમ થાય કે જેઓ બહાર જાય છે તેઓ તેમને શીખવવામાં આવતા આદર્શને પૂર્ણ પણે સમજવાને લાયક નથી અથવા તો એમ છે કે અમે તેમને તેમના આદર્શના વિષયમાં જરૂરી સમજૂતી આપી શકતા નથી?”

હું એમ નથી કહેતી કે અહીંનું શિક્ષણ સંપૂર્ણ અને તદ્દન જેવું જોઈએ તેવું છે. પરંતુ એ તો નક્કી છે કે ઘણા વિદ્યાર્થીઓને અહીં રસ પેડ છે અને તેમને એમ લાગે છે કે જે અહીં છે તે બીજે પ્રાપ્ત થઈ શકે તેમ નથી.

એટલે, કેવળ એ પ્રકારના વિદ્યાર્થીઓએ જ અહીં રહેવું જોઈએ, અને આપણી પાસે આવતી માગણીઓને પૂરી કરવા જેટલી જરૂર આપણી પાસે નથી એટલે આપણે માટે પસંદગી કરવાનું કામ સહેલું થશે.

આશીર્વાદ.

(૩ નવેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

જેઓ સમજું શકતા નથી તેમને આપણા આદર્શ વિષે સમજાવવું શક્ય છે ખરું? અને એ વસ્તુ તેમને કઈ રીતે સમજાવી શકાય? અમે એટલે કે

તાલીમ આપનારાઓ અને શિક્ષકો, શું આ કાર્ય કરવાને માટે લાયક છીએ?”

આપણે જે શીખવવા માગીએ છીએ તે કોઈ માનસિક આદર્શ નથી, એ એક નવીન પ્રકારના જીવન માટેનો અને નૂતન ચેતનાને સિદ્ધ કરવા માટેનો આદર્શ છે. આ વસ્તુ સિદ્ધ કરવાનું કામ સૌને માટે નવું છે અને બીજાઓને આપણા આદર્શ માટે શીખવવાનો એક માત્ર ઉત્તમ માર્ગ એ છે કે દરેકે પોતે આ નવીન ચેતનાનું અનુસરણ કરતાં જીવન ગાળવું અને પોતાની જીતનું એના વડે રૂપાંતર થવા દેવું. ઉદાહરણ આપવા માટેનો એથી વધુ સારો કોઈ પદાર્થ પાઈ નથી. બીજાઓને કહેવું કે “સ્વાર્થી ન બનશો”, એનાથી કોઈ અર્થ સરે તેમ નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ સર્વ પ્રકારના સ્વાર્થીપણાથી મુક્ત હશે તો એ અન્યને માટે એક અદ્ભુત દાખલાનું કામ કરશે. અને જો કોઈ વ્યક્તિ ખરા દિલથી પરમ સત્યનું અનુસરણ કરતાં કાર્ય કરવાની અભીષ્ટા સેવતી હોય છે તો એ પોતાની આસપાસના માણસોને તેનો ચેપ લગાડે છે. એટલે તાલીમ આપનારાઓ તેમ જ શિક્ષકોની પહેલી ફરજ તો એ છે કે જે ગુણો વિષે તે બીજાઓને શિક્ષણ આપતા હોય તે ગુણોના ઉદાહરણકૃપ તેઓએ પોતે જ બનવું.

અને, શિક્ષકો અને તાલીમ આપનારાઓમાં કોઈ તેમની જ્યા માટે લાયક ન હોય — કારણ કે તેમના વર્તન દ્વારા તેઓ ખોટો દાખલો બેસાડતા હોય — તો તેમની પહેલી ફરજ એ છે તેઓએ પોતાનું ચારિત્ય અને વર્તન સુધારીને પોતાના સ્થાન માટે લાયક બનવું. આમાં કોઈ બીજો માર્ગ જ નથી.

આશીર્વાદ

(૪ નવેમ્બર ૧૯૬૬)

“મધુર માતાજી,

આશ્રમના શિક્ષક અને તાલીમ આપનાર માટે કયા મુકારની લાયકાતો આપ આવશ્યક ગણો છો? જે પોતાને એમ લાગતું હોય કે પોતે આ કાર્ય સારી રીતે કરી શકે તેમ નથી તો એ કરવું જ નહિ તે વધુ સારું ન કહેવાય? કારણ કે આમાં તો અમારે લઈને બાળકોને સહન કરવાનો વારો આવે છે, ખરું ને?”

અહીંના શિક્ષકો અને તાલીમ આપનારાઓમાં ગમે તે અપૂર્ણતાઓ હશે છતાં

બહારના કરતાં તેઓ હંમેશાં વધુ સારા હશે. કારણ કે અહીં જે કોઈ કાર્ય કરે છે, તે વિના-વેતને એક ઉચ્ચતર હેતુને ખાતર કાર્ય કરે છે. એ વસ્તુ સ્પષ્ટપણે સમજી રાખવી કે કોઈ વ્યક્તિમાં ગમે તેટલી લાયકાત કે આવડત હોય તે છતાં તેણે એક એવા આદર્શને સિદ્ધ કરવા માટે સતતપણે પ્રગતિશીલ રહેવાનું છે કે જે આદર્શ અત્યારની માનવજીતિએ સિદ્ધ કરેલી વસ્તુઓ કરતાં હજુ ઘણે ઊંચે છે.

પરંતુ જો કોઈને પોતાથી શક્ય તેટલું ઉત્તમ કાર્ય કરવાની તમજા હોય તો, તે પોતે કામ કરતો જાય તે જ પ્રગતિ કરીને વધુ ને વધુ સારી રીતે કાર્ય કરતો બની શકે છે.

ટીકા કરવાથી ભાયે જ કોઈ હેતુ સરે છે, એ સહાય કરવા કરતાં વધુ અંશે તો નિરૂત્સાહ જ પેદા કરે છે. અને જ્યાં જ્યાં શુભેચ્છા રહેલી હોય તે ઉતેજન આપવા યોગ્ય છે કારણ કે ધીરજ અને ખંત હોય તો, એવી કોઈ પ્રગતિ નથી કે જે સિદ્ધ ન થઈ શકે.

મુખ્ય વાત એ છે કે એવો નિશ્ચય સેવવો કે ગમે તેટલી સિદ્ધ પ્રાપ્ત થઈ હોય છતાં જો ઈચ્છા હોય તો તેથી પણ વધુ સિદ્ધ કરવાને અવકાશ રહેલો જ હોય છે.

આપણે જે આદર્શને સિદ્ધ કરવાનો છે તે આ છે: અક્ષુષ્ય એવું આત્માનું અને વર્તનાનું સમત્વ, એક અપરિહૃદય ધૈર્ય અને વિશેષ કરીને પસંદગી અને કામનાનો અભાવ.

આથી સ્પષ્ટ થાય છે કે જેઓ શિક્ષણનું કાર્ય કરે છે તેમને માટે તેમના કાર્યની પરિપૂર્ણતા અર્થે સર્વ પ્રકારના અહુકારનો અભાવ તેમનામાં સિદ્ધ થયેલો હોવો જોઈએ; અને આ વિષયમાં, આ પ્રકારની સિદ્ધ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની બાબતમાં કોઈ મનુષ્યને છૂટ આપવામાં આવતી નથી.

પરંતુ ફરીથી કહીશ કે આ પ્રકારનો પ્રયત્ન કરવાનું કામ બીજા કોઈ સ્થળ કરતાં અહીં વધુ સહેલાઈથી થઈ શકે છે.

આશીર્વાદ.

(૫ નવેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

જે લોકોને સામાન્ય જીવનનાં સિનેમા, રેસ્ટોરન્ટ, સામાજિક જીવન, વગેરે ગ્રત્યે ઘણું આકર્ષણ હોય તેઓએ આપણી શાળામાં ભાગવા આવવું જોઈએ? કારણ કે એમ લાગે છે કે, એક નિયમ તરીકે, આ કારણ માટે જ આપણા મૌટા ભાગના વિદ્યાર્થીઓ તેમની રજાઓમાં બદ્દાર જાય છે, અને

જ્યારે તેઓ પાછા આવે છે ત્યારે દરેક વખતે તેમને પાછા અહીંના જીવન સાથે મેળમાં આવતાં લાંબો સમય લાગે છે.”

જે લોકોને સામાન્ય જીવન અને તેના ઉધમાત પ્રત્યે સજજડ આસક્તિ હોય તેમણે અહીં ન આવવું જોઈએ, કારણ કે તેઓ તેમના મુખ્ય તત્ત્વથી બહાર હોય છે અને અહીં આવીને અવ્યવસ્થા ઊભી કરે છે.

પરંતુ આ વસ્તુ, તેઓ અહીં આવે તે પહેલાં જાણવી મુજલે છે, કારણ કે તેમાંના ઘણાખરા બહુ જ નાના હોય છે અને તેમના ચારિશ્યનું પોત હજુ બરાબર ઘણાયું નથી હોતું.

પરંતુ જ્યારે તેઓ દુનિયાદરીની ધમાચકડીમાં ખેંચાઈ જાય ત્યારે તેમને પોતાને અને અન્યને માટે એ વસ્તુ વધુ સારી હોય છે કે તેઓ તેમનાં માબાપ અને તેમની આદતો પ્રત્યે તરત જ પાછા વળી જાય.

આશોવાઈ.

(૧૪ નવેમ્બર ૧૯૬૬)

“મધુર માતાજી,

અહીં એવાં ઘણાં બાળકો છે કે જેમને તેમનાં માબાપે અહીં કેવળ ભાણવા માટે મોકલ્યાં છે. એમનામાંથી એ વિચાર તેમનાં મગજમાં સુદૃઢપણે સ્થાપિત થયેલો હોય છે કે તેઓ કેવળ વિદ્યાર્થીઓ છે અને શિક્ષણ પૂરું થતાં તેઓને અહીંથી જવાનું છે.

જ્યારે આપણને એક વાર એવી ખબર પડે કે આ બાળકોને પોતે શું કરવા માગે તેનો બરાબર ખ્યાલ છે તો, શું એમ કરવું વધુ સારું ન ગણાય કે તેમને રીતસર ખબર જ આપી દેવીકે તેઓએ અહીંથી બીજે અભ્યાસ કરવા ચાલ્યા જવું? અથવા, તો પછી એમ કરવું કે એમને એક વાર સ્વીકાર્ય છે તો તેમને તેમનો અભ્યાસ ચાલુ રાખીને અહીં પૂરો કરવા દેવો?”

દુખર્યા, એવા ઘણાં માબાપો છે કે જેઓ તેમના બાળકોને અહીં એક વિશિષ્ટ પ્રકારથી કેળવણી અપાય છે તેટલા માટે નહિ પણ આશ્રમ તેમનો અભ્યાસ માટે પૈસા માગતો નથી એટલા માટે મોકલે છે, કારણ કે બીજાં સ્થળ કરતાં અહીંને માટે તેમને ઓછા પૈસા ખર્ચવા પડે છે.

પરંતુ આ પ્રકારની વ્યાપારી વૃત્તિ માટે બિચારાં બાળકોના કોઈ દોષ નથી અને

જો તેમનામાં લાયકાત હોય તો તેમને તેમનો વિકાસ પ્રાપ્ત કરવાની આપણે તક આપવી જોઈએ. એટલે, આપણાને એમનામાં કોઈ શક્તા જાણાય છે તો આપણે તેમને સ્વીકારીએ છીએ. એટલે પછી જ્યારે તેઓ સ્પષ્ટપણે એમ બતાવે કે તેઓ અહીંની કેળવાણીથી કશો લાભ પ્રાપ્ત કરવા શક્તિમાન નથી ત્યારે જ આપણે, તેમને જવું હોય તો જવા દઈએ છીએ.

આશીર્વાદ.

(૧૫ નવેમ્બર ૧૯૬૮)

**“મધુર માતાજી,**

જે વિદ્યાર્થીઓ જાણતા હોય કે તેઓ તેમનું શિક્ષણ પૂરું કરીને અહીંથી જવાના છે તેમને માટે શું એ કરવું અનિવાર્ય નથી કે તેમને અવારનવાર બહાર જવા દેવા કે જેથી કરીને પાછળથી તેઓ બહારના જીવનમાં બરાબર ગોડવાઈ શકે?”

બહારના જીવનમાં ગોડવાવામાં કશી મુશ્કેલી પડતી નથી. એ એક એવું બંધન છે કે જેની સામે તમે જન્મથી બંધાયેલા હો છો, કારણ કે વંશપરંપરાના સંસ્કારથી એ વસ્તુ તમારામાં જડાયેલી હોય છે, અને જે લોકો આ પ્રકારના બંધનમાંથી મુક્ત થવાને માટે જન્મેલા હોય છે તેમને પણ સાચી રીતે મુક્ત બનવા માટે ગંભીરપણે અને સતતપણે આ પ્રકારના પૂર્વજોના સંસ્કારો સાથે યુક્તમાં ઊત્તરવું પડે છે.

આશીર્વાદ.

(૧૬ નવેમ્બર ૧૯૬૮)

**“મધુર માતાજી,**

જે વિદ્યાર્થીઓ અહીંનું શિક્ષણ પૂરું કરીને બહાર જવાના હોય તેમની પાસે આપ શી અપેક્ષા રાખો છો? એ તો નક્કી છે કે સામાન્ય લોકો અને તેમની વચ્ચે ઘણો મોટો ભેટ હુશે. આ ભેટ કયા પ્રકારનો હુશે?”

ઘણી વાર, જ્યારે તેઓ સામાન્ય જીવનમાં જઈ પડે છે કે તરત જ તેમને આ ભેટનો ઘ્યાલ આવે છે અને પોતે જે ગુમાવ્યું છે તે બદલ ખેટ અનુભવે છે. એમાંના ઘણા થોડામાં એવી હિંમત હોય છે કે તેમના સામાન્ય વાતાવરણના આસાયેશને તેઓ છોડી શકે, પરંતુ એ સિવાય બીજા લોકો, પણ જ્યારે તેઓને સામાન્ય જીવનનો

સામનો કરવાનો આવે છે ત્યારે, જે લોકોને આશ્રમ સાથે કશો જ સંબંધ નથી હોતો તેવા લોકોની અભાનતા કરતાં, તેઓ જુદી જ રીતે કામ લે છે.

આપણે કશા બદલાની આશાથી કામ કરતા નથી. કેવળ માનવજીતની પ્રગતિમાં સહાયભૂત થવા માટે જ કાર્ય કરીએ છીએ.

આશીર્વાદ

(૧૮ નવેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

**શિક્ષક કે તાલીમ આપનારે વિદ્યાર્થીઓ ઉપર શિસ્ત લાદવી એ આપ કેટલા અંશો ફરજરૂપ માનો છે?”**

વિદ્યાર્થીઓને અનિયમિત, તોછડા કે બેકાળજીવાળા બનતા અટકાવવા એ અનિવાર્ય છે. કૂર અને નુકસાનકારક તોફાન પણ ચલાવી ન લેવાય.

પરંતુ એક સર્વ સામાન્ય અને સુનિશ્ચિત નિયમ તરીકે એ વસ્તુ સમજ લેવી જોઈએ કે શિક્ષકો અને ખાસ કરીને શારીરિક શિક્ષણની તાલીમ આપનારાએ તેઓ તેમના વિદ્યાર્થીઓ પાસેથી જે ગુણોની અપેક્ષા રાખતા હોય તેના તેઓ પોતે જ ઉદાહરણરૂપ હોવા જોઈએ. શિસ્ત, નિયમિતતા, સારી રીતભાત, હિંમત, સહનશક્તિ, પ્રયત્નમાં ધૈર્ય — આ બધા ગુણો, શબ્દો કરતાં ઉદાહરણથી વધુ સારી રીતે શીખવી શકાય છે. અને એક સુનિશ્ચિત નિયમ તરીકે એ જાણી લેવું કે જે વસ્તુ કરવાની તમે તમારા બાળકોને મનાઈ કરતાં હો તે તો તેના દેખતાં ન જ કરવી.

બાકી તો, દરેક પ્રસંગમાં તેનો આગવો ઉકેલ રહેલો હોય છે અને આપણે વિવેકબુદ્ધિ અને કળનો ઉપયોગ કરીને પગલાં લેવાં જોઈએ.

આટલા માટે જ જો તમે અમલમાં મૂકી શકો તે એક શિક્ષક બનવું કે તાલીમ આપનાર બનવું એ જ સૌથી મોટી શિસ્ત છે.

આશીર્વાદ.

(૨૦ નવેમ્બર ૧૯૬૬)

દરેક બાળકે કજિયો-કંકાસ કરવાનું બંધ કરવું જોઈએ. એણે એ શીખવું જોઈએ કે કોઈ તેને શિક્ષા કરશે એવી બીકથી નહિ પણ કજિયા કરવા એ શરમજનક વસ્તુ

છે એમ સમજુને વર્તન કરવું જોઈએ.\*

પ્રથમના પ્રસંગે એ સાચી પ્રગતિ કરે છે. બીજા પ્રસંગે જ્યારે એ ભય રાખે છે ત્યારે તેનું માનવ ચેતનામાંથી પતન થાય છે કારણ કે ભય એ પોતે જ ચેતનાનું પતન છે.

(૨૧ નવેમ્બર ૧૯૬૬)

“મધુર માતાજી,

શિક્ષક અને તાલીમ આપનારની જવાબદારી કેવળ શાળાના કે ખે ગ્રાઉન્ડનો સમય પૂર્તી જ મર્યાદિત છે?

હું આ વસ્તુ પૂછું છું કારણ કે આપણાં ઘણાં બાળકો સામાન્ય રીતે રસ્તામાં બલું બેહૂદું વર્તન કરે છે. તેઓ ગમે ત્યાં ચાલે છે, રસ્તા વર્ચ્યે વાતો કરવા ઊભા રહે છે, અને સૌથી મુશ્કેલ પ્રશ્ન તો એ છે કે તેઓ સાઈકલ ઉપર બત્તી વિના કે બ્રેક વિના સવારી કરે છે અને બબ્બે જણા બેસે છે. અમારામાંથી કોઈ એ પ્રત્યે ધ્યાન આપતું નથી કારણ કે એ વસ્તુઓ અમારા કામના સમયની બહાર બને છે.

અને આ વસ્તુને અટકાવવા માટે કશો પ્રયત્ન થતો નથી. કાયદા પ્રત્યેની ઉપેક્ષા એટલી બધી વ્યાપી ગઈ છે કે કેટલાક જવાબદાર લોકો પણ તેમનું ઉલ્લંઘન કરતા જોવામાં આવે છે.”

આ દુઃખદ પરિસ્થિતિનો ઉત્તમ ઈલાજ એ છે કે જ્યારે બાળકો એકઠાં થયાં હોય (કદાચ ખે ગ્રાઉન્ડ ઉપર), ત્યારે તેમને, રસ્તામાં કઈ રીતે વર્તવું તે વિષયમાં એક ટૂંકો પદાર્થપાઠ આપવો — શું કરી શકાય અને શું ન કરી શકાય. જે કોઈને તેમની સમક્ષ બોલતાં આવડતું હોય અને તેમને રસ પે તેવી રીતે અને શક્ય હોય તો હાસ્ય પ્રેરે તેવી રીતે કહેશે તે જરૂર એનું પરિણામ આવશે.

આશીર્વાદ.

(૨૧ નવેમ્બર ૧૯૬૬)

\* પાછળથી શ્રી માતાજીએ ઉમેરેલું : આ તો પ્રથમનું પગલું છે. જ્યારે એ આટલે સુધી આવ્યું હોય છે ત્યારે તેણે આગળ વધવું જોઈએ અને સારા બનવાને આનંદ માણવો જોઈએ.

**“મધુર માતાજી,**

આનો અર્થ શું એમ થાય કે અમે એકવાર બાળકોને સારી રીતે સમજાવી દઈએકે રસ્તામાં કઈ રીતે વર્તવું એટલે પછી અમારા કામના સમય બહુરાના કલાકોમાં તેઓ શું કરે છે તે અંગે અમારી કોઈ જવાબદારી રહેતી નથી?”

જે વસ્તુ પોતે જાતે ન જોઈ હોય તે બાબતમાં ઉસ્તક્ષેપ કરે એ મુશ્કેલી-ભર્યું કાર્ય છે. અફવા હુંમેશાં શંકસ્પદ હોય છે. પરંતુ તાલીમ આપનારામાંથી કોઈ પોતે પોતાના વિદ્યાર્થીની રસ્તામાંની ગેરવર્તણું જુએ તો એ એમાં વચ્ચેમાં પડે તો તે યોગ્ય કહેવાય, પરંતુ અલબત એક શરતે, કે તેનો એ વિદ્યાર્થી સાથેનો સંબંધ મિત્રાચારીભર્યો અને પ્રેમમય હોય.

આશીર્વાદ

(૨૨ નવેમ્બર ૧૯૬૬)

**મધુર માતાજી,**

આપને શું એમ નથી લાગતુંકે બાળકોના શિક્ષણના આપણા કાર્યક્રમમાં, આશ્રમને માટે કોઈ નિઃસ્વાથી કાર્યનું – કંઈ નહિ તે અઠવાડિયે એક દિવસ પૂરતું – સ્થાન હોવું જોઈએ?

નિઃસ્વાથી કર્મ કરવું એ હુંમેશાં સારી વસ્તુ છે. પરંતુ જો એ કાર્ય આનંદદાયક હોય અને કંટાળાજનક ફરજરૂપ ન હોય તો વધારે સારું.

આશીર્વાદ,

(૨૬ નવેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

આપણે દરેક વર્ષે ગ્રૂપ એ-૧ અને એ-૨ ના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને ખાસ ઈનામ આપીએ છીએ. આ વર્ષે એક છોક્કરાએ સમગ્ર વર્ષ દરમ્યાન ઘણું સારું કામ કર્યું છે, પરંતુ એ અત્યારે રજાઓ ગાળવા તેને ઘેર ગયો છે અને તેણે બીજુ ડિસેમ્બરના પ્રદર્શનમાં ભાગ લીધેલો નથી. આપને શું એમ લાગે છે કે, આમ છતાં, તેને આ વર્ષ માટેનું ઈનામ આપવું જોઈએ?”

એ કઈ રીતે ગયો તેના ઉપર સઘળો આધાર છે; એટલે કે એ તેનાં માબાપની

ઇચ્છાને કારણે ગયો છે કે એને પોતાને જવું હતું તે માટે ગયો છે. જો એ પોતાની ઇચ્છાથી ગયો હોય તો, ભલે બહુરથી જોતાં એની લાયકાત ઊંચી હોય છતાં કદાચ એને ઈનામ ન આપવું એ ઠીક રહેશે, કારણ કે આપણે જો ઈનામ આપીએ તે એનો અર્થ એ થાય કે આપણે વિદ્યાર્થીના આંતરિક વલાણને અને આપણા ધ્યેય વિષેની તેની સમજને, એટલે કે નૂતન સૃષ્ટિ માટે આવતી કાલના મનુષ્યોના સર્જનના કાર્ય વિષેની એની સમજને આપણે કશી અગત્ય આપતા નથી.

આશીર્વાદ.

(૧૮ ડિસેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

બાળકો કામ કરતાં થાય અથવા તેમ કરવામાં તેમને રસ પડે તેટલા માટે તેમને કોઈ પ્રકારનાં ઈનામો તેમને કામના બદલા તરીકે આપવાં એ ચોગ્ય કહેવાય?”

એ તો સ્પષ્ટ છે કે બાળકો પોતે પોતાની ચેતના વિકાસ અર્થે અને પોતે જે કંઈ ન જાણતાં હોય તેમાંથી થોડું જાણો તે માટે અભ્યાસ કરે તે વધુ સારું ગણાય પરંતુ જે બાળકો વિશેષ પ્રકારે ખંતીલા, શિસ્તપાલક અને એકાગ્ર ચિત્ત જણાય, તેઓને ઈનામો આપવામાં કંઈ ખોડું નથી.

આશીર્વાદ.

(૧૭ ડિસેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

આપને એમ નથી લાગતું કે કોઈ વ્યક્તિ અહીં શિક્ષક કે તાલીમ આપનાર બને — ખાસ કરીને નાના બાળકોની બાબતમાં — તે અગાઉ તેણે આશ્રમમાં અમુક સમય વસવાટ કર્યો હોય તે જરૂરી છે?”

આમાં જે જરૂર છે તે ચેતના અમુક પ્રકારના વલાણની — અને દુભ્રિયે એવું બને છે કે આશ્રમમાં ઘણાં બધાં વર્ષો ગાળ્યા પછી, આ પ્રકારનું વલાણ કેળવાય જ, એવું બનતું નથી.

સાચું કહું તો, શિક્ષકોને નીમવામાં આવે ત્યારે તેઓ આ પ્રકારનું વલાણ અખત્યાર કરી શકે છે કે કેમ અને તેમના કાર્ય સાથે પોતાની જાતને બંધબેસતી કરી

શકે છે કે કેમ તે જોવા માટે તેમને પ્રાયોગિક ઘોરણે નીમવા જોઈએ.  
આશીર્વાદ.

(૧૮ ડિસેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

‘ચેતનાનું અમુક પ્રકારનું વલણ’એ શબ્દો દ્વારા આપ શું કહેવા માગો  
છો?”

આમાં ચેતનાનું એ પ્રકારનું વલણ અપનાવવાનું રહે છે કે તે વ્યક્તિને અંતરમાં  
પ્રતીતિ થયેલી હોવી જોઈએ કે જે કંઈ જ્ઞાન પામવા પાત્ર છે તેની સરખામણીમાં  
પોતે કશું જાણતા નથી અને હુરેક ક્ષણે તેની તૈયારી જે કંઈ નવું જાણવા મળે તે  
શીખવા માટેની હોવી જોઈએ કે જેથી તે યોગ્ય રીતે ભાગવી શકે. આ સૌથી વધુ  
પ્રાથમિક અગત્યનો મુદ્દો છે.

એક બીજી વાત પણ છે અને તે એ કે આપણા બાધ જીવનને આપણે જે પ્રકારે  
જાણીએ છીએ તે એક ઓછાવતા પ્રમાણમાં ભિથ્યા આભાસ સરખું છે અને એટલા  
માટે આપણે સતતપણે સત્ય માટેની અભીષ્ટા સેવવાનું ચાલુ રાખવું જોઈએ.

આશીર્વાદ.

(૧૯ ડિસેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

માબાપ કે વાલીઓએ આશ્રમમાં કયો ભાગ ભજવવાનો છે? તેમનાં  
બાળકોને વધુ સારું શિક્ષણ મળી શકે તે માટેના કાર્યમાં તેઓ કઈ રીતનો  
ફાળો આપી શકે?”

અહીં માબાપો અને વાલીઓની પહેલી ફરજ તો એ છે કે વાણી કે વર્તન દ્વારા અહીં  
અપાઈ રહેલા શિક્ષણથી વિરુદ્ધ ન જવું.

આપણે વિધેયક રીતે જોઈએ તો એમ કહી શકાય કે તેમણે તેમના બાળકો  
જીજુ અને શિસ્તબદ્ધ બને તે માટે તેમને ઉતેજન આપતાં રહેવું જોઈએ.

આશીર્વાદ,

(૨૪ ડિસેમ્બર ૧૯૬૬)

**“મધુર માતાજી,**

કેશન, પહેરવેશ અને ઘરેણાંની બાબતમાં આપનો શું અભિપ્રાય છે?  
આશ્રમ જીવનમાં કઈ વસ્તુ શિષ્ટાની ઘોતક ગણાય?”

પ્રભુનો આભાર, મારી પાસે કોઈ અભિપ્રાય નથી. મારા માટે તો શિષ્ટા એટલે સાદાઈ અને સર્વ્યાઈ.

આશીર્વાદ.

(૪ જાન્યુઆરી ૧૯૭૦)

**“મધુર માતાજી,**

આપ અમને જે સ્વતંત્રતા આપો છો તેનો બાળકો વ્યવસ્થિત ઉપયોગ કરી શકે એવું તેમને કઈ રીતે શીખવી શકાય?”

બાળકોએ દરેક વસ્તુ શીખવાની હોય છે. તેઓ પોતાના જીવનને ઉપયોગી અને સર્જનશીલ બનાવવા માટે પોતાને તૈયાર કરવા માટે આ વસ્તુ તેમના પાયાના ઘ્યાલરૂપ હોવી જોઈએ.

સાથે સાથે, જેમ જેમ તેઓ મોટાં થતાં જાય તેમ તેમ, તેમણે તેમની પોતાની અંદર કઈ વસ્તુઓ પ્રત્યે વધુ રસ છે અને કઈ વસ્તુઓ તેઓ સારી રીતે કરી શકે તેમ છે તે શોધી કાઢવાની વૃત્તિ હોવી જોઈએ. તેમનામાં એવી ઘણી ગુપ્ત શક્તિઓ હોય છે જેમને વિકાસ કરવાનો હોય છે. કેટલીક શક્તિઓ તો નવેસરથી શોધી કાઢવાની હોય છે.

બાળકોને એ પણ શીખવવું જોઈએ કે તેમણે મુખેલીઓ ઉપર પ્રભુત્વ મેળવવાનું છે અને એ પણ જણાવવું જોઈએ કે એમ કરવાથી જીવનને એક વિશેષ મૂલ્ય પ્રાપ્ત થાય છે; જ્યારે તમે કઈ રીતે એમ થઈ શકે તે જાણી લો છો ત્યારે તમારામાંથી કંટાળાની લાગણી હમેશાને માટે અદૃષ્ટ થઈ જાય છે અને જીવન પ્રત્યે તદ્દન નવી રીતનો રસ પ્રાપ્ત થાય છે.

આપણે પૃથ્વી ઉપર પ્રગતિ કરવાને માટે આવ્યાં છીએ અને આપણે માટે દરેક વસ્તુ શીખવા પાત્ર છે.

(૧૪ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

ગઈ કાલે આપે લખેલું છે કે, ગુપ્ત શક્તિઓને વિકસાવવાની છે અને કેટલીક શક્તિઓને નવેસરથી શોધી કાઢવાની છે.

આ પ્રકારની શક્તિઓની શોધ પરત્વે શિક્ષક અથવા તાલીમ આપનારની ભૂમિકા કયા પ્રકારની હોય છે?”

શિક્ષક કોઈ એવા પુસ્તક સરખો ન હોવો જોઈએ કે જેને મોટેથી વાંચી શકાય, દરેકને માટે એક જ પ્રકારના વાચનવાળો હોય — પછી એની પ્રવૃત્તિ અને ચારિન્ય ગમે તેવાં હોય, શિક્ષકની પહેલી ફરજ વિદ્યાર્થીને પોતાની જાતને જાણતાં અને પોતે શું સિદ્ધ કરવાને શક્તિમાન છે તે શોધી કાઢતાં શીખવવાની છે.

આમ કરી શકાય તે માટે તોણે એની રમતોનું નિરીક્ષણ કરવું જોઈએ, તે કઈ પ્રવૃત્તિઓ પ્રત્યે કુદરતી રીતે અને આપોઆપ આકર્ષાય છે, તેની બુદ્ધિ જાગ્રત છે કે કેમ, તેને કઈ જાતની વાર્તાઓ ગમે છે, કઈ પ્રવૃત્તિઓમાં તેને રસ પડે છે, માનવજીતની કઈ સિદ્ધિઓમાં તેને રસ પડે છે — આ સર્વનું નિરીક્ષણ કરવું જોઈએ.

શિક્ષકે, તેને સોંપેલાં બાળકોમાંનું દરેક કયા પ્રકારનું છે તે જાણી લેવું જોઈએ. અને કાળજીપૂર્વકના અવલોકન પછી તેને એમ જાણાય કે તેને સોંપેલાં બાળકોમાંનાં બે કે જ્રાણ એવી વિશિષ્ટ કોટિનાં છે કે જેઓ ભાણવા માટે આતુર છે અને જેમને પ્રગતિ પ્રત્યે પ્રેમ છે, તો તેણે તેની પોતાની શક્તિઓનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે તેમના વ્યક્તિગત આત્માની પસંદગીની દિશામાં વિકાસ કરવા માટે જરૂરી એવી સ્વતંત્રતા તેમને મળી રહે.

જૂની પદ્ધતિમાં વર્જીમાં બધા બેઠા હોય અને શિક્ષક આવીને સૌને એક જાતનું ભાણવે એ એક સરળ અને કરકસરવાળી પદ્ધતિ તો છે, પણ સાથે સાથે એ અત્યંત બિનઅસરકારક હોય છે અને એમાં સૌના સમયનો બગાડ થાય છે.

(૧૫ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

આપે લખેલું છે કે કાળજીપૂર્વકના અવલોકન પછી તેને (શિક્ષકને) એમ જાણાય કે તેને સોંપેલાં બાળકોમાંનાં બે કે જ્રાણ એવી વિશિષ્ટ કોટિનાં છે કે જેઓ ભાણવા માટે આતુર છે અને જેમને પ્રગતિ પ્રત્યે પ્રેમ છે, તો તેણે તેની પોતાની શક્તિઓનો ઉપયોગ એવી રીતે કરવો જોઈએ કે તેમના વ્યક્તિગત

આત્માની પસંદગીની દિશામાં વિકાસ કરવા માટે જરૂરી એવી સ્વતંત્રતા તેમને મળી રહે.

આપના કહેવાનો આશય એ છે કે, પસંદગીની સ્વતંત્રતા કેવળ અસાધારણ બાળકોને જ આપવી જોઈએ? — તો પછી બીજાંઓનું શું?

મેં અસાધારણ બાળકોને પસંદગીની સ્વતંત્રતા આપવાનું કહેલું કારણ કે જો આપણે તેમનો સંપૂર્ણ રીતનો વિકાસ થાય તેમ ઈચ્છતા હોઈએ તો એ વસ્તુ એમને માટે અનિવાર્ય બની રહે છે.

બેશક, પસંદગીની આ સ્વતંત્રતા બધાં જ બાળકોને આપી શકાય અને એકંદરે જોતાં, અમની પ્રકૃતિ ખરેખર કેવી છે તે જાણવાનો એ એક સારો માર્ગ છે; પરંતુ બનશે એવું કે એમાંનાં ઘણાંખરાં આળસુ પુરવાર થશે અને અભ્યાસમાં ખાસ રસ નહિ લે. પરંતુ એમ પણ બને કે તેઓ તેમના હસ્તકૌશલ્યનો ઉપયોગ કરીને ઘણી ઘણી વસ્તુઓની રચના કરવાનું શીખી શકશે. આ વસ્તુને પણ ઉતેજન આપવું. આ રીતે, બાળકો તેમનું સમાજમાંનું સાચું સ્થાન શોધી શકશે અને જ્યારે તેઓ મોટાં થશે ત્યારે તેમનો ફાળો આપવાને માટે તૈયાર હશે.

દરેક બાળકને એ વસ્તુ શીખવવી કે પોતે જે કાંઈ કરતાં હોય તેમાં તેમને મજા પડવી જોઈએ, એ કામ પછી બૌદ્ધિક હોય, કલાને લગતું હોય કે શારીરિક રીતનું હોય — અને સૌથી વધુ તે એ કે કામ કરવામાં ગર્વ અનુભવવો જોઈએ, — કામ ગમે તે હોય પણ જો એ કાળજી અને કુશળતાપૂર્વક કરેલું હોય તો એ ગર્વ લેવા લાયક વસ્તુ છે.

(૧૬ જાન્યુઆરી ૧૯૭૨)

“મધુર ભાતાજી,

અસાધારણ બાળકોની બાબતમાં આપ શું એમ વિચારો છોકે તેમનામાં રહેલી વિશિષ્ટ કુશળતા પ્રત્યે તેમની સર્વ શક્તિઓને વાળવી કે પછી તેમને સર્વાંગીણ વિકાસ પ્રત્યે દોરવી જોઈએ?”

એનો આધાર સર્વાંગીણ તે બાળક અને તેની ક્ષમતા ઉપર રહે છે.

(૧૮ જાન્યુઆરી ૧૯૭૨)

“મધુર ભાતાજી,

મેં એક વાર આપને પૂછેલું કે આપણે આપણા શિક્ષણના કાર્યક્રમમાં

આપણાં બાળકોને, આશ્રમને માટે કોઈ નિઃસ્વાર્થી કામ — કંઈ નહિ તો અઠવાડિયે એક દિવસ માટે — કરતાં શીખવવું કે કેમ. અને આપે જવાબ આપેલો કે, નિઃસ્વાર્થી કામ કરવું એ હુંમેશાં એક સારી વસ્તુ છે. પરંતુ આ વસ્તુ જે આનંદ દાયક રીતે કરવામાં આવે અને એ કોઈ કંટાળાજનક બોજારુપ ન હોય તો વધુ સારું.

તો આપ અમને સૂચ્યવી શકશો કે આ વસ્તુ અમે અમારા કાર્યક્રમમાં કઈ રીતે સમાવી શકીએ?

જો બાળકો તેમનાથી થઈ શકે તેવાં જુદાં જુદાં કાર્યો જુઓ તો તેમાંથી એક યા બીજું કોઈ કામ કરવાનું વલાણ તેમનામાં જાગ્રત થશે અને એ વસ્તુ તેમને માટે એક રમત જેવી રસપ્રદ બની રહેશે — જો તેઓ સાચી રીતે બુદ્ધિમાન હશે તો.

(૧૮ જાન્યુઆરી ૧૯૭૨)

“મધુર માતાજી,

આપે જ્યારે એમ કહેલું કે અમારે બાળકોની રમતનું અવલોકન કરવું તો તે સમયે કેટલી ઉમરનાં બાળકોનો ઘ્યાલ આપના મનમાં હુતો?”

એનો અર્થ સર્વાંશો તે બાળક ઉપર રહે છે. કેટલાંક બાળકો સાત વર્ષની ઉંમરે સભાન બની ગયાં હોય છે જ્યારે કેટલાંકને લાંબો સમય લાગે છે.

આમાં અગત્યની વસ્તુ એ છે કે બાળકોને પોતાની મેળે નિર્ણય કરવાની તક આપવી.

“માતાજી, સાતથી કેટલાં વર્ષ સુધી?”<sup>૧</sup>

આપણે અધાર વર્ષ કહી શકીએ. એનો આધાર દરેક દાખલા ઉપર રહે છે. કેટલાંક બાળકો ૧૪ કે ૧૫ વર્ષની ઉંમરે સંપૂર્ણપણે વિકાસ પામેલાં હોય છે. એ વસ્તુ દરેકને માટે જુદી હોય છે. એનો આધાર દરેક કેસ ઉપર રહે છે...

(૧૮ જાન્યુઆરી ૧૯૭૨)

૧. ૧૫મી જાન્યુઆરી ૧૯૭૨નો પત્ર.

૨. મૌખિક પ્રશ્નોત્તર.

**“મધુર માતાજી,**

આપે લખેલું છે કે શિક્ષકે તેના હસ્તકનું બાળક કયા પ્રકારનું છે તે શોધી કાઢવું જોઈએ અને એ માટે તેની ટેવો અને પ્રતિકાર્યોનું અવલોકન કરવું જોઈએ’. અમે બાળકો કયા પ્રકારનાં છે તે કેવી રીતે પારખી શકીએ?”

તેઓ કઈ રીતે જીવે છે તેનું નિરીક્ષણ કરીને.

બાળકોનું વર્ગીકરણ કરવા માટે શિક્ષકે તેમની ટેવો અને પ્રતિકાર્યોનું અવલોકન કરવું જોઈએ.

શિક્ષકે કેવળ પદાર્થ પાઠો રટનાર યંત્ર નહિ પરંતુ એક મનોવૈજ્ઞાનિક અને અવલોકનકાર પણ બનવું જોઈએ.

(૧૯ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

શું અમારે એક જ પ્રકારનાં બાળકોને એકસાથે રાખવાં જોઈએ?”

એના લાભ પણ છે અને ગેરલાભ પણ છે. આપણે બાળકોનાં ગ્રુપો ગોડવતી વેળાએ આપણને ઉપલબ્ધ સાધનો અને સગવડોનો ઘ્યાલ રાખવો જોઈએ. જે કોઈ વ્યવસ્થા ગોડવીએ તેમાં જરૂર પડ્યે ફેરફાર અને સુધારો થઈ શકે તેવી હોવી જોઈએ.

એક સારા શિક્ષક બનવા માટે અખૂટ ધીરજવાળા ગુરુ સરખી આંતરદૃષ્ટિ અને જ્ઞાન હોવાં જરૂરી છે.

(૧૯ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

આપે કહેલું છે કે શિક્ષકની પ્રથમ ફરજ બાળકને પોતાને વિષે જાણતાં શીખવવાની છે.

અમે બાળકને તેની જાતને ઓળખતાં કઈ રીતે શીખવી શકીએ? એમ થઈ શકે તેટલા માટે અમારી પોતાની ચેતના જ ઉચ્ચ કક્ષાએ પહુંચેલી હોય એ જરૂરી ખરું કે નહિ?

હા, જરૂર એમ જ!<sup>૧</sup>

શિક્ષકનું વલણ એવું હોવું જોઈએ કે પ્રગતિ કરવા માટે તેનામાં સતતપણે સંકલ્પ જાગ્રત હોય. આ વસ્તુ તેણે કેવળ એટલા માટે નથી કરવાની કે જેથી તે વિદ્યાર્થીઓને જે કાંઈ શીખવવાનું હોય તે હુંમેશાં સારી રીતે જાણો લે, પરંતુ સૌથી વધુ તો એટલા માટે કે એમ કરીને એ બીજાઓ માટે તેમણે જેવા બનવાનું છે તે માટેના એક જીવંત દાખલા રૂપ બની શકાય.

(પાંચ મિનિટના ધ્યાન બાદ) શિક્ષકે પોતે વિદ્યાર્થીઓને જેવા બનવાનું કહેતો હોય તેના જીવંત ઉદાહરણરૂપ બનવાનું છે.

(૧૮ જાન્યુઆરી ૧૯૭૨)

“મધુર માતાજી,

શું બાળકોને પોતાની જાત ઓળખતાં શીખવવા માટેનો આ એક માત્ર ઉપાય છે?<sup>૨</sup>”

એ જ ખરો રસ્તો છે. જુઓને, શિક્ષક તેનાં બાળકોને એમ કહેતો હોય કે “જૂઢું બોલવું નહિ” અને પોતે જ જૂઢું બોલતો હોય; કહેતો હોય કે “ગુસ્સો કરવો નહિ” અને પોતે જ ગુસ્સો કરતો હોય — તો પછી પરિણામ શું આવે? બાળકો તેમના શિક્ષક ઉપરથી નહિ પણ તે જે શીખવતો હશે તેની ઉપરથી પણ તે વિશ્વાસ ગુમાવી બેસશો...

“માતાજી,

આપ જે કાંઈ લખો છો તે હું દરરોજ ટાઈપ કરી લઉં છું અને બીજા શિક્ષકોને બતાવવા માટે ‘પ’ તેને શાળામાં લઈ જાય છે અને એ તેમને ઘણું ગમે છે. અને હવે કેટલાક શિક્ષકો તેમના પૂછવાના પ્રશ્નો મને આપે છે.”<sup>૩</sup>

(હસતાં) સરસ! ઘણું સરસ!

(૧૮ જાન્યુઆરી ૧૯૭૨)

૧. આટલું વાક્ય મૌખિક રીતે કહેલું.

૨. મૌખિક પ્રશ્નોત્તર.

**“મધુર માતાજી,**

અમે જ્યારે બાળકોને તેમની આગળ પડીને રસ લેવાની ક્ષમતા અનુસાર વગ્ાં પાડીને ગોઠવણી કરવા જઈએ છીએ ત્યારે અમે જોઈએ છીએ કે જુદા જુદા વિષયોની બાબતમાં તેમનામાં તેમની જ્ઞાનપ્રાપ્તિના અનેક સ્તરોનું મિશ્રણ હોય છે. આને લઈને જે શિક્ષકો જૂની અને જાણીતી રીતે વગ્ાં લેવાને ટેવાયેલા છે તેમને આ વિષયમાં ઘણી મુશ્કેલી પડે છે.”

આપણે અહીં મુશ્કેલ વસ્તુઓ કરવાને જ આવેલાં છીએ. જો બીજાઓ જે કરે છે તેનું આપણે પુનરાવર્તન જ કરવાનું હોય તો, એ વિષયમાં કશી મહેનત કરવા જેવું નથી કારણ કે જગતમાં પહેલેથી જ ઘણી ઘણી શાળાઓ છે.

લોકોની અંદર રહેલા અજ્ઞાનને દૂર કરવા માટે ઘણા મનુષ્યોએ સહેલામાં સહેલા લાગતા ઉપાયો યોજેલા છે. પરંતુ આપણે એ અવસ્થાને વટાવી ગયા છીએ અને માનવજીત વધુ સારી રીતે અને વધુ સંપૂર્ણ રીતે જ્ઞાન પામવાને તૈયાર છે. એટલે હવે જે લોકો આગલી હરોળમાં છે તેમની એ ફરજ છે કે તેમણે તેમને માર્ગદર્શન આપવું કે જેથી તેઓ તેનું અનુસરણ કરી શકે.

(૨૧ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

બાળકો પોતાની અંદર રહેલી ક્ષમતાઓને પારખે અને તેઓ પોતાની મેળે પોતાને વ્યક્તિગત વિકાસના માર્ગ આગળ વધે તે માટે આપણી શિક્ષણ પદ્ધતિના આયોજન વિષે આપના શા ખ્યાલો છે?”

આપણે અહીં એ જ વસ્તુ કરવા પ્રયત્ન કરીએ છીએ.<sup>૧</sup> એનો આધાર શિક્ષક ઉપર છે. મારી પાસે કાગળ ઉપર મૂકી શકાય તેવી કઈ યોજના નથી.

આપણે અહીં આ વસ્તુ કરવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ એ સારી રીતે થઈ શકે તેનો આધાર શિક્ષક ઉપર છે — એ કેટલી મહેનત લે છે અને એનામાં કેટલા અંશો મનોવૈજ્ઞાનિક સમજશક્તિ છે તેના ઉપર છે. શિક્ષકમાં તેના વિદ્યાર્થીનું ચારિન્ય અને શક્યતા પારખવાની આવહત હોયી જોઈએ જેથી કરીને એ તેના શિક્ષણને દરેક વ્યક્તિગત દાખલામાં બંધબેસતું કરી શકે.

(૨૨ જાન્યુઆરી ૧૯૭૨)

૧. આટલો ભાગ મૌખિક કહેવાયેલો.

**“મધુર માતાજી,**  
**આપણે શું શિક્ષકોનું તેમના વિષયો અનુસાર વર્ગીકરણ કરવું જોઈએ?”**

જ્યારે કોઈ ને કોઈ એક કે વધુ વિષયોનો ઊંડો અભ્યાસ કરવો હોય ત્યારે વિષયવાર વર્ગીકરણ અગત્યનું હોય છે. પરંતુ તે પહેલાં જો સૌને માટે ઉપયોગી એવું સર્વસામાન્ય જ્ઞાન સૌને સમાન રીતે એક પાયા રૂપે આપવામાં આવેલું હોવું જોઈએ : ઉ.ત. લખતાં-વાંચતાં આવડતું હોય, ઓછામાં ઓછી એક ભાષા સાચી રીતે બોલતાં આવડી ગઈ હોય, ભૂગોળનું થોડું સામાન્ય જ્ઞાન હોય, આધુનિક વિજ્ઞાનની સામાન્ય રૂપરેખા જાણવામાં હોય અને સમૂહમાં રહેવા માટેના જે થોડાક અનિવાર્ય નિયમો છે તેનું જ્ઞાન મળી ગયેલું હોય, ત્યારે એ પાયો પૂરો પે છે.

જ્યારે કોઈ વિષયનો વિગતવાર અને સાંગોપાંગ અભ્યાસ કરવાનો હોય ત્યારે બાળકની ઉંમર અને શીખવાની તેની ક્ષમતા ઉપર આધાર રહે છે.

આગળ પડતાં બાળકો એ વસ્તુ બાર વર્ષની ઉંમરે શરૂ કરી શકે છે. જો કે મોટા ભાગનાંને માટે પંદર, સતર કે અઠાર વર્ષની ઉંમર વધુ ઢીક પે છે.

અને જ્યારે કોઈ ને કોઈ વિષય ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરવું હોય, ખાસ કરીને જો એ વિષય વિજ્ઞાનને લગતો કે તત્ત્વજ્ઞાનને લગતો હોય તો તેણે પોતાની આખી જિંદગી સુધી શીખતા રહેવા તૈયાર હોવું જોઈએ : કદી પણ અભ્યાસ કરતાં અટકવું જોઈએ નહિં.

(૨૨ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**  
**હું ફરીથી એ જ પ્રશ્ન ઉભો કરું છું : ‘બાળકોના પ્રકારો’ શબ્દોથી આપ ચોક્કસ કહેવા માગો છે?**

અને આ પ્રકારો કેવળ તેમના ચારિત્યને લાગુ પે છે કે તેમના રસના અન્ય વિષયોને પણ લાગુ પે છે ?”

ચારિત્યના પ્રકારો.

કોઈ બાળકમાં રહેલી શક્યતાને માપવા માટે, કેવળ સામાન્ય નૈતિક ઝ્યાલો બહુ ખપમાં લાગતા નથી. કેટલાકના સ્વભાવ બંદખોર, શિસ્ત વિનાના અને જક્કી હોય છે પરંતુ એમની પાછળ જે કેટલાક ગુણો છુપાઈ રહેલા હોય છે તેમનો ઉપયોગ, કરવાનું કોઈ જાણતું નથી. આણસુ પ્રવૃત્તિની પાછળ પણ ધીરજ અને

શાંતિના ગુણો માટેની ભહાન શક્યતા હોઈ શકે છે. આ વસ્તુઓને શોધી કાઢવા અને જુદી જુદી પ્રકૃતિઓનો સર્વોત્તમ ઉપયોગ કરી શકે એટલા માટે વિદ્યાર્થીઓ કરતાં, શિક્ષકોએ વધુ સખત કામ કરવું જોઈએ.

(૨૩ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

ગઈ કાલે આપે વર્તણૂક અંગેના નિયમોનો ઉલ્લેખ કરેલો. આપણા સમૂહને માટે વર્તણૂકના કચા નિયમોને અનિવાર્ય ગણો છે?”

ધીરજ, ખંત, ઉદારતા, ખુલ્લાં મન, આંતરદૃષ્ટિ, શાંતિ, સમભાવપૂર્વકની દૃઢતા અને જ્યાં લગી તેના ઉપર સંપૂર્ણ પ્રભુત્વ પ્રાપ્ત ન થાય અથવા તેનો નાશ ન થાય ત્યાં સુધી અહુંકાર ઉપરનો કાબૂ.

**“મધુર માતાજી,**

મારા પૂછવાનો ભાવાર્થ બરાબર આ રીતને ન હતો. ‘વર્તણૂકના નિયમોનો’ અર્થ હું ‘રીતભાતના નિયમો’ એમ કરું છું.”

રીતભાતના નિયમો એ સામાન્ય જીવનના ભૌતિક નિયમોમાં આવી જાય છે અને આપણા દૃષ્ટિબિંદુથી જોતાં, તેમનું કશું જ મૂલ્ય નથી.

(૨૩ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

મેં બાળકોને તેમના ચારિત્યના પ્રકાર અનુસાર ગોઠવવાની વાત કરેલી છે. અમારી હુલાની અજ્ઞાન અવસ્થામાં જો અમે કોઈ વર્ગીકરણ લાદવા પ્રયત્ન કરીએ તો એ વસ્તુ વિકસતાં બાળકો સાથેની કોઈ મનસ્વી અને ભયજનક રમત સરખું નહિ બને?”

સ્વાભાવિક રીતે, કોઈ પ્રકારના મનસ્વી અને અજ્ઞાનમૂલક નિર્ણયો ન લેવા જોઈએ. એ વસ્તુ બાળકો માટે હાનિકારક નીવડશે.

મેં જે કહેલું છે તે એવા શિક્ષકો માટે કે જે ચારિત્યની પરખ કરીને તેમની ગુણવત્તા યોગ્ય રીતે માપી જાણો છે, નહિ તો પછી, આવું કાંઈ કરવાનું પરિણામ

સામાન્ય યંત્રવત્ત શિક્ષણા કરતાં ભયંકર અને નુકસાનકારક આવવા સંભવ છે.

(૨૪ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

આપ કહ્યો તે અમે કરીએ તેવી અપેક્ષા રાખો છો તે કરી શકાય તે માટે કોઈ ઉતાવળા અને મનસ્વી કાર્યો કરવાને બદલે શું અમારી શિક્ષકોની એ ફરજ નથી કે અમારે સધન અને સત્યનિષાપૂર્વક યોગસાધના કરવી જોઈએ?”

જરૂર!\*

મેં જે લખેલું છે તે તમારે સિદ્ધ કરવાના આદર્શરૂપ છે; તમે એ કરી શકો તે માટે તમારી જાતને તૈયાર કરવી જોઈએ.

આ પદ્ધતિ અપનાવવા માટે શિક્ષકમાં એક વિવેકપૂર્વકનું મનોવૈજ્ઞાનિક જ્ઞાન હોવું જોઈએ અને એ વસ્તુ સમય અને અનુભવ માર્ગી લે છે.

(૨૪ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

આપે કહેલું છે કે એક શિક્ષકે એક વિવેકશક્તિવાન મનોવૈજ્ઞાનિક, — ગુરુ — થવું જોઈએ. આપ સારી પેઠે જાણો છો કે અમે એ વસ્તુથી ઘણા દૂર છીએ. અત્યારે શિક્ષકો જે રીતના છે એ વસ્તુને લક્ષયાં રાખીને, અમારી શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવા માટે કચા પ્રકારની વ્યવસ્થા ગોડવવી જોઈએ?”

તેમનાથી બને તે કરીને — એવા જ્ઞાનપૂર્વક કે તેમને સર્વ કાંઈ શીખવાનું છે. આ રીતે કરવાથી તેમને અનુભવોને લાભ મળશે અને તેઓ વસ્તુઓને વધુ ને વધુ સારી રીતે કરી શકશે. શીખવા માટેનો આ એક ઉત્તમ માર્ગ છે અને જો તેઓ અંતરની સચ્ચાઈપૂર્વક બે ત્રાણ વર્ષ સુધી આ પ્રમાણે કર્યે જશે તો તે શ્રેષ્ઠ લાયકાતવાળા બની રહેશે. અને એ વસ્તુ ઘણી ઉપયોગી નીવડશે.

(૨૫ જાન્યુઆરી ૧૯૭૨)

\* આટલું મૌખિક રીતે કહેવાયેલું.

**“મધુર માતાજી,**

શું આપણી પાસે બાળકોની જે મ શિક્ષકોનું પણ વર્ગીકરણ હોવું જોઈએ?  
તેમની શીખવવાની રીત, દૃષ્ટિ અને અમુક વિષયો પ્રત્યેનો અનુરાગ લક્ષમાં  
રાખીને વર્ગીકરણ કરવું જોઈએ?”

આમ કરી શકાય તેટલા માટે જે શિક્ષક દ્વારા અભ્યાસનું આયોજન થતું હોય, તે  
એક વિવેકશક્તિવાન, અવલોકનકાર અને શુભેચ્છાપૂર્ણ વ્યક્તિ હોવી જોઈએ અને  
તોણે એ પણ લક્ષમાં રાખવું જોઈએ કે તોણે પોતે પણ શીખવાનું છે અને પ્રગતિ  
કરવાની છે.

સાચું વલણ એ છે કે સમગ્ર જીવનને એક એવું સાતત્યપૂર્ણ અભ્યાસનું ક્ષેત્ર  
ગણવું જોઈએ કે જ્યાં તમારે શીખવાનો અંત નથી અને જે કાંઈ જ્ઞાન પામવાનું છે  
તે પણ સંપૂર્ણપણે જાણી શકાય તેમ નથી. તમે હુંમેશાં વધુ શીખી શકો છો અને  
વધુ સારી રીતે સમજ પામી શકો છો.

(૨૫ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

જો બાળકો નવ વર્ષની ઉમરથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેકનોલોજીના  
ક્ષેત્રમાં પ્રાયોગિક કામ કરવા માગતાં હોય તો તેમને ઉતેજન આપવું  
જોઈએ?”

ઇં, જરૂર.

(૨૫ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

આ પ્રકારના કાર્યમાં, શિક્ષકે દરેકને માટે વ્યક્તિગત રીતનો સમય  
આપવો જોઈએ. પરંતુ શિક્ષકોની સંખ્યા ઘણી નાની છે. તો અમે સૌ કોઈની  
જરૂરિયાતને શક્ય તેટલી પૂર્ણ રીતે આદર આપવાનું અને સાથે જેઓ  
મદદ માગતા હોય તેમને સંતોષ આપવાનું કામ કરી રીતે કરી શકીએ?”

આમાં કોઈ થિયરી ન બનાવાય. દરેક વસ્તુ પ્રસંગ ઉપર, શક્યતાઓ ઉપર અને  
સંજોગો ઉપર આધાર રાખે છે. આમાં શિક્ષકે બને તેટલી સારી રીતનું વલણ રાખવું

અને શક્ય તેટલું ઉત્તમ ને ઉત્તમ કાર્ય કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

(૨૬ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

આપે એક દિવસ કહેલું કે કેટલાક શિક્ષકો જરૂરી ક્ષમતાવાળા નથી અને એમણે ભાગ્યાવવાનું બંધ કરવું જોઈએ. તો કોઈ શિક્ષકની ક્ષમતા માપવા માટે કચું ધોરણ હોઈ શકે?”

સૌ પ્રથમ તો આપણે શું કરવા માગીએ છીએ તે જાણીને સમજી લેવું જોઈએ. અને તે કઈ રીતે ઉત્તમ પ્રકારે થઈ શકે તે સમજી લેવું જોઈએ.

બીજું એ કે એનામાં એક એવી મનોવૈજ્ઞાનિક વિવેકબુદ્ધિ હોવી જોઈએ કે જેથી તે તેના વિદ્યાર્થીઓને સમજી શકે, તેમની ક્ષમતાઓ જાણી શકે અને એના પાયા ઉપર વ્યવહાર કરી શકે.

સ્વાભાવિક રીતે, એ પોતે જે વિષય શીખવતો હોય તે તો તેણે જાણી લેવો જોઈએ. જો એ ફેન્ચ શીખવતો હોય તો એને ફેન્ચ આવડતું હોવું જોઈએ. જો એ અંગ્રેજી, ભૂગોળ, વિજ્ઞાન શીખવતો હોય તો એ વિષયો તે જાણતો હોવો જોઈએ.

પરંતુ સૌથી અગત્યની વસ્તુ એ છે કે એનામાં એક મનોવૈજ્ઞાનિક વિવેકશક્તિ હોવી જાઈએ.\*

(૩૧ જાન્યુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

આજકાલ બહુરની શાળાઓમાં ખાસ કરીને પદ્ધિમમાં, ‘જાતીય શિક્ષણ’ને ઘણી અગત્ય આપવામાં આવે છે.”

‘જાતીય શિક્ષણ’ શું છે? એમાં એ લોકો શું શીખવે છે?

મને લાગેવળો છે ત્યાં સુધી, લોકોનું મન આ વિષયમાં ગૂંથાયેલું ન હોવું જોઈએ. મારા સમયમાં અમે કદ્દી પણ આ વિષયનું ચિંતન કરતાં ન હતાં. હવે બાળકો એના વિષે આખો સમય વાતો કરતાં રહે છે — એ વસ્તુ એમના મનમાં, લાગણીઓમાં છે. એ અત્યંત મુશ્કેલ વસ્તુ છે, ઘણી મુશ્કેલ.

પરંતુ જો તેઓ બીજે એ વિષયમાં વાત કરતા હોય તો આપણે અહીં પણ એ

\* મૌખિક ઉત્તર

વિષય ઉપર કહેવું જોઈએ. એમને આ વસ્તુઓનાં પરિણામો વિષે કહેવું જોઈએ. ખાસ કરીને છોકરીઓને કહેવું જોઈએ કે એનાં પરિણામો ભયંકર આવે તેમ છે. જ્યારે હું નાની હતી ત્યારે એ દિવસોમાં લોકો એ બધા વિષે વાતો કરતા નહિ, એ વસ્તુઓ પ્રત્યે ધ્યાન પણ આપતા નહિ. એ બધી વસ્તુઓ વિષે એ લોકો કોઈ વાતો કરતા નહિ. અહીં હું એ વિષયની ચર્ચા થાય તેમ ઈચ્છતી ન હતી. આટલા માટે તો આપણે શારીરિક વ્યાયામ કરીએ છીએ. એ રીતે, શક્તિઓનો ઉપયોગ બળ, સૌંદર્ય, કુશળતા, વગેરે ખીલવવામાં થાય છે અને તમારી અંદર સંયમની શક્તિ આવે છે. તમે જોશો કે જે લોકો ખૂબ પ્રમાણમાં શારીરિક વ્યાયામ કરે છે તેઓ તેમના આવેગો ઉપર ઘણી વધુ સારી રીતે સંયમ રાખી શકે છે.<sup>+</sup>

(ધ્યાન બાદ) મનુષ્યે જે શક્તિઓ બાળકો પેદા કરવામાં વપરાય છે અને જે એમના જીવનમાં આટલું બધું આગળ પડતું સ્થાન લે છે તેમને એથી ઊલટું, સૂક્ષ્મ બનાવીને પ્રગતિ અને ઉચ્ચતર વિકાસ માટે અને એક નવીન જીતિના આગમન માટે વાપરવી જોઈએ. પરંતુ સૌપ્રથમ તો ગ્રાણ અને શરીરમાંથી સર્વ પ્રકારની કામનાનો ત્યાગ થવો જોઈએ. નહિ તો પણી કોઈ ભયંકર પરિણામ આવી શકે છે.

(૧ ફેબ્રુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

નાનાં બાળકો અને મોટા વિદ્યાર્થીઓ (ઉ.ત. ચૌદ કે પંદર વર્ષની ઉપરના) પ્રત્યેના શિક્ષકના વર્તન અને જવાબદારીના વિષયમાં કચા પ્રકારનો તાત્ત્વિક ભેદ રહેલો છે?”

એ તો સ્વાભાવિક છે કે જેમ જેમ બાળકોમાં ચેતના અને બુદ્ધિનો વિકાસ થતો જાય તેમ તેમ એ તત્ત્વો દ્વારા જ આપણે તેમની સાથે વર્તન કરી શકીએ છીએ.

(૩ ફેબ્રુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

કોઈએ કોઈ બાળકને શિક્ષા કરવી જોઈએ?”

**શિક્ષા!** શિક્ષા શબ્દથી તમે શું કહેવા માગો છો? જો કોઈ બાળક વર્ગમાં કોલાહલ કરતું હોય અને બીજાઓના કામમાં વિક્ષેપ નાખતું હોય તો તમારે તેને યોગ્ય રીતે

+ ઉપરના પેરેગ્રાફ મૌખિક રીતે કહેવાયેલા.

વર્તવા કહેવું જોઈએ. અને તેમ છતાં તે અટકે નહિ, તો તેને વર્ગની બહાર મોકલી આપવું જોઈએ. આ કોઈ શિક્ષા નથી, આ તો તેના કર્મનું સ્વાભાવિક પરિણામ છે. પરંતુ શિક્ષા કરવી! શિક્ષા! શિક્ષા કરવાનો તમને કોઈ અધિકાર નથી. તમે શું પ્રભુ છો? શિક્ષા કરવાનો હક્ક તમને કોણે આપ્યો? તમારા કર્મો માટે, બાળકો પણ તમને શિક્ષા કરી શકે છો. તમે પોતે પણ શું પૂર્ણ છો? સારા-નઠારાનું તમને ભાન છે? કેવળ પ્રભુ જ જાણે છે. કેવળ પ્રભુને જ શિક્ષા કરવાનો અવિકાર છે.<sup>૧</sup>

તમે જેવાં આંદોલનો તમારામાંથી પ્રગટાવો છો, તેવાં જ આંદોલનોનો તમને સંપર્ક થાય છે. જો તમે નુકસાનકારક અને વિનાશકારી આંદોલનો પ્રગટાવતા હશો તો તેનાથી તમે એ જ પ્રકારનાં આંદોલનોને તમારી પ્રત્યે આકર્ષી લાવશો અને એ જ ખરી શિક્ષા છે (જો તમારે એ શબ્દ વાપરવો હોય તો). પરંતુ એને અને પ્રભુએ કરેલી દિવ્ય વસ્તુવ્યવસ્થા સાથે તેનો મેળ પડતો નથી.

દરેક કાર્ય, પછી તે સારું હોય કે ખરાબ, પણ તેવું પરિણામ તે લાવે છે. પરંતુ બદલાનો અને શિક્ષાનો ખ્યાલ કેવળ મનુષ્યનો ખ્યાલ છે અને ઝણા-ચેતનાના કાર્ય સાથે એનો કોઈ મેળ પડતો નથી. આ જગત ઉપર જે ચેતના રાજ્ય કરે છે તેણે જો શિક્ષા અને બદલાના મનુષ્યના ખ્યાલો પ્રમાણે કાર્ય કર્યું હોત તો ઘણા લાંબા કાળ સુધી આ પૃથ્વી ઉપર કોઈ મનુષ્યનું અસ્તિત્વ જ ન રહ્યું હોત.

જ્યારે મનુષ્ય એટલા પ્રમાણમાં શુદ્ધ બની રહેશે કે જ્યારે તે દિવ્ય આંદોલનોમાં વિકૃતિ લાવ્યા સિવાય, પોતામાંથી પ્રગટાવી શકશે ત્યારે જ આ પૃથ્વી ઉપરથી કષ્ટનો નાશ થશે. આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી.

(૩ ફેબ્રુઆરી ૧૯૭૨)

કેટલાક શિક્ષકોએ મને લખી જણાવ્યું છે કે મેં તમારે માટે જે લઘ્યું હતું તે તેમણે વાંચ્યું છે. અને એનાથી એમને ઘણો બધો ફાયદો થયો છે. એટલે તમે તેમને એ લખાણ બતાવતાં રહી શકો છો.<sup>૨</sup>

“અને આ પ્રાર્થના, માતાજી?”

હા, જો તમે એને કાગળ ઉપર ટાઇપ કરી રાખો તો :

૧. આ પેરેગ્રાફ મૌખિક ઉત્તર છે.

૨. ૧૪ મી ફેબ્રુઆરીનાં આ સર્વ લખાણો મૂળમાં મૌખિક હતાં.

“અમારે પ્રભુના સાચા સેવકો બનવું છે.”

અને પછી આ પ્રાર્થના :

“પરમ પ્રભુ સંપૂર્ણ ચૈતન્ય; કેવળ આપ જ એ વસ્તુ જાણો છો કે અમે શું કરી શકીએ તેમ છે, અમારી ઈચ્છા આપની સેવા કરવાની છે અને તેમ થઈ શકે તેવી ક્ષમતા, લાયકાત અમારામાં પ્રગટ થાય તે માટે અમારે કઈ રીતની પ્રગતિ કરવી જોઈએ તે પણ કેવળ આપ જ જાણો છો. અમારી ક્ષમતાઓ વિષે અમને સબળ બનાવો પરંતુ અમારી મુજ્કેલીઓ વિષે પણ એમ કરો કે જેથી અમે તેમનો પરાભવ કરી શકીએ અને આપની સેવા વફાદારીપૂર્વક કરી શકીએ.”

અને પછી અંતે આ:

પ્રભુના સાચા સેવકો થવામાં જ પરમ સુખ રહેલું છે.

કેટલાક લોકોને આનાથી સહાય મળે છે. તમે તેમને તમારી નોંધપોથી બતાવી છે?

“મારી આ (ધ્યાનની) નોંધપોથી કોઈને બતાવતી નથી, હું કેળવણી વિષયક પ્રશ્નોને બીજી નોંધપોથીમાં ટાઈપ કરી લઈ છું અને શાળામાં તેમને આપું છું પરંતુ આ નોંધપોથી સૌ કોઈને બતાવવાની નથી.”

ના, આ તે તમારા માટે છે. પરંતુ આવી સૌને માટેની હોય તેવી વસ્તુઓની તમે નકલ કરી લઈ શકો છો અને જે કોઈનામાં શુભ ભાવના હોય તેમને બતાવી શકો છો. મને ઘણાના એવા પત્રો મહ્યા છે કે એમને એથી ઘણો લાભ થયો છે. એટલે તમે એમ કરવાનું ચાલુ રાખી શકો છો.

“ભલે, માતાજી, હું આ નોંધપોથી કોઈને બતાવતી નથી કારણ કે મને એમ લાગતું હતું કે આપ કદાચ તરત જ એનો ઉપયોગ બુલેટિન માટે કરવા માગતા હતા.”

ના, બધી સામગ્રી તો નહિ, ઉ. ત. હું આ વસ્તુને બુલેટિનમાં ન મુક્કું.

(૧૪ ફેબ્રુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

આપે શાળા માટે જે પ્રકારના વર્ગીકરણનો ઉદ્દેશ કરેલો છે એવાં જ  
વર્ગીકરણ શારીરિક શિક્ષણમાં હોવાં જોઈએ?”

શારીરિક શિક્ષણની બાબતમાં તો એવું છે કે એનો આધાર શરીર અને તેની શક્તિઓ ઉપર રહે છે. જે સાદી કસરતોથી થાક ન લાગે તેવી હોય, તે સર્વને માટે અપનાવી શકાય.

પછીની વાત તો શરીર, તેની શક્તિ, તેની તંદુરસ્તી, થાક ખમી શકવાની ક્ષમતા, વગેરે, વગેરે ઉપર આધાર રાખે છે.

શરીરની ક્ષમતા જોઈને કસરતો કરાવવી જોઈએ. બાળકોનું વર્ગીકરણ પણ આ પ્રકારની ક્ષમતાઓને આધારે કરવું જોઈએ. આ વસ્તુમાં અનુભવ અને અવલોકન કામ લાગે છે.

શારીરિક શિક્ષણની સારી રીતની તાલીમ આપનાર થવા માટે, તમારામાં શરીરતંત્રનું, તેનાં અવયવોનાં કાર્યોનું, તેમના વિકાસ વિષેનું અને તેમનાં કાર્યો વિષેનું જ્ઞાન હોવું જરૂરી છે.

(૧૬ ફેબ્રુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

શિસ્તપાલન વિષે અમારે માટે આપ કંઈ લખી શકશો?”

ભૌતિક જીવન માટે શિસ્ત એ અનિવાર્ય વસ્તુ છે. શરીરના અવયવો યોઝ રીતે હુલનચલન કરે છે તેની પાછળ એક પ્રકારની શિસ્ત રહેલી હોય છે. શરીર જ્યારે બીમાર પડે છે ત્યારે કોઈ અવયવ કે શરીરનો ભાગ, સમગ્ર દેહતંત્રની શિસ્તનું પાલન કરતો નથી હોતો ત્યારે જ એમ બને છે.

પ્રગતિ માટે પણ શિસ્ત એક અનિવાર્ય વસ્તુ છે. વ્યક્તિ જ્યારે પોતાને માટે એક કઠોર અને સમજદાર શિસ્તપાલન અપનાવે છે ત્યારે તે, બીજાઓ દ્વારા લાદવામાં આવતી શિસ્તથી મુક્ત બને છે.

સૌથી પરમ શિસ્ત તો ગ્રભુ પ્રત્યેના સર્વાંગીણ સમર્પણમાં રહેલી છે. એની આડે પોતાની કોઈ લાગાડીઓ કે કર્માને આવવા દેવાં જોઈએ નહિ, આ સમર્પણમાંથી કશું બાકી રાખવું જોઈએ નહિ — એ જ એક પરમ અને સૌથી કઠોર શિસ્તપાલન છે.

(૧૭ ફેબ્રુઆરી ૧૯૭૨)

**“મધુર માતાજી,**

ગઈ કાલે આપે શિસ્ત વિષે લખેલું. પરંતુ સામાજિક જીવનમાં જે શિસ્ત અમારી ઉપર લાદવામાં આવેલી હોય છે તેની પ્રત્યે અમારું વલાણ કર્યા પ્રકારનું હોવું જોઈએ?”

સામાજિક જીવનમાં શિસ્તપાલન અનિવાર્ય છે કે જેથી કરીને દુર્બળ લોકો ઉપર બળવાન લોકો દમદારી ન વાપરે અને સમાજમાં રહેવા ઈચ્છતા સર્વ લોકોએ તેનું માનપૂર્વક પાલન કરવું જોઈએ.

પરંતુ જો સમાજને સુખી કરવો હોય તો આ શિસ્તનાં ધોરણોની રચના, વિશાળ મનવાળા મનુષ્ય કે મનુષ્યો દ્વારા થવી જોઈએ — બની શકે તો આવા લોકો પ્રભુની હાજરી વિષે સભાન હોવા જોઈએ અને તેમને તેઓ સમર્પિત હોવા જોઈએ.

જો દુનિયાને સુખી કરવી હોય તો, સત્તા એવા લોકોના હાથમાં હોવી જોઈએ, જે લોકો પ્રભુના સંકલ્પ વિષે સભાન હોય પરંતુ અત્યારે તો એ વસ્તુ અશક્ય છે, કારણ કે પ્રભુના સંકલ્પ વિષે “સાચી” રીતે સભાન હોય તેવા મનુષ્યોની સંઘ્યા અદ્ય છે અને વળી એ લોકોમાં કોઈ પ્રકારની મહત્વાકંશા સ્વાભાવિક રીતે જ નથી હોતી..

પરંતુ આ વસ્તુ સિદ્ધ થવાની ઘડી આવી પહોંચશે ત્યારે એ તદ્દન સ્વાભાવિકપણે બની આવશે.

આથી સૌ કોઈની એ ફરજ છે કે એને માટે પોતે પોતાની જાતને શક્ય તેટલી પૂર્ણ રીતે તૈયાર રાખે.

(૧૮ ફેબ્રુઆરી ૧૯૭૨)

**“માતાજી,**

ધારણા લોકો એ વસ્તુની ટીકા કરે છે કે આપણા શારીરિક શિક્ષણના કાર્યક્રમમાં આપણે વધુ પડતા નિયમો રાખેલા છે અને આપણે બાળકો ઉપર વધુ પડતી શિસ્ત લાદીએ છીએ.”

શિસ્ત વિનાની કોઈ શારીરિક કેળવાણી ન હોઈ શકે. જો કડક શિસ્ત ન હોય તો શરીર પણ યોગ્ય પ્રકારે કાર્ય ન કરી શકે. ખરું જોતાં તો માંદગી આવવા પાછળ, શિસ્તપાલનની અનિવાર્યતાની હકીકતનો અસ્વીકાર જ રહેલો હોય છે.

પાચન, વિકાસ, રુધિરનું ભ્રમણ, વગેરે વસ્તુઓ શિસ્તને આધીન છે. વિચારો, હળનચલન, ભાવપ્રદર્શન, એ સર્વમાં શિસ્ત રહેલી હોય છે. અને જો શિસ્ત નથી હોતી તો તરત જ માંદગી આવે છે<sup>૧</sup>

(૧૮ ફેબ્રુઆરી ૧૯૭૨)

“મધુર માતાજી,

વિદ્યાર્થીઓ, ખાસ કરીને કિશોરાવસ્થાના વિદ્યાર્થીઓ, ઘણી વાર એવી ફરિયાદ કરે છે કે તેમને ન ગમતી હોય એવી કસરતો પણ તેમણે કરવી પડે છે. આપ આનો જવાબ આપશો?”

આપણો આ પૃથ્વી ઉપર આપણા સ્વધંદને પોષવા નહિ પરંતુ પ્રગતિ કરવા માટે છે.

શારીરિક કસરતો કોઈ મજાક ખાતર કે પોતાના તરંગોને પોષવા માટે કરવામાં આવતી નથી, પરંતુ તેની પાછળ એવો હેતુ રાખેલો છે કે એક પદ્ધતિસરની શિસ્ત અપનાવી શરીરનો વિકાસ અને સુદૃઢતા સિદ્ધ કરવાં.

સાચું ડાખાપણ એ છે કે પોતે જે કાંઈ કરતાં હોઈએ તેમાંથી આનંદ પ્રાપ્ત કરો અને એમ કરવું ત્યારે જ શક્ય બને છે કે જ્યારે આપણે એવી દરેક વસ્તુને પોતાની પ્રગતિના એક સાધનરૂપ ગણતાં હોઈએ.

“સુખની શોધ એ પોતાની જાતને દુઃખી કરવાનો સર્વોત્તમ માર્ગ છે.”

જો તમારે શાંતિ અને સુખ જોઈતાં હોય તો તમારું ધ્યાન હુંમેશાં આ વસ્તુ ઉપર હોવું જોઈએ.

“પ્રભુને જાણવા અને પામવા માટે મારે કયા પ્રકારની પ્રગતિ કરવી જોઈએ ?”<sup>૨</sup>

આ વસ્તુ ‘થ’ને બતાવજો. એણે બાળકોના કથનને લક્ષ્યમાં લેવું જોઈતું ન હતું. એ અહીં ઘણા સમયથી રહેલી છે. અને આ વાતની જાણ રહેવી જોઈએ.

“સુખની શોધ એ પોતાની જાતને દુઃખી કરવાનો સર્વોત્તમ માર્ગ છે”. એ એક નિર્ભેદ સત્ય છે. એનાથી એ વસ્તુ પ્રસ્થાપિત થાય છે કે જો તમે, તમારા ક્ષુદ્ર અહુંકારને પોષવા માગતા હશો તો ખાતરી રાખજો કે તમે દુઃખી થવાના જ. સાચે

૧. આટલો ફકરો મૌખિક રીતે કહેવાયેલો.

૨. આ પ્રશ્ન અને ઉત્તર લેખિત સ્વરૂપમાં હતા. આ પછીનું વિવરણ મૌખિક હતું.

જ! પોતાને દુઃખી કરવાનો એ સારામાં સારો માર્ગ છે. આમ કહો કે ‘આહ, આ તો કંટાળો આપે છે; ઓહ, મારા મને ગમે તે કરવું જોઈએ; ઓહ, પેલો માણસ મારા પ્રત્યે સારી રીતે વર્તતો નથી; ઓહ મારે જે જોઈએ છે તે વસ્તુ જીવનમાંથી ભળતી નથી,’ છટ!!!

“મારે જેવા થવું જોઈએ તેવો હું છું?

“મારે કરવું જોઈએ તે કરું છું?

“મારે જેટલી પ્રગતિ કરવી જોઈએ તેટલી પ્રગતિ કરું છું?”

આમ કરો તો કંઈક રસપ્રદ વસ્તુ બને.

“મારે આગળ પ્રગતિ કરવા માટે શું કરવું જોઈએ? મારે કઈ ખોડ મટાડવી જોઈએ? મારી કઈ ખામીઓ મારે સુધારી લેવી જોઈએ? મારે મારી કઈ નિર્બળતાનો ત્યાગ કરવો જોઈએ?”

અને પછી, સ્વાભાવિક રીતે, બીજી ક્ષાળે, “હું કઈ રીતે પ્રભુને સમજવા અને તેમની સેવા કરવાને શક્તિમાન બની શકું?”

આ વસ્તુ લખી રાખી છે કે જેથી તમે તે “ક” ને બતાવી શકો.

“બારાબર છે. માતાજી એ જાણો છે તો ખરી, પરંતુ આ વસ્તુ બાળકોને કઈ રીતે સમજાવવી તે એને જાણવું છે.”

હા, આટલું જ કહેવાનું છે.

(૧૮ ફેબ્રુઆરી ૧૯૭૨)

\*

## એક મોનિટરને ઉત્તરો

“આપણી અહીંની પ્રવૃત્તિઓ એટલી બધી વૈવિધ્યપૂર્ણ છે કે એમાંથી કોઈ એકને વળગી રહીને એની અંદર પૂર્ણતા લાવવી મુશ્કેલ છે, કદાચ એટલા કારણે જ અમે એક સામાન્ય કક્ષા કરતાં વધુ આગળ જઈ શકતા નથી કે પછી એમ છે કે અમારામાં એક મજબૂત એકાગ્રતાનો અભાવ છે?”

સામાન્ય કક્ષાના કારણમાં પ્રવૃત્તિઓની વિવિધતા કે સંખ્યાનું કોઈ કારણ નથી. પરંતુ એકાગ્રતાનો શક્તિનો અભાવ જ કારણભૂત છે.

તમારે એકાગ્રતા કરતાં શીખવું જોઈએ અને સર્વ વસ્તુઓ સંપૂર્ણ એકાગ્રતાપૂર્વક કરવી જોઈએ.

(૪ જુલાઈ ૧૯૬૧)

“આ એક મોટો પ્રશ્ન છે કે વિદ્યાર્થીઓમાં રસ કઈ રીતે જાગ્રત કરવો — પછી તે રમતગમતોમાં હોય, પહેલવાનીમાં હોય, કે વ્યાયામની બાબતમાં હોય. જ્યારે તેમનામાં રસહીનતા જોઈએ છે ત્યારે અમારો ઉત્સાહ પણ ઓસરવા માಡે છે.”

વિદ્યાર્થીઓનો રસ, શિક્ષકની સાચી ક્ષમતાના પ્રમાણમાં હોય છે.

(૧૨ જુલાઈ ૧૯૬૧)

(શારીરિક શિક્ષણ આપનાર કેંપનોને આપેલા એક સંદેશને અનુલભીનેઃ)  
“હું આપ અમારી પાસે જેની અપેક્ષા રાખો છો તેનાથી ઘણા દૂર છીએ. ઓછામાં ઓછો હું તો છું જ. એ એક કષ્ટાયી કાર્ય છે અને એમાં સમય લાગશે, લાંબો સમય જશો, પણ અત્યારે હું શું કરવું? ચેતનાનું પરિવર્તન કરીને ભડક વ્યક્તિ થવામાં ઘણોબધો સમય જશો. અત્યારે તો અમે વિદ્યાર્થી ઓના સ્તરે જ છીએ, એટલે તાત્કાલિક ઉકેલ હુથ લાગતો નથી. અમે હુરરોજ અને હરેક વસ્તુમાં તેમનો રસ કઈ રીતે જાગ્રત કરી શકીએ?”

આ વસ્તુ તો રૂપાંતર સાધીને ભદ્ર વ્યક્તિ થવા કરતાં પણ વધુ અશક્ય છે. એટલે સારામાં સારી વસ્તુ એ છે કે તરત જ કામે લાગી જવું. બાકીનું બીજું બધું તમારામાં રહેલી આળસે ઊભાં કરેલાં બહાનાં માત્ર છે.

(૧૫ જુલાઈ ૧૯૬૧)

“અમે ઘણી વાર ચૈત્ય સ્વરૂપ અને આત્માની વાત કરીએ છીએ પણ હું એમના વિશે કશું પણ સમજતો નથી. આ બે વસ્તુઓ શું છે અને અમે આપને કઈ રીતે અનુભવી શકીએ?”

શ્રી અરવિંદે (તેમના પત્રોમાં) આ વિષય ઉપર ઘણું ઘણું લખેલું છે અને મેં પોતે પણ ‘કેળવણી’ પુસ્તકમાં એ વિષે બધું સમજાવેલું છે. તમારે તે વાંચવું જોઈએ, અભ્યાસ કરવો જોઈએ અને સૌથી વધુ તો અમલમાં મૂકવું જોઈએ,

(૪ ઓક્ટોબર ૧૯૬૧)

હું ઈચ્છણું છું કે તમે ધ્યાનપૂર્વક તમારું આત્મનિરીક્ષણ કરો અને મને સમજાવો કે આ ડિટેક્ટિવ વાર્તાઓમાં તમને કઈ વસ્તુ આનંદ આપે છે?

(૧૬ ઓક્ટોબર ૧૯૬૧)

“હું એ પુસ્તકો આરામ ખાતર વાંચ્યું છું. ડિટેક્ટિવ વાર્તાઓમાં (ખાસ કરીને પેરી મેસનમાં) હુંમેશાં એક કોર્ટ-રૂમનું દૃશ્ય આવે છે જેમાં પેરી મેસન, વકીલ તરીકે તેનો કેસ હારી જાય તેવું હોય છે, એના અસીલ ઉપર ખૂનનો આરોપ હોય છે, બધા જ પુરાવા એની વિરુદ્ધમાં હોય છે, પણ પેરી મેસન વકીલ તરીકે એક એવી ઉત્તમ કુશળતા બતાવે છે કે આખી પરિસ્થિતિ ફેરવાઈ જાય છે. આખી વાર્તા રહુસ્યોભરી હોય છે અને કોર્ટમાં કેસ એક ઉત્તમ, માનસિક પહેલવાનની કુશળતાના પ્રદર્શન જેવો હોય છે. પરંતુ દરેક વખતે, જ્યારે હું પુસ્તક પૂરું કરું છું ત્યારે મને લાગે છે કે મને કશું જાણવા મળ્યું નથી, કશું નવું જાણ્યું નથી, અને સમયનો દુર્વ્યય થયો છે.”

એ તદ્દન નકામું તો નથી. નિઃશંકપણે તમારા મગજમાં ખૂબ ગ્રામાણમાં તમસ છે અને લેખકની મનોમય બાળગરી તમારા તમસને જરા ક્ષુદ્ધ કરે છે અને મનને

જાગ્રત કરે છે. પરંતુ આવું લાંબો સમય ટકી રહે નહિ એટલે તમારે સત્તવરે ઊર્ધ્વતર વસ્તુઓ પ્રત્યે વળવું જોઈએ.

(૧૬ ઓક્ટોબર ૧૯૬૧)

**“મધુર માતાજી,**

અમને સૌને લાગુ પડે એવી એક વસ્તુ મારી નજરે પડી છે : એમાં અમે બીજુ ડિસેમ્બરના\* કાર્યક્રમ માટે, શક્ય તેટલી વધુ પ્રકારની પ્રવૃત્તિઓમાં ભાગ લઈએ છીએ. શું એ વધુ સારું નહિ કે અમે એક કે બે પ્રવૃત્તિઓ પસંદ કરીને એમાં જ સૌથી ઉત્તમ દેખાવ કરીએકે જેથી અનેક પ્રવૃત્તિઓમાં તદ્દન મધ્યમ કષ્ટાનો દેખાવ ન થાય?”

દરેક વ્યક્તિ તેની પ્રકૃતિને આધીન પ્રવૃત્તિ કરે છે અને જો એ પોતાની પ્રકૃતિના નિયમને હિંમત અને સત્ત્યનિષ્ઠાપૂર્વક અનુસરે છે તો એ સત્ત્યને અનુસરે છે. એટલે આમાં બીજાઓની તુલના કરીને નિયાય કરવો શક્ય નથી. વ્યક્તિ કેવળ પોતાને જ સમજ શકે અને તેમાં પણ તે પોતાની જાતને છેતરે નહિ તે માટે ખૂબ જ સત્ત્યનિષ્ઠા હોવી જોઈએ.

(૪ નવેમ્બર ૧૯૬૧)

**“મધુર માતાજી,**

આપે ઘણી વાર અમને કહેલું છે કે અમારી પ્રવૃત્તિઓ પ્રભુને સમર્પણ રૂપે હોવી જોઈએ. આનો બરાબર અર્થ શું છે અને એ કઈ રીતે કરવું? ઉ.ત. અમે ટેનિસ કે બાસકેટ બોલ રમતા હોઈએ તો એ વસ્તુઓ પ્રભુને સમર્પણ તરીકે કઈ રીતે થઈ શકે? સ્વાભાવિક રીતે આમાં મનની રચનાઓ પૂરતી નથી!”

એનો અર્થ એ છે કે તમે જે કાંઈ કરતા હો તેની પાછળ કોઈ વ્યક્તિગત હેતુ ન હોવો જોઈએ. અહુમૂલક હેતુ ન હોવો જોઈએ. વિજય, મહત્ત્વ, લાભ, ભૌતિક લાભ કે ગર્વને પોષવા માટે નહિ પણ એક સેવા અને ‘અર્પણ તરીકે, પ્રભુના સંકલ્પ’ વિષે વધુ પ્રમાણમાં સભાન બનવા માટે, અને પોતાને સર્વાશો એમાં ઓતપ્રોત કરી દેવા માટે એ કાર્ય કરવું જોઈએ અને આ પ્રમાણે ત્યાં સુધી કર્યે જવું જ્યાં સુધી તમે

\* શારીરિક શિક્ષાણો વાર્ષિક ઉત્સવ

એટલે અંશે આગળ વધો કે તમને અનુભવ અને લાગણી થાય છે કે કેવળ પ્રભુ જ તમારામાં કાર્ય કરે છે, એમની શક્તિ જ તમને ગતિમાન કરે છે અને એમનો જ સંકલ્પ તમને ટેકો આપે છે — આ વસ્તુ કોઈ મનોમય જ્ઞાનરૂપ નહિ પણ ચેતનાની અને શક્તિની એક સાચી અનુભૂતિરૂપ બની રહેવું જોઈએ.

આમ બનવું ત્યારે જ શક્ય બને જ્યારે સર્વ પ્રકારના અહંમૂલક હેતુઓ અને અહંભાવભર્યા પ્રતિકાર્યો અદૃષ્ટ થઈ જાય.

(૨૦ નવેમ્બર ૧૯૬૧)

**“મધુર માતાજી,**

આ બાબતમાં અમારા મિત્રોમાં આ પ્રશ્ન વિષે અને શારીરિક શિક્ષણની શક્ય પદ્ધતિઓ વિષે ચર્ચા થયેલી. આમાં પાયાનો સવાલ આ છે : એવો કાર્યક્રમ કઈ રીતે ગોઠવવો કે જે સૌને ગમે અને સામાન્ય રીતે સર્વે ભાગ લેનારાઓ માટે અસરકારક બને? આ માટે હુરીફાઈઓની જરૂર ખરી? અમારે કશી ફરજ ન પાડવી? અને જો આ સંબંધમાં સંપૂર્ણ સ્વતંત્રતા અપાય તો આમ કરવું શક્ય બને? વગેરે... આ એક એવો વિષય છે જેમાં સૌને પૂરતો સંતોષ થાય તેવો ઉકેલ શોધી કાઢવો સહેલું નથી — સિવાય કે જ્યારે માતાજી પોતે જ એમાં વચ્ચેમાં પડે.”

એમ થવું શક્ય નથી. સૌને પોતાની આગવી રસવૃત્તિ અને સ્વ-ભાવ હોય છે. શિસ્ત વિના કોઈથી કશું થાય નહિ — આખું જીવન જ શિસ્તરૂપ છે.

(૨૦ સપ્ટેમ્બર ૧૯૬૨)

**“આપણા શરીરિક શિક્ષણના કાર્યક્રમ અને આપણી પ્રવૃત્તિઓ વિષે એક મિત્ર સાથે અમારે ચર્ચા થયેલી અને તેણે પૂછેલું કે આટલી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે અને છતાં ટીક ટીક પ્રમાણમાં ઉચ્ચ ધોરણ જીળવી શકી હોય તેવી એકાદ વ્યક્તિ — આખા જગતમાંથી એકાદ વ્યક્તિ પણ બતાવી શકશો?”**

એ વસ્તુ ભૂલશો નહિ કે આપણો જે બધાં અહીં છીએ તે એક એવી વસ્તુ સિદ્ધ કરવા પ્રયત્ન કરીએ છીએ કે જે હજુ પૃથ્વી ઉપર બીજે ક્યાંય અસ્તિત્વમાં નથી; એટલે આપણો જે વસ્તુ કરવા માગીએ છીએ તેનો દાખલો બીજે ક્યાંય ખોળવા

જવું બેહૂંદું છે.

“એણે મને એમ પણ કહેલું કે, શ્રી માતાજી એમ કહે છે કે કોઈનામાં અમુક વિષયની કુદરતી બિશિષ્ટ હોય તેને માટે એ વિષયમાં પૂર્ણપણે આગળ વધવા માટે સર્વ પ્રકારની સ્વતંત્રતા છે. પણ આવી સ્વતંત્રતા કયાં છે? ઉ.ત. કોઈ સંગીતકાર માટે, વગેરે? મધુર માતાજી, આપ આ સ્વતંત્રતા વિષયમાં યોડા શર્દો કહેશો?”

હું જે સ્વતંત્રતાની વાત કરું છું તે સ્વતંત્રતા, આત્માના સંકલ્પને અનુસરવાની બાબતમાં છે, મન કે ગ્રાણની કલ્પનાઓ કે તરંગો નહિં.

હું જે સ્વતંત્રતાની વાત કરું છું તે એક એવા નિર્ભેણ સત્યની છે કે જે, નિમ્ન અને અજ્ઞાનમય સ્વરૂપની સર્વ પ્રકારની નિર્ભળતાઓની ઉપરવટ થઈ શકે.

હું જે સ્વતંત્રતાની વાત કરું છું તે એક એવી સ્વતંત્રતા છે જેમાં તમે સર્વારો પોતાની જાતને હોમી દઈ શકો, અને કશું પણ બાકી રાખ્યા વિના પોતાની ઉચ્ચતમ, ઉમદા અને સર્વોત્તમ દિવ્ય અભીપ્સા સિદ્ધ કરવામાં જ લાગી જાઓ.

તમારામાંથી કોણ આ માર્ગ સર્ચાઈપૂર્વક આવે છે? આમાં તુલના કરવી સહેલી છે, પણ સમજવું મુશ્કેલ છે અને અનુસરણ કરવું સૌથી વધુ અધરું છે.

(૧૮ નવેમ્બર ૧૯૬૨)

“છોકરીઓને હુંમેશાં અમુક ગેરલાભ રહે છે; તેઓ છોકરાઓની માફક ધારે તેમ કરી શકે નહિં.”

કેમ નહિં ?

આથી વિરુદ્ધના સેંકડો પુરાવા છે.

(૩૧ મે ૧૯૬૩)

“મારા મગજમાં એવો ઘણો અંધારગ્રસ્ત મસાલો છે જેને લઈને હું સ્પષ્ટપણે વિચારી શકતો નથી અને નવા વિચારોને તરત જ ગ્રહણ કરી શકતો નથી. હું આમાંથી કઈ રીતે મુક્ત થઈ શકું?”

ખૂબ અભ્યાસ કરીને, ખૂબ વિચાર કરીને બૌદ્ધિક વ્યાયામ કરીને. ઉ.ત. ગમે તે કોઈ

એક વિચારની સ્પષ્ટ વ્યાખ્યા કરો અને પછી એની વિરુદ્ધનો વિચાર ઉભો કરો, એ બંને વિચારોનું સામંજસ્ય શોધો એટલે કે એવો ત્રીજો વિચાર શોધો જેમાં પેલા બંને વિચારોનું સામંજસ્ય હોય.

(૨૫ જૂન ૧૯૬૩)

તમે નવલકથાઓ કેમ વાંચો છે? એ એક મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિ છે અને એમાં સમયનો બગાડ થાય છે. તમારું મગજ સ્પષ્ટ ન હોવાનું અને હજુ પણ ગ્રંચવાડામાં રહેલું હોવાનું એ પણ એક કારણ છે એ સ્પષ્ટ છે.

(૨૭ જૂન ૧૯૬૩)

**“મધુર માતાજી,**

થોડા દિવસ અગાઉ મેં ગ્રૂપ અ-૨ નાં બાળકોમાં એક અત્યંત વિચિત્ર વસ્તુ જોઈ : છોકરાઓને છોકરીઓ સાથે કામ કરવું નથી; એમને એમની સાથે કે સોબતમાં પણ રહેવું નથી. આવો બેદભાવનો ઘ્યાલ આવાં નાનાં બાળકોમાં કઈ રીતે આવ્યો? હજુ તો તેઓ માંડ અગિયાર વર્ષનાં છે!

**વિચિત્ર વાત છે.”**

આ વસ્તુ વંશવારસામાંથી અને અવચેતનામાંથી આવે છે.

આ જડવૃત્તિ, પુરુષત્વના ગર્વ ઉપર, ઉચ્ચતાના મૂર્ખાઈભર્યા ઘ્યાલમાંથી, અને વધુ તો એવી મૂર્ખામીભરી બીકમાંથી આવે છે કે ક્રી એ એક ભયંકર વસ્તુ છે અને એ આપણને નર્કમાં ઘેંચી જાય છે. બાળકોમાં આ વસ્તુ જો કે અર્ધજાગ્રત હોય છે પરંતુ એની એમનાં કાર્યો ઉપર અસર થાય છે.

(૩ જુલાઈ ૧૯૬૩)

**“મધુર માતાજી,**

આપે સમજાવ્યું કે છોકરીઓ અને છોકરાઓ વરચેનો આ બેદભાવ વારસાગત છે છતાં એ પૂછવું પડે છે કે અમારે કેપ્ટનોએ શું કરવું? વ્યક્તિગત રીતે હું તો એ વસ્તુ પ્રત્યે દુર્લક્ષ સેવવા માગું છું, પણ બીજાઓ સલાહ આપવાનું કે ધમકાવવાનું પણ પસંદ કરે છે. મને લાગે છે કે દુર્લક્ષ સેવવાથી આ પ્રશ્નને વધુ પડતું મહુત્વ નહિં મળે અને છોકરા અને છોકરીઓ વરચેનો બેદભાવ ઉગ્ર નહિં બને. આપ શું ધારો છો?”

આમાં કશો સર્વસામાન્ય નિયમ ન બનાવાય, દરેક વસ્તુ વ્યક્તિ અને સંજોગો ઉપર આધાર રાખે છે. બંને પદ્ધતિમાં સારાં અને ખોટાં તત્ત્વો છે, લાભ અને ગેરલાભ છે. કેટનો માટે, મુખ્ય વસ્તુ એ છે કે તેમનામાં કણથી કામ લેવાની શક્તિ હોવી જોઈએ, પૂરતા પ્રમાણમાં આંતર્દૃષ્ટિ ખોલેલી હોવી જોઈએ કે જેથી જ્યારે વચ્ચેમાં પડવું પડે ત્યારે તેમ થાય અને જ્યારે આંખ આડા કાન કરવા જેવું હોય ત્યારે દુર્લક્ષ કરવું.

(૧૫ જુલાઈ ૧૯૬૩)

“અહીં જે આટલી બધી સ્વતંત્રતા છે અને જેમાંથી અમે કશો લાભ ઉઠાવી શકતા નથી તેને બદલે થોડીક પાચાની શિસ્ત દાખલ કરી હોય તો તે વધારે સારું છો!”

અત્યારે તમે આમ કહો છો, પણ જ્યારે તદ્દન અનિવાર્ય હોય, દા.ત. શારીરિક શિક્ષણની બાબતમાં, ત્યારે જે ઓછામાં ઓછી શિસ્તની માળગણી કરવામાં આવે છે તેની સામે (કંઈ નહિ તો મનમાં) બળવો કરનારાઓમાંના તમે પણ એક છો.

(૨૧ જુલાઈ ૧૯૬૩)

“અમારા શિક્ષક ‘ક્ષ’એ અમને એક ગંભીર અને સૂચક વાર્તાલાપમાં એમ કહેલું કે ‘કઠીન કસોટીઓમાંથી પસાર થવા માટે તૈયાર થઈ રહેજો, આપણે અમુક અત્યંત મુશ્કેલ અને ભયજનક વસ્તુના ગાળાની નજીક છીએ’. પણ એમણે કંઈ સ્પષ્ટતા કરેલી નહિ.”

એ એક દુર્ભાગ્યની વાત છે કે એમણે તેમનો વિચાર સ્પષ્ટ કર્યો નહિ, કારણ કે એમણે કંઈ વસ્તુને અનુલક્ષીને એમ કહ્યું હશે તે હું જાણતી નથી. કદાચ તેઓ તમને તમારી બિનજવાબદારી, અવિચારીપણું, ભુલકણાવેડા અને બેદરકારી સામે ચેતવ્યા હશે.

તમે બધા યુવાનો અહીં આવી રહ્યા છો તેમને બહુ સરળ જિંદગી ગાળવાનું મળ્યું છે અને તેનો લાભ લઈને આધ્યાત્મિક પ્રગતિ સાધવાને બદલે તમે બહુ ટિકાપાત્ર ન બનો તેવી રીતે, બને તેટલી મોજમજા ઉડાવી છે. એટલે તમારી શક્તિ સાવધંગીરી જડ થઈ ગઈ છે.

‘ક્ષ’એ એવી રીતે કહેલું તે ચોક્કસ તમને જાગ્રત કરવાને માટે જ.

(૨૭ ઓગસ્ટ ૧૯૬૩)

“મેં હજુ સુધી ૧લી ડિસેમ્બરના અંગદર્શન કાર્યક્રમ માટે પૂરતા પ્રમાણમાં તૈયારી કરી નથી, અને વધુમાં, મને મારામાં ઉત્સાહ પણ વર્તાતો નથી.”

જ્યારે તમે કોઈ વસ્તુ કરવાનો નિર્ણય કર્યો હોય, અને સ્વીકાર કર્યો હોય, ત્યારે પછી, એ વસ્તુ બને તેટલી સારી રીતે કરવી જ જોઈએ.

ચેતનાના વિકાસ અને આત્મસંયમની દિશામાં, દરેક વસ્તુને પ્રગતિના સાધનરૂપ બનાવી શકાય છે, અને આવી રીતે પ્રગતિને ત્વરિત, તાત્કાલિક રીતે કરવાની વસ્તુ જ, આખીએ વસ્તુને, — પછી એ ગમે તે હોય — રસદારી બનાવી મૂકે છે.

(૨૬ સપ્ટેમ્બર ૧૯૬૩)

“શ્રી અરવિંદે એમના એક વિચારસૂત્રમાં લખ્યું છે કે\* ‘જેઓ સ્વતંત્રપણે, સંપૂર્ણ રીતે અને સભાનપણે આત્મસંયમના નિયમનું પાલન કરવામાં ઊણો ઊત્તરતા હોય તેમને તો અન્ય વ્યક્તિના સંકલ્પને આધીન બનાવવા જોઈએ’. માતાજી, હું પણ એવાઓમાંનો એક છું. આપ મારો સ્વીકાર કરીને મને શિસ્તના પાઠ આપવા ફૂપા કરશો?”

મારા બાળક, આ વસ્તુ તો હું ઘણા લાંબા સમયથી કરવા પ્રયત્ન કરી રહી છું, ખાસ કરીને જ્યારથી હું તારી નોંધપોથી મંગાવીને સુધારું ત્યારે તો એમ જ છે.

શિસ્તપાલના એ નિયમ તરીકે જ મેં તને દરરોજ એક જ વાક્ય સાચી રીતે લખવાનું કહેલું — એ લાંબું વાક્ય ન હોય તો ચાલે, પરંતુ “એમાં ભૂલો ન હોવી જોઈએ” — પણ અફસોસ!

અત્યાર સુધીમાં મને સફળતા મળી નથી — તારાં વાક્યો મોટે ભાગે લંબાણભર્યા અને અસ્પષ્ટ હોય છે, તો કેટલીક વાર અત્યંત ટૂંકા હોય છે — પણ બધામાં ભૂલો હોય છે અને ઘણી વાર, ઘણી ઘણી વાર, જાતિ, સુરચના અને વ્યકરણની “એવી ભૂલો હોય છે” જે મેં અગાઉ અનેક વાર સુધારેલી હોય છે.

મને ઘણી વાર એમ લાગે છે કે હું જ્યારે તને તારી નોંધપોથી પાછી મોકલું છું ત્યારે તું ફરીથી વાંચી જતો હોઈશ તો પણ તેનો અભ્યાસ કરીને તેમાંથી લાભ ઉદ્ઘાવતો નહિ હોઉં.

પોતાની જાતને આત્મસંયમ શીખવવો એ કોઈ સહેલી વસ્તુ નથી. જેઓ

\* શતાબ્દી આવૃત્તિ, ગ્રંથ ૧૭, પૃ. ૮૮.

દૃઢચિત અને પોતાના પ્રત્યે કઠોર, હિંમતવાન અને સહનશક્તિવાળા હોય છે તેમને પણ એ કામ અધરું લાગે છે.

પરંતુ તમે આખા યે જીવન ઉપર સંયમને સ્થાપિત કરી શકો તે પહેલાં કંઈ નહિ તો “એક” જ પ્રવૃત્તિ હાથ ધરીને તેને શિસ્તપૂર્વક કરવાનો અને તેમ કરવામાં સફળ થાઓ તેમ કરવાનો પ્રયત્ન કરો, એટલું તો અનિવાર્યપણે જરૂરી છે.

(૧૩ ઑક્ટોબર ૧૯૬૩)

“એમ લાગે છે કે આપને અમે આપની મંજૂરી માટે અંગ્રેજી સાહિત્યનાં પુસ્તકોની એક ચાદી મોકલેલી, પરંતુ આપની ઈચ્છા એવી લાગે છે કેવળ શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં પુસ્તકો જ વાંચવાં જોઈએ. આપે એમ પણ કષ્યું છે કે બીજા જૂનાં સાહિત્યનાં પુસ્તકો વાંચવાથી ચેતનાનો સ્તર હેઠો ઉત્તરે છે.

માતાજી, આપે આ જે વાત કહેલી છે તે કેવળ યોગ, કરનારાઓ માટે છે કે સૌને અનુલક્ષીને છે?”

પ્રથમ તો, જે વાત મેં કહી હોવાનું કહેવાય છે તે સાચી નથી. બીજું, જે કંઈ સલાહ આપવામાં આવે છે તે દરેક વ્યક્તિને અનુલક્ષીને હોય છે, અને સર્વ સામાન્યપણે લાગુ પાડી ન શકાય.

(૧૨ નવેમ્બર ૧૯૬૩)

“હું અભ્યાસ કરવામાં ઘણો જ અનિયમિત છું. મારે શું કરવું તે સમજાતું નથી.”

તમારું ‘તમસ’ જરાક ખંખેરી નાખો નહિ તો પછી તમે મૂક્ષ મતિ બની જશો!

(૨૭ ડિસેમ્બર ૧૯૬૩)

“દરેક વ્યક્તિને નવીન વસ્તુનો ભય લાગે છે, શરીર નવી રીતે કામ કરવાની ના પાડે છે, — જાણો કે કોઈ નવીન પ્રકારનું આસન કરવાનું હોય કે પછી જુદી રીતે દૂબકી લગાવવાની હોય તેમ. આ ભય ક્યાંથી આવતો હુશો? અમે એનાથી કઈ રીતે મુક્ત થઈ શકીએ? અને બીજાઓ પણ એમ કરી શકે તેવી પ્રેરણા કઈ રીતે આપી શકીએ?”

શરીરને નવી વસ્તુનો ડર લાગે છે કારણ કે એને પાયો જ 'તમસ' છે, એ તો પ્રાણ જ એમાં 'રજસ' તત્ત્વ લાદે છે. એટલા માટે જ પ્રાણ જ્યારે શરીરમાં મહત્ત્વાકંક્ષા, હરીફાઈ કરવાની વૃત્તિ અને અહંકાર દાખલ કરે છે ત્યારે જ એ શરીરને પોતાનું તમસ ખંખેરી નાખવા ફરજ પડે છે અને પ્રગતિ માટે પ્રયત્ન કરવા પ્રેરે છે.

એ તો સ્વાભાવિક જ છે કે જેમનામાં તેમનું મન આગળ પડતું હોય છે તેઓ તેમના દેહ ઉપર ઉપદેશનો મારો ચલાવી શકે છે અને ભયથી મુક્ત થવા માટે જરૂરી કારણો પૂર્ણ પાડી શકે છે.

સારામાં સારી વસ્તુ તો એ છે કે તમારે તમારી જાતનું પ્રભુને સમર્પણ કરી દેવું અને એની અનંત કરુણા ઉપર શ્રદ્ધા રાખવી.

(૧૩ મે ૧૯૬૪)

"આધ્યાત્મિક અનુશાસનને માટે તૈયાર થવાની રાહ જોતાં જોતાં, અને શ્રી માતાજી મને મારી નિત્રામાંથી બહાર બેંચી કાઢીને મારા ચૈત્ય સ્વરૂપને જાગ્રત કરે તેવી અભીપ્સા સેવવા ઉપરાંત મારે બીજું શું કરવું જરૂરી છે?"

તમારી બુદ્ધિ ખીલવો, નિયમિતપાણે અને ખૂબ ધ્યાનપૂર્વક શ્રી અરવિંદનાં લખાણો વાંચો, તમારા પ્રાણમય સ્વરૂપને વિકસાવવા અને તેની ઉપર પ્રભુત્વ મેળવવા, તમે તમારી કામનાઓને જીતવા સારુ તમારી હિલયાલો અને પ્રતિક્રિયાઓ ઉપર નજર રાખો; તમારા ચૈત્ય સ્વરૂપને શોધી કાઢવાની અભીપ્સા કરો અને તેની સાથે તાદાત્મ્ય કરો. શારીરિક રીતે તમે જે કરો છો તે કર્યે જાઓ, તમારા દેહનો પદ્ધતિસર વિકાસ કરો અને તેની ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરો, પણ ગ્રાઉન્ડ ઉપર અને તમે જ્યાં કામ કરો છો ત્યાં કામ કરીને તમે સેવા કરો, અને એ સર્વ બને તેટલું અહંકાર વિના કરો.

(૨૨ જુલાઈ ૧૯૬૪)

"એવો પણ સમય આવે છે જ્યારે મને બધું છોડી દેવાનો વિચાર આવે છે પણ-ગ્રાઉન્ડ, બેન્ડ, અભ્યાસ, વગેરે અને મારો બધો સમય કામ કરવામાં ગાળવાનું મન થાય છે. પણ મારી તર્કબુદ્ધિ આનો સ્વીકાર કરી શકતી નથી. આવા વિચારો કેમ અને કયાંથી આવે છે?"

તમારી બાબતમાં તમારી તર્કબુદ્ધિ સાચી છે. બાધ્ય પ્રકૃતિમાં ઘણી વાર એક એવી

તમોમય વૃત્તિ હોય છે કે જે જીવનની પરિસ્થિતિને એવી સીધી સાદી બનાવી દેવા દઈછે છે કે જેમાં તેને વધુ સંકુલ પરિસ્થિતિઓનું સંયોજન કરવાની મહેનત ન કરવી પડે પરંતુ જ્યારે તમારે સ્વરૂપના સર્વાંગી વિકાસ પ્રત્યે પ્રગતિ કરવી હોય છે ત્યારે આ પ્રકારનું સામાન્યીકરણ કરવું લેશ માત્ર સલાહ ભર્યું નથી હોતું.

(૧૮ ઓગસ્ટ ૧૯૬૪)

“ઘણી વાર જ્યારે હું શ્રી અરવિંદનાં લાખાણો વાંચું છું કે સાંભળું છું, ત્યારે હું આશ્રયચક્તિ થઈ જાઉં છું. કર્દી રીતે આવું શાશ્વત સત્ય, લેખનનું આ સૌંદર્ય લોકોની ધ્યાન બહુાર ગયું હશે? એ ખરેખર વિચિત્ર છે કે તેમનો હજુ એક પરમ સર્જક, એક શુદ્ધ કલાકાર અને એક અદ્ભુત કવિ તરીકે સ્વીકાર થયો નથી! એટલે હું મારી જાતને એમ કહું છું કે મારી તુલના અને મારી કદરવૃત્તિ ઉપર મારા ગુરુ પ્રત્યેના ભક્તિભાવની અસર છે અને બધા કંઈ ભક્તિભાવવાળા નથી હોતા. મને આ સાચું લાગતું નથી. પણ તો પછી લોકોના હદ્યો તેમના શબ્દો પ્રત્યે મંત્રમુગ્ધ બન્યા નથી?”

શ્રી અરવિંદને કોણ સમજ શકે છે? તેઓ વિશ્વ જેટલા વિરાટ છે અને તેમનું શિક્ષણ અનંત છે....

એમની થોડીક જ નજીકમાં જઈ શકાય તે માટે આપણે તેમના પ્રત્યે સાચા હદ્યનો પ્રેમ રાખવો જોઈએ અને તેમને કાર્ય પ્રત્યે નિતાંતભાવે આત્મસમર્પણ કરી દેવું જોઈએ. આવી રીતે જ, દરેક વ્યક્તિ પોતાનાથી બને તેટલું ઉત્તમ કાર્ય કરે છે અને પોતાનાથી બને તેટલો ફાળો આપે છે કે જેથી શ્રી અરવિંદે જગતનું રૂપાંતર થવાનું ભાખેલું તે બની આવે.

(૨ ડિસેમ્બર ૧૯૬૪)

“શ્રી અરવિંદે કચાંક કહ્યું છે કે જો કોઈ પ્રભુની કૃપાને પોતાનું સમર્પણ કરી શકે તો એ આપણે માટે બધું જ કરી શકે છે. તો પછી તપસ્યાનું મૂલ્ય કેટલું?”

જો તમારે શ્રી અરવિંદે કોઈ વિષય ઉપર શું કહ્યું છે તે જાણવું હોય, તો કંઈ નહિ તો તેમણે એ વિષય ઉપર જે કાંઈ લખેલું છે તે બધું જ વાંચી જવું જોઈએ. ત્યારે તમને જણાશો કે ઉપરછલ્લી રીતે જોતાં તેમણે અન્યાંત વિરોધાભાસી લાગે એવી વસ્તુઓ

કહેલી છે. પરંતુ જ્યારે તમે બધું જ વાંચી લેશો અને થોડું સમજતા થશો ત્યારે તમને સમજશો કે સર્વ પ્રકારનાં વિરોધાભાસી વક્તવ્યો એકબીજાનાં પૂરક છે અને તેઓ વ્યવસ્થિત રીતે એક સંપૂર્ણ સમન્વયમાં જોડાયેલા છે.

અહીં શ્રી અરવિંદનું એક ઉદ્ધરણ છે જે તમને બતાવી આપશો કે તમારો પ્રશ્ન અજ્ઞાનમૂલક છે. એવાં બીજાં ઘણાં વિધાનો છે જે વાંચવાં રસપ્રદ નીવડશો અને જેનાથી તમારી બુદ્ધિ વધુ નમનીય બનશો :

“જો સમર્પણ સંપૂર્ણ ન હોય તો પછી બિલાડીના બચ્ચાનું વલણ અપનાવી નહિ શકાય; એક તામસિક નિષ્ઠિયતા હશે જેણે સમર્પણનું નામ અપનાવ્યું હશે. જો શરૂઆતમાં સંપૂર્ણ સમર્પણ શક્ય ન હોય તો અનિવાર્યપણે — એ વ્યક્તિગત પ્રયત્ન જરૂરી રહે છે.”

(૧૬ ડિસેમ્બર ૧૯૬૪)

“એકાગ્રતા અને સંકલ્પબળનો વિકાસ કઈ રીતે કરવો? — એ સર્વ વસ્તુઓ કરવા માટે જરૂરી છે.”

એકાગ્રતા અને સંકલ્પશક્તિનો નિયમિત, ખંતપૂર્વકનો, ચીવટપૂર્ણ અને અપરિહાર્ય અભ્યાસ કરવા વડે.

(૭ એપ્રિલ ૧૯૬૫)

“મનોમય અનાસક્તિ અને જિજ્ઞાસાનો અભાવ એ મનોમય જડતાનો એક પ્રકાર છે?”

સામાન્ય રીતે એમાં મનની તમોગ્રસ્તતા હોય છે, સિવાય કે તમે એક અત્યંત ઉગ્ર સાધના વડે શાંતિ અને અનાસક્તિ પ્રાપ્ત કરી હોય જેને લઈને સારા-નરસા, સુખદ અને દુઃખ પ્રત્યે સમતા પ્રાપ્ત થવાથી એમના અસ્તિત્વનું ભાન પણ ન હોય. પરંતુ એમ બને છે ત્યારે મનોમય પ્રવૃત્તિનું સ્થાન એક ઘણી ઉચ્ચ કક્ષાની અંતઃ-સ્કુરાણાની કિયાએ લીધેલું હોય છે.

(૨૫ મે ૧૯૬૬)

“મનની આળસ અને તમોગ્રસ્તતામાંથી કઈ રીતે બહાર નીકળાય?”

ખંત અને ચીવટપૂર્વકની ઈચ્છા રાખવા વડે. દરરોજ વાચન, વ્યવસ્થા અને ખિલવણીની માનસિક કસરત કરવા વડે.

દિવસ દરમ્યાન આમાં વારાફરતી મનની એકાગ્રતાપૂર્વકની નીરવતાનો પણ અભ્યાસ કરવો જોઈએ.

(૧ જૂન ૧૯૬૬)

\*

## વાર્તાલાપો

૫ એપ્રિલ ૧૯૬૭

(શ્રી માતાજી એક નોંધ લખે છે.) આ એક પ્રશ્નનો ઉત્તર છે. શાળાના શિક્ષકોને મેં શું કહ્યું તે તમે જાણો છો? મને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. આ મારા ઉત્તરની શરૂઆત છે :

“સામાન્ય જીવન” અને આધ્યાત્મિક જીવન વચ્ચેનો ભેદભાવ એક ગઈગુજરી હકીકત બની ગઈ છે.”

તમે એનો પ્રશ્ન વાંચ્યો છે? મને એ ફરી વાંચી સંભળાવો.

“અમે ભવિષ્યની ચર્ચા કરી. મને એમ લાગ્યું કે લગભગ બધા જ શિક્ષકો એવું કાંઈક કરવાની બાબતમાં સંમત થયા કે જેથી બાળકો, તેઓ અહીં શા માટે છે તે વિષયમાં સભાન બને. એ ક્ષાણો મેં કહ્યું કે, મારા અભિપ્રાય પ્રમાણે, બાળકો આગળ વારંવાર આધ્યાત્મિક વસ્તુઓ વિષે વાત કરવાથી પરિણામ ઊંઠું જ આવે છે, અને આ શબ્દો તેમનો સઘળો અર્થ ગુમાવી દે છે.”

“આધ્યાત્મિક વસ્તુઓ” — આધ્યાત્મિક વસ્તુઓ શબ્દોથી એ શું કહેવા માગે છે?

“દેખીતી રીતે, જો શિક્ષકો તેમનું એક વાર્તાની જેમ રટણ કરે તો...”

આધ્યાત્મિક વસ્તુઓ... ...એમને ઈતિહાસ અથવા આધ્યાત્મિક વસ્તુઓ શીખવવામાં આવે છે, એમને વિજ્ઞાન અથવા આધ્યાત્મિક વસ્તુઓ શીખવવામાં આવે છે. એ તો મૂર્ખતા છે, ઈતિહાસમાં આત્મા છે; વિજ્ઞાનમાં આત્મા છે — સત્ય સર્વ સ્થળે છે. અને જરૂર એ છે કે તેમને ખોટી રીતે નહિ પણ સાચી રીતે શીખવવું જોઈએ. એ વસ્તુ તેમના મગજમાં ઊતરતી નથી.

વધુમાં એ લખે છે કે, “મેં એવું સૂચન કર્યું કે એના કરતાં, બધાએ એકઠા થઈને શ્રી માતાજીના સ્વરને\* સાંભળવો વધુ સારો. ભલે અમે કંઈ પણ સમજી ન શકીએ પરંતુ આપનો અવાજ જ જે આંતરિક કાર્ય સિદ્ધ કરી શકશે એનું મૂલ્યાંકન અમે ન કરી શકીએ. આ વિષયમાં હું એ વસ્તુ જાગવા માગું છું કે બાળકોને આપની સાથે સંપર્કમાં આગાવાનો સારામાં સારો માર્ગ કયો. આ વિષયમાં મારાં અને બીજાઓનાં સૂચનો મને અસંબદ્ધ અને કશા મૂલ્ય વિનાનાં લાગે છે.

માતાજી, એમ કરીએ તો વધુ સારું નહિ કે અમે શિક્ષકો જે વિષય શીખવતા હોઈએ તેની ઉપર જ એકાગ્રપણે કારણકે આધ્યાત્મિક જીવનની તો આપ જ કાળજી લો છો?”

હું એને આ જવાબ આપીશ : “આધ્યાત્મિક જીવન” જેવું કંઈ છે જ નહિ! એ હજી પણ જરી પુરાણો, સંતોનો, સંન્યાસીનો ખ્યાલ છે — જેમાં આધ્યાત્મિક જીવન હોવાનું મનાય છે અને બીજાંઓનાં જીવન સામાન્ય જીવન ગણાય છે — અને એ સાચું નથી, સાચું નથી, લેશમાત્ર સાચું નથી.

આમ છતાં જો તેઓને કોઈ બે વસ્તુઓ વચ્ચેનો વિરોધ જરૂરી લાગતો હોય — કારણ કે મગજ બિચારું એવું છે કે જો એને કોઈ વસ્તુનો વિરોધ ન કરવાનો હોય તો એ કામ જ કરતું નથી — તો, વધારે સારું એ છે કે એ લોકો સત્ય અને અસત્ય વચ્ચેનો વિરોધ ગણાનામાં લે, એમ કરવું એ કોઈ સંપૂર્ણ પદ્ધતિ તો નથી છતાં કંઈક ઠીક છે. કારણ કે, સૌ વસ્તુઓમાં, સર્વ ઢેકાણે, સત્ય અને અસત્યનું મિશ્રણ થઈ ગયેલું છે. જેને “આધ્યાત્મિક જીવન” હુંમેશા આવે છે, સંન્યાસીઓ, સ્વામીઓ, એવા જે કોઈ લોકો પોતાને દિવ્ય જીવનના પ્રતિનિધિ ગણાવતા હોય, એ સૌમાં — ત્યાં પણ, સત્ય અને અસત્યનું મિશ્રણ હોય છે.

સારું તો એ હુંમેશા કે આપણે કશો ભેદભાવ જ ન ગણીએ.

(મૌન)

બાળકોને માટે, તેઓ બાળકો છે તેટલા માટે જ એ વધુ સારું ગણાય કે એમનામાં ભાવિ ઉપર વિજ્ય પ્રાપ્ત કરવાની હિચાશક્તિ રેડવી, એવો સંકલ્પ ઊભો કરવો કે તેઓ હુંમેશા ભાવિ પ્રત્યે નજર માડો અને શક્ય તેટલી ઝડપી ગતિ કરીને પોતાને... જે વસ્તુ બનવાની છે તેના પ્રત્યે દોરે — પણ એમણે એમની

\* શ્રી માતાજીના સને ૧૮૫૦ પછીના દાયકાના વાર્તાલાપોની રેકૉર્ડ કરેલી ટેઇપ.

સાથે તેમના ભૂતકાળનું, તેમને દબાવી દે તેવું ઘંટીનું પૈડું પોતાની સાથે જેંચતા ન જવું જોઈએ. એ તો આપણે ચેતનામાં અને જ્ઞાનમાં અત્યંત ઉંચે ગયેલા હોઈએ ત્યારે જ આપણે પાછળ દૃષ્ટિ કરીએ તો વાજબી ગાણાય અને ત્યારે આપણને જે બિંદુએથી ભાવિની શરૂઆત થાય છે તે દૃષ્ટિગોચર થઈ શકે છે. જ્યારે આપણે સમગ્ર ચિત્રને નિહાળી શકીએ, જ્યારે આપણને અત્યંત વિશ્વવ્યાપક દૃષ્ટિ ગ્રાપ્ત થાય, ત્યારે પછી આપણને ખ્યાલ આવે છે કે જે વસ્તુ બનવાની છે તેના વિષે આ અગાઉ પણ જાહેરાત કરવામાં આવેલી છે; જેમ કે શ્રી અરવિંદે કહેલું છે કે આ પૃથ્વી ઉપર હિંદુ જીવનની સ્થાપના થવાની છે, કારણ કે એ “પહેલેથી જ પદાર્થ તત્ત્વમાં” અંતર્ભૂત રહેલું છે. જો આપણે દૃષ્ટિબંધુથી જોઈએ તો પાછળ કે નીચેની બાજુએ દૃષ્ટિ નાખવી રસપ્રદ નીવડે છે — જે કંઈ થઈ ગયેલું છે તેને જાણવા માટે નહિ અથવા મનુષ્યો જે જાણો છે તે વસ્તુઓ જાણવા માટે નહિ? એમ કરવું તકન નિરર્થક હોય છે.

બાળકોને એમ કહેવું જોઈએ કે ઘણી અદ્ભુત વસ્તુઓ પ્રગાટ થવાની છે માટે તેમને જીલવાને માટે તૈયાર બનો. હવે જો એ લોકો એ વિષયમાં કોઈ સરળ અને વધુ સ્પષ્ટ રીતે સમજાય તેવી વસ્તુ જાણવા માગે તો તમે તેમને કહી શકો કે શ્રી અરવિંદ આ વસ્તુઓનો અગાઉથી ઉદ્ઘોષ કરવા માટે આવેલા હતા એટલે તમે જો એમના લખાણને વાંચશો તો તેમને એ વિષયમાં સમજાણ પડશો. આ રીતે તેમનામાં રસ જાગે છે અને શીખવાની દીઢ્યા જાગ્રત થાય છે.

“એને જે મુશ્કેલી પડે છે તે હું બધું રપણદિપણે જોઈ શકું છું — જે બધી વસ્તુઓ લખાયેલી છે અને એ લોકો જે બધાં લેકચરરો આપે છે — તેમાં કેવળ ભાષાના પરપોટા હોય છે, એમાં કશું સત્ય કે અંગત રીતે અનુભવેલું હોતું નથી, એટલે એની અસર તો નથી જ થતી પણ એથી જીલટી અસર થાય છે. એ જેનો ઉદ્દ્દેખ કરે છે તે આ વસ્તુ છે.”

હા, એટલા માટે જ એમણે, મેં જેમ કહ્યું તેમ કરવું જોઈએ.

આહ! બહુ થોડા સમય પહેલાં તો શિક્ષકો એમ કહેતા હતા કે આપણે આમ કરવું જોઈએ કારણ કે બીજે બધે એમ જ કરવામાં આવે છે. (હસતાં હસતાં) હવે એ લોકો થોડા આગળ વધ્યા લાગે છે. પણ હજુ ઘણું અંતર કાપવાનું બાકી છે.

પરંતુ, સૌથી વધુ અગત્યની વસ્તુ આ ભેદભાવને નાભૂદ કરવાની છે અને એ દરેકમાં, એ સૌના મગજમાં આ ભેદભાવ રહેલો છે — આધ્યાત્મિક જીવન

ગાળવાનો અને સામાન્ય જીવન ગાળવાનો, આધ્યાત્મિક ચેતના ધારણ કરવાનો અને સામાન્ય ચેતના હોવાનો — ખરી રોતે ચેતના એક જ છે.

ધ્યાનાખરા લોકોમાં એ ચેતના ત્રાણ ચતુર્થાંશ ભાગ જેટલી નિદ્રાવીન હોય છે કે વિકૃત થયેલી હોય છે. ધાણમાં તો એ સર્વાંશો વિકૃત હોય છે. આમાં ખરી જરૂર એ વસ્તુની છે કે એક ચેતનામાંથી બીજી ચેતનામાં ભૂસકો મારવાનો નથી, પરંતુ પોતાની ચેતનાને ખુલ્લી કરવાની છે (ગૈર્ધ પ્રત્યે નિર્દેશ) અને તેને સત્યના સ્પંદનોથી ભરી દેવાની છે, જે વસ્તુ અહીં થવી જોઈએ તેની સાથે સંવાદમાં લાવવાની છે — ત્યાં તો એ સમગ્ર શાશ્વતીથી અસ્તિત્વમાં છે — પરંતુ અહીં તો એ પૃથ્વી ઉપરની “આવતી કાલની” વસ્તુ છે. જો તમે તમારી જાતને ભૂતકાળના બોજથી લાદીને આગળ ભેંચતા જશો, જે વસ્તુનો ત્યાગ કરવાનો છે તેને આગળ ભેંચતા જશો, તો તમારી પ્રગતિ બહુ જડપથી નહિ થાય.

ધ્યાન રાખો કે પૃથ્વીના ભૂતકાળની વસ્તુઓ જાળવામાં ધણો રસ પે તેવું છે અને ઉપરોગી પણ છે, પરંતુ એ વસ્તુ તમને બાંધી રાખે કે ભૂતકાળ સાથે જોઈ રાખે એવું ન બનવું જોઈએ. જો એ વસ્તુને તમે કૂદકો લગાવવાના પાઠ્યા તરીકે વાપરો તે ઢીક છે, પણ સાચું કહું તો એ વસ્તુ ગૌણ છે.

### (મૌન)

બાળકો જ્યારે ખૂબ નાનાં હોય ત્યારથી જ તેમને શિક્ષણ આપી શકાય એવી કોઈ શિક્ષણ પદ્ધતિ ઉપજાવી કાઢવી જોઈએ કે ઊભી કરવી જોઈએ. જ્યારે એ નાનાં હોય છે ત્યારે એમ કરવું સરળ પે છે. આપણે એવા લોકોની જરૂર છે — ઓહ, આપણે એવા વિશિષ્ટ પ્રકારના શિક્ષકોની જરૂર છે કે જેમનામાં સૌ પ્રથમ તો જે કાંઈ જ્ઞાન-સંચય ઊભો થયેલો છે તેનું ભંડોળ સારા પ્રમાણમાં હોય કે જેથી તેઓ તમામ પ્રકારના પ્રશ્નોના ઉત્તરો આપી શકે. એની સાથે એમનામાં સાચી અંતઃસ્કુરણાજન્ય બુદ્ધિનું જ્ઞાન હોવું જોઈએ જો કે, એ વિષય એમના સ્વાનુભવનો હોય તો વધારે સારું. અને એ પ્રકારના વલણ કરતાં અનુભૂતિ હોય તો એ વધુ દૃઢ્યવા યોગ્ય ગણાય એ તો સ્વાભાવિક વસ્તુ છે. તો, એમનામાં એ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ કે જ્ઞાન પામવાની સાચી રીત એ છે કે મન તદ્દન નીરવ હોવું જોઈએ, એ નીરવતા સત્ય ચેતના પ્રત્યે ઉન્મુખ હોવી જોઈએ અને ત્યાંથી જે કાંઈ આવતું હોય તેને જીલવાની ક્ષમતા ધરાવતી હોવી જોઈએ. આ પ્રકારની આવડત હોય તો ઉત્તમ ગણાય. કંઈ નહિ તો એ વસ્તુ સમજાવવી જોઈએ કે સાચી વસ્તુ એ જ છે — સાચી વસ્તુનું એક પ્રકારનું દર્શન છે — અને એનાથી કેવળ જ્ઞાનની દુનિયામાંથી

જે કંઈ જાણી શકાય છે એટલું જ નહિ, પણ એ વસ્તુ તો સમગ્ર કાર્યક્ષેત્રને પાણ આવરી લે છે : એટલે કે, એ રીતે આપણને આપણે કઈ વસ્તુ “કઈ રીતે” કરવી અને ક્યારે કરવી તેનું પણ ચોક્કસ પ્રકારનું માર્ગદર્શન મળી રહે છે. અને એ રીતે જ્યારે આપણે આગળ વધીએ ત્યારે આપણે શું કરવું જોઈએ અને ક્યારે કરવું જોઈએ તેનો આપણને સ્પષ્ટ ચિત્તાર મળી રહે છે. કંઈ નહિ તો બાળકોમાં વિચારશક્તિ જાગે, — એ લગભગ સાત વર્ષની ઉંમરે આવે છે. પરંતુ ચૌદ કે પંદર વર્ષે એ તકની સ્પષ્ટ બની રહે છે — ત્યારે આ વસ્તુ કઈ રીતે થઈ શકે તેનો સાત વર્ષની ઉંમરે તેમને થોડોકે આણસાર આપવો જોઈએ અને ચૌદ વર્ષની ઉંમરનાં થાય ત્યારે સંપૂર્ણ સ્પષ્ટીકરણ કરવું જોઈએ. એમને એ વસ્તુ સમજાવવી જોઈએ કે વસ્તુઓને ઉંડાણમાં રહેલી સાચી વસ્તુ સાથે સંપર્કમાં આવવાનો એ જ એકમાત્ર માર્ગ છે અને બાકીની બીજી બધી રીતો તો જે વસ્તુ સીધેસીધી તાદૃશપણે જાણી શકાય તેમ છે તેને અનુરૂપ ઓછાવતા પ્રમાણમાં આડે ઘે કાર્ય કરતી મનોમય ધારણાઓની પદ્ધતિઓ જ છે.

આનો સાર એટલો જ કે શિક્ષકોમાં પોતાનામાં જ, કંઈ નહિ તો અનુશાસન અને અનુભૂતિની સાચા હદ્યપૂર્વકની શરૂઆત થઈ હોવી જોઈએ. એમાં પુસ્તકો એકઠાં કરીને એમાંથી આ રીતે ભાખણે આપે તે ન ચાલે. એ રીતે તમે શિક્ષક નહિ બની શકો — ભલે પછી બહારના જગતને જેમ કરવું હોય તે કરે. આપણે કોઈ પ્રચારકો નથી. આપણે તો કેવળ એ બતાવી આપવા માગીએ છીએ કે શું થઈ શકે તેમ છે અને એ વસ્તુ “થવી જ” જોઈએ એ વસ્તુ પુરવાર કરવા માગીએ છે.

જ્યારે તમે અત્યંત નાનાં બાળકોને લો ત્યારે એ વસ્તુ અદ્ભુત હોય છે. ત્યારે બહુ કરવાપણું હોતું નથી. તમે “બની રહો” એટલું જ બસ થઈ પડે છે.

કદી ભૂલ ન કરો.

કદી મિશાજ ન રૂમાવો.

હુંમેશાં સમજદાર રહો.

અને શિક્ષકે માત્ર એટલું જ કરવાનું છે કે આ પ્રકારની પ્રવૃત્તિ અથવા ઊર્ભિ કેમ ઉત્પન્ન થઈ છે તે સ્પષ્ટપણે જોવું અને જાણવું, એ બાળકનું અંદરનું બંધારણ કઈ રીતનું છે તે સમજવું, એમાંથી કઈ વસ્તુને પુષ્ટિ આપીને આગળ લાવવાની છે તેનું દર્શન મેળવવું — માત્ર આટલું જ કરવાનું છે, અને પછી તેમને સ્વતંત્રપણે પોતાનો વિકાસ કરવા ધૂટાં મૂકૂવાં, કેવળ તેમને ઘણી ઘણી વસ્તુઓને જોવાની, સ્પર્શ કરવાની શક્ય તેટલી વસ્તુઓ કરી જોવાની તક આપવી. એમાં બહુ મજા પેં છે. અને સૌથી વધુ અગત્યની વસ્તુ તો એ છે કે તમે જે વસ્તુ જાણો છો એમ

માનતા હો, એ વસ્તુ એમની ઉપર ઠોકી ન બેસાડવી.

એમને કદી ધમકાવશો નહિ. હંમેશાં સમજવાનો પ્રયત્ન કરો અને જો કોઈ બાળક તૈયાર હોય તો અને સમજાવો. જો તમે પોતે તૈયાર હો પણ એ બાળક પોતે સમજવા માટે તૈયાર ન હોય તો, જે આંદોલન ખોદું હોય તેને બદલે ખરું આંદોલન ઉપજાવો. પરંતુ આ બધું તો... શિક્ષકોમાં જે પ્રકારની પૂર્ણતાની અપેક્ષા રાખી શકાય તેથી ઘણું વધારે છે.

પરંતુ શિક્ષકો માટે આ પ્રકારનો કાર્યક્રમ અને અભ્યાસ માટે કાર્યક્રમ ઘડી કાઢવો અત્યંત રસદાયક બનશે. અને એની શરૂઆત છેક પાયાથી કરવી — એ એવો નમનીય હોવો જોઈએ કે એના ઉપર પડતા પ્રભાવોને એ ઊડાણમાંથી ગ્રહણ કરી શકે. એ લોકો જ્યારે સાવ નાનાં હોય ત્યારે એમને સત્યનાં થોડાંક બિંદુઓ આપશો તો તેઓ જેમ જેમ મોટાં થતાં જશે તેમ તેમ તકન સ્વાભાવિક રીતે ખીલી ઊઠશે. અને એક સુંદર કાર્ય બનશે.

\*

## ૧૧. નવેમ્બર ૧૯૬૭<sup>૧</sup>

તો?

અ: આપે ‘બ’ને તેના હમણાંના પત્રનો જે ઉત્તર<sup>૨</sup> આપ્યો છે એના બે પ્રકારના અર્થ તારવવામાં આવ્યા છે.

કેટલાક આપના પહેલા વાક્ય ઉપર ભાર મૂકે છે : “જો ભેદભાવ તરત જ દૂર થઈ જાય તો એ વસ્તુ અત્યંત પસંદ કરવા જેવી ગાળાશે.” અને એ લોકો એમ માને છે કે આ બધા વિભાગોને તાત્કાલિક રીતે દૂર કરી દેવા, છેક

વ્યવહારું સ્તરે પણ, — અને આખીયે શાળા માટે એક તંત્ર ગોકર્ણું, એટલે કે સ્વતંત્ર મગતિના વર્ગોને વિશાળ કરવા અથવા એવી કોઈ બંધબેસતી વ્યવસ્થા કરવી.

બીજાઓ એમ માને છે કે સૌ પ્રથમ તો અમારે મનોવૈજ્ઞાનિક ભેદભાવો સાફ કરી દેવા અને સ્વતંત્ર મગતિનો ભાવ ફેલાવવો. આપના ઉત્તરના બીજા

૧. શારીરિક શિક્ષાણ કેન્દ્રના પાંચ શિક્ષકો સાથેની વાતયીત.

૨. આ અગાઉ છપાયેલો (પૃ. ૨૦૩-૨૦૪) તા.૬-૧૧-૬૭નો પ્રક્રિયા અને ઉત્તર

ભાગ ઉપરથી આ લોકો એમ ધારે છે કે જે વર્ગો આજ સુધી પરંપરાગત રીતે ચલાવવામાં આવ્યા છે તેમને માટે થોડો વચનગાળાનો સમય જોઈશે અને પછી અમારે શું કરવું તે નક્કી થઈ શકશે.

સૌપ્રથમ તો, હું કાંઈ ઉત્તર આપું તે પહેલાં બરાબર ચોક્કસ રીતે તદ્દન, ખૂબ વ્યવહારું અને નક્કર રીતે જાણવા માણું છું કે આમાં તફાવત શું છે?

મારું માનવું આ પ્રમાણે છે : જે સ્વતંત્ર પ્રગતિના વર્ગો છે તેમાં કોઈ એવી વ્યવસ્થા નથી કે જેમાં બધા વિદ્યાર્થીઓ બેઠા હોય, શિક્ષક એના ઉચ્ચાસન ઉપરથી આખો વખત સંભાષણ આપે જતા હોય અને વિદ્યાર્થીઓ અહીંતહીં તેમના મેજ પાસે બેઠેલા હોય. એમાં તો એમને જે કામ કરવું હોય તે કરતા રહે અને શિક્ષક ત્યાં કેવળ હાજર હોય, એ ઓરડામાં ગમે ત્યાં હોય, કોઈ ખાસ ઠેકાણો બેઠલા હોય; વિદ્યાર્થીઓ તેની પાસે જઈને પૂછવા હોય તે પ્રશ્નો પૂછતા હોય, હું એમ સમજું છું કે આવું કંઈક હરો, તદ્દન ...

**અઃ માતાજી, વસ્તુસ્થિતિ એવી જ છે.**

તો હવે, જૂની પદ્ધતિ ચાલુ રાખવાની હોય તો, બધા જ વિદ્યાર્થીઓ ત્યાં હારબંધ બેઠા હોય, શિક્ષક તેના ઉચ્ચાસન ઉપર બેઠેલા હોય, એટલે કે તદ્દન વિચિત્ર એવી પરિસ્થિતિ હોય. મને બરાબર યાદ છે કે જ્યારે હું પણ ગ્રાઉન્ડ ઉપર જતી ત્યારે સૌ કોઈ સ્વતંત્રપણે મારી આસપાસ બેઠેલાં હોય એથી મને ઘણો આનંદ થતો... પણ ટેબલ, ઉચ્ચાસન, વિદ્યાર્થીઓ તેમના બાંકડા સાથે જકડાયેલા હોય... હું તદ્દન સ્થૂલ રીતની વાત કરું છું, કોઈ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિ નહિ; એટલે જો એવી પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું હોય તો એટલો પણ એક મોટો સુધારો થયો ગણાય.

આવું તો ન હોવું જોઈએ કે બધા જ વિદ્યાર્થીઓ આમ એક હારબંધ અંદર આવીને પોતપોતાને ઠેકાણો બરાબર બેસી જાય અને પછી શિક્ષક આવીને બેસે... અને જો એ વિદ્યાર્થીઓ સારી રીતભાતવાળા હોય તો ઊભા થાય (હસાહસ), પછી શિક્ષક બેસે અને સંભાષણ શરૂ કરે. વિદ્યાર્થીઓ એમને મનજાવે તેવા વિચારો કરતા રહે, તેમના વિચારો અનેક દિશાઓમાં ભટકતા રહે અને તેમને ઢીક લાગે તો ધ્યાન આપે. ત્યારે આ તો સમયનો બગાડ જ કહેવાય, બીજું કંઈ નહિ,

આ બધું ખૂબ, ખૂબ, ખૂબ સ્થૂલ અને વ્યવહારું છે; અને એમાં એકદમ ફેરફાર કરી શકાય. શિક્ષક પોતાને માટે એક ખૂણો કે કોઈ બીજું સ્થળ પસંદ કરે કે પછી

કોઈ નાનકડો રૂમ પસંદ કરે — એવું ગમે તે કામ હોય, એ બધું મારે મન સરખું છે — એ ગમે તે સ્થળ હોય, એ જ રૂમ હોય કે પાસેનો કોઈ રૂમ હોય. વિદ્યાર્થીઓ ત્યાં જઈને તેનું માર્ગદર્શન માગો શકે, શિક્ષક પોતે પોતાના વિદ્યાર્થીઓને આપવાના ઉત્તરોને તૈયાર કરવામાં જ રસ લે, બીજા કશામાં નહિ.

આ તરત જ થઈ શકે, નહિ?

હુંવે, એમ પણ જરૂરી નથી કે એ સૌ પોતાને એક જ નામે બેલાવે, એટલે કે ત્યાં... કોઈ મનુષ્યનો આત્મા હોય... આહ! આપણે એને કોઈ વિવેકભર્યું નામ આપી શકીએ... કોઈ નભું ઘેટા જેવો આત્મા... એમને જોઈએ એટલો સમય આપીએ... અને એમને કોઈ દોરવાણી આપે એ પણ જરૂરી છે.

વિદ્યાર્થી શાળાએ જાય ત્યારે એને એમ ન લાગવું જોઈએ કે પોતાનું ચાલતું નથી એટલે એને એ રીતે ઘંટી ફેરવવા જવાનું છે, પણ એને એમ લાગવું જોઈએ કે એ પોતાને રસ પેડ તેવી કોઈ વસ્તુ કરવા જઈ રહ્યો છે. શિક્ષકે શાળામાં એ હેતુસર જઈને બેસવું ન જોઈએ કે પોતાને અદ્યોપોણો કલાક પોતે જે કાંઈ ઠીકઢાક કરીને તૈયાર કર્યું હોય તેનું સંભાપણ કરવાનું છે, અને ભલે પછી એ પોતાને જ કંટાળાજનક લાગતું હોય એટલે વિદ્યાર્થીઓને પણ કશી મજા વિનાનું લાગે. આથી ઊંઠણું એણે થોડાક એવા વિકાસશીલ વિદ્યાર્થીઓ સાથે ગાઢ સંપર્કમાં આવવું જોઈએ કે જેમનામાં થોડીક જિજ્ઞાસાવૃત્તિ હોય અને શિક્ષકે તેમની જિજ્ઞાસા પરિતૃપ્ત કરવી જોઈએ. આ રીતે એ શિક્ષકે સભાન બનવું જોઈએ, બહુ નભપણે સભાન બનવું જોઈએ, કે પોતાને બધું જ કંઈ આવડતું નથી અને પોતાને પણ ઘણું શીખવાનું બાકી છે — પણ તે પુસ્તકોમાંથી નહિ — પરંતુ જીવનને સમજીને એ શીખવાનું છે.

ત્યારે આ રીતની રૂપરેખા તમને તમારા કામ માટે આપું છું. મને ખબર નથી... તમે વિદ્યાર્થીઓને વસ્તુઓ વહેંચો છો...

અઃ માતાજી, હું આપને એક મિનિટમાં જ કહીશ કે અમે કઈ રીતે કામ કરવાના છીએ; એમાં સંપૂર્ણ સ્વતંત્રતા, હશે...

સરસ, સરસ. આગળ કહો. તમારો પ્રશ્ન શું છે?

અ : ગમે તેમ હોય તો પણ આપણી આ નવી દૃષ્ટિએ જોતાં, અને વ્યવહૃત કારણોને લઈને, આપણે સેંકડો વિદ્યાર્થીઓને સમાવી લે તેવી એકમાત્ર સંકુલ વ્યવસ્થા ગોઈવવાની કલ્પના તો ન કરી શકીએ, ખાસ કરીને જ્યારે આપણે એમ ઈચ્છાએ છીએ કે બાળકોને તેમના વિકાસ માટે એક

આત્મીયતાભર્યું વાતાવરણ મળવું જોઈએ. જ્યારે અમે આ પ્રશ્નનો 'ક' સાથે વિચાર કર્યો ત્યારે અમારો ખ્યાલ એવો હતો કે અમે 'કુટુંબો'ની રચના કરીએ એટલે કે વધુમાં વધુ ૧૮૦ થી ૨૦૦ જેટલા બાળકોનાં બનેલા સમાંતર ગ્રૂપો બનાવીએ અને આમ તો જોકે આ બધાં ગ્રૂપોની પાછળ એક સમાન આદર્શની પેરાણા હશે અને એમાં જેને આપણે માધ્યમિક ગાળો કહી શકીએ તેવી બાળકના વિકાસ માટેની સર્વ પ્રકારની સગવડો હશે, તેમ છતાં એ દરેક બાળક પોતાની અમુક આગવી મૌલિકતા જાળવી શકશે.

આ ગ્રૂપોની વચ્ચે પણ, પરસ્પર આપ-દેની સર્વ પ્રકારની શક્યતાઓ અને વૈવિધ્યપૂર્ણ સંપર્કોની શક્યતાઓ હશે, કદાચ કેટલીક પ્રવૃત્તિઓ તો સર્વ સમાન હશે અને માધ્યમિક કક્ષા સુધી એ પ્રવૃત્તિઓ વધુ ને વધુ વાર બનતી રહેશે. ત્યાર પછી એક બીજી વ્યવસ્થા આવશે જે મહા વિદ્યાલયના જીવનને અનુરૂપ વિશિષ્ટતાને અનુરૂપ હશે.

આ રીતે અમે અમારા હેતુની એકતાને સમગ્રપણે આવિભાગ કરતા રહીશું તેમ છતાં એમાં જીવંત વૈવિધ્યને પણ સ્થાન હશે. આપ આ વિષે શું ધારો છો?

બરાબર ચાલશે. સારી વાત છે. સિદ્ધાંત આમ જ છે ને?

અઃ હા, માતાજી.

આ સિદ્ધાંત છે અને હું એને વ્યવહારમાં મૂકવાની બાબતમાં, તમારી પાસે કેટલાક રૂમ વગેરે છે... તમે કઈ રીતે...

અ : હું, માતાજી, હું અમારા વગ્ાવો વિષે કહીશ, એટલે કે જે કંઈ ચાલે છે તેને ચાલુ રાખવાની વાત.

ભલે, કહો.

(આ પ્રસંગે 'અ' સ્વતંત્ર પ્રગતિના વગ્ાવો વિષે એક લાંબો રિપોર્ટ આપે છે)

સારું, સારું છે. તો પછી તમારે શું જોઈએ છે?... તમારી વાત બરાબર છે. પરંતુ આ વસ્તુ સૌ કોઈને લાગુ પડશે, તો ખરુંને!

અ : માતાજી, આ વિષયમાં અમે જરા ખચકાઈ એ છી એ કારણું કે પરંપરાગત વર્ગોમાં કેટલાંક એવાં બાળકો છે — અલભતા, મોટાં બાળકો — કે જે ઓ આ રીતે કાર્ય કરતાં શીખેલાં નથી. એટલે, આપે આપના છેલ્લા પત્રમાં ઉદ્દેશ કરલો તે મુજબ અમે ધારેલું કે થોડો વચ્ચગાળાનો સમય જરૂર અને ઉ. ત. આપે સૂચવેલું તેમ, ત્રણોક માસમાં જો પરિસ્થિતિ, એક વધુ જડપી વિકાસને માટે અનુકૂળ હશે તો અમે ફેરફાર કરી લઈશું.

(‘બ’ને) પરંતુ તમે, દા.ત. તમે જે કરતા હતા તેને બદલે શું કરવાનું સૂચવો છો?

બ : તત્ત્વતઃ ‘અ’ એ જે સૂચવ્યું છે તેમ જ.

દા.

બ : ફક્ત ફેર એટલો છે કે બપોર પછીના સમયમાં શિક્ષકો વિદ્યાર્થીઓને અગાઉની જેમ અમુક નિશ્ચિત સમયે મળવા ઈરછશે.

નિશ્ચિત સમયે? વિદ્યાર્થીઓ શાળામાં નિયમિત સમયે આવે છે, નહિ?

બ : બપોર પછી દરરોજ ત્રણ પિરિયડ રાખીશું.

ત્રણ પિરિયડ?

બ : ૪૦-૫૦ મિનિટના ત્રણ પિરિયડ, એનો અર્થ એક અમે બપોર પછીના સમયમાં અગાઉની જેમ એ જ સિદ્ધાંત પ્રમાણે કામ કરીશું.

ત્રણ પિરિયડ? મને જરા વિચારવા દા.

ક : ત્રણ વર્ગો, એક પછી એક, માતાજી.

સ્કૂલ અમુક નિશ્ચિત સમયે ખૂલે છે, નહિ? વિદ્યાર્થીઓ પણ સમયસર આવતા હશે. એ લોડો ગમે ત્યારે આવી ન શકે.

અ : હા, માતાજી.

કારણ કે સ્વતંત્ર પ્રગતિનો અર્થ અનુશાસન હીનતા નથી...

અ : ના, ના. એ તો સમજાય તેવું છે.

વિદ્યાર્થીઓ પોતે સ્વતંત્ર છે માટે અર્ધા કલાક મોડા આવવાનું ન ચાલે, કારણ કે આ પ્રકારની સ્વતંત્રતા, સ્વતંત્રતા નહિ પણ અવ્યવસ્થા કહેવાય. દરેકે પોતે પોતાને માટે કડક શિસ્તનું ઘોરણ અપનાવવું જોઈએ. પરંતુ બાળક પોતે આત્મસંયમ કેળવવા શક્તિમાન હોતું નથી એટલે તેને શિસ્તપાલન પણ શીખવવું જોઈએ. એટલે ઓશે એક જ સમયે જાગો જવું જોઈએ, એક જ સમયે તૈયાર થઈ જવું જોઈએ અને એક જ સમયે શાળાએ જવું જોઈએ. આ વસ્તુ અનિવાર્ય છે, નહિ તો એક ભારે ગ્રંથવાડો ઉલ્લો કરશે.

અ : ૭-૪૫ કલાકે, માતાજી.

બરાબર, એટલે નિશાળ વિધિવત્ત રીતે ૮ વાગે ઉઘડશે.

અ : ૭:૪૫ કલાકે.

ના. શાળાનું મકાન ૭:૪૫ કલાકે ખૂલે છે.

એ : ના, ના....૭:૪૫ કલાકે વર્ગો શરૂ થાય છે.

આહ! એ લોકો ૭:૪૫ કલાકે શરૂ કરે છે, અને ક્યારે પૂરું કરે છે?

અ : ૧૧-૩૦ કલાકે.

૧૧:૩૦ કલાકે. ('બ')ને) તો તમે કહો છો કે બપોર પછી તમે...

બ : એ લોકો ૧:૫૦ કલાકે શાળાએ પાછાં આવશે.

૧-૫૦ વાગે અને તેઓ ક્યારે છૂટશે?

બઃ : ૪ કલાકે.

૪ કલાકે, એ લોકોએ ખેગાઉંડ ઉપર ક્યારે પહોંચવાનું હોય છે?

અ : માતાજી, લગભગ ૪:૩૦ કલાકે.

બઃ : ૪:૩૦ કે ૫ કલાકે.

અ : કેટલીક વાર પાંચ કલાકે.

એ લોકો ત્યાં જાય ત્યારે તેઓ કંઈક ખાતાં હશે, એમને કંઈક ખાવાનું આપતા હશો. એ ૪:૩૦ કલાકે થાય. ભલે એમ થઈ શકે છે...

બઃ : એમને ૩:૩૦ થી ૪:૩૦ વચ્ચે કંઈક ખાવાનું આપવામાં આવે છે.

જો એ લોકો બરાબર નિયમિત હોય તો એ શક્ય છે. પણ મારે સમજવું પડશે. — ‘ત્રાણ પિરિયડ’ એટલે એકના એક જ શિક્ષક ત્રાણ જુદા જુદા વર્ગો લે છે કે એના એ જ વિદ્યાર્થીઓ ત્રાણ જુદા જુદા શિક્ષકો પાસે જાય છે અને દરેક શિક્ષક દરેકને વ્યક્તિગત શિક્ષાણ આપે છે?

બઃ : મધુર માતાજી, ના. એમાં જરા જુદી રીત છે.

તો સ્પષ્ટ કરો. તમારા વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે?

બઃ : અમારા લગભગ દોઢસો વિદ્યાર્થી છે.

એકસો પચાસ! ભલે. તમારા દોઢસો વિદ્યાર્થી આવ્યા. પછી શું થાય છે?

બઃ : ત્યાં, દરેક વિદ્યાર્થીએ, અમુક મુકુરર કરેલા વર્ગમાં જવાનું હોય છે.

એકસો ને પચાસ? દોઢસો વિદ્યાર્થીઓ એક જ વર્ગમાં! અશક્ય!

બ : એક વર્ગમાં નહિ. અમે તેમને બે વર્ગમાં વિભાજિત કરીએ છીએ — ફેન્ચ અને અંગ્રેજુનાં જુદાં જુદાં ધોરણોમાં.

આહ ! એ બધા એક જ ધોરણમાં નથી હોતા.

બ : પાંચમાથી દસમા ધોરણના.\*

આહ, ઓહ, ઓહ ! અને આ દોઢસો વિદ્યાર્થીઓ માટે કેટલા શિક્ષકો હોય છે ?

બ : લગભગ ત્રીસ જેટલા શિક્ષકો.

ત્રીસ શિક્ષકો. ઠીક, પછી શું થાય છે ? તમારી પાસે કેટલા વર્ષો અને વર્ગોના રૂમ છે ?

બ : અમારી પાસે લગભગ પંદરથી સોણ રૂમો છે.

અને તમે બપોર પછીના વર્ગોમાં શું શીખવાડો છો ? જુઓ, તમે અમુક નિશ્ચિત વસ્તુઓ જ શીખવાડો છો કે પછી એ એક જ પ્રકારનું કામ હોય છે ?

અ : માતાજી, મને કહેવા દો... આમાં ફેર એ રહે છે કે અમે પ્રગતિને તરફના સ્વતંત્ર રાખવા માગીએ છીએ જ્યારે એ લોકો અમુક અંશો નિશ્ચિત વર્ગોને પહેલાંની જેમ ચાલુ રાખવા માગે છે.

નિશ્ચિત વર્ગો?

અ : એટલે કે નિશ્ચિત ધોરણો, અમુક નિશ્ચિત વિદ્યાર્થીઓ અને અમુક નિશ્ચિત શિક્ષક ...

આહ ! એટલે આમાં કેવળ શિક્ષકની ભણાવવાની પદ્ધતિમાં ફેર થશે પણ એ અમુક વિષય અમુક જ વિદ્યાર્થીઓને શીખવશે.

\* આ ઉલ્લેખ ધોરણો વિષે છે. બાળકોની ઉંમર વિષે નહિ.

અ : ... જે વિદ્યાર્થીઓ એ સમયે આવી ગયા હશે તેમને.

હા, હા એ ટીક છે. એ ચાલે. આનો અર્થ એ કે તમારે અમુક સમય માટે .... પણ એ વખતે તમે શું શીખવાડો હો? ભાષાઓ?

અ : તત્ત્વત : ભાષાઓ, હા, માતાજી.

આહ! એ કેવળ ભાષાઓ માટે જ છે.

અ : એ કેવળ ભાષાઓ માટે જ છે.

હું સમજુ. અને એ દોષસો વિદ્યાર્થીઓ માટે કેટલી ભાષાઓ હશે?

બ : સિદ્ધાંત તરીકે, ગ્રંથ, અંગ્રેજી, ફેન્ચ અને તેમની માતૃભાષા.

આહ! એ તો ધાણી થઈ ગઈ! બંગાળી, ગુજરાતી, હિન્દી, વળી તામિલ, તેલુગુ. આમ જ પાંચ ભાષાઓ થઈ ગઈ.

બ : સંસ્કૃત!

એના વિના ન ચાલે... દરેકે એ શીખવી જોઈએ. ખાસ કરીને આઈં જે રહેતા હોય તે બધાએ એ ભાષા તે શીખવી જ જોઈએ... કેવળ પંડિતોનું સંસ્કૃત નહિ... પણ બધા, બધા જ લોખકોનું, પછી તેઓ ગમે ત્યાં જન્મેલા હોય.

અ : માતાજી, સિદ્ધાંત રૂપે અમે એમ જ કરવા માગીએ છીએ — આવતી સાલથી બધાં જ બાળકને તેમની માતૃભાષા અને સંસ્કૃત શિખવાડીશું.

હા. કેવળ પંડિતાઈ મેળવવા માટેનું સંસ્કૃત નહિ, પણ એવું સંસ્કૃત, સંસ્કૃત — આને કઈ રીતે કહેવું — એવું સંસ્કૃત કે જેની દ્વારા, ભારતની અન્ય ભાષાઓનાં દ્વારા ખુલ્લાં થતાં હોય. હું ધારું છું કે એ અનિવાર્ય છે — આદર્શ એવો હોવો જોઈએ કે એક નવીનીકૃત સંસ્કૃત એ ભારતની પ્રતિનિધિત્વ ભાષા બની રહે, એટલે કે, એ

સંસ્કૃત એવી રીતે બોલાતું હોવું જોઈએ – ભારતની સર્વ ભાષાઓની પાછળ સંસ્કૃત છે અને એ એમ જ હોવું જોઈએ. અમે જ્યારે વાત કરતાં હતાં ત્યારે શ્રી અરવિંદનો ખ્યાલ એ મુજબનો હતો. કારણ કે, અત્યારે આખા દેશની ભાષા અંગેજુ છે, પણ એ અકુદ્ધરતની પરિસ્થિતિ છે. એ ભાષા બીજા દેશો સાથેના સંબંધો માટે ઉપયોગી છે, પણ જેમ દરેક દેશને પોતાની આગવી ભાષા હોય છે તેમ... અને અહીં જ્યારે કોઈને રાષ્ટ્રભાષા સ્થાપવી હોય છે ત્યારે બધા લોકો જગડવા માટે છે. દરેકને પોતાની ભાષા જોઈએ છે. એ તો મૂખ્યમીં છે. પણ કોઈએ સંસ્કૃત સામે વાંધો ન લેવો જોઈએ. એ બીજી ભાષાઓ કરતાં વધુ પુરાતન ભાષા છે અને એનો ધ્વનિ, ઘણા શબ્દોના ઘાતુરૂપ ધ્વનિ હોય છે.

શ્રી અરવિંદ પાસેથી હું આ વસ્તુ શીખી છું અને સ્પષ્ટ રીતે એ બહુ રસમદ છે. આમાંના કેટલાક ઘાતુઓ તો જગતની સર્વે ભાષાઓમાં મળી આવે છે – ધ્વનિ, ઘાતુઓના ધ્વનિ, બધી જ ભાષામાં મળી આવે છે, ત્યારે, આ, આ વસ્તુ શિખવાડવી જ જોઈએ અને એ જ રાષ્ટ્રભાષા હોવી જોઈએ. ભારતમાં જન્મેલા દરેક બાળકે એ ભાષા જાણવી જોઈએ – જેમ ફાન્સમાં જન્મેલા દરેક બાળકે ફેન્ચ જાણવું પડે છે તેમ. એ કાંઈ બરાબર બોલી શકતા નથી, એ લોકો એ ભાષા સાંગોપાંગ જાણતા પણ નથી હોતા, ઇતાં એમને થોડુંઘણું ફેન્ચ તો શીખવું જ પડે છે – અને દરેક દેશમાં એવું જ હોય છે. દરેક પોતાની રાષ્ટ્રભાષા શીખવી પડે છે. અને એ શીખ્યા પછી એ એને ગમતી હોય તેવી અન્ય ભાષાઓ શીખી શકે છે. અત્યારે આપણે જગડાઓના વાતાવરણની વચ્ચમાં છીએ અને કોઈ પણ નવી વસ્તુ કરવા માટે આ ઘણું ખરાબ વાતાવરણ છે. પણ એમ કરવું શક્ય બની શકે એ માટેનો દિવસ પણ આવશે,

એટલે હું અહીં સરળ સંસ્કૃત શીખવવામાં આવે તેમ ઈચ્છાનું છું. બને તેટલું સરળ. પણ “સરળીકૃત” નહિં- ફક્ત એના મૂળમાં જઈને... આ બધા ધ્વનિઓ, ઘાતુઓના ધ્વનિઓ કે જેમાંથી પાછળથી શબ્દો બનેલા છે. મને ખબર નથી કે અહીં કોઈ એવું કરી શકે તેવું છે કે નહિ. હકીકતમાં, હું જાણતી નથી કે ભારત સમગ્રમાં કોઈ એવું કરી શકે તેવું હોય, શ્રી અરવિંદ જાણતા હતા. પરંતુ જો કોઈ સંસ્કૃત જાણતું હોય તો એ કરી શકે... મને ખબર નથી. સંસ્કૃત શીખવવા માટે તમારી પાસે કોણ કોણ છે? ‘વ’?

વ : ‘વ’, ‘ડાયુ’.

‘ડબ્લ્યુ’? પણ એ તો અહીં કદી હોતા નથી.

બઃ એ ફેલુઆરીમાં પાછા આવનાર છે.

ધણ સમય પહેલાં ‘ક્ષ’ પણ હતાં.

બઃ ‘ક્ષ’..... અને કેટલાક જુવાન શિક્ષકો, ‘ચ’, ‘જ’ છે.

ના, આપણે કોઈ એવી વ્યક્તિ જોઈએ કે એ બરાબર જાણતી હોય. મેં એક વાર ‘વ’ને વાત કરલી, એ કહેતા હતા કે એ પોતે એક એવું સરળ વ્યક્તરાણ તૈયાર કરી રહ્યા હતા કે જે આખા દેશની ભાષા માટે ચાલે — એણે શું કર્યું તે હું જાણતી નથી. મને ખબર નથી. કદાચ ‘વ’ સૌમાં ઉત્તમ ગાળાય.

એટલે, બપોર પછીના શાળામાં તમારી પાસે કયા કયા શિક્ષકો હોય છે? તમે ત્રીસની વાત કરેલી.

બઃ બધા વર્ગો માટે, પાંચમા ઘોરણથી....

આખી શાળા માટે?

બઃ માધ્યમિક શાળા માટે, માતાજી.

એથી નીચેના વર્ગો સાથે તમારે નિસબ્બત નથી?

બઃ શિક્ષકોનું અન્ય જૂથ એ કામ કરશે.

હા, એ તો બરાબર, અને માધ્યમિક કક્ષામાં તમારે ત્રીસેક શિક્ષકો વચ્ચે લગભગ ૧૫૦ વિદ્યાર્થીઓ હશે, અને એ લાકો આવે છે ત્યારે શું જાણતા હોય છે? કંઈ નહિ? કિન્ડર ગાર્ટન વર્ગમાં પણ એમને ફેન્ચ શિખવાડે છે એમ મનાય છે, ખરું ને? એ લોકો એમની સાથે ફેન્ચમાં વાતચીત કરે છે. પણ મને ખબર નથી કે એ બાબતનું બહુ કડકાઈથી પાલન થતું હોય.

અ : બહુ કડકાઈથી નહિ, માતાજી.

બહુ નહિ, હે?

ડ : પહેલાં એ બાબતમાં કડક ધોરણ હતું. હવે ઘણો-ખરો સમય એ લોકો હિન્દીમાં વાતચીત કરે છે.

જ્યારે બાળકો બહુ નાનાં, તદ્દન કુમળી વયનાં હોય છે ત્યારે એ લોકોને રમવું ગમે છે, એમનામાં... એમનામાં કોઈ વસ્તુએ પાસાદાર આકાર લીધો હોતો નથી અને એવે સમયે એક જ વસ્તુને જુદી જુદી ભાષામાં જુદાં જુદાં નામે ઓળખવામાં આવતી હોય તે જાણી તેમને ખુબ મજા પડે છે. એમનામાં હજુ... અથવા એમનામાં હજુ કોઈ પ્રકારનું માનસિક જરૂરાનું પાસું હોતું નથી. એમનામાં હજુ એવી નમનીયતા હોય છે, જેથી એ લોકો જાગો છે કે વસ્તુ માત્ર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી હોય છે અને તેને આપેલાં નામ તો એક સગવડભરી ગોઠવણ હોય છે. એટલે હું ધારું છું કે એમને માટે કોઈ વસ્તુનું નામ એ એક પરંપરાગત આદતની વસ્તુ હોય છે. એટલે ઘણાં બાળકોને અમુક અમુક વસ્તુ કહેવાની દ. ત. ‘હા’ અને ‘ના’ ની બહુ મજા પડે છે. આ બે શર્બદો ‘હા’ અને ‘ના’ લો, જેમાં કોઈ વસ્તુને સ્વીકારવામાં કે ઇન કારવામાં આવે છે. ફેન્ચમાં એને આમ કહે છે, જરૂરનીમાં આમ, અંગજીમાં આમ, ઈટાલિયનમાં આમ, હિન્દીમાં આમ, સંસ્કૃતમાં તેને કહે છે કે... આ એક બહુ ગમત પડે તેવી રમત હોય છે. જો તમે એવા બાળકને કેમ રમાડવું એ જાણતા હો તો તમે કોઈ વસ્તુ લઈને એને કહી શકો છો, જુઓ. આ વસ્તુ છે ને તે આવી છે... એમાં કોઈ નાનું ગલુડિયું, કોઈ નાનું જીવંત પક્ષી, કોઈ નાનો છોડ અને પછી તેને કહો કે “જુઓ, આ બધી ભાષાઓ છે અને...” એમની અંદરની પાટી તદ્દન સાફ હોય છે, એ લોકો આ વસ્તુ સારી પેઠે શીખી શકે છે, ઘણી સહેલાઈથી. એ એક ઘણી મજા પડે તેવી રમત બને છે. (‘બ’ ને) પણ આ વસ્તુ સાથે તમારે નિસ્બત નથી, તમે તો અગાઉથી જ...

ભલે. એટલે, સ્વાભાવિક રીતે તમારા ત્રીસ શિક્ષકો અને ૧૫૦ વિદ્યાર્થીઓ છે, તો તમારે... એ લોકો જુદા જુદા વર્ગોમાં જાય છે, જેને જે ભાષા ભાગવી હોય ત્યાં, એ તદ્દન સ્વાભાવિક છે અને લગભગ અનિવાર્ય જેવું લાગે છે, કારણ કે બધા જ શિક્ષકોને ભેગા કરવાથી કોઈ હેતુ સરતો નથી — એ લોકો વાતો કરવા માંડશો — અને પછી પાછા વિદ્યાર્થીઓ આવશે એ તો એક ભારે... ના! એ બરાબર છે.

જ્યારે કોઈને અંગેજ ભણવું હોય ત્યારે તે અંગેજના વર્ગમાં જાય, ફેન્ચ ભણવું હોય તો ફેન્ચના, જ્યારે...

ક : એ વસ્તુ સાવ એવી નથી.

તો પછી?

બ : સવારમાં એવું હોય છે ખરું.

તો તમે શું ભણાવો છો?

બ : હું ગણિત ભણાવું છું.

એને અને ભાષાઓને કશો સંબંધ નથી!

બ : અને ઈતિહાસ

તમે ગણિત ફેન્ચ ભાષામાં શીખવાડો છો? હા, પણ તો પછી, આ પ્રશ્ન વધુ ગૂંઘવાડાભર્યો બને છે... શું (હસાહસ) શું વાત છે? ('બ'ને) તમારે મને શું કહેવાનું છે?

અ : ('બ' તરફ વળીને) આપણો શું સમજવીએ?

બ : આપણે જે કરવા માગીએ છીએ તે જ.

ક : તમારા મૌખિક વર્ગો પણ હોય છે?

બ : મૌખિક વર્ગો કેવળ ભાષાઓ માટે નહિ પણ ગણિત અને વિજ્ઞાન માટે પણ.

અ : માતાજી, એ લોકો ભાષાઓ, ગણિત અને વિજ્ઞાન માટે ફક્ત બપોર પછી, નિશ્ચિત કરેલા વર્ગો ચાલુ રાખે છે. સવારનો સમય સ્વતંત્ર કાર્યો માટે અનામત રાખેલો હોય છે. બપોર પછી એ લોકોના વર્ગો, ત્રણ વિષયો માટે નક્કી કરેલા રહે છે, જ્યારે સવારમાં એવું કંઈ...

ભાષાઓ?

અ : ભાષાઓ, ગણિત, વિજ્ઞાન... અને ઈતિહાસ પણ...

વિજ્ઞાન?

અ : વિજ્ઞાન પણ ખરું, દા, ગ્રાફ્ટિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાનશાસ્ત્ર.

દા, એ તો આખી દુનિયા છે. પછી શા માટે? તો પછી શું બચ્યું? સાહિત્ય? અને બીજું શું? તમારું વિજ્ઞાન સર્વ વિષયોને આવરી લે છે તો પછી સાહિત્ય જ બાકી રહે છે, અને પછી? કલા? સ્વાભાવિક રીતે આ...

અ : ('બ')ને તમે બધા જ વિષયો માટે નક્કી કરેલા વગ્ાં રાખો છો?  
(માતાજીને) માતાજી, સારાંશ એ છે કે બપોર પછીના સમયમાં એ લોકો કંઈક અંશો અગાઉની જેમ જ નક્કી કરેલા વગ્ાંની વ્યવસ્થા ચાલુ રાખે છે.  
પરંતુ એની સરખામણીમાં સવારનું કામ સ્વતંત્ર હોય છે.

હવે મને જિજ્ઞાસા થાય છે. ભાષા કઈ રીતે ભાષાવો છો? કારણ કે કોઈ શિક્ષક સૌને એક જ વાત કહે છે... એ લોકો બહાર આવે છે ત્યારે કશું સમજ્યા હોતા નથી! ભાષા તો એક એવી વસ્તુ છે જે ખૂબ ખૂબ જીવંત હોવી જોઈએ! અને એમાં જીવન આવી શકે તે માટે એમાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લેવો જોઈએ. એ લોકોએ કેવળ બાંડડા ઉપર બેઠેલા કાન બની રહેવાનું નથી! નહિ તો એ લોકો જ્યારે બહાર આવશે ત્યારે કશું સમજ્યા નહિ હોય.

અ : માતાજી, અમને લાગેવળગે છે ત્યાં સુધી ભાષાનું શિક્ષણ આ રીતે ગોઠવેલું છે : લેખિત કામની બાબતમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે અંગત સંબંધ હોય છે. અને જે કોઈ મૌખિક કામ હોય છે, સભાઓ, વગેરે, તેમાં અને બાળકોની સમક્ષ દરરોજ અનેક શક્યતાઓ રજૂ કરીએ છીએ  
અને તેઓ આ કે તે પ્રવૃત્તિમાં જોડવા માટે સ્વતંત્ર હોય છે.

શક્યતાઓ?

અ : ઉદાહરણ તરીકે જુદા જુદા વિષય ઉપર વાતચીત અને ચર્ચા થાય છે — દા.ત. કેટલાંક બાળકો વિજ્ઞાનનો વિષય પસંદ કરે છે તો બીજાં કેટલાંક ચાલુ સમયની ઘટનાઓ પસંદ કરે છે, વગેરે. અથવા એમાં કોઈ નાટ્યરચના, વગેરે પણ સામેલ થઈ શકે છે. આ બધી વસ્તુઓ વિષે બાળકોને આગલા દિવસે કે તે જ દિવસે અગાઉથી જાગ્રા કરવામાં આવી હોય છે; એમણે વર્ગમાં જવાનું હોય છે ખરું, પણ કયા તે, તેઓ પસંદ કરે છે... અને જે કાંઈ વ્યાકરણ, લેખન વગેરે હોય છે તે બધું એમાં આવી જાય છે.

હા, કારણ કે બાળકોને ભાષા તો પહેલેથી જ આવડતી હોય છે. (“બ’ને) અને તમે?

અ : એની બાબતમાં પણ એમ જ છે.

(‘અ’ને) હા, એમ હો તો એ બરાબર છે.

(‘બ’ ને) પણ તમારા બપોર પછીના વર્ગો... એમાં તમે શું કરવાના છો? એના જેવું કે બાળકો બાંકડા ઉપર બેઠાં રહે અને શિક્ષક એનું ભાષણ આપ્યે જાય? મારા પ્રભુ, એમાં તો કેટલો બધો કંટાળો આવે! પહેલાં તો શિક્ષકને જ કંટાળો આવે અને એ પછી એ વિદ્યાર્થીઓને આપે.

આમાં આપણે એક આવી વ્યવસ્થા ગોઈવી શકીએ: તમે ગમે એક વિષય લો પછી શિક્ષકે ગમે ત્યાં, ગમે તે પ્રશ્નો પૂછ્યવા: બોલો, આ વિષયમાં તમે શું કહો છો? આ વિષયમાં તમે શું જાણો છો? અને એવી રીતે આગળ. અને આમ કરીએ તો, જો બીજા બધા ધ્યાન દઈને સાંભળતા હશે તો એમને ફાયદો થશે. એવી કોઈક વ્યવસ્થા ગોઈવવી જોઈએ કે જેમાં કાંઈક જીવંત વસ્તુ હોય — એવું કોઈ કંટાળાજન ક ભાષણ ન હોય કે જે સાંભળીને પાંચેક મિનિટ પછી બધાને ઊંઘ આવવા લાગે, તમે પશ્નો પૂછ્યો, અથવા તો, જો ત્યાં કોઈ પાટિયું હોય તો તેના ઉપર મોટા મોટા અક્ષરે કોઈ પ્રશ્ન લખો અને પૂછ્યો : બોલો, આનો કોણ જવાબ આપી શકે તેમ છે?” આમ કર્યા પછી તમે આમતેમ પ્રશ્નો પૂછ્યતા રહો, જેઓ માગણી કરતા હોય તેમને પૂછ્યો... અને જ્યારે કોઈએ ઉત્તર આપ્યો હોય ત્યારે પછી વળી તમે પૂછ્યો: “તમારામાંથી કોઈ આમાં કાંઈ ઉમેરી શકે તેમ છે?” શિક્ષકમાં પોતાનામાં થોડી જીવંતતા હોવી જોઈએ.

દું સમજી શકું છું — દરેક ભાષા માટે એક વર્ગ રાખવાનું અને જુદાં જુદાં શૂપો

રાખવાનું – બપોર પછીના ગાળા વિષે હું એ સમજું શકું છું. પણ પ્રભુને ખાતર એવું ન કરશો..., પેલા બધા, બાંકડા ઉપર બેઠા હોય તે એમનાં ઘડિયાળો જોયા કરે તે, "હું આ ક્યારે અટકશો?" સોમાં એક પણ એવો શિક્ષક નથી કે જે સૌં કોઈને મજા પડે તેમ કરી શકે. અને પ્રથમ તો એને પોતાને જ કંટાળો આવે છે. અને માટે.. અહીંનાં, પણ બહુરાના જગતમાં તો એ વસ્તુ એની આજીવિકા હોય છે, એટલે...

તમારે વીસ, ત્રીસ કે ચાલીસ વિદ્યાર્થીઓને લેવા... તમે કેટલાને એક સાથે લો છો? વીસ? લગભગ વીસ?

### બ : હા, માતાજી

તો પછી એમ કરો : 'જુઓ, આપણે થોડી ગમ્મત કરીએ, આપણે ગમ્મત કરવા માટે શું કરીશું. આપણે કઈ રમત માંડિશું?' અને આમ, સ્વાભાવિક રીતે તમે નવી નવી વસ્તુઓ શોધી કાઢી શકો છો. અને શિક્ષકને પોતાને જાગ્રત રહેવું પેડ છે કારણ કે એને કંઈક શોધતા રહેવાનું હોય છે. વિદ્યાર્થીઓ પણ એવા હોય છે... એમનામાં પણ થોડું સ્વાભિમાન હોય છે એટલે એ લોકો પણ કંઈક કહેવા ઈચ્છતા હોય છે, અને એને લઈને વાતાવરણમાં જીવંતતા આવે છે. તમે ઘેર રહીને ભાણતા હો એના કરતાં આ રીત વધુ રસદાયક નથી? જો તમે ગ્રામાણિક હશો, તો તમે, પછીના દિવસે લેવાના વર્ગ માટે આગલી સાંજે તૈયારી કરશો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરીને નોંધ કરી લશો, અને તમે જે વિષય લેશો તે માટે તૈયારી કરશો. સમજ્યાને, એટલે કે તમે એવી તૈયારી કે જેથી તમે દરેક પ્રશ્નના જવાબ આપી શકો. આમ તો એ વસ્તુ સહેલી છે. પણ જો તમે તમારો વિષય બરાબર પાકો કરેલો હોય તો વધુ સારું. રાત્રિ દરમ્યાન તમે થોડોક પ્રકાશ અને પ્રેરણા પામવાને માટે પ્રયત્ન કરો, કે જેથી બીજા દિવસે તમે જે વસ્તુ જાણતા હો તે જીવંતરૂપે જીવવાનો અનુભવ થાય. શિક્ષકો અને વિદ્યાર્થીઓ..ના! એવાં જીવંત સ્વરૂપોનું એ ગ્રૂપ હોવું જોઈએ જેમાનાં થોડા બીજા કરતાં વધુ જાણતા હોય? બસ.

અ : માતાજી, હું એક બીજો પ્રશ્ન છે, અગત્યનો પ્રશ્ન છે, આપે એવું ઘણી વાર કંબું છે કે કોઈ પણ પ્રશ્નનો સાચો ઉત્તર તો કેવળ અંતરની નીરવતામાં જ પ્રામણ થઈ શકે. તો, બાળકોને આ પ્રકારની નીરવતા સ્થાપિત કરવાનું કઈ રીતે શીખવી શકાય? શાનને બદલો ચેતનાને સ્થાપિત કરવી હોય તો તેનો

## આ જ ઉપાય છે ને?

(લાબું મૌન)

જુઓ, આ પ્રકારના વર્ગોની પદ્ધતિ, જેમાં બધા બેઠલા હોય અને ત્યાં શિક્ષક હોય, અને કામ માટેનો સમય પણ મર્યાદિત હોય ત્યારે આમ કરવું શક્ય નથી. એ તો જ્યારે આંતરિક નીરવતા સ્થાપિત કરવા માટે તમને સંપૂર્ણ સ્વતંત્રતા હોય ત્યારે તમે મૌન રહી શકો પણ જ્યારે બધા વિદ્યાર્થીઓ વર્ગમાં ભેગા થયેલા હોય અને શિક્ષક પણ હોય... અને શિક્ષક પોતાની અંદર નીરવતા સ્થાપિત કરતો હોય, અને વિદ્યાર્થીઓ... ના, એમ કરવું શક્ય નથી.

તમે તમારે ઘેર, રાત્રિ દરમ્યાન, આગળના દિવસો નીરવતા ધારણ કરી શકો, તૈયારી કરી શકો, પણ વર્ગના દિવસે તો એવું ન થઈ શકે... એ વસ્તુ તાત્કાલિક અમલી બનાવી શકાય એવો કોઈ નિયમ નથી. એ તો કુદરતી છે કે તમે ચેતનાની ખૂબ ઉચ્ચ અવસ્થામાં હો અને તમે તમારા મનને તદ્દન નીરવ રાખતાં શીખેલા હો ત્યારે તમે એમ જ કરો; પણ હજી તમે એ કક્ષાએ પહોંચેલા નથી, તમારામાંથી કોઈ એ કક્ષાએ પહોંચેલા નથી. એટલે એના વિષે વાત ન કરવી જ સારી, એટલે હું માનું છું કે વર્ગ દરમ્યાન... ખાસ કરીને આ પ્રકારની પદ્ધતિ કે જેમાં મર્યાદિત સમયના વર્ગો હોય છે; વિદ્યાર્થીઓ, શિક્ષક અને વિષય પણ નક્કી કરેલા હોય છે... ત્યારે તમે ત્યાં સક્રિય રહો એ વધારે સારું.

એવું હોવું જોઈએ... જો વિદ્યાર્થીઓ પોતે ધ્યાનનો અભ્યાસ કરવા માગતા હોય, એકાગ્રતા કરીને... સ્વયંસ્કૃતાણની ભૂમિકા સાથે સંપર્ક સાધવા માગતા હતા — કેવળ મનોમય ઉત્તરને બદલે એવું કાંઈક ગ્રાપ્ત કરવા માગતા હોય — ઉદ્ઘંમાંથી કોઈ પ્રકાશ અને જીવંત વસ્તુ ગ્રાપ્ત કરવા માગતા હોય ત્યારે... પણ એવી ટેવ ઘરે રહ્યા હોય ત્યારે કેળવી લેવી જોઈએ.

કુદરતી રીતે, જો કોઈને આવી ટેવ હશે, તો વર્ગમાં — જ્યારે શિક્ષક પ્રશ્ન પૂછતા હશે, પાટિયા ઉપર પ્રશ્ન લખેલો હશે અને પૂછતા હશે કે, “આનો ઉત્તર કોણ આપે છે?” ત્યારે એવી વ્યક્તિ આમ કરીને (શ્રી માતાજી પોતાના હાથ પોતાના કપાળ ઉપર મૂકું છે) કંઈક ઝીલશે, ઓહ! અને પછી કહેશે... પરંતુ આપણે એ અવસ્થાએ પહોંચ્યા હોઈશું ત્યારે ઘણા આગળ વધેલા હોઈશું.

એમ નથી હોતું ત્યારે તેઓ તેમના મગજના ભંડારમાંથી પોતે જે કાંઈ શીખેલા હોય છે તેને બહાર આણે છે, એ કંઈ બહુ રસપ્રદ તો નથી હોતું, પરંતુ એથી તેમને માનસિક વ્યાયામ તો મળે છે. અને વર્ગની પદ્ધતિ એક લોકશાહી પદ્ધતિ

છે, ખરુંને? કારણ કે... તમારે મર્યાદિત સમયમાં અને મર્યાદિત જગ્યામાં... તમારે શક્ય તેટલી વધુ સંઘાને ભાણવવાનું હોય છે, કે જેથી સૌ કોઈને લાભ થાય. આ એક તદ્દન લોકશાહી ભાવના છે. એટલે એમાં એક પ્રકારની... સમતલતાની જરૂર રહે છે, હવે... તમે એ સૌને એક જ સ્તર ઉપર મૂકો એ તો શોચનીય છે. પરંતુ જગતની અત્યારની અવસ્થામાં આપણે એમ કહી શકીએ છીએ કે “આટલું તો હજુ જરૂરી છે.” કેવળ પૈસાપાત્ર લોકોનાં બાળકોને બીજી રીતની વ્યવસ્થા પોષાય... સ્વાભાવિક રીતે એ વસ્તુનો વિચાર કરવો ગમે તેવું નથી. ના, આ તો આખી વસ્તીનો, પ્રાથમિક વર્ગની બાબતનો પ્રશ્ન છે... ઓસ્ટોવિલ માટે. અને એ પ્રશ્ન રસદાયક હશે : જે બાળકો ગમે ત્યાંથી આવ્યા હોય, જેમને પોતાને ઘરે અભ્યાસ કરવાની સગવડ ન હોય, જેમનાં માતા-પિતા અજ્ઞાન હોય, જેમને માટે અભ્યાસ કરવાની કોઈ શક્યતા ન હોય; તદ્દન, બિલકુલ, સાવ કાચી સામગ્રી; એમ — આપણે તેમને જીવન જીવતાં કર્દ રીતે શીખવીશું? એ એક રસદાયી પ્રશ્ન હશે.

આ : માતાજી, અમે જે વસ્તુ ગઈ સાલ કરી છે તેને માટે અમે બાળકના વ્યક્તિત્વના સંબંધે સંપૂર્ણપણે માનલાયક બન્યા હોઈશું. સંપૂર્ણ, હરેક ક્ષણે — બાળકની ગણતરી હશે, એ કચા ગૂપ્તાનું છે એની અગત્ય નહિ હોય. બિલકુલ નહિ. અને પછી, મેં આપને હમણાં જે પ્રશ્ન પૂછ્યો હતો તેની બાબતમાં એવું છે કે સવારના સમયમાં, કાર્ય કરવાની પદ્ધતિ જરા જુદા પ્રકારની છે, કારણ કે એ કાર્ય સ્વતંત્રતાપૂર્વક કરવામાં આવે છે. એટલે એવી પરિસ્થિતિમાં, કદાચ બાળકો...

હા, ત્યાં, સવારમાં, સ્વતંત્ર પ્રગતિના વર્ગોમાં જે રીતે કામ કરે છે તે રીતે... એ લોકો ભલે એમ કરેઃ મૌન રહીને અંતરમાં એકાગ્રતા કરીને બહાર અને ભીતરમાં બધી જ ગરબડ શાંત પાડી દઈ નીરવ બની જઈને રાહ જોઈ શકે. સવારમાં એ લોકો એમ કરી શકે, ના, મારા કહેવાનો આશય એ છે કે જ્યારે તમારે પોણા કલાક-કલાકનો વર્ગ લેવાનો હોય... બધા વિદ્યાર્થીઓ અને શિક્ષક એ માટે એકઠા થયા હોય... ત્યારે તમારે સતત કામ કરતા રહેવું પડે છે. જો પોણા કલાક માટે સૌ કોઈ શાંત — નીરવ બની રહી શકે તો તે ભારે મજા પડે... (હસાહસ).

તરત પુરતું તો એમ થઈ શકે કે તમે તમારા અભ્યાસક્રમમાં કોઈ વિષય નક્કી કરો, તમે બેસો અને વિદ્યાર્થીઓને કદો, “એક — પા કલાક માટે આપણે સૌ શાંત-

નીરવ બની રહીએ, બસ માત્ર અવાજ નહિ, કોઈ કશો અવાજ નહિ કરવાનો. આપણે પા કલાક માટે શાંત બની રહીશું. પા કલાક માટે સંપૂર્ણ શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરવા સાથે સ્થિર બનીને ધ્યાન આપીશું, અને પા કલાકને અંતે આપણે જોઈશું કે એમાંથી શું આવે છે.” તમે શરૂઆતમાં પાંચ, ત્રણ કે બે મિનિટ રાખો તો પણ ચાલે — પા કલાક જરા લાંબા સમય ગણાય પણ તમારે પ્રયત્ન કરવો જોઈએ... કેટલાક વિદ્યાર્થીઓ ઉંચાનીયા થવા લાગશે. બાળકોમાંનાં બહુ થોડાં સ્થિર રહી શકે છે; નહિ તો એ લોકો ઉંઘી જાય છે. પણ એ લોકો ઉંઘી જાય તો પણ કશો વાંધો નહિ. તમે એકાદ વાર તો આવો અખતરો કરી શકો : “આપણે જોઈએ કે પા કલાક માટે શાંત રહ્યા પછી મારા પ્રશ્નનો ઉત્તર કોણ આપી શકે છે? આમાં એવું નથી કરવાનું કે દસ મિનિટ તો તમે એ વિષયમાં જે કંઈ મનોમન રીતે જાણતા હો તે સૌ વસ્તુઓને પકડવા પ્રયત્ન કરતા હો, ના, એમ નહિ — દસ મિનિટ તો એવી જ હોવી જોઈએ જેમાં તમે, આમ, ખાલી, નીરવ, ધ્યાનસ્થ બન્યા રહો... ધ્યાનસ્થ અને શાંત.”

અને જો આવા પ્રસંગે, શિક્ષક એક ખરો શિક્ષક હશે તો એ આ દસ મિનિટ દરમ્યાન, સ્વંયસ્કુરાણાના પ્રદેશમાંથી જ્ઞાન લાવીને આખા વર્ગ ઉપર ફેલાવી શકશે. આ રીતે તમે થોડું રસદાયક કામ કરી શકશો, અને પરિણામો પણ જોઈ શકશો. પછી, શિક્ષક પોતે પણ થોડીક પ્રગતિ કરવા પ્રયત્ન કરશે. તો પ્રયત્ન કરી જોજો... પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે.

**આ : એમે આ વસ્તુનો અખતરો કરી જોયો છે, માતાજી.**

જુઓ, આમાં એવું છે કે જેઓ અત્યંત સત્યનિષ્ઠ, સર્યાઈભર્યા અને — આને કંઈ રીતે કહેવું? — તેમની અભીષ્ટામાં તદ્દન સીધા હોય છે, તે અદ્ભુત મદદ છે એક તદ્દન જીવંત, અને સક્રિય ચેતના તેમની અભિમુખ નીરવતામાં પ્રત્યુત્તર વાળવા તૈયાર હોય છે. આ રીતે તમે છ વર્ષનું કામ છ માસમાં પરૂં કરી લઈ શકો છો, પણ એમાં... એમાં કોઈ જાતનો ડેણ ન હોવો જોઈએ, એમાં કોઈ વસ્તુની નકલખોરી ન હોવી જોઈએ, અને એમાં કંઈ ઘમંડ પણ ન હોવો જોઈએ. એમાં... તમારે સાચી રીતે તદ્દન પ્રમાણિકતાપૂર્વક, શુદ્ધ, સત્યનિષ્ઠ, સભાન બનીને... ઊર્ધ્વમાંથી આવતી વસ્તુની પ્રતિકૃતિઝ્ય બની રહેવું જોઈએ. અને ત્યારે... ત્યારે... ત્યારે તમે રાક્ષસી પગલે આગળ વધી શકો છો.

**પરંતુ વસ્તુ રોજની, નિયમિત, કોઈ નિશ્ચિત સમયે કરવાની વસ્તુ ન બનાવી**

મૂકશો, કારણ કે એની પછી ઘરડ પડી જાય છે અને કંટાળો ઉપજાવે છે. એ વસ્તુ... “અણધારી રીતે બનવી જોઈએ! અચાનક તમે કહો કે આહ! ઘરો કે આપણે આમ કરીએ તો...” તમે થોડાક આત્મસ્થ હો, થોડાક તૈયાર હો ત્યારે આ વસ્તુ રસદાયક બને છે.

તમે જે પ્રશ્ન પૂછો તે બને તેટલો બુદ્ધિપૂર્વકનો હોવો જોઈએ, કોઈ ચીલાચાલુ કે ઘારણા ઉપર રચાયેલો પ્રશ્ન ન હોવો જોઈએ – ના, એ પ્રશ્ન જરાક જીવંત હોવો જોઈએ. તો એમાં મજા પડે.

(મૌન)

જ્યારે આ રીતે તમે પ્રાપ્તિ કરવાનો પ્રયત્ન કરશો ત્યારે તમને જાણાઈ આવશે કે તમારી પ્રકૃતિમાં – નિમ્ન પ્રકૃતિમાં, એટલે કે નિમ્ન મન, નિમ્ન પ્રાણ, ભૌતિક ચેતનામાં – કેટલો બધો ઘમંડ, આંદંબર અને મહત્વાકંશા છવાયેલાં છે... ગમે તે વસ્તુનો ઉપયોગ એ માટે કરો છો... મોટા દેખાવાની ભાવનાનો તદ્દન, પાયામાંથી ત્યાગ થઈ જવો જોઈએ અને એ સ્થાને સત્યનિષ્ઠ અભીષ્ટાની જ્યોતિ પ્રગટવી જોઈએ, અભીષ્ટાની એવી શુદ્ધ જ્યોતિ જે આપણને કેવળ પરમ ચેતનાની આપણી પાસેની અપેક્ષા મુજબ જીવન જીવાડે, એ પોતે આપણી પાસે જે કરાવવાની અપેક્ષા રાખતી હોય તે જ વસ્તુ કરીએ. એની ઈચ્છા મુજબ, જ્યારે જે કરાવવાની અપેક્ષા રાખતી હોય તેમ કરીએ ત્યારે પછી વસ્તુસ્થિતિ બદલાઈ જાય છે... આ વસ્તુ આપણા માર્ગમાં જરા દૂરની વસ્તુ છે, છતાં આપણે તે કરવા પ્રયત્ન કરવો જોઈએ, આપણા સમગ્ર સ્વરૂપને શુદ્ધ કરવાનો આવો પ્રયત્ન કરવો જોઈએ જે...

ત્યારે પછી શાળા, વિદ્યાર્થીઓ કે શિક્ષકો કંટાળાની વાત નહિ રહે ત્યારે ... પછી જીવન જ પોતાનું પરિવર્તન માગશે. ત્યારે, આ આપણો આદર્શ અને મંત્ર્ય છે.

તમારે બીજા કોઈ પ્રશ્નો પૂછવાના છે?

અ : માતાજી, આપ શાળાના પ્રથમ ડિવસ ૧૬મી ડિસેમ્બરના ડિવસ માટે, બાળકો માટે કોઈ સંદેશ આપશો?

જો એ આવશે તો આપીશ.

‘ઈ’, મને પુષ્પો આપો, ત્યાં પેલાં લાલ પુષ્પોવાળી ફૂલદાની છે. ત્યાં, ત્યાં આ બે જણા માટે છે. ત્યાં.

(‘અ’ને) લો, આ તમારે માટે છે.

(‘બ’ને) અને આ તમારે માટે છે. તમારે... તમારે માટે આખું ભાવિ આગળ ખુલ્લું પેલું છે. તમારે તમારી જૂની રીતે વિચારવાની ટેવના બંધનને તોડી નાખવું જોઈશો... તમે આટલા બધા લાંબા સમયથી અહીં રહ્યા છો એનો પૂરતા પ્રમાણમાં લાભ ઉઠાવ્યો નથી, હજુ તમે ઘણા અંશે અગાઉ જેવા છો.

એટલે હવે, તમારે એમ કરવું કે, બધી વસ્તુઓને ભાંગી નાખવી. કેવળ ઉર્ધ્વમાંથી આવતા પ્રકાશને આધારે જ જીવો. તમારી ચેતનાને મુક્ત કરો. આ વસ્તુ અગત્યની છે. તમે આવ્યા તે સાંદું કર્યું. તમે આમ તદ્દન તમારી જૂની ટેવોમાં બંધાયેલા છો અને... હજુ કાંઈક વધારે છે, વારસાગત સંસ્કારોનો બોજો અને એવું બીજું બધું... સૌને માટે એવું હોય છે, પણ, અત્યારને માટે તો કેવળ... હું હજુ પણ તમને મુક્ત કરી રહી છું. તમે હજુ એવા ને એવા જ છો — એવા ને એવા, એવા ને એવા જ છો — તમારી જૂની આદતો — બહુ જૂની નહિ — શિક્ષાણી જૂની ટેવો. એટલે એ બધાને... આમ કરીને ભાંગી નાખો! જ્યારે તમે વર્જિમાં જાઓ ત્યારે દરરોજ, વર્જિમાં પેસતાં પહેલાં એક પ્રાર્થના કરજો, પરમ ચેતનાનું આરાધન કરજો, અને તેને વિનંતી કરજો કે આ સર્વ ભસાલાને, જીવતા પદાર્થના ભસાલાને તેના પ્રભાવ હેઠળ લઈ લે. ત્યાર પછી એ વસ્તુ જીવંત અને રસપ્રદ બનશો, તમે સમજ્યાને? એમ છે.

આવજો,

અને હવે ‘ડ’ને માટે એક ગુલાબ.

(‘ડ’ને) લો. હવે જુઓ, આ વસ્તુ વધુ સક્રિય છે. તમે એ જોઈ નહિ શકો પણ એ વસ્તુ વધુ સક્રિય છે.

પરંતુ સ્વી, સ્વીઓ, મૂળમાં તો કાર્યકારક શક્તિ હોય છે. એ વસ્તુ તમારે કદી ભૂલવી નહિ. અને તમારે જો પ્રેરણા પ્રાપ્ત કરવા માટે કોઈ પુરુષ-ચેતનાનો આધાર લેવો હોય તો લઈ શકો છો. પરમ ચેતના તો સૌથી વધુ, નિશ્ચિત હોય છે, છતાં, જો તમારે કોઈ સાંકળનારી વ્યક્તિ જોઈતી હોય... પરંતુ સક્રિય રૂપ આપવાને માટે તો તમારામાં જ એવી શક્તિ છે જે સર્વ વસ્તુઓને વિગતવાર અમલમાં લાવી શકે અને સુવ્યવસ્થિત કરી શકે. આ વસ્તુ હું પાલભેન્ટની સભ્યા સ્વીઓમાં રેંગ છું — તમે જાણો છો કે પાલભેન્ટમાં સ્વી સભ્યો છે. અને હું તેમને આ વસ્તુ શીખવાનું છું. પુરુષોને આધીન કદી ન રહેશો. તમારામાં જ સક્રિય શક્તિ છે. આની અસર થશો જ.

(‘અ’ અને ‘બ’ને) ઓહ! આ વસ્તુ તમને ઉતારી પાડવા માટે નથી...

(હસાઇસ). પ્રેરણા આપે છે... અને તેને સહીય રૂપ આપવામાં આવે છે... બસ.

એટલે મેં તમને આપ્યું છે. તમને પણ આપ્યું છે... ('ઈ'ને) તમે - તમને તો મેં કશું આપ્યું નથી. એ ત્યાં છે!

લો. અને આ 'ક'ને માટે છે.

બસ ત્યારે. આવજો મારાં બાળકો.

('અ'ને અને તમારે જ્યારે જરૂર પડે ત્યારે મને લખજો. હું એમ નથી કહેતી કે હું તરત જ ઉત્તર આપીશા, પણ આથી જેમ (શ્રી માતાજી તેમના હૃથ કપાળ ઉપર ભૂકે છે), હું તરત જ ઉત્તર આપ્યું છું. તમારે એ પદ્ધતિ શીખી લેવી જોઈશો, ખરું ને? એમ, (લખતાં) સમય લાગે છે. ઇતાં, મને માહિતગાર રાખવી એ સારું છે.

અ : હા, માતાજી.

આવજો.

\*

## ૮ ફેબ્રુઆરી ૧૯૭૩

અ : અમે નવી પદ્ધતિ સ્થાપિત કરી શકીએ ત્યાં સુધી અમારી જાતને તૈયાર કરવાનો ઉત્તમ માર્ગ કયો?

કુદરતી રીતે, એ માટે તમારે તમારી ચેતનાને વિશાળ કરવી પડશે — પરંતુ એ કઈ રીતે થાય? તમારી પોતાની ચેતના... એને વિશાળ અને આલોકિત કરવાની છે. અને તમે બધાં જો તમારા ચૈત્ય સ્વરૂપને શોધી કાઢીને એની સાથે તાદાત્મ્ય કરી શકો તો બધા જ પ્રશ્નોનો ઉકેલ આવી જશે.

ચૈત્ય સ્વરૂપ એ મનુષ્યમાં પરમાત્માનો પ્રતિનિધિ છે. એમ છે, સમજયા — પ્રભુ પોતે કાંઈ દૂર અને અગોચર વસ્તુ નથી. પ્રભુ તમારામાં છે જ, પણ તમે એમના વિષે સંપૂર્ણપણે સભાન નથી. એના કરતાં તમારામાં... અત્યારે એ એક હાજરી કરતાં પ્રભાવના સ્વરૂપે વધારે કાર્ય કરે છે. એ હાજરી સભાન બનાવી જોઈએ. હરેક ક્ષણે તમે તમારી જાતને પૂર્ણી શકો કે શું... કઈ રીતે... પ્રભુ જુઓ છે. એવું છે એ : પ્રથમ તો પ્રભુ એને કઈ રીતે જુઓ છે, પછી પ્રભુ એના વિષે

કઈ જાતનો સંકલ્પ કરે છે અને છેવટે પ્રભુ કઈ રીતે કાર્ય કરે છે. એમાં થઈ શકે તે માટે તમારે કોઈ અગમ્ય ભૂમિકાઓમાં જવાની જરૂર નથી, એ બરાબર અહીં જ છે. ફક્ત એટલું જ કે, હાલ પૂર્તું, આપણી બધી જૂની આદતો અને સામાન્ય ચેતના વડે એની ઉપર એક આવરણ આવી જાય છે જે તમને અને જોવા દેતાં નથી અને અનુભવવા દેતાં નથી. તમારે અને આગળ ઊંચે લાવવી જોઈએ.

ખરી રીતે, તમારે એનાં સભાન કરણો બની રહેવું જોઈએ... સચેતન... પ્રભુ વિશે સભાન.

સામાન્ય રીતે આમ થતાં આખી જિંદગી ચાલી જાય છે, કેટલાક લોકોને તો એ માટે અનેક જન્મો લેવા પડે છે. અહીં, અત્યારની પરિસ્થિતિમાં તમે એ વસ્તુ થોડાક મહિનાઓમાં સિદ્ધ કરી શકો છો.

### (લાંબું મૌન)

તમને કંઈ અનુભવ થયો, તદન સાચું કહો તમને કંઈ લાગણી અનુભવાયેલી કે પછી તમને કશો ફેર લાગેલો નહિ. સાચું કહો? કેમ? કોઈ જવાબ આપતું નથી, (માતાજી દરેક વ્યક્તિને પૂછે છે અને સૌ પોતપોતાનાં પ્રતિકાર્યો વિષે કહે છે).

**બ :** મધુર માતાજી, હું આપને પૂછી શકું કે કોઈ ખાસ વસ્તુનું અવતરણ થયેલું?

કોઈ અવતરણ નથી થયેલું. એ એક બીજો ખોટો જ્યાલ છે: કશાનું અવતરણ થયું નથી. આ તો એક એવી વસ્તુ છે જે હુંમેશાં અહીં હાજર છે અને જેને તમે અનુભવતા નથી.

ચોથું પરિમાણ શું એ તમે જાણો છો? એ શું છે તેની તમને ખબર છે?

**બ :** અમે એના વિશે સાંભળ્યું છે...

તમને એનો અનુભવ છે?

**બ :** મધુર માતાજી, ના.

આહ! પરંતુ આધુનિક વિજ્ઞાનનો એ ઉત્તમ પ્રકારનો અભિગમ છે, ચતુર્થ પરિમાણ. આપણે માટે પ્રભુ પોતે ચતુર્થ પરિમાણમાં છે... ચતુર્થ પરિમાણની અંદર. એ હુંમેશાં સર્વ સ્થળે હાજર હોય છે. એ આવતું કે જતું નથી. એ હુંમેશાં સર્વ સ્થળે હાજર હોય છે. કેવળ આપણો મૂર્ખતાને કારણે આપણે એનો અનુભવ થતો અટકાવીએ છીએ. જતા રહેવાની લેશમાત્ર જરૂર નથી, લેશમાત્ર નહિ, જરા પણ નહિ, બિલકુલ નહિ.

ચૈત્ય સ્વરૂપ વિષે સભાન થવા માટે તમારે ચતુર્થ પરિમાણ વિષે એક વાર સભાન થવું જોઈએ, નહિ તો એ શું છે તે તમે જાણી નહિ શકો.

મારા પ્રભુ! સિતેર વર્ષથી હું જાણું છું — સિતેરથી વધુ વર્ષોથી જાણું છું કે ચતુર્થ પરિમાણ એ શું વસ્તુ છે!

(મૌન)

અનિવાર્ય અનિવાર્ય! જીવનની શરૂઆત તેની સાથે થાય છે. નહિ તો પછી આપણે અસત્ય, ગોટાળા અને ગુંચવાળામાં અને અંધકારમાં પડ્યા રહીએ છીએ. મન, મન, મન, મન! નહિ તો તમારે તમારી ચેતના વિષે સભાન થવા માટે એને મનોમયરૂપ આપવું પડે છે. એ તો ભયંકર, ભયંકર છે! બસ.

અ : માતાજી, નવું જીવન એ જૂના જીવનનો તંતુ ચાલુ રાખતું નથી, નહિ? એ ભીતરમાંથી બહુર આવે છે.

હા, હા...

અ : એ બેમાં કશું સામાન્ય નથી હોતું...

છે, છે, પણ તમે એના વિષે સભાન નથી. પણ તમારે થવું જોઈએ, થવું જોઈએ... તમારું મન તમને એનો અનુભવ થવા દેતું નથી, તમારે... તમે સર્વ વસ્તુઓને મનોમય આકાર આપો છો, સર્વ વસ્તુઓને... વસ્તુઓ વિષે વિચાર કરવો એને તમે ચેતના કહો છો, એને તમે ચેતના કહો છો : વસ્તુઓ વિશેના વિચારને પણ એ તો કોઈ પણ અંશો ચેતના નથી. ચેતના તો સંપૂર્ણ પણે સ્વરચ્છ પ્રવાહી જેવી અને “શાદો વિનાની” હોવાનું શક્ય બનવું જોઈએ.

(મૌન)

ત્યાં, દરેક વસ્તુ પ્રકાશિત અને ઉભાભરી બને છે... બળવાન! અને શાંતિ, સાચી શાંતિ, જે કોઈ જડતા કે અચલતા નથી.

**અ : માતાજી, આ વસ્તુ અમે બાળકોને એક ધ્યેય તરીકે આપી શકીએ?**

બધાને... નહિ. શારીરિક રીતે સરખી ઉમર હોવા છતાં એ સૌની ઉમર એક સરખી હોતી નથી. કેટલાંક બાળકો એવાં છે... જે તદ્દન પ્રાથમિક અવસ્થામાં છે. જો તમે તમારા ચૈત્ય સ્વરૂપ વિષે સભાન હશો તો તમને ખબર પડશે જ કે ક્યાં બાળકોમાં ચૈત્ય સ્વરૂપનો વિકાસ થયેલો છે. કેટલાંક બાળકોમાં, ચૈત્ય સ્વરૂપ હજુ ગર્ભાવસ્થામાં છે. ચૈત્ય સ્વરૂપની ઉમર એકસરખી નથી, લેશમાત્ર નહિ, સામાન્ય રીતે ચૈત્ય સ્વરૂપ પોતાનું ઘડતર કરવા માટે અનેક જન્મો લે છે, અને એ જ, એક દેહમાંથી બીજા દેહમાં જાય છે અને જેથી આપણાં આપણા ભૂતકાળના જન્મોનું જ્ઞાન નથી : કારણ કે આપણે આપણા ચૈત્ય સ્વરૂપ વિષે સભાન નથી. પરંતુ કેટલીક વાર કોઈક ક્ષણે ચૈત્ય સ્વરૂપ કોઈ ઘટનામાં ભાગ લે છે; સભાન બને છે, અને એ વસ્તુ સમરણમાં રહે છે. આપણને કેટલીક વાર... કેટલીક વાર થોડું ઘણું યાદ આવે છે, કોઈ સંજોગો કે ઘટના, કે વિચાર કે પછી કોઈ કાર્ય — કારણ કે ચૈત્ય સ્વરૂપ સભાન હતું.

તમે એ વસ્તુ કેવી છે એ જુઓ છો, હું હવે સો વર્ષની નજીક પહોંચતી જાઉં છું. હવે પાંચ જ વર્ષ બાકી છે. મેં મારા સ્વરૂપ વિષે સભાન બનવાનો પ્રયત્ન પાંચ વર્ષની ઉમરે કરેલો, બેટા. આ તમને જાણવા માટે કહું છું... અને હું આગળ ચાલી જાઉં છું, એ પણ ચાલ્યો જાય છે. કેવળ,... અલભત, હું એવા બિંદુએ પહોંચ્યો છું જ્યારે હું શરીરના કોષાજુઓ માટે કાર્ય કરું છું. પણ એ કાર્યની શરૂઆત લાંબા સમય અગાઉ કરેલી.

આ વસ્તુ તમને નિરુત્સાહ કરવા માટે નથી... એ ફક્ત તમને એ બતાવવા માટે છે કે એ વસ્તુ કંઈ આપોઆપ બની જતી નથી!

શરીર... શરીર હજુ પણ એવા પદાર્થનું બનેલું છે જે ઘણો ભારે છે, અને અતિમાનસનો આવિર્ભાવ થવા માટે એ પદાર્થે પોતાનું રૂપાંતર કરવું જોઈએ.

બસ ત્યારે.

\*

## ૧૪ ફેબ્રુઆરી ૧૯૭૩

(બાળકો સાથે કરવાના કામની વ્યવસ્થા સંબંધે એક પ્રશ્ન કરવામાં આવેલો  
ત્યારે શ્રી માતાજીએ નીચે જણાવ્યા પ્રમાણે જણાવેલું :)

પરંતુ આમાં મુશ્કેલી એક જ વસ્તુની છે. માબાપો. જ્યારે બાળકો માબાપ સાથે રહેતાં હોય છે ત્યારે મને એ નિરર્થક લાગે છે, કારણ કે માબાપો તો તેઓ જેમ ભાગેલાં તેમ તેમનાં બાળકો ભાગે, સારી નોકરી લે, પૈસા કમાય એવી અપેક્ષાઓ રાખે છે — આ બધું આપણી અભીસાની વિરુદ્ધનું છે.

જે બાળકો તેમનાં માબાપ સાથે રહે છે તેમનું શું કરવું. ખરેખર મને સમજ નથી પડતી. બાળકો ઉપર તેમનાં માબાપોની એટલી બધી અસર હોય છે કે છેવટે તેઓ બીજી કોઈ સ્થળની શાળામાં જવા માપણી કરે છે.

સૌ મુશ્કેલીઓમાં એ મોટી છે — સૌમાંથી — અને એ છે માબાપની અસર અને આપણે જો માબાપની અસર નાભૂદ કરવા પ્રયત્ન કરીએ તો એ માબાપો આપણી વિરુદ્ધ જશે અને એ તો પહેલો કરતાં પણ ખરાબ, કારણ કે એ લોકો આપણે માટે ખોટી વાત કરશો. બસ.

મારો અનુભવ એ જાતનો છે. સૌમાંથી નવ્વાંણું બાળકો આડે રસ્તે ગયાનું કારણ તેમનાં માબાપ હોય છે.

આ વસ્તુ મને અનિવાર્ય લાગે છે. આપણે એક પરિપત્ર કાઢવો જોઈએ કે “જે માબાપોની ઈચ્છા તેમનાં બાળકોને સામાન્ય રીતનું શિક્ષણ આપવાની, સારી નોકરી મેળવતાં શીખવવાની, તેમની આજીવિકા રણવાનું શીખવવાની, તેમની કારકિર્દી જળકતી થાય તેવું શીખવવાની હોય, તેમણે તેમનાં બાળકોને અહીં મોકલવાં નહિ”. બસ.

આપણે એમ કરવું જોઈએ... એ અગત્યનું છે, જુઓ, વાત એમ છે કે ઘણાં માબાપો તેમનાં બાળકોને અહીં મોકલે છે તેનું કારણ એ છે કે અહીંનો ખર્ચ ઓછો આવે છે. અને એ તો સૌથી ખરાબ, ખરાબ વસ્તુ છે. આપણે... આપણે આપણે... તેમને ચોખ્યેચોખ્યું કહી દેવું જોઈએ કે “જો તમારે તમારાં બાળકોને ઉજજવળ કારકિર્દી માટે અને પૈસા રણતાં શીખવા માટે મોકલવાં હોય તો અહીં ન મોકલશો.”

બસ.

અ : માતાજી, આપ કહો છે તે પ્રમાણેનો પરિપત્ર લખીને તેનો મુસદ્કો આપને વાંચી સંભળાવીશ. હું, ‘બ’ અને બીજા મળીને એ કરીશું.

ઘણાં બાળકો બહુ સારું કામ કરતાં હતાં અને ઘણાં સુખી હતાં. રજાઓમાં તેઓ તેમનાં માબાપ પાસે ગયા અને તદન બદલાઈ જઈ, બગડી જઈને પાછાં આવ્યાં. અને જો આપણે એમને એ વસ્તુ કહીશું તો એમનાં માબાપ તેમને કહેશે, “અરે, આ લોકો ખરાબ છે, એ લોકો તમને માબાપની સામે થવાનું શીખવાએ છે.” એટલે એવું થયું જોઈએ કે... માબાપને તેમનાં બાળકોને મોકલે તે પહેલાં તેમને ખ્યાલ રહેવો જોઈએ.

મારો આ પ્રકારનો અનુભવ, ઘણાં, ઘણાં, ઘણા, ઘણાં વર્ષોથી છે! ભય બાળકોનો નથી, એમનામાં આળસ નથી, એવું પણ નથી કે બાળક સામાં થાય છે : ભય, મહાન ભય તો માબાપો તરફથી છે.

જેઓ તેમનાં બાળકોને અહીં મોકલે તેમણે વસ્તુસ્થિતિ સમજીને મોકલવાં જોઈએ. તેમણે જાણવું જોઈએ કે અહીંની પદ્ધતિ અન્ય સ્થળો જેવી નથી અને ઘણાં નહિ આવે... અને જેઓ આવે છે તે ઓછા ખર્ચને કારણે આવે છે, ભલે, તેઓ મોકલવાનું બંધ કરે.

(જ્યારે શિક્ષક વિદાય લેવાની તૈયારી કરતા હૃતા ત્યારે શ્રી માતાજીએ  
કહ્યું :)

મારી એવી ઈચ્છા છે... કે લોકો તેમનાં બાળકોને મોકલે તે પહેલાં આપણાં વલણ તેઓ જાણી લે, કારણ કે એ પરિસ્થિતિ દ્યાપાત્ર છે કે બાળકો ખુશ છે પણ માબાપો નથી. અને એમાંથી કેટલીક વિચિત્ર અને કેટલીક વાર ભયંકર પરિસ્થિતિ સર્જય છે. આ વસ્તુ ખૂબ ખૂબ અગત્યની છે!

\*

૧૮ ફેબ્રુઆરી ૧૯૭૩

અ : આજે હું આપને ‘ક્ષ’નો એક પત્ર વાંચી સંભળાવું છું. ઓણે આ પત્ર ઓના વર્ગ સંબંધે આપેલો છે. આપ જાણો છોકે આ વર્ષે ઓણે નાનાં બાળકો સાથે કામ કરવાનું શરૂ કર્યું છે.

ઓહ!

અ : એટલે એ આમ લખે છે, “આપણો એવું ઈરછીએ છીએ કે બાળક પોતાનો સર્વાંગી વિકાસ સાધી શકે. અને સૌથી વધુ તો આપણો એમ ઈરછીએ છીએ કે એ માટે તેનામાં તેની ઈરછા આપોઆપ જાગ્રત થાય”. (પછી પત્રમાં બાળકો માટે સૂચવેલી રમતો, એમને માટે તૈયાર કરેલી સામગ્રી, અને જુદાં જુદાં રૂપની પ્રવૃત્તિઓનો ઉદ્દોખ છે. આગળ લખ્યું છે) : “પરંતુ જ્યારે બાળકોને તકન સ્વતંત્રતા આપવામાં આવે છે ત્યારે એમનામાંની બધા પ્રકારની પ્રવૃત્તિઓ આગળ આવે છે અને એમાંથી મુશ્કેલીઓ સર્જય છે, ખાસ કરીને એ લોકો જે જાતની કિયાઓ કરે છે અને ધોંઘાટ કરે છે તેમાં. થોડા દિવસ અગાઉ એ લોકોએ એમના મિકેનોમાં તલવાર અને પિસ્તોલો બનાવેલી.”

ઓહ!

અ : (આગળ વાંચે છે) : “અમે તેઓ ભજવી શકે તેવું એક નાટક તૈયાર કરેલું અને આશા રાખેલી કે આ બધું થોડા વખત પછી શાંત પડી જશે. પણ અમારે આ હિંસકવૃત્તિ, યુદ્ધ કરવા મત્યેનો અભિગમ — અરે ડિટેક્ટિવ નવલકથાઓ વિષે શું કરવું?”

તમારી પાસે લખવાનું કરી છે?

અ : હા.

જ્યાં સુધી મનુષ્યમાં અહુંકાર અને કામના આગળ પડતાં છે ત્યાં સુધી હિંસાની જરૂરિયાત રહેવાની... બરાબર છે ને?

અ : હા, માતાજી.

પરંતુ હિંસાનો ઉપયોગ ફક્ત તમારા ઉપર કોઈ હુમલો થાય ત્યારે કેવળ આત્મરક્ષણ માટે કરવો. આપણે જે આદર્શ સિદ્ધ કરવા ઈરછીએ છીએ અને જેની ગ્રત્યે

માનવજીતિ આગળ વધી રહી છે તે એ છે કે માનવજીતિમાં સમજદારી સ્થપાય અને સર્વસાધારણ સામંજસ્યમાં કોઈની જરૂરિયાત સંતોષાય એ વસ્તુ લક્ષમાં રહે.

અ : હા, માતાજી.

ભવિષ્યમાં હિંસાની જરૂર નહિ રહે; કારણ કે સૌની ઉપર પ્રભુનું સાપ્રાજ્ય સ્થપાશે અને એમની ચેતનામાં સર્વ વસ્તુઓનું સામંજસ્ય સ્થપાઈ દરેક વસ્તુ પરિપૂર્ણતાને પામશે.

અ : હા, આપે જે કહ્યું તે હું વાંચી બતાવું છું માતાજી, ('અ' એ નોંધ વાંચે છે).

આ બરાબર છે ને?

અ : હા, માતાજી, તદ્દન બરાબર

એટલે, એક સામાન્ય રીત તરીકે, જ્યારે વસ્તુસ્થિતિ આ પ્રકારની ઊભી થાય, જ્યારે બાળકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતાં હોય ત્યારે શું કરવું તે બાબતમાં 'ક્ષ' એ પૂછેલું છે કે "અમારે એમાં હુસ્તક્ષેપ કરવો કે આખી પ્રવૃત્તિ એની મેળે શરીર જાય કે અદૃષ્ય થઈ જાય તેની રાહ જોવી?"

તમારે બાળકોને જાણો અમસ્તા પૂછતા હો તેમ પૂછવું, "ઓહ! તમારે દુશ્ભાનો છે?" "ઓ દુશ્ભાનો કોણા છે?"... તમારે એમ કહેવું... એમને થોડાં વાતે વળગાડવાં... એ લોકો એ વસ્તુ જોઈ શકે છે કે... લશ્કરમાં એક બળ અને સૌન્દર્ય હોય છે જેનો બાળકો બહુ તીવ્રપણે અનુભવ કરે છે. પણ એ વસ્તુ જળવાઈ રહેવી જોઈએ. ફક્ત લશ્કરનો ઉપયોગ હુમલો કરીને કબજો જમાવવા નહિ પણ સંરક્ષાણ માટે કરવો જોઈએ અને...

અ : રક્ષણ કરવા.

...અને રક્ષણ કરવા. બરાબર છે.

પ્રથમ તો એ (શિક્ષકે) સમજવું જોઈએ. હાલની ક્ષાળો આપણો એવી સ્થિતિમાં છીએ કે હૃથિયારોની દજી જરૂર રહે છે. આપણો એ વસ્તુ સમજી લેવી જોઈએ કે

આ એક પ્રવાહી સ્થિતિ છે, છેવટની નહિ અને આપણે એ છેવટની સ્થિતિ પ્રત્યે ગતિ કરવાની છે.

શાંતિ — શાંતિ, સંવાદ — ચેતનાનાં આ સ્વાભાવિક પરિણામો હોવાં જોઈએ.

અ : અને માટે જ અનો બીજો પ્રશ્ન છે. માતાજી એ કહે છે — હું આપને ચાદ આપું કે એના હુસ્તકનાં બાળકો આદિથી દસ વર્ષનાં છે — એ કહે છે કે, “જ્યારે આ એક એવી ઉમર છે કે જ્યારે મનોમય અભિગમની માંડણી થવાની શરૂઆત થયેલું ઘણાં બાળકોમાં દેખાય છે, ત્યારે અમે આ મનોમય પ્રવૃત્તિનો કરી રીતે ઉપયોગ કરીને એવી રીતે સમૃદ્ધ બનાવીએ કે જેથી તેમની આંતરિક સ્વાભાવિકતાને આંચ ન આવે?”

અનો ઘણો આધાર દરેક કેસ, અને બાળક ઉપર રહે છે!

જુઓ, ભારત વિષે આ અહિંસાનો ખ્યાલ છે — જેમાં સ્થૂલ હિંસાનું સ્થાન સૂક્ષ્મ હિંસાએ લીધું છે — પણ એ તો એથી પણ ખરાબ છે!

તમારે એમને આમ સમજાવવું... તમારે બાળકોને એમ સમજાવવું કે સ્થૂલ હિંસાને બદલે નૈતિક હિંસા આચરવી એ કંઈ સારી વસ્તુ નથી.

એ ટ્રેન સામે સૂર્ય જઈને તેને પસાર થતી અટકાવવામાં જે સૂક્ષ્મ હિંસા રહેલી છે તે એવા બધા ક્ષોભ ઉપજાવે છે કે જે નૈતિક હિંસા કરતાં વધુ ખરાબ હોય છે. તમે... મને સાંભળો છો ને?

પણ અનો આધાર બાળક અને કેસ ઉપર રહે છે. તમારે એમને કોઈ નામ ન આપવાં, એમ ન કહેવું કે અમુક અમુક આમ કહેલું. આપણે તેમને વિચારો અને પ્રતિકાર્યોની સમજ આપવી.

તમારે સમજાવવું... એ એક સારો દાખલો છે : તમે એક ટ્રેન આગળ સૂર્ય જઈને તેને અટકાવો એ એક મોટી હિંસા છે... એની ઉપર શાંકો વડે હુમલો કરો તેથી પણ વધુ ખરાબ. તે તમે સમજો છો ને, આવી ઘણી ઘણી વસ્તુઓ ગ્રસંગ પ્રમાણે કહી શકાય છે.

મેં પોતે પણ પણ્ણાબાજુને ખૂબ ઉતેજન આપેલું કારણ કે અને લઈને એક પ્રકારની કુશળતા, અને હિંસામાં પોતાની કિયાઓ અને અનુશાસન ઉપર ભારે કાબૂ આવે છે. એક વાર મેં પોતે પણ્ણાબાજુને ખૂબ ઉતેજન આપેલું અને ગોળીભાર કરતાં પણ શીખેલી. હું પિસ્તોલ વડે અને રાઇફલ વડે પણ ગોળીભાર કરતી કારણ કે અને લઈને તમારામાં સ્થિરતા, કુશળતા અને પાંકું નિશાન લેવાની અદ્ભુત શક્તિ

આવે છે અને એનાથી તમને ભય ઉપજે તેવી પરિસ્થિતિમાં પણ અવિચલ રહેતાં આવે છે. મને સમજાતું નથી કે કેમ આ બધી વસ્તુઓ... આપણે નિરાશાવાદી અહિંસક બની જવું ન જોઈએ — એને લઈને તો આપણું પોત પાતળું પડી જાય છે.

જો એ બાળકોને જુએ છે... શું હતું? એ લોકો તરવાર બનાવતાં હતાં?

અ : હા, માતાજી, એ લોકો મિકેનોમાંથી તરવાર બનાવતાં હતાં.

એ શિક્ષકે એ પ્રસંગે એમ કહેવાની તક ઝડપી લેવી જોઈએ કે, “ઓહ, તમારે પણાબાજી શીખવી જોઈએ!”

અને પિસ્તોલ પણ?

અ : હા, માતાજી.

અને તેમને કહો.. ગોળીબાર કરતાં શીખો... એને એક કલા બનાવો, એને એક કલા અને શાંતિ અને આત્મસંયમપૂર્વકની કુશળતાની તાલીમ તરીકે અપનાવો. કોઈએ કદી... કદી ઉદ્ઘાપોછ ઉભો ન કરવો જોઈએ... એ જરા પણ ચાલશે નહિ, જરા પણ નહિ, લેશ માત્ર નહિ. હું એ વસ્તુના પક્ષમાં નથી. આત્મરક્ષાણની પદ્ધતિઓ ઉપર ગ્રભુત્વ મેળવવું જોઈએ અને એની પ્રેક્ટિસ કરવી જોઈએ.

(આ ક્ષણે ‘અ’એ ઉત્તર ફાન્સના ફલેન્ડર્સમાં તીરંદાજી કરવામાં આવે છે તેનો ઉલ્લોભ કરેલો પણ બરાબર સ્પષ્ટતા ન કરવાને કારણે શ્રી માતાજી એમ સમજેલાં કે એ રમવાનાં તીર-કામકાંની વાત કરે છે.)

એ લોકો પક્ષીઓને મારવા માંડશે.

અ : પરંતુ માતાજી, આપણી પાસે અહીં તીરંદાજી માટેની સગવડ નથી અને એથી એ બાબતમાં મુશ્કેલી છે.

એ લોકો વસ્તુઓને બગાડશો. હું બહુ... અલબત જો... પરંતુ એ લોકોએ બરાબર સમજુ લેવું જોઈએ કે એ વસ્તુ આત્મ-રક્ષા માટે છે, બીજા કશા માટે નહિ.

ના, આમાંથી અક્સમાતો સર્જય. મને લાગતું કે આ વસ્તુ ડહાપણ ભરેલી છે. જો એ લોકો રસ બતાવે તો તમે એમને પટાબાજી અને શુટિંગ શીખવાડજો, એટલે કે એમ, જે વસ્તુ હું ‘ક્ષ’ને લખું છું... જો એ કોઈ બાળકને એમ કરતાં જુએ તો

એણે... (શ્રી માતાજી જાણે કોઈ જુગુપ્સાજનક વસ્તુ સામે હોય તેમ હાથ ઊંચા કરે છે), એણે તેમને કહેવું જોઈએ. એને તેમને સમજાવતાં આવડવું જોઈએ કે, “આ વસ્તુ તમને તમારા સનાયુઓ ઉપર કાબૂ આપે છે, એ તમને કઠણ, શાંત અને આત્મસંયમવાળા બનવાની ફરજ પાડે છે”. એથી ઊલટું આનાથી એમને એક સરસ પાઠ શિખવાડવાની તક મળે છે. પણ પ્રથમ તો તમારે સમજવું જોઈએ અને પછી તેમને સમજાવતાં આવડવું જોઈએ તેમને સમજાવવું જોઈએ કે સૂક્ષ્મ અને સ્થૂલ હિંસા એકસરખાં ખરાબ છે. સૂક્ષ્મ અહિંસા વધુ ખરાબ પણ હોઈ શકે. એટલે કે સ્થૂલ હિંસા, કંઈ નહિ તો તમને મજબૂત, આત્મસંયમવાન બનાવે છે જ્યારે સૂક્ષ્મ હિંસા... તમે આવા બની રહી શકો (શ્રી માતાજી, દેખીતી શાંતિનો અભિનય કરે છે) અને છતાં તમારામાં ભયંકર સૂક્ષ્મ રીતની હિંસાખોરી હોઈ શકે છે.

\*

## ૨૪ ફેબ્રુઆરી ૧૯૭૩

અ : આજે સાંજે આપની પાસે હું ‘ક્ષ’નો એક પત્ર વાંચું છું જે, આપે આ અગાઉના તેની ઉપરના પત્રમાં તેના પ્રશ્નના ઉત્તર રૂપે કહેલું તેને અનુલક્ષીને છે. “અમે જોયું છે કે ઘણાં બાળકોમાં ભૌતિક ચેતનાને અનુસરતી અત્યંત બળવાન પ્રાણમય મરૂત્તિ હોય છે. બીજાં કેટલાંકને માટે એ કેવળ રમત માત્ર હોય છે. એક છોકરો એવો પણ છે કે વરંડા ઉપર માર્ય કરે છે અને કહે છે કે એ ‘શ્રી માતાજીના લશ્કરમાં’ એક સૈનિક થવાનો છે. આવા જુદા જુદા કેસો અંગો આપ કંઈ ચોક્કસ નિર્દેશ કરવા માગો છો”?

શેની કૂચ કરે છે?

અ : એ વરંડામાં માર્ય કરે છે.

છેડા ઉપર તો નહિ ને?

અ : ના. ના. પછી એ ‘એબાઉટ-ટર્ન’ કરે છે, એ ‘એટેન્શન’ની અદામાં ઊભો રહે છે અને કહે છે, ‘હું શ્રી માતાજીના લશ્કરમાં સૈનિક બનવાનો છું’.

એ તો ઘણું સારું.

## અ : આગળ વાંચું, માતાજી ?

હા, હા.

અ : “સૂક્ષમ હિંસાની બાબતમાં હું સમજું શકતી નથી કે પ્રકૃતિનાં ક્યાં તત્ત્વો એનાં નિર્દેશક ગણાય. ઉ. ત. કેટલાંક બાળકો રીસાય છે, જે કોઈ એના તરંગોને અટકાવે છે તેની સામે સામો થાય છે, એને કહેવાય? આવી બાબતમાં શું કરવું યોગ્ય ગણાય કે જેથી અંતે તેમનું ઝ્યાંતર થઈ શકે?”

મને લાગે છે કે બાળકોની આવી નાની નાની પ્રવૃત્તિઓને બધું અગત્યતા ન આપવી — એમ કરવાથી તો એમને ઉતેજન મળે છે — તમારે એ તરફ ધ્યાન ન આપવું, એવું ન જણાવી દેવું કે તમે એને અગત્યતા આપો છો. એ વસ્તુનો નિકાલ કરવાનો સૌથી ઉત્તમ માર્ગ, એને અગત્ય આપવા કરતાં ધ્યાન ન આપવું તે છે. આવી બધી પોતાની જાતને અગત્યતા આપવાની બાળકોની નાની નાની પ્રવૃત્તિઓ પ્રત્યે તમારે દુર્લક્ષ કરવું. તમે ધ્યાન આપો છો એવું ન જણાવો — એટલા માત્રથી, એમને ભળતો માનસિક ટેકો ચાલ્યો જાય છે. જો કોઈ બાળક રીસાય તો બિલકુલ ધ્યાન ન આપો. આને લઈને રીસાવાની ટેવનો ટેકો તૂટી પડે છે, સમજ્યાને?

અ : હા માતાજી.

બાળકોની આવી બધી નાની નાની પ્રવૃત્તિઓને તમારે કશી અગત્યતા આપવી નહિ... જરાપણ અગત્યતા ન જ આપવી....

અ : કારણ કે જો તેમના લક્ષ્યમાં આવે છે કે તમે અગત્યના આપો છો તો એમને ફરી વાર એમ કરવાની લાલચ થાય છે.

ખરી વાત છે!

બાળકોમાં પોતા પ્રત્યે ધ્યાન ખેંચવાની સાહજિક વૃત્તિ હોય છે. પેલો અગાસી ઉપર પોતે સૈનિક હોવાનો દેખાવ કરતો છોકરો... અને એના જેવી વસ્તુઓ. એમને એમ કરવા દેવું, કશી અગત્ય આપવી નહિ. એમને ધમકાવશો નહિ, ખાસ કરીને, ધમકાવશો તો નહિ જ, ફક્ત ધ્યાન ન આપવું.

બાળકો નિર્ભળ પ્રાણીઓ હોય છે એટલે પોતે વિચિત્ર દેખાઈને પોતાની પ્રત્યે ધ્યાન ખેંચી શકશે તેમ ઘારે છે. એમને એ જ્યાલ આવવો જોઈએ કે એ યુક્તિ કામ લાગતી નથી.

**અ : અને અમારે એમને ધમકાવવાં નહિ, ખરું?**

ઓહ, ખાસ કરીને એમ તો ન કરશો. એમને ધમકાવશો તો નહિ જ, એ ખાસ અગત્યનું છે. એવું કરો તો શિક્ષકો પણ બાળકો જેટલા જ ખરાબ બને છે. જ્યારે શિક્ષક ધમકાવે છે ત્યારે એનાથી એવી છાપ ઉઠે છે કે એણે પોતાના મગજનો કાબૂ ગુમાવ્યો છે. એનો અર્થ એ કે એ વિદ્યાર્થીના સ્તર ઉપર આવી ગયો છે. તમારે હુંમેશાં હુસ્તાં રહેતાં... હુંમેશાં... શીખવું જોઈએ.

**અ : એ ઘણું અગત્યનું છે.**

ઘણું, ઘણું, ઘણું અગત્યનું.

(“બ” શ્રી અરવિંદે લખેલા, પૃથ્વી ઉપર અતિમાનસ આવિર્ભાવમાંથી વાંચે છે:)

“અતિમનસ એ તેના મૂળમાં એક ઝડત ચેતના છે. એ ચેતના સર્વદા અજ્ઞાનથી પર હોય છે. અજ્ઞાન એ આપણા હુલાના ગ્રાન્ટ્ટિક અથવા ઉત્કાંતિગામી અસ્તિત્વનો પાયો છે. આપણામાં રહેલી ગ્રફ્ટિ એમાંથી આત્મજ્ઞાન અને વૈશ્વિક જ્ઞાન અને સાચી ચેતના અને વિશ્વમાંના આપણા અસ્તિત્વનો સાચો ઉપયોગ શો એ જાણવા પ્રયત્ન કરે છે. અતિમનસ પોતે ઝડત ચેતના હોવાથી, એની અંદર આ પ્રકારનું જ્ઞાન અંતર્દીત હોય છે અને તેના સત્ય અસ્તિત્વની શક્તિ હોય છે. એનો માર્ગ સીધો હોય છે અને તે પોતાના લક્ષ્ય પ્રયે સીધે- સીધી ગતિ કરે છે. એનું ક્ષેત્ર વિશ્વાળ હોય છે અને તેને અમર્યાદિત પણ બનાવી શકે છે. આનું કારણ એ છે કે એની ગ્રફ્ટિ જ જ્ઞાનની છે અને એની અંદર જ્ઞાન, સ્વાભાવિકપણે રહેલું હોય છે : એટલે એને માટે જ્ઞાન પ્રાપ્ત કરવાપણું હોતું નથી. એ જ્યારે પગલાં માર્ડ છે ત્યારે અચિત્ત કે અજ્ઞાનમાંથી કોઈ અર્ધપ્રકાશ પ્રત્યે નહિ, પણ સત્યમાંથી મહુત્તર સત્ય પ્રત્યે; સાચા સંવેદનમાંથી વધુ ગહુન સંવેદન પ્રત્યે, અંત:પ્રજ્ઞામાંથી

અંતઃપ્રકાશમાંથી વધુ અમર્યાદ અને નિતાંત જજવદ્યતા પ્રત્યે, વિસ્તરતી વિશાળતામાંથી તદ્દન અમર્યાદ વિસ્તાર પ્રત્યે અને અનંતતા પ્રત્યે ગતિ કરે છે. એનાં ઉદ્ઘર્ષ શિખરો ઉપર એ દિવ્ય સર્વજ્ઞતા અને સર્વ શક્તિમત્તા ધારણા કરે છે. છતાં જ્યારે એ ઉત્કાંતિમય ગતિમાં પોતાનો કંબિક રીતનો આવિર્ભાવ કરે છે, જેને પરિણામે, અંતમાં તેની ઉદ્ઘર્ષતમ શિવરાવલીઓ પ્રગટ થાય, ત્યારે પણ, સ્વાભાવિક રીતે જ એ અજ્ઞાન અને જ્ઞાનના બંધનથી સ્વતંત્ર હોય છે: એ સત્યમાંથી પ્રકાશ પ્રત્યે ગતિ કરે છે અને હુંમેશાં સત્ય અને પ્રકાશમાં વસે છે. એનું જ્ઞાન સત્ય છે એટલે એનો સંકલ્પ પણ હુંમેશાં સત્ય હોય છે. એ વસ્તુઓ સાથે કામ કરતાં, ફંકાં મારતું નથી અને એનાં પગલાં લડખડાતાં નથી. અતિમનસના લાગણી અને ઊર્ભિ તેમના સત્યથી અળગાં પડતાં નથી, કોઈ ભૂલચૂકું કરતાં નથી, સત્ય અને ખરી વસ્તુથી આડે ફંટાતાં નથી, સૌંદર્ય અને આનંદનો દુરુપયોગ કરતાં નથી અને દિવ્ય ઉમદાપણામાંથી ચલિત થતાં નથી. અતિમનસમાં જ્ઞાનશક્તિ કોઈ ગેરમાર્ગ કે આડે માર્ગ દોરીને સ્થૂળતામાં સરી પડતી નથી. અહીં તો એ જ્ઞાનશક્તિ (દ્વિક્રિયો) સ્વાભાવિક રીતે અપૂર્ણ હોય છે અને આપણા અજ્ઞાનને કારણે એ નિંદનીય, અવિશ્વસનીય અને દુરુપયોગી બની રહી હોય છે. જ્યારે અતિમનસ કોઈ અધૂરું વિધાન કરે છે ત્યારે પણ એ પૂર્ણ સત્ય પ્રત્યે ગતિ કરતું વિધાન હોય છે, એનું અપૂર્ણ કાર્ય પણ પૂર્ણતા પ્રત્યે ગતિમાન હોય. આપણા જીવનમાં જે અસત્યો અને અનિશ્ચિતતા આવી રહેલાં છે તેનાથી અલગ રીતે સ્વાભાવિક રીતે જ અતિમનસનું જીવન, કાર્ય અને દોરવણી, સુરક્ષિત હોય છે. એ તદ્દન સલામત રીતે પોતાના પૂર્ણતાના કાર્યમાં આગળ વધે છે. એક વાર જો આ ઝડત ચેતનાનો પાયો અહીં દૃઢપણે સ્થપાઈ જાય તો, દિવ્ય જીવનની ઉત્કાંતિનું કાર્ય સુખપૂર્ણ પ્રગતિ અને પ્રકાશમાંથી આનંદ પ્રત્યેની આગેકૂચ હુશે.\*

આ ખૂબ, ખૂબ, ખૂબ અગત્યનું છે. ખૂબ અગત્યનું.

જે કોઈ લોકો અતિમનસની અભિવ્યક્તિ કરતા હોવાનો દંબ કરતા હુશે તેઓ ઢીલા પડી જશે.

(મૌન)

---

\* શતાબ્દી ગ્રંથ ૧૬, પૃ. ૪૧-૪૨.

બઃ આજની સાંજ પૂરતું તો આટલું જ છે, માતાજી.

ધણું સારું, આને ક્યાં પ્રસિદ્ધ કરવાના છો?

બઃ બાળકો માટેનું એક પુસ્તક હું તૈયાર કરું છું, તેમાં.

આહ! એ એટલું બધું સરસ... અને એટલું બધું અગત્યનું છે!

ઓરોવિલમાં કેટલાક લોકો એવા છે કે જેઓ એમ માને છે કે તેઓ તો ક્યારનાય અતિમનસને વ્યક્ત બનાવી રહ્યા છે. અને જ્યારે તમે તેમને કહો છો કે એ ખરું નથી, ત્યારે તેઓ માનવા તૈયાર નથી. એમારો એ વાંચવું જોઈએ. એ સૌ કોઈએ વાંચવું જોઈએ.

અઃ માતાજી, થોડા વખત પહેલાં એ લોકોએ મને પૂછેલું કે હું તેમની પાસે જઈને શ્રી અરવિંદ વિષે કંઈ કહીશ કે કેમ. તો હું આ પેરેગાફ વાંચવાની તક લઈ?

ઓહ, ધણું સરસ, ધણું સરસ, ધણું સરસ. તમે એ ધીમે ધીમે વાંચજો જેથી એ લોકો બરાબર સાંભળી લે.

\*

## ૨૬ ફેબ્રુઆરી ૧૯૭૩

(“અ’ માતાજી પાસે, શિક્ષકોએ જેના ઉત્તરો આપવાના છે તેવા ઘણા પ્રશ્નો વાંચે છે.)

અ : અને હું છેલ્લો પ્રશ્ન આ છે : “માતાજીએ લખેલું છે કે બાળકો, ખાસ કરીને નાનાં બાળકોની બાબતમાં, તેમના મનમાં રમત અને કામ વરચે ભેદ ન હોવો જોઈએ. એમનું કામ તેમના રસમાંથી પેદા થવું જોઈએ. રમત અને કામ વરચે ભેદ ન રહે તેવી વસ્તુસ્થિતિ કેવી હોવી જોઈએ? આપ કોઈ સૂચનો કરશો?”

સૌથી વધુ અગત્યની વસ્તુ તેમનાં માબાપ અને તેમની “શાળા છે... શાળા. “શાળાએ જવાનું.” આપણે તેમને કહી શકીએ “તમે શાળામાં જઈ રહ્યા છો... તમે આવો છો... આપણે આજે આવી આવી રમતો રમીશું...” વગેરે. પણ માબાપો? જેઓ અહીં તેમનાં માબાપ વિના રહે છે....

અ : તેઓ ભાગ્યશાળી છે.

ઓહ! મોટાં ભાગ્યવાન?

(થોડા સમય પછી, ‘અ’ એ શ્રી માતાજીને પૂછ્યું કે તેમણે શિક્ષકોને કશું પૂછવાનું છે. લાંબો સમય મૌન રહ્યા પછી શ્રી માતાજીએ કહ્યું :)

મારું મસ્તક ખાલી છે.

\*

૧૪ માર્ચ ૧૯૭૩

(‘બ’ શ્રી માતાજી પાસે એક શિક્ષકનો પત્ર વાંચે છે જેમાં એવું લખેલું છે કે,  
“મારે આ સર્વ ગુંચવાડાથી દૂર જવું છે, આ વર્ષ પૂરતું શાળા છોડી જવું છે.”  
પછી, જે સંજોગમાં એહો આ પ્રકારનો નિષ્ણય કર્યો તેની શ્રી માતાજીને જાણ  
કરવામાં આવી)

મને લાગેવળો છે ત્યાં સુધી હું આ બધી વસ્તુઓ સમજ શકતી નથી. મારે માટે  
એ બધું.... ‘અ’ એને માટે શું કહે છે?

અ : આપને શું કહેવું તે હું જાણતો નથી, માતાજી.

ફક્ત મને એટલું કહો: તમારા ઉપર શી છાપ પડી છે? મને એવું સંવેદન થાય  
છે કે ગુંચવાડાનું કોઈ તત્ત્વ શાળામાં દાખલ થઈ ગયું છે અને.... એ લોકોનો  
ભાવાર્થ એક જ હોય છે પણ ભાષા જુદી જુદી વાપરે છે અને એમાંથી સંઘર્ષ ઊભો  
થાય છે. હું જાણું છું કે સૌની આભીપ્સા એક સરખી છે પણ સૌ, સૌની ભાષામાં  
બોલે છે, અને એ ભાષાઓમાં સંવાદ નથી અને એટલે એ લોકો કોઈ મુદ્દા વિના  
દલીલબાણી કરે છે. મને એમ લાગે છે કે સૌ કોઈ થોડો સમય મૂંગાં રહે તે વધુ  
સારું. તમે જે ઉકેલ સૂચ્યવતા હો તે કહો.

મારે પણ એવું થાય છે, જે લોકો મારી સાથે છે તેમની સાથે મારે કદી પણ  
મુશ્કેલી પડતી ન હતી, અને હવે જાણો એ લોકો જુદી ભાષામાં બોલે છે.

અ : જે વસ્તુઓ આપણને નજીક લાવે તેના કરતાં આપણે દૂર લઈ જનારી  
વસ્તુઓ ઉપર વધુ પડતો ભાર મૂકીએ છીએ, એટલે...

હા, એ પ્રકારનો ભાર. પણ મારી ઉપર તેની એક વિચિત્ર અસર થાય છે એથી મને  
એમ લાગે છે કે હું માંદી છું. મને કંઈ થયું નથી. હું સાજી છું અને પેલી વસ્તુને  
લઈને આખો વખતે જાણો હું માંદી હોઉં એમ મને લાગે છે.

અ : એ વિસંવાદનું આંદોલન છે.

હા, ખરી વાત તો એ છે કે એ સામાન્ય મનોમય ચેતનામાંથી અતિમાનસ પ્રત્યેની ગતિના વચ્ચગાળાની પરિસ્થિતિ છે, અતિમનસ ચેતનાની હાજરીમાં, મનોમય ચેતનાને ભય લાગે છે, મને એવો અનુભવ થાય છે — હું એ વસ્તુ મારી પાસે કયા સ્વરૂપે આવે છે તેની વાત તમને કરું — ગમે તે ક્ષણે આપણું મૃત્યુ થઈ શકે, એ આંદોલન એટલું બધું બિન્ન હોય છે. એટલે જ્યારે હું તદ્દન શાંત થઈ જાઉ છું ત્યારે... મારું સ્વરૂપ, ચેતના... જૂની ચેતના — મનોમય, ચેતના તો નહિ, છતાં — જૂની ચેતના એનો મંત્ર જપે છે. એનો એક મંત્ર છે... એ એનો મંત્ર જપે જાય છે. અને એ વસ્તુ એક પશ્ચાદભૂમિકા જેવી, એક સંપર્ક બિંદુ જેવી... વિચિત્ર છે... અને એને પેલે પાર કોઈ પ્રકાશ અને શક્તિથી સભર એવી વસ્તુ છે જે લગભગ ભયજનક લાગે છે. એટલે તમે સમજ્યાને, જો એ જ વસ્તુ... હું કે જે... મને ઘણો લાંબો અનુભવ છે, નહિ? જો એને લઈને જો મારામાં એમ થતું હોય, તો બીજાઓમાં એના જેવું કંઈ થતું હોય, તો મને લાગે છે કે આપણે બધા ગાંડા થઈ જઈશું! બસ, એટલું ચાલશો.

આ વસ્તુને મળતી કોઈ વસ્તુ છે?

અ : હા, માતાજી,

તો પછી આપણે એવી શાંતિ રાખીએ કે જેથી પેલી વસ્તુ સાથેનો સંપર્ક ગુમાવી ન બેસીએ....

અ : (શરીરશાસ્ત્ર વિશે એક નવા અભિગમની બાબતનું વિષયાંતર કર્યા પછી:) પરંતુ તો પછી, આપણે આપણી પરિસ્થિતિ ઉપર પાછા આવીએ, તો, ઉ.ત. આપણે એમ ન કરી શકીએ કે જે વસ્તુ આપણાને વધુ નજીક લાવે તેવી હોય તેમને શક્ય તેટલી જડપથી સિદ્ધ કરવી જેથી આપ તે દિવસે કહેતાં દંતાં તેમ જુદાં જુદાં તત્ત્વોનું અનુસંધાન શક્ય બને... હું ધારું છું કે જો બધા લોકો એ વસ્તુ શોધવા મંડી પડે, કઈ રીતે તેમના કામનાં સર્વ પાસાંને સર્વાંગ સંપૂર્ણ બનાવી શકાય તો એ લોકો જે મુદ્દાઓમાં બિન્નતા હોય તેમને ભૂલી જાય અને પાસે લાવનારી વસ્તુઓનો જ વિચાર કરે.

હા, હા, પણ આપણી ભાખા... હું તમને કહેવા જતી હતી કે “એ એક સારો વિચાર છે.” પણ જ્યાં હું એ બોલવા જતી હતી ત્યાં જ મેં મારો કાન પકડ્યો.

એ કોઈ વિચાર નથી, સમજો છોને, એ તો આપણી ભાષા એવી છે કે... એ એક ઊંઘી બરણી જેવી, મનોમય બરણી જેવી વસ્તુ છે જે મૂળ વસ્તુને ઢાંકી દેવા માણે છે અને છોડવા માગતી નથી. સાચે જ, “આ એક મુશ્કેલ સમય છે”. મને લાગે છે કે આપણે ‘અત્યંત શાંત’ બની જવું જોઈએ. “અત્યંત શાંત.” “અત્યંત શાંત.” હું તમને મારો જૂનો મંત્ર કહું છું; એ મારા બાધ સ્વરૂપને તદ્દન શાંત રાખે છે :

**ॐ નમો ભગવતે.**

આ ત્રાણ શબ્દો છે. મારે માટે તેમનો અર્થ આ મુજબ છે :

ॐ — હું પરમ પ્રભુનું આરાધન કરું છું.

નમો — તમને સર્વાંગ સમર્પિત થાઉં છું.

ભગવતે — મને દિવ્ય બનાવો.

મારો કહેવાનો અર્થ એ છે કે આ, એનું ભાષાંતર છે... તમે સાંભળો છે ને?

**અ : હા, માતાજી.**

મારા માટે એ સર્વ વસ્તુઓને શાંત કરી દે છો.

\*

## વિભાગ - ૩

# નાટકો



## ભાવિ તરફ

સ્થાનિક રીતરિવાજો મુજબ દૃશ્યની વિગતોમાં થોડા જેવા ફેરફારો  
કરી હુર કોઈ દેશમાં આ નાટિકા ભજવી શકાય.

### પાત્રો

‘તે’

કવિ; પારદૃષ્ટ સંગીતકાર; ચિત્રકાર; સખી

(પડદો ઉપરે છે ત્યારે ‘તે’ અને તેની બાળપણાની સખી સોફા ઉપર પાસે  
પાસે બેઠેલાં છે.)

તે

તું આવી તે મને બહુ જ ગમ્યું. આપણો કેટલા બધા વખત પણી મળીએ  
છીએ... મેં તો ધારેલું કે તું મને ભૂલી જ ગઈ હશે.

### સખી

ના, ના એવું તે કદી બને? પણ હું શું કરું? તારી ભાળ જ નહોંતી મળતી.  
તને ક્યાં શોધવી એ પણ સમજતું ન હતું. પણ આજે તને જોઉં છું ત્યારે મને જરા  
આશ્ર્ય થાય છે, હો! તું તો હવે પરણી છે, એ તો ભારે નવાઈની વાત છે. હું તો  
એ માની જ શકતી નથી.

તે

તને શું, મને પોતાને પણ ઘણું આશ્ર્ય થાય છે.

### સખી

સમજું છું... તે વખતે તો તું લઝ વિષે ખૂબ જ કટાક્ષો કરતી હતી. તું કહેતી  
હતી કે લઝ એ તો ‘પેદાશ અને વપરાશની એક સહકારી મંડળી’ છે, મને એ  
બધુંયે યાદ આવે છે. જીવનમાં તને જ્યાં જ્યાં માનવ પોતાની પશુતાનું પ્રદર્શન

કરતો નજરે પડતો, માણસમાં રહેલો પશુ જ્યાં જ્યાં પ્રગટ થતો દેખાતો ત્યા ત્યાં, એ બધું જોઈ જોઈને, તને કેવી તો ઘૃણા થતી હતી. તું કેવા તો ભાવથી કહેતી, કે બાપુ, આપણે માણસો જાનવર ન થઈ રહીએ, આંચળવાળાં પ્રાણી ન બની રહી એ તો બહુ સારું.

### તે

હા, તારી વાત સાચી છે. સમાજની રૂઢિઓની મશ્કરી કરવામાં મને હુંમેશા મજા આવી છે. લોકોના ચાલુ વિચારોની ઠેકડી કરવામાં મને બહુ જ ગમ્મત પડી છે. પણ તું એટલું તો જરૂર કબૂલ કરીશ કે સાચા પ્રેમ સામે મેં કદીય કશું પણ કશું નથી. વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચે અંતરનું ગણન સામ્ય હોય અને તેમાંથી તેમની વચ્ચે પ્રેમ જન્મે, એ પ્રેમમાંથી તેમની વચ્ચે વિચારોની અને ભાવનાની એકતા જન્મે એ સામે મારે કદી પણ વિરોધ રવ્યો નથી. ઊલદું, હું પાતે જ હુંમેશાં એક પરમ ભલ્ય પ્રેમનું સ્વખન સદાય સેવી રહી છું. હું તે ઝંખતી રહી છું, કે જગતમાં વ્યક્તિઓ સાથે મળીને એક પરમ પ્રેમનો આનંદ માણે, એ પ્રેમમાં લેશ પણ પશુભાવ ન હોય. મેં ઝંખ્યું છે કે આ સ્થૂલની ભૂમિકા ઉપર પણ, જગતના સર્જનની મૂળ ક્ષાણે જે પરમ પ્રેમ પ્રગટ થયો હતો તે જ પ્રેમ પાછો અહીં પ્રગટ થાય. આવું હતું મારું પ્રેમનું એક મહા સ્વખન. એ સ્વખનને સાચું કરવાની શોધમાં મેં લખનો સ્વીકાર કર્યો. પણ હવે જોઉં છું કે એ અનુભવ બહુ સુખી નથી નીવડ્યો. મારું અંતર તો કેટલીય આતુરતાથી, સાચા ભાવથી પોતાનો પ્રેમ અર્પવા તલસી રહેલું છે. પણ મારા પ્રેમને ઓણે ઝંખેલો પ્રેમ જડ્યો નથી.

### સખી

અરે રે!

### તે

ના, ના. આ કહું છું તે દયા ઉપજાવવા નથી કહેતી. મારે દયાની જરૂર નથી. હું જાણું છું કે પ્રેમ વિષેનું મારું સ્વખન અત્યારના જગતમાં સિદ્ધ બને તેમ નથી, એ સ્વખન સિદ્ધ થાય તે પહેલાં તો માનવ સ્વભાવે ઘણું ઘણું પલટાઈ જવું પડશો! હશે, પણ એટલું તે ખરું જ કે અમે બને — હું ને મારા પતિ ખૂબ સરસ ભિત્રો તો છીએ જ. પણ એમ છાંયે એ વાત પણ છે કે અમને પોતપોતાના અંતરમાં એકલતા તો લાગે છે જ. હા, અમને પરસ્પર માન છે, એકબીજાને અમે પૂરેપૂરાં અનુકૂળ રહીએ

છીએ. એને લીધે અમારા જીવનમાં સુમેળ પણ છે, અને તેથી જીવન સાવ ભારત્ય  
નથી લાગતું. પરંતુ એને કાંઈ સુખ તે થોડું જ કહેવાય?

### સખી

વાગા લોકોને માટે તો કદાચ એટલી વસ્તુ પણ ઘણું સુખ ગણાય.

### તે

એ સાચું, પણ મને તો કદી કદી જીવન ખૂબ જ ખાલી ખાલી લાગે છે! અને  
એ આભાવને પૂરવા માટે જ મેં આ કામ ઉપાડ્યું છે. અને એ કામ ખરેખર અદ્ભુત  
છે. દુઃખી માનવોનાં દુઃખો હળવાં કરવાં, માનવતાની શક્તિઓને જગાડવી,  
માનવજીતિને તેના સાચા લક્ષ્યનું દર્શન કરવાં, માનવતાને તેનું ઝ્યાંતર કરી આપવું  
— આ મારું આજે મને બહુ પ્રિય થઈ પડેલું કાર્ય છે. એની પાછળ આજે મારી  
બધીયે શક્તિ હું રેડી રહી છું.

### સખી

મને લાગે છે કે તારા જીવનમાં કોઈ અતિ મહાન, અતિ અલૌકિક વસ્તુ કાર્ય  
કરી રહી છે. મને પોતાને એ વસ્તુ હજુ સ્પષ્ટ દેખાતી નથી અને એટલે એ મને  
જરા અગમ્ય પણ લાગે છે.

### તે

હા, એ અગમ્ય ચીજની બધીયે વાત મારે તને કહેવી છે, પણ બધું વિગતવાર  
માંડીને કહેવું પડશે. એ બધું કહેવામાં થોડો વધુ વખત પણ લાગશે. કહે, એ માટે  
હું તારે ત્યાં આવું તો?

### સખી

એ તો બહુ જ સારું થાય. મને ખૂબ જ આનંદ થાય. તો બોલ, ક્યારે  
આવીશ? આજે આવીશ?

### તે

હા, આજે જ આવું. હું જોઉં છું કે અમારા જીવનમાં એક અદ્ભુત વસ્તુ  
અમારી આગણ પ્રગટ થઈ રહી છે, અમારા જીવનને દોરી રહી છે. એ વિષે વાત

કરતાં મને બહુ જ આનંદ થાય છે. પણ હું થોડી વાર પછી નીકળીશ. હમણાં મારે થોડુક કામ છે. મારા પતિ હવે ફરીને પાછા આવવાની તૈયારીમાં છે. તે પહેલાં તેમને માટે મારે થોડી તૈયારી કરી રાખવાની છે. એ આવીને કામે બેસી જાય પછી હું છુદ્ધી છું. એ પછી હું તારે ત્યાં આવીશ.

### સખી

બહુ સરસ. તો હું જાઉ ત્યારે.

(પઢા પાછળના બારણા સુધી તે સખીને વળાવી આવે છે. ત્યાંથી પાછી ફરીને તે લખવાના ટેબલ પાસે જઈ ત્યાં થોડા કાગળો, લખવાની સામગ્રી વ્યવસ્થિત ગોઠવે છે. ટેબલ ઉપર ફૂલદાનીમાં થોડાં ફૂલ મૂકે છે અને બધુ બરાબર છે કે નહિ તે જોતી હોય તેમ બધી બાજુએ નજર નાખી લે છે. એ ક્ષાણે બારણું ઊઘડવાનો અવાજ સંભળાય છે.)

### તે

લો, એ આવી ગયા. (કવિ પ્રવેશો છે. તેના તરફ પ્રેમપૂર્વક જતાં) આવો. ફરવામાં મળા આવી?

### કવિ

(શૂન્ય મને) હા, આનંદ રહ્યો. આભાર. (એક ખુરશી ઉપર તે પોતાની હેટ મૂકે છે) આજે ફરતાં મને મારા કાવ્યનો અંત જડી આવ્યો. હું ધારું છું કે ખુલ્લી હવામાં થોડું હરવા ફરવાનું રાખ્યું હોય તો પ્રેરણાને વેગ જરૂર મળે. જો ત્યારે એ કાવ્યની સમાપ્તિ હવે આ રીતે બને તો ધાણું સરસ થાય. કાવ્યના છેવટના ભાગમાં હું હવે એક વિજયગીત મૂકીશ. માનોને કે મારી આ રચના એક વિજય સ્તોત્ર જ બની રહેશે, માનવની એક યશોગાથા બની રહેશે. આ પૃથ્વી ઉપર માનવે પોતાનો વિકાસ સાધ્યો છે, તેણે પોતાના મૂળ સ્થાનનું જ્ઞાન મેળવ્યું છે. એ જ્ઞાનમાંથી તેને પોતાની સર્વ શક્તિનું ભાન જાય્યું છે, અને એમાંથી એ શક્તિઓને સિદ્ધ કરવાનું બળ મળ્યું છે. માનવના જીવનપણ્ય ઉપર એકત્વના પ્રકાશ પથરાઈ રહ્યો છે. એ આનંદમય પ્રકાશ હેઠળ માનવે પૃથ્વી ઉપર અમરતાને ઊતારવા માટે કૂચ આદરી છે. આમ, એ આખી રચના એક ધારી સુંદર ફૂતિ બની જશે, એક સાચી વિશ્વભાવભરી રચના બની રહેશે, નહિ? અને હવે એ વખત આવી ચૂક્યો છે કે જ્યારે કળાએ પોતે માત્ર વિરૂપતાની અને પરાજ્યની જ ગુણગાથા ગાવાનું કામ મૂકી દેવું પડશે... કવિતા,

ચિત્ર, સંગીત — એ સર્વ કળાઓએ હુવે કેવળ સૌન્દર્યનું જ ગાન ગાવું જોઈએ, વિજય અને આનંદનું જ સ્તોત્ર ઉચ્ચારવું જોઈએ, પોતાના એ ઉદ્ગારો દ્વારા કળાએ ભાવિ સિદ્ધિઓનો માગાં ખોલી આપવો જોઈએ, એક નવા જગતના આગમનનો પંથ મોકાળો કરી દેવો જોઈએ. એ નૂતન જગતમાં અસત્ય નહિ હોય, દુઃખ નહિ હોય, કુરૂપતા નહિ હોય, મૃત્યુ નહિ હોય. એવો સમય આવશે ત્યારે કળાઓ માટે સોનેરી દિવસ ઊગશે...પણ એ નથી થયું ત્યાં સુધી આહુ, હમણાં તો માનવના નસીબમાં કેવળ યાતનાઓના જ ભંડાર છે. માણસે અત્યારે તો કેવળ સહન કરવાનું જ છે. ઓહ, કેવાં દુઃખો, કેવી તો પીડાઓ, કેવી તો એકલતા...ભયંકર! ભયંકર! અને હરેક જણે પોતાનો બોજ પોતે જ ઊઠાવવાનો છે, તમે ઈચ્છો કે ન ઈચ્છો, તમારી શક્તિ હો કે ન હો. (વિચારમાં ગરક થઈ જાય છે.)

### તે

(કવિની પાસે સ્નેહપૂર્વક જઈ તેના ખભા ઉપર પોતાનો હાથ મૂકૃતાં)

વારુ, હુવે કામ શરૂ કરો. ઉદાસીનતાનું ઉત્તમ ઓસડ એક જ છે, કામ. લો, ત્યારે તમારી પ્રેરણાની ગોદમાં તમને હુવે મૂકી દઉં છું. મારે થાંનું બહાર જવાનું છે. મારી બહેનપણીને ત્યાં આજની બપોર ગાળવાની છું. આજે એની સાથે કેટલીક વાતો કરવાની છે. આપણા જીવનને દોરતા અદ્ભુત પ્રકાશ વિષે એને મારે કંઈક કહેવાનું છે. હા, અને અમે પેલા ગ્રંથમાંથી પણ થોડુંક વાંચીશું. એ બધી બાબતોનું ચિંતન-મનન કરવામાં પણ અમને બંનેને ઘણો આનંદ પડે છે. જો કે એ વિષયો સામાન્ય માણસોના મનને તો ખૂબ જ મુંજુવી દે તેવા અઘરા છે. તેમાં વળી આ સ્ત્રીઓ કેવી રીતે રસ લઈ શકે એ પ્રશ્ન ઘણુાને થાય પણ ખરો. લોકોને મન તો એમ જ છે કે સ્ત્રીઓ તો માત્ર કપડાંલતાંની વાતો કરી શકે... અને એ સાવ ખોડું પણ નથી જ. ઘણીએક સ્ત્રીઓ એવી છીછરી પણ છે જ, કંઈ નહિ તો દેખાવમાં તો એવી હોય છે જ. પણ ઘણી વાર એવી દેખાતી છીછરી વૃત્તિની પાછળ પણ દુઃખી હૃદય છુપાયું હોય છે. એ છીછરાપણું સ્ત્રી એક બુરખા તરીકે ધારણ કરતી હોય છે, પોતાની અંદરનો ઘણો ઘણો અસંતોષ ઢાંકી રાખવા માટે. ખરેખર, જીવન કેટલું દુઃખી છે! આવી તો કેટલીયે સ્ત્રીઓ મારી જાણમાં છે. સાચે જ, એમના તરફ આપણે દ્યા રાખવાની છે. બિચારાં!

### કવિ

સાચેજ. સ્ત્રીની સ્થિતિ ખૂબ જ દ્યાજનક છે. જગતમાં લગભગ એકેએક સ્ત્રી નિરાધાર જેવી છે. જીવનમાં તેને જે રક્ષાણ મળવું જોઈએ તે તેને નથી દોતું.

જીવનના તોફાની સાગરમાં નાજૂક નૌકા જેવી સ્ત્રી અથડાતી કુટાતી ભટકે છે. એ તોફાનની સામે રક્ષણ આપનારી બંદરગાહ એને માટે ક્યાંય નથી. સ્ત્રીને પાસે એવું જ્ઞાન નથી, સ્ત્રીને એવું શિક્ષણ નથી, કે જેથી તે પોતાની રક્ષા કરી શકે.

### તે

સાચું છે. એને વળી એમ પણ છે કે જે સ્ત્રી ઘણું ઘણું બળવાન હોય છે તેને પણ જીવનમાં કેંક ઉંડી ઉંડી ભૂખ તે રહેલી જ હોય છે. જગતની સમર્થમાં સમર્થ સ્ત્રીને પણ એક એવો સ્નેહ જોઈતો હોય છે કે જે તેને રક્ષણ આપી રહ્યો હોય. તેણે પણ જીવનમાં કોઈ એક એવી શક્તિની વાંધના રહે છે કે જે એક સર્વશક્તિમાન જેવી શક્તિ હોય, જે એના ઉપર છત્ર બનીને ઝૂકી રહેતી હોય, પાતાની હુંકાળી મધુરતા વહે આવરી લેતી હોય. સ્ત્રી જ્યારે પ્રેમ જંખે છે ત્યારે સાચેસાચ આવું જંખતી હોય છે. એવા પ્રેમ મેળવવાનું જેના ભાષ્યમાં લખાયું હોય તેનું જ જીવન કૃતાર્થ બને છે. જીવનમાં એવા પ્રેમ મળતાં સ્ત્રીની સર્વ આશાની પૂર્તિનાં દ્વાર ખૂલે છે, જીવનમાં તેને કંઈક શ્રદ્ધા બેસે છે. એવો પ્રેમ ન મળે ત્યાં સુધી સ્ત્રીનું જીવન એક સુકા રણ જેવું જ હોય છે. એને એ શુષ્ણતા, આહ, સ્ત્રીના હંદયને કેવી શેકી નાખે છે, કેવી સ્કૂલી નાખે છે!

### કવિ

ઓહ, આ બધું તું કેટલું સરસ રીતે કહે છે. જાણો કે તને પોતાને જ આ સ્થિતિનો પ્રબળ અનુભવ થઈ રહ્યો છે. જરૂર, મારું હવેનું સ્ત્રીશિક્ષણ વિષે જે પુસ્તક તૈયાર થવાનું છે તેમાં આ વસ્તુ હું જરૂર મૂકીશ. ચાલો ત્યારે, હું હવે કામે બેસી જાઉં.

### તે

હા, એને હું પણ હવે જાઉં. લખો, ખૂબ સારું સારું લખો. (એક પુસ્તક લઈ બહાર જાય છે.)

### કવિ

(ટેબલ પાસે જઈને બેસે છે. પોતાના કામ માટેની બધી સામગ્રીને તૈયાર રાખેલી જુઓ છે.) આ કેટલી કાળજી છે, પ્રેમળ મધુર, સદાયની, રોજરોજની. એની મધુરતા, એની કાળજી, એમાં કદી પણ ચૂક નથી. હું એને જોઉં દુંધું, એને મને એક ગ્રકાશનાં દર્શન થાય છે. એનામાંથી જાણો કે એક પ્રેમળતા નીતરી રહી છે, એક બુદ્ધિપ્રભા વિસ્તરી રહી છે. એ પ્રેમળતા, એ બુદ્ધિપ્રભા એની આસપાસનાં સૌ કોઈ ઉપર

પથરાઈ રહી છે. સૌ કોઈને તે એક વિશાળ જીવન તરફ લઈ જઈ રહી છે. ખરેખર, એને જોઈને હું મુખ્ય બનું છું, એના પ્રતિ મને પરમ માન પ્રગતે છે... પણ... પણ, આ પ્રેમ નથી...પ્રેમ! આહુ, એ કોઈક જુદી વસ્તુ છે. હા, એ તો મારું હજુ એક સ્વખ છે, કેવું સ્વખ! શું એ કદીયે સાચું પડવાનું છે? (કોઈ એક ઉત્તમ કંઈમાંથી ગવાતું સંગીત સંભળાવા લાગે છે.\* કવિ જરૂરથી ઊઠે છે અને ખુલ્લી બારી પાસે જઈને ઊભા રહે છે.) શો કંઈ છે, અદ્ભુત! (સંગીત પૂરું થાય ત્યાં સુધી તે શાંતિથી સાંભળ્યા કરે છે. અંતે એક નિઃશ્વાસ નાખી તે ટેબલ તરફ જવા લાગે છે ત્યાં બારણું ઉપર ટકોરો સંભળાય છે.) કોણ? (જઈને બારણું ખોલે છે. ચિત્રકાર પ્રવેશો છે.)

### કવિ

અરે વાહ! સુપ્રભાત, આવ આવ દોસ્ત, શા શુભ સમાચાર છે?

### ચિત્રકાર

એક વાત કરવા આવ્યો છું. હું બજારમાં નીકખ્યો હૃતો ત્યાં રસ્તામાં જ તારી પત્ની

\* ઓ નીલ ગગનની ચાંદની,  
અધિ હદ્ય-મન-માહિની!  
તવ વરસે અમરત ધારા-  
આ જાચે સમદર ખારા,  
આ જાચે ધરતી આરા.  
  
અધિ સપ્તસિંહુ ઉર હારિણી,  
ઓ ગગનગામી ગિરિશાયિની,  
તવ ચરણ સ્પર્શની આતુરા  
આ જાગે કુંજ કંદબની.  
ઓ નીલ ગગનની ચાંદની.  
  
અધ ભુવન ભુવન દૃગ નાંદિની,  
ઓ દિગ દિગંતર ગામિની.  
તવ જ્યોતિ-વર્ષાણ ઝંખતી  
આ જરે એકલ યામિની,  
ઓ નીલ ગગનની ચાંદની,  
  
અધિ કમલ મુદુદલ હાસિની,  
ઓ શિવલલાટ નિવાસિની,  
તવ પરમ સ્નેહલ જાહ્નવી  
અવતાર ભૂતલ પાવિની.  
ઓ નીલ ગગનની ચાંદની.

(દરબારીના સૂરોમાં)

-સુન્દરમ્

મળી. મને કહ્યું કે જાઓ, કવિ યજશાળામાં બેઠેલા છે. એટલે હું આવી ચહ્યો છું.

### કવિ

બહુ જ સારું કર્યું. હા, તું કહે છે તેવી યજશાળામાં જ છું. ભલે પધારો. ચાલ, તો કહે તારી વાત, એકદમ. શું છે? ચિત્ર અંગે કંઈ છે?

### ચિત્રકાર

ના, આજે ચિત્રની વાત નથી. એ વળી કોઈ બીજી વાર. અત્યારે તો સંગીતની, એક સંગીતકારની વાત લાવ્યો છું. (કવિ વધુ ધ્યાનપૂર્વક સાંભળે છે.) ગઈ કાલે સાંજે મારા મિત્રોને ત્યાં સંગીતનો એક જલસો હતો. એમાં એક સંગીતકાર બાઈનું સંગીત સાંભળવા મળ્યું. શું કહું. ભાઈ, સાચ્યી, ઉત્તમ કલાકાર છે. અને લાગે છે કે એ તારી પડોશમાં જ રહે છે. (કવિને આશ્રમ્ય થતું લાગે છે. તેને વાતમાં રસ વધવા માર્દી છે.) તું અને ઓળખે છે ખરો?

### કવિ

ના, સીધો પરિચય તો નથી. પણ મેં અને અહીંથી ઘણી વાર ગાતાં સાંભળી છે. સાચ્યે જ, કંઈ તો ઘણો અદ્ભુત છે. એ ગાય છે અને મારામાં કંઈ કંઈ સંવેદન જાગે છે. જાણે કે જીવનના એકેએક તાર રણણણી ઊઠે છે. અનો કંઈ સાંભળ્યો છે ત્યારથી જ મને થતું રહ્યું છે કે જાણે હું, અને ઓળખું છું, જાણે કે કોઈ જૂના જૂના કાળમાંથી એક પડવો આવી રહ્યો છે. હા, લગભગ છએક માસથી એ કંઈ હું સાંભળતો રહ્યો છું. મારા કામની અંદર એ કંઈ જાણે એક પ્રેમાળ સાથી બની ગયો છે. એ સંગીત જાણે કે મારા કામમાં એક મધુર સાથ પૂરી રહ્યું છે. હા, મને પણ ઘણી વાર થયું છે કે આ સુંદર કંઈવાળી વ્યક્તિનો પરિચય થાય તો કેવું સારું!

### ચિત્રકાર

લો, એ તો ઘણું જ સરસ થયું. તો કાલે મને એની સાથે પરિચય થયો છે. બહુ સારી વ્યક્તિ દેખાય છે. અમે બહુ બહુ વાતો કરી. તારી કવિતા તો એ ખૂબ ઉત્સાહથી વાંચે છે. એનાં ઓણે વખાણ પણ બહુ જ કર્યાં. વળી ઓણે પોતાની કથની પણ કહી સંભળાવી. ઓણે કહ્યું, જીવનમાં એને કોઈનો આધાર નથી. પોતે એકલી જ છે. નિર્વાહના પ્રશ્ન પણ કદી વિકટ બની જાય છે. પણ એને એક સ્વર્ણ છે કે એક દિવસ પોતે કાસર્ટોમાં ગાતી થઈ જશો. મેં એ સાંભળ્યું અને તરત

જ મને તારો વિચાર આવ્યો, તારા સંગીતકાર મિત્રો યાદ આવ્યા. તું કેવો ઉદારદિલ છે તે તો હું જાણું જ છું. એટલે મેં પાતે જ એને કહ્યું કે તારે વિષે હું મારા એક મિત્રને વાત કરીશ અને એમની મારફતે તે જાણીતા સંગીતકારોના પરિચયમાં આવી શકે તો તે માટે કંઈક કરવા કહીશ, અત્યારે હું એ માટે જ આવ્યો છું.

### કવિ

ઉત્તમ. એને સહાય કરવામાં મને જરૂર આનંદ થશે. તો કહો, તમે લાડોએ હુવે શ્રી યોજના વિચારી છે?

### ચિત્રકાર

યોજના એમ છે કે તું હા પઢે તો હું હમણાં જ તારી સાથે એનો મિલાપ કરાવી આપું. બહુ દૂર જવાનું નથી. તું કહે તો એને હમણાં જ લઈ આવી શકું છું.

### કવિ

ભલે. જા, લઈ આવ એને. હું બેઠો છું. (ચિત્રકાર જાય છે.)

### કવિ

(બેચેન બની આંટા મારવા લાગે છે.) ખરેખર, કેટલું બધું વિચિત્ર!... જગતમાં કશું અક્ષમાત જેવું છે જ નહિ. હરેક વસ્તુ કાર્યકારણના નિયમ મુજબ જ બને છે. માત્ર એ કારણો ઉપર આપણો કંઈ કાબૂ નથી હોતો એ જ મુશ્કેલી છે. શ્રી ખબર, જીવનમાં અંતરનું સાભ્ય શું શું નહિ કરી શકતું હોય?... ખરેખર, આ વીણાનો સ્વર જેટલો સુંદર છે એવી જ સુંદર એ પોતે પણ શું હશે? લો, એ લોકો આવી પણ ગયાં. (ખાલી વાસી રાખેલું બારણું બહારની બાજુથી ધકેલાઈને ખૂલે છે). ઓહ, શું સૌન્દર્ય છે!

(પારદૃષ્ટિ સંગીતકાર મંદમંદ હુસતી પ્રવેશો છે. તેની પાછળ ચિત્રકાર આવે છે.)

### ચિત્રકાર

આ મારા મિત્ર, જાણીતા કવિ, તમે જેમનાં ખૂબ વખાડા કરો છો તે.

### કવિ

બહુ આનંદ થયો. અને હું પણ કહી શકું હું પણ તમારા કંઠનો મહાપ્રશંસક

છ. તમારો કંઈ એક પૂર્ણ કળા સરજુ રહે છે.

### પાર દૃષ્ટિ સંગીતકાર

એ તો આપની કૃપા છે, મહાશય! આપની ઘણી જ આભારી છું. પણ આપની મારે ક્ષમા માગવાની છે, કશા જ ઉપચાર વિના આવી ચડી છું. પણ આપણે તો નજીક નજીકનાં જ પાડોશી છીએ આપણે મળીએ છીએ તો આજે જ, પણ તે પહેલાંથે હું આપને ઓળખું છું. મેં આપને ઘણીયે વાર આપની બારી પાસે ઊભા રહી મારું સંગીત સાંભળતા જોયા છે. અને હું ગાઈ રહેતી ત્યારે આપ જે તાણી પાડતા તે પહેલાં પહેલાં તો મને ગમતું પણ નહોતું. મને થતું કે આ તો આપ મારી મજૂરી જ કરો છો.

### કવિ

ભારે ભૂલ થઈ એ તો! નહિ નહિ, એ તો મારી પ્રસન્નતા જણાવવાને જ હું એમ કરું છું. તમારા તરફથી મને આ જે કલારસ મળે છે તે માટે એ મારા આભારની અભિવ્યક્તિ જ છે.

### ચિત્રકાર

લો, ત્યારે, મારુ' કામ હવે પૂરું થયું. હું જઈશ હવે. મારાં ચિત્રોના વેપારીને મારે મળવા જવાનું છે. આહ! બડો ઠગ છે, ભાઈ! આજની ફેશનના નામે તે મારી પાસે એવાં તે અર્થહીન ચિત્રો કરાવવા માગે છે કે... પણ હું એનું કંધું લેશ પણ નથી કરવાનો.

### કવિ

હા, એમ જ કરવું જોઈએ. એવી વેપારી વૃત્તિનો સખત વિરોધ કરવો જોઈએ. બહાદુરીથી એની સામે થજે. આજના યુગની રસવૃત્તિ હીન બની ગઈ છે, લોકો કળાના એક મિથ્યાભાસમાં લપસી રહ્યા છે. અને એ વિકૃતિ આપણા આજનાં સર્વ કલાકારોમાં પણ ફેલાઈ રહી છે. એ સડો જીવનનાં સર્વ ક્ષેત્રોમાં ફેલાઈ રહેલો છે. એને આપણાથી લેશ પણ પ્રોત્સાહન ન અપાય.

### ચિત્રકાર

સાચ્યું, સાચ્યું. દોસ્ત. હું જાઉં છું આજે મને સત્યને ખાતર લડી લેવાની એક નવી હિંમત મળી છે. જાઉં ત્યારે, જય જય!

## કવિ અને પારદૃષ્ટિ સંગીતકાર

જ્ય જ્ય!

### કવિ

(સોફા તરફ હુથ કરીને ) આવો, બેસો.

### પારદૃષ્ટિ સંગીતકાર

(બેસીને) તો આપ મને થોડક લોકોનો પરિયય કરાવશો અને મારું સંગીત સંભળાવવાની તક મેળવી આપશો, એમ માનું ને?

### કવિ

અવશ્ય. અહીંના એક મહાન સંગીતદિઝન્શક મારા મિત્ર છે. હું માનું છું કે તમારા જેવી શક્તિશાળી વ્યક્તિ માટે બધાં જ બારાણાં સહેલાઈથી ખૂલ્લી જરો.

### પારદૃષ્ટિ સંગીતકાર

એમ થાય તે મને ઘણી મોટી મદદ મળી રહે. આપની હું આભારી રહીશ.

### કવિ

ના, ના, મારો આભાર માનવાનો ન હોય. (આવીને તેની પાસે બેસે છે.) તમને ક્યાં ખબર છે કે તમે મને કેટલો બધો આનંદ આપેલો છે... તમે નથી જાણતોં કે તમારા કંઠની ઉભા મારા નિત્યના કામમાં કેવો તો સુખદ સાથ આપી રહેલી છે. તમારે લીધે મારી કેટલીયે કણો મહા સુખમાં, મહા આનંદમાં વીતી છે. એ બધા માટે ઉપકાર તો ઊલટો મારે માનવાનો રહે છે.

### પારદૃષ્ટિ સંગીતકાર

આ તો આપની ઘણી કૃપા થઈ. (પોતાની આસપાસ નજર નાખે છે અને પછી કવિ તરફ સ્મિતપૂર્વક વળે છે.) કેવું વિચિત્ર છે, અહીં જાણે કે મને આ બધું જ પરિચિત લાગે છે, આ બધી વસ્તુ તો નહિ, પણ આ અહીંની હવા, અહીંનું આ વાતાવરણ મને ખૂબ જ નિકટનું, પરિચિત લાગે છે. મારી ધૂષ્ટતા થતી હોય તો ક્ષમા કરજો, પણ મને જાણે એવું લાગે છે કે હું મારા જ ધરમાં બેઠી છું, જાણે કે હું સદાય અહીં જ રહેતી આવી છું. મને એમ પણ થાય છે કે જીવનમાં હવે મને બધું જ સુખ મળી આવશે.

## કવિ

એમ બને તો તેનો સૌથી પ્રથમ આનંદ મને જ થશે.

### પારદૃષ્ટિ સંગીતકાર

(થોડીક શાંતિ પછી) અને આપને એક મજેદાર વાત પણ કહેવા જેવી છે. આ શહેરમાં હું લગભગ છ માસથી આવીને રહી છું. મારી માનું મૃત્યુ થયું, અને પછી મારા નિર્વાહની શોધમાં હું આ બાજુ નીકળી આવી. અહીં આવીને એક નાનકું મકાન શોધવા નીકળેલી. અને એ શોધમાં ઘણાં ઘણાં મકાનો જોવા મળેલાં. કોઈમાં અમુક ખાસ સગવડ હોય તો કંઈક અગવડ પણ હોય જ. એમ કરતાં છેવટે મેં આપની પાસેનું જ મકાન પસંદ કર્યું. એમાં કોઈ વિશેષ સગવડ તો નહોતી જ, પણ એ મકાન જોઈને મને થયેલું કે અહીં હું સુખી થઈશ, જીવનમાં કોઈ ઉત્તમ વસ્તુઓ મને અહીં આવી મળશે... વિચિત્ર કહેવાય, નહિ?

## કવિ

(વિચારપૂર્વક) હા, વિચિત્ર જ કહેવાય... ઘણું વિચિત્ર...(સ્વગત) અંતરની સમાનતા તે શું આ જ, શી ખબર? (પારદૃષ્ટિ સંગીતકારને) અને જુઓ, આ પણ એવું જ આશ્ર્યજનક છે, કે જે દિવસથી તમારો કંઈ મને પ્રતિદિન સાંભળવા મળ્યો છે, તે વખતથી મને ઘણી ઘણી શાંતિ, ઘણી ઘણી તૃપ્તિ રહેવા લાગી છે. અને તે પછી તમને મળવા માટે મને બહુ જ ઉત્કંઠા રહી છે.

### પારદૃષ્ટિ સંગીતકાર

મેં તો આપને માત્ર મહાલેખક તરીકે જ જાણ્યા હતા. આપની શક્તિ માટે મને અપાર માન રહ્યું છે, પણ એવી તો મને સ્વખે પણ આશા નહોતી કે હું આપને એક દિવસ મળી શકીશ. જીવનમાં કેટલુંક તો ખૂબ જ અસાધારણ અને અગમ્ય જેવું હોય છે... હા, આપણને એ બધાંનાં કારણેણી ખબર નથી હોતી એટલે જ કદાચ એ અગમ્ય કહેવાય. એ કારણો જાણી શકાય તો પછી બધુંયે સરળ અને સ્વાભાવિક જેવું જ લાગે. જુઓને, આ ક્ષાળે હું પોતે પણ એક આરામની અને શાંતિની લાગણી અનુભવી રહી છું. અને એ લાગણી મને ખૂબ જ બળ આપી રહી છે. અને આજે તો મારે જીવનમાં એવા બળની, પ્રોત્સાહનની ઘણી જ જરૂર છે... આપ ક્યાં નથી જાણતા કે એક અનાથ સ્વીને માટે જીવન કેવું તો વિખમ હોય છે. ન કોઈની મદદ, ન કોઈનું રક્ષણ, એકલે હાથે પોતાનો નિર્વાહ કરવાનો હોય, સંકટના સમયે

કોઈના તરફ પણ આધાર માટે વળવાનું ન હોય એ સ્થિતિ કેવીક તો કપરી હોય છે! પરંતુ આપને મજા પછી મને થાય છે કે હવે મારી બધીયે મુસીબતો ઊકલી જશે.

### કવિ

હા, મારાથી બનતી બધી જ મદદ તમને કરીશ, નિશ્ચિત રહેજો. તમારા જેવા કળાકાર માટે, તમારા જેવી વ્યક્તિ માટે કંઈ પણ કરી શકું તો મને ઘણો જ આનંદ થાય. ખરું જોતાં એ તો મારું કર્તવ્ય જ ગણાય.

### પારદૃષ્ટિ સંગીતકાર

(એક સ્વાભાવિક ઉમળકથી કવિનો હૃથ પોતાના હાથમાં લઈ લેતાં) આપનો બહુ જ આભાર. મને થાય છે કે જાણો આપણો હમેશાં આ રીતે, એક બીજાની પાસમાં બેઠેલાં છીએ. આપણો જાણો કે મિત્રો છીએ, જૂનાં સુપરિચિત મિત્રો છીએ... સાચે જ આપણો મિત્રો છીએ, નહિ?

### કવિ

(ગંભીરભાવે) હા, મિત્રો છીએ, સાચે જ.

### પારદૃષ્ટિ સંગીતકાર

મને અહીંનું બહુ આરામ લાગે છે. એટલો બધો કે મારાથી શિષ્યાચાર પણ ભૂલી જવાય છે. અને આ વળી જુઓ, ભૂલવામાં કંઈ બાકી રહેતું હોય તેમ, આ મારી આંખમાં ઊંઘ ઘેરવા લાગી છે. મારા ધરમાં હું ઊંઘી શકતી નથી. કેટલાય વખતથી એ પીડા ઊભી થઈ છે. સૂવા જાઉ છું ને મારી આસપાસ મને અદૃશ્ય શત્રુઓ ઊભેલા દેખાય છે, બધા મારા તરફ ડોળા કાઢી રહ્યા છે, મને મારવી ન હોય તેમ. અને એમાંથી મારો આરામ ચાલ્યો ગયો છે. બહુ જ બેચેન રહેવાય છે. મને આરામ આપે એવી શાંતિ મળતી નથી. પણ અહીં મને એક જુદો અનુભવ થઈ રહ્યો છે, જાણો કે કોઈ હુંકભરી, કોઈ સમર્થ વસ્તુ એક સજીવન વસ્ત્ર જેવી મને વીંટાઈ રહી છે. અને... આહ... મને ઊંઘ ઘેરવા માંડી છે, ભારે ભારે, ધીરે ધીરે ઓહ, મને ઊંઘ ઘેરે છે. ઓહ...

### કવિ

(તેના પ્રતિ સ્નેહપૂર્વક જોતાં) એમ હોય તો આ સોઝા ઉપર તમે સૂઈ જાઓ. નિશ્ચિત રહેજો, કશી વાતથી મુંગાશો મા. રૂઢિ કે શિષ્યાચારના જ્યાલથી સંકોચાશો

નહિ. એ ચીજોનો કશો જ અર્થ નથી, એ તો માત્ર સાંકળો છે, સાંકળો. માણસે માણસને દુઃખી કરવાને જ એ ઘડી છે.

### પારદૃષ્ટિ સંગીતકાર

મારાથી ઊંઘી શકાય તો તો ઘણું જ સારું થાય. માથામાં મને એક ચાલુ દુખાવો રહે છે. અને તેની પીડા પણ બહુ ભારે છે. મારે ખૂબ જ જલદી આગળ વધુંનું હતું. અને એટલાં માટે મેં એટલી તે મહેનત કરી છે કે... મારું મગજ સાવ ધુમ થઈ ગયું છે.

### કવિ

(આતુરતાથી) તમને વાંધો ન હોય તો... હું માનું છું કે હું તમને સહેલાઈથી મટાડી શકું તેમ છું. (તેના કપાળ ઉપર તે થોડીક વાર સુધી પોતાનો હાથ ફેરવે છે અને પછી એકાદ ક્ષાળ સુધી તેના માથા ઉપર તે હાથ રાખી મૂકે છે. પારદૃષ્ટિ સંગીતકાર, જે હવે સોફા ઉપર સૂઈ ગયેલી છે, તે આનંદ અને આરામના ભાવ સાથે ઊંઘી જાય છે.)

### પારદૃષ્ટિ સંગીતકાર

(અર્ધી ઊંઘમાં) હવે તો મને તદ્દન સારું થઈ ગયું. કશી પીડા નથી હવે... બહુ જ સુખ લાગે છે.

### કવિ

(પારદૃષ્ટિ સંગીતકારની આસપાસ તેને આરામ મળે તે રીતે તકિયા ગાઈવે છે અને પછી તેની પાસમાં બેસી તેના હાથ પોતાના હાથમાં લે છે... સ્વગત) અરે બિયારી, આટલી સુંદરતા અને સાથે આટલી બધી એકલતા.

### પારદૃષ્ટિ સંગીતકાર

(ઊંઘમાં બાલતી) ઓહ! કેટલું સુંદર!

### કવિ

(મીઠાશથી) શું સુંદર છે?

### પારદૃષ્ટિ સંગીતકાર

(ચાલુ ઊંઘમાં) ત્યાં તમારી આસપાસ. એ જાંબલી પ્રકાશ... જાણો એક દીરો

જળહુણે છે, જીવતો અને જગમગતો. એ પ્રકાશ મારી આસપાસ પણ દેખાય છે. એમાંથી મને શક્તિ મળે છે. એ મારી રક્ષા કરી રહ્યો છે. એ જાણે કે મારું પરમ રક્ષણ બની રહ્યો છે હવે મને જગતમાં કશું પણ કનુંશો નહિ. (આનંદપૂર્વક) આહ, કેટલો સુંદર છે એ પ્રકાશ, એ જાંબલી પ્રકાશ, તમારી આસપાસ!

### કવિ

તમને હવે આરામ થઈ ગયો છે તો હમણાં શાંતિથી ઊંઘી જાઓ. કશું જોશો નાહિ.

### પારદૃષ્ટિ સંગીતકાર

(દૂર દૂરથી બોલતી હોય તેમ) હું ઊંઘું છું, ઊંઘું છું. ઓહ, આ કેવી શાંતિ છે, કેવું સુખ છે!

### કવિ

(તેના તરફ કોમળ ભાવથી જોતાં) હા, ઊંઘી જા, બાળક, ઊંઘી જા. ઊંઘી લે અને જીવનમાં તાજગી મેળવી લે. તારે માટે જિંદગી વસમી બનેલી છે. તારે ખૂબ જ આરામ લેવો જોઈએ. (એક ક્ષણ શાંત રહીને) મારી જાતને હવે નહિ છેતરું. શા માટે છેતરું? હા, હું કબૂલ કરું છું. એના કંઠે જેમ મારા ચેતનને ઝંકારી મૂક્યું છે, તેવું જ આજે એનું આ સાંનિધ્ય પણ મને એક પરમ સુખ આપી રહ્યું છે, શાંત અને ગહન. એ સૂતી છે અહીં, મારા રક્ષણ હેઠળ. આ છે એની પ્રથમ સચેતન નિદ્રા. મારામાં એણે વિશ્વાસ મુક્યો છે. અને એ વિશ્વાસમાંથી મારે માટે એક જવાબદારી પણ જન્મે છે. એ જવાબદારી લાગે છે પણ મીઠી. પણ... પણ હું જેને પરાયો છું તેનું...તેનું શું? હા, એ સર્મર્થ છે, હિંમતવાન છે એ હું જાણું છું. હું જાણું છુ કે એને એ વાત પણ ક્યારની જણાઈ ગઈ છે કે એના તરફ મને માત્ર એક મિત્ર તરીકેનો જ ભાવ છે અને એ પોતે પણ માત્ર એટલા ભાવથી તૃપ્ત થઈ શકે તેમ નથી. એના હંદ્યના ઊંડો પ્રેમભાવ તો હુજુ જાણ્યા વગરનો જ પહેલો છે. તોયે એના તરફ પણ મારે જવાબદારી તો છે જ. હું એને કઈ રીતે કહી શકું કે મારું સમગ્ર અંતઃકરણ તો કોઈ અન્ય ઉપર ઢરેલું છે. પણ તો પછી મારાથી દંબ પણ કેવી રીતે સેવી શકાય? જગતમાં દંબ એજ માત્ર એક પાપ છે. અને દંબ કરવા ઈચ્છુ તોપણ એથી કશો અર્થ નહિ સરે. એના જેવી ખીને છેતરી નહિ શકાય. એ છેતરાય એ અશક્ય છે. ઓહ! જીવન, ધાર્ણી વાર તું કેટલું તો કૂર છે!

### પારદૃષ્ટિ સંગીતકાર

(હજુ ઉંઘમાં ને ઉંઘમાં તે પડખું ફેરવે છે અને કવિના હાથમાં પોતાનો હાથ મૂકે છે.) હું સુખી છું... ( અને બાળકના જેવા વિશ્વાસભાવથી તે કવિના ખોળામાં પોતાનું મસ્તક ઠેરવે છે)

### કવિ

મીઠી મારી! આહ, શું કરવું?

(વિચારમાં મન બની તેની તરફ ખૂબ વખત સુધી જોઈ રહે છે. પારદૃષ્ટિ સંગીતકાર એક શાસ લે છે, આણસ મરદે છે અને જાગે છે.)

### પારદૃષ્ટિ સંગીતકાર

(કંઈક આશ્વર્ય સાથે પોતાની આસપાસ જોતી) હું ઉંઘી ગઈ હતી, ખરું?... હા, મને બહુ સરસ ઉંઘ આવી ગઈ. આવું તો જીવનમાં પહેલી જ વાર ઉંઘી છું.

### કવિ

બહુ આનંદની વાત છે.

### પારદૃષ્ટિ સંગીતકાર

(કવિ તરફ સ્નેહપૂર્વક જોતી) તમને શું કહું! તમારી આસપાસનો પેલો પ્રકાશ મારી આસપાસ પણ ફરી વળ્યો હતો. મેં જોયું કે એ મારી રક્ષા કરી રહ્યો છે, મને પુષ્ટિ આપી રહ્યો છે. આહ, એ એવો તો સુંદર હતો, એવો તો આનંદદાયી હતો! હમણાં પણ, હું જાગી છું તો પણ એ મારી આસપાસ ફેલાયેલો લાગે છે.

### કવિ

સાચું છે, તમારી આસપાસ એ પ્રકાશ હજુ પણ છે. શું આવો રંગીન પ્રકાશ તમે પહેલી વાર જ જુઓ છો?

### પારદૃષ્ટિ સંગીતકાર

હા, આ પહેલાં પણ મને આવા પ્રકાશ જેવું દેખાયું છે. માણસોની આસપાસ મને કદી કદી રંગીન લાઈન પણ દેખાયા છે. અને કદી કદી રંગીન ધુમ્મસ પણ દેખાયાં છે. પરંતુ તમારી આસપાસ હતો તેવો સુંદર પ્રકાશ તો મેં ક્યારેય જોયો નથી. અને

એ પ્રકાશના જેવું આકર્ષણ પણ મને બીજા કોઈ પ્રકાશમાં થયું નથી. બીજા લોકોની આસપાસ તો ઘણી વાર એક રોગીલું મેલું ધુમ્મસ હોય એવું પણ દેખાય છે. એ શું હશે ?

### કવિ

એ વાત પૂરેપૂરી સમજાવવા તો મારે જરા લાંબો જવાબ આપવો પડે. પણ તમને હું થોડાકમાં પણ એ વસ્તુ સમજાવવા પ્રયત્ન કરીશ. મારાથી બને તેટલી સારી રીતે. તમને રસ ન પડે તે મને અટકાવજો. જુઓ, આપણું સ્વરૂપ અનેક જુદી જુદી અવસ્થાઓનું બનેલું છે. જેવી રીતે પૃથ્વી, પાણી, હવા, અગ્નિ, એ જુદી જુદી અવસ્થાવાળાં તત્ત્વો છે તેના જેવી એ ભિન્ન અવસ્થા છે. સમજાય છે ને?

### પારદૃષ્ટિ સંગીતકાર

કહો, હું સાંભળું છું, મને રસ પડે છે.

### કવિ

હવે આ અવસ્થાઓમાંથી જે ઓછી સઘન અવસ્થા હોય છે તે વધારે સઘન અવસ્થાની અંદર પ્રવેશ કરે છે તેમ જ તેને વીંધીને આરપાર પહોંચી જાય છે. એક છિદ્રવાળા વાસણુમાંથી પાણી જમીને તેની વરાળ થઈ જાય તેના જેવું અહીં બને છે. એમાં ફેર માત્ર એટલો રહે છે કે આ વસ્તુઓમાંથી એક પણ નાશ પામતી નથી. એ રીતે આપણી અંદર જે સૂક્ષ્મ તત્ત્વ રહેલું છે તે આપણા શરીરની આસપાસ એક જાતનું આવરણ બની રહે છે. એ આવરણને આપણે આભામંડલ કહુંએ છીએ.

### પારદૃષ્ટિ સંગીતકાર

સમજુ, તમારું કહેવું બરાબર સ્પષ્ટ છે. પણ એમ હોય તો એ આભામંડલોને આ રીતે જોઈ શકાય તો ઘણો લાભ થાય, નહિ ?

### કવિ

હા, તમે સાચી કલ્પના કરી. એ આભામંડલના દર્શનથી ઘણા જ લાભ થાય છે. એ વાત તો તમે સહેલાઈથી સમજુ શકશો કે આ આભામંડલ આપણી આંતર સ્થિતિનું આબેહૂબ્ર પ્રતિબિંબ જ હોય છે. આપણી લાગણીઓનું, આપણા વિચારોનું એમાં બરાબર પ્રતિબિંબ જિલાય છે. આ વિચારો અને લાગણીઓ જો સંવાદમય અને શાંત હશે તો આભામંડલ પણ સંવાદમય અને શાંત હશે. લાગણીઓ જો

ઉષેરાયેલી હશે, વિચારોમાં જો અસ્વસ્થતા હશે તો આભામંડલમાં પણ એ ઉષેરાટ અને અસ્વસ્થતા જોવા મળશે. એવું આભામંડલ તમે અમુક માણસોની આસપાસ ધૂમમસ જોયું હતું તેના જેવું જ હોય છે.

### પારદૃષ્ટિ સંગીતકાર

હા, આસમજાય છે. એટલેકે આ આભામંડલો એક રીતે રહસ્યદર્શક જેવા હોય છે.

### કવિ

હા, એમ જ. જે લોકો માણસની આસપાસનું આ વાતાવરણ જોઈ શકે છે તેઓ કદી પણ છેતરાતા નથી. દાખલા તરીકી, કોઈ દુષ્ટ વૃત્તિનો માણસ પોતાને વિષે ગમે તેવી સારી છાપ પાડવાના પ્રયત્ન કરે, પોતે દેવદૂત જેવા દેખાવાનો ગમે તેટલો પ્રયત્ન કરે તોપણ એની મહેનત કશી કામ નહિ આવે. એનું આભામંડલ બતાવી દેશો કે એના વિચારો, એના હેતુઓ કેવા મળિન છે.

### પારદૃષ્ટિ સંગીતકાર

(અહોભાવથી) વાહ, કેવું અદ્ભૂત! આવા જ્ઞાનમાંથી તે જગતમાં કેવાં કેવાં પરિણામો આવી શકે! પણ આ સુંદર વસ્તુઓ તમને ક્યાંથી જાગવા મળી? આ તત્ત્વના જાણકાર લોકો જગતમાં બહુ દેખાતા નથી.

### કવિ

ના રે, આજના જમાનામાં તો એ જ્ઞાન ખાસ કરીને બહુ ઓછુ વ્યાપક છે. આ યુગમાં તો માત્ર સફળતાની કિંમત છે, અને એ સફળતામાંથી જે સ્થૂલ ભૌતિક તૃપ્તિઓ મળી શકે છે તેનું મહત્વ અંકાય છે. તોપણ હવે લોકો વર્તમાન જીવનથી અસંતુષ્ટ બનતા જાય છે, જીવનનું મૂલ કારણ શું છે, જીવનનું ધ્યેય શું છે એ વિષે લોકોમાં જિજ્ઞાસા જાગતી જાય છે. અને એવા જિજ્ઞાસુઓની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. તો બીજુ બાજુએ આ તત્ત્વના જાણકાર પુરુષો પણ જગતમાં મોજૂદ છે જ, અને તેઓ આ પીડિત માનવજાતિને સહાય કરવા મથી રહેલા છે. એ મહાપુરુષોએ જગતની એક અતિ ગુણ વિદ્યાનું રક્ષણ કરેલું છે. પેઢી દર પેઢી એ વિદ્યા માનવજાતિમાં ઊતરી આવી રહી છે. એ વિદ્યાને આધારે આત્મવિકાસની એક સાધનાપ્રદત્ત રચાયેલી છે. એ વિદ્યા માણસને તેના સત્ય સ્વરૂપ પ્રત્યે જાગૃત કરવા માગે છે, માણસ શું શું સિદ્ધ કરી શકે તેમ છે એ તેને જાણવવા માગે છે. એ છે એનું લક્ષ્ય.

## પારદૃષ્ટિ સંગીતકાર

ઓહ, કેટલું સરસ એ જ્ઞાન હશે! કહો, મને પણ એ થોડું શીખવશો ને? આપણે હવે વારંવાર મળતાં રહીશું, નહિ? મને તો એમ થાય છે કે આપણે કદી છૂટાં ન પડીએ... હું ઊંઘમાં હતી ત્યારે મને એક નવો જ અનુભવ થયો. મને થયેલું કે જાણો તમે જ મારું સર્વસ્વ છો, જાણો કે હું સર્વથા તમારી જ છું. મને એમ પણ થયેલું કે તમારા રક્ષણાની છાયા હવે સદાયે મારી આસપાસ રહેશે. આજ સુધી તો હું બધું જ બીતી રહી છું. મને થતું કે મારી સામે અનેક શત્રુઓ ખડા છે. પણ આ અનુભવ પછી હવે મારામાં શાંતિ આવી છે. હું હવે સ્વસ્થ છું. મને મારામાં વિશ્વાસ આવ્યો છે. મારા શત્રુઓને, મને હાનિ કરવા માગનાર સૌ કોઈને હું હવે તો કહી શકું છું, ‘આવી જાઓ, હવે હું તમારાથી ડરવાની નથી, મને એક પરમ રક્ષણ મળેલું છે. એ રક્ષણ હવે કદી હટવાનું નથી’ કહો, મારી આ વાત સાચી છે?

### કવિ

દા, સાચી છે.

## પારદૃષ્ટિ સંગીતકાર

આજે હું પરમ સુખી છું. આજરે તમને હું પામી છું. દા, તમારે માટે મેં જીવનમાં કેટલી બધી રાહ જોઈ છે! અને પુછું, ‘તમે પણ હવે સુખી છો, નહિ?’

### કવિ

દા...તમે સૂતાં હતાં તે વેળા હું પણ એક સુખ અનુભવી રહ્યો હતો. એ બહુ શાંત સુખ હતું, સ્વસ્થ સુખ હતું. જીવનમાં એવો અનુભવ મને પહેલી વાર જ થયો. (વિચારમાં ઊતરતા) દા, સાચો પ્રેમ તે આ જ, એ પ્રેમ તે શક્તિ પણ છે. એવા પ્રેમના ભિલનમાંથી ઊઘે છે સિદ્ધિનો માર્ગ... પણ...

## પારદૃષ્ટિ સંગીતકાર

કહો કહો, કેમ અટક્યા? આપણાને આપણો સહવાસ આવો આનંદધાયક છે તો પછી તેમાં વિઘ્ન કરે તેવું...

### કવિ

(એકદમ ઊભો થઈને) આહ, તમને ખબર નથી! (કવિ ‘તે’ ને આવેલી જોઈ

અટકી પડે છે. થોડાક વખતથી આવીને તે પડદા પાછળ ઊભી રહી હતી)!  
(‘તે’ સ્મિત કરતી કરતી બહુ સ્વસ્થ ભાવે આગળ આવે છે.)

### પારદૃષ્ટિ સંગીતકાર

(એકદમ મૂંજાઈ જતી) મને ખબર ન હતી કે તમે લખ કરેલું છે.

તે

(પારદૃષ્ટિ સંગીતકારને) ના, ના. મૂંજાશો મા. (કવિ તરફ વળીને) તમે પણ ન મૂંજાશો. હા, મેં તમારી વાતચીત છેવટના ભાગમાં આખીયે સાંભળી છે. હું અંદર આવતી હતી તે જ વેળાએ આ બહેન જાયાં હતાં. મારે તમને વિક્ષેપ કરવો ન હતો. એટલે હું પાછી જ ચાલી જતી હતી. પણ મને થયું કે હું સાંભળ્યું તે જ વધુ ઠીક રહેશે, આપણને સૌનેય તેથી લાભ થશે, અને હું ઊભી રહી કારણ કે મને ખાસ તો (કવિને ઉદેશીને) તમારો જ વિચાર આવ્યો, મારા પ્રિય ભિત્રનો. મને થયું કે આમાં હવે તમારી સ્થિતિ તો ખરેખર અત્યંત વિકટ બની જાય તેવી છે. હું જાણું છું કે તમે કેટલા તો પ્રામાણિક છો, કેવા તો વફાદાર છો. અને તમારા એવા હંદયની પછી કેવી સ્થિતિ થાય! બે સામસામી દિશામાં બેંચાતું તમારું હંદય કેવી કરુણ અસઘ દશામાં જઈ પડે. આપણે જાણીએ છીએ કે આપણને લાઘેલું સત્યનું દર્શન શો આદેશ આપે છે. એ સત્ય તો કહે છે કે બે અંતરને સાચી રીતે સાંધનારી કરી તો માત્ર એક પ્રેમ જ છે. એ પ્રેમ નથી હોતો ત્યાં પછી ગમે તેવું મિલન હોય તોપણ તેમાં કશો અર્થ રહેતો નથી. હા, પ્રેમ વિનાનાં મિલનો પણ બને છે ખરાં. લોકો અન્યોન્ય તરફ માનથી પ્રેરાઈને જીવનમાં જોડાય છે, એકબીજાને અનુકૂળ બનીને સાથે રહે છે. અને એવું જીવન ઠીક ઠીક સારું ગણાય તેવું પણ હોય છે. પણ હું માનું છું કે જીવનની ભૂમિ ઉપર પ્રેમનો ઉદ્ય થાય ત્યારે બીજી તમામ વસ્તુઓએ પોતે હઠી જઈ એને માર્ગ કરી આપવો જોઈએ. તમને તો યાદ છે કે આપણે કઈ સમજૂતીથી જોડાયા છીએ. આપણે એકબીજાને વચન આપી રાખેલું છે કે આપણામાંથી ગમે તેના જીવનમાં પ્રેમનો ઉદ્ય થાય તે ક્ષણે આપણે અન્યોન્યને સંપૂર્ણ મુક્તિ આપી દેવી. એટલા માટે જ મેં ઊભાં રહી બહું સાંભળ્યું અને હવે હું તમને આ કહેવા આવી છું : ‘તમે મુક્ત છો, સુખી થાઓ.’

### કવિ

(અત્યંત આર્ડ બનીને) પણ હું, તું? તારું શું? હું જાણું છું કે તારો નિવાસ તો તે તારી ચેતનાના મહા ઉચ્ચ શિખર ઉપર રાખેલો છે, ત્યાંના શુદ્ધ અને નિર્મળ પ્રકાશમાં

જ તું સદા વાસ કરે છે. તોય જીવન એકલું તે એકલું જ. આ એકલતા જરવવી કદીક  
તો બહુ અસહ્ય થઈ પડે છે. એ જીવનની નીરસતા, નિષ્પાણતા અસહ્ય છે.

## તે

ના, મારે એવી એકલતાનો ભય નથી. હું એકલી નહિ પડું. હું આપણા ગુરુઓ  
પાસે જઈશ, અને તેમની સાથે રહીશ. એ મહા પુરુષોએ આપણને જીવનનો માર્ગ  
બતાવ્યો છે, જગતના શાશ્વત જ્ઞાનના એ મહા ભંડારીએ, દૂર બેઠાં બેઠાં, આજ લગી  
આપણા જીવનને દોર્યું છે. હું માનું છું, તેઓ મને જરૂર પોતાની છાયામાં લઈ લેશે.  
(તે પારદૃષ્ટિ સંગીતકાર તરફ વળે છે અને તેનો હાથ પોતાના હાથમાં લે છે) આવો  
બહેન, તમે લેશ પાણ મુંજુશો નહિ. જે સ્વીના હદ્યમાં સંવેદનશક્તિ છે, જેનામાં  
સાચી ભાવના છે તેવી હરેક સ્વીને પોતાના સાથીને શોધી લેવાનો સંપૂર્ણ અધિકાર  
છે. જીવનમાં પોતે કોનું રક્ષણ લેવું, કોના પ્રકાશને અનુસરવું એ નિર્ણય તેઓ પોતે  
કરી શકે છે. જીવનનો આ એક કુદરતી નિયમ છે. તમારું વર્તન એ નિયમ અનુસાર  
જ રહેલું છે. અને એ રીતે, આ જે બધું બન્યું છે તે બરાબર જ બન્યું છે. તમને  
કદાચ નવાઈ થશે કે આ અમે શું કહી રહ્યાં છીએ, કેવું આચરણ કરી રહ્યાં છીએ.  
તમારે માટે આ બધી નવી વસ્તુઓ છે અને અમારા આ વર્તનનાં કારણોની તમને  
ખબર પાણ નથી. (કવિ તરફ હાથ કરીને) પાણ એ તમને બધુંએ સમજાવશે. વારું  
ત્યારે, હું વિદ્યાય લઉં છું હવે. પાણ લાવો, જતાં પહેલાં, તમારી સંમતિ હોય તો એક  
કામ કરતી જાઉં. (પારદૃષ્ટિ સંગીતકારનો હાથ લઈને તે કવિના હાથમાં મૂકી આપે  
છે) આ હો તમારું શુભ મિલન, તમારા પ્રેમનું સાફલ્ય. પ્રેમ જ જીવનમાં મહાનમાં  
મહાન આશીર્વાદ છે. એથી મોટો આશીર્વાદ બીજો નથી. તોય હું મારા આશીર્વાદ  
તેમાં ઉમેરતી જાઉં છું કેમકે હું જાણું છું કે તમને એ આશિષ વહાલી લાગશે. અને  
તમારી હા હોય, તો એ આશિષમાં એક સુવિચારના શબ્દ પાણ ઉમેરવા મન થાય  
છે. અથવા કહું કે લગભગ એક વિનંતી કરવાનું મન થાય છે. હું માણું કે તમારું  
આ મિલન તે તમારા આત્મવિકાસનું એક પગથિયું બની રહે. તમારું સહજીવન તમે  
શરીરની કુદાને માટે ન વાપરશો, અને તમે પશુવૃત્તિની તૃપ્તિનું સાધન ન બનાવશો.  
ઊલદું, તમારા સહજીવનનો આધાર લઈ તમે શરીરની કુદામંથી ઉપર નીકળી જવા  
પ્રયાસ કરજો. તમારા જીવનમાં સાથે રહીને તમે પૂર્ણ બનવાની સાધના આદરજો.  
એ માટે તમારી અંદર એક અખંડ જંખના જાગતી રાખજો, એ ધ્યેય તરફ પ્રગતિ  
કરવા તમારો પ્રયાસ સતત ચાલુ રહેજો. તમારું આ સહજીવન ઉમદા બનજો, ઉદાર  
બનજો. એ ઉમદાપણું તે તમારા ગુણોનું ઉમદાપણું દજો, એ ઉદારતા તે તમારા

વ્યવહારની ઉદારતા હજો. જગતમાં તમે એક દૃષ્ટાંત બની રહેજો, અને જગતનાં સૌ કલ્યાણવાંછુઓને બતાવજો કે માનવજીવનનું સાચું લક્ષ્ય શું છે.

### પારદૃષ્ટિ સંગીતકાર

(ખૂબ જ પીગળેલા હદ્યથી) ખરેખર, આ કંઈક અલૌકિક વસ્તુ તમે આપો છે. તમે અમારામાં મહા વિશ્વાસ મૂક્યો છે, અમને એક ગંભીર કાર્ય સોંઘ્યું છે. તમારા વિશ્વાસનાં અમે પાત્ર નીવડીએ, તમારી આશાઓને અમે સફળ કરીએ એ માટે અમે સદાય જાગૃત રહીશું. પણ તમારે મુખેથી મારે એક વાત જાણવી છે. કહો, હું આ ઘરમાં આવી અને તે પછી આ જે ઘટના બની છે તેથી ખરેખર તમારા જીવનમાં કોઈ ભારે આધાત તો મેં નહિ જ નિપણ્યા હોય.

તે

નહિ, નહિ. એવી ભીતિ ન રાખશો. ના, હવે તો એ વાત મને બહુ જ સ્પષ્ટ થઈ ગઈ છે કે મને તો જગતમાં માત્ર એક જ પ્રેમ તૃપ્તિ આપી શકે તેમ છે. એ પ્રેમ તે પ્રભુ પ્રતિનો પ્રેમ, પ્રભુનો દિવ્ય પ્રેમ. માત્ર એ જ પ્રેમ કદી કોઈને છેહ દેતો નથી. મને શ્રદ્ધા છે કે એક દિવસ મારી એ દિવ્ય પ્રેમની સાધના સફળ થશે. એ સાધના માટેની અનુકૂળ પરિસ્થિતિ, એ માટેની જરૂરી સહાય મને મળી રહેશે, મારા જીવનમાં એ પરમ સાક્ષાત્કાર સિદ્ધ થશે, મારું સ્થૂલ સ્વરૂપ એક નવા રૂપે બની રહેશે, દિવ્ય બની રહેશે. અને એ નૂતન રૂપાંતર, એ દિવ્ય સિદ્ધ જગતને બદલી નાખશે. આ સારુંયે જગત એક સુમેળ અને સંવાદની, પ્રકાશ અને જ્યોતિની, શાંતિ અને સૌન્દર્યની ધન્ય ભૂમિ બની રહેશે.

(પારદૃષ્ટિ સંગીતકારનું હદ્ય વધુ ને વધુ આર્દ્ર થતું જાય છે.

તે પ્રાર્થના કરતી હોય તેમ મૂક ઊભી ઊભી હાથ જોડે છે.

કવિ 'તે' ની પ્રતિ માનપૂર્વક ઝૂકે છે, તેનો હાથ

પોતાના હાથમાં લે છે અને પોતાનું લલાટ તેના

(ઉપર મૂકે છે. પડદો પડે છે.)

\*

## મહા રહસ્ય

ઇ એકોકિતાઓ અને એક ઉપસંહાર

નીચેનાઓના સહકારમાં

નલિની (લેખક)

પવિત્ર (વિજ્ઞાનશાસ્ત્રી)

આન્ડ્રે (ઉદ્ઘોગપતિ)

પ્રણાવ (વ્યાયામવિદ्)

ઇ વિશ્વવિદ્યાત પુરુષો કોઈ એક આકસ્મિક રીતે એક લાઈફબોટમાં ભેગા થઈ ગયેલા છે, જો કે આવી આકસ્મિક ઘટનાઓ ખરું. જોતાં આકસ્મિક હોતી જ નથી. આ પુરુષો માનવ-પ્રગતિ માટે યોજાયેલી એક વિશ્વપરિષદમાં ભાગ લેવાને એક વહૃાણમાં જઈ રહ્યા હતા. એમના એ વહૃાણને મધ્યદરિયે અક્સમાત થયો અને એ બધાએ એક લાઈફબોટમાં આશ્રય લીધો હતો.

આ બોટમાં એક સાતમો માણસ પણ છે. એ યુવાન છે, અથવા કહો કે એને કોઈ વય નથી, એ વયથી પર છે. એનાં વખ્તો કોઈ પણ અમુક દેશની કે કાળની ન કહેવાય તેવી શૈલીનાં છે. સુકાન પાસે એ બેઠેલો છે, સ્થિર અને મૂંગો, પરંતુ બીજાઓ જે બોલે છે તેને તે ધ્યાનપૂર્વક સાંભળી રહેલો છે. આ બધા લોકો એના તરફ ઉપેક્ષાભાવથી જુએ છે, એને કોઈ ગણનાપાત્ર વ્યક્તિ ગણતા નથી.

આ માણસો આ છે;

(૧) રાજપુરુષ

(૨) લેખક

(૩) વિજ્ઞાનશાસ્ત્રી

(૪) કલાકાર

(૫) ઉદ્ઘોગપતિ

(૬) વ્યાયામવિદ्

(૭) અજ્ઞાત માનવ

પાણી લગભગ ખૂટી ગયેલું છે. ખોરાક પૂરો થવા આવ્યો છે. શારીરિક યાતના અસંઘ બનવા લાગી છે. ક્ષિતિજ ઉપર કોઈ આશાનું ચિહ્ન દેખાતું નથી. મૃત્યુ નજીક આવી રહેલું છે. પોતાના આ વર્તમાન દુઃખને ભૂલી જવા માટે દરેક જણ પોતાની જીવનકથા કહે છે.

(પડદો જિપે છે.)

## રાજપુરુષ

તમારી એવી દીચ્છા છે તો ભલે, પહેલો હું તમને મારી જીવનકથા કહીશ.

હું એક રાજપુરુષનો પુત્ર હતો. એટલે છેક બાળપણથી જ મને રાજતંત્ર અંગેના તથા રાજકારણના પ્રશ્નોનો પરિચય થઈ ગયો હતો. મારાં માતાપિતા પોતાના ભિત્રોને માટે મોટા મોટા ભોજન સમારંભો યોજતાં હતાં, તેમાં આ પ્રશ્નો છૂટથી ચર્ચાતા હતા અને હું બાર વર્ષનો હતો ત્યારથી મને આ ખાણાંમાં ભાગ લેવાની તક મળેલી હતી. પરિણામે મારે માટે દરેક જુદા જુદા પક્ષના અભિપ્રાયો હવે ગુપ્ત વસ્તુ રહ્યા ન હતા. અને મારા નાનકડા ઉત્સાહી મગજે આ એકેએક મુજ્જેલીના માટે સહેલા સટ ઉકેલો શોધી કાઢ્યા હતા.

મેં ભાગવા માંડ્યું ત્યારે મારો અભ્યાસ પણ સ્વાભાવિક રીતે આ જ દિશામાં આગળ વધ્યો અને રાજકારણનો હું એક તેજસ્વી વિદ્યાર્થી બની રહ્યો.

પરંતુ પછીથી જ્યારે આ સિદ્ધાંતોને વ્યવહારમાં ઉતારવાનો પ્રસંગ આવ્યો ત્યારે મારી સામે ગંભીર મુજ્જેલીઓ આવીને ઊભી રહેવા લાગી. હવે મને સમજવા લાયું કે પોતાના વિચારોને વ્યવહારમાં મૂર્ત કરવા એ તો લગભગ એક અશક્ય જેવું કાર્ય છે. હું જેમ જેમ કામ કરતો ગયો તેમ તેમ મારે સમાધાનો કરતાં જવાં પડ્યાં અને થોડે થોડે કરતાં મારો મહાન આદર્શ બિચારો ચીમળાઈ ગયો.

મને એ વાત પણ હવે જણાઈ આવી કે જીવનમાં માણસને જે સફળતા મળી આવે છે તે તેના વ્યક્તિગત ગુણોના પ્રમાણમાં નથી હુંતી. એ તો માણસમાં સંજોગોને અનુકૂળ થઈ જવાની જે આવડત હોય છે, બીજાઓને ખુશ રાખવાની જે કણા હોય છે તેમાંથી આવતી હોય છે. અને આ માટે તમારે લોકોની દુર્બળતાઓની ખુશામત કરવાની રહે છે, તેમની અપૂર્ણતાઓને સુધારવાનો પ્રયત્ન કરવાની વાત તો ભૂલી જ જવાની રહે છે.

આપ સર્વ એ તો જાણો જ છો કે મારી કારકિર્દી કેવી તો તેજસ્વી હતી. એટલે એ વિષે મારે કશું કહેવાની જરૂર નથી. પરંતુ આપને હું એક વાત કહીશ. હું જ્યારે વડો પ્રધાન બન્યો અને એ સ્થાને મારા હૃથમાં થોડીએક સાચી સત્તા આવી ત્યારે મારી જીવાનીમાં માનવ-કલ્યાણ કરવા માટેની જે જે મહત્વાકંશાઓ મેં સેવી હતી તે બધી તાજી થઈ અને એ મુજબ મેં કામ કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો. પ્રથમ તો હું કોઈ પણ પક્ષનો ન રહું એમ બની રહેવા મેં પ્રયત્ન કર્યો. અને પછી જગતના

રાજકારણના અને સમાજજીવનમાંના પ્રવાહો વચ્ચે જે મહાન સંધર્ષ ચાલી રહેલો હતો તેનું નિરાકરણ શોધવા માટે પ્રયત્ન આઈયો. મેં જોયું કે આ ભિન્ન પ્રવાહો વચ્ચે જગત ચિરાઈ રહેલું છે. સાથે સાથે મને એ પણ જાણાયું કે આ દરેક પ્રકારના પ્રવાહનાં લાભ પણ છે અને ગેરલાભ પણ છે. કોઈ પણ એક દૃષ્ટિબિંદુ સંપૂર્ણ રીતે સાચું નથી, તો પૂરેપૂરું ખોટું પણ નથી, સારું નથી તેમ જ ખરાબ પણ નથી. આ દરેક દૃષ્ટિમાં જે ઈષ વસ્તુ હોય તેને કેવી રીતે જાણી લેવી તે આપણે શોધવાનું રહે છે અને તે બધામાંથી એક વ્યવહારું રીતનો સંવાદપૂર્ણ માર્ગ ઉપજાવવાના રહે છે. પણ મારે કહેવું પડે છે કે બધાં વિરોધી તત્ત્વોના મેળ મેળવી આપે તેવો કોઈ સમન્વય શોધવામાં હું નિષ્ફળ જ નીવડ્યો અને એથીયે વધુ તો એવા કોઈ પણ સમન્વયને હું વ્યવહારમાં ઉતારી શક્યો નહિએ.

મારે તો જગતમાં શાંતિ જોઈતી હતી, સુમેળ જોઈતો હતો, જગતની પ્રજા પ્રજાઓ વચ્ચે ભિત્રાચારીભરી સમજૂતી જોઈતી હતી, માનવ માત્રના હિતને માટે સર્વનો સહકાર જોઈતો હતો. પરંતુ મેં જોયું કે મારા કરતાંયે કોઈ એક મહાન એવી શક્તિ આવીને મને યુદ્ધ કરવાની ફરજ પાડી રહી છે, મારે યુદ્ધ આદરવું પડ્યું, ગમે તેવાં સાધનોનો ઉપયોગ કરીને એ યુદ્ધને આગળ ધપાવવું પડ્યું અને કેટલાયે કૃપણ, અનુદાર નિર્ણયો લઈને એ યુદ્ધને જીતવું પડ્યું.

અને મેં આ બધું કર્યું છે છતાં લોકો મને એક મહાન રાજપુરુષ તરીકે વધાવી રહેલા છે, મારા પર માનપાન અને પ્રશંસાની વૃષ્ટિ થઈ રહેલી છે. જગત મને માનવતાના મહા ભિત્ર તરીકે સંબાધી રહેલું છે.

પણ હું જાણું છું કે હું કેવો તો દુર્ભણ માનવ છું. મને ખબર છે કે મારા બાળપણની આશાઓને સફળ કરી શકે તેવું સાચું જ્ઞાન મારા હૃથમાં આવેલું નથી, એવી કોઈ સાચી શક્તિ મને મળી નથી.

અને હવે તો અંત નજીક આવી રહ્યો છે. મને લાગે છે કે જગતમાં હું બહુ જ ઓછુ કરી શક્યો છું, અને મેં જે કંઈ કર્યું છે તે પણ બહુ જ ખરાબ રીતે કરેલું છે. મૃત્યુના દરવાજામાં હું આ પગ મૂકી રહ્યો છું ત્યારે મારું અંતર ઉદાસ છે, મારાં સ્વપ્નો ભાંગી ગયેલાં છે.

## લેખક

હું તો વાણીની પાંખે ચડીને, જીવનમાં ધબકતા સૌન્દર્ય અને સત્યના ધબકારને જીલવા નીકળી પડ્યો હતો. આપણાં ચક્ષુ સમક્ષ આ સૃષ્ટિનો પટ પેલો છે. અહીં પૃથ્વી ઉપર માણસો છે, પ્રાણીઓ છે, આ જીવો છે અને પદાર્થો છે, આ દશ્યો છે અને ઘટનાઓ છે. અને સાથે સાથે એક બીજું જગત પણ છે આના જેવું જ, આપણી અંદર આપણી લાગણી અને ચિંતનો, આપણાં સંવેદનો અને ચેતનાની આ આંતર સૃષ્ટિ પણ ઘણી ઘણી મહાન છે. અહીં આ બધાં મળીને એક અગમ્ય એવો પટ ગુંથાઈ રહેલો છે, તેડોલસની રચેલી જાણે કે ભૂલભૂલામણી, કોઈ મયદાનવનો રચેલો માયામહેલ. આ મનોહર સૃષ્ટિએ મને જાહું કર્યું, એનો પુકાર મારા કાને આવ્યો કે મને જાણી લે, સમજી લે, પકડી લે. એવો મધુર પુકાર, એવી આજ્ઞાકારક વાણી મેં કદ્દી સાંભળી ન હતી. અને એ અવાજનો રણકાર હું શબ્દોમાં જીલવા મથ્યો છું.

મારે જગતના રહસ્યને વાચા આપવી હતી. આ સૃષ્ટિની મૂક સ્ફિન્કસને બોલતી કરવી હતી. જગતની પાછળ કશુંક છુપાયેલું છે, કશુંક અકબંધ વસાઈને પેલું છે, અને પોતાની ગેબમાંથી સૂર્યો અને સિતારાઓને, માનવનાં હદ્યને એ ગતિમાં મૂકી રહેલું છે. એ તમામ પરનો પરદો મારે ખોલી નાખવો હતો, એ રહસ્યને દિવસની રોશનીમાં રજૂ કરી દેવું હતું. આ જગતની ઘટમાળ, સ્થૂલ અને સૂક્ષ્મ બંનેય જગતોની ઘટમાળ, જાણે કે એક કઠપુતલીનો ખેલ છે, મૂંગો મૂંગો ચાલ્યા કરતો. પણ એ ખેલ ગોટાળિયો પણ છે. એ ખેલને મેં વાચા આપી, ચેતના આપી. મેં જોયું કે આ વાણી, આ શબ્દ એ તો એક અદ્ભુત સાધન છે, પરમ સાધન છે. વાણી પોતાના દેહમાં વસ્તુને બાંધી પણ લે છે અને તેને પ્રગટ પણ કરે છે. એ પ્રવાહી છે છતાં અસ્પષ્ટ નથી, એ સધન છે છતાં અપારદર્શક નથી. શબ્દ એકી સાથે બે જગતનો નિવાસી છે. એ સ્થૂલ જગતમાં વસનારો છે અને તેથી તે સ્થૂલનું બનેલું રૂપ રચી શકે છે, એ સૂક્ષ્મ જગતનો વાસી પણ છે અને સૂક્ષ્મ વસ્તુઓ સાથે, સૂક્ષ્મ શક્તિઓ અને આંદોલનો સાથે, સિદ્ધાંતો અને વિચારો સાથે પણ સંપર્કમાં રહી શકે છે. એ અસ્થૂલને સ્થૂલમાં લાવી શકે છે, અદેહને દેહ આપી શકે છે. અને સૌથી વિશેષ તો શબ્દ વસ્તુનો મર્મ બતાવી શકે છે, રૂપમાં રહેલો ચોક્કસ ભાવ વ્યક્ત કરી શકે છે.

મારાં ઉર્ભિકાવ્યોમાં મેં હદ્યની જંખનાઓને ગુંથવાના પ્રયત્નો કર્યા, માનવમાં કે પ્રકૃતિમાં કઈ જંખના રહેલી છે, એ શાને માટે આતુર છે, શા કારણો રહ્યે છે. એનાં

મેં ગીત ગાયાં. પછી મેં એથીયે વિશાળ પટ હુાથ લીધો. કથા અને કહાની લખી, જીવનના ભાવ અને પ્રેરણા આલેખ્યાં, અનેક રૂપે અનેક રીતે. જીવનમાં વિરલ જ પ્રગટાતું શાશ્વતપણ, જીવનમાં ડગલે ડગલે તોકાતી મૂર્ખતા અનાં મેં ચિત્ર દોર્યાં. ઈતિહાસ આલેખ્યો, માનવની ચેતનાનો, પ્રકૃતિની ચેતનાનો. મેં ઈતિહાસને સરજતી ઘટનાઓ ગૂંઠી એમાં પ્રાણ પૂર્યા, અના રહસ્યો તારવ્યાં અને મેં નાટકો રચ્યાં, જીવના મંગલ પ્રવાહોનાં અને કરુણ પ્રવાહોનાં. અને આપ સૌઅં જોયું કે કળાનું આ પ્રાચીન રૂપ આજના અર્વાચીન જીવનમાં પણ કેવું તે સમર્થ વાહન બની શકે છે, આજની કૃધાઓ અને લાગણીઓને કેવી તો ભવ્ય રીતે આલેખી શકે છે. અને મેં પાત્રો સર્જર્યાં, અમર અને અવિસમરણીય. જીવનાં જીવતા બળોને તેમાં મેં જીવતા જાગતા કરી મૂક્યાં. એ હતી મારી નવલકથાઓ. આજના યુગ માટે, આજના વૈજ્ઞાનિક અને શોધક માનસને માટે તો આ એક ઘણું વિશાળ, ઘણું વધારે સ્પષ્ટ અને સમર્થ સાધન છે. નવલકથા વસ્તુનું ચિત્ર આપે છે અને તેનું રહસ્ય પણ આપે છે. અને એ મહાન સાધનનો પ્રયોગ કરી મેં વ્યક્તિત્વોની અને સમાજોની જીવનકથા આલેખી, એથીયે આગળ જઈ મેં માનવતાની કથાને પણ કહેવાનું સાહસ આદર્યું. આ માનવતાના જીવનનો ચકરાતો, અમળાતો, ઉંચે ઉંચે ઉછળતો મહા પ્રવાહ, એમાંથી પણ કંઈક મારી નવલકથામાં મૂક્યા મેં મહેનત કરી. પણ મને ખબર હતી, મારું હૃદય કહેતું હતું કે માનવના આત્માને એકલી વિશાળતા, આ નર્યા વિસ્તાર — આ એકલો વિરાટ સમાનભાવ પૂરતાં નથી. અને તો ઊર્ધ્વ ગતિ પણ જાઈએ છે. અને તો કોઈ મહા શૈલી પણ જોઈએ છે અને એટલે મેં મહાકાવ્ય રચ્યું. ખરેખર મારા સારાયે જીવનનો એ પરમ પુરુષાર્થ હતો. હા, એ ખરું છે કે આપનામાંથી ઘણાને એ મહાકાવ્ય સમજાતું નથી, તેમ જ સમજાયું પણ નથી. ઘણા લોકો માત્ર અનાથી અંજાઈ ગયા હતા. તો પણ હુરેકના ઉપર એ મહાકાવ્યે પોતાનું જાહુ તો પાર્થર્યું જ છે. ખરેખર, જગતના રહસ્યને બેદીને ખુલ્લાં કરી દેવાનો એ મારો આખરી પ્રયાસ હતો, મરણિયો પ્રયાસ હતો.

હું મારા વિષયો બદલતો રહ્યો છું, મારી શૈલીઓ બદલતો રહ્યો છું. એક સિદ્ધહસ્ત વૈજ્ઞાનિકની ઠબે મેં શબ્દો સાથે જાહુના જેલ કર્યા છે. હું શબ્દનું બંધારણ બદલી શકતો, શબ્દની કાયાપલટ કરી શકતો. શબ્દમાં એક નવીન અર્થ, નવીન ધ્વનિ, નવું તત્ત્વ પૂરી શકતો. મારી વાણીમાં રોમન વક્તા સિસેરોની છટા હતી, આંગ્સ મહાકવિ મિલ્ટનની સભરતા હતી, ફેન્ચ કવિ રાસીનની ઋજુતા હતી. વર્ડસવર્થની ઉત્તમોત્તમ કૃતિઓમાં આવતી સરલતા પણ હું લાવી શકતો, શેકસપિયરનું જાહુ પણ પ્રગટાવી શકતો. મારે માટે વાલ્મીકિની ભવ્યતા અને વ્યાસની ઉદાતતા આપ્રાય ન હતાં.

અને છતાં મારાથી સિદ્ધિ ઉજી દૂર જ રહી છે. મને મારી કલાથી સંતોષ નથી.

હું દુઃખી છું. મેં કરી કરીને છેવટે શું કર્યું છે? માત્ર સ્વભોનું સર્જન : “હવામાં સ્વભન વાવિયાં?” મને લાગે છે જગતના સાચા સત્યને હું સ્પર્શી શક્યો નથી, જગતના આત્મસૌન્દર્યને હું જાણી શક્યો નથી. મેં માત્ર સપાઠીને જ ખોતર્યા કરી છે. પ્રકૃતિના બહારના ઉપવસ્તુને જ હું રમાડતો રહ્યો છું. પરંતુ પ્રકૃતિનો ખરો દેહ, પ્રકૃતિનો ખરો આત્મા એ તો મારા હાથમાં આવ્યો જ નથી. આ સૃષ્ટિના શરીરની આસપાસ મેં એક કરોળિયાનું જાણું વાયું છે. એ ભલે ગમે તેટલું સુંદર દેખાય, પણ છેવટે એ એક જાણું જ છે. આ જગતના રહસ્યમાં દાખલ થવા માટે, તેને પ્રકટ કરવા માટે, તેને વ્યક્ત અને સાકાર કરવા માટે મેં જે જે સાધનને, જે જે કરણને શુદ્ધ અને સંપૂર્ણ માન્યાં હતાં તે આખર જતાં નકામાં નીવડયાં છે. મને છેવટે તો જણાયું છે કે સૃષ્ટિના અંતરતમ સ્વરૂપમાં તો કોઈ એક મહાન નીરવતા, કોઈ નરી મૂક્તા, એના જેવું જ કંઈક આવી રહેલું છે.

સૃષ્ટિનો આ અનંત પ્રવાહ વહી રહ્યો છે, આ લક્ષાધિ જગતો જન્મી જન્મીને નાશ પામી રહ્યાં છે એ નશરતાની સરિતાને કિનારે ઊભો ઊભો હું લાચાર બની હાથ પ્રસારી રહ્યો હું અને પેલા ફાસ્ટસની પેઠે પુકારી રહું છું, “હે અનંતાનંત પ્રકૃતિ, કહે કહે, હું તને ક્યાં પકડી શકીશા?” એક મહાન કવિને વિષે એક એવી ઉપમા આવેલી કે એ તો શૂન્યના ભીતરમાં પોતાની સુવાર્ણ પાંખોને વ્યર્થ વીજી રહેલો નિષ્ફળ દેવદૂત હતો. હું કહીશ, અમારી આખીયે જાતિ આવી જ છે.

મારા જીવનના અંતે, હજુ પણ એક બાળક જેવી જ અખુદ દશામાં ઊભો ઊભો હું પુકારી રહું છું “આ શું છે બ્યં? કર્મૈ દેવાય હવિષા વિદેશ? - અમારે કયા દેવને નમસ્કાર કરવાના છે? આ શક્તિનું સ્વરૂપ-પ્રભુનો આ વિરાટ દેહ કોના જેવો છે?”

### ૩

## વિજ્ઞાનશાસ્ત્રી

મારા જીવનનો આરંભ આપ લોકોમાંથી કેટલાકના જીવન કરતાં જુદી જ રીતે થયો છે. મારા માનવ બંધુઓનું જીવન મારે સુધારવું જોઈએ એ ભાવના મારાં જીવનમાં પહેલેથી ન હતી. મને કર્મ કરતાં જ્ઞાનનું આકર્ષણ વિશેષ હતું અને આ જ્ઞાન તે અર્વાચીન રીતનું વૈજ્ઞાનિક જ્ઞાન, એ મને વિશેષ ગમતું હતું. મને થતું કે આ પ્રકૃતિના રહસ્ય ઉપર એક પરદો ઢંકાઈ રહેલો છે, એ પરદાનો એકાદ ખૂઝો પણ જો ઊંચો કરી દઈ શકું, પ્રકૃતિની ગુપ્ત કમાનોનું રહસ્ય હું જો થોડું સરખું પણ વધુ સમજી શકું તો એ એક અદ્ભુત ઘટના બની જશે, આમાં એક વિચાર તો મેં, કદાચ અજ્ઞાત રીતે જ,

સ્વીકારી લીધો હતો કે માણસના જ્ઞાનમાં જે કંઈ વધારો થાય છે તેના પરિણામે તેની શક્તિમાં પણ વધારો થાય જ છે. પ્રકૃતિના ઉપર કોઈ નવું પ્રભુત્વ મેળવી શકાય તો તેમાંથી, વહેલાં મેડાં, માણસની પરિસ્થિતિમાં, તેના ભૌતિક તેમ જ નૈતિક જીવનમાં પણ કંઈક સુધારો થવો જ જોઈએ. મારી દૃષ્ટિએ, જગતમાં અજ્ઞાન એ જ એક અનિષ્ટ હતું ભલે પછી એ એકમાત્ર અનિષ્ટ ન હોય તો પણ અન્ય સર્વ અનિષ્ટોનું આદિ અનિષ્ટ તો ખરુ જ. આ વિચાર એકલો મારો જ ન હતો. ગઈ સદીમાં વિજ્ઞાનનાં મંડાણ થયાં ત્યારે એના વાતાવરણમાં જન્મેલા તમામ વિચારકો પણ આમ જ માનતા હતા. અમને લાગતું હતું કે માનવજ્ઞતિની આગ્રહ્ય આ અજ્ઞાનને લીધે જ અટકી રહી છે. વળી અમે બીજી એક વસ્તુ પણ સ્વીકારી લીધો હતી કે માનવની પૂર્ણતાને કોઈ સીમા નથી. પ્રગતિ ભલે ધીરી થાય કે જડપથી, પરંતુ તે થવાની જ છે એમાં શંકા નથી. આપણે આટલે સુધી આવ્યા છીએ તો આથી પણ હવે આગળ જઈ શકીએ છીએ જ. અને પરિણામે અમો વૈજ્ઞાનિકોનો એ નિર્ણય હતો કે જગતમાં જેટલી જ્ઞાનનીમવૃદ્ધિ થશે તેટલી વધુ સમજ આવશે, વધુ શાણપણ આવશે, વધારે ન્યાય સ્થપાશે. ટૂંકમાં જગત વધુ પ્રગતિ કરશે.

આમાં એક બીજો વિચાર પણ અમે આપોઆપ સ્વીકારી લીધા હતા. એ વિચાર એ હતો કે આ વિશ્વનું જે ખરેખરું સ્વરૂપ છે તેને યથાર્થ રીતે જાણી શકાય તેમ છે, વિશ્વના નિયમોને તેમના મૂળ રૂપે વસ્તુગત રીતે સમજ શકાય તેમ છે. આ વસ્તુ એટલી બધી તો સ્પષ્ટ દેખાતી હતી કે એની સત્યતા વિષે અમને શંકા પણ નહિ થયેલી. વિશ્વ અને હું — અમે બંને હસ્તીમાં છીએ. અને આમાંથી બંનેએ એકમેકને સમજવાનાં એ તેમનું કાર્ય છે. બેશક, હું વિશ્વનો જ એક અંશ છું પણ એ વિશ્વને સમજવાની કિયા કરતી વેળા હું વિશ્વથી અલગ થઈ જઈને ઊભો રહું છું અને વિશ્વને એક બિન્ન વસ્તુ તરીકે નિછાળું છું. હું એ વાત પણ સ્વીકારું છું કે હું જેને પ્રકૃતિના કાયદાઓ કરું છું તે મારાથી સ્વતંત્ર રીતે જ હસ્તી ધરાવી રહેલા છે. એ નિયમોને તેમનું પોતાનું આગવું અસ્તિત્વ છે અને જે જે માણસોની બુદ્ધિ એ નિયમોને સમજ શકે તેવી હશે તે સર્વને માટે એ નિયમો એકસરખા જ છે.

શુદ્ધ જ્ઞાન અંગે એ વખતે આ પ્રમાણેનો એક આદર્શ હતો. અને એ આદર્શથી પ્રેરણા પામીને મેં મારું કામ શરૂ કર્યું. મેં ફિલ્ડિક્સ-ભૌતિક વિદ્યાનો વિષય પસંદ કર્યો. તેમાંથી ખાસ તો આજુનો, રેડિયો એક્ટિવિટીનો વિષય લીધો. આ વિષયના રાજમાર્ગો બેકરેલ અને કયુરોઝે બાંધી આપેલા હતા. એ નૈસર્જિક રેડિયો એક્ટિવિટીનું સ્થાન વખતે ઉત્પાદિત રેડિયો એક્ટિવિટી લેવા લાગેલી હતી. હવે જાણે કે આ આલ્કેમિસ્ટો-ક્રીમિયાગરોનાં સ્વખો સાચાં થવા લાગ્યાં હતા. યુરેનિયમનું બેદન શોધી કાઢનાર જગતના મહાન ભૌતિકશાસ્ત્રીઓ સાથે હું કામ કરતો હતો. આજુ બોમબનો જન્મ

થતો મેં સગી આંખે જોયો. એ મારે માટે એક સખત, ખંતીલી, એકાગ્ર સાધનાનો કાળ હતો એ સમયમાં જ મને એક વિચાર સ્ક્રૂઓ અને એમાંથી મારી પ્રથમ શોધ સર્જઈ. એ શોધના પરિણામે આપણે હવે ઈન્ટ્રો-એટોમિક-આશુસ્થ યા તો ન્યુક્લિયર શક્તિમાંથી જ હવે સીધેસીધી વિદ્યુત શક્તિ મેળવી શકીએ છીએ. આપ સૌ જાણો છો કે આ આશુસ્થ વિદ્યુતની શોધને લીધે આખાય જગતની આર્થિક પરિસ્થિતિમાં એક ધરમૂળનો ફેરફાર થઈ ગયેલો છે. કારણ કે આને પરિણામે હવે હરેક માણસને બહુ જ ઓછી કિંમતે વીજળી મળી શકે તેમ છે. આ શોધે માણસને માયેથી શારીરિક મજૂરીનો અભિશાપ હૃદાવી દીધો છે પરસેવો પાડીને જ રોટી કમાવવાની ફરજમાંથી તેને મુક્ત કર્યો છે. અને પરિણામે આ શોધખોળે આખાયે જગતને આશ્વર્યચક્તિ કરી મૂકી.

આ રીતે મારા યૌવનનું સ્વખ બન્યું. સજજનો, આ એક ઘણી મહાન શોધ હતી. અને મને સાથે સાથે એ પણ જાણાઈ આવ્યું કે જગતને માટે આ તો એક ઘણી મહત્વની સિદ્ધિ છે, એક ઘણું મહાન વરદાન છે. અને એ વસ્તુ મારી કોઈ ખાસ ઈચ્છા વિના જ બની આવી હતી.

આટલું કાર્ય તો મારે માટે ઘણું ઘણું હતું. હું તેથી જીવનમાં અપાર તૂપ્તિ અનુભવી શકું તેમ હતું. પરંતુ મને મળેલી તૂપ્તિ અલ્પજીવી જ હતી. કેમકે, આ શોધ પછી થોડા જ સમયમાં મે એક બીજી શોધખોળ કરી. આ વાત મારા સિવાય કોઈને હજુ મેં કહી નથી, પરંતુ આપ સૌને એ કહી શકું છું. આપણે માટે હવે મૃત્યુ હાથવેંત જ દૂર રહ્યું છે, અને મારું આ ગુપ્ત રહસ્ય મારી સાથે જ દફનાઈ જવાનું છે એટલે એને કહેવામાં હવે કશી હાનિ દેખાતી નથી. આ શોધખાળમાં મે યુરેનિયમ, થોરિયમ અને બીજી કેટલીક વિરલ ધાતુઓમાંથી આશુશક્તિને મુક્ત કરવાની પદ્ધતિ શોધી કાઢી. એટલું જ નહિ પણ એથીયે આગળ વધીને મે ત્રાંબુ, એલ્યુમિનિયમ ઈ. જેવી ઘણીખરી તમામ સામાન્ય ધાતુઓમાંથી પણ આશુશક્તિને મુક્ત કરવાની પદ્ધતિ ઉપજાવી. પણ આ શોધ પછી તો મારી સામે એક મહાન પ્રશ્ન આવીને ખડો થયો અને એના વિચાર આવતાં તો મારું હદ્ય લગભગ ભાંગીને ભુક્કા થઈ ગયું. હવે પ્રશ્ન એ બન્યો કે મારે આ શોધને જાહેરમાં મૂકવી કે નહિ? એ પ્રશ્ન હજુ પણ આણગુકલ્યો જ રહ્યો છે. અત્યારે તો જગતમાં કેવળ હું જ એ મહા રહસ્યને જાણું છું.

આપ સૌએ એટમ બોમ્બની કથા તે જાણેલી જ છે. આપ જાણો છે કે આ બોમ્બ પછી એના કરતાં પણ અનેકગાડી વધુ વિનાશક શક્તિવાળું બીજું શરૂ શોધાયું છે.-ઇન્ડ્રોજન બોમ્બ. આપ અને હું — આપણે સૌ જાણીએ છીએ કે આ શોધખોળોને પરિણામે માણસજીતિના હાથમાં પૂર્વે કદી ન હતી તેવી પ્રયંક વિનાશક શક્તિ આવી ગઈ છે અને એ શક્તિના ભારણ હેઠળ માનવજીત આજે થરથર કંપી

રહેલી છે. પરંતુ હું જો મારી શોધ બહાર પાડું, મારા રહસ્યને જો ખુલ્ણું કરી દઉં, તો તો હવે, કહો કે, હરકોઈ માણસના હાથમાં એક મહા રાક્ષસી શક્તિ આવી જશે. શક્તિના ઉપર સરકાર કોઈ પણ રીતે કશો કાબૂ કે નિયંત્રણ નહિ મૂકી શકશે. યુરેનિયમ અને થોરિયમ ધાતુઓ વિષે તો એમ હતું કે સરકારો તેમને સહેલાઈથી પોતાના એકહથ્ય કાબૂમાં રાખી શકતી હતી. કેમકે, પ્રથમ તો આ ધાતુઓ પોતે જ ઘણી વિરલ છે અને બીજું તેમને એમિક પાઈલમાં કામ કરતી કરવી એ તો ઘણું મુશ્કેલ કામ છે. પરંતુ આ નવું હથિયાર તો કોઈ પણ સાધારણ માણસ પણ નાની સરખી પ્રયોગશાળા ઊભી કરીને બનાવી શકે છે. અને આવું પ્રયંડ હથિયાર, આખા ને આખા પેરિસ, લંડન કે ન્યૂયૉર્કને એક જ ઘડકામાં ઉડાડી દઈ શકે તેવી પ્રયંડ શક્તિ કોઈ પણ ચકમ કે ઝનૂની માણસના હાથમાં મુકાઈ જાય તો જગતનું શું થાય તે આપ કટ્ટી શકશો. એ તો માનવજાતને માટે મૃત્યુની જ ભેટ બની રહે! સજજનો, મારી શોધ આમ મારા હદ્ય ઉપર એક મહા શિલા પેઠે તાળાઈ રહેલી છે. હું કેટલાયે વખતથી આના વિચારમાં અટવાયા કરું છું, અને મારા હદ્યને તેમ જ બુદ્ધિને બંનેને સંતોષ મળી શકે તેવા નિર્ણય ઉપર હું હજુ આવી શક્યો નથી.

આ રીતે, પ્રકૃતિનાં રહસ્યોની શોધ આદરતી વેળા, મારા યુવાન મગજે જે એક પહેલો વિચાર સ્વીકારી લીધો હતો તે ધરાશાયી બની ગયો. માનવતાના જ્ઞાનમાં જે જે વૃદ્ધિ થાય છે તેમાંથી જો માનવની શક્તિમાં પણ સાથે સાથે વૃદ્ધિ થતી હોય છે તો પણ એનું પરિણામ એ નથી આવતું કે એમાંથી માનવજાત આપોઆપ જે એક વધુ ઉત્તમ સ્થિતિમાં પહોંચી જાય છે. વિજ્ઞાનની પ્રગતિ થતાં માણસની નૈતિક પ્રગતિ પણ થાય જ છે એમ કહી શકતું નથી. વૈજ્ઞાનિક જ્ઞાનમાં, બૌદ્ધિક જ્ઞાનમાં માનવની પ્રકૃતિને બદલવાની કોઈ શક્તિ નથી, અને છતાં આ પ્રકૃતિને બદલવાની તો રહે છે જ. પથ્થર યુગના માણસમાં જે રીતની લોભવૃત્તિ હતી, જે રીતનાં આવેશો હતા તેવા જ આવેશો અને લોભવૃત્તિ જો આજના યુગના માનવમાં પણ ટકી રહેવાનાં હશે તો માણસજાતિને માટે વિનાશ જ સર્જયિલો છે. આજે માનવજાત એવી સ્થિતિએ પહોંચી છે કે તેનામાં જો હવે જરૂરી અને સમૂળ એવું કોઈ નૈતિક પરિવર્તન નહિ આવે તો એ માનવજાતિ પોતાના હાથમાં આવેલી આ શક્તિ વડે પોતાનો જ વિનાશ કરી દેશે.

અને હવે મારા યૌવનના બીજા મહા વિચારની વાત કહીશ. એની પણ કેવી દુર્દ્શા થઈ ગઈ! મારે તો શુદ્ધ જ્ઞાનનો આનંદ જોઈતો હતો, પ્રકૃતિના ગુપ્ત મંત્રનું રહસ્ય પાકે પાયે હાથ કરવું હતું. પ્રકૃતિના સાચા નિયમોને મારે સમજવા હતા અને એ જ્ઞાનનો મારે આનંદ માણસો હતો. પરંતુ એમાંથી પણ કશું પ્રાપ્ત ન થયું. અહીં પણ મારો આદર્શ તૂટી પડ્યો... હવે અમે વૈજ્ઞાનિકોએ એ વિચાર તો કયારનોયે મૂકી

દીધો છે કે કોઈ પણ વાદ કાં તો સાચો હોય કે કાં તો ખોટો જ હોય. અત્યારે એમે માત્ર એટલું જ કહીએ છીએ કે અમુક વાદ સ્વીકારવાથી આપણને વધારે અનુકૂળતા રહે છે, એ વાદ હકીકતો સાથે મળતો આવે છે, હકીકતોના ખુલાસા આપે છે. પરંતુ આ વાદ ખરેખર સાચા જ છે, એટલે કે વાસ્તવિક સત્ય પ્રમાણેનો જ છે એવું જ્ઞાન આપણને મળ્યું છે એમ કહેવાય કે નહિ એ જુદો જ પ્રશ્ન છે. કદાચ એવો પ્રશ્ન કરવો એમાં પણ કશો અર્થ નથી. અત્યારે વિજ્ઞાનના ક્ષેત્રમાં એક કરતાં વધુ વાદો પ્રવર્તી રહેલા છે. એકની એક જ હકીકતોને એટલી જ સરસ રીતે સમજાવતા બીજા વાદો પણ અસ્તિત્વમાં છે. અને એ પણ એટલા જ સાચા હોઈ શકે છે. પણ આપણે વિચાર કરો કે આ વાદ તે ખરેખર શું છે? એ માત્ર સકેતો જ છે. હા, એના આધારે આપણે અગાઉથી કેટલુંક જોઈ શકીએ છીએ તેટલા પૂરતા તે કામના તો છે જ. વસ્તુઓ કેવી રીતે બને છે એ આ વાદો સમજાવે છે, પરંતુ આ વસ્તુઓ શા માટે અસ્તિત્વમાં આવી, અને તેમનું અસ્તિત્વ શા માટે છે તે કોઈ વાદ સમજાવી શકતો નથી. આ વાદો આપણને વાસ્તવિકતામાં લઈ જતા નથી. આપણને જાણો એમ જ લાગે છે કે આપણે સત્યની આસપાસ, વાસ્તવિકતાની આસપાસ ગોળ ગોળ ફરી રહ્યા છીએ, તેને જુદા જુદા ખૂણાએથી, જુદા જુદા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ. પરંતુ એ સત્યને સંપૂર્ણ રીતે શોધી કાઢવામાં, પકડવામાં આપણને કદી સફળતા મળેલી નથી. અને એ વાસ્તવિકતા પોતે પણ પોતાનું ઢાંકણ ખોલતી નથી, પોતાનું સ્વરૂપ બતાવતી નથી.

આમાં એક બીજી વસ્તુ પણ પાછી ધ્યાનમાં લેવા જેવી છે. આપણે પદાર્થોનું જ્યારે જ્યારે માપ લઈએ છીએ, અને એ રીતે આપણને બાધ્ય વિશ્વનું રહસ્ય કંઈક હાથ લાગશે એમ માની લઈએ છીએ, ત્યારે એ માપ લેવાની કિયા કરવા જતાં આપણે પોતે પણ એ વસ્તુમાં દાખલ થવું પડે છે. એટલે થાય છે એમ કે આ માપ લેવાની કિયા કરવા જતાં જ આપણે પદાર્થોનું આ જે બાધ્ય સ્વરૂપ છે તેમાં થોડોએક, ભલે પછી તે અત્યંત અલ્ય હોય તોપણ એક ફેરફાર કરી દઈએ છીએ અને એ રીતે જગતનું સ્વરૂપ બદલી નાખીએ છીએ. અને આ રીતે માપણીમાંથી આપણને જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે સોએ સો ટકા ખરું જ્ઞાન છે એમ આપણે ખાતરી ધરાવી શકતા નથી. આ બધી માપ લેવાની કિયામાંથી આપણે જે જ્ઞાન તારવીએ છીએ તે માત્ર જગતની એક સંભવિત સ્થિતિ સૂચયી શકે છે એ કાંઈ પાકુ નિશ્ચિત જ્ઞાન હોતું નથી આપણા આ બાધ્ય જગતને અંગે આવી અનિશ્ચિતતા બહુ નાની સરખી હોય છે, નજીવી જેવી હોય છે, પરંતુ આપણે જ્યારે એક નાનામાં નાની વસ્તુનું — આણુના જગતનું જ્ઞાન મેળવવા નીકળીએ છીએ ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે. અર્દી વસ્તુનું-આ અણુનું માપ કાઢવાની કિયામાં એક મૂળગત અશક્તિ આવીને ઊભી રહે છે, એમાં

એક એવું તે વિધન આવીને ઊભું રહે છે કે તેને જીતવાની તમારે માટે કશી આશા રહેતી નથી. આમ બનવાનું કારણ તે સંશોધનની અમારી પદ્ધતિમાં કોઈ અપૂર્ણતા રહેલી છે એવું નથી. પરંતુ જગતમાં વસ્તુઓનું સ્વરૂપ જ એવું છે. અને પરિસ્થિતિ એટલે સુધી અપરિદ્ધાર્ય જેવી છે કે વિશ્વનો અત્યાસ કરવા માટે આપણે આપણી બુદ્ધિરૂપી જે રંગીન કાચ વાપરીએ હીએ તે કાચ વિના પણ આપણે કદ્દી ચલાવી શકવાના નથી. હું જે જે માપ લઉં છું, જે જે વાદો રચું છું, તેમાં જેટલું જગતનું તત્ત્વ આવી રહેલું છે તેટલો જ હું પણ છું, તેટલું જ મારું સ્વરૂપ પણ છે, તેટલું જ માનવનું મન પણ છે. આ માપ જેટલાં વસ્તુગત દેખાય છે તેટલાં જ આત્મગત પ્રકારનાં પણ હાય છે. કદાચ એ માપની હસ્તી કેવળ મારા મગજમાં જ હશે.

અનંતના સાગર કિનારા પર ભમતાં ભમતાં એક પગલું મારી નજરે પડ્યું. એ પગલાની છાપ પરથી એ પગલું પાડી જનાર પ્રાણીનો આકાર ઊભો કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. આખરે હું એમાં સફળ નીવડ્યો છું અને મેં જોયું છે કે એ પગલું પાડનાર તો હું પોતે જ છું. અને આમ હમણાં હું અહીં બેઠો છું — આપણે બધા અહીં બેઠા હીએ — અને આમાંથી કેવી રીતે મુક્તિ પામીશું તે કંઈ સમજાતું નથી...

પણ આ હડીકતમાં એક આશાનું પણ કિરાણ છે. હું જાણું છું કે જગત વિષે મને કશું પાકું જ્ઞાન નથી થયું, મને માત્ર સંભવિતતાઓ જ દેખાયેલી છે.—અને એમાંથી જ એક આશા રહે છે, આશ્વાસન રહે છે કે માનવજીતનું ભાવિ હુમેશને માટે સિવાઈ ગયેલું નથી.

## ૪

### કલાકાર

હું એક ભજ કુટુંબમાં જન્મ્યો હતો. અમારું કુટુંબ બહુ જ સંસ્કારી ગણાતું હતું, પણ એમાં કળાને માત્ર એક વિનોદના સાધન તરીકે જ લોખવામાં આવતી હતી. કળા એ માણસના જીવનની કારકિર્દી બની શકે છે એ ખ્યાલ અમારે ત્યાં કોઈને ન હતો.

કલાકાર તે ગંભીર માણસો હોઈ શકે એવું કોઈ જાણતું ન હતું. કલાકાર તો નૈતિક રીતે શિથિલ હોય, પૈસા પ્રત્યે લાપરવા હોય એમ સમજવામાં આવતું. અને આ વાત તો જરા જોખમકારક પણ ગણાય. આ બધાનો કદાચ વિરોધ કરવાને ખાતર જ મને થયું કે મારે કલાકાર જ થવું જોઈએ. મારી આખીયે ચેતના મારી

આંખોમાં જ એકાગ્ર થઈ રહેવા લાગી. મારે જે કાંઈ કહેવું હોય તે હું શબ્દ કરતાં એકાદ સ્કેચ દોરીને વધુ સહેલાઈથી કહી શકતો હતા. પુસ્તકોના વાંચન કરતાં મને ચિત્રો જોવામાંથી વધારે સારું જ્ઞાન મળવા લાયું. હું જે કાંઈ વસ્તુ એક વાર જોતો — કુદરતનાં દૃષ્યો, માણસોના ચહેરા કે ચિત્રો — તે કદી ભુલાતાં નહિ.

હું તેર વર્ષનો થયો ત્યારે તો ચિત્રકામની આખીએ ટેકનિક — વોટર કલર, પેસ્ટલ, ઓઈલ પેઇન્ટિંગ મેં હાથ કરી લીધાં હતાં. બેશક, એ માટેની મારી જહેમત પણ અપાર હતી. એ વખતે મને મારાં મા-બાપના મિત્રો અને ઓળખીતાઓ માટે પૈસા લઈને થોડુંક કામ કરવાનો પ્રસંગ પણ મળી ગયો. પછી તો હું કમાવા લાયો. અને મારાં ચિત્રોમાંથી કમાણી થવા લાગી એટલે મારું કુટુંબ પણ મારી એ પ્રવૃત્તિને ગંભીર ભાવે જોવા લાયું. એટલે તે પછી મેં એ વિષયનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. મારે આર્ટસ સ્કૂલમાં જોડાવું હતું. પણ તે વખતે તેમાં દાખલ થવા જેટલી મારી ઉમર ન હતી. હું એ ઉમરે પહોંચ્યો કે તરત મેં તેમાં અભ્યાસ શરૂ કરી દીધો. સ્કૂલમાં જોડાયા પછી લગભગ તરતમાં જ હું રોમ પારિતોષિક માટેની સ્પર્ધામાં ઊભો રહ્યો અને તેમાં પ્રથમ નંબરે આવ્યો. આ ઈનામના અત્યાર સુધીના વિજેતાઓમાં હું સૌથી નાનો હતો. એ સ્પર્ધામાં જોડાવાથી મને ઈટાલીની કળાનો સંપૂર્ણ પરિચય સાધવાની તક મળી ગઈ. તે પછી મને એક પ્રવાસ સ્કીલરશિપ મળી અને તેને આધારે હું સ્પેન, બેલિયમ, હોલેન્ડ, ઇંગ્લેન્ડ અને બીજા દેશોના પ્રવાસ કરી આવ્યો. મારે માત્ર અમુક જ દેશની અમુક યુગની કળાના ચિત્રકાર બની રહેવું ન હતું. મેં તો જગતના સર્વ દેશોની કળાના, પૂર્વ તથા પશ્ચિમની કળાનો, કળાનાં સર્વ સ્વરૂપોનો અભ્યાસ કર્યો.

આ સાથે હું મારાં પોતાનાં ચિત્રો તો કરતો જ હતો. એમાં મેં એક નવી ફોર્મ્યુલા, નવી પદ્ધતિ શોધવાનો પ્રયત્ન કર્યો. અને પછી તો મને સફળતા મળવા લાગી, કીર્તિ આવવા લાગી. પ્રદર્શનોમાં પ્રથમ ઈનામો આવ્યાં, ચિત્રોના પંચોમાં સભ્યપદ મળ્યાં, જગતનાં મહાનમાં મહાન મ્યુઝિયમોએ મારાં ચિત્રો ખરીદાં, ચિત્રના સોદાગરોમાં મારાં ચિત્રો માટે પડાપડી થવા લાગી! આમ પૈસા આવ્યા, ઈલકાબ આવ્યા, માનપાન આવ્યાં. અરે, મારે માટે “પ્રતિભાશીલ સર્જક” એવા શબ્દ પણ ઉચ્ચારાયો. પરંતુ આ બધું છતાં મને કશો સંતોષ નથી. પ્રતિભા વિષેની મારી કલ્પના સાવ જુદી છે. તમારે નવાં નવાં રૂપો સર્જવાં જોઈએ, નવાં સાધનો અને નવી પ્રક્રિયા લાવવી જોઈએ અને તે દ્વારા એક નવીન કોટિનું, વધુ ઉચ્ચ પ્રકારનું વધારે વિશુદ્ધ, વધારે સાચું, વધારે ઉમદા એવું સૌન્દર્ય પ્રકટાવવું જોઈએ. પણ મને લાગે છે કે જ્યાં સુધી મારે માનવજાતિ સાથે બંધાઈ રહેવું પડશે તાં સુધી હું જગતની સ્થૂલ પ્રકૃતિનાં રૂપોના બંધનમાંથી કદી પણ પૂરેપૂરો મુક્ત થઈ શકીશા નહિ. મારામાં આ અભીષ્ટા તો હતી જ, મારે સ્થૂલતાના

બંધનમાંથી મોક્ષ જોઈતો હતો. પણ એ માટેનું જ્ઞાન મને મળ્યું નથી.

અને હવે જ્યારે મૃત્યુના મુખમાં ઊભા છીએ ત્યારે મને લાગે છે કે મારે જે ચિત્ર કરવાં હતાં તેવાં ચિત્ર હું કરી શક્યો નથી. મારે જે સર્જન કરવું હતું તે હું સર્જ શક્યો નથી અને મારા પર આટલી બધી કીર્તિ વરસી રહી છે છતાં મને લાગે છે કે મારું કામ તદ્દન નિઃસાર રહેલું છે.

#### ૫

### ઉદ્ઘોગપતિ

આપણે સૌ અત્યારે પોતપોતાનાં હદ્ય ખોલી રવ્યા છીએ ત્યારે હું પણ હદ્ય ખોલીને વાત કરીશ. વળી હું જે કહેવાનો છું તેનો ઉપયોગ મારા હરીફો યા તો મારી સફળતાના — મારી કહેવાતી સફળતાના વિરોધીઓ હવે કોઈ રીતે કરી શકવાના નથી એટલે મારી સાચી જીવનકથા, લાકોએ ઘણી વાર વાર્ણવી છે તે રીતની નહિ પણ હું પોતે મારા જીવનને જે રીતે જોઉં છું તે રીતે કહીશ.

મારા જીવનની જે જે હકીકતો આપવામાં આવી છે તે તો બરાબર સાચી જ છે. મારા પિતા એક નાનકડા શહેરમાં એક લુહાર હતા. એમના તરફથી મને ઘાતુકામનો શોખ વારસામાં મળ્યો. કોઈ પણ કામ સરસ રીતે થાય એમાં જ કેવો આનંદ રહેલો હોય છે, જે કોઈ કામ હાથ લઈએ તેમાં કેવી રીતે પોતાની જાતને ભૂલી જઈ શકાય એ વાત પણ તેમણે મને બતાવી. એમની પાસેથી મને એ પણ જાણવા મળ્યું કે આપણામાં એવી ઈચ્છા રહે કે આપણે હુંમેશાં વધુ ને વધુ સારી રીતે કામ કરતા થઈએ, બીજાઓ કરતાં વધુ સારું કામ કરીએ, આપણે પોતે પહેલાં કર્યું હોય તેના કરતાં વધુ સારુ કરીએ. મારા પિતાને મન નફો એ મુખ્ય લક્ષ્ય નહોંતું. પરંતુ તેઓ પોતે પાતાનાં ધંધામાં શ્રેષ્ઠ સ્થાને પહેંચ્યા હતા તે માટે તેમને ગર્વ નહોતો થતો એમ પણ ન હતું. તેમનાં વખાણ થાય ત્યારે તેમને થતો આનંદ તેઓ કદી છુપાવતા ન હતા.

આ સદીના આરંભમાં જ્યારે અંદરથી સળગતા ઝોંજિનની પહેલી વાર શોધ થઈ ત્યારે એમાંથી જે નવી નવી શક્યતાઓ ખૂલતી હેખાઈ તે ઝોંજિને અમારા જેવા જુવાન છોકરાઓ તો ગાંડા ગાંડા થઈ ગયા. એમે એક ઘોડા વિનાની ગાડી, ઘોડા વખત પછી મોટરકારના નામે ઓળખાવા લાગેલી ગાડી બનાવવા લાગી ગયા. એ માટે અમારે બેહુદ મહેનત કરવી પડી. એ વખતે આવી ગાડીના થોડાક નમૂના તો લોકોએ બનાવેલા હતા પણ એ બધામાં ખામી ઘણી જ હતી, અને મેં મારી પહેલી કાર બનાવી. મારા

જવનનો એ મોટામાં મોટો આનંદ હતો. એ માટેના ભાગો હું જુદે જુદે ડેકાણેથી ભેગા કરી લાવ્યો. અને એ ભાગો જે કામ માટે વપરાતા હતા તે કરતાં મેં તેમનો કોઈ જુદો જ ઉપયોગ કરી લીધો. એ કારને મારા પિતાની વર્કશોપમાંથી બહાર કાઢી થોડે દૂર આવેલા ટાઉન હોલ સુધી હું લઈ ગયો, એ પણ એક બનાવ હતો. કારની બેઠકનું કશું ડેકાણું ન હતું. આ હમણાં, પડ્યા, હમણાં પડ્યા એમ થયા કરે. ગાડી ચાલે ત્યારે ભખભખ ધુમાડા નીકળે, ખખડ ભખડ, ખખડ ભખડ અવાજો થાય. બેય બાજુ ડોલંડોલા થતી થતી આગળ વધે. એને જોતાં રસ્તે ચાલતા લોકો ગભરાઈ ઊક્યા, કૂતરાં ભસવા મંડી પડ્યાં, ઘોડા ઝડ થઈ ગયા. પણ મારે મન તો જગતની એ સર્વશ્રેષ્ઠ સુંદર ચીજ હતી.

એ પછીનાં વરસોની વાત હું છેડી દઈશ. પ્રથમ તો આ નવા ચંત્ર સામે લોકો તરફથી ભયંકર વિરોધ થવા લાગ્યો. અરે, આ તે શું બનાવ્યું છે? ગાડી ખેંચવા માટે તો ભગવાને ઘોડો બનાવેલો છે. પછી ઘોડા વિનાનો સંચો બનાવાય કેવી રીતે? અને આ બધી રેલ્વેઓ બની છે તે જાણે ઓછું પડતું હોય તેમ હવે આ આપણા શહેરમાં અને આ રસ્તા પર આ બલાઓ આણી મૂકી છે. હવે અહીં ચાલવાની જગા સરખી પણ ક્યાં રહેશે? આવી આવી નાપાક શોધખોળોથી જગતનું કોણ જાણે કેવુંયે નખ્ખોદ જશે! કેટલાક વળી એમ પણ કહેવા લાગ્યાં કે આવાં ઢંગધડા વિનાનાં ચંત્રો કંઈ બહુ ચાલવાના નથી. એને ચલાવવાનું કામ તો ખાસ તૈયાર થયેલાં માણસો જ કરી શકે, યા તો કોઈ બેઝાંગેબ ધૂની માણસ જ એ કામ કરે. પણ કેટલાક ડિમતવાળા માણસોએ મને થોડાંક નાણાં ધીર્યાં અને મેં એક નાનકડી વર્કશોપ ઊભી કરી. ચારપાંચ માણસો રોક્યા અને થોડું એક લોખંડ લઈ આવીને કામ શરૂ કર્યું. પણ મને નાણાં ધીરનાર લોકોમાં પણ કંઈ જાણી સમજ ન હતી. એ તો પહેલાંના વખતમાં કેટલાક લોકો પરદેશોમાં સોનું શોધવા નીકળી પડેલાં અને ત્યાં અજાણી ભૂમિમાં એક કલ્પિત લક્ષ્મીની શોધમાં પાયમાલ થઈ ગયેલા એમની માફક જ એક આંધળી શ્રદ્ધાથી પ્રેરાઈને કામ કરતા હતા.

મારે પોતાને તો કોઈ અઠળક પૈસો કમાવો ન હતો. મારે તો એક સહેલાઈથી ચલાવી શકાય અને બીજી મોટરો કરતાં વધુ સત્તી હીય એવી એક મોટર ગાડી બનાવવી એટલી જ ઝંખના હતી. વળી મને એક વસ્તુ તો દેખાતી હતી કે આ વાહન રાખવું ઓછું ખર્ચાળ પણ બની શકવું જોઈએ, કેમકે એ ચાલતું હોય તેટલા વખત પૂરતો જ તેને ખોરાક આપવાનો રહે છે. એટલે જો એની વેચાણ કિંમતને ઢીક ઢીક નીચે લઈ જઈ શકાય તો તેના ખરીદનાર ઘણા નીકળી આવશે. જે લોકો ઘરમાં બબ્બે ઘોડા રાખવાનું ખર્ચ કરતાં અચકાતા હશે તેવા લોકો તો આ મોટર ગાડી જરૂર ખરીદશે.

અને મેં જે પહેલું મોદેલ જથ્યાબંધ ઉત્પત્ત કર્યું તે તો દજી પણ મને સમરણમાં

રહી ગયેલું છે. એ મશીન એવું તો મજબૂત બનાવવામાં આવેલું કે ગમે તેવો અભાણ જેડૂત પણ એને ગમે તેટલી બેદરકારીથી વાપરે તોપણ વાંધો ન આવે. પણ ટેટલાક લોકો મોટરકારને હજુ પૈસાદારોને માટેનું જ મોજશાખનું સાધન ગણતા હતા અને તે બધા આનો થોડોધાણો તિરસ્કાર પણ કરતા રહ્યા. આમ છતાં આ મોડેલ હાંકવામાં ધાણ સહેલું હતું. લગભગ કશી જ મહેનત વિના એને ચલાવી શકતું હતું. અને એ જોતાં એવી આશા બંધાવા લાગી કે હવે સારી મોટરકારો પણ એવી બનાવી શકાશે કે જેને સાવ બિનઅનુભવી માણસ ચલાવી પણ શકશે.

પરંતુ આ મોટરકારનો ઘોડા ઉપર વિજય થતાં વાર લાગી. એ વિજય પહેલા વિશ્વ યુદ્ધમાં મળી શક્યો. આ લડાઈમાં ધાયલો માટેની ઓભ્યુલન્સ ગાડીઓ, દાર્ઢાળાનાં વાહનો, તેમ જ બીજુ જે જે વસ્તુઓ ભારવાળી યા તો ઝડપથી લઈ જવા જેવી હાય તે દરેકને યંત્રથી સજજ કરી દેવામાં આવી. એ યંત્રો બનાવવામાં મારી ફેક્ટરીની પ્રવૃત્તિ કોઈ અકલ્ય વેગે વધી ગઈ. લશ્કર તરફથી ખૂબ જ મોટા મોટા ઓર્ડરો આવવા લાયા, અને એમાંથી મને મારી બનાવટોમાં સુધારા કરવાની તકો મળતી રહી. મેં નવાં નવાં યંત્રોને સંપૂર્ણ બનાવ્યાં, યંત્રોના ભાગોને જોડવાની પદ્ધતિઓ સંપૂર્ણ બનાવી.

યુદ્ધ પણું થયું ત્યારે એક સરસ રીતે ચાલ્યે જતું કારખાનું મારા હાથમાં રહ્યું. પરંતુ એ કારખાનામાં બનતી વસ્તુઓ શાંતિના કાળમાં ખ્રે તેવી ન હતી. અને મારા મદદનીશો ગભરાઈ ઊક્યા. એ મને હવે દબાણ કરવા લાયા કે આપણે માલ બનાવવો ઓછો કરી નાખીએ, કામદારોની સંખ્યા કમી કરીએ, વેપારીઓને ત્યાં મૂક્યા માલના ઓર્ડરો રદ કરીએ, અને નવા ઓર્ડરો હવે કેવા આવે છે તે જોવા માટે થોડો વખત થોબી જઈએ. એમના કહેવામાં બેશક ડાહાપણ તો હતું જ. પરંતુ મેં જોયું કે અમારે માટે આ એક ફરી ન આવે તેવી અપૂર્વ તક હતી. અમે હવે જગતમાં સસ્તામાં સસ્તી ગાડી બનાવી શકીએ કે નહિ તે જોવાનું હતું. માલના ઉત્પાદનમાં જો ઘટાડો કરવામાં આવે તો એનું પરિણામ તો કિંમતના વધારામાં જ આવે. એટલે મેં નક્કી કર્યું કે આપણે હવે જેટલો વેચી શકાય તેટલો જ માલ ઉત્પત્ત કરીને બેસી રહીએ એમ નહિ પણ આપણે જેટલો માલ ઉત્પત્ત કરીએ તેટલો વેચી શકાય છે કે નહિ તે જોઈએ. અને મારી દૃષ્ટિ સાચી હતી તે હું છ માસમાં જ સાબિત કરી શક્યો. મેં અમારા માલની ખૂબ જ કુશળતાપૂર્વક પુષ્કળ જાહેરાત કરવા માંડી અને અમે બનાવેલો બધા જ માલ વેચાઈ ગયો.

એ પછી મારી કંપની લગભગ પાતાની મેળે જ ચાલવા લાગી. રોજિંદા કામે અંગેના મહત્વના નિર્ણયો લેવાનું કામ મારે મારા મદદનીશોના હાથમાં જ વધુ ને વધુ સોંપવાનું થવા લાયું, અને મારે ભાગે માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો જ રજૂ કરવાનું

કામ રહેવા લાગ્યું. આમાં હવે એ વસ્તુ વિચારવાની આવી કે માલના ગુણમાં કાંઈ પણ ઊણપ ન આવે, કામદારોના પગારમાં કશો ઘટાડો થવા ન પામે, — અને ખરું જોતાં તો મારા કામદારોને જગતમાં વધુમાં વધુ પગાર મળવો જોઈએ — અને છતાં માલને કેવી રીતે સસ્તામાં સસ્તો વેચી શકાય, અને નવા નવા ખરીદનારોને પહુંચ્યો શકાય. વળી એ પણ વિચારવાનું હતું કે ધંધાની સમતુલાને કાંઈ હાનિ થવા દીધા વિના નફાનો ભાગ ઓછામાં ઓછા કરી શકાય કે નહિ. વળી જાહેરાત પણ એવી રીતે થવી જોઈએ કે તેને લીધે માલની બનાવતના ખર્ચમાં વધુ પડતો વધારો થાય છતાં માલનું વેચાણ તો બરાબર ધાર્યા પ્રમાણેનું જ થાય. અને છેવટ જતાં એ વિચાર પણ કર્યો કે અમને માલ પૂરો પાઠનાર વેપારીઓ જો અમારી પાસેથી ખૂબ જ વધુ પડતો નફો કઢાવવા માગે તો પછી યંત્રના છૂટા ભાગો, અર્દી બનાવેલી વસ્તુઓ, અને છેવટે કાચો માલ પણ અમારે પાતે જ ઉત્પન્ન કરી લેવા જેટલી તૈયારી રાખવી.

હવે મારો ધંધો જાણે કે એક જીવતી વસ્તુની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. હું જે જે વસ્તુને હાથમાં લેવા લાગ્યો તે બધી જ સફળ થવા લાગી. અને એમ કરતાં કરતાં તો હું લગભગ એક લોકવાયકા જેવા બની રહ્યો. લોકો મને એક દેવ જેવો ગણવા લાગ્યા. મેં તો જીવનમાં એક નવો પંથ રચી આપ્યો છે, હું તો દરેક જાણને માટે દૃષ્ટાંત રૂપ હું એમ કહેવાવા લાગ્યું. મારે માટેનો અહોભાવ એટલી હદ સુધી પહુંચ્યો કે મારા મૌંમાંથી ગમે તેવો સાધારણ શબ્દ નીકળે, મારી ક્ષુદ્રમાં ક્ષુદ્ર કિયા તેને લઈને લોકો પૃથક્કરણ કરવા લાગી જતા, તેને અંદરબહુાર ઉથલાવી ઉથલાવીને વિચાર કર્યા કરતા, તેમાંથી એક મહાન સિદ્ધાંત ઊભા કરતા અને તેને જગત આગળ એક નવાં ધર્મશાસ્ત્ર રૂપે રજૂ કરતા.

પણ આ બધા પાઇળનું ખરું સત્ય તો શું હતું? એટલું જ કે મારો ધંધો વૃદ્ધિ પામતો રહ્યો હતો એટલે જ તે જીવતો રહી શક્યો હતો. એ ધંધાની આગેકુચ્ચમાં જો સહેજ પણ રૂકાવત આવી હોતો તો તેમાં એનું મૃત્યુ જ હતું. કારણ કે, આવા વધતા જતા ધંધામાં માલના ઉત્પાદન જેટલાં જ થઈ જવા દો તો પછી, તમારા નફાનો જે કાંઈ ભાગ રહેતો હોય તે પેલાં ખર્ચમાં સાવ હોઈયાં જ થઈ જાય. અને આ નફો તમારે માલને સસ્તો વેચવા માટે ઓછો જ રાખવો રહે છે. વારુ, મારો ધંધો તો એટલી જરૂરથી વધવા લાગ્યો કે હવે સંવાદપૂર્વક આગળ વધતાં વધતાં એક પુખ્ત અવસ્થા તરફ જઈ રહેલા જીવતા દેહ જેવો ન રહેતાં એક કુલાવેલા બલૂન જેવો જ વધુ દેખાવા લાગ્યો. દાખલા તરીકે, અમારા કારખાનામાં એમ બનતું કે

અમુક ખાતાંઓને બીજાં ખાતાંઓ સાથે પહેંચી વળવાને માટે પોતાનાં માણસો પાસેથી વહાણના ગુલામેની માફક કામ લેવું પડવા લાયું. અને એવા ખાતાંને અમે તેની સાધનસામગ્રીમાં સુધારો-વધારો કરીને ઠીક કરી લેતા તો વળી પાછી એવી જ તકલીફ કોઈ બીજે ઠેકાણે આવીને ઊભી રહેતી, અને આ પરિસ્થિતિથી તો હું સાવ લાયાર બની ગયો છું. હું જોઉં છું કે આ આખી પ્રવૃત્તિમાં જો ક્યાંય પણ કંઈ વાંધો આવશે તો એથી મારા કામદારોને માથે જ વધુ આફત ઊતરશે.

અને આ બધાને અંતે માનવજીતિને મેં શું આપ્યું છે? આજે લોકો વધારે સહેલાઈથી મુસાફરી કરે છે. પરંતુ તેથી શું? એના પરિણામે શું લોકો એકબીજાને વધુ સમજવા લાયા છે ખરા? મારા દાખલાને અનુસરીને, જીવનને વધુ સરળ કરવા માટે કામની ગણાતી વસ્તુઓનું જથાબંધ ઉત્પાદન થવા લાયું છે અને એ વસ્તુઓ વધુ ને વધુ લોકોમાં વેચાઈ રહી છે. પરંતુ આને લીધે તો શું જીવનમાં માત્ર નવી નવી જરૂરિયાતો જ ઊભી નથી થઈ? અને સાથે સાથે વધુ ને વધુ નફા માટેનો લાભ પણ શું નથી જન્મ્યો? મારા કામદારોને ઘણા સારા પગાર મળે છે. પણ મને લાગે છે કે એના પરિણામે હું તો તેમનામાં વધુ ને વધુ કમાણી કરવા માટેની — બીજાં કારખાનાંના માણસો કરતાં વધુ આવક મેળવવાની દૃઢા જ માત્ર જગૃત કરી શક્યો છું. મને થાય છે કે મારા કામદારોના હૃદયમાં સંતોષ આવેલો નથી, એટલું જ નહિ, મને તો લાગે છે કે એઓ સુખી પણ નથી. મારી આશાઓ તો એવી હતી કે આ કામદારોના જીવનનું ધોરણ જો ઉંચું આવશે, તેમને જો પોતાના જીવનની સુખસગવડો માટે અભયવચનો મળી જશે તો તેમનામાં પોતાનો માનવ તરીકે વધુ વિકાસ કરવાની દૃઢા જાગરો. પણ હું જોઉં છું કે એવું કશશુય થયું નથી. મારી આશાઓ ખોટી હરી છે. ખરેખર, માનવજીતિના દુઃખનું પ્રમાણ તો એનું એ રહ્યું છે, એનું સ્વરૂપ પહેલાંના જેવું જ ભીષણ રહ્યું છે. મને લાગે છે કે આ દુઃખના નિવારણ માટે મેં જે જે સાધનો પ્રયોજ્યાં છે તે દ્વારા તો એનું નિવારણ નથી જ થવાનું. માનવના જીવનમાં કોઈ એક મૂલગત ખામી આવી રહેલી છે અને મારાં કાર્યો એ ખામીને સુધારી શક્યાં નથી. ખરું કહું તો એ ખામી શું છે તે હું પોતે પણ સમજ શક્યો નથી. મને લાગે છે કે આપણે હજુ જીવનનું રહસ્ય શોધવાનું બાકી જ રહેલું છે અને એ રહસ્ય હાથ આવે નહિ ત્યાં સુધી આપણા સર્વ પ્રયત્નો નિષ્ફળ જ જવાના છે.

## વ्यायामविद्

મારો જન્મ એક વ्यાયામપ્રિય માણસોના કુટુંબમાં થયો હતો. મારાં માતાપિતા હરેક પ્રકારની રમતગમતો અને કસરતો સારી રીતે કરી જાણતાં હતાં. મારી માતા તરવામાં, રૂબકીમાં, તિરંદાજીમાં, પટાબાજીમાં અને નૃત્યમાં ખાસ પ્રવીણ હતી. તેની આ શક્તિ માટે તે ખૂબ પ્રભ્યાત હતી અને કેટલીક સ્થાનિક રમતગમતોમાં તે પ્રથમ સ્થાને પણ આવી હતી.

મારા પિતા એક અદ્ભુત વ્યક્તિ હતા. એ જે કોઈ વસ્તુ હાથ લેતા તે હંમેશાં થઈને રહેતી. તેઓ ભાણતા હતા ત્યારે ફૂટબોલના ઘણા જાણીતા ખેલાડી હતા. બાસ્કેટ બોલ અને ટેનિસ પણ તે સરસ રમતા હતા. બોઝિસિંગ તેમ જ કોસ-કન્ટ્રી (લાંબી) દોડમાં તો તેઓ અમારા જિલ્લામાં કયારનાયે પહેલે નંબરે આવી ગયા હતા. પછીથી તેઓ એક સર્કસ કંપનીમાં જોડાયેલા અને તેમાં ટ્રાપીઝ (ઓલા) ના કામમાં અને વેદેસવારીનાં કામોમાં તે બહુ જ પ્રભ્યાત હતા. પરંતુ તેમનો ખાસ વિષય શરીર વિકાસ અને કુસ્તીનો હતો. આ બે વિષયોમાં તેમણે ખૂબ જ નામના મેળવી હતી.

આવાં માબાપોને પેટ જન્મ લેવા એ એક મોટુ સદ્ભાય જ ગણાય. એક બળવાન તંદુરસ્ત અને શક્તિશાળી શરીરનો વિકાસ કરવા માટે આ એક સંપૂર્ણ એવી આદર્શ પરિસ્થિતિ હતી. મારાં માતાપિતાએ તીવ્ર સાધના દ્વારા જે જે શરીરિક સમૃદ્ધિ ગ્રાપ્ત કરી હતી તે બધી મને સહજમાં વારસામાં મળી ગઈ. મારાં આ વ्यાયામપ્રિય માબાપોને પોતાનું એક સ્વખ પણ મારામાં સિદ્ધ થયેલું જોવાની ઝંખના હતી. તેઓ મને એક મહાન અને સફળ કસરતબાજ બનાવવા ઈચ્છાતાં હતાં, એટલે તેમણે મને ખૂબ જ કાળજીપૂર્વક ઉછેરવા માંડ્યો. તેમની પાસે તંદુરસ્તી, શક્તિ, બળ અને તાકાત ખીલવવા માટે જે કાંઈ જ્ઞાન અને અનુભવ હતાં તે બધાં મારા વિકાસમાં યોજ દીધાં. અને મારા આવા વિકાસને માટે જે જે વસ્તુ મદદ રૂપ થાય તેમ હતી તે બધી તેમણે કરવા માંડી. એમણે મારે માટે મારા જન્મના વખતથી જ આરોગ્ય અને તંદુરસ્તી માટેની ઉત્તમોત્તમ પરિસ્થિતિ ઊભી કરી આપી. ખોરાક, કપડાં, નિદ્રા, સ્વચ્છતા, સારી ટેવો અને બીજી ઘણી બાબતોમાં સ્થૂલ રીતે શક્ય હતી તેટલી બધી સામગ્રી તેમણે મારે માટે એકઠી કરેલી. તે પછી તેમણે મારે માટે શરીરિક કસરતોનો એક ઘણો સરસ કાર્યક્રમ બનાવ્યો. અને કમે કમે મારા શરીરનો તેમણે સમતોલ અને પ્રમાણસરનો વિકાસ કરાવ્યો. મારા શરીરમાં તેમણે સુંદરતા

પ્રગટાવી, લયબદ્ધતા અને સંવાદિતતા સરજાવી. તે પછી તેમણે મારામાં ચપળતા, સાહસિકતા, જાગરુકતા, ચોક્કસતા અને સંયોજકતાનાં તત્ત્વો ખીલવ્યાં અને છેવટે તેમણે મને શક્તિ અને સહનશીલતા ખીલવવાની તાલીમ આપી.

તે પછી મને એક છાત્રશાળામાં મોકલવામાં આવ્યો. ત્યાં જે શારીરિક કેળવણીનો કાર્યક્રમ હતો તે મને સૌથી વધુ આકર્ષક લાગ્યા. મેં એમાં ખૂબ જ રસ લેવા માંડ્યો અને થોડાક જ વરસોમાં શાળાના ખેલાડીઓ અને કસરતબાળોમાં હું પણ એક ગણ્ણાવા લાગ્યો. અને પછી મને જીવનમાં પ્રથમ વિજય મળ્યો. ત્યાંની શાળાનો વચ્ચેની બોક્કિસંગાની સ્પર્ધામાં હું પ્રથમ આવ્યો. મેં ચેમ્પિયનશિપ મેળવી. મારાં માબાપને પોતાનું સ્વખ થવા લાગેલું જોતાં ખૂબ જ આનંદ થયો, ગર્વ થયો! મને પોતાને પણ મારી આ સફળતાથી ખૂબ પ્રોત્સાહન મળ્યું. મેં હવે શારીરિક કેળવણીની તમામ શાખાઓની ટેકનિક જાણી લેવાનો અને તેમાં પ્રવીણ થવાનો સંકલ્પ કર્યો અને એ વસ્તુ સિદ્ધ કરવામાં હું ખૂબ જ એકાગ્રચિતે કામે લાગી ગયો. મેં કાળજીપૂર્વક અને સખત રીતે મહેનત કરવા માંડ્યી. મારા શિક્ષકોએ મને રમતગમત અને ખેલકૂદની તમામ પ્રવૃત્તિઓમાં શામેલ કર્યો અને એ રીતે મને શરીરની જુદી જુદી શક્તિઓનો વિકાસ કેવી રીતે સાધવો તે શીખવાનું મળ્યું. મને લાગતું હતું કે આપણને જો એક સમગ્ર રીતની શારીરિક તાલીમ આપવામાં આવે તો એક જ વિષયમાં નહિ પણ એકથીયે વિશેષ વિષયોમાં, ઘણા વિષયોમાં આપણે સફળ થઈ શકીએ. એટલે પછી મને જે જે રમતગમતોમાં ભાગ લેવાની તક મળતી તે દરેકમાં હું ભાગ લેવા લાગ્યો. અને એમ વરસ વીતવા લાગ્યાં. નિયમિત રીતે હું ખુલ્લી સ્પર્ધાઓમાં ફિલે પર ફિલે મેળવતો જ ગયો. કુસ્તી, બોક્કિસિંગ, વેઈટ લિફ્ટિંગ, શરીરવિકાસ, તરવું, દોડકૂદની રમતો, ટેનિસ, વ્યાયામ અને બીજી ઘણી પ્રવૃત્તિઓમાં મને પ્રથમ સ્થાન મળતું ગયું.

હવે હું અઢાર વર્ષની વયે પણોંચ્યો અને ત્યારે મને રાષ્ટ્રીય ઓલિમ્પિક ચેમ્પિયનશિપની સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા થઈ. હું તો શરીરના સર્વાંગીણ વિકાસમાં માનનારો હતો, એટલે આ ચેમ્પિયનશિપમાં મેં ડિક્ષલોન-દશવિધ સ્પર્ધામાં મારું નામ આપ્યું. આ સ્પર્ધા સૌથી વધુ કઠિન સ્પર્ધા છે. એમાં તમારી ઝડપ, તમારી તાકાત, શ્રમસામર્થ્ય, સુયોજન અને બીજી ઘણી શક્તિઓની ભારેમાં ભારે કસોટી થાય છે. અને પછી મેં આ સ્પર્ધા માટેની તાલીમ લેવી શકું કરી. છ માસ લગી મેં સખત મહેનત કરી અને હું સહેલાઈથી ચેમ્પિયનશિપ જીતી ગયો. મારી પછીના બીજા માણસને મેં કેટલોયે દૂર પાછળ મૂકી દીધો હતો.

અને આ વિજય મળ્યા પછી અમારા દેશની શારીરિક કેળવણીના સંયોજકો સ્વાભાવિક રીતે જ મને વિશ્વ ઓલિમ્પિક રમતોમાં મોકલવાના વિચાર કરવા લાગ્યા.

આ વિશ્વ ઓલિમ્પિયાડ બે વરસ પછી ભરાવાનું હતું અને મારા દેશના પ્રતિનિધિ તરીકે મારે ડિક્ટલોન સ્પર્ધામાં ભાગ લેવો તેવી ઓફર મને કરવામાં આવી. પણ આ વિશ્વસ્પર્ધામાં તો જગતના ઉત્તમોત્તમ કસરતબાળો ભેગા થતા હોય છે. તેમાં ભાગ લેવો એ કઈ હસવાનો ખેલ ન હતો. મારી પાસે હવે બહુ વખત રહ્યો ન હતો.

એટલે મેં મારા પિતાની દોરવાણી હેઠળ મારી તૈયારી શરૂ કરી દીધો. અને મારી માતા બીજી રીતે બધી સંભાળ રાખવા લાગ્યો. મારે ખૂબ જ સખત કામ કરવાનું રહેતું. કેટલીક વાર તો અમુક હુદ પછી વધુ પ્રગતિ કરવી અશક્ય જેવું લાગતું હતું. એકએક ચીજ — ખૂબ જ મુશ્કેલ દેખાતી, પરંતુ મેં મારી તૈયારી અસ્ખલિત રીતે ચાલુ જ રાખી. દિવસ પર દિવસ, માસ પર માસ જવા લાગ્યા. મારી તાલીમ વધવા લાગ્યો અને છેવટે વિશ્વ ઓલિમ્પિકનો દિવસ આવી લાગ્યો.

મારે બધાઈ મારવાની તો ન જ હોય, પણ સાથે સાથે મારે એ હુકીકત છુપાવવી પણ ન જોઈએ કે એ ઓલિમ્પિકમાં મે પોતે આશા રાખી હતી તે કરતાં પણ હું ઘણું વધુ સારું કામ કરી શક્યો. ડિક્ટલોન સ્પર્ધામાં હું વિશ્વ ચ૆મ્પિયન તો થયો જ, પણ આ ઉપરાંત મેં એમાં જેટલા માઈ મેળવ્યા તેટલા ભૂતકાળમાં કે તે પછીની સ્પર્ધાઓમાં પણ કોઈએ મેળવ્યા નથી. આટલા બધા માઈ કોઈ મેળવી શકે એવી કોઈને કલ્પના સરખી પણ ન હતી. પરંતુ એ અશક્ય જેવી લાગતી વસ્તુ શક્ય બની. અને એમ મારી તથા મારાં માતાપિતાની જીવનની મોટામાં મોટી મહત્વાકંસ્થા સિદ્ધ થઈ રહી.

પરંતુ હવે મારામાં કંઈક વિચિત્ર વસ્તુ બનવા લાગ્યો. આમ તો હું જીવનમાં સફળતા અને કીર્તિના શિખરે પહુંચ્યો ગયો હતો તો પણ મેં જોયું કે મારામાં ધીરે ધીરે એક જાતની ઉદાસીનતા, એક રીતનું ખાલીપણું આવી રહ્યું હતું. મારી અંદરથી જાણે કે કશુંક કહેતું હતું કે જીવનમાં કશુંક ખૂટે છે, કશુંક શોધવાનું બાકી રહે છે, મારામાં કશુંક મારે સ્થાપિત કરવાનું રહે છે. એ કશુંક જાણે મને કહેતું હતું : જીવનમાં કોઈક મહાન વસ્તુ આવેલી છે અને મારી શારીરિક શક્તિ અને સામર્થ્યના, મારા કૌશલનો હું તે મહાન વસ્તુ ખાતર વધુ સારો ઉપયોગ કરી શકું તેમ છું. પણ મને કંઈ જ ખ્યાલ આવતો ન હતો કે આ મહાન વસ્તુ કઈ હશે. પછીથી એ અવસ્થા ધીરે ધીરે ચાલી ગઈ. ત્યાર બાદ મેં બીજી ઘણું ઘણ્યો મોટી સ્પર્ધાઓમાં ભાગ લીધેલો. દરેકમાં મેં ઘણ્યો સારી સફળતા મેળવેલી. પણ એ વખતે હુંમેશાં હું જોતો હતો કે જ્યારે જ્યારે મને સફળતા મળતી ત્યારે પેલી ઉદાસીનતાની લાગણી, ખાલીપણાનો ભાવ જાગૃત થઈ મારો કબજો લઈ લેતાં હતાં.

હવે તો મારી ખ્યાતિ ખૂબ વધવા લાગ્યો. મારી આસપાસ જુવાનોનું એક જૂથ બેગું થવા લાગ્યું. એ જુવાનોને મારી પાસે શારીરિક તાલીમ લેવાની ઈચ્છા થવા લાગ્યી અને

મેં ખુશીથી એમને શીખવવા માંડ્યું. વિવિધ પ્રકારની શારીરિક તાલીમ આપવા માંડી. મેં જોયું કે આ મારા પ્રિય વિષયો બીજાઓને શીખવવામાં પણ મને ઘણો આનંદ પડે છે, અને એ રીતે બીજાઓને તૈયાર કરવાનું કામ મને બહુ સારી રીતે ફાવી ગયું. મારા ઘણા વિદ્યાર્થીઓ જુદી જુદી રમતગમતોમાં અને શારીરિક પ્રવૃત્તિઓમાં આશ્ર્યકારક પરિણામો લાવવા લાભ્યા. આ રીતે શારીરિક કેળવણીની બાબતમાં હું એક ઘણો સફળ શિક્ષક બની રહ્યો. આ વિષય પણ મને અત્યંત પ્રિય હતો અને એને છોડવાનો વિચાર મને જરા પણ ગમતો ન હતો. અને એમાંથી પછી મને આ શારીરિક શિક્ષણના કાર્યને જ મારી જીવનભરની પ્રવૃત્તિ બનાવવાના વિચારો આવવા લાભ્યા. પણ એ રીતે કામ કરવું હોય તો આ વિષયની સૈદ્ધાન્તિક બાજુ પણ મારે જાણી લેવાની જરૂર જણાઈ અને એ માટે હું શારીરિક શિક્ષણની એક પ્રભ્યાત કોલેજમાં અભ્યાસ માટે જોડાયો. ત્યાં મેં ચાર વર્ષ અભ્યાસ કર્યો અને શારીરિક કેળવણીની મારી ડીગ્રી પ્રાપ્ત કરી.

આમ શારીરિક કેળવણીની સિદ્ધાંત અને વ્યવહારની બંને બાજુઓમાં હું પારંગત બન્યો અને મારું કામ શરૂ કર્યું. હું ફક્ત જાતે જ કસરતબાજ હતો ત્યાં લગ્ની મારું લક્ષ્ય માત્ર મારા શરીર પૂરતું જ હતું. મારા શરીરને તંદુરસ્ત, સશક્ત બનાવવા માટે, એમાં દક્ષતા અને સુંદરતા લાવવા માટે, અને એક ઉચ્ચ કોટિની પૂર્ણતાએ લઈ જવા માટે જ હું પ્રયત્ન કરતો હતો. હવે બીજા માણસો પણ આ રીતનો વિકાસ પ્રાપ્ત કરે એ દૃષ્ટિએ મેં અન્ય લોકોને મદદ આપવાનું શરૂ કર્યું. મારા આખાય દેશોમાં મેં શિક્ષકોને માટેનાં તાલીમી કેન્દ્રો ઊભાં કર્યાં. અને એમાંથી શારીરિક શિક્ષણ માટે ઘણા સારા શિક્ષકો અને નિયામકો તૈયાર કર્યાં. એ શિક્ષકોની મદદ લઈને મેં મારા દેશના એકઅંક ખૂગામાં શારીરિક કેળવણીનાં અસંખ્ય કેન્દ્રો ઊભાં કર્યાં. આ કેન્દ્રો દ્વારા અમારે દેશની સામાન્ય જનતામાં આરોગ્યની ભાવનાને વ્યાપક કરવી હતી તેમ જ શારીરિક કેળવણી અને આનંદવિનોદની પ્રવૃત્તિઓને શાખીય રીતે ઘેડવાં હતાં તેમ જ લોકપ્રિય બનાવવાં હતાં. અમારાં કેન્દ્રોએ આ કામ બહુ સરસ રીતે પાર પાડ્યું. થોડાંક વરસોમાં તે મારા દેશનું સર્વસામાન્ય આરોગ્ય બહુ જ ઉત્તમ બની ગયું. અમારા કસરતબાજો દેશોમાં તેમ જ દેશની બહારની રમતગમતમાં બહુ સારાં પરિણામો લાવતા થઈ ગયા. થોડા જ વખતમાં રમતગમતની દુનિયામાં મારો દેશ આંતરરાષ્ટ્રીય ખ્યાતિવાળો બની રહ્યો. મારે એ વાત પણ સ્વીકારવાની છે કે મારા દેશની સરકારે આ કાર્યમાં મને ખૂબ જ મદદ અને ટેકો આપ્યો હતો. મારે માટે શારીરિક કેળવણીના પ્રધાન તરીકેના એક ખાસ પોર્ટફોલિયો મારી સરકારે મને આપ્યો. હું આટલું બધું કાર્ય કરી શક્યો તે એને આભારી છે.

અને થોડા જ વખતમાં હું જગતના એકએક ભાગમાં એક મહાન શારીરિક

કેળવણીકાર અને સંગઠનકાર તરીકે વિખ્યાત બની રહ્યો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં શારીરિક શિક્ષણના વિષયમાં હું એક પ્રમાણરૂપ વક્તિ ગણવા લાગ્યો. ઘણા દેશોની સરકારોએ મને પોતાને ત્યાં મારી શારીરિક શિક્ષણની પદ્ધતિ વિષે વ્યાખ્યાન આપવા માટે આમંત્રણો આપ્યાં અને પોતાને ત્યાં મારી પદ્ધતિ દાખલ કરી આપવાની મને વિનંતિ કરી. મારા પર જગતના દરેક ભાગમાંથી પત્રોનો પ્રવાહ વહેવા લાગ્યો. લોકો શારીરિક કેળવણી અંગેના તેમના પ્રશ્નોમાં મારી સલાહ માગવા લાગ્યાં, મારી પદ્ધતિને સમજવાની ઈચ્છા બતાવવા લાગ્યા.

પરંતુ મારી આ વેગવાન પ્રવૃત્તિઓની વચ્ચે વચ્ચે મને ઘણી વાર એક લાગણી થઈ આવતી હતી. મને થતું હતું કે મારી આ જે શક્તિ અને જ્ઞાન છે, મારું આ જે દેશવ્યાપી સંગઠન અને એમાંથી પ્રગટેલ જે શક્તિ છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં મારો જે પ્રભળ પ્રભાવ છે એ બધાને હું જો કોઈ આથી પણ વધુ ઉચ્ચ, વધુ ઉમદા, વધુ ઉન્નત ધ્યેય ખાતર કદાચ વાપરી શકું તો જ મારી આ બધી પ્રવૃત્તિને તેની કોઈ સાચી સાર્થકતા પ્રાપ્ત થાય. પરંતુ આ મહાન વસ્તુ કઈ હશે તે હું હજુ લગ્ની શક્યો નથી.

કેટલીક વાર લોકોએ મને ‘પરમ માનવ’ તરીકે વાર્ણવ્યો છે. પરંતુ ખરેખર, હું ‘પરમ માનવ’ નથી. હજુ પણ હું પ્રકૃતિનો ગુલામ જ છું, હજુ પણ હું માણસ જ છું. માણસ તરીકની બધી યે અવિદ્યા, બધીય ભર્યાદાઓ અને અશક્તિઓ મારામાં છે. કોઈ પણ અકસ્માત કે માંદળીનો ભોગ હું બની જઈ શકું છું. માણસની આખીયે શક્તિને નિયોગી લેતી કોઈ પણ ઉત્ત્ર વાસના મારો કબજો લઈ શકે છે. હું અનુભવું છું કે આખરે તો હું આ બધી વસ્તુઓથી પર નથી જ જઈ શક્યો. મારે હજુ કંઈક બીજું શીખવાનું છે. કંઈક બીજું સિદ્ધ કરવાનું છે.

અત્યારે હવે મારી સામે મૃત્યુ આવીને ઊભું છે, પરંતુ મને તેનો લેશ પણ ડર નથી. કોઈ પણ પારાવાર વેદનાનો વિચાર, ભૂખ કે તરસ મને મૂંજવતાં નથી. મને માત્ર એક જ વસ્તુનું દુઃખ રહી જાય છે કે મારા પ્રશ્નોનો ઉકેલ મારા આ જીવનમાં જ હું શોધી શક્યો નથી. જીવનમાં મેં ઘણી મહાન સફળતા મેળવી છે, મને કીર્તિ, માન, ધન મળ્યાં છે, માણસ જે જે જંખી શકે તે બધું મને મળ્યું છે. પરંતુ તેથી તૃપ્તિ નથી થઈ. કેમકે હું હજુ એ વસ્તુ જાણી શક્યો નથીકે, ‘જીવનમાં મને આટલું બધું મળ્યું છે છતાં કોક વસ્તુ મને ખૂબ ખૂટી લાગે છે તે કઈ હશે? મારી શારીરિક પૂર્ણતાનો અને શક્તિનો ઉચ્ચ્યમાં ઉચ્ચ્ય ઉપયોગ કર્યો હશે? મારી આ દેશવ્યાપી સંગઠન શક્તિને, મારા આંતરરાષ્ટ્રીય પ્રભાવને કઈ વસ્તુને માટે ઉત્તમોત્તમ રીતે વાપરી શકાય તેમ હશે?

૭

## આ પછી પેલા અજ્ઞાત માનવનો અવાજ સંભળાવા લાગે છે, સ્વર્ણ, નન્દ, સ્પર્શ, એક ગણુન શક્તિથી ભરપૂર

### અજ્ઞાત માનવ

તમે સૌ જે જાણવા ઈચ્છો છો તે હું તમને કહી શકું છું.

તમારી સર્વની પ્રવૃત્તિઓ અને પ્રવૃત્તિઓનું ક્ષેત્ર આટલાં બધાં જુદાં જુદાં રહેલા છે છતાં તમને સર્વને એક જ પ્રકારના અનુભવ થયેલો છે. તમને તમારી પોતપોતાની પ્રવૃત્તિમાં સફળતા મળેલી છે છતાં તમે છયે જાણ એક જ સમાંતર નિર્ણય ઉપર આવ્યા છો. આમ એટલા માટે થયું છે કે તમે સૌ સપાઠી પરની ચેતનામાં જ રહેલા છો, તમે વસ્તુઓના બાધ્ય સ્વરૂપને જ જોતા રહેલા છો, તમને વિશ્વની સાચી વાસ્તવિકતાનું જ્ઞાન થયેલું નથી.

તમે માનવજ્ઞતિની શ્રેષ્ઠ વ્યક્તિઓના પ્રતિનિધિ છો. માનવને માટે જે કાંઈ ઉત્તમોત્તમ સિદ્ધિ શક્ય છે તે તમે દરેકે મેળવેલી છે, તમે માનવજ્ઞતિની ઊંચામાં ઊંચી ટોચ છો પરંતુ આ ટોચ પર પહુંચ્યા પછી હવે તમારી સામે એક ખીણ આવીને ઊભી છે, અને હવે તમારાથી આગળ વધાય તેમ નથી. તમને એકને પણ તમારા પોતાના કાર્યથી તૃપ્તિ નથી અને છતાં તમારે હવે શું કરવું જોઈએ તે તમે કોઈ જાણતા નથી. તમારા જીવનમાંથી તેમજ તમારી શુભ નિષ્ઠામાંથી તમને એક બેવડો પ્રશ્ન ઊભો થયેલો છે અને તેનું નિરાકરણ તમને કોઈને પણ જરૂર નથી. આ પ્રશ્ન બેવડો છે એમ હું કહું છું તેનું કારણ એ છે કે એને બે બાજુ છે. વ્યક્તિગત અને સામુદ્દરિક. પોતાનું હિત અને બીજાઓનું હિત બંને પૂર્ણ પણે કઈ રીતે સિદ્ધ થઈ શકે? જીવનની આ વિકટ સમસ્યા છે અને તમારી કોઈની પાસે એનો ઉકેલ નથી. અને તે સ્વાભાવિક છે, કેમકે આ સમસ્યા મનોમય માનવથી ઊકલવાની નથી, ભલે પછી એ માનવ ગમે તેટલો મહાન હોય. આ ઉકેલ મેળવવો હશે તો માણસે એક નવીન ચેતનામાં, એક ઊર્ધ્વ ચેતનામાં સત્ય-ચેતનામાં જન્મ લેવો પડશે. જગતના આ જ્ઞાનભંગર આભાસની પાછળ એક શાશ્વત વાસ્તવિકતા આવી રહેલી છે. આ સંધર્ષમાં અટવાતી અચેતન માનવતાની પાછળ એક અદ્વૈતરૂપ ચેતના આવી રહેલી છે. આ સતત ચાલુ રહેતાં અસત્યોની પાછળ એક નિર્મણ જ્યોતિર્મય સત્ય આવી રહેલું છે. આ તમોમય અને હઠીલા અજ્ઞાનની પાછળ એક પરમ સમર્થ જ્ઞાન આવેલું છે.

અને આ પરમ વાસ્તવિકતા કાંઈ બધું દૂર આવેલી નથી. એ તો તમારી પાસે

છે, ઘણી પાસે છે. તમારા સ્વરૂપના કેન્દ્રમાં તે બેઠેલી છે, આખા વિશ્ના કેન્દ્રમાં તે બેઠેલી છે. અને ત્યાંથી તેને તમારે માત્ર શોધી લેવાની છે અને જીવનમાં સાકાર કરવાની છે. એ તમે કરી શકશો ત્યારે તમે તમારા બધાય પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો, તમારી સર્વ મુશ્કેલીઓને પાર કરી શકશો.

તમે કદાચ કહેશો કે આ વસ્તુ તો જગતના ધર્મોએ ક્યારની કહી દીધેલી છે. ઘણા ધર્મોમાં આ વાસ્તવિકતાની વાત આવે છે, એ બધા એને પ્રભુનું નામ આપે છે. હા, ધર્મોએ આ વાત તો કરી છે, પરંતુ તેમ છતાં આ ધર્મ તમારા પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ લાવી શક્યા નથી, તમારા પ્રશ્નોનો નિઃશંક એવો ઉત્તર આપી શક્યા નથી. ઉલટું, આ ધર્મને તો આ દીનનુઃખી માનવજીતિનાં દર્દોના ઈલાજ કરવાના પ્રયત્નમાં સાવ નિષ્ફળતા જ મળેલી છે.

જગતના કેટલાક ધર્મ કોઈ પયંગંબરને લાઘેલા દર્શનમાંથી ઊભા થયેલા છે, તો કેટલાક ધર્મો કોઈ તત્ત્વજ્ઞાનિક તથા આધ્યાત્મિક આદર્શ ઉપર મંડાયેલા હોય છે. પરંતુ આ પયંગંબરનાં દર્શનો થોડાક જ વખતમાં એક કિયાકાંડમાં પલટાઈ ગયેલાં છે, અને તત્ત્વજ્ઞાને આપેલાં આદર્શો એક રૂપ માન્યતાના રૂપે બની ગયા છે. અને એમ એ ધર્મ પાછળ રહેલું સત્ય લુભ્ટ થઈ ગયું છે. આ ઉપરાંત આ ધર્મોની, એક એક ધર્મની, વિના અપવાહે, એક ખાસ વાત એ રહેલી છે કે તે બધા માનવજીતિને જે નિરાકરણ બતાવે છે તે જીવન ઉપર નહિ પણ મૃત્યુ ઉપર મંડાયેલું, પારલૌકિક નિરાકરણ છે. એ નિરાકરણનો સાર એ હોય છે કે: ભાઈ, આ અશુભ્યી ભરેલા જગતનો કોઈ ઈલાજ છે જ નહિ. એટલે તમારા ઉપર જે કાંઈ દુઃખો આવી પડે તે શાંતિથી કશી દાદ ફરિયાદ કર્યા વિના સહન કરી લો. અને તમારા આ સમર્પણ ભાવનો બદલો તમને મૃત્યુ પછી મળી રહેશે. અથવા તો બીજોં નિરાકરણ એ બતાવવામાં આવે છે કે, તમે જીવન પ્રત્યેની તમામ આસક્તિ તજ દો અને એમાંથી પછી જીવન જીવવાની કૂર ફરજમાંથી તમને હુંમેશને માટે મુક્તિ મળી જશે. પરંતુ આવા નિરાકરણમાંથી પૃથ્વી ઉપર રહેતી માનવ જીતિનાં દુઃખોનો કશો ઈલાજ મળી આવતો નથી, તેમ જ જગતની સર્વવ્યાપી પરિસ્થિતિનો પણ કશો ઈલાજ મળતો નથી. એટલે આપણે જગતની આ અંધાધૂંધીનો, અતંત્રતા અને દુઃખનો જો સાચો ઉકેલ શોધવો હશે તો તે ઉલટું, જગતની અંદર જ શોધવાનો રહે છે. ખરી વાત તો એ છે કે આ ઉકેલ જગતની અંદર જ આવેલો છે, જગતમાં તે એક ગુપ્ત રૂપે પડેલો છે અને આપણે તેને બહાર લઈ આવવાનો છે. વળી આ ઉકેલ અગમ્ય રીતનો કે કોઈ કાલ્પનિક રૂપનો નથી. એ એક ઘણો જ વાસ્તવિક રૂપવાળો, સધન ઉકેલ છે, અને કુદરતે પોતે જ એ આપેલો છે. આપણાને જો કુદરતનું અવલોકન કરતાં આવડરો તો એ કુદરતમાંથી જ

એ ઉકેલ મળી આવે તેમ છે. આપણે જોઈએ છીએ કે કુદરત એ એક આરોહણ રૂપની ગતિ છે. કુદરત એક રૂપમાંથી બીજું નવું રૂપ, એક જાતિમાંથી બીજી નવી જાતિ ઉત્પત્તિ કરે છે. અને એ નવા રૂપમાં વિશ્વ ચેતનાનું કાંઈક વધુ તત્ત્વ પ્રગટ કરવાની શક્તિ હોય છે. જગતની તમામ હડીકતો જોતાં એ વસ્તુ પુરવાર થાય છે કે પૃથ્વી ઉપર થયેલા વિકાસકર્મમાં માનવજાતિ એ કાંઈ છેવટનું પગથિયું નથી. આ માનવજાતિની પછી એક બીજી નવી જાતિ પૃથ્વી ઉપર અવશ્ય આવવાની જ છે. એ માનવજાતિ, અત્યારે માનવ પશુ કરતાં જેટલો આગળ વધેલો છે એના જેટલી જ અત્યારના માનવ કરતાં આગળ વધેલી હશે. જગતમાં અત્યારની માનવ-ચેતનાને સ્થાને એક નવી ચેતના, એક મનોમય નહિ પણ અતિમાનસ ચેતના આવશે, અને એ ચેતના એક વધુ ઉચ્ચ્ય, અતિમાનવ કિંબા દિવ્ય માનવજાતિને જન્મ આપશે.

આવી જાતિના ઉદ્યની શક્યતા છે એ વાત કેટલાય વખતથી માણસોને દેખાતી રહી છે. માનવજાતિને એ માટેનું વચ્ચેન પણ મળી ગયું છે. અને પૃથ્વી ઉપર એ વસ્તુ સિદ્ધ થવાનો વખત હવે આવી ચૂક્યો છે. તમને સૌને જે આટલો બધો અસંતોષ થાય છે, તમારા જીવનમાં તમારે પ્રાપ્ત કરવું હતું તે થઈ શક્યું નથી. એવી જે લાગણી થાય છે તેનું કારણ પણ આ જ છે. અંધકારમાં સપદાયેલા આ જગત માટે મુક્ત થવાનો આ જ એક માર્ગ છે. અને તે એ કે માનવની ચેતનામાં એક આમૂલ્ય પરિવર્તન થઈ જવું જોઈએ. ખરી વાત તો એ છે કે ચેતનાનું આ રૂપાંતર થવું, એક વધુ ઉચ્ચ અને વધુ સત્ય ચેતનાનો આવિર્ભાવ થબો એ શક્ય છે એટલું જ નહિ પણ નિશ્ચિત પણ છે. એથીયે આગળ જઈને એમ પણ કહી શકાય કે આપણા જીવનનું લક્ષ્ય પણ આ જ છે, પૃથ્વી ઉપર જીવન પ્રગટ્યું છે તે પણ આ કારણે જ છે. આ વિકાસકિયામાં પ્રથમ ચેતનાનું રૂપાંતર થવાનું રહે છે, તે પછી જીવનનું રૂપાંતર થશે અને પછી રૂપોનું રૂપાંતર થશે. નવી સૃષ્ટિ આ કમમાં રચાશે. ખરી રીતે તો પ્રકૃતિની સારીએ કિયા ક્રમે ક્રમે પેલી પરમ વાસ્તવિકતામાં પાછા પહોંચવા માટેની જ એક ગતિ છે. આ આખુંયે વિશ્વ, એના સમગ્ર રૂપે તેમ જ એની નાનામાં નાની વસ્તુ પણ, એ પરમ વાસ્તવિકતામાંથી જ પ્રગટ થયેલું છે. અને સાથે સાથે આ જગતનું ધ્યેય પણ એ પરમ વાસ્તવિકતા જ છે. અને આમ આપણે મૂળમાં તત્ત્વ રૂપે જે કાંઈ છીએ તે આપણે પ્રગટ મૂર્તિ રૂપે જીવનમાં બનવાનું છે. આપણા સ્વરૂપના ઊંડાણમાં એક સૌનાદર્ય, એક શક્તિ, એક પૂર્ણતા ગુપ્ત રૂપે રહેલાં જ છે તેમને આપણે સમગ્રપણે જીવનમાં સાકાર કરવાનાં છે. એમ બનશે ત્યારે સારુંયે જીવન પ્રભુના ભવ્ય, શાશ્વત, દિવ્ય આનંદનું પ્રગટ રૂપ બની રહેશે.

એક નીરવતા છવાય છે અને તેમાં છયે જણા સંમતિનો  
ભાવ સૂચવતા એકબીજા પ્રત્ય જોઈ રહે છે.  
ત્યાર પછી :

### લેખક

તમારા શબ્દોમાં એક મહા શક્તિ છે, એક હૃદયસ્પર્શી બળ છે. હા, અમને લાગે છે કે અમારી આગળ એક નવું દ્વાર ખૂલ્યું છે, અમારા હૃદયમાં એક નવી આશા જન્મી છે, પણ એ આશાને સિદ્ધ થવા માટે સમય જોઈશે. હમણાં તો મૃત્યુ આપણી રહ્ય જુઓ છે. અંત નજીક આવી રહ્યો છે. આહ, અફ્સોસ છે કે આ વાત આપણને બહુ મોડી જાણવા મળી.

### અજ્ઞાત માનવ

ના, બહુ મોડું નથી થયું. આ જગતમાં કદ્દી કશું મોડું હોતું નથી,

આવો, આપણે સર્વે એક મહાન અભીપ્સાપૂર્વક સંકલ્પ કરીએ, પ્રભુની ફૂપાને અહીં આવવા માટે પુકાર કરીએ. ચમત્કાર હુંમેશાં બની શકે છે. શ્રદ્ધાની શક્તિને કોઈ સીમા નથી. અને પ્રભુના આ ભાવિ કાર્યમાં ભાગ લેવાનું જો આપણું નિર્માણ હશે તો પછી પ્રભુની ફૂપા જરૂર અહીં આવશે અને આપણું જીવન લંબાવશે. આવો, એક જ્ઞાનીની નમ્રતા ધારાણ કરીને અને બાળકની સરલ શ્રદ્ધાપૂર્વક આપણે પ્રાર્થના કરીએ. આપણે સાચા હૃદયથી આ નવી ચેતનાને, આ નવા સત્યને, આ નવા સૌન્દર્યને પુકાર કરીએ. જગતમાં આ સર્વે પ્રગટ થવાં જ જોઈશે. એ પ્રગટ થતાં પૃથ્વીનું રૂપાંતર થશે, આ સ્થૂલ જગતમાં અતિમાનસનું જીવન સિદ્ધ થશે.

બધાં શાંત બની એકાગ્રતા કરે છે.

અજ્ઞાત માનવ પાઇઠો બોલવા લાગે છે :

‘હું પરમ સત્ય, અમારી પ્રાર્થના છે કે આ જે અદ્ભુત રહસ્ય અમારી સમક્ષ પ્રગટ થયું છે તેનો અમે જીવનમાં પૂર્ણ રીતે સાકાર કરીએ.’

બધા એ પ્રાર્થના ફરીથી બોલે છે અને એકાગ્રતામાં મગ્રા રહે છે.

એકાએક કળાકારનો અવાજ સંભળાય છે:

જુઓ! જુઓ!

ક્ષિતિજ ઉપર ટપકા જેવું એક વહૃણ દેખાય છે, અને ધીરે ધીરે તે પાસે  
આવતું જાય છે. આશ્ર્યના ઉદ્ગારો. અશાત માનવ બોલે છે:

આપણી ગ્રાર્થના સંભળાઈ છે.

વહૃણ જ્યારે સ્પષ્ટ દેખાવા લાગે છે ત્યારે વ્યાયામવિદ્ધૂદીને હોડીની બાજુ  
પર ચડી જાય છે. પોતાનો રૂમાલ બહુર ખેંચી કાઢે છે અને હલાવે છે. વહૃણ  
પાસે આવતું જાય છે.  
વિજ્ઞાનશાસ્ત્રી બોલી ઉઠે છે:

એ લોકોએ આપણને જોયા છે. એ આવે, એ આવે!

અને અશાત માનવ ધીરે ધીરે બોલે છે:

આ છે મુક્તિ, આ છે નવું જીવન.

( ૫૩૮ )

\*

# સત્ય પ્રતિ આરોહણ

જીવનનું એક નાટક  
પ્રવેશક, સાત સોપાનો અને ઉપસંહારમાં

## પાત્રો

માનવકલ્યાણવાદી; નિરાશાવાદી; વિજ્ઞાનશાસ્ત્રી; કળાકાર; ત્રણ વિદ્યાર્થીઓ;  
બે પ્રેમીઓ; સંન્યાસી; બે અભીષ્ટુઓ

પ્રવેશક : કળાકારના સ્ટુડિયોમાં, પ્રાથમિક સભા  
આરોહણનાં સાત સોપાનો, સાતમું સોપાન શિખર ઉપર  
ઉપસંહાર : નવું જગત

## પ્રવેશક

### કળાકારના સ્ટુડિયોમાં

સાંજ, રાત પડવા આવી છે. સત્ય પ્રાપ્તિ માટેની એક સમાન અભીષ્ટા  
ધરાવતી વ્યક્તિઓના એક નાના મંડળની મળેલી સભાનો અંત.

#### ઉદ્ઘાર રહેલા :

માનવકલ્યાણવાદી, સંદ્રભાવથી ભરેલો માણસ,

નિરાશાવાદી, જીવન તરફથી નિરાશા પામેલો અને પૃથ્વી ઉપર હવે સુખ  
શક્ય હોઈ શકે જ નહિ એમ માનતો થયેલો માણસ.

વિજ્ઞાનશાસ્ત્રી, પ્રકૃતિના પ્રશ્નોને ઉકેલવા પ્રયત્ન કરતો,

કળાકાર, એક વધુ સુંદર આદર્શનું સ્વપ્ન સેવતો.

ત્રણ વિદ્યાર્થીઓનું જૂથ (બે છોકરાઓ અને એક છોકરી), એક વધુ ઉત્તમ  
કોટિના જીવનમાં તેમ જ પોતાની જાતમાં જેમને શ્રદ્ધા છે એવાં.

બે પ્રેમીઓ, માનવ-પ્રેમમાં પૂર્ણતાને શોધી રહેલાં.

સંન્યાસી, સત્યને પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારનાં તપ કરવાને તૈયાર.

બે અભીષ્ટુઓ, એકબીજામાં સમાન અભીષ્ટા હોવાને લીધે ભેગાં થઈ  
ગયેલાં, અને અનંત પ્રભુએ તેમની પસંદગી કરેલી હોવાથી અનંત પ્રભુની તેમણે  
પસંદગી કરેલી એવાં.

(પઢદો જીપડે છે.)

### કળાકાર

મારા પ્રિય ભિત્રો, આપણી સભા હવે પૂરી થવા આવી છે. પરંતુ એ સભાનું આપણે વિસર્જન કરીએ અને આપણે સંગઠિત પ્રવૃત્તિ આદરવા માટે છેવટનો નિર્ણય લઈએ તે પહેલાં મારે આપને ફરી વાર પૂછી લેવું જોઈએ કે આપ સર્વેએ જે કાંઈ નિવેદનો કર્યા છે તેમાં આપને કાંઈ વિશેષ ઉમેરવાનું હવે છે ખરું?

### માનવકલ્યાણવાદી

હાજી, મારે ફરી એક વાર જાણાવવું જોઈએ કે મેં મારું સારુંયે જીવન માનવજ્ઞતિને મદદ કરવામાં સમર્પણ કરી દીધું છે. માનવજ્ઞતિને સહાય કરવા માટેની જે કોઈ પદ્ધતિઓ જાણીતી છે તથા શક્ય છે તે સર્વ મેં અનેક વરસો લગી અજમાવી જોઈ છે. પણ ઓમાંથી એક પણ પદ્ધતિએ મને સંતોષકારક પરિણામ આપ્યું નથી અને એટલે મને હવે પૂરી ખાતરી થઈ ગઈ છે કે મારા પ્રયત્નમાં મારે સફળ બનવું હોય તો મારે સત્ય શોધી લેવું જ જોઈએ. ખરેખર, તમને જીવનનો સાચો અર્થ જડ્યો ન હોય તો પછી તમે માણસોને અસરકારક મદદ કેવી રીતે આપી શકવાના છો? આપણો જેટલા જેટલા ઈલાજો અજમાવ્યા છે તે બધા રોગને કેવળ ઉપર ઉપરથી જ મટાડે છે, રોગને તે નિર્મળ કરી શકતા નથી, માનવજ્ઞતિનો ઉદ્ધાર કેવળ સત્યની ચેતના જ કરી શકશે.

### નિરાશાવાદી

મેં તો જીવનમાં બહુ બહુ વેક્યું છે, ભાઈ. હું તો જીવનમાં ઘણી ઘણી ભાંતિઓ અનુભવી ચૂક્યો છું. આહ, મારા પર તો ઘણા ઘણા અન્યાયો ગુજર્યા છે, કેવાં કેવાં તો હુઃખ ઉત્તર્યા છે. હવે તો કશામાંય મારી શક્તા રહી નથી. મારી પાસે તો હવે જગત માટે કે માણસો માટે કોઈ જ આશા રહી નથી. મારે તો બસ, હવે માત્ર એક જ આશા છે,—સત્ય શોધી લેવું છે, જો કદી પણ સત્ય શોધાય તેમ હોય તો.

### પહેલો અભીપ્સુ

તમે જુઓ છો કે અમે બે જાણ અહીં સાથે આવેલાં છીએ, પણ એનું કારણ એ છે કે એક સમાન અભીપ્સાએ અમારાં જીવન ભેગાં કર્યા છે. અમે કોઈ કામનાના બંધનથી કે લાગણીના બંધનથી બંધાયેલાં નથી. અમારાં જીવનમાં માત્ર એક જ વસ્તુ રમી રહી છે: સત્યની શોધ.

## પ્રેમીઓમાંનું એક (અભીષ્ટુઓ પ્રત્યે આંગળી ચીંધી)

આપણા આ બે ભિત્રો કરતાં અમારી સ્થિતિ તો સાવ ઊલટી જ છે. અમે બે તો (પોતાની પ્રિયતમાને આલિંગન ભરતાં) કેવળ એકબીજાને આધારે, એકબીજાને અર્થે જ જીવીએ છીએ. અમારી તો કેવળ એક જ અભીષ્ટા છે કે અમે સંપૂર્ણ અદ્વૈત પામીએ, બે શરીરોમાં અમે એક જ આત્મા બની રહીએ. અમારાં બે બદનમાં એક જ ચિત્ત, એક જ સંકલ્પ, એક જ શાસોચ્છ્વાસ ચાલે, બે હદ્યમાં એક જ ધબકાર ધબકે. અમારી ઝંખના છે કે અમે બંને અમારા હદ્યના પ્રેમ દ્વારા જ જીવીએ, એ પ્રેમમાં જ, એ પ્રેમને ખાતર જ જીવીએ. અમારે પ્રેમનું આ પૂર્ણ સત્ય શોધવું છે. અને જીવનમાં ઉતારવું છે. અમારું જીવન અમે આ ધ્યેયને સમર્પણ કરેલું છે.

### સંન્યાસી

મારી વાત પૂછો તો સત્ય કાંઈ આટલી બધી સહેલાઈથી મળી જશે એમ મને લાગતું નથી. સત્યમાં પહુંચ્યવાનો માર્ગ તો મહા કઠણ હોવો જોઈએ, એમાં તો અનેક ઊંચાં ઊંચાં ચઢાણો, ઊંડી ઊંડી ખાઈએ, ભયંકર ભયો, કારમાં જોખમો, ઘોર આપત્તિએ, અમોત્પાદક ભાંતિએ, એ બધું હોવું જોઈએ. આ સર્વ વિદ્ધનોને જીતવા માટે આપણામાં એક અચલ સંકલ્પશક્તિ અને લોખંડી નસો હોવી જોઈએ. અને આ રીતે, મારી સમક્ષ મેં જે ભવ્ય ધ્યેય રાખ્યું છે તેને માટે પાત્ર થવાને હું હરેક રીતનું બલિદાન આપવાને તૈયાર છું, એ માટે હું હરેક રીતની તપશ્ચર્યા, હરેક રીતનો ત્યાગ કરવા તૈયાર છું.

### કળાકાર (બીજાઓ તરફ ફરીને)

તો તમારે શું કાંઈ વધુ કહેવાનું નથી?... ના. તો પછી આપણે બધા હવે પૂરેપૂરા સંમત છીએ. આપણે સૌ એક સાથે નીકળીશું અને સાથે મળીને પર્વત ચચીશું. એ પવિત્ર ગિરિનું આરોહણ આપણને સત્ય તરફ લઈ જશે. આ પર્વત પર ચડવું એ તો મહા કઠણ અને કપરું સાહસ છે, પણ છતાંયે એ સાહસ જેવું છે. કેમકે, આપણે એના શિખર પર પહુંચ્યો ત્યારે આપણને સત્યનું દર્શન થશે અને ત્યાં પછી તમામ પ્રશ્નોના ઉકેલ આવી જ જશે.

તો હવે આપણે સૌ આવતી કાલે પર્વતની તળેટીમાં બેગા થઈએ છીએ. ત્યાંથી આપણો સંઘ આરોહણ શરૂ કરશે. નમસ્કાર.  
(સૌ કોઈ 'નમસ્કાર' કહીને છૂટા પડે છે.)

## પહેલું સોપાન

[હરિયાળીથી ઢકાયેલો એક રીતનો ઉચ્ચ પ્રદેશ. એના પરથી આખી ખીણ જોઈ શકાય છે. આ ઉચ્ચ પ્રદેશમાંથી રસ્તો આગળ વધે છે. અત્યાર લગી એ રસ્તો સહેલો તેમજ વિશાળ હતો તે અહીંથી હવે એકાએક સાંકડો બની જાય છે અને ડાબી બાજુએ આવેલા પ્રચંડ ખડકોના બનેલા પર્વતની શિલાઓને વીંટળાતો વીંટળાતો આગળ વધે છે.

બધા યાત્રીઓ એકી સાથે આવી પહેંચે છે. સૌ કોઈમાં શક્તિ અને ઉત્સાહ ઊછળી રહ્યાં છે. પોતાની નીચે પથરાયેલી ખીણ ઉપર તેઓ નજર ફેરવે છે, પછી માનવકલ્યાશવાદી હાથનો ઈશારો કરીને સૌને ભેગાં કરે છે.]

### માનવકલ્યાશવાદી

મિત્રો, મારે તમને કાંઈક કહેવું છે. તમને મારે કેટલીક ગંભીર બાબતો જણાવવાની છે. (ચુપકીદી; બધા ધ્યાનપૂર્વક સાંભળે છે.)

આપણે સૌ આનંદ કરતા કરતા આ ઉચ્ચ પ્રદેશ સુધી સહેલાઈથી ચડી આવ્યા છીએ. અહીંથી આપણે હવે જીવનને જોઈ શકીએ છીએ અને જીવનના પ્રશ્નોને તથા માનવનાં દુઃખનાં કારણોને વધારે સારી રીતે સમજ શકીએ છીએ. આપણું જ્ઞાન હવે વધારે વિશાળ બન્યું છે, વધારે ઊંઠું બન્યું છે અને આપણે જે ઉકેલ શોધી રહ્યા છીએ તે મેળવવાની શક્તિ આપણામાં હવે આવી ગઈ છે... (ચુપકીદી )

પરંતુ આપણે હવે એક નવો નિર્ણય માગતી પરિસ્થિતિમાં આવી પહોંચ્યા છીએ. અહીંથી હવે આપણો ચઠવાનો માર્ગ વધુ ને વધુ સીધો બનવાનો છે, માર્ગ હવે વધુ કઠાળ પણ બનશે, અને ખાસ વાત તો એ છે કે આપણે પર્વતની પેલી બાજુ ચાલ્યા જઈશું ત્યાર પછી આપણને આ ખીણ અને માણસો દેખાતાં બંધ થઈ જશે. અને એનો અર્થ તો એ થાય કે મારે માર્ગ કામ હવે છોડી દેવું પડશે, માનવતાને સહાય કરવાની મારી પ્રતિજ્ઞા મારે પડતી મૂકવી પડે. એટલે હવે તમે મને તમારી સાથે આગળ આવવા માટે આગ્રહ ન કરશો. મારે હવે તમારો સાથ પડતો મુકવો પડે છે અને મારી ફરજ ઉપર હું પાછો પહોંચી જાઉ છું.

(તે નીચે ઉત્તરવાનો માર્ગ લે છે. બાકીનાં સૌ આશ્રયચક્રિત બનીને નિરાશામાં એકબીજાની સામે જોઈ રહે છે. પછી... )

### સંન્યાસી

બિચારો મિત્ર! એ પાછો. નીચે પહોંચી ગયો. કર્મ પ્રત્યેની એની આસક્તિએ

એના પર વિજય મેળવ્યો છે. બાધ્ય જગત અને તેના આભાસોની ભ્રાંતિએ એને જીતી લીધો છે. પણ તેથી કંઈ આપણા ઉત્સાહમાં લેશ માત્ર ફેર નહિ પડે. ચાલો, આપણે આગળ ચાલતા થઈએ. આપણાને કોઈ અફ્સોસ નથી, કશી શંકા આશંકા નથી.

(બધા ફરીથી આગળ ચાલવા લાગે છે.)

## બીજું સોપાન

[રસ્તાનો એક ભાગ. એનો ઢાળ હવે વધુ ને વધુ ઊંચો બનવા લાગે છે. રસ્તો અહીંથી હવે કાટખૂણે વળી જાય છે અને આગળ ક્યાં જાય છે તે જોવું અશક્ય બની જાય છે. નીચેના ભાગમાં એક લાંબું ધંડું વાદળ રસ્તાને જગતથી પૂરેપૂરો અલગ કરી નાખે છે.]

સૌ કાઈ ઓછાવતા આનંદપૂર્વક આગળ વધતા રહે છે, સિવાય કે નિરાશાવાદી. એ સૌથી પાછળ પગ ઘસડતો આવે છે અને રસ્તાની બાજુ પરની એક ઊંચી જગા પર બેસી પડે છે. પોતાના બે હાથમાં તે માયું ઢાળી દે છે અને એ સ્થિતિમાં હાલ્યા ચાલ્યા વિના બેસી રહે છે. બીજાઓ એને પોતાની પાછળ આવતાં અટકી ગયેલો જોઈને પાછા ફરે છે. વિદ્યાર્થીઓ માંથી એક જગ્યા તેની પાસે આવે છે અને તેના ખભાને અડે છે.]

## વિદ્યાર્થી

કાં, ભાઈસાહેબ? શું થયું? થાક લાય્યો ?

## નિરાશાવાદી

(ખભો હલાવીને વિદ્યાર્થીને પાછો ધકેલી દેતા)

ના, ભાઈ, ના. રહેવા દો, મને એકલા બેસી રહેવા દો. હવે તો બહુ થઈ ગયું. એ વાત હવે અશક્ય છે!

## વિદ્યાર્થી

પણ શા માટે, ભલા? ચાલો ચાલો હવે, થોડીક વધુ હિંમત રાખો!

## નિરાશાવાદી

ના ના, કહું છું કે હવે મારાથી કશું જ નહિ બને. આપણું આ સાહસ મૂર્ખાઈ ભરેલું છે, અશક્ય છે. (નીચે પગ ડેઠળનું વાદળ બતાવીને) આ જુઓ પેલું! આપણે જગતથી, જીવનથી સાવ કપાઈ ગયા છીએ. હવે આપણે સમજવાને માટે આધાર રૂપ કશું જ, કશું જ રહ્યું નથી.

(ઉપર કાટખૂણે વળી જતાં રસ્તા તરફ એ પાછી નજર નાખે છે.)

અને આ પેલું! આ હવે તમે કયાં જઈ રહ્યા છો એ પણ તમને અહીંથી દેખી શકતું નથી. ભલા ભાઈ, આ વાત જ આખી અર્થ વિનાની છે, યા તો બ્રાંતિ છે—કે કદાચ બંને પણ હોય! પણ આખરે તો એમ પણ હોય કે જગતમાં કદાચ કશું શોધવા જેવું સત્ય જ નહિ હોય. જગત, જીવન — એ તો કોઈ બંધ બારણાંવાળું નરક જ છે ને! અને આપણને એમાં કોઈએ સપડાવ્યા છે! ભલે ભાઈ, તમારી ઈચ્છા હોય તો તમે આગળ જાઓ. બાકી આપણે તો આવવું નથી. મારે હવે કોઈ બ્રાંતિમાં ફસાવું નથી!

(તે પાછો પોતાનું મોકું બે હાથમાં ઢાળી દે છે. વિદ્યાર્થી અને સમજાવવાની બધી આશા મૂકી દે છે. અને અને હવે વિલંખ કરવો નથી એટલે નિરાશાવાદીને અની નિરાશામાં પડતો રહેવા દઈને ગિરિનું આરોહણ કરનારાઓમાં જોડાવાને ચાલતો થાય છે.)

## ત્રીજું સોપાન

[વિજ્ઞાનશાસ્ત્રી અને કળાકાર યાત્રીમંડળની પાછળ પાછળ ચાલ્યા આવે છે. તેઓ વાતોમાં ઉત્તરી પેઢલા હોલાથી પાછળ પડી ગયેલા છે. તેમનો વાર્તાલાપ હવે પૂરો થવા આવ્યો છે.]

## વિજ્ઞાનશાસ્ત્રી

હા, હું તમને એમ કહેતો હતો કે આ સાહસ ખરેખર આપણે જરા હળવા મનથી આદરી બેઠા છીએ.

## કળાકાર

વાત તો સાચી છે. હજુ સુધીઆપણે આટલું ચયડાતેનું કંઈ પરિણામ આવ્યું નથી, બેશક, આપણને ચયડતાં ચયડતાં ઘણી ઘણી રસિક વસ્તુઓ અવલોકન કરવાને તો મળેલી

છે જ, પરંતુ એ અવલોકનમાંથી આપણને કોઈ વિશેષ લાભદાયક વસ્તુ મળી નથી.

### વિજ્ઞાનશાસ્ત્રી

હા, હું તો મારી પોતાની કાર્યપદ્ધતિઓ જ વધુ પસંદ કરું છું. બીજી પદ્ધતિઓ કરતાં એમાં તર્કની સુસંગતતા તો વધારે જ છે. અને વળી એ પદ્ધતિઓ મેં સતત પ્રયોગોના ઉપર જ માર્ગદર્શિકા છે. એક પગથિયું સાચું છે એવી મને ખાતરી થઈ જાય ત્યાર પછી જ હું બીજું પગલું આગળ ભરું છું. તો હવે આપણા મિત્રોને જરા બોલાવી દઈએ. હું માનું છું કે એમને આપણે કંઈક વાત કહેવાની જરૂર તો છે જ.

(હાથનો દિશારો કરીને તેમજ અવાજ કરીને તે બીજાઓને બોલાવે છે, બધાં પાસે આવી જતાં તે તેમને પાછો સંબોધવા લાગે છે.)

મારા પ્રિય દોસ્તો, મારા સફરના સાથીઓ, આપણે હવે જેમ જેમ જગતથી અને જગતની વાસ્તવિકતાઓથી દૂર ને દૂર જઈ રહ્યા છીએ તેમ તેમ મને હવે લાગવા માંગ્યું છે કે આપણે હવે બાળકના જેવું વર્તન કરવા લાગ્યા છીએ. આપણને એમ જણાવવામાં આવેલું કે આપણે જો અત્યાર લગી અગમ્ય રહેલાં શિખરોવાળા આ ઉચ્ચ પર્વત ઉપર ચડી જઈશું તો આપણને સત્યની ગ્રાપ્તિ થશે. અને પછી આપણે બધા આ પર્વત પર ચડવાનો રસ્તા કેવો છે એનો કાંઈ અભ્યાસ કર્યા વિના જ બસ નીકળી પડ્યા. પણ આપણે ખરે રસ્તે જઈએ છીએ કે ખોટે તે કોઈ કહી શકે તેમ છે ખરું? આપણને શું કોઈ ખાતરી આપી શક્શે ખરું કે આપણા પ્રયાસોનું પરિણામ આપણે આશા રાખેલી તેવું જ આવશે? મને તો લાગે છે કે આપણા હાથે એક અક્ષમ્ય એવી ધૃષ્ટા થઈ ગઈ છે, આપણા પ્રયાસની પાછળ કશી જ વૈજ્ઞાનિક દૃષ્ટિ રહેલી નથી. એટલે મેં તો હવે નિર્ણય કરી લીધો છે કે મારે અહીં જ અટકી જવું અને આ પ્રશ્નનો અભ્યાસ કરી લેવો, અને શક્ય હોય તો આપણે કયો માર્ગ લેવો જોઈએ, આપણને આપણા ધ્યેય સુધી ઠેક પહુંચાડી શકે તેવો સાચા રસ્તો કયો છે તે વાત ચોક્કસ કરી લેવી. બેશક, આ નિર્ણય કરતાં મને હિલગીરી તો ઘણી જ થાય છે, કારણ કે, તમારી સૌની સાથેની મારી મિત્રતા તો એવી ને એવી જ અખંડ છે.

(થોડી વાર પછી)

વળી મને એ વાતની પણ ખાતરી થઈ ગઈ છે કે હું જો કુદરતની કોઈ એક નાનામાં નાની વસ્તુના બંધારણ પાછળનું રહેસ્ય મેળવી શકું, દા.ત. આ રસ્તા પર જે નાનકડો પથ્થર પડ્યો છે તે કેવી રીતે બનેલો છે એ વાત જો હું જાણી શકું તો એમાંથી પણ હું જે સત્યને આપણે શોધી રહ્યા છીએ તેમાં પહુંચ્યો શકીશ. એટલે દોસ્તો, હું હવે અહીં જ થોતી જાઉં છું અને તમને સર્વને ‘મિલન-વિદાય’ વાંચું

છું – હા, મારી આશા છે કે આ આપણી ‘મિલન-વિદ્યાય’ – ‘એ રવાર’ રહેશે. કારણ કે તમે બધાં પાછાં મારી પાસે આવો, વૈજ્ઞાનિક પ્રક્રિયાનો આશ્રય લો એવું પણ કદાચ બને ખરું જ. અથવા તો એમ પણ બને કે, હું જે શોધી રહ્યો છું તે જો મને મળી આવે તો એ શુભ સમાચાર લઈને હું પણ તમારી પાસે આવી પહોંચું.

### કળાકાર

મને પણ આ જ વિચાર, તમારી વિદ્યાય લેવાનો વિચાર આવી રહ્યો છે. જોકે એ માટેનાં મારાં કારણો આ ભિત્રનાં કારણો જેવાં નથી. પણ છતાં એ કારણો આ વિજ્ઞાનશાસ્ત્રીનાં કારણો જેટલાં જ પ્રબળ તો છે જ.

વાત એમ છે કે આપણા આ આરોહણ દરમિયાન મને કેટલીક અનુભૂતિઓ થઈ છે. મારી સમક્ષ નવાં નવાં સૌન્દર્ય પ્રગાટ કરવામાં આવેલાં છે, અથવા એમ કહો કે મારામાં સૌન્દર્યની એક નવીન દૃષ્ટિ જન્મી છે. અને એની સાથે સાથે જ હવે એ અનુભૂતિઓને નક્કર સ્વરૂપમાં રજૂ કરવા માટે, એ અનુભૂતિઓને જડતત્ત્વના ઢાળમાં ઢાળવા માટે એક તીવ્ર અને અદ્યમ દૃષ્ટિ પણ મારામાં જાગી છે. મને લાગે છે કે એ કળા રૂપો માણસ માત્રની કેળવણીને માટે કામમાં આવશો અને આ સ્થૂલ જગતને તે પ્રકાશિત કરી આપશે. તો ભિત્રો, હું દિલગીર હૃદયે તમારી વિદ્યાય લઉં છું. મારી નવી અનુભૂતિઓને હું આકાર આપી લઈશ ત્યાં સુધી હું અહીં જ રહીશ. અને મારે કહેવાનું જ્યારે કહેવાઈ ગયું હશે ત્યારે હું પાછો આગળ ચડવાનું શરૂ કરીશ અને નવી શોધખોળો કરવા માટે, તમે જ્યાં પહોંચ્યાં હશો ત્યાં તમારી સાથમાં આવીને પાછો જોડાઈ જઈશ.

તો નમસ્કાર, અને મારી શુભેચ્છા!

(બીજાં બધાં કાંઈક છોભીલાં પડીને એકબીજાની સામે જુઓ છે – પછી નાનકડી વિદ્યાર્થીની બોલી ઉઠે છે :)

### વિદ્યાર્થીની

અરે, કોઈ અટકી પે તો એમાં શું થઈ ગયું, ભાઈ? જગતમાં દરેક જણા પોતાનું ભાવિ જ્યાં લઈ જાય ત્યાં જાય છે અને પોતાની જેવી પ્રકૃતિ હોય તે પ્રમાણે વર્તે છે. નહિ નહિ, આપણી શોધમાંથી આપણાને કશું પણ ચળાવી શકે તેમ નથી. ચાલો, આપણે તો હિંમત અને ધીરજપૂર્વક, વગર અટકયે આપણે માર્ગે ચાલવા જ લાગીએ.

(વિજ્ઞાનશાસ્ત્રી અને કળાકાર સિવાય બીજાં બધાં આગળ વધે છે.)

## ચોથું સોપાન

[બે અભીષ્ટુઓ અને સંન્યાસીનું બનેલું એક જૂથ વગર અટક્યે પસાર થાય છે અને મક્કમ અને નિયમિત પગલે પોતાનો ચડાવ ચાલુ રાખે છે.

એમની પાછળ બે પ્રેમીઓ આવે છે. બીજાઓ તરફ ધ્યાન આપ્યા વિના પોતાની અંદર જ મગ્ન રહીને તેઓ હૃથમાં હૃથ નાખીને ચાલે છે.

તેમની પાછળ તરત જ ત્રણ વિદ્યાર્થીઓ આવે છે. તેઓ થાકી ગયેલાં દેખાય છે અને અટકે છે.]

## પહેલો વિદ્યાર્થી

લો, ભર્યાંઓ! તમારે કુંગર ચડવો હતો ને, તો લો આ રહ્યો કુંગર, ચડો હવે! બાપ રે, આ તે કેવો તો રસ્તો છે? ઊંચા, ઊંચો ને ઊંચો. ક્યાંય અટક્યા વિના બસ ચાલ્યો જ જાય છે. અરે આપણને શાસ લેવાનો પણ વખત મળતો નથી — મને તો હવે થાક લાગવા માંડ્યો છે.

## વિદ્યાર્થીની

આ શું? તમે પણ અમને છોડી જવા માગો છો? એ તો કાંઈ બહુ સારું ના કહેવાય.

## પહેલો વિદ્યાર્થી

ના, ના, છોડી જવાની વાત જ નથી. પણ આપણે શું જરા આરામ પણ ન લઈ શકીએ? આ જરાક એકાદ મિનિટ બેસી લઈએ ને શાસ ખાઈ લઈએ — બીજું કાંઈ નહિ, થોડોક શાસ ખાઈ લઈએ. અને આ પગ, બાપ રે, કેવા દુખવા લાયા છે! મને લાગે છે જરા આરામ કરીશું તો પછી વધારે સારુ ચડાશો. એટલે હું તો કહું છુ કે આપણે જરાક બેસી લઈએ એકાદ મિનિટ, એકાદ મિનિટ જ. પછી તો પાછા આપણે વધુ જોરથી ચડવા લાગીશું, જોજોને!

## બીજો વિદ્યાર્થી

ભલે ભલે! તમને આમ થાકેલા પાકેલા મૂકી દઈને અમારાથી કાંઈ ચાલ્યા ન જવાય. અને આમ તો મને પણ થોડોક થાક તો લાયો છે. આવો ત્યારે આપણે

બધાં જ બેસીએ. અત્યાર સુધી આપણે જે કંઈ જોયું છે અને શીખ્યાં છીએ એની જરા વાતો પણ કરી લઈએ.

### વિદ્યાર્થીની

(એકાદ સેકન્ડની મનમથામણ પછી તે પણ બેસે છે.)

વારુ ભાઈ, હું કંઈ તમને મૂકીને તો નહિ જ ચાલી જાઉં. પણ આપણે બહુ વખત બેસવાનું નહિ, હોંકે. રસ્તામાં વિલંબ કરવો એમાં હુમેશાં જોખમ રહે છે.

(પ્રેમીઓ પોતાની પાછળ નજર નાખે છે.)

અને તમને બેઠેલાં જોઈને ચાલ્યાં જાય છે.)

### પાંચમું સોપાન

[સ્થાન ઘણું ઊંચું છે. એ દેખાઈ આવે છે. રસ્તો હવે વધુ સાંકડો બન્યો છે અને ક્ષિતિજ હવે ઘણી જ વિશાળ નજરે પેડે છે. નીચેની ખીણ ઉપર ગાઢ વાદળો છવાઈ ગયેલાં હોઈ તે સતત છુપાયેલી જ રહે છે. ડાબી બાજુએ, રસ્તાથી સહેજ પાછળના ભાગમાં એક નાનકું મકાન ઊભેલું છે અને તેની સામે ખુલ્લી જગા છે. પહેલાં ત્રાણ જગનું જૂથ વિના અટક્યે પસાર થઈ જાય છે. એ પછી એ પ્રેમીઓ એકબીજાને આલિંગન કરીને ચાલતાં ચાલતાં આવે છે. તેઓ પોતાના અન્યોન્યના સ્વભનમાં જ રૂબેલાં છે.]

### પ્રેમિકા

(પોતે એકલાં છે તે જોઈને)

લો! જુઓ! હવે અહીં બીજું કોઈ નથી... આપણે હવે એકલાં જ છીએ.

અને બીજું કોઈ હોય તોય શું અને ન હોય તોય શું! આપણે એમની જરૂર નથી. આપણે બે જણ જ કેટલાં બધાં સુખી છીએ.

### પ્રેમી

(રસ્તાની પડખેનુ મકાન જોઈને)

વહાલી, જો તો પેલું ધર, ટેકરીની બાજુ ઉપર, એકલું છે છતાં બહુ પ્રેમપૂર્વક

બોલાવતું લાગે છે, બધું નજીકમાં છે છતાં અનંત અવકાશ તરફ ખૂલ્લી રહેલું છે. જાણે કે આપણા માટે જ એ બાંધું ન હોય. આપણે હવે વધું શું જોઈએ? આ જ જાણે કે આપણા મિલનનું આદર્શ નિવાસસ્થાન છે. આપણે, આપણે બેચે મળીને એક પૂર્ણ સમગ્ર, છાયાહીન, નિરભ્ર, પ્રેમમિલનનો સાક્ષાત્કાર કર્યો છે. પેલાં બીજાં ભલે એમના સત્યની શોધમાં આગળ જાય—અને સત્ય જેવું કાંઈ છે કે કેમ તે પણ કોણ જાણે છે, ભલા? પણ આપણને તો આપણું સત્ય મળી આવ્યું છે. આપણે માટે એટલું સત્ય બસ છે.

### પ્રેમિકા

વહુલા, તમારી વાત બરાબર છે. ચાલો, આપણે એ મકાનમાં જઈને જ વાસ કરીએ અને આપણો પ્રેમરસ માણીએ. આપણે હવે બીજું કશું વિચારવું નથી.

(એકબીજાના સતત આલિંગનમાં રહેતાં એ પ્રેમીઓ રસ્તો છોડી જાય છે અને મકાન તરફ વળે છે.)

### છુંસોપાન

[રસ્તો હવે તદ્દન સાંકડો બની ગયો અને એક પ્રચંડ ખડક આગળ આવીને એકદમ અટકી જાય છે. ખડકની ઊંચી દીવાલ સીધી આકાશ તરફ ચડ્યે જાય છે અને એનું શિખર નજરથી પાર જ રહે છે. ડાબી બાજુએ એક નાનકડો સપાટ પ્રદેશ અને તેની પેલી બાજુએ એક નીચી અને નાનકડી ઝૂપડી દેખાય છે. આખું દૃષ્ટ તદ્દન ખાલી અને નિર્જન છે.

છેલ્ણાં ત્રાણ યાત્રીઓ બેગાં આવી પહોંચે છે. પણ સંન્યાસી હવે થોભી જાય છે અને બીજાં બેને દીશારો કરીને અટકાવે છે.]

### સંન્યાસી

મારે તમને એક અગત્યની વાત કહેવાની છે. તમે બંને, જરા સાંભળશો ને? આ આપણા આરોહણમાં મને હવે મારું સાચું સ્વરૂપ, મારો સાચો આત્મા મળી આવ્યો છે. શાશ્વત પરમાત્મા સાથે મારું મિલન થઈ ગયું છે. મારે માટે હવે બીજી કોઈ ચીજ અસ્તિત્વમાં રહી નથી, મારે હવે કશી ચીજની જરૂર રહી નથી, જગતમાં હવે જે કાંઈ તત્ત્વ સત્ત નથી; તે બધું એક વ્યર્થ ભાંતિ જ છે. એટલે હું ધારું છું કે હવે હું માર્ગના અંતે આવી પહુંંચ્યો છું (પોતાના હાથ વડે તે ડાબી બાજુ પરનો સપાટ પ્રદેશ બતાવે છે). જુઓ, ત્યાં પેલું એક ભય અને એકાંત સ્થળ છે. મારે હવે જે જીવન ગાળવું

છે તેને માટે ખરેખર એ ઘણું જ અનુકૂળ સ્થાન છે. ત્યાં હવે હું પૂર્ણ ધ્યાનાવસ્થામાં રહીશા, પૃથ્વી અને માનવોથી દૂર દૂર ફરજમાંથી મને હવે મુક્તિ મળી ગઈ છે.

(અને કાંઈ પણ વિશોષ કર્યા વિના, વિદ્યા લેવાની લેશ પણ કિયા કર્યા વિના, તેમજ પાછળ દૃષ્ટિ નાખ્યા વિના; તે પોતાના અંગત ધ્યેયની સિદ્ધિ માટે સીધો ચાલ્યો જાય છે.

બંને અભીપ્સુઓ એકલાં રહી જાય છે અને સંન્યાસીના વ્યવહારની ભવ્યતાથી કંઈક અંજાઈને એકબીજા સામે જોઈ રહે છે. પણ તેઓ તરત જ સ્વસ્થ બની જાય છે અને અભીપ્સુ બાલા બોલી ઉઠે છે.)

### અભીપ્સુ બાલા

નહિ! એ કહે છે તે સત્ય ના હોઈ શકે, પૂર્ણ સત્ય ના હોઈ શકે. આ વિશ્વરૂપી સર્જન તે કેવળ ભાંતિ જ છે, અને એમાંથી આપણે માત્ર નાસી ધૂટવું જ જોઈએ એમ હોઈ જ ન શકે. અને આપણે હજુ પર્વતની ટોચ ઉપર તો પહોંચ્યાં પણ નથી. આપણું ચડાણ તો હજુ આપણે પર્સું કરવાનું છે.

### અભીપ્સ કિશોર

(રસ્તો લગભગ સીધા કાટખૂણે ઊભેલા ખડકની દીવાલ આગળ આવીને અટકી જાય છે તે બતાવીને)

પણ આ તૈયાર કરેલો રસ્તો અહીં હવે પૂરો થઈ જાય છે. અહીંથી આગળ કોઈ માનવ પ્રાણીગયું હોય એમ લાગતું નથી. આ ખડક તો જુઓ, સીધો દીવાલની જેમ ઊભો છે. એના પર ચડવું તે અશક્ય જેવું લાગે છે. એના પર ચડવાની રીત આપણે જ હવે શોધી લેવાની છે. એ માટેનાં સાધન પણ આપણે જ ઉપજાવવાનાં છે. હવે તો આપણે આપણા જ પ્રયત્નને બણે, એક એક ડગલું મુક્તાં આગળ વધવાનું છે. અહીં કોઈ ભોભિયો નથી, કોઈની કશી મદદ નથી. આપણો સંકલ્પ અને આપણી શ્રદ્ધાકેવળ એ બેના આધારે જ આપણે આગળ વધવાનું રહે છે. અને લાગે છે કે આપણે નવો રસ્તો ખોદીને તૈયાર કરવો પડશે.

### અભીપ્સ બાલા

(ઉત્સાહપૂર્વક)

તે એમાં શું? વાંધો નહિ. ચાલો, આપણી કૂચ તો આપણે આગળ ને આગળ ચલાયે જ રાખોએ. હજુ આપણે કશુંક શોધવાનું તો બાકી છે જ. આ વિશ્વની પાછળ કંઈક અર્થ તો છે જ. આપણે એ શોધી કાઢીશું.

(બંને જણા પાછાં પોતાની કૂચ ચાલુ કરે છે.)

## સાતમું સોપાન

### શિખર

[બંને અભીષ્ટુઓ માર્ગ પરની સર્વ કસોટીઓનો વીરતાપૂર્વક સામનો કરતાં કરતાં અહીં સુધી આવી પહોંચ્યાં છે. હવે તેઓ પ્રચંડ બળ વાપરીને એક ઠેકડો ભરે છે અને શિખર ઉપર પૂર્ણ પ્રકાશમાં પહોંચી જાય છે. અહીં હવે તે બંને ખડકના જે એક નાનકડા ટુકડા ઉપર ઊભેલાં છે તે સિવાય બધું કેવળ પ્રકાશનું જ બનેલું છે. ખડકના ટુકડા પર એમના ચાર પગને માટે માંડ ઊભા રહી શકાય એટલી જ જગા છે.]

### અભીષ્ટુ કિશોર

શિખર શિખર! આખરે આવી પહોંચ્યાં! ઓહ, અહીં તો કેવળ સત્ય જ છે, પ્રકાશનું, ચમકનું, ચોકાવતું નર્થું સત્ય, બીજું કાંઈ જ નહિ.

### અભીષ્ટુ બાલા

હા, સત્ય સિવાય બીજું બધું જ અહીંથી અદૃશ્ય થઈ ગયું છે. આપણે આટલી બધી મહેનતકરતાં કરતાં જે પગથિયાં ચડી ચડીને અહીંઆવ્યાં એ પણ હવે તો ભૂંસાઈ ગયાં છે.

### અભીષ્ટુ કિશોર

આહ, અહીં તો નર્થું શૂન્ય છે, આગળ, પાછળ, સર્વત્ર. માત્ર આપણને પગ મૂકવા જેટલી જ જગા અહીં છે, બાકી કાંઈ જ નહિ.

### અભીષ્ટુ બાલા

તો હવે ક્યાં જઈશું? શું કરીશું?

### અભીષ્ટુ કિશોર

અહીં તો સત્ય જ છે, કેવળ સત્ય, આસપાસ, ચોમેર, સર્વત્ર, માત્ર સત્ય જ છે.

### અભીષ્ટુ બાલા

હા, પણ એ સત્યનો સાક્ષાત્કાર કરવાને આપણે હવે આગળ જવું જોઈશે. અને એ સાક્ષાત્કાર કરવા માટે આપણે એક બીજું રહસ્ય પણ જાણવાનું રહે છે.

### અભીષ્ટુ કિશોર

હાસ્તો, અહીં હવે આપણો અંગત પ્રયત્ન પૂરો થઈ જાય છે. હવે તો કોઈ બીજી શક્તિ આવીને સહાય કરે તો જ આગળ જવાય.

### અભીષ્ટુ બાલા

હા, હવે તો પ્રભુની કૃપા, કેવળ પ્રભુની કૃપા જ કાંઈ કરી શકે. એ કૃપા જ આપણને રસ્તો ખોલી આપી શકે, એ કૃપા જ હવે તો ચમત્કાર કરી શકે.

### અભીષ્ટુ કિશોર

(ક્ષિતિજ તરફ બંને હાથ લંબાવીને)

જો જો, ત્યાં, દૂર દૂર. પેલી ઊંડી ઊંડી ખીણાની પેલી બાજુ પર, ઓ પેલું શિખર દેખાય. અરે, ત્યાં તો કેવો પ્રકાશ જળહણે છે, કેવાં તો પૂર્ણ સ્વરૂપો છે, કેવો તો અદ્ભુત સંવાદ છે! એ તો પ્રભુની ભાખેલી ભૂમિ છે, નૂતન પૃથ્વી છે!

### અભીષ્ટુ બાલા

હા, એ જ નૂતન ભૂમિ, એ જ, એ જ. આપણે ત્યાં જ જવાનું છે. પણ અરે, કેવી રીતે જઈશું ત્યાં?

### અભીષ્ટુ કિશોર

આપણે ત્યાં જવાનું છે તો ત્યાં જવાનાં સાધન પણ આપણને મળી આવશે.

### અભીષ્ટુ બાલા

હાસ્તો, આપણે પૂર્ણ શ્રદ્ધા રાખીએ, પૂર્ણ વિશ્વાસ રાખીએ પ્રભુની કૃપામાં. પ્રભુને આપણું સમર્પણ કરી દઈએ, પૂરેપૂરું, સંપૂર્ણ.

### અભીષ્ટુ કિશોર

હા, પ્રભુની ઈચ્છાના હાથમાં આપણું પૂર્ણ સમર્પણ કરી દઈએ અને હવે એ

શિખર પર પહોંચવાના રસ્તા તો સૌ અદૃષ્ટ થઈ ગયા છે. એટલે આપણે તો હવે એક જ કરવાનું રહે છે, ભય કે સંકોચ કશું પણ રાખ્યા વિના જુકાવી દઈએ, પૂરી શ્રદ્ધાથી.

### અભીષ્ટુ બાલા

(હા, અને આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણને કોઈ ઉપાડીને પહોંચાડી દેશે.  
(બંને કૂદકો મારે છે.)

### ઉપસંહૃત

(એક જાહુઈ પ્રકાશનનો પ્રથેશ)

### અભીષ્ટુ કિશોર

આવી પહોંચ્યાં, આવી પહોંચ્યાં, કોઈ અદૃષ્ટ પાંખો પર, કોઈ અદૃષ્ટ શક્તિ આપણને લઈ આવી!

### અભીષ્ટુ બાલા

(આસપાસ સર્વત્ર નજર નાખતાં)

ઓહ, અદ્ભુત, અદ્ભુત પ્રકાશ! હવે તો આ નૂતન જીવન આપણે કેવી રીતે જીવીએ એ જ આપણે શીખીએ.

(પડદો)

\*

બાળકને આ સ્થિતિમાં પહોંચાડવા માટે તેનામાં એકાગ્રતા અને એકધ્યાનનો વિકાસ કરવાની સાથે સાથે અવલોકનશક્તિ, સાચી સ્મરણશક્તિ અને ચોક્કસ એવી નોંધશક્તિનો વિકાસ પણ કરાવવો જરૂરી છે. અવલોકન-શક્તિનો વિકાસ કરવા માટે આપોઆપ બની આવતાં જુદાં જુદાં પ્રકારનાં મનોયતનો યોજ શકાય છે. તેમ જ બાળકના ચિત્તને જાગૃત કરવામાં, ચપળ અને વેગવાન કરવામાં મદદ રૂપ થાય તેવી સર્વ તકોનો લાભ લઈ શકાય છે. સ્મરણશક્તિના વિકાસ કરતાં પણ વિશેષ ભાર તો સમજશક્તિના વિકાસ ઉપર આપવાની જરૂર છે. આપણે જે વસ્તુ સમજતા હોઈએ છીએ તેનું જ આપણને બરાબર જ્ઞાન રહે છે. યાંત્રિક રીતે ગોખી કાઢેલી વસ્તુઓ ધીરે ધીરે સ્મૃતિમાંથી ઝાંખી થઈ જાય છે, અને આખરે ખુલાઈ પણ જાય છે. પણ તમે જે વસ્તુ સમજ્યા હશો તે પછી ભૂલી જવાતી નથી. વળી એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે. બાળક જ્યારે તમને કોઈ પ્રશ્ન કરે કે આ વસ્તુ આમ કેમ છે, આમ શા માટે થતું હશો ત્યારે તેનો ખુલાસો તમે હમેશાં આપજો. બાળકને કદી ના ન પાડશો. તમને પોતાને જો એ વિષયનું જ્ઞાન ન હોય તો પછી બાળકને જે લોકો સમજાવી શકે તેવા હોય તેમની પાસે લઈ જશે અથવા તો એ અંગેનાં પુસ્તકો તમે બાળકને મેળવી આપજો. આ રીતે તમે કંમે કંમે બાળકમાં સાચા અભ્યાસ માટેનો રસ જાગૃત કરી શકશો, જ્ઞાન મેળવવા માટે અખંડ પરિશ્રમ કરવાની ટેવ પાડી શકશો.

શ્રી માતાજી